

# गायत्री महाविश्वान

## भाग-३

युगऋषि पं. श्रीराम शर्मा आचार्य



# ગાયત્રી મહાવિજ્ઞાન

## ભાગ-૩



પ્રકાશક  
યુગ નિર્માણ યોજના,  
ગાયત્રી તપોભૂમિ, મધુરા - ૨૮૧ ૦૦૩ (ગ. ગ.)

પ્રાપ્તિસ્થાન  
ગાયત્રી જ્ઞાનપીઠ  
શાખા : અમદાવાદ  
પાટીદાર સોસાયટી, જૂના વાડજ, અમદાવાદ-૩૮૦ ૦૧૩  
ફોન નં : ૭૪૪૭૨૫૨

: મુદ્રક :  
યુગ નિર્માણ પ્રેસ,  
ગાયત્રી તપોભૂમિ, મધુરા.

भर्गो देवस्य धीमहि स्थियो चो नः प्रचारेत्  
तत्सवितुर्वरेण्यं स्वः मर्मतः



વેદમાતા ગાયત્રી

# ગાયત્રી મહાવિજ્ઞાન

## ભાગ ત્રીજો

### ભૂમિકા

ગાયત્રીને પાંચ મુખ અને દશ હાથ હોવાનું વાર્ણિન અનેક જગ્યાએ જેવા મળે છે. તેવાં અનેક ચિત્રો અને મૂર્તિઓ પાણ મળે છે. આ પાંચ મુખ અને દશ હાથ એ સાધારણ ઉપાસકો માટે એક પ્રશ્ન બની રહે છે. તેને ન ઉકેલી શકવાથી તેઓ ગાયત્રી વિજ્ઞાન જેવા આધારભૂત વિજ્ઞાનને કોઈ સાંપ્રદાયિક કથાવાતરાઓ હોવાનું માની લઈને તેના મહત્વની ગંભીરતામાં શંકા કરવા લાગે છે.

આ પુસ્તકની રચના એ પ્રશ્નના સરળ ઉકેલ માટે કરવામાં આવેલી છે. ગાયત્રીનાં પાંચ મુખ એ આત્માના પાંચ કોશ, પાંચ આવરણ- અન્તર્મય કોશ, પ્રાગુમય કોશ, મનોમય કોશ, વિજ્ઞાનમય કોશ અને આનંદમય કોશ છે. એ પાંચ આત્માના આવાગમનનાં, બંધન તથા મુક્તિનાં દાર છે. એ માણસના શ્વાસ લેવા-મૂક્વા માટે નાકનાં છિદ્રો જેવાં છે. પાંચ મુખોનાં ચિત્ર બનાવવા પાછળ યોગવિજ્ઞાનું ગુપ્ત વિજ્ઞાન અને વિદ્યાન રહેલું છે. તેને જાણીને પરમ પદને, લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે.

ગાયત્રીના દશ હાથ એ જીવનનાં દશ શૂળો, કષ્ટો, દુઃખોમાંથી મુક્તિ આપનારી મહાશક્તિઓ છે. જેના મસ્તક ઉપર માતાના દશ હાથનું વરદાન છે તે બધી જાતનાં દુઃખોમાંથી ચોક્કસ બચી જય છે.

આ પુસ્તકમાં ગાયત્રીનાં પાંચ મુખ અને દશ હાથનું રહસ્ય ‘ગાયત્રી મંજરી’ ના આધારે સમજવીને આ મહાવિજ્ઞાના તત્ત્વજ્ઞાન ઉપર થોડો પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેની સાથે યોગ્ય અનુભવ હોવાને લીધે આ પુસ્તક સાધક- વર્ગને ઉપયોગી થઈ પડશે તેવો અમોને વિશ્વાસ છે.

- શ્રી રામ શર્મા આચાર્ય

# ગાયત્રી મહાવિજ્ઞાન

## ભાગ ત્રીજો

### ૧. ગાયત્રીનાં પાંચ મુખ

ગાયત્રીને પંચમુખી કહી છે. પંચમુખી શંકરની માફક ગાયત્રી પણ પંચમુખી કહેવાઈ છે. પુરાણોમાં કેટલેક ઠેકાડે એવું વારુંન આવે છે, જેમાં વેદમાતા ગાયત્રીને પાંચ મુખવાળી તરીકે ઓળખાવવામાં આવી છે. સામાન્ય કરતાં વધારે મુખ, વધારે હાથ-પગવાળા દેવીએવતાઓનાં વારુંન કંઈક અભયબ જેવાં લાગે છે, વિસ્મયકારક લાગે છે અને તેથી એને માટે શંકા ઉત્પત્ત થાય છે. ચાર મુખવાળા બ્રહ્માજી, પાંચ મુખવાળા શિવજી અને છ મુખવાળા કાતિંદ્રિય વાર્ગવાયા છે. ચતુર્ભૂજ વિષગુ, અષ્ટભૂજ દુર્ગા અને દશભૂજ ગણેશ પ્રસિદ્ધ છે. એ સિવાય બીજાં કેટલાંય એવાં ઉદાહરણો આપી શકાય છે. રાવાગનાં દસ માથાં અને વીસ ભૂજાઓ તથા સહસ્રભાડુના હજર હાથ અને ઈન્દ્રની વીસ આંખો જગમશદૂર છે.

એ દેખીતી વાત છે કે કહેવતો અને ટુચકાઓ ઘણાં આકર્ષક અને મનોરંજક હોય છે. એવી કહેવતો અને ટુચકાઓની પ્રશ્નોત્તરી કરવાથી એનાં રહસ્યોને ખુલ્ખાં પાડતી એક મહત્વની મનોવૈજ્ઞાનિક કિયાનો વિકાસ થાય છે. નાની વયનાં બાળકોને આવા ટુચકાઓ પૂછીએ તો આવા વિચિત્ર પ્રશ્નોનો જવાબ આપવા માટે પોતાના મગજને તેઓ સારી રીતે તસ્દી આપશે. સાચો ઉકેલ મેળવવા માટે બુદ્ધિ ઉપર તેઓ ઢીક ઢીક ભાર મૂકશે. પોતાની બુદ્ધિથી ઉકેલ નહીં મેળવાય તો બીજાઓની મદદ દેશે અને જ્યાં સુધી એનો સંતોષકારક ખુલાસો નહીં મળે ત્યાં સુધી તેઓ કૃતૂહલપૂર્વક બેચેન રહેશે. આ પ્રમાણે સીધાસાદા, સરળ, નીરસ પ્રશ્નોને બદલે વાંકાચૂકા અને આંટીધૂંટીવાળા પ્રશ્નોનો આવા ટુચકાઓ દ્વારા ઉકેલ મેળવવામાં બાળકોનો બૌદ્ધિક વિકાસ અને મનોરંજન બંને સારી રીતે સાધી શકાય છે.

#### દેવતાઓનાં વધુ અંગોનું રહસ્ય

દેવદાનવોનાં અધિક મુખ અથવા અધિક અંગો હોવાં એ રહસ્યમય ટુચકાઓ જેવાં છે, જેમાં તેના સંબંધી શૂઠ રહસ્યો છુપાયેલાં હોય છે. આવી વિલક્ષણતાને લીધે જિજ્ઞાસુઓનું કૃતૂહલ વધે છે. તેઓ આવી વિચિત્રતા શા માટે આવી તેનું કારણ શોધે છે. આવા ટુચકાઓના ઉકેલ માટે જ્યારે પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે એવાં સરસ રહસ્યો બહાર આવે છે તથા અનુભવ થાય છે, કે જે આવી વિલક્ષણતાઓથી દેવો અને દાનવોને વિભૂષિત કરવામાં ન આવ્યા હોતો એમાં છુપાયેલા જ્ઞાન તરફ કોઈનું ધ્યાન જત જ નહીં અને તેથી સાચા રહસ્યમય જ્ઞાનથી એ વંચિત જ રહેત. ટુચકાઓના જવાબો બાળકોને એવી દબતાપૂર્વક યાદ રહી જય છે કે તેઓ એને કદી ભૂલતાં નથી. તે જ પ્રમાણે અધ્યાત્મનો વિદ્યાર્થી પણ વધારે મુખવાળા દેવોને સમજવાને જ્યારે ઉન્સુક થાય છે ત્યારે તેને પેલી દિવ્ય મહાશક્તિ સાથે જોડાયેલી હોય એવી અદ્ભુત વાતો સહજમાં જાગવા મળે છે.

કોઈ વખતે પ્રસંગ મળ્યેથી બધા દેવોની આકૃતિઓનું હું વિસ્તારપૂર્વક વારુંન કરીશ. હનુમાનજીનું પૂંછું, ગણેશજીની સૂંધ, હ્યાત્રીવિનું અશ્વમુખ, બ્રહ્માજીનાં ચાર મુખ, દુર્ગાજીની આઠભૂજ, શિવજીનાં ત્રણનેત્ર, કાતિંદ્રિયનાં છ મુખ વગેરે તથા એ દેવતાઓનાં ઉંદર, મોર, આખલો, સિંહ વગેરે વાહનોમાં શું શું રહસ્યો છે તેનું વિગતવાર વારુંન કોઈ વખતે કરીશ. આને તો માત્ર ગાયત્રીનાં પાંચ મુખો ઉપર જ પ્રકાશ નાખવાનો છે.

ગાયત્રી એ સુવ્યવસ્થિત જીવનનું, ધાર્મિક જીવનનું એક અભિન્ન અંગ છે. તેથી એને સારી રીતે સમજવી,

એનો મર્મ, રહસ્ય, તથા જાગુવું તથા એની સાધનાની ચોક્કસ માહિતી મેળવવી એ ખાસ જરૂરી છે. ડેક્ટર, એન્જિનિયર, યાંત્રિક, સુથાર, લુહાર, રંગાટી, સોની, દરજી, કુંભાર, વાગ્કર, નાટ્યકાર, અધ્યાપક, ગાયક વગેરે સર્વ વર્ગના લોકો પોતાના કામની બારીકીઓ સમજે છે તથા તેમના ધ્યાનાં હાનિલાભની અંટીધૂટીનું ચોક્કસ જ્ઞાન ધરાવે છે. ગાયત્રી વિદ્યાના નિજાસુઅઓ અને સાધકોએ પણ પોતાના વિષયનો સારો પરિચય મેળવવો જોઈએ, નહીં તો તેમની સફળતાનો માર્ગ ઝડપો. ઝડપિઓએ ગાયત્રીને પાંચ મુખવાળી બનાવીને એવું બતાવું છે કે આ મહાશક્તિની અંદર રહેલાં પાંચ તથો એવાં છે કે જેનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરીને તેને જીવનમાં ઉત્તારવાથી આ સંસારસાગરના સધળા મુશ્કેલ પ્રસંગોને પાર કરી શકાય છે.

ગાયત્રીનાં પાંચ મુખ ખરી રીતે એના પાંચ ભાગો છે. (૧) ઝું (૨) ભૂર્ભૂવઃ સ્વઃ (૩) તત્ત્વવિતુવીરણં (૪) ભગોદ્વિવસ્ય ધીમહિ (૫) ધિયો યોન: પ્રયોદ્વયાતુ. યજોપવીતના પણ પાંચ ભાગ છે. ત્રણ લટો, ચોથી મધ્યગ્રંથિ ભગોદ્વિવસ્ય ધીમહિ (૫) ધિયો યોન: પ્રયોદ્વયાતુ. યજોપવીતના પણ પાંચ ભાગ છે. ત્રણ લટો, ચોથી મધ્યગ્રંથિ અને પાંચમી બ્રહ્મગ્રંથિ. પાંચ દેવતા પ્રસિદ્ધ છે. (૧) ઝું એટલે ગાયેશ. (૨) વ્યાહતિઓ એટલે ભવાની, (૩) ગાયત્રીનું પ્રથમ ચરણ એટલે બ્રહ્મા, (૪) બીજું ચરણ એટલે વિષણુ અને (૫) ત્રીજું ચરણ એટલે મહેશ. આ પ્રમાણે આ પાંચ દેવતાઓ ગાયત્રીનાં શક્તિકેન્દ્રો કહેવાય છે.

ગાયત્રીના આ પાંચ ભાગોમાં એવો સંદેશ છુપાયો છે કે જે જાગુવાથી માણસ જીવનની બહારની અને અંદરની સધળી મુશ્કેલીઓ સફળતાપૂર્વક પાર કરી શકે. હું ક્રીણ છું? શા કારણે આ જીવન ધારણ કર્યું છે? મારું લક્ષ્ય શું છે? ગરીબ અથવા દુઃખી રહેવાનું કારણ શું? સંસારની સંપત્તિઓ અને આત્મિક શાંતિની પ્રાપ્તિ શી રીતે થાય? કર્યું બંધન એવું છે કે જે આપણને જન્મબંધનના ચક્કાવામાં ફેરબા કરે છે? અન્ત આનંદનું મૂળ શેમાં છે? આ આખું વિશ્વ શું છે? સંસારનો અને આપણો સંબંધ કેવો છે? જન્મમરાણનું ત્રાસદાયક ચક શી રીતે છૂટે? વગેરે અધરા પ્રશ્નોના સરળ જવાબો ઉપરોક્ત પંચકોષોમાં રહેલા છે.

ગાયત્રીનાં પાંચ મુખોમાં અસંખ્ય સૂક્ષ્મ રહસ્યો અને તત્ત્વો છુપાયાં છે એ જાણ્યા પછી માણસને એટલી તૃપ્તિ થઈ જય છે કે હવે કાંઈ જાગુવાનું રહેતું નથી. મહર્ષિ ઉદ્ઘાલકે આ વિદ્યાની પ્રતિષ્ઠા કરી હતી, જેને જાણ્યા પછી બીજું કાંઈ જાગુવાનું બાકી રહેતું નથી અને આ વિદ્યા તે આપણી ગાયત્રી વિદ્યા જ છે. ચાર વેદ અને પાંચમો યજ્ઞ પાંચ ગાયત્રીનાં પાંચ મુખો છે, જેમાં સધળું જ્ઞાનવિજ્ઞાન અને ધર્મકર્મ બીજાંપે કેન્દ્રિભૂત થયેલું છે.

શરીર પાંચ તત્ત્વોનું બનેલું છે અને આત્માના પણ પાંચ કોષો છે. પૂર્વી, પાણી, હવા, તેજ અને આકાશ એ પાંચ તત્ત્વોના સંમિશ્રાણથી દેહ બને છે. ગાયત્રીનાં પાંચ મુખો એમ બતાવે છે કે આ શરીર એ બીજું કાંઈ નહીં, પણ પાંચ મહાભૂતોના જડ પરમાણુઓનું સંમિશ્રાણ જ છે, આપણી સાધના માટેનું એક અત્યંત ઉપયોગી હથિયાર ‘સેવક અને વાહન’ છે. પોતે શરીર છે એવું માનવું એ મોટી ભૂલ છે. આ ભૂલ જ માયા અથવા અવિદ્યા કહેવાય છે. શરીર અને આ સંસારનું વાસ્તવિક સ્વરૂપ સમજમાં આવી જતાં જ જીવ મોહનિદ્રામાંથી જગી ઉઠે છે અને સંપત્તિ મેળવવી તથા અધિકાર અને ભોગો ભોગવવાની બાળચેષ્ટાઓમાંથી પરાવૃત્ત થઈ આત્મકલ્યાણને માર્ગ આગળ વધે છે. પાંચ મુખોનો આદેશ એ પણ છે કે પાંચ તત્ત્વોથી બેનેલા સર્વે પદાર્થો કેવળ ઉપયોગ માટે છે. એમાં વેપાવું, તત્ત્વ થવું, આસક્તિ રાખવી કે મોહવશ થવું એ ખતરનાક છે.

### ગાયત્રીનાં પાંચ મુખીથી પાંચ કોશોની સક્રિયા.

પાંચ મુખોનો બીજો ઉદ્દેશ આત્માના પાંચ કોષો તરફ નિર્દેશ કરવાનો છે. જેમ શરીર ઉપર ગંજી, બંડી, ખમીસ, ઝભો અને ઓવરકોટ એમ એક ઉપર બીજું પહેરવામાં આવે છે, તેમ આત્માની ઉપર પણ આવાં પાંચ આવરાણ રહેલાં છે. અત્રમય કોશ, પ્રાગુમય કોશ, મનોમય કોશ, વિજ્ઞાનમય કોશ અને આનંદમય કોશ એ એનાં

પાંચ નામો છે. આ પાંચ આવરાણોમાં જીવ બંદીવાન બન્યો છે. એના દરવાજાઓ ખૂલી જતાં જીવ બંધનમુક્ત થાય છે.

આમ તો ગાયત્રીનાં આ પાંચ મુખોમાં અનેક પંચકોશનું અદ્ભુત રહસ્ય છુપાયું છે, પણ એ ચર્ચા કરવાનો અવકાશ નથી. અહીં તો આ પાંચ કોશો પર જ પ્રકાશ નાભવાનો મારો ઈરાદો છે. ખજનાને પણ કોશ કહેવામાં આવે છે. આત્માના આ પાંચ ખજના છે. એ દરેકમાં ધારી મૂલ્યવાન સંપત્તિ ભરેલી છે. ધમ્મકુભરોને ત્યાં નેમ ચલાડી નોટો રાખવાનાં, ચાંદીની પાટો રાખવાનાં, સોનાની લગડી રાખવાનાં, ઝવેરાત રાખવાનાં તથા હુંડી, ચેક વગેરે રાખવાના અલગ ખાનાં હોય છે તેમ આત્માના આ પાંચ ખજનાઓ છે. સિદ્ધ કરેલા આ પાંચ કોશો મારફતે એટલી બધી સંપત્તિ અને સુખસગવડો મેળવી શકાય છે કે જેના લીધે સ્વર્ગીય સુખની પ્રાપ્તિ થઈ શકે છે. યોગી લોકો આ જ આનંદને માટે તપ કરતા હોય છે અને દેવતાઓ આ જ આનંદને માટે મનુષ્યદેહની જંખના કરતા હોય છે. આ કોશોનો સદૃપ્યોગ અનંત આનંદનું સર્જન કરી શકે છે અને એમના દુરુપ્યોગથી પાંચ દીવાલવાણું બંધનકારક કેદખાનું જ સર્જય છે.

અનંત સુખસગવડોનો અનુભવ કરવા માટે જ પરમાત્માએ આપાણને આ પાંચ કોશોની બેટ આપી છે. આ પાંચ અસવારો આપાણને મનગમતી સહેલગાહ કરાયે છે. અનિષ્ટદ્વારી શત્રુઓનો નાશ કરી આત્મરક્ષણ માટે ધારણ જ ઉપયોગી એવાં આ પાંચ હથિયારો તપનાં સાધનો છે. આ પાંચ વસ્તો છે, જે આપણી અગવડો મટાડે છે અને શોભામાં વધારો કરે છે. આ પાંચ શક્તિશાળી સેવકો છે, જે આપણી સેવામાં હરહંમેશ હાજર રહે છે. આ પંચામૃત એટલું સ્વાદિષ્ટ છે કે જેનું માત્ર એકાદ ટીપું ચાખવા મુજનાત્માઓ પણ ફરીવાર આ દેહમાં અવતાર ધારાણ કરે છે.

બગડેલું અમૃત જેર થઈ જય છે. સ્વામીભક્ત ઝૂતરો પણ હડકવા લાગવાથી પોતાના માલિકને જ સંકટમાં નાંખે છે. સેલું અન્ન વિષા થઈ જય છે. જીવનના આધાર જેલું લોહી જ્યારે બગડે છે ત્યારે તેનું પણ થઈ જય છે અને ચાંદાના રૂપમાં બહાર આવે છે. એવી જ રીતે આ પાંચ કોશો જ્યારે વિકૃત સ્વરૂપ ધારણ કરે છે ત્યારે ભારે દુઃખ આપે છે. વિવિધ પ્રકારનાં પાપ અને પશ્ચાત્નાપ, કલેશ, દુઃખ ને દુલ્ભિય, ચિંતા ને શોક, અભાવ અને દારિદ્ર્ય તથા નાનીમોટી વેદનાઓથી પીડાતો માનવજીવ ઉપરોક્ત વિકૃતિઓનો શિકાર બન્યો છે. સૌંદર્ય અને દર્શનશક્તિના કેન્દ્ર સમી આંખ જ્યારે વિકૃત બને છે ત્યારે મુખની સુંદરતા તો એક બાજુએ રહી, પણ એના શરીર ઉપર કપડાની પડી બાંધવી પડે છે. સુંદર દશ્યો જોઈને મનોરંજન કરવાનું તો બાજુએ રહ્યું, પણ અંદર થતી પીડાથી માછલીની માફક તરફડાં પડે છે. આનંદના ભંડાર સમા આ પાંચ કોશોમાં થતી વિકૃતિ જ જીવનને દુઃખમય બનાવે છે, નહીં તો ઈશ્વરનો રાજકુંવર જે દિવ્ય રથમાં બેસી નંદનવનમાં આવ્યો છે તેમાં આનંદ જ મળવો જોઈએ. પંચકોશોમાં પેદા થતી વિકૃતિ સિવાય દુઃખ અને દુલ્ભિયનું બીજું કોઈ કારણ હોઈ શકે નહીં.

પાંચ તત્ત્વ, પાંચ કોશ, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ પ્રાણ, પાંચ ઉપપ્રાણ, પાંચ તન્માત્રાઓ, પાંચ યજ્ઞ, પાંચ દેવ, પાંચ યોગ, પાંચ અધિ, પાંચ અંગ, પાંચ વર્ગ, પાંચ સ્થિતિ, પાંચ અવરસ્થા, પાંચ કલેશ વગેરે અનેક પંચકો ગાયત્રીનાં પાંચ મુખોની સાથે સંબંધ ધરાવે છે. એને સિદ્ધ કરનારી પુરુષાર્થી વ્યક્તિ ઋષિ, રાજર્ષિ, બ્રહ્મર્ષિ, મહર્ષિ અને દેવર્ષિ કહેવાય છે. આત્માની ઉત્ત્રતિની પાંચ કક્ષાઓ છે ને પાંચ ભૂમિકાઓ છે. એ પૈકી જે મનુષ્ય જે ભૂમિકાને સિદ્ધ કરી લે છે તે એ કક્ષાનો ઋષિ બની જય છે. એક વખત ભારતભૂમિ ઋષિઓની ભૂમિ હતી, જ્યાં ઋષિથી ઉત્તરતા દરજાનો કોઈ માણસ જ નહોતો. આજે તો આ પંચાયતનો તિરસ્કાર થઈ રહ્યો છે અને પ્રપંચમાં ફસાઈને મનુષ્ય પંચ કલેશોથી પીડાઈ રહ્યો છે.

## ૨. અનંત આનંદની સાધના

તૈતિરીય ઉપનિષદની ત્રીજી વલ્લી (ભૃગુવલ્લી)માં એક ખાસ મહત્વપૂર્ણ આખ્યાયિકા આવે છે. એમાં પંચકોશોની સાધના ઉપર સારો પ્રકાશ પાડવામાં આવો છે.

બૃગુના પુત્ર ભૃગુએ પોતાના પિતા પાસે જઈને પ્રાર્થના કરી કે ‘અધીહિ ભગવો ભ્રસેતિ!’ અર્થાત् - હે ભગવાન, મને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપો.

વરુણે જવાબ આપ્યો - ‘યતો વા ઈમાનિ ભૂતાનિ જ્યન્તે, યેન જતાનિ જીવન્તિ, તત્પ્રયન્તભિસં વિશિષ્ટિ તિદ્વિજિજ્ઞાસસ્વ તદ્ભ્રસેતિ!’ એટલે કે હે ભૃગુ, જેમાંથી આ પ્રાર્ણી માત્ર ઉત્પત્ત થાય છે, જેનાથી ઉત્પત્ત થેયેલાં પ્રાર્ણીઓ જીવે છે અને અંતે જેમાં વિલીન થઈ જાય છે તે બ્રહ્મને જાળવાની તું ઈરછા કર.

પિતાની આજ્ઞા પ્રમાણે એ બ્રહ્મને જાળવા માટે પુત્ર ભૃગુએ તપનો આરંભ કરી દીધો. લાંબા ગાળાના તપને અંતે ભૃગુએ અવ્રમય જગત (સ્થૂળ સંસાર) માં ફેલાયેલી બ્રહ્મની વિભૂતિને જાણી લીધી અને પછી પિતા પાસે ગયો.

ભૃગુએ પિતાને ફરી પાછું કહ્યું ‘અધીહિ ભગવો ભ્રસેતિ’ અર્થાત् - હે ભગવાન, મને બ્રહ્મજ્ઞાનની દીક્ષા આપો.

વરુણે જવાબ આપ્યો, ‘તપસો બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ તપો ભ્રસેતિ!’ એટલે કે - હે પુત્ર ! તું તપ કરીને બ્રહ્મને જાળવાનો પ્રયત્ન કર, તેમકે તપથી જ બ્રહ્મને જાણી શકાય છે. ભૃગુએ ફરી તપશ્ચર્યા કરી અને પ્રાર્ણમય કોશની બ્રહ્મવિભૂતિ જાણી લીધી અને ફરી પાછો પિતા પાસે ગયો અને પિતાએ ફરી પાછો તપથી જ બ્રહ્મને જાળવાનો ઉપદેશ આપ્યો. પુત્રે ફરી પાછું કઠોર તપ કર્યું અને મનોમય જગતની બ્રહ્મવિભૂતિનું જ્ઞાન પ્રાપ્ત કર્યું.

એ જ પ્રમાણે પિતાએ ફરી પાછો તપમાં લગાવી દીધો અને એહે વિજ્ઞાનમય કોશની ઈશ્વરીય વિભૂતિનું જ્ઞાન સંપાદન કર્યું. છેવટે પાંચમી વખતના એના તપના પરિણામે એને આનંદમય કોશની વિભૂતિનું જ્ઞાન પ્રાપ્ત થયું.

આનંદમય જગતના છેલ્લા પગથિયા પર પહોંચવાથી કેવી રીતે પૂર્ણ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, તેનું વર્ણન તૈતિરીયોપનિષદની ત્રીજી વલ્લીના પાંચમા મંત્રમાં બતાવ્યું છે કે-

‘આનન્દો ભ્રસેતિ વિજનાત્ - આનન્દાદ્ઘેર  
ભલ્લિમાનિ ભૂતાનિ જ્યન્તે, આનન્દન  
જતાનિ, જીવન્તિભાનન્ શ્રયન્ત્યભિ સવિશ્વન્તીતિ ।  
સેમાં ભાર્ગવી વાર્ણણિ વિદ્યા પરમેવ્યોમન્ પ્રતિષ્ઠિતા ॥’

એટલે કે ભૃગુએ જોયું કે આનંદ જ બ્રહ્મ છે, આનન્દથી જ સર્વ પ્રાર્ણી પેદા થાય છે, ઉત્પત્ત થઈને આનંદથી જ જીવિત રહે છે અને અન્તમાં આનંદમાં જ વિલીન થઈ જાય છે.

ઉપનિષદ્કાર ઉપરોક્ત આખ્યાયિકા મારફતે બતાવે છે કે બ્રહ્માનંદ, પરમાનંદ અને આત્માનંદમાં જ બ્રહ્મજ્ઞાન સમાયેલું છે. આનંદમય જગતમાંના કોશમાં પહોંચવા માટે કઠોર તપ કરવાનું કહ્યું છે. જેમ જેમ કોશની સીડીનાં પગથિયા ચઢતા જઈએ છીએ, તેમ તેમ બ્રહ્મની સમીપ પહોંચતા જવાય છે. આગળ જતાં બતાવ્યું છે કે-

‘સ્થ એતં વિત્, અસ્માંલોકાત્પ્રેત  
એતમન્નમયમાત્માનમુપસંકામતિ,

એતं પ્રાણમયમાત્માનમુપસંકામતિ,  
 એતં મનોમયમાત્માનમુપસંકામતિ,  
 એતં વિજ્ઞાનમયમાત્માનમુપસંકામતિ,  
 એતમાનનદમયમાત્માનમુપસંકામતિ ॥'

એટલે કે આ પ્રમાણે જે માણસ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરે છે તે આ અત્રમય કોશને જીતે છે, આ પ્રાણમય કોશને જીતે છે, આ મનોમય કોશને જીતે છે, આ વિજ્ઞાનમય કોશને જીતે છે અને છેવટે આ આનંદમય કોશને પાણ પાર કરી શકે છે.

બ્રહ્મરૂપી આનંદ પ્રાપ્ત કરવો એ જીવનનો ઉદ્દેશ્ય છે. નહીંકે ડગલે અને પગલે દુર્ભાગ્ય, દૃષ્ટિ અને દરિક્રતાનો અનુભવ કરવો. લોકો સાંસારિક સુખસગવડોના સંચય માટે આખું જીવન વિતાવી દે છે, પાણ એ સુખોનો ઉપભોગ કરવાનો પ્રસંગ આવે છે તે પહેલાં જ એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કે નેથી એવી અગવડોમાં કશું સુખ બાકી જ રહેતું નથી અને આખરે આખો પ્રયત્ન મૃગતૃખણ જેવો ફોગટ ગયેલો દેખાય છે.

સંસારના પદાર્થોમાં જેટલું સુખ છે તેના કરતાં અનેકગાણું સુખ આત્માની ઉત્ત્રતિમાં સમાયું છે. આરોગ્યમય અવસ્થાવાળા પાંચે કોશોથી સંપત્ર થયેલ આત્મા જ્યારે પોતાના વાસ્તવિક સ્વરૂપને પામે છે ત્યારે તેને અવગુણનીય આનંદ થાય છે. બ્રાહ્મી સ્થિતિના અનુભવનું મૂલ્ય અને મહત્ત્વ શું છે તેની તેને ત્યારે જ ખબર પડે છે. સંસારના કુદ્ર સુખો કરતાં અનેકગાણું સુખ આત્માનંદમાં સમાયું છે અને તેથી જ એ આત્માનંદ માટે ઊચામાં ઊચા પ્રકારનો ત્યાગ અને તપ કરવામાં સંકોચ ન હોવો જોઈએ, પાણ અજ્ઞાની મનુષ્ય એમ જ કરે છે.

'તૈતરીયોપનિષદ'ની આઠમી વક્ષીમાં આનંદની મીમાંસા કરતાં કહેવાયું છે કે 'કોઈ મનુષ્ય જો પૂર્ણ સ્વસ્થ, સુશક્ષિત, ગુણવાન, સામર્થ્યવાન, સૌભાગ્યવાન તથા જગતની સર્વ ધનસંપત્તિનો સ્વામી હોય અને તેને જે આનંદ થાય તે માનુષિક આનંદ કહેવાય છે. એના કરતાં કરોડો અને અબજોગાળા આનંદે બ્રહ્માનંદ કર્યો છે.' આ પ્રકારના બ્રહ્માનંદનું વર્ણન 'શતપથ બ્રાહ્મણ' ૧૪-૭-૧-૩૧ તથા 'બૃહદારણ્યક ઉપનિષદ' ૪-૩-૩૩ માં આપવામાં આયું છે.

પંચમુખી ગાયત્રીની સાધના એ પાંચ કોશોની સાધના છે. એક એક કોશની એક એક બ્રહ્મવિભૂતિ છે. આ બ્રહ્મવિભૂતિઓ એ સીડીનાં એક એક પગથિયાં છે, જે સાધકને પોતાનો રસાસ્વાદ કરાવતાં આગલા પગથિયા ઉપર ચઢવા માટે તૈયાર કરે છે.

માનવજીવન નેવી અમૂલ્ય સંપત્તિકીટ-પતંગોની માફક વેદ્ધી દેવાની નથી. ચોરાશી લક્ષ યોનિઓમાં બ્રમણ કરતો જીવ ધારું તપને અંતે મનુષ્યદેહ મેળવે છે. તુચ્છ સ્વાર્થ માટે એને વેદ્ધી નહીં દેતાં પરમાર્થ માટે એનો ઉપયોગ થયો જોઈએ. ગાયત્રી સાધના એવો પરમાર્થ છે કે ને આપણા વક્તિગત અને સામાન્યિક જીવનને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરી દે છે.

આગલાં પાનાં ઉપર વેદમાતા જગતજનની આધશક્તિ ગાયત્રીનાં પાંચ મુખની ઉપાસના-આત્માના પાંચ કોશોની સાધનાનાં વિધાનો બતાવવામાં આવ્યાં છે. બૃગુની માફક ને કોઈ તપશ્ચર્યા કરીને આ કોશને એક પછી એક પાર કરશે તે બ્રહ્મપ્રાપ્તિનો અધિકારી થશે.

### ૩. ગાયત્રી મંજરી

અકદા તુ મહાદેવં કેલાશ ગિરિ સંસ્થિતમ્ ।

પપ્રચ્છ પાર્વતિ વન્ધા વિભુધ મંડવે: ॥૧॥

એક વખત કેલાશ પર્વત પર બિરાજમાન દેવતાઓના પૂજય મહાદેવજીને વંદનીય પાર્વતીએ પૂછ્યું-

કતમં યોગ માસીનો યોગેશ ત્વમુપાસતે ।

એન હિ પરમાં સિદ્ધિ પ્રાપ્તુવાનું જગદીશ્વર ॥૨॥

હે સંસારના સ્વામી યોગશ્વર મહાદેવ ! આપ ક્યા યોગની ઉપાસના કરો છે કે જેનાથી આપને પરમ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે ?

શ્રુત્વા તુ પાર્વતી વાચં મધુસિકતાં શ્રુતિપ્રિયમ્ ।

સમુવાચ મહાદેવો વિશ્વકર્માણ કારક: ॥૩॥

પાર્વતીની કણપ્રિય અને મધુર વાણી સાંભળીને વિશ્વવનું કલ્યાણ કરનાર મહાદેવજી બોલ્યા-

મહદ્રહસ્યં તદ્દ શું યતુ પૃષ્ઠં ત્વયા પ્રિયે ।

તથાપિ કથયિદ્ધામિ સ્નેહાત્વામહં સમમ્ ॥૪॥

હે પાર્વતી ! તમે ખૂબ જ ગુપ્ત અને ગૂઢ રહસ્યનો વિષય પૂછ્યો છે, છતાં પણ તમારા પ્રેમને લીધે બંધુ જ રહસ્ય તમોને કહીશ.

ગાયત્રી વેદ માતાસ્તિ સાધશક્તિર્ભતા ભુવિ ।

જનાનાં જનની ચૈવ તામુપાસે ઉહમેવ હિ ॥૫॥

ગાયત્રી વેદમાતા છે, પૃથ્વી પર તે આધશક્તિ કહેવાય છે અને એ જ સંસારની માતા છે. હુ તની જ ઉપાસના કરું છુ.

થોળિનાનાં સમસ્તાનાં સાધનાનાં તુ હે પ્રિયે ।

ગાયન્ત્રેવ મતા લોકે મૂલાધારો વિદાંવરે ॥૬॥

હે પ્રિયે ! વિદ્વાનોએ બધી જ યોગિક સાધનાઓનો મૂળ આધાર ગાયત્રીને જ માનેલ છે.

અતિ રહસ્યમધ્યેષા ગાયત્રી તુ દશ ભુજા ।

લોકડતિ રાજતે પંચ ધારયન્તિ મુખાનિ તુ ॥૭॥

દશભુજાઓવાળી, ખૂબ જ રહસ્યવાળી આ ગાયત્રી સંસારમાં પાંચ મુખોને ધારાણ કરીને ખૂબ જ સુંદર બનેલ છે.

અતિ બૂઢાનિ સંકૃત્વાવચનાનિ શિવસ્ય ચ ।

અતિ સંવૃદ્ધ નિજશાસા શિવમૂર્યે તુ પાર્વતી ॥૮॥

શંકરનાં ખૂબ જ ગૂઢ વચ્ચનો સાંભળીને ખૂબ નિજશાસાથી પાર્વતીજીએ શંકરને પૂછ્યું-

પંચાસ્ય દશબાહુ નામેતેથાં પ્રાણવક્ષભ ।  
કૃત્વા કૃપા કૃપા લોત્વ કિમ્ભુ રહસ્યં તુ મે વદ ॥૮॥

હે પ્રાણવક્ષભ ! કૃપાળુ ! કૃપા કરીને એ પાંચ મુખ અને દશ ભુજાઓનું રહસ્ય મને બતાવો.

કૃત્વાત્વે તમમહાદેવ : પાર્વતી વચન મૃદુ ।  
તસ્યાઃ શંકા મયા કુર્વન્ન પ્રત્યુવાચનિં પ્રિયામ્ ॥૧૦॥

પાર્વતીજનાં આ કોમળ વચનો સાંભળીને મહાદેવજીએ પાર્વતીની શંકાનું સમાધાન કરતાં કહું -  
ગાયત્રીસ્તુ મહાશક્તિર્વિઘ્ને યાહિ ભૂત્વે ।

અનન્ય ભાવતોડહસ્મિનોતપ્રોતોડહસ્ત ચાત્મનિ ॥૧૧॥

પૃથ્વી પર ગાયત્રીની જે મહાન શક્તિ છે તે આત્મામાં અનંત ભાવથી ઓતપ્રોત થઈ રહેલ છે.

વિભર્તિ પંચાવરણાન્ન જીવ : કોશા સ્તુ તે મતાઃ ।  
મુખાનિ પંચ ગાયત્રીસ્તાનેવ વેદ પાર્વતિ ॥૧૨॥

જીવ પાંચ આવરણોને ધારાળ કરે છે તેમને કોશ કહેવાય છે. હે પાર્વતી ! તેને જી ગાયત્રીનાં પાંચ મુખ સમજો.

વિજ્ઞાનમયાક્રમય પ્રાણમય મનોમયાઃ ।  
તથાનન્દમયાસ્તેવ પંચકોશાઃ પ્રકીર્તિતાઃ ॥૧૩॥

અન્ત્રમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય એ પાંચ કોશ કહેવાય છે.

અભેવ કોશ કોશેષુ હનનતા ઝાંસિ સિદ્ધયઃ ।  
જુખા આસાધ યા જીવો ધન્યત્વમધિજયછતિ ॥૧૪॥

આ કોશ રૂપી ભંડારોમાં અનંત રિદ્ધિ-સિદ્ધિઓ ધુપાયેલી છે. તેમને મેળવીને જીવ ધન્ય થઈ જાય છે.

યસ્તુ યોગીશ્વરો હોતાન પંચકોશાક્ર વેધતે ।  
સભવસાગરં તીવ્રાં બન્ધનેભ્યો વિમુચ્યતે ॥૧૫॥

જે યોગીજનો આ પાંચ કોશોનું વેધન કરે છે તે ભવસાગરોને પાર કરીને બંધનોમાંથી ધૂટી જાય છે.

જુખાં રહસ્યમેતેથાં કોશાણાં યોડવગયછતિ ।  
પરમાં ગતિમાણોતિ સ અભેવ નાત્ર સંશય ॥૧૬॥

જે આ કોશોનું જુખા રહસ્ય જાણે છે, તે ચોક્કસ જ પરમગતિને પ્રાપ્ત કરે છે.

લોકા નાં તુ શરીરાશિ ક્ષમાદેવ ભવન્તિ નુ ।  
ઉપત્યકાસુ સ્વાસ્થ્યં ચ નિર્ભરિ વત્તિ સદા ॥૧૭॥

મનુષ્યનું શરીર અન્તર્થી બને છે. ઉપત્યકાઓ પર સ્વાસ્થ્યનો આધાર રહે છે.

આસનેનોપવાસેન તત્ત્વ શુદ્ધયા તપસ્યાય ।  
ચૈવાગમયકોશસ્ય સંશુદ્ધિરભિજયતે ॥૧૮॥

આસન, ઉપવાસ, તત્ત્વશુદ્ધિ અને તપશ્ચયર્थી અગ્રમય કોશની શુદ્ધિ થાય છે.

**એશ્વર્ય:** પુરુષાર્થક તેજઃ ઓળે યથસ્તથા ।

પ્રાગુણકન્યા તુ વર્ધન્તે લોકોના મિત્યસંશ્યમ્ ॥૧૮॥

પ્રાગુણકિંત્યી મનુષ્યોનાં એશ્વર્ય, પુરુષાર્થ, તેજ, ઓજ અને યશ ચોક્કસ વર્ધે છે.

**પંચભિસ્તુ** મહાપ્રાગેર્વબુપ્રાર્થે પંચભિઃ ।

અતે પ્રાગુમયઃ કોશો જતો દશભિકુતમઃ ॥૨૦॥

પાંચ મહાપ્રાગુણ અને પાંચ લઘુપ્રાગુણ તે દશ પ્રાગુણી ઉત્તમ પ્રાગુમય કોશ બન્યો છે.

**બંધેન** મુદ્રયાચૈવ પ્રાગુણામેન ચૈવ હિ ।

**એષ:** પ્રાગુમયઃ કોશ-યતમાનાં તુ સિદ્ધ્યતિ ॥૨૧॥

બંધ, મુદ્રા અને પ્રાગુણામથી પ્રયત્નશીલ પુરુષને આ કોશ સિદ્ધ થઈ જાય છે.

ચેતનામા હિ કેન્દ્રન્તુ મનુષ્યાગુણાં મનોમતમ્ ।

જાયતે મહતીત્વન્તા: શક્તિસ્તસ્મિન્ વશજતે ॥૨૨॥

મનુષ્યોમાં મનને ચેતનાનું કેન્દ્ર માનેલ છે. તેને વશ કરવાથી મહાન અંતઃશક્તિ ઉત્પત્ત થાય છે.

**ધ્યાન** ત્રાટક તન્માત્રાજ્યાનાં સાધનેન્તુ ।

ભવયત્યુજ્વલઃ કોશ: પાર્વત્યેશ મનોમય: ॥૨૩॥

ધ્યાન, ત્રાટક, તન્માત્રા અને જ્યાની સાધના કરવાથી હે પાર્વતી, મનોમય કોશ ખૂબ જ ઉજ્જવળ થઈ જાય છે.

યથાવત્ પૂર્ણિતો જ્ઞાનં સંસારસ્ય ચ સ્વર્પસ્ય ચ ।

ન્યૂતાભિત્યેવ વિજ્ઞાનં પ્રોક્તં વિજ્ઞાવેતુભિઃ ॥૨૪॥

વિજ્ઞાનીઓએ કલ્યું છે કે પોતાના વિશે પૂરું જ્ઞાન હોવું એ જ વિજ્ઞાન છે.

**સાધના** સોડહમિત્યેષા તથા વાત્માનુભૂતયઃ ।

સ્વરાગુણાં સંયમસ્વેવ અંધિલેદસ્તયૈવ ચ ॥૨૫॥

એષાં સંસિદ્ધિલિન્નૂ નં યતામાનસ્ય જ્ઞાતમનિ ।

નુ વિજ્ઞાનમયઃ કોશ: પ્રિયે યાતિ પ્રભુદ્વતામ્ ॥૨૬॥

હે પ્રિયે ! સોડહની સાધના, આત્માનુભૂતિ, સ્વરોનો સંયમ અને ગ્રંથિભેદની સિદ્ધિથી પ્રયત્નશીલ આત્મામાં વિજ્ઞાનમય કોશ પ્રભુદ્વત થાય છે.

આનન્દાવરણોઽત્ત્વાત્યન્ત શાંતિ પ્રદાયિકા ।

તુરીયા સિદ્ધિતિ લોકિ સાધકં તદ્વિગ્રહિતિ ॥૨૭॥

આનન્દ-આવરણની ઉત્ત્રતિથી ખૂબ જ શાંતિ આપનારી તુરીયાવસ્થા સાધકને પ્રાપ્ત થાય છે.

नादा बिन्दु कलानांतु साधनया भवु ।

नन्वानन्दमयः कोश साधके हि प्रबुद्धयेत् ॥२८॥

नादबिन्दु अने कलानी पूर्ण साधना करवाथी साधकनो आनंदमय कोश जगृत थाय छे.

भूलोकस्यास्य गायत्री कामधेनुर्मता भुवेः ।

लोक आश्रयनेनामु सर्वमेवाधिगच्छति ॥२९॥

विद्वानोभे गायत्रीने भूलोकनी कामधेनु मानेल छे. तेनु शरण लઈने मनुष्य बधुं ज मेलवी ले छे.

पंचस्यास्यास्तु गायत्र्याः विद्यां यस्त्वपवगच्छति ।

पंचतत्त्व प्रपंचात सनून हि प्रमुख्यते ॥३०॥

पांच मुखवाणी गायत्री विद्याने जे जागे छे ते चोक्कस ज पांच तत्त्वोना प्रपंचथी धूटी जाय छे.

दशभुजस्तु गायत्र्याः प्रसिद्धा भवनेषुयाः ।

पंच शूल महा शूलान्येताः संकेतयन्ति हि ॥३१॥

संसारमां गायत्रीनी जे दश भुजओ प्रसिद्ध छे ते भुजओ पांच शूल अने पांच महाशूलो ग्रत्ये संकेत करे छे.

दश भुजनामेतासां यो रहस्यं तु वेत्तिसः ।

त्रासं शूलातिशूलानां ना नेवावगच्छति ॥३२॥

जे मनुष्य आ दश भुजओनुं रहस्य जागे छे, ते शूल अने महाशूलथी भय पामतो नथी.

दृष्टिस्तु दोषसंयुक्ता परेषाभवद्भनम् ।

भयस्तु क्षुद्रता सावधानता स्वार्थं युक्तता ॥३३॥

अविवेकस्तथा वेष्टस्तुष्टुगावस्य तथैव च ।

ओतानि दश शूलानि शूलदानि भवन्ति हि ॥३४॥

दोषवाणी दृष्टि, परावलभ्नन, भय, क्षुद्रता, असावधानी स्वार्थपरायाशता, अविवेक, कोध, आणस, तृष्णा-  
ओ बधां दुःखदायक दश शूल छे.

निजेदश भुजेनूनं शूलान्येतानि तु दश ।

संहरते हि गायत्री लोककल्याणकारिणी ॥३५॥

संसारनुं कल्याणु करनार गायत्री पोतानी दश भुजओथी ए दश शूलोनो संहार करे छे.

कलीयुगे मनुष्याणां श्रीराशीति पावति ।

पृथ्वी तत्त्व प्रधानानि जनास्यै भवन्तिहि ॥३६॥

हे पार्वती ! कलियुगमां मनुष्योनुं शरीर पृथ्वीतत्त्वप्रधान होय छे ए तो तमे जाणो ज छो.

सूक्ष्म तत्त्व प्रधानान्य युगोदल्लुत नूणामतः ।

सिद्धिनां तपसामेते न भवन्त्वधिकारिणः ॥३७॥

તેથી બીજા યુગમાં ઉત્પત્ત થયેલ સૂક્ષ્મ તત્ત્વવાળા મનુષ્યો સિદ્ધિ અને તપના અધિકારી હોતા નથી.

પંચાંગ યોગ સંસ્ક્રિદ્ધા ગાયત્ર્યાસ્તુ તથાપિ હે ।

તદ્યુગાનાં સર્વત્રેકાં સિદ્ધિ સંપ્રાભુવંત હિ ॥૩૮॥

તો પણ તે ગાયત્રીના પંચાંગ યોગની સિદ્ધિથી તે યુગોની સર્વત્રેક સિદ્ધિ પ્રાપ્ત કરે છે.

ગાયત્ર્યા વામમાર્ગિયશ્વેયમત્યુચ્ચસાધકેः ।

ઉત્ત્રં પ્રચંડમત્યનં વત્તિ તત્ત્ર સાધનમ् ॥૩૯॥

ઉચ્ચ સાધકો પાસેથી જાણવા યોગ્ય ગાયત્રીની વામમાર્ગી તંત્રસાધના ખૂબ જ ઉત્ત્ર અને પ્રચંડ છે.

અતભેવ તુ તદ્ગુપ્તં રક્ષિતં હિ વિચક્ષણેः ।

સાધતો દુદુપ્યોજો ન કુપાત્રે: કથંચન: ॥૪૦॥

કુપાત્રો દ્વારા તેનો કોઈ પણ રીતે દુદુપ્યોગ ન થાય તેથી વિદ્ધાનોએ તેને ગુપ્ત રાખેલ છે.

બુરુણૈવ વિદ્ધાતત્ત્વં બુરુણૈવ હદિ પ્રકાશયતે ।

બુરુ વિના તુ સા વિદ્ધા સર્વથા નિષ્ફલા ભવેત् ॥૪૧॥

હે પ્રિયે ! વિદ્ધાનું તત્ત્વ ગુરુ દ્વારા જ હદ્યમાં પ્રકાશિત થઈ શકે છે. ગુરુ વિના તે વિદ્ધા નિષ્ફળ થઈ જાય છે.

ગાયત્રી તુ પરાવિદ્ધા તદ્દ્વલાવાપ્ત યે ગુરુ: ।

સાધકેન વિદ્ધાતત્ત્વો ગાયત્રી તત્ત્વ પંડિતઃ ॥૪૨॥

ગાયત્રી પરા વિદ્ધા છે, તેથી તેના ફળની પ્રાપ્તિ માટે સાધકે ગાયત્રીનું તત્ત્વ જાણનાર ગુરુ કરવા જોઈએ.

ગાયત્રી યો વિજનાતિ સર્વ જનાતિ સનતુ ।

જનાત્મયાં ન વસ્તતસ્ય સર્વાઃ વિદ્ધાસ્તુ નિષ્ફલા ॥૪૩॥

જે ગાયત્રીને જાણે છે તે બધું જ જાણે છે. જે તેને જાણતો નથી તેની બધી જ વિદ્ધા નિષ્ફળ છે.

ગાયત્રેવ તપો યોગ: સાધનં ધ્યાનમુશ્યતે ।

સિદ્ધિ જનાનાં સા માતા, નાતઃ કિંચિદ્બૃહત્તરમ् ॥૪૪॥

ગાયત્રી જ તપ છે, યોગ છે, સાધન છે, ધ્યાન છે અને એ જ સિદ્ધિઓની માતા છે. ગાયત્રીથી વધારે શ્રેષ્ઠ બીજી કોઈ જ વસ્તુ નથી.

ગાયત્રી સાધના લોકે ન કસ્યાપિ કદાપિ હિ ।

યાતિ નિષ્ફલતામેતત્ત્રં ધૂવં સત્યં હિ ભૂતવે ॥૪૫॥

સંસારમાં કદી પણ કોઈની ગાયત્રી સાધના નિષ્ફળ જતી નથી એ પૃથ્વી પરનું ધૂવ સત્ય છે.

પ્રાપ્યનિતિ પરમાં સિદ્ધિક્ષાસ્યન્તૌતત્તુ યે જનાઃ ।

જુદું મુનં રહસ્યં યત્ત પાર્વતી ત્વાં પતિપ્રતામ् ॥૪૬॥

હે પરમ પતિપ્રતા પાર્વતી ! મેં જે આ ગુપ્ત રહસ્ય કહું છે, તેને જે લોકો જાણે (તેનો અમલ કર્યો) તે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરશે.

ગાયત્રી મંજરીના રૂઢ શ્લોકોમાં ભારતીય અધ્યાત્મવિદ્યાનો જે સારાંશ વાચકોના હિત માટે રન્દૂ કરેલ છે તેનું જે સારી રીતે મનન કરવામાં આવે અને તેનાથી જે નિરૂપિય આવે તે પ્રમાણે આચરણ કરવામાં આવે તો મનુષ્ય ચોક્કસ જ આ લોક તથા પરલોકનાં બધાં હું ખોથી બચીને સત્પુરુષોને મળનારી શ્રેષ્ઠ ગતિનો અધિકારી બની શકે છે. તેમાં માનવશરીર, મન તથા આન્ત્મા સંબંધી જેટલાં તથ્યો પ્રગટ કર્યા છે તે બધાં તર્કયુક્ત, બુદ્ધિ સંગત અને અનુભવ દ્વારા પાણ બધી રીતે ઉપયોગી છે. જ્યારે એક અજ્ઞાની માણસ પોતાને શરીર જ સમને છે અને તેના જ પાલનપોષણ, ભોગ, રક્ષણ વગેરેની ચિંતામાં લાગ્યો રહે, ત્યારે એમ કહેવું જોઈએ કે તે પશુઓ નેવું જીવન જીવે છે. જે કે ઉપરથી આ શરીર હાડકાં તથા ચામડીનું જ દેખાય છે, જેમાં મળમૂત્ર, લોહી, ચરબી વગેરે પદાર્થો ભરેલા છે, પાણ તેની અંદર મન, બુદ્ધિ, અંતઃકરણ જેવાં મહાન તત્ત્વો પાણ આવેલાં છે. તેમનો વિકાસ કરીને માણસ પશુ શ્રેણીમાંથી ખુદ ઈશ્વરના જેવી કક્ષામાં પહોંચી શકે છે. ‘ગાયત્રી લહરી’માં એ તત્ત્વોની જાગુકારી અને તેમના વિકાસની સાધનાનું સૂત્ર રૂપમાં વર્ણિન કરવામાં આવેલ છે.

શરીરના જે રૂપને આપાણે બહારથી આંખો દ્વારા જોઈએ છીએ તે ‘અન્ત્રમય કોશ’ની અંદર છે. તેને સ્થિર રાખવા માટે જ મનુષ્ય ખાય છે, પીવે છે, સૂવે છે અને મળમૂત્રનું વિસર્જન કરે છે, પાણ ધાળા લોકો તંદુરસ્ત, શક્તિવાન અને દીર્ઘજીવી કર્દી રીતે રહી શકાય તે પાણ જાળતા નથી. અન્ત્રમય કોશની અંદર સૂક્ષ્મ ‘પ્રાણમય કોશ’ છે. તેની સાધના અને વિકાસ કરવાથી જુદાં જુદાં શારીરિક અંગો પર અધિકાર પ્રાપ્ત થઈ જાય છે અને તેની શક્તિને ખૂબ જ વધારી શકાય છે. ‘પ્રાણમય કોશ’ થી સૂક્ષ્મ ‘મનોમય કોશ’ છે. તેની સાધનાથી માનસિક શક્તિઓ એકઠી કરીને અદ્ભુત કાર્ય થઈ શકે છે. તેની મુખ્ય સાધનાવિધિ ધ્યાનને બતાવવામાં આવેલ છે. તેનાથી અન્ય વ્યક્તિઓને વશ કરવી, ભૂત-ભવિધની બાબતોનું જ્ઞાન વગેરે અનેક શક્તિઓ પ્રાપ્ત થાય છે.

‘મનોમય કોશ’ પછી તેથી પાણ સૂક્ષ્મ ‘વિજ્ઞાનમય કોશ’ બતાવવામાં આવેલ છે. વિજ્ઞાનમય કોશથી મનુષ્ય આત્માના ક્ષેત્રમાં પહોંચી જાય છે અને જીવને બંધનમાં રાખનારી ત્રાણ ગ્રંથિઓને ખોલી શકે છે. છેદ્ધે ‘આનંદમય કોશ’ આવેલ છે. તેથી પંચતત્ત્વોથી બનેલ મનુષ્ય પરમાત્માની નજીક પહોંચી જાય છે અને સમાધિનો અભ્યાસ કરીને પોતાના મૂળ સ્વરૂપમાં લીન થઈ શકે છે.

આ રીતે ગાયત્રી મંજરીના થોડાક શ્લોકોમાં યોગશાસ્ત્રનું ખૂબ જ ગંભીર જ્ઞાન સૂત્રરૂપમાં બતાવવામાં આવ્યું છે. તેને ગાયત્રી યોગના છુપાયેલ રત્નબંડારની ચાવી કહી શકાય છે. તેના એક એક શ્લોકની વિસ્તૃત વ્યાખ્યા કરવામાં આવે તો તે ઉપર ખૂબ જ પ્રકાશ પડી શકે છે. ‘ગાયત્રી મહાવિજ્ઞાન’નો આ ત્રીજો ભાગ આ રૂઢ શ્લોકોની વાખ્યાના રૂપમાં લખવામાં આવેલ છે. તેનાથી વધુ પ્રકાશ મેળવીને યોગમાર્ગના પથિકો પોતાનો માર્ગ સરળ કરી શકે છે.

## ૪. અન્ત્રમય કોશની સાધના

### ગ્રાયશ્રીનાં પાંચ મુખુ

આત્માના પાંચ કોશો પેકી પ્રથમ કોશનું નામ અન્ત્રમય કોશ છે. અન્ત્રના સાત્ત્વિક અર્થનું નામ પૃથ્વીનો રસ છે. જળ, અનાજ, ફળ, શાકભાજ, ધાસ વગેરે પૃથ્વીમાંથી પેદા થાય છે. દૂધ, ધી, માંસ વગેરે પાણ એમાંથી જ ઉત્પત્ત થાય છે. આ બધી જ ચીજેને અન્ત કહેવામાં આવે છે અને એનાથી જ રોજ-વીર્ય બને છે તથા મનુષ્યના શરીરનું નિમર્જિણ થાય છે. આ અન્તથી જ શરીર વધે છે તથા પુષ્ટ થાય છે અને છેંવટે અન્તરૂપી પૃથ્વીમાં ભર્સમ થઈને માટીમાં મળી જાય છે. અન્તથી ઉત્પત્ત થઈને અંતે તે જ માટીમાં મળી જાય છે. આ દેહ અન્તની પ્રધાનતાને લીધે “અન્ત્રમય કોશ” કહેવાયો.

અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે અને તે એ છે કે હડમાંસનું ને પૂતળું દેખાય છે તે અન્રમય કોશની આધીનતામાં છે, પણ તે જ અન્રમય કોશ છે એમ સમજી લેવાનું નથી. મૃત્યુ થવાથી દેહ નષ્ટ થાય છે, પણ અન્રમય કોશ નષ્ટ થતો નથી. એ તો જીવની સાથે જ રહે છે. અશરીરી જીવ પણ શરીરની સાથે સંબંધ રાખનારી ભૂત્યોનિમાં અથવા સ્વર્ગ અને નરકમાં અનુભવાતી ભૂખ, તરસ, શરદી, ગરમી અને દુઃખ-દુઃખી પીડાય છે અને તેથી જ દેહ દ્વારા ને ભોગો ભોગવાય છે તેવા ઈન્દ્રિયભોગોની ઈચ્છાઓ તેને ભૂત્યોનિમાં પણ રહે છે. આથી સ્પष્ટ થાય છે કે અન્રમય કોશ એ શરીરનો સંચાલક, કારાગ, ઉત્પાદક, ઉપભોક્તા વગેરે તો છે જ, પણ તેનાથી અલગ પણ છે. એને સૂક્ષ્મ શરીર પણ કહેવામાં આવે છે.

રોગ થાય અને ડોક્ટર અથવા વૈદ્ય ઉપચાર, ઔષધી, ઈન્દેક્શન તથા ઓપરેશન દ્વારા શરીરને તંદુરસ્ત બનાવે છે. આ બધી ચિકિત્સા પદ્ધતિઓ સ્થૂળ શરીર સુધી જ પહોંચે છે. હાડ, માંસ અને ચામડીના વિકારોથી ઉત્પન્ન થતા રોગો સુધી જ એમની મર્યાદા પહોંચે છે, પરંતુ કેટલાક રોગો એવા પણ છે કે જે અન્રમય કોશની વિકૃતિથી જ ઉત્પન્ન થાય છે અને જેને શારીરિક ચિકિત્સકો મટાડી શકતા નથી.

અન્રમય કોશની સ્થિતિ પ્રમાણે જ શરીરનું આખું માળખું અને તેનાં રૂપરંગ બને છે અને તે પ્રમાણે જ ઈન્દ્રિયોની શક્તિઓ પણ હોય છે. જન્મથી જ બાળક શરીરની કેટલીક ઊંઘાપો, અપૂર્ગતાઓ તથા વિશેષતાઓ લઈને જ આવે છે. કોઈનો દેહ આરંભથી જ જરૂર હોય છે. કેટલાક પાતળો દેહ લઈને આવે છે. આંખોની દાઢિ, વાણીની વિશેષતા, મગજની મંદટા અથવા તીવ્રતા અથવા કોઈ ખાસ અંગોની નિર્ભળતા કે ન્યૂનતા હોવી એ અન્રમય કોશની સ્થિતિ અને શક્તિ અનુસાર જ હોય છે. માતાપિતાના રેન્-વીર્યનો પણ એમાં થોડો પ્રભાવ હોય છે, પણ મોટે ભાગે પોતાનો અન્રમય કોશ જ મુખ્ય ભાથ ભન્યે છે. કેટલાંક બાળકો પોતાનાં માતાપિતા કરતાં અનેક બાબતોમાં ઘણી જ ભિન્નતાવાળાં હોય છે.

શરીર અન્રથી બને છે, પોખાય છે અને વધી છે, પણ અન્રની અંદર જ સૂક્ષ્મ જીવન હોય છે. તેનાથી અન્રમય કોશ તૈયાર થાય છે. જેમ શરીરમાં પાંચ કોશ છે તેમ અન્રમય પણ ત્રણ કોશ છે- સ્થૂળ, સૂક્ષ્મ અને કારાગ. સ્થૂળમાં સ્વાદ અને વજન, સૂક્ષ્મમાં પ્રભાવ અને ગુણ તથા કારાગમાં અન્રના સંસ્કાર રહે છે. જીથી માત્ર અન્રનો સ્વાદ માલૂમ પડે છે. પેટ એના વજનનો અનુભવ કરે છે. રસથી એની માદકતા, ઉષ્ણતા વગેરે અનુભવાય છે. અન્રમય કોશ ઉપર એના સંસ્કાર જમે છે. માંસ વગેરે અનેક અભક્ષ પદાર્થો એવા છે કે જે જીબને સ્વાદિષ્ટ લાગે છે તથા દેહને પુષ્ટ બનાવવામાં મદદ કરે છે, પણ એમના સૂક્ષ્મ સંસ્કારની અસરથી અન્રમય કોશ એવો વિકૃત બની જય છે કે જેના અદશ્ય પરિણામ રૂપે આકસ્મિક રોગો, જન્મ-જન્માંતરોની કુરૂપતા અથવા શારીરિક અપૂર્ગતાઓ જન્મે છે અને એટલા જ માટે આત્મવિદ્યાનો જાગ્રાત હંમેશાં સાત્ત્વિક અને સંસ્કારી અન્ર ઉપર જ ભાર મૂકે છે કે જેથી સ્થૂળ શરીરમાં બીમારી, કુરૂપતા, અપૂર્ગતા, આળસ અથવા કમજીરીની વૃદ્ધિ થવા ન પામે. જેઓ અભક્ષ વસ્તુઓ ખાય છે તેઓ અત્યારે નહીં તો ભવિષ્યમાં એવી આંતરિક વિકૃતિના ભોગ બની જશે કે જેનાથી તેઓ શરીરના સાચા સુખથી વંચિત રહેશે.

કેટલાયે શારીરિક વિકારોનું મૂળ અન્રમય કોશમાં હોય છે. એનું નિવારણ દવાદર્ઢી નહીં, પણ યૌગિક સાધનાઓથી જ થાય છે. સંયમ, ચિકિત્સા, ઓપરેશન, વ્યાયામ, માલિશ, વિશ્રામ, ઉત્તમ આહાર, વિહાર અને જળ-વાયુ દ્વારા શારીરિક આરોગ્યમાં બહુ જ સાદું પરિણામ લાવી શકાય છે તેવી જ રીતે કેટલીક એવી પ્રક્રિયાઓ પણ છે, જેનાથી અન્રમય કોશને શુદ્ધ બનાવી પુષ્ટ કરી શકાય છે તથા શારીરિક અપૂર્ગતાઓને ફૂર્ઝ કરી શકાય છે. આવી પદ્ધતિઓ પેકી નીચે જાણાવેલી ચાર મુખ્ય છે.

(૧) ઉપવાસ, (૨) આસન, (૩) તત્ત્વશુદ્ધિ, (૪) તપશ્ચર્યા- આ પ્રક્રિયાઓ ઉપર હવે આ પ્રકરણમાં

પ્રકાશ નાખીશું.

## ઉપવાસ-

જેના શરીરમાં વિજાતીય પ્રવ્યનો, મળનો સંચય થઈ રહ્યો હોય એવા રોગની ચિકિત્સાની શરૂઆતમાં કુશળ ચિકિત્સક અને જુલાબ આપશે, જેથી અનો કોઈ શુદ્ધ થઈ જાય અને ઔષધી અનું કામ સારી રીતે કરી શકે. સંચિત ધ્યેલા મળની સફાઈ કરવામાં ન આવે તો ઔષધી એ મળની સાથે એકરૂપ થઈ જતાં એ કથો જ ગુણ કરતી નથી. અન્રમય કોશની અનેક સૂક્ષ્મ વિકૃતિઓ દૂર કરવામાં ઉપવાસ ધારો અગત્યનો ભાગ ભજવે છે. ચિકિત્સાની શરૂઆતમાં આપેલો જુલાબ જે કામ કરે છે તે જ કામ અન્રમય કોશની સાધનાની શરૂઆતમાં ઉપવાસ કરે છે.

મોટે ભાગે ઉપવાસના લાભોથી સર્વે પરિચિત છે. પેટમાં રોકાયેલું અપકવ અન્ર પચી જાય છે. આરામ લીધા પછી નવચેતન પામેલું પાચન અંગ બમાણું કામ કરે છે. આમાશયમાં અપકવ સ્થિતિમાં રહેલું અન્ર જે વિષ ઉત્પન્ન કરતું હોય તે બંધ થાય છે. બીજી બાજુ આહારની બચતથી આર્થિક લાભ પાણ થાય છે. આમ ઉપવાસના લાભો એવા છે કે જે વિદિત છે. ડોક્ટરો પાણ કરે છે કે “સ્વલ્પાહારી દીર્ઘજીવી હોય છે.”

જે ધારું ખાય છે, ઠાંસી ઠાંસીને પેટ ભરે છે, જે કદી પેટને ચેન પડવા દેતો નથી, એક દિવસ પાણ આરામ આપતો નથી, એવો માણસ પોતાની જીવનસંપત્તિને જલદીથી ખતમ કરી રહ્યો હોય છે અને દીર્ઘજીવી થવાને બદલે એને આ દુનિયામાંથી સ્થળાંતર કરતું પડે છે. આજના રાષ્ટ્રીય અન્રસંકટના દિવસોમાં તો ઉપવાસ એ સાચી દેશભક્તિનું કાર્ય ગણાય. ખરેખર લોકો જે અઠવાહિયામાં એક ઉપવાસ કરવાનું શરૂ કરે તો તેથી પાણ પરદેશમાં જતા કરોડો દુષ્પિયાનો ઠીક ઠીક બચાવ થાય અને અન્ર સસ્તું થવાની સાથે બીજી ચીજેમાં પાણ સોંધવારી થાય.

ગીતામાં “વિષય વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ” વાળા શ્લોકમાં બતાવ્યું છે કે ઉપવાસથી વિષય-વિકારોની નિવૃત્તિ થાય છે. મનનું વિષય-વિકારોથી નિવૃત્ત થવું એ એક મોટો માનસિક લાભ છે. આ વાત ધ્યાનમાં રાખીને જ વેદધર્મમાં દરેક શુલ્ક કર્યાની સાથે ઉપવાસનો સંબંધ જોઈ દીધો છે. કન્યાદાન વખતે માતાપિતા બંને ઉપવાસ કરે છે. યજોપવીત, પ્રતબંધ, સમાવર્તન, વેદારંભ વગેરે દરેક સંસ્કાર વખતે ભ્રષ્ટચારી ઉપવાસ કરે છે.

અનુષ્ટાનના દિવસોમાં યજમાન અને આચાર્ય બંને ઉપવાસ કરે છે. નવદુર્ગાઓના નવ દિવસ દરમ્યાન અનેક સ્ત્રીપુરુષો પૂર્ણ અથવા આંશિક ઉપવાસ રાખે છે. ભાગ્યાણ-ભોજન થવાનું હોય તે દિવસે ભોજન પૂર્વે ગૃહસ્થને ત્યાંનાં બધાં ભોજન કરતાં નથી. પતિ અને સાસુ-સસરા તથા પૂજયજીનો ભોજન ન કરે ત્યાં સુધી સ્ત્રીઓ ભોજન કરતી નથી. આ આંશિક ઉપવાસો પાણ ચિત્તશુદ્ધિની દિલ્લિએ ધારા ઉપયોગી થાય છે.

આરોગ્યની દિલ્લિએ ઉપવાસનું મહત્વ ખૂબ છે. રોગીઓ માટે તો એને જીવનનું મૂળ કદ્યો છે, ‘બીમારીને ભૂખે મારો’ એવો ચિકિત્સાશાસ્ત્રનો રોગીઓને આદેશ છે. ખૂબ્યા રહેવાથી બીમારી મરી જાય છે અને રોગી બચી જાય છે. સંકામક, કષ્ટસાધ અને જીવદેણ રોગોમાં લંઘન એ જ એકમાત્ર ચિકિત્સા હોય છે. ન્યુમોનિયા, ક્રોલેરા, પ્લેગ, ટાઇફોઇઝ વગેરે રોગોમાં કોઈ પાણ ચિકિત્સક ઉપવાસ કરાવ્યા સિવાય રોગીને રોગમુક્ત કરી શકતો નથી. પ્રાકૃતિક ચિકિત્સાવિજ્ઞાનમાં તો સર્વ રોગોમાં પૂર્ણ અથવા આંશિક ઉપવાસને જ મુખ્ય ઉપયોગ ગણાવામાં આવ્યો છે.

આપણા ઋષિઓ આ વાતને સારી રીતે સમજ્યા હતા. એમાં દર મહિને કેટલાક ઉપવાસોને ધાર્મિક મહત્વ આપ્યું છે.

અન્રમય કોશની શુદ્ધ માટે ઉપવાસની ખાસ આવશ્યકતા હોય છે. શરીરમાં કેટલીય જતની ઉપચિકાઓ છે, જેને શરીરશાસ્ત્રીઓ ‘નારીગુર્ધ’ કહે છે. જેવામાં આવ્યું છે કે કેટલીક જગ્યામે જ્ઞાનતંતુઓ જેવી પાતળી વાચની મહાવિજ્ઞાન - ભાગ-૩

નાડીઓ એકબીજા ઉપર લપેટાયેલી હોય છે. આવું ગુચ્છક ધારીવાર દોરીની માફક આપસમાં એકબીજા ઉપર લપેટાયેલું હોય છે. કોઈ કોઈ જગ્યાએ આવું ગુચ્છક ગાંઠની માફક મજબૂત ગોળી ઠેવું બની જાય છે.

કોઈ વખત આવાં ગુચ્છકો સર્પની જેમ એકબીજાને સમાંતર પહેલાં હોય છે અને છેવટે એમનાં માથાં એકબીજામાં ચોટી જાય છે. કોઈ કોઈ જગ્યાએ મોટા વડના જાડની માફક એની શાખા-પ્રશાખાઓ ફેલાતી રહે છે. અને એવી રીતે કેટલાંક ગુચ્છકો આપસમાં લપેટાઈ જાય છે. એમના રંગ અને આકારમાં ધારું તદ્દાવત હોય છે. ચોક્કસ રીતે પરીક્ષા કરવામાં આવે તો એમનું દરેકનું ઉણગતામાન, આગું-પરિક્રમાણ તથા ગુણ અવગુણની રેનાસ્થિતામાં ધારું અંતર જોવા મળશે.

વૈજ્ઞાનિકો આ નાડીગુચ્છકોના કાર્યક્ષેત્રનો હજુ સુધી પૂરતો પરિચય મેળવી શક્યા નથી, પણ યોગી લોકો જાગે છે કે આ ઉપનિયોગો શરીરમાં અન્નમય કોશની બંધન-અંધિઓ છે. ભરાગ થતાની સાથે બધાં બંધનો ખૂલ્લી જાય છે. પછી એક પણ ગુચ્છક જોવા મળતું નથી. આ ઉપનિયોગો અન્નમય કોશના ગુણકોશોના પ્રતીક જેવી છે.

‘દીનિકા’ જાતિની ઉપનિયોગ ચંચળતા, ઉદ્વિગ્નતાના પ્રતીક જેવી છે. જે જે વ્યક્તિઓમાં આ જાતિનાં નાડીગુચ્છકોનું પ્રમાણ અધિક હોય તેઓ એક જ સ્થાન પર લાંબા સમય સુધી બેસી કામ કરી શકે નહીં. એમણે કાંઈ ને કાંઈ ખટપટ કરવી જ પડે છે.

‘દીપિકા’ જાતિની ઉપનિયોગો જેશ, કોધ, શારીરિક ઉણગતા, અધિક પાચન, ગરમી વગેરે ઉત્પન્ન કરે છે. આવા ગુચ્છકોના વધારે પ્રમાણવાળો મનુષ્ય ચામડીના રોગો ફોક્સા-શેક્સ્પી, નસકોરી ફૂટવી, પીળો પેશાબ, આંખોની બાળતરા વગેરે ફરિયાદોથી પીડાતો હોય છે.

‘મોચિકા’ ની અધિકતાવાળી વ્યક્તિ શરીરનો પસીનો, લાળ, કદ, પેશાબ વગેરે મળોનું અધિક પ્રમાણમાં વિસર્જન કરે છે. પાતળા જાડા થવા અને શરદીની ફરિયાદનો એ વારંવાર ભોગ બને છે.

‘આધ્યાત્મિકી’ જાતિનાં ગુચ્છક આળસ, અધિક નિદ્રા, અનુત્સાહ અને ભારેપણું ઉત્પન્ન કરે છે. એવી વ્યક્તિ થોડીક મહેનત કરતાં થાકી જાય છે. એનાથી શારીરિક અથવા માનસિક કાર્ય વિશેપ પ્રમાણમાં નહીં થાય.

‘પૂપા’ જાતિનાં ગુચ્છક મનને કામવાસના તરફ, બળાત્કાર તરફ જોંચી જાય છે. સંયમ અને બ્રહ્મયર્થની કરેવી યોજનાઓ ઊંઘી વાળે છે. પૂપાનું થોડું પણ ઉત્તેજન તપને બેચેન બનાવી દે છે તથા એને કાબૂ બહાર લઈ જઈ વિકારગ્રસ્ત કરી દે છે. શિવજી ઉપર બાણ છોડતી વખતે કામદેવે કુસુમબાળાંથી એ પ્રદેશની પૂપાઓને ઉત્તેજિત કરી દીધી હતી.

‘ચંદ્રિકા’ જાતિની ઉપનિયોગો સૌંદર્ય વધારે છે. એની અધિકતાથી વાણીમાં મધુરતા, નેત્રોમાં માદકપણું અને ચહેરા ઉપર આકર્ષણ, કોમળતા અને મોહકતા આવે છે.

‘કપિલા’ જાતિની અધિકતાથી બીક લાગવી, હદ્યનું ખડકવું, ખરાબ સ્વાસ્થ, આશંકા, મગજની અસ્થિરતા, નસુંસકતા, વીર્ય રોગ વગેરે લક્ષણો સ્પષ્ટ થાય છે.

‘ધૂસાર્થિ’ માં સંકોચનશક્તિ ધારી હોય છે. કદ બહુ મુશ્કેલીથી નીકળે છે. ફોલ્લા જલદીથી પાકતા નથી. દસ્ત ધારું કઠાગ થઈ જાય છે. મનની વાત કહેવામાં ધારું સંકોચ રહે છે.

‘ઉભા’ ઓની અધિકતાથી માણસ હંઝ્યા કરે છે, હંડી મોસમમાં પણ ગરમી વાળે છે, જટ કોધ આવી જાય છે, બધાં કામોની અંદર ઉતાવળાપણું આવી જાય છે, લોહીની ગતિ અને શ્વાસ-પ્રશ્વાસની કિયામાં ધારી તીવ્રતા આવે છે.

‘अमाया’ वर्णनां गुच्छक दृष्टा, मजबूती, कठोरता, गंभीरता तथा हठीलापाणु भतावे છે. આવી જતनां શરીરો પર બાધોપચાર કથી અસર કરતા નથી. કોઈ દવા ઉપયોગી થતી નથી. આવી પ્રકૃતિવાળો માણસ સ્વેચ્છાપૂર્વક રોગી અથવા રોગમુક્ત બની શકે છે. કોઈ કુપથ એને રોગી બનાવી શકતું નથી, કેમકે એની ઈચ્છાશક્તિ એટલી મજબૂત હોય છે, પણ જ્યારે એનું પતન થવા મારે છે ત્યારે કોઈ પણ જતનો સંયમ અથવા નિયમપાલન એને મદદ કરતાં નથી.

ચિકિત્સકોના ઉપચાર અને કવાર નિષ્ફળ જાય છે, કેમકે જુદી જુદી ઉપત્યકાઓના અસ્તિત્વને લીધે શરીરની સૂક્ષ્મ સ્થિતિ એવી થઈ જાય છે કે જ્યાં ચિકિત્સા કાંઈ ખાસ કામ આપતી નથી.

‘ઉદ્ગીથ’ ઉપત્યકાઓની અતિવૃદ્ધિથી સંતાન ઉત્પત્તિ બંધ થાય છે. જે પુરુષ અથવા જીવમાં આ ઉપત્યકાઓનું પ્રમાણ વધારે હોય એ બીજી બધી રીતે સંપૂર્ણ નીરોગી હોય છતાં પણ સંતાન ઉત્પાદન માટે અયોગ્ય થઈ જાય છે.

સ્વીપુરુષો પૈકી જેનામાં ‘અસિતા’ નું પ્રમાણ વધારે હોય તે પોતાના વિંગનાં બાળકો ઉત્પત્ત કરવામાં વિશેષ સફળ થાય છે. અસિતા- સંપત્ત સ્વી કન્યાઓને એને પુરુષ પુત્રોને ઉત્પત્ત કરવામાં સફળતા મેળવે છે. દંપતીમાં જે અધિક ‘અસિતા’ સંપત્ત હોય તેની શક્તિ જીતશે.

‘યુક્તહિંસા’ જતિનાં ગુચ્છક ફૂરતા, દુષ્ટા તથા પરરીડનની પ્રેરાગા આપે છે. આવી વ્યક્તિઓને થોરી, જુગાર, વભિચાર, ઠગાઈ વગેરે કરવામાં ઘણો રસ પડે છે. જેઈતા પ્રમાણમાં ધનસંપત્તિ હોવા છતાં અનુચ્છિત માર્ગથી પણ ધન મેળવવા મન લબચાયા કરે છે. કોઈ ખાસ કારાગ ન હોવા છતાં બીજાઓ પ્રત્યે ઈઞ્ચ, દ્વિપ અને આકમાણકારી આચરણ કરવા પ્રેરાય છે. આવા માણસો માંસાહાર, મધ્યપાન, શિકાર ખેલવો, મારપીટ કરવી, ઝઘડો-તોફન કરવાં અને એવા કામમાં પટલાઈ કરવાનું ધાણું પસંદ કરે છે. ‘હિંસા’ ઉપત્યકાના અધિક પ્રમાણવાળું શરીર હંમેશાં એવાં કામમાં રસ વેશે કે જેથી અશાંતિ જ ઉત્પત્ત થાય. એવા લોકો પોતાનું માણું ઝોડવામાં, આત્મહત્યા કરવામાં અથવા બાળકોને મારજૂ કરવામાં તથા કુક્રો કરવામાં રસ વેશે.

ઉપરોક્ત પંક્તિઓમાં થોડીક ઉપત્યકાઓનું વાર્ગન કરવામાં આવ્યું છે. આવી ઉપત્યકાઓની છંદ જતિઓ છે. સંભવ છે કે એમની સંખ્યા આથી પણ વધારે હોય. આ ગ્રંથિઓ એવી છે કે જે શરીરની સ્થિતિને ઈચ્છાનુકૂળ રાખવામાં બાધક નીવડે છે. મનુષ ઈચ્છે છે કે તે પોતાના શરીરને બહુ સરસ બનાવે અને તેને માટે ધાણીવાર કોઈક ઉપાય પણ યોજે છે, પણ ધાણી વખત આ ઉપાયો સફળ થતા નથી, કેમકે આ ઉપત્યકાઓ અંદર ને અંદર એવી વિલક્ષણ કિયાઓ અને પ્રેરાગાઓ ઉત્પત્ત કરે છે કે જેનાથી બાધ્ય પ્રયત્નો સફળ થતા નથી. આવી રીતે મનુષ ધાણીવાર પોતે અસફળ અને અસહાય હોવાનો અનુભવ કરે છે.

અત્રમય કોશને શરીર સાથે જેડનારી આ ઉપત્યકાઓ શારીરિક અને માનસિક દુષ્કર્માંથી વિકૃત થઈ જાય છે અને સત્કર્માંથી સુષ્વવસ્થિત રહે છે. બૂરું આચરણ ખાઈ ખોટે છે અને શરીર આવી ખાઈમાં પડી રોગ, શોક વગેરેની પીડા સહન કરે છે. આવી પીડાઓથી બચવા માટે આહારવિહાર સંયમિત અને સાન્નિવક રાખવો, દિનચર્યા ટીક રાખવી અને કુદરતના આદેશ પ્રમાણે ચાલવું અંબે ખાસ જરૂરી છે. સાથે સાથે એવા પણ ખાસ યૌગિક ઉપાયો છે કે જેથી ઉપરોક્ત આંતરિક વિકારો પર કાબૂ મેળવી શકાય. માત્ર બાધોપચારથી આ વિકારો દૂર થવા મુશ્કેલ છે.

ઉપત્યકાઓના સંશોધન, શુદ્ધિકરણ અને સમતોલનનો ઉપવાસની સાથે ઘણો સંબંધ છે. યોગસાધનામાં ઉપવાસનું એક ખાસ વિજ્ઞાન છે. અમુક અવસર પર, અમુક માસમાં, અમુક મુહૂર્તમાં, અમુક પ્રકારનો ઉપવાસ કરવાનું અમુક ફળ હોય છે, આવાં વિધાનો શાસ્ત્રમાં ઠેકઠેકાગે મળે છે. ઋતુઓ પ્રમાણે શરીરમાં છ અધિઓ

ઓછાવતા પ્રમાણમાં રહે છે. શ્રીભાઈ બદ્ધને વસંત સુધીની ઈ ઝ્યતુઓ દરમ્યાન શરીરમાં અનુકૂમે ઈ અભિઓ ક્રિયાશીલ રહે છે. ઉષ્મા, બહુવૃચ, હૃવાદી, રોહિતા, આપતા અને વાતિ. આ દરેકના ગુણો બિન્દુ બિન્દુ હોય છે.

(૧) ઉત્તરાયણ-દક્ષિણાયનની ગોળાધ સ્થિતિ, (૨) ચંદ્રમાની ઘટતી-વધતી કળા (૩) ભૂમિ ઉપર નક્ષત્રોનો પડતો પ્રભાવ અને (૪) સૂર્યનાં અંશક્રિયાણોનો માર્ગ આ ચારે બાબતોનો શરીરની અંદર રહેલ ઈ ઝ્યતુ - અભિઓની સાથે સંબંધ થવાથી શું પરિણામ આવે છે તેનો વિચાર કરીને ઈ ઝ્યતિઓએ એવાં પુણ્ય પર્વો નક્ષી કર્યા છે કે જેમાં અમુક ચોક્કસ વિધિથી ઉપવાસ કરવામાં આવે તો તેનું અમુક ચોક્કસ ફળ મળે. જેવી રીતે કાર્તિક વદ ચોથ જેને 'કરવા ચોથ' કહેવામાં આવે છે એ દિવસે કરેલો ઉપવાસ દંપતીપ્રેમ વધારનારો નીવડે છે, કેમકે એ દિવસની ગોળાધ સ્થિતિ ચંદ્રની કળા, નક્ષત્રોનો પ્રભાવ અને સૂર્યમાર્ગ એ બધાનું પરિણામ શરીરમાં રહેલા અભિ ઉપર પડતાં શરીર અને મનની સ્થિતિ એવી બની જાય છે કે જેથી દાંપત્યસુખ દફ, મજબૂત અને ચિરસ્થાયી બનવામાં ઘણી સહાયતા મળે છે.

આ ઈ પ્રમાણે બીજાં અનેક પ્રત-ઉપવાસો છે, જે અનેક ઈચ્છાઓ અને આવશ્યકતાઓને પૂરી કરે છે તથા અનેક અનિષ્ટોને અટકાવવામાં સહાયભૂત થાય છે.

ઉપવાસના પાંચ બેદો છે. (૧) પાચક, (૨) શોધક, (૩) શામક, (૪) આનક અને (૫) પાવક. પાચક ઉપવાસ એ છે કે જે પેટનાં અપચો, અજ્ઞાર્ણ અને કોણબદ્ધતાને પચાવે છે. શોધક એ છે જે રોગોને ભૂખે મારીને હટાવે છે, જેને લંઘન પાણું કહેવામાં આવે છે. શામક એ છે કે જે કુવિયારો, માનસિક વિકારો, દુષ્પ્રવૃત્તિઓ અને વિકૃત થયેલી ગ્રંથિઓ-ઉપત્યિકાઓનું શમન કરે છે. આનક ઉપવાસ ખાસ પ્રયોજન માટે દેવીશક્તિનું આકર્ષણ આપાગુણ તરફ રાખવા માટે કરવામાં આવે છે અને પાવક ઉપવાસ એ છે કે જે પાપોના પ્રાયશ્ચિત્ત માટે અને આત્મિક પવિત્રતાની વૃદ્ધિ માટે કરવાના હોય છે.

કર્દ્યાંબ્રજિતને શારીરિક અને માનસિક સ્થિતિ અનુસાર ક્રૂં ઉપવાસ અનુકૂળ આવશે અને તે કેવા વિધિનિયમોથી થવો જોઈએ એનો નિર્ણય કરવા માટે સ્ફૂર્ખ વિવેચનની જરૂર રહે છે.

સાધકનો અન્ધમય કોશ કર્દ સ્થિતિમાં છે? એની ઉપત્યિકાઓ વિકૃત થઈ ગઈ છે? ઉત્તેજિત થયેલી કર્દ ગ્રંથિને શાંત કરવી જોઈએ અથવા મંદ પદેલી કર્દ ઉપત્યિકાને સતેજ કરવાની જરૂર છે? એ જોઈને નિર્ણય કરવો જોઈએ કે વ્યક્તિએ કેવા પ્રકારનો ઉપવાસ ક્યારે કરવો?

પાચક ઉપવાસમાં કક્કિને ભૂખ ન લાગે ત્યાં સુધી ભોજન છોડી દેવું જોઈએ. એક વખતનો, એક દિવસ અથવા જે દિવસનો આહાર છોડવાથી સાધારણ રીતે કબજિયાત પાકી જાય છે. આવા ઉપવાસમાં મદદ તરીકે લીધુનો રસ ગરમ પાણીમાં લેવાથી અથવા પાચક ઔષધીનું સેવન કરવાથી વિશેષ મદદ મળશે.

શામક ઉપવાસમાં આરામ ભખું જ અગત્યની વાત છે. જ્યાં સુધી રોગી કટોકટીની સ્થિતિને પાર કરી ન જાય ત્યાં સુધી આ ઉપવાસ ચાલવો જોઈએ. આવા ઉપવાસોમાં ગરમ કર્યા પછી ઠંડા કરેલા પાણીનો ઉપયોગ એ ઈ એક માત્ર અવલંબન હોવું જોઈએ.

શામક ઉપવાસ દૂધ, ધાસ, ફળોનો રસ વગેરે પ્રવાહી પદાર્થો ઉપર ઈ ચાલવો જોઈએ. આવા ઉપવાસ દરમ્યાન સ્વાધ્યાય, આત્મચિંતન, એકાંતસેવન, મૌન જરૂર, ધ્યાન, પૂજન, અર્થન, પ્રાર્થના વગેરે આત્મશુદ્ધિના ઉપયારો પાણ સાથે ચાલવા જોઈએ.

આનક ઉપવાસમાં સૂર્યક્રિયાણો દ્વારા ઈષ્ટ દેવીશક્તિનું આવાહન કરવાનું હોય છે. સૂર્યનાં સપ્તવાર્ણિ ડિરણોમાં રાહુ-કેતુને છોડી બાકીના સાતેય ગ્રહોની રાશિઓ સંમિલિત થઈ છે. સૂર્યમાં તેજસ્વિતા, ઉષગતા તથા પિત્રપ્રકૃતિની

પ્રધાનતા છે.

ચંદ્રમા : શીતળ, શાંતિદાયક, ઉજન્નતલ અને કીર્તિકારક છે.

મંગળ : કઠોર, બળવાન અને સંહારક છે.

બુધ : સૌભ્રય, શિષ્ટ, કફ્ફપ્રધાન, સુંદર અને આકર્ષક છે.

ગુરુ : વિદ્યા, બુધિ, ધર્મ, સૂક્ષ્મદર્શિતા, શાસક, ન્યાય અને રાજ્યનો અધિકારી છે.

શુક : વાતપ્રધાન, ચંચળ, ઉત્પાદક, પાણ ફૂટનીતિવાળો છે.

શનિ : સ્થિરતા, સ્થૂલતા, સુખોપભોગ, દઢતા અને પરિપુષ્ટતાનો પ્રતીક છે.

જે ગુરુઓની જરૂર હોય એને અનુરૂપ દેવી તત્ત્વોના આકર્ષણ માટે સપ્તાહના તે દિવસે ઉપવાસ કરવો જોઈએ. એ દિવસના ઉપવાસમાં જે લઘુ આહાર કરવાનો હોય તે એ ગ્રહોની શક્તિની સામે સમતા રાજનારી હોવો જોઈએ. એટલું જ નહીં, પાણ જે તે ગ્રહને અનુરૂપ રંગની વસ્તુઓ, વસ્ત્ર, ખોરાક વગેરેનો ઉપયોગ થાય એ જ ઈષ્ટ છે.

રવિવાઙ્મને દિવસે સફેદ રંગની વસ્તુઓ તથા ગાયના દૂધ અને દહીનો જ ઉપયોગ કરવો ઈષ્ટ છે. સોમવારે પીળો રંગ તર્થી ચોખાનો ઉપયોગ સારો કહેવાય. મંગળવારે લાલ રંગ અને લેસનું દૂધ, દહી અને છાશ ઈષ્ટ છે. બુધવારે લીલો રંગ અને ખાટાં મીઠાં ફળ વેવાં, ગુરુવારે નારંગી રંગનાં મીઠાં ફળ ઉપયોગમાં વેવાં. શુકવારે લીલો રંગ તથા બકરીનું દૂધ, દહી તથા ગોળનો ઉપયોગ સારો કહેવાય. પ્રાતઃકાળનાં કિરણોની સન્મુખ આંખો બંધ કરીને નિર્ધારિત કિરણો પોતાની અંદર પ્રવેશ કરે છે એવું ધ્યાન ધરવાથી સૂર્યશક્તિ આપણી અંદર અવતરે છે.

પાવક - ઉપવાસ પ્રાયશ્ક્રિત સ્વરૂપે જ કરવાના હોય છે. તે દરમ્યાન માત્ર હૃદયથી પ્રભુ પાસે જ્ઞમા યાચવી અને એવી ભૂલ ભવિષ્યમાં ન કરવાની પ્રતિક્ષા વેવી. આવા અપરાધ માટે કષ્ટ પડે એવી શારીરિક તિતિક્ષા કરવી તથા શુભકાર્ય માટે એટલું દાન કરવું કે નેના પુણ્ય દ્વારા ઉપજની શાંતિ પાપની પીડાનું શમન કરી શકે. ચાંદ્રાયાગવ્રત, કૃદ્યાંદ્રાયાગ વગેરે પાવક ક્રતો ગાણી શક્ય.

કોઈ પાણ ઉપવાસમાં નીચેની વાતોનું ખાસ ધ્યાન રાખવું :

(૧) ઉપવાસ દરમ્યાન વગર તરસે પાણ વારંવાર પાણી પીવાનું રાખવું. (૨) ઉપવાસને દિવસે અધિક શ્રમ પડે એવું કામ ન કરવું. (૩) ઉપવાસ દરમ્યાન જો નિરાહાર ન જ રહી શકાય, તો બહુ જ થોડી માત્રામાં રસવાળો પદાર્થ, ફળ અથવા દૂધ વેવું. મીઠાઈ, હલવો તથા એવી ભારે ચીજે ખાવાથી ઉપવાસનું પ્રયોજન માર્યું જય છે. (૪) ઉપવાસ છોડવામાં બહુ ધ્યાન રાખવાનું છે. ખૂબ હલકો અને જલદીથી પણ એવો પદાર્થ અલ્ય પ્રમાણમાં વેવાની શરૂઆત કરી ધરિ ધરિ વધારવો. (૫) ઉપવાસ દરમ્યાન લગભગ બધો વખત આત્મચિંતન, સ્વાધ્યાય અને ઉપાસનામાં ગાળવો.

ઉપત્યિકાઓનું શોધન, પરિમાર્જન અને ઉપયોગીકરણ કરવા માટે જે ઉપવાસ કરવાના હોય તેને માટે કોઈ જાગ્રકાર માર્ગદર્શકની જરૂર હોય છે, પાણ પ્રતેક ગાયત્રી સાધકે સામાન્ય રીતે કરવાના ઉપવાસ માટે રવિવાર બહુ ઉપયોગી દિવસ છે. એ દિવસે સાતે ગ્રહોની સમ્ભિલિત શક્તિ પૃથ્વી ઉપર આવે છે. એ શક્તિ વિવિધ પ્રયોજનો માટે ઉપયોગી છે. રવિવારે પ્રાતઃકાળે સ્નાન કરીને અથવા માત્ર હાથ મોં ધોઈને શુદ્ધ વસ્ત્રો પહેરી સૂર્યની સામે મોં કરીને ભેસવું. એકવાર ખુલ્લાં નેત્રોથી સૂર્યનારાયણનાં દર્શન કરી લઈએંઓ બંધ કરી દેવી અને પછી ગાયત્રીના તેજપુંજ્રવાળા રવિમંડળનું ધ્યાન કરવું. ‘સૂર્ય ભગવાનના તેજેરાશિરૂપી સમુક્રમાં અમે સ્નાન કરી રહ્યા છીએ અને આ તે અમારી

ચારે બાજુએ ફેલાઈ રહ્યું છે.' આવું ધ્યાન કરવાથી સવિતાટેવનાં બ્રહ્મકિરણો તમારી અંદર ઓતપ્રોત થઈ જશે. બહારથી મુખ ઉપર પ્રકાશનું પડવું અને અંદરથી ધ્યાનકર્ષણ દ્વારા સૂક્ષ્મ સૂર્યકિરણોને ભેંચવાથી ઉપય્યિકાઓના વિકાસમાં ધ્યાની મદદ મળે છે. આવી સાધના ૧૫ થી ૩૦ મિનિટ સુધી કરવી.

એ દિવસે સંક્રિયા વસ્તુઓનો વધારે ઉપયોગ કરવો જોઈએ. મોટે ભાગે વસ્તો પાણ સંક્રિયા પહેરવાં, બપોરે બાર વાયા પછી ફળાહાર કરવો. જે લોકો રહી શકે તેમાંણે નિરાહાર રહેવું. ન બની શકે એમાંણે ફળ, દૂધ અને શાકભાજી લઈને ચલાવવું. બાળક, વૃદ્ધ, ગર્ભિણી, રોગી અને કમાઝેર વ્યક્તિ બપોરે દાળ, ભાત વગેરે અને રાત્રે દૂધ લઈ શકે છે. મીહું અને સાકર એ બંને સ્વાદ ઉત્પન્ન કરનારી વસ્તુઓનો ત્યાગ કરીને કરેલો આહાર પાણ એક પ્રકારનો ઉપવાસ જ છે. અસ્વાદ આહારના આંશિક ઉપવાસથી શરૂ કરી ગાયત્રી સાધક પોતાની પ્રવૃત્તિ ધીમે વધારી શકે છે.

## આસન -

મોટે ભાગે આસનો પાણ શારીરિક વ્યાયામ તરીકે જ ગણાયાં છે. વ્યાયામ દ્વારા મળનારા બધા લાભો આસનોથી મળી શકે છે. સાધારણ કસરત મારફત અંદરનાં જે અંગોને વ્યાયામ નથી મળી શકતો તેમને આસનો મારફત મળી શકે છે.

યોગસાધનામાં આસનોને જ્ઞાપિઓએ મુખ્ય સ્થાન આપ્યું છે, કેમકે સ્વાસ્થ્યરક્ષા માટે તે અતિશ્ય ઉપયોગી હોવા ઉપરાંત મર્મસ્થાનોમાં રહેતી 'હૃદ્વલા' અને 'કૃદ્વલા' તારિત શક્તિને આસનો જ કિયારીલ રાખે છે. મર્મસ્થાન અતિકોમળ છે અને એવું સુરક્ષિત બનાવ્યું છે કે સામાન્ય રીતે બાધ્ય પ્રભાવ તાં સુધી પહોંચતો નથી. આસનોથી એની રક્ષા થાય છે.

આ મર્મસ્થાનોની રક્ષા કરવામાં કોઈ પ્રકારની અરદાણ આવી જાય, તો જીવન સંકટમાં આવી પડવાનો સંભવ છે. આવાં મર્મસ્થાનો ઉદર અને છાતીમાં વિશેષ છે. કંઠકૂપ, સ્કંધ, પુષ્ટિ, મેરુદંડ અને બ્રહ્માંધ સાથે સંબંધ ધરાવતાં તું મર્મસ્થાન છે. એમની ઉપર કોઈ આધાત લાગી જાય કે કોઈ રોગને લીધે કશી વિકૃતિ આવી જાય, રૂતાભિસરાણમાં અવરોધ થાય અથવા રેતી જેવો કઠાણ પદાર્થ જામી જાય અથવા વિષકાળિકા જરૂર થઈ જાય, તો દેહ અંદર ને અંદર ધોવાતો જાય છે. બહારથી પ્રત્યક્ષ અથવા વિશેષ ઇપમાં કોઈ રોગ દેખાતો નથી, છાતાં અંદર ને અંદર અંદર ને અંદર ધોવાતો જાય છે. બહારથી પ્રત્યક્ષ અથવા વિશેષ ઇપમાં કોઈ રોગ દેખાતો નથી, પાણ મોઢાની કડવાશ, શરીરમાં રોમાંચ, ભારેપાણું, ઉદાસીનતા, માથાનો હલકો દુઃખાવો, તરસ વગેરે આંતરિક જવરનાં લક્ષણો દેખા દે છે. વેદ, તોકટરો કશું સમજી શકતા નથી. તેઓ દવા કરે છે, પાણ ખાસ લાભ મળી શકતો નથી.

મર્મો ઉપર આધાત લાગવાથી આકસ્મિક મરાણ પાણ નીપને છે. તાંત્રિક વિદ્યાનો આગુકાર જ્યારે મારાણપ્રયોગ કરે છે ત્યારે તેનું આકસ્માણ આ મર્મસ્થાનો પર જ હોય છે. હાનિ, શોકુ, અપમાન વગેરેનો કોઈ માનસિક આધાત લાગે છે, ત્યારે મર્મસ્થાન ઘવાય છે અને એ વ્યક્તિનો પ્રાણ ભયમાં આવી પડે છે. મૂત્રપિંડોમાં શિથિલતા, હરસ જેવા જલદીથી ન મટે એવા રોગો થાય છે.

મસ્તક અને હૃદયનાં મર્મસ્થાનોમાં હૃદ્વલા નામની પોકિટિવ વિદ્યુતનો નિવાસ છે. બંનેના પ્રમાણમાં ફરક પડી જાય તો લક્ષ્ય, અધ્યાત્મિક, સંધિવાત જેવા રોગો પેદા થઈ જાય છે.

કેટલીકવાર ધારા મજબૂત અને તંદુરસ્ત દેખાતા મનુષ્યને પાણ એવો મંદ રોગ લાગુ પડી જાય છે કે તેની બહારથી ટેખાતી સુંદર શારીરિક સ્થિતિ જેતાં તે લાગુ ન પડવો જોઈએ. આવા માર્મિક રોગો મર્મસ્થાનોની અથવસ્થાને લીધે ઉદ્ભબે છે કારાણ કે સામાન્ય પરિશ્રમ અથવા કસરત મારફતે આ મર્મસ્થાનોને પૂરો વ્યાયામ મળતો હોતો નથી. ઔષધીઓની અસર તાં સુધી પહોંચતી નથી. શલ્ષક્રિયા અથવા ઈનેક્શનો એમને ઉતેજન આપવામાં અસમર્થ

નીવડે છે. આવી વિકટ થંધિઓને સીધી અને કાર્યક્રમ બનાવવામાં માત્ર યોગાસનો જ અનું તીક્ષ્ણ હથિયાર છે કે જે મર્મસ્થાનોની શોધનક્ષયામાં ચમત્કારિક અસર કરી શકે છે.

અથિઓએ જેણું કે આહારવિહાર સારી રીતે રાખવા છતાં તથા આરામ અને વ્યામની સમતોલ વ્યવસ્થા રાખવા છતાં ટેટલીકવાર સૂક્ષ્મ અજ્ઞાત કારણોને લીધે મર્મસ્થાન વિકૃત બની જય છે અને તેમાં રહેલી હવ્યવહા અને કવ્યવહા શક્તિઓના સમતોલપણામાં વિકૃતિ આવવાને લીધે બીમારી અને કમજોરી પેદા થાય છે, જેથી યોગસાધનામાં વિક્રેપ પડે છે. આવી મુશ્કેલીઓ દૂર કરવા માટે એમણે પોતાના દીર્ઘકાળના અનુભવ અને સંશોધન દ્વારા ‘આસન’ ક્ષયાઓની શોધ કરી છે.

આસનોનો સીધો પ્રભાવ આપણાં મર્મ સ્થાનો પર પડે છે. મુખ્ય નસ-નાડીઓ અને માંસપેશીઓ વગેરેનું પણ આસનો દ્વારા એવું સંકોચન અને પ્રસરણ થાય છે કે જેથી એમાં જમા થયેલો વિકાર દૂર થઈ જય છે, એટલું જ નહીં, પણ નિત્ય સફરી થતી રહેતી હોવાથી નવો વિકાર જમા થતો નથી. મર્મસ્થાનોની શુદ્ધિ, સ્થિરતા અને પુષ્ટિ માટે આસનોનો ઉપયાર સર્વ રીતે ઉત્તમ કહેવાયો છે.

આસનો અનેક છે. એ પેકી ૮૪ મુખ્ય છે. એ સર્વના પ્રકાર, કરવાની વિધિ અને ઉપયોગિતાનું વાર્ગન કરવાનો અવસર નથી. આસનવિદ્યાનું સર્વાંગી શિક્ષણ આ પુસ્તકમાં આપી શકાય નહીં. એ માટે માઝું ‘બળવર્ધક વ્યાયામ’ પુસ્તક જોવું જોઈએ. આને તો ગાયનીની યોગસાધના કરનારા સાધકોને ટેટલાંક સુલભ આસનો બતાવીશું, જે સામાન્ય રીતે એમનાં સર્વ મર્મસ્થાનોની સુરક્ષામાં સહાય કરે છે.

એમાં આઠ આસનો એવાં છે કે જે બધાં મર્મસ્થાનો ઉપર સારો પ્રભાવ પાડે છે. બીજાં બધાં આસનો કરતાં આ આસનો વધારે સરળ અને ઉપયોગી છે. આ પેકી જે જે આસનો તમને વિશેષ અનુકૂળ લાગે એવાં બેચાર અથવા વધારે પસંદ કરવાં અને ભોજનની પૂર્વે આસનક્ષયા પતાવી દેવી. ઉપાસના પછી જ આસનક્ષયા કરવી કે જેથી તીવ્ર રક્તસંચારથી આવેલી ચિત્તની ચંચળતા ધ્યાનમાં બાધક નીવડે નહીં.


## સર્વાંગાસન -

આસન ઉપર ચત્તા સૂઈ જવું અને શરીરને બિલકુલ શિથિલ બનાવી દેવું. હાથોને જમીન સાથે એવી રીતે રાખવા કે હેઠેળીઓ જમીન સાથે ચોટેલી રહે. હવે ધૂંટણો સીધા અક્ષણ રાખી બંને પગ જોડેલા રાખી ઉપર ઊચા કરવા અને ઝડપની માફક ઊભા કરવા. શરીરને પણ ઉઠાવવું અને પગને આગળ લઈ જઈ માથાની પદ્ધતિઓ જમીનને અડાવા. પગના પંજ જમીનને અડવા જોઈએ. પગ વાંકા થવા ન જોઈએ, પરંતુ બિલકુલ સીધા રહેવા જોઈએ. હાથને કમર પર મૂકવા અથવા જમીન પર રાખવા. ચિલુક ગળાને અડકાડિને રાખવી.

## બદ્ધપદ્માસન :

પદ્માસન વાળીને બેસવું. પછી બંને હાથ પીઠ પાછળ લઈ જઈ જમાણા હાથથી જમાણા પગનો અંગૂઠો પકડવો અને એ જ પ્રમાણે ડાબા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડવો. કમરને બિલકુલ સીધી રાખવી અને દિનાં નાકના અને ભાગ ઉપર સ્થિર રાખવી. હડપચીને ગળાની સાથે અડકેલી રાખવી. ધાળા માણસોના હાથ શરૂઆતમાં કમરની પાછળ થઈને પગનો અંગૂઠો પકડી શકતા નથી, કારણ કે એમની એ નસો જોઈએ ટેટલી શુદ્ધ અને પૂરેપૂરી વિકસિત નથી હોતી અને તેથી જ બંને પગના અંગૂઠા પકડવાની તાકાત ન આવે ત્યાં સુધી એક જ પગનો અંગૂઠો પકડીને સંતોષ માનવો અને આસ્તે અભ્યાસ વધારતા રહેવું.

## હાથ અને પગને મજબુત બનાવવાવાળા ચાર ઉપયોગી આસન



સ્વર્ગાસન



બદ્ધપદમાસન



પાદ હસ્તાસન



ઉત્કટાસન

આ આસનોને દરરોજ કરવાથી હાથ અને પગની નસો અને માસપેશીઓ મજબુત થાય છે અને તેની શક્તિ વધે છે.

## પીઠ અને પેટને મજબુત બનાવવાવાળા ચાર મહાપ્રભાવી આસન

આ આસનોનો અભ્યાસ કરતા રહેવાથી કમર, પાસળીયો, ફેફસાં, હદ્ય, પીતાશય, આંતરડાઓ અને કલેજાની નબળાઈઓ દૂર થઈ જાય છે.



પશ્ચિમોત્તાન આસન



મયુરાસન



સર્પાસન



ધનુરાસન

## પાદહસ્તાસન :

સીધા ઊભા રહી પછી ધીમે ધીમે હાથને નીચે જુકાવો. હાથને ધરિ ધરિ નીચે લઈ જઈને બંને પગના અંગૂઠા પકડો. બંને પગ જેઠેલા અને તદ્દન સીધા રાખવા. ધૂંટણો બિલકુલ સીધા રાખવા. ત્યાર બાદ માથું બંને હાથોની વચમાં લાવી નાક ધૂંટણોને અડકાડવું.

જમાણા હાથથી ડાબા પગનો અંગૂઠો અને ડાબા હાથથી જમાણા પગનો અંગૂઠો પકડીને પાગ આ આસન કરવું. આ આસન કરતી વખતે પેટને અંદરની બાજુ ખૂબ જોરથી બેંચવું.

## પશ્ચિમોત્તાનાસન :

બેસીને પગને લાંબા કરો. બંને પગ ભેગા રાખો. ધૂંટણો વાળવા નહીં, પગ બિલકુલ સીધા રાખવા. ત્યાર પછી કમરને જુકાવીને બંને હાથથી બંને પગના અંગૂઠા પકડવા. ધ્યાન રાખો કે પગ જમીનથી બિલકુલ ઊચા થવા ન જોઈએ. પગના અંગૂઠા પકડીને માથું ધૂંટણોની વચમાં રાખી એવો પ્રયત્ન કરવો કે માથું ધૂંટણ કરતાં પાગ નીચું રાખી શકાય.

બની શકે તો કોણીઓ જમીનને અડી શકે એવો પ્રયત્ન કરો. શરૂ શરૂમાં પગ લાંબાવી, ધૂંટણ સીધા રાખીને અને કમરને જુકાવીને અંગૂઠા પકડવાનો પ્રયત્ન કરવો જોઈએ.

## ઉત્કટાસન :

સીધા ઊભા રહો. બંને પગના ધૂંટણો, એડી અને પંજાઓ એકબીજાને અડકવાં જોઈએ. બંને હાથ કમર પર રાખો. પેટને થોડુંક અંદર બેંચો અને ધૂંટણોને વાળીને શરીર સીધું રાખીને ધીમે ધીમે પાછળથી જુકાવો. નેમ ખૂરથી પર બેઠા હો એ જ પ્રમાણે સ્થિતિ રાખો. જ્યારે કમર ધૂંટણોની સામે આવી જય તારે તમે સ્થિર થઈ જાઓ.

આ આસનનો સારો અભ્યાસ થઈ જય પછી એડીઓને પાગ જમીનથી ઊચે ઉઠાવી રાખો અને માત્ર પંજ ઉપર જ સ્થિર રહો.

## સપર્સન :

પેટને નીચે રાખી ઊધા સૂઈ જવું. પછી બંને હાથોના પંજ જમીન ઉપર ટેકવી હાથ સીધા કરવા. પંજને નાભિ પાસે રાખવા. આખું શરીર જમીનને અડકાડેલું રાખો. હવે અનુક્રમે માથું, તોક, ગળું, છાતી અને પેટ ધરિ ધરિ જમીનથી ઊચે ઉઠાવતા જવું અને શરીર નેટબું ઉપરની તરફ બેંચાય તેટબું ઊચે બેંચો. દાંસામે રાખવી, સાપની ફેણની માફક શરીરનો છાતી સુધીનો ભાગ જમીનથી ઊચો રાખો.

## ધનુરાસન :

આસન ઉપર ઊધા સૂઈ જવું. પછી બંને પગને ધૂંટણમાંથી વાકાં વાળીને પાછળની તરફ ઊચા કરવા અને હાથ પાછળ લઈ જઈને પગ પકડવા. હવે ધરિ ધરિ માથું અને છાતીને ઊચાં ઉઠાવવાં અને સાથે સાથે હાથ વે પગને ઉપર બેંચવાનો પ્રયત્ન કરવો. આગળ-પાછળથી શરીર એટલું ઊચું થાય કે નેથી આખરે પેટ અને પેદું જ જમીનને અડેલું રહે. આમ આખું શરીર ધનુષ આકારમાં ગોઠવાશે.

## મધૂરાસન :

ધૂંટણો ટેકવીને આસન ઉપર બેસી જવું. પછી બંને હાથ જમીન ઉપર સાધારણ અંતરે એવી રીતે રાખવા કે

પંજ અંદરના ભાગમાં રહે. હવે બંને પગને ઉઠાવી સીધા કરી પાછળ લઈ જઈ પંજ ઉપર ભાર દઈ હાથની બંને કોણીઓ નાભીની બંને તરફ લગાવી, છાતી, માથું અને પગને જમીનથી ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરવો.

જ્યારે પગ જમીન ઉપરથી ઉઠાવીને કોણીઓની સમાંતર આવી જય ત્યારે માથું અને છાતીને પાણ સીધાં કરી દેવાં. આખું શરીર હાથની કોણીઓ પર સીધું જમીનને સમાંતર અદ્ધર કરવું.

આ આઠ આસનો એવાં છે કે ને કષ્ટસાધ્ય નહીં હોવા છતાં મર્મ અને સંધિસ્થાનો ઉપર સારો પ્રભાવ પડી શકે છે. યોગશાલોમાં એમની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે.

આ બધાં આસનોથી ને લાભ થાય છે તે સર્વે લાભ એકમાત્ર સૂર્ય નમસ્કારથી પાણ થાય છે. સૂર્ય નમસ્કાર એ એક એવી કિયા છે, જેનાથી આ સર્વ આસનોના સધણા લાભ મળી શકે છે. એમનો એકબીજા સાથે એવો કમબદ્ધ સંબંધ છે કે અલગ અલગ આસનો કરવાને બદલે સૂર્ય નમસ્કારનું એક જ આસન કરવું વિશેષ લાભપ્રદ નીવડશે.

અમે ગાયત્રી સાધકોને ઘાગું કરીને પ્રાતઃકાળે સૂર્ય નમસ્કાર કરવાની જ સલાહ આપીએ છીએ. અમારા અનુભવે સૂર્ય નમસ્કારના લાભ ખૂબ મહત્વના છે. તે છતાં જેઓની ઈચ્છા હોય તે ઉપરોક્ત આઠ આસનો પાણ કરી શકે છે. એ પાણ એટલાં જ ફાયદાકારક છે.

## સૂર્ય નમસ્કારની વિધિ

પ્રાતઃકાળે સૂર્યોદય સમયે આ આસનની સાધના માટે તૈયાર થઈ જવું. એ વખતે ઢાંડી, ગરમી અથવા હવાનું પ્રમાણ વધારે હોય તો શરીર ઉપર હલકું કપડું પહેરી લેવું, નહીં તો સામાન્ય રીતે લંગોટ અથવા ચડી સિવાય બધાં જ કપડાં ઉતારી નાખવાં. ખુલ્લી હવામાં અથવા સ્વચ્છ, ખુલ્લી હવા આપતી ભારીઓવાળા ઓરડામાં કમર સીધી રાખી ઊભા રહો.

મુખ પૂર્વ બાજુએ રાખી નેત્ર બંધ કરીને બે હાથ જોડી ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન ધરવું અને ભાવના કરવી કે ‘સૂર્યનાં તેજસ્વી, આરોગ્યમય કિરાગો મારા શરીરમાં પ્રવેશ કરીને સર્વે અવયવોને આરોગ્ય આપી રહ્યાં છે’. આવી ભાવના કરીને નીચે લખેલી કિયાનો આરંભ કરવો :

(૧) બંને પગને સીધા રાખો. કમર સાથે ઉપરના ભાગને નીચે ઝુકાવો અને બંને હાથને જમીન પર ટેકવો. મસ્તકને ધૂટાગો સાથે અડકાડો. આ ‘હસ્તપાદાસન’ થયું.

(૨) મસ્તકને ધૂટાગોથી દૂર કરી લાંબો શ્વાસ લો. પ્રથમ જમાણા પગને પાછળ લઈ જાઓ અને તેનો પંજે જમીન પર ટેકવો. ડાબા પગને આગળથી વાળવો. બંને હથેળીઓ જમીનને અડકાવી રાખવી. દિન્દિ સામે રાખવી અને માથું થોડું ઊંચું રાખવું. આનાથી બંને અંગોને અને પેહુના ભાગને સારો વ્યાયામ મળશે. આને ‘એકપાદ પ્રસરણાસન’ કહે છે.

(૩) હવે ડાબા પગને પાણ પાછળ લઈ જાઓ. જમાણા પગથી ડાબા પગને જરા ધૂટો રાખો. કમરને જરા ઊચી ઉઠાવો. માથું અને મુખ થોડું નીચે ઝૂકી જશે.

આ ‘દ્વિપાદ પ્રસરણાસન’ થયું. આનાથી હથેળીઓની બધી નસોને, ભુજાઓને, પગની આંગળીઓને અને પગની પીડીઓને સારો વ્યાયામ મળે છે.

(૪) બંને પગના ધૂટાગો, બંને હાથ, છાતી અને મસ્તક એ બધાં અંગોને સીધાં રાખીને જમીન સાથે સ્પર્શ કરવો. શરીર કડક સીધું રાખો. સૂર્ય જવાની માફક નિશ્ચેષ ન થાઓ. પેટ જમીનને ના અડકાડો.

આને ‘અણંગ પ્રણિપાતાસન’ કહે છે. આનાથી બંને હાથ પાંસળીઓ, પેટ, ગરદન, ખભા અને હાથની જાત્રાની મહાવિશ્વાન - ભાગ-૩

પેશીઓને વ્યાયામ મળે છે.

(૫) હાથોને ઊભા સીધા કરો. છાતી ઉપર ઉઠાવો. કમરને જમીન તરફ જુકાવવી અને માણું ઊચું કરી આકાશ તરફ જોવું. ધૂંટાળોને જમીનથી અધર રાખવા. હાથના પંજાઓ ઉપર શરીર સીધું રાખવું. કમરને નેટલી વાંકી વાળી શકાય એટલી વાળવી.

આ સપર્સન થયું. આનાથી હદયને, આંતરડાંને તથા કંઠને સારો વ્યાયામ મળશે.

(૬) હાથ અને પગનાં તળિયાં જમીનને અડાડવાં. ધૂંટાળો અને કોણીઓને વાંકી વળવા ન દેવી. કમર નેટલી બને તેટલી જિંચી કરવી. દાઢી ગળાને અડકેલી રહે, માણું નીચું રહે.

આ 'મયૂરાસન' થયું. આનાથી ગરદાન, પીઠ, કમર, કુલા, પિંડી, પગ અને ભુજાઓને વ્યાયામ મળશે.

(૭) અહીંયાંથી હવે પહેલાં થ્યેલી ક્રિયાઓ તરફ પાછા ફરવાનું હોય છે. ડાબા પગને પાછળ રાખી જમાણા પગને આગળ વેવો. પૂર્વોક્ત નં. ૨ પ્રમાણે 'એકપાદ પ્રસરાણાસન' કરવું.

(૮) પૂર્વોક્ત નં. ૧ પ્રમાણે 'હસ્તપાદાસન' કરવું.

(૯) સીધા ઊભા રહેવું. બને હાથોને ઉપર આકાશ તરફ લઈ જઈ હાથ જોડવા. માથાને નેટલું પાછળ લઈ જવાય તેટલું લઈ જવું. હાથને પાણ નેટલા પાછળ લઈ જઈ શકાય તેટલા લઈ જવા, પાણ વાંક વળવા ન દેવા.

આ 'ઉદ્ધવ નમસ્કારાસન' થયું. આનાથી ફેફસાં અને હદયને સારો વ્યાયામ મળશે.

(૧૦) હવે આરંભિક સ્થિતિ પર આવી જવું. સીધા ઊભા રહીને હાથ જોડવા અને ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન ધરવું.

આ 'એક સૂર્ય નમસ્કાર' થયો. આરંભમાં પાંચથી શરૂઆત કરવી અને ધીરિ ધીરિ વધારતા જવું. વ્યાયામ દરમ્યાન મોં બંધ રાખવું જોઈએ અને શ્વાસોદ્ધિવાસ પાણ નાકથી જ થવો જોઈએ.

### તત્ત્વશુદ્ધિ

આ સૂચિ પાંચ તત્ત્વોની બનેલી છે. સર્વ પ્રાણીઓનાં શરીરો પાણ આ જ તત્ત્વોનાં બનેલાં છે. માટી, પાણી, હવા, તેજ અને આકાશ આ પાંચ તત્ત્વોનો જ આ સર્વ સંસાર છે. જે વસ્તુઓ દાખિથી દેખાય છે અને ઈન્દ્રિયોથી જે બીજી અનેક વસ્તુઓ અનુભવાય છે તે સર્વેની ઉત્પત્તિ આ પાંચ તત્ત્વોમાંથી જ થઈ છે. વસ્તુઓનું રૂપાંતર, ઉત્પત્તિ, વિકાસ અને વિનાશ એ સર્વે આ તત્ત્વોના ઓછાવતા પ્રમાણનું જ પરિણામ છે.

એ દેખીતી વાત છે કે આબોહવાની અસર શરીર પર પડે છે. કંડા દેશોના યુરોપિયન લોકોનાં રૂપ, રંગ, કદ અને સ્વાસ્થ્ય, આફિકાના ઉણશ પ્રદેશના લોકોનાં રૂપ, રંગ, કદ અને સ્વાસ્થ્યથી બિન્ન જ હોય છે. પંજાબી, કાશ્મીરી, બંગાળી, ગુજરાતી, મદ્રાસી લોકોનાં શરીર અને સ્વાસ્થ્યમાં પાણ લિબ્રતા જ જાગુણાશે. આ આબોહવાનું પરિણામ છે.

કોઈ કોઈ પ્રદેશમાં મેલેરિયા, પીળિયો તાવ, મરડો, હાથીપગો, કોઢ વગેરે રોગો મોટા પ્રમાણમાં હોય છે, જ્યારે કેટલેક ડેકાણેનાં હવાપાણી એવાં સારાં હોય છે કે જ્યાં જવાથી ક્ષય વગેરે કષ્ટસાધ્ય રોગો પાણ આપોઆપ મટી જાય છે. પશુ, પક્ષી, ધાસ, અન્ન, ફળ, ઔષધી વગેરેનાં રૂપ, રંગ, સ્વાસ્થ્ય, પ્રકૃતિ વગેરેમાં હવાપાણીના પ્રમાણમાં ફક્ત પડે છે અને એ જ પ્રમાણે વરસાદ, કંડી, ગરમી વગેરે તત્ત્વો પાણ પ્રાણીઓના શરીરમાં સૂક્ષ્મ પરિવર્તન કરે છે.

આયુર્વેદ શાસ્ત્રમાં કહું છે કે વાત, પિત અને કફનું વિષમ પ્રમાણ રોગોનું કારણ બને છે. વાતનો અર્થ વાયુ, પિતનો અર્થ છે ગરમી અને કફનો અર્થ છે જળ. પાંચે તત્ત્વો પૈકી પૃથ્વીતત્ત્વ શરીરનો સ્થિર આધાર છે. આ દેહ માટીનો બનેલો છે અને એ બજી જશે અથવા દટાઈ જશે ત્યારે પાછો માટીના રૂપમાં ફેરવાઈ જશે. આ પૃથ્વીતત્ત્વ શરીરનો મુખ્ય આધાર હોવાથી એ રોગનું કારણ બની શકતું નથી.

આકાશ તત્ત્વનો સંબંધ મન સાથે, બુદ્ધિ સાથે અને ઈન્દ્રિયોની તન્માત્રાઓ સાથે હોય છે. સ્થૂલ શરીર ઉપર જળ, વાયુ અને ગરમીનો પ્રભાવ પડે છે અને એ પ્રભાવના આધાર ઉપર જરૂર રોગ અને સ્વાસ્થ્યનો સંબંધ હોય છે.

વાયુ તત્ત્વના વધારે કે ઓછા પ્રમાણને લીધે સંવિવા, લક્વા, કંપ, શરીર જરૂર જરૂર જરૂર જરૂર, શીતળાનો તાવ, રક્તપિત્ત, કોલેરા, ક્ષય, દમ, ચાંદી, દાહ, રક્તવિકાર વગેરેનો ઉપદ્રવ થાય છે.

જળતત્ત્વની ન્યૂનાધિકતાથી જળોદર, મરડો, સંઘર્ષણી, બહુમૂત્રતા, પ્રમેહ, સ્વખાદોષ, પ્રદર, સળેખમ, ખાંસી વગેરે રોગ ઉત્પત્ત થાય છે.

અધ્યાત્મતત્ત્વની કમજેરીથી શરદી, શળેખમ, અપચો, શિથિલતા વગેરે રોગો થાય છે. આ જરૂર પ્રમાણે બીજાં તત્ત્વોના વધતા ઓછા પ્રમાણથી બીજા અનેક રોગ થાય છે.

આયુર્વેદના મત પ્રમાણે સ્થૂળ શરીરની સ્થિતિ તથા વિકૃતિ કરનારાં જે કોઈ ભારે પ્રભાવશાળી, ગતિશીલ અને સંકિય તત્ત્વો હોય તો તે વાત, પિત અને કદ અથર્ત્વ વાયુ, ગરમી અને જળ જરૂર હૈ. દૈનિક જીવનમાં પાણ જે કાંઈ વધધટ થાય છે તેનું મુખ્ય કારણ પાણ આ જરૂર તત્ત્વોની ન્યૂનાધિકતા જરૂર હૈ. એમ છતાં બાકી રહેલાં બે તત્ત્વો-પૃથ્વી અને આકાશનો શરીર ઉપરનો પ્રભાવ કોઈ રીતે ઓછો નથી જરૂર.

જડા અથવા પાતળા થવું, લાંબા અથવા ઢીગાળા થવું, રૂપવાન અથવા કુરૂપ થવું, ગોરા કે કાળા થવું એ પૃથ્વીતત્ત્વના પ્રમાણ ઉપર આધાર રાખે છે. ચતુરાઈ, મૂર્ખતા, સદાચાર, દુરાચાર, નીચતા, મહાનતા, તીવ્ર બુદ્ધિ, જિન્નતા, પ્રસ્ત્રતા તથા ગુણ, કાર્ય, સ્વભાવ, ઈચ્છા, આકાંક્ષા, ભાવના, આદર્શ, લક્ષ્ય વગેરે બાબતોનો આધાર શરીરમાં આકાશતત્ત્વ કેટલા પ્રમાણમાં છે તેના ઉપર છે.

ઉન્માદ, હદ્યના ધબકારા, અનિદ્રા, પાગલપાળું, દુષ્ટ સ્વખા, વાઈ, મૂછર્ણ, ગભરાટ, નિરાશા વગેરે રોગોમાં આકાશ- તત્ત્વ પ્રધાન કારણ રૂપ છે.

રસોઈના સ્વાદનો આધાર તેમાં નાખવામાં આવતી ચીજેના પ્રમાણ ઉપર રહે છે. ચોખા, દાળ, શીરો, રોટલી વગેરેને બનાવવામાં જેટલો અભિન જોઈએ તેનાથી વત્તો-ઓછો હોય તો તે ચીજે ખાવાલાયક રહેતી નથી. એ જરૂર પ્રમાણે પાણી, ખાંડ, ધી, મીહું વગેરેનું પ્રમાણ વત્તું-ઓછું થાય તો લોજનના સ્વાદ, રૂપ તથા ગુણમાં ધારૂણો જરૂર ફેરફાર પડી જાય છે.

આ જરૂર દશા શરીરની છે. તત્ત્વોની માત્રામાં ગરબડ થઈ જાય તો સ્વાસ્થ્ય પાણ બગડી જાય છે. જળ, વાયુ, ગરમી (અસ્તુ પ્રમાણે) વગેરેને લીધે રોગી મનુષ્ય નીરોગી થઈ જાય છે અને નીરોગી મનુષ્ય રોગિણ બને છે.

યોગના સાધકોએ જાણી લેવું જોઈએ કે આ પાંચ તત્ત્વોના બનેલા શરીરને સ્વસ્થ રાખવા માટે એ પાંચ તત્ત્વોને શરીરમાં સમાન અને સ્થિર રાખવાની ખાસ જરૂર છે. ગાયત્રીનાં પાંચ મુખ શરીરમાં પાંચ તત્ત્વો બનીને નિવાસ કરે છે. આ તત્ત્વો પાંચ જ્ઞાનેન્દ્રિયો તથા પાંચ કર્મન્દ્રિયોને કિયાશીલ રાખે છે. લાપરવાહી, અવ્યવસ્થા અને આહારવિહારનો અસંયમ તત્ત્વોની સમતુલ્યાને બગાડી નાંખે છે અને એના પરિણામે રોગઘર્સન થવું એ બીજું કાંઈ નહીં, પાણ પંચમુખી ગાયત્રીમાતાનો-દેહી પરમેશ્વરીનો તિરસ્કાર કરવા બરાબર છે.

વેદાંત શાસ્ત્રમાં આ પાંચ તત્ત્વોને આત્માનાં આવરણ અથવા બંધન માની લેવામાં આવ્યાં છે. ભગવાન ગાયત્રી મહાવિજ્ઞાન - ભાગ-૩

શંકરાચાર્યએ ‘તત્ત્વબોધ’ની સંકેત પિટિકામાં ‘પંચીકરણ વિદ્યા’ બતાવી છે. એમનું એમ રહેવું છે કે બંધનમાંથી મુક્તિ મેળવવા માટે પ્રથમ એ જાગ્રી લેવું જોઈએ કે આ સંસાર ભીજું કાંઈ જ નથી, તેવળ પંચભૂતોના પરમાણુઓનું અહીંથી તહીં ઉડતા રહેવું અથવા આપસમાં સંયોગ તથા વિયોગ થવો એ જ છે. જેમ કે વાયુથી ધ્કેલાતાં વાદળાં અહીં તહીં ફરતાં એના સંયોગ અને વિયોગથી આકાશમાં પરવત, રીછ, સિંહ, પક્ષી, ઘર, વૃક્ષ, ગુફા વગેરે વિવિધ પ્રકારના કુતૂહલપૂર્ણ વિચિત્ર આકારો રચે છે અને તે ક્ષાળે ક્ષાળે બદલાય છે, એ જ પ્રમાણે આ સંસારમાં જુદા જુદા પ્રકારનાં ચિત્રો બને છે, વિકાસ પામે છે અને લય પામતાં રહે છે.

નેવી રીતે વાદળાંથી બનેલાં ચિત્રો મિથા છે, ભ્રમ છે, સ્વપ્ન છે, મુગજળ છે, તેમ સંસાર પાણ માયા, ભ્રમ અથવા સ્વપ્ન છે. આ પાંચ ભૂતોના ભ્રમાણનો ખેલમાત્ર છે. એટલા જ માટે આ સંસારને લીલાધરની લીલા અથવા નટવરની કળા અથવા માયા કહી છે.

કેટલાક ટૂંકી દાણિવાળા લોકો સંસાર સ્વપ્ન છે એમ સાંભળતાની સાથે જ ગરમ થઈ જય છે અને વેદાંતશાસ્ત્ર પર એવો આરોપ મૂકે છે કે આવા વિચારોથી અકર્માયતા, નિરાશા, નિયુત્સાહ, અનિચ્છા વગેરે પેદા થાય છે અને સાંસારિક ઉત્ત્રતિની મહત્ત્વકાંકા શિથિલ થઈ જતાં આપણું રાણ્ણ અને સમાજ પાછળ પડી જશે, આ આક્રોપ બહુ છીછરો અને અવિવેકી છે.

વેદાંતના વિરોધીઓ એટલું તો સમજે છે કે અમારે મરવાનું છે અને મરતી વખતે કોઈ ચીજ સાથે આવતી નથી. આટલી વાત ચોક્કસ જાગ્રવા છતાં તેઓ સાંસારિક ઉત્ત્રતિની વાત છોડતા નથી. સ્વપ્નમાં પાણ બધાં કામ થતાં રહે છે અને એ જ પ્રકારે શરીરની બનાવટ પાણ થઈ છે. એમાં પેટની, ઈન્દ્રિયોની અને મનની ભૂખ પાણ એટલી તીવ્ર મૂકેલી છે કે કોઈ પાણ વક્તિ જાગુભર પાણ કર્તવ્ય-કર્મ સિવાય સુખચેનથી બેસી શકતી નથી. નિષ્ઠય વક્તિને માટે જીવનને ટકાવી રાખવાનું લગભગ અશક્ય છે.

આ સંસારની તાત્ત્વિક ચર્ચા કરતાં વેદાંત એમ બતાવવા માગે છે કે આ સંસાર પંચભૂતોના અસ્થિર પરમાણુઓનો સમૂહ માત્ર છે, જે સ્વપ્નવત્ત છે. એનો અર્થ એ થયો કે સાંસારિક વસ્તુઓનું ઉપાર્નન અને ઉપયોગ આભીય લાભને માટે જ થઈ શકે. વસ્તુઓના સૌંદર્ય ઉપર આસક્ત થઈ એના સંચય, સ્વામિત્વ અને અનિયંત્રિત ઉપભોગની મૃગતૃધણમાં આપણા આત્મિક હિતનું બલિદાન આપી શકાય નહીં.

કર્તવ્યશીલ રહેવું એ શરીરનો સ્વાભાવિક ધર્મ છે. એનો ત્યાગ કરવો એ કોઈપણ જીવિત વક્તિને માટે શક્ય નથી. આ સંસાર પંચભૂતોનું કીડાંગણ માત્ર છે. એ વેદાંતનું વિધાન સંપૂર્ણ રીતે વિજ્ઞાનસંમત છે. તત્ત્વજ્ઞની માફક વૈજ્ઞાનિકો પાણ એમ જ બતાવે છે કે જાગુ-પરમાણુઓનું શીધ ગતિથી પરિભ્રમાણ થવાના કારણે જ સંસાર ગતિશીલ છે અને આ પંચતત્વોથી બનેલા હજ જતિના પરમાણુઓ જ સંસારની અસંખ્ય વસ્તુઓ, દેહો અને યોનિઓના ઉત્પાદન તથા વિનાશનું કારણ છે.

‘પંચીકરણ વિદ્યા’ ના શિક્ષણ પ્રમાણે જ્યારે સાધક સારી રીતે એમ સમજી લે કે આ સંસાર અહીં તહીં ભટકતા પરમાણુઓના સંયોગ વિયોગથી જાગે જાગે નવી બનતી અને વિનાશ પામતી ચિત્રાવલી માત્ર છે, તો સંસાર પ્રત્યેનો એનો દાણિકોણ ભૌતિક ન રહેતાં આધ્યાત્મિક બની જશે. આ વસ્તુઓનો બિનજરૂરી મોહ તજી દેવાથી એની ભૂરાઈઓથી બચી જવાશે. નહિ તો લોભ અને મોહને ઉત્તેજન મળતાં વિવિધ પ્રકારનાં પાપ, તૃષ્ણા, દ્વેષ, શોક અને અભાવજન્ય કલેશોથી જીવન નરકમય થઈ જશે.

દેહ અને મનને આપણાં માનવાનું કોઈ કારણ નથી. આ જડ, નશ્વર, પરિવર્તનશીલ દેહ પાણ સંસારના બીજ પદાર્થોની જેમ જ પંચભૌતિક છે. એટલા માટે એને આપણા ઉપયોગની વસ્તુ, ઉધિયાર અથવા વાહન

# અનુક્રમણિકા

ગાયત્રી મહાવિજ્ઞાન ભાગ-૩

| ક્રમ | વિગત                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                           | પાના. નં. |
|------|--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|-----------|
| ૧.   | ગાયત્રીનાં પાંચ મુખ્ય<br>દેવતાઓનાં વધુ અંગોનું રહસ્ય : ગાયત્રીનાં પાંચ મુખ્યોથી પાંચ કોશોનો સંકેત                                                                                                                                                                                                                                                                                                                                                                              | ૩૨૬       |
| ૨.   | અનંત આનંદની સાધના                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                              | ૩૨૮       |
| ૩.   | ગાયત્રી મંજરી                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                  | ૩૩૧       |
| ૪.   | અવ્રમય કોશની સાધના<br><br>ઉપવાસ, આસન, સર્વાંગાસન, બદ્ધ-પદ્માસન, પાદહલ્સતાસન, યંશિમોત્તાનાસન,<br>ઉત્કટાસન, સપર્સિન, ધનુરાસન, મધુરાસન, સૂર્યનમસ્કાર વિધિ, તત્ત્વશુદ્ધિ, જળતત્ત્વ,<br>અભિતત્ત્વ, વાયુતત્ત્વ, પૃથ્વીતત્ત્વ, આકાશતત્ત્વ, તપશ્રયા                                                                                                                                                                                                                                    | ૩૩૬       |
| ૫.   | પ્રાગુમય કોશની સાધના<br><br>પ્રાગુક્રિયાની સુગમ કિયાઓ, ત્રણ બંધો, સાત મુદ્રાઓ, નવ પ્રાણાયામ.                                                                                                                                                                                                                                                                                                                                                                                   | ૩૪૮       |
| ૬.   | મનોમય કોશ<br><br>ધ્યાન, ત્રાટક, જયસાધના, તન્માત્રા સાધના, રસસાધના, ગંધસાધના, સ્પર્શસાધના                                                                                                                                                                                                                                                                                                                                                                                       | ૩૯૩       |
| ૭.   | વિજ્ઞાનમય કોશ<br><br>સોડહં સાધના, આત્માનુભૂતિયોગ, આત્મચિંતનની સાધના, બીજી સાધના, સ્વરયોગ,<br>સ્વર બદલવો, સ્વરસંયમી દીર્ଘજીવન, વિજ્ઞાનમયે કોશની વાયુસાધના, ગંધિલેદ                                                                                                                                                                                                                                                                                                              | ૩૮૦       |
| ૮.   | આનંદમય કોશ<br><br>નાદસાધના, બિંદુસાધના, કલાસાધના, પાંચ કળાઓની તાત્ત્વિક સાધના, તુરિયાવસ્થા.                                                                                                                                                                                                                                                                                                                                                                                    | ૪૦૪       |
| ૯.   | પંચકોશની સાધના સંબંધી જાળવા જોવું                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                              | ૪૧૯       |
| ૧૦.  | પંચમુખી સાધનાનો ઉદેશ<br><br>આત્મજ્ઞાન, આત્મદર્શન, આત્માનો અનુભવ, આત્મલાભ, આત્મકલ્યાણ.                                                                                                                                                                                                                                                                                                                                                                                          | ૪૨૪       |
| ૧૧.  | ગાયત્રીસાધના નિર્ણય જતી નથી.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                   | ૪૩૫       |
| ૧૨.  | ગાયત્રીનો તંત્રોક્ત વાસમાર્ગ                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                   | ૪૩૬       |
| ૧૩.  | અનાદિ ગુરુમંત્ર ગાયત્રી<br><br>સાચા શિક્ષાગની આવશ્યકતા, મનોભૂમિનું શુદ્ધિકરાગ, દૂષિત વાતાવરણનો પ્રભાવ, શિક્ષાગું<br>અને વિદ્યાનું મહત્ત્વ, ગાયત્રી દ્વારા દ્વિજત્વની પ્રાપ્તિ, ઉત્કીલન અથવા શાપમોચન, આત્મ-<br>કલ્યાણની ત્રણ કક્ષાઓ, પ્રથમ ભૂમિકા- મંત્રની દીક્ષા, દ્વિતીય ભૂમિકા-અભિદીક્ષા, ત્રીજી<br>ભૂમિકા-બ્રહ્મદીક્ષા, કલ્યાણ મંદિરનું પ્રવેશદ્વાર, તપસ્વીની ગુરુદ્વિક્ષાગા, બ્રહ્મદીક્ષાની<br>દક્ષિણા, ‘આત્મદાન’, ‘પરાવાણી’ દ્વારા આંતરિક પ્રેરણા, વર્તમાનકાળની મુશ્કેલીઓ | ૪૪૪       |

समज्ञने आनंदमयी ज्ञनयात्रा माटे उपर्योग तो करवो जेईभे, पाणि देह अथवा मननी आवश्यक तृषुणाओंनी पाठ्यण आत्माने नकामो डेरानन करवो आ मान्यताने हृष्यमां ऊडी उतारवा माटे शरीरनुं पृथक्कराग करतां ‘तत्वबोध’ मां बताववामां आव्युं छे के शरीरना क्या क्या भागो क्यां क्यां तत्वोथी बनेला छे.

पृथ्वीतत्वनी प्रधानताथी अस्थि, मांस, त्वचा, नाडी, रोम वगेरे बधा नक्कर पदार्थो बनेला छे. जगतत्वनी प्रधानताथी परसेवो, मूत्र, कह, रक्त, शुक्र वगेरे प्रवाही पदार्थो बने छे. तात्पर्य ऐ छे के शरीरमां जे कोई पाणि अंग, प्रत्यंग, पदार्थ तथा प्रेरणा थाप छे ऐ पंचतत्वोना आधार पर ज छोय छे.

आ पांच संसार आ प्रपञ्चरूप अने वार्णवाणा शरीरमांधी ‘अहं’ नी मान्यताने उडावी दृढ़ पोताने विश्ववापी चैतन्य आत्मामां विलीन करी देवानी दृढ़ मान्यता ए ज मुक्ति बनी जाय छे. शरीर अने संसारनी पंचभौतिक सत्ताने ज प्रपञ्च नामधी ओणभवामां आवे छे. वेदांतशास्त्रना योगमार्गनो ए ज आदेश छे के ‘हुं’ अने ‘मातुं’ नुं द्वेत छोडीने केवल ‘हुं’ नुं अद्वैत ज ग्रहण करो. आ विश्वमां जे कांઈ छे ते हुं आत्मा ज हुं. माराधी लिङ्ग ऐवुं कशुं ज नथी. आ ज मान्यता अद्वैत ब्रह्मने प्राप्त करावी आपशे.

आ ज वातने भक्तिमार्गी भीज शब्दमां कहे छे. “जे कांઈ छे ते ‘हुं’ छे. मातुं अलगपाणा जेवुं कशुं ज नथी.” आ बंने वातो-मान्यताओंनो बिलकुल एक ज अर्थ छे. भक्तिमार्ग अने वेदांत ए बंनेमां मात्र शब्दोना तक्षवत सिवाय बीजुं कशुं ज तात्त्विक अंतर नथी.

अन्नमय कोशनी शुद्धि माटे नीजे उपाय तत्वशुद्धि छे. स्थूल रूपमां शरीरनां पांच तत्त्वोने दीक राखवा माटे जग, वायु, ऋतु, प्रदेश अने वातावरणनुं ध्यान राख्युं ए खास जडेनुं छे. सूक्ष्म रूपथी पंचीकराग विद्या अनुसार तत्वशान प्राप्त करीने आत्म अने अनात्म तत्त्वोनो तक्षवत समज्ञने प्रपञ्चथी धृटकारो मेणववो जेईभे. तत्वशुद्धिनां बन्ने पासां महत्वपूर्ण छे. जेने पोतानो अन्नमय कोश दीक राखवो होय तेहो व्यावहारिक ज्ञनमां पंच तत्त्वोनी शुद्धि संबंधी वातो पर पाणि भराबर ध्यान आपवुं जेईभे.

## ४७४तत्त्व :

४७४थी शरीर अने वस्त्रोनी भराबर शुद्धि करता रहो. स्नान करवानो उदेश्य केवल शरीरनो भाव्य मेल दूर करवानो ज नथी, पाणि पाणीमां रहेली ‘विशिवा’ नामनी विद्युतधी देहने सेतोज करवानो छे. एटलुं ज नहीं, पाणि ओक्सिजनन अने नाईट्रोजनन जेवां बहुमूल्य तत्त्वो शरीरमां सीध्यावां ए पाणि छे. सवारे शौच जवाना पचीस-त्रीस मिनिट पहेलां एक ज्वास जेटलुं पाणी पीवुं जेईभे, जेथी रातनो अपचो धोवाई जाय अने शौच साझ आवे.

पाणी हमेशा धूंटडे धूंटडे आस्ते आस्ते दूधनी माफ्क पीवुं जेईभे. दरेक धूंटडा साथे ऐवी भावना करता जवुं के ‘आ अमृततुल्य जग्मां जे शीतणता, मधुरता अने शक्ति भरी छे एने जेंयीने हुं मारा शरीरमां धाराशुं करी रक्षो हुं.’ आवी भावना साथे पीवायेलुं पाणी दूधनी माफ्क गुणु करे छे.

जे स्थानोनुं पाणी भारे, क्षारवाणु, तेली अने छीछरां तणावोनुं तथा डानिकारक होय तां रहेवाथी अन्नमय कोशमां विकार पेदा थाप छे. केटलांक स्थलोनां पाणी ऐवां होय छे के ज्यां हाथीपगो, अंडवृद्धि, नासूर, जगोदर, कोठ, घंजवाण, मेवेरिया, नू, मच्छर वगेरेनो उपक्रम हमेशां चालु ज होय छे. ऐवां स्थानो छोडीने ज्यां सुपाच्य, स्वच्छ तथा हल्कुं पाणी सखेलाईथी मली शके ऐवी जग्याए निवास करवो जेईभे. पैसादार लोको दूरना स्थगेथी पाणि पोताना माटे उत्तम जग मंगावी शके छे.

कोई कोई वभत ऐनिमा द्वारा पेटमां जग चढावी आंतरडानी सङ्काइ करी लेवी जेईभे. आधी पेटमां संचित

થયેલા મળનું વિષ પેટમાંથી નીકળી જય છે અને ચિત્ત ધારું હલકું થઈ જય છે. પ્રાચીનકાળમાં બસ્તીક્રિયા એ યોગનું એક આવશ્યક અંગ ગણાતું હતું. હવે એ જ ક્રિયા એનિમા દ્વારા ધારી સુગમ રીતે થઈ શકે છે.

**જળચિકિત્સા** પદ્ધતિ રોગનિવારણ માટે તથા આરોગ્ય વધારવા માટે ધારી ઉપયોગી છે. ડૉ. લુઈફુનેએ આ વિજ્ઞાન ઉપર સ્વતંત્ર ગ્રંથ લખ્યો છે. એમાં બતાવેલી પદ્ધતિ પ્રમાણે કરવામાં આવતાં કટિસ્નાન, મેહન-સ્નાન, મેડુંડ-સ્નાન, ભીની ચાદરમાં લગેટાઈ જવું, કપડાની પઢીનું ખાસ્ટર વગેરે પ્રયોગ રોગનિવારણના કાર્યમાં ધારી જ સહાયતા કરે છે.

### અભિતત્ત્વ :

સૂર્યનાં પ્રકાશમાં વધારે સમય સુધી રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. ધરનાં બધાં બારીબારણાં ખુલ્લાં રાખવાનું જેથી ગરમી તથા હવાની સારી રીતે આવજ થઈ શકે. સવારનો તડકો ઉઘાડા શરીર પર લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. સૂર્યના તાપમાં તપાવેલા પાણીનો ઉપયોગ કરવો એ ભીના શરીર પર તડકો લેવા નેટલો ઉપયોગી છે.

સૂર્યનાં સપ્તવાર્ષ કિરણોમાં અલ્ટ્રાવાયોલેટ અને આલ્ફાવાયોલેટ કિરણો સ્વાસ્થ માટે ધારું જ ઉપયોગી સાબિત થયાં છે. તે જળનો સાથે તાપનું મિશ્રણ થવાથી બેંચાઈ આવે છે. રંગીન કાચની શીશીઓમાં પાણી, તેલ, દૂધ વગેરે ભરી તેને સૂર્યના તાપમાં રાખી સૂર્યશક્તિયુક્ત બનાવી તેની મારફતે સંપૂર્ણ રોગો સારા કરવાની ચિકિત્સા પદ્ધતિ મારા ‘સૂર્ય ચિકિત્સા વિજ્ઞાન’ પુસ્તકમાં વિસ્તારથી આપવામાં આવી છે. અભિ અને જળના સંમિશ્રણથી જે વરણ બને છે, તેના ઉપયોગી ધારણા રોગો મટી જય છે. “પંચ તત્ત્વોથી સંપૂર્ણ રોગચિકિત્સા” પુસ્તકમાં આની સર્વ વિધિ આપવામાં આવી છે.

રવિવારે ઉપવાસ રાખવાથી સૂર્યની તેજસ્વી અને બળદાયિની શક્તિનું આવાહન થાય છે. પૂરો અથવા અર્ધ ઉપવાસ પાણ શરીરની કાંતિ અને આત્મિક તેજ વધારવામાં ધારું ઉપયોગી નીવડે છે.

### વાયુતત્ત્વ :

ગીય વસ્તીવાળા મકાનનું વાતાવરણ ધૂળ અને ધુમાડાથી હંમેશાં ઘેરાયેલું રહેતું હોય અને ખુલ્લી શુદ્ધ હવાની આવજ ન્યાં બિલકુલ થતી ન હોય, એવા સ્થાનમાં નિવાસ કરવો એ આરોગ્ય માટે ભારે હાનિકારક છે. તમારો નિવાસ ખુલ્લી હવામાં હોવો જોઈએ. વૃક્ષો અને છોડવાઓ દિવસે ઓક્સિજન છોડે છે, તેથી એ મનુષ્યને ધારું ઉપયોગી છે. બની શકે ત્યાં સુધી વૃક્ષો અને છોડવાઓની વચ્ચે આપાણો દેનિક કાર્યક્રમ રાખવો જોઈએ. આપણા ધરાંગાંગણે અને ચબૂતરા ઉપર ફૂલજાડ રાખવાં જોઈએ.

પ્રભાતનો વાયુ સ્વાસ્થ્યપ્રદ હોય છે અને તેથી તેનું સેવન કરવા માટે સવારના પહોરમાં ખુલ્લામાં ઝડપથી ફરવાનું રાખવું. દુર્ગધવાળી અને બંધ હવાવાળી જળાઓની હવા જવર-તાવ પેદા કરનારી હોય છે. તેજ હવાના સુસવાટાથી ચામડી ફાટી જય છે. અધિક ઠંડી અથવા ગરમ હવાથી ન્યુમોનિયા અથવા લૂ વાગવાનો ભય રહે છે અને તેથી મોસમની પ્રતિકૂળ હવાથી હંમેશાં આપાણું રક્ષાણ કરતા રહેવું જોઈએ.

પ્રાગાયામથી ફેલાણનો વાયામ થાય છે અને શુદ્ધ વાયુથી રક્તની શુદ્ધિ થાય છે. એટલા માટે સ્વચ્છ હવાવાળી જળામાં બેસી નિય્ય પ્રાગાયામ કરવા જોઈએ. પ્રાગાયામની વિધિ પ્રાણમય કોશનાના પ્રકરણમાં વખવામાં આવશે.

હવન કરવો એ અભિતત્ત્વના સંયોગથી વાયુને શુદ્ધ કરવાની ક્રિયા છે. જે વસ્તુ અભિમાં બળી ગઈ તે નષ્ટ થતી નથી, પાણ સૂક્ષ્મ બનીને વાયુમંડળમાં ફેલાઈ જય છે. લિન્ન લિન્ન વૃક્ષોની સમિધાઓ તથા હવનસામગ્રીઓમાં આવશે.

અલગ અલગ ગુણો હોય છે. એમની મારફતે એવું વાયુમંડળ રચાય છે જે શરીર અને મનને સ્વસ્થ બનાવવામાં ધારું ઉપયોગી બને છે. કઈ સત્ત્વિધા કઈ હવનસામગ્રી સાથે, કેવા વિધાનથી હવન કરવામાં આવે તો શું શું પરિણામ આવે છે એનું વિસ્તૃત વર્ણન કરવા એક સ્વતંત્ર પુસ્તક લખવાનો વિચાર છે.

ગાયત્રી સાધકોએ તો પોતાના અત્રમય તોશની વાયુશુદ્ધિ માટે હવનસામગ્રી બનાવીને રાખી લેવી જોઈએ. જે ધૂપદાનીમાં દરરોજ થોડી થોડી સણગાવીને પોતાના નિવાસસ્થાનનો વાયુ શુદ્ધ કરતા રહેવું.

ચંદનનો ભૂકો, દેવદાર, જયફળ, એલચી, જવંતી, અગર-તગર, કપૂર, નાગરમોથ, ખસ, કપૂરકાચલી તથા મેવોઓને ખાંડીને થોડું ધી તથા સાકર મેળવીને ધૂપ બનાવવો. આવા ધૂપની સુગંધ ધારી મનમોહક અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. બજરમાંથી કોઈ સારી અગરબત્તી અથવા ધૂપબત્તી લાવીને પણ કામ ચલાવી શકાય છે. સાધનાકાળમાં સુગંધ માટે આવી કોઈ વ્યવસ્થા કરી લેવી એ ઉત્તમ છે.

મોંઢાથી કદ્દી શ્વાસ લેવો નહીં. નાક વડે જ હંમેશાં શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરવી. ચાદરથી મોંઢું ઢાંકી કદી સૂવું નહીં. આપણું મોંઢું બીજના મોંઢાની એટલું પાસે ન લઈ જવું કે જેથી તેનો ઉચ્છ્વાસ આપણા અંગમાં જાય. ધૂળ, ધૂમાડો, દુર્ગંધ તથા અશુદ્ધ વાયુથી હંમેશાં દૂર રહેવું,

## પૃથ્વીતત્ત્વ :

શુદ્ધ માટીમાં વિષ નિવારણની અદ્ભુત શક્તિ હોય છે. ગંદા હાથ માટીથી ધોવાથી શુદ્ધ થાય છે. પ્રાચીનકાળમાં જ્યાંઘિમુનિઓ જમીન ખોદી ગુફા બનાવી રેમાં રહેતા. એની એમના સ્વાસ્થ્ય ઉપર ધારી સારી અસર પડતી હતી.

માટી એમના શરીરના દૂષિત વિકારોને ખેંચી લેતી હતી. સાથે સાથે ભૂમિમાંથી નીકળતી બાષ્પ (ઉધા) દ્વારા એમના દેહનું પોષણ થતું હતું. સમાધિ લગાવવા માટે ગુફાઓ ધારું સુંદર કામ આપતી, કેમકે ચારે બાજુ માટી હોવાથી શ્વાસ મારફતે ધારો આહાર મળી જતો હતો અને કેટલાયે દિવસો સુધી બોજનની જરૂર જ નહોતી પડતી અથવા અદ્ય ભોજનથી ચાલતું હતું.

નાનું બાળક પ્રકૃતિની ધારું નજીક છે. તે પૃથ્વીનું મહત્ત્વ સારી રીતે જાળે છે. ગાદીતકિયા કરતાં ભૂમિ પર રમવું અને ભૂમિ પર સૂવું એ વધારે પસંદ કરશે. પશુઓ પોતાનો થાક ઉતારવા માટે જમીન પર આળોટે છે અને એમ કરીને પૃથ્વીની પોષણશક્તિથી ફરી તાજળી મેળવે છે. તીર્થયાત્રા અથવા ધર્મકાર્યોમાં ઉધાડા પગે ચાલવાનું વિધાન હોય છે. તપસ્વીઓ ભૂમિ ઉપર શયન કરે છે.

આવી પ્રથાઓનો ઉદ્દેશ ધર્મસાધનાના નામે સાધકોને પૃથ્વીની પોષણશક્તિનો લાભ મેળવી આપવાનો હોય છે. પાકાં મકાનોમાં રહેનારાઓ કરતાં માટીનાં ઝૂંપડાંમાં રહેનારાઓનું આરોગ્ય હંમેશાં વધારે સારું હોય છે.

માટીના ઉપયોગ મારફતે આરોગ્ય સુધારણામાં આપણને ધારી સહાય મળે છે. નિર્દોષ પવિત્ર ભૂમિ પર ઉધાડા પગે ચાલવું જોઈએ. જ્યાં થોડું થોડું લીલું ધાસ ઊંઘું હોય તાં ચાલવું સર્વથી ઉત્તમ છે.

પહેલવાન લોકો, પછી એ ગમે તેવા અમીર કેમ ન હોય, ઇની ગાદી ઉપર કસરત કરવાને બદલે ખાસ સુંવાળી માટીનો અખાડો જ વાયામ માટે પસંદ કરશે, કેમકે માટીના અમૂલ્ય ગુણોનો લાભ એમના શરીરને મળે છે. સાખુની જયાએ મુલતાની માટીનો ઉપયોગ કરી શકાય છે. એથી મેલ દૂર થશે, વિષ બહાર નીકળશે અને ચામડી કોમળા, તાજી, ચમકવાળી બનશે અને મનને પ્રકૃતિષ્ઠાન કરી દેશે.

શરીર માટી ચોળીને સ્નાન કરવું એ સુંદર પ્રયોગ છે. એનાથી જરૂરીના દિવસોમાં અળાઈએ દૂર થાય છે.

માથાના વાળને મૂલતાની માર્ટીથી ધોવાનો રિવાજ હજુ સુધી ચાલુ છે. એનાથી માથાનો મેલ દૂર થાય છે, ખોડો થતો બંધ થાય છે. વાળ કાળા અને સુંવાળા રહે છે તથા મગજમાં ધારી શાંતિ રહે છે. હાથ ધોવા તથા સાફ કરવા તથા વાસણ માંજવા માટે માર્ટી જેવી સારી બીજી કોઈ ચીજી નથી.

ચાંદાં તથા ગુમડાં, દાદર, ખંજવાળ, સંઘિવા, એરી જાનવરોનું કરડવું, સોજે, જખમ, નાસૂર, આંખો દુખવી, કોઢ, ચાંદી, રસ્તાવિકાર વગેરે અનેક રોગો ઉપર ભીની માર્ટીનો લેપ કરવાથી આશ્રમજનક લાભ થાય છે. ડૉ. હૃદી કુનેએ પોતાની જણાચિકિત્સામાં માર્ટીની પહીના અનેક ઉપચાર લખ્યા છે. ચૂલામાંની બળેલી માર્ટીથી દાંત સાફ કરવા, નાકના રોગોમાં માર્ટીના ઢગલા ઉપર પાણી નાખી સુંધવું, લૂલાગવામાં પગ ઉપર માર્ટીનો લેપ લગાવવાની વિધિ વગેરે વાતોથી બધા પરિચિત છે.

કોઈ સ્થળે ધાળા વખત સુધી મળમૂત્ર થતાં રહે, પછી ત્યાં નાખવાનું બંધ કરવામાં આવે તો પણ ત્યાં લાંબા વખત સુધી દુર્ગંધ ફેલાયેલી રહે છે, કારણ કે ભૂમિમાં શોષણાશજિત છે. તે પદાર્થોને શોષી શકે છે અને તેના ગુણ અથવા અવગુણ લાંબો વખત સુધી ધારણ કરી શકે છે.

પૃથ્વીની સૂક્ષ્મ શક્તિ લોકોના સૂક્ષ્મ વિચારો અથવા ગુણોને પણ આકર્ષી પોતાનામાં ધારણ કરી વે છે. ને સ્થાન પર હત્યા, વ્યભિચાર, જુગાર, મધ્યપાન વગેરે દુષ્કર્મ થતાં હોય એવી જગ્યાઓનું વાતાવરણ એટલું ધાતક હોય છે કે ત્યાં જનારાઓ ઉપર એનો પ્રભાવ પડ્યા સિવાય રહેતો નથી.

સમશાનભૂમિમાં જ્યાં અનેક મૃત શરીર નષ્ટ થાય છે ત્યાં એક જતની ભયકરતા આવી જય છે. ત્યાં જનારા પર એક જતનો વિલક્ષણ પ્રભાવ પડે છે. કેટલીક તાંત્રિક સાધનાઓ તો એવી છે કે ને સમશાનભૂમિનું વાતાવરણ જ તૈયાર કરે છે.

ભૂમિગત પ્રભાવનો ગાયત્રી સાધકોએ લાભ ઉઠાવવો જોઈએ. જ્યાં સંતપુરુષો રહેતા હોય, જ્યાં સ્વાધ્યાય, સદ્વિચાર, સત્કાર્ય થતાં હોય એવાં સ્થાન પ્રત્યક્ષ તીર્થ છે. એ સ્થાનોનું વાતાવરણ સાધકની સફળતા માટે ધાર્યું લાભદાયક છે. ને સ્થાનો ઉપર કોઈ સમયે કોઈ અવતારી અથવા દિવ્યપુરુષ રહ્યા હોય એવાં સ્થાનોની પ્રભાવશજિતનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને તીર્થ બનાવાયાં હોય છે. જ્યાં કોઈ સિદ્ધપુરુષ અથવા તપસ્વી ધાળા કાળ સુધી રહ્યા હોય તે સ્થાન સિદ્ધપીઠ બની જય છે અને ત્યાં રહેનારાઓ ઉપર અનાયાસે તેનો પ્રભાવ પડે છે.

સૂક્ષ્મદર્શી મહાત્માઓએ જેયું છે કે ભગવાન શ્રીકૃષ્ણના પ્રત્યક્ષ લીલાતરંગો પ્રનભૂમિમાં ધારી પ્રભાવપૂર્ણ સ્થિતિમાં હજુ પણ મોજૂદ છે.

કેટલાયે મુમુક્ષુઓ પોતાની આત્મિક શાંતિને માટે આ પુણ્યભૂમિમાં સ્થાયી અથવા અલ્પકાલીન નિવાસ માટે વ્યવસ્થા કરે છે, કેમકે કલેશયુક્ત વાતાવરણવાળાં સ્થાનોમાં નેટલા શ્રમથી, નેટલા સમયમાં નેટલી સફળતા મળે છે એના કરતાં આવી પુણ્યભૂમિના વાતાવરણમાં બહુ જ જલદીથી ધારો વધારે લાભ મળી શકે છે. તીર્થસ્થાનોમાં ઉધાડા પગે ભ્રમાણ કરવાનું માહાત્મ્ય એટલા જ માટે હોય છે કે એ સ્થાનોના પુણ્યતરંગો આપણા શરીરની સાથે પ્રત્યક્ષ સ્પર્શ કરીને આત્મશાંતિ પ્રદાન કરવામાં સહાયભૂત થાય છે.

### આકાશતત્ત્વ :

પાછલાં ચાર તત્ત્વો કરતાં આકાશતત્ત્વ વધારે સૂક્ષ્મ હોવાથી અધિક શક્તિશાળી છે. વિશ્વવ્યાપી પોલાણના શૂન્યાવકાશમાં એક શક્તિતત્ત્વ ભરેલું છે, નેને અંગ્રેજીમાં “દીથર” કહે છે. પોલાણવાળી કોઈપણ જગ્યાને ખાલી સમજવી નહીં. તે વાયુથી પણ અધિક સૂક્ષ્મ હોવાથી પ્રત્યક્ષ રૂપમાં એનો અનુભવ થતો નથી, તેમ છતાં એનું અસ્તિત્વ સંપૂર્ણ રીતે સાબિત થયું છે.

રેઝિયો માર્કટે ગાયન, સમાચાર, ભાષણ વગેરે સંભળાય છે એ ઈથરમાં, આકાશતત્વમાં તરંગોના રૂપમાં આવે છે. જે પ્રમાણે પાણીમાં પથરો ફેંકવાથી એમાં લહેરો પેદા થાય છે અને આ લહેરો જળશયના બીજા છેડા ચુંધી પહોંચી જય છે, તે પ્રમાણે ઈથરમાં શબ્દના તરંગો પેદા થાય છે અને તે પલકવારમાં વિશ્વભરમાં ફેલાઈ જય છે. આ જ વિજ્ઞાનના આધાર પર રેઝિયોયંત્રની શોધ થઈ છે.

એક સ્થાન પર શબ્દતરંગોની સાથે વીજળીની શક્તિ મેળવીને એમને વધારે બળવાન કરીને પ્રવાહિત કરવામાં આવે છે. બીજાં સ્થાનો પર ન્યાં રેઝિયોયંત્ર લગાડ્યું હોય ત્યાં આકાશમાં વહેતા તરંગોને પકડી લેવામાં આવતાં મોકલેલો સંદેશો સંભળાય છે.

વાણીના ચાર પ્રકાર હોય છે:

(૧) વૈખરી :- જે મોટેથી બોલાય છે અને કાનથી સાંભળવામાં આવે છે, જેને શબ્દ કહેવામાં આવે છે.

(૨) મધ્યમા :- જે સંકેતથી, મુખાકૃતિના ભાવથી, ભાવભંગથી, નેત્રોથી સમજાય છે તે, જેને 'ભાવ' કહેવામાં આવે છે.

(૩) પશ્યન્તિ :- જે મનમાંથી નિકળે છે અને મનથી જ સંભળાય છે, જેને 'વિચાર' કહેવામાં આવે છે.

(૪) પરા :- જે આકાંક્ષા, ઈચ્છા, નિશ્ચય, પ્રેરણા, શાપ, વરદાન આદિના રૂપમાં અંત:કરાગમાંથી નિકળે છે. એને 'સંકલ્પ' કહે છે.

આ ચારે પ્રકારની વાણીઓ આકાશમાં તરંગરૂપે પ્રવાહિત થાય છે. જે વ્યક્તિ નેટલી પ્રભાવશાળી હોય તેના પ્રમાણમાં જ તેના શબ્દ, ભાવ, વિચાર અને સંકલ્પ પ્રબળ બનીને પ્રવાહિત થાય છે.

આકાશમાં અસંખ્ય પ્રકૃતિની અસંખ્ય વ્યક્તિઓ દ્વારા અસંખ્ય પ્રકારની સ્થૂળ અને સૂક્ષ્મ શબ્દાવલી પ્રેરિત થતી રહે છે. આપણું મન જે કેન્દ્ર ઉપર સ્થિર થાય છે, તે જ જતના અસંખ્ય પ્રકારના વિચારો આપણા મગજમાં ધૂસી જય છે અને અદશ્ય રૂપમાં પોતાના પૂર્વ નિર્ધારિત વિચારોને પુષ્ટિ આપવાનો આરંભ કરી ટે છે. જે આપણો વિચાર વ્યભિચાર કરવાનો હોય તો અસંખ્ય વ્યભિચારીઓ દ્વારા આકાશમાં પ્રેરિત કરેલા એવા જ પ્રકારના શબ્દ, ભાવ, વિચાર અને સંકલ્પ આપણા ઉપર વરસી પડે છે અને એને ઉત્તેજન આપી, માર્ગદર્શન આપી એ કાર્ય કરવા ઉત્સાહિત કરે છે.

આપણા સ્વનિર્ભિત વિચારોમાં એક પ્રકારનું માલિક આકર્ષણ હોય છે. એ વિચારો એ જ જતના આકાશગામી વિચારોને આપણા તરફ બેંચે છે. રેઝિયોમાં જે સ્ટેશનના મીટર ઉપર કંટો મૂકવામાં આવે તે જ જ જ્યાનો સંદેશ સંભળાય છે. એ જ વખતે બીજું સ્ટેશન સંદેશ મોકલતું હોય તો તેની વાણી આપણે સાંભળી શકતા નથી. આ જ રીતે આપણા પોતાના સ્વનિર્ભિત મૌલિક વિચારો પણ પોતાની જ જતિના વિચારોને આકર્ષે છે.

મહદાને જોઈને એક કાગડો કા કા કરે છે, તો તેનો અવાજ સાંભળીને બીજા અનેક કાગડાઓ ત્યાં ભેગા થાય છે. એ જ પ્રમાણે આપણો પોતાનો એક વિચાર એ જ જતના અનેક વિચારોને બેંચે લાવે છે અને એ રીતે એક ખારસી નાની સરખી રેના ત્યાં જમા થઈ જય છે. પછી સૈન્યની પ્રબળતાના આધારે એ વિચારની દિશામાં કાર્યનો પણ આરંભ થઈ જય છે.

આકાશતત્વની આ વિલક્ષણતાને ધ્યાનમાં લઈને કાતિલ જેવાળા સર્પની માફક વિચારોથી બહુ જ સાવધાન રહેવું જોઈએ. નહીં તો એવો એક જ કુવિચાર પોતાના અનેક નાતભાઈઓને બોલાવીને આપણા માથે એક ખારસી

મોટી આફ્ત ઊભી કરી દેશે. જે કોઈ પણ કુવિચાર મનમાં આવે તો, નેવી રીતે એરનું એક ટીપું આખા ભોજનને બગાડી નાખે છે, તેવી જ રીતે એ આખા માનસક્રિયાને ખરાબ કરી નાખશે.

હંમેશાં ઉત્તમ, ઉદાર અને સાત્ત્વિક વિચારોને જ મનમાં સ્થાન આપવું કે નેથી અખિલ આકાશમાંથી એ જ પ્રકારના વિચારો ખેંચાઈને આપણા તરફ આવે અને આપણને સન્માર્ગ તરફ પ્રેરે. ઉત્તમ વાતોનું મનન, સ્વાધ્યાય, આત્મચિંતન, પરમાર્થ અને ઉપાસનામય મનોભૂમિ આપણું ધારું જ કલ્યાણ કરી શકે છે. પ્રતિકૂળ કાર્યોન થાય તો એકલા ઉચ્ચ વિચારોથી પણ સદ્ગતિ થાય છે, પછી ભલેને એવા વિચારોને અનુરૂપ કાર્ય ન પણ થાય.

સંકલ્પ કદ્દી નષ્ટ થતા નથી. પૂર્વકાળમાં ઝીષિમુનિઓના અને મહાપુરુષોના જે વિચાર, પ્રવચન અને સંકલ્પ હતા, તે હજુ પણ આકાશમાં ગૂંજા કરે છે. જે આપણી મનોભૂમિ અનુકૂળ હોય તો એ દિવ્ય મહાત્માઓનું માર્ગદર્શન અને સહાય આપણને મળ્યા સિવાય નહીં રહે.

પરમાત્મા તરફની દિવ્ય પ્રેરણા, શક્તિઓ, કિરણો અને તરંગો પણ આકાશ દ્વારા માનવના અંત:કરણને પ્રાપ્ત થાય છે. દિવ્ય શક્તિઓ એ બીજું કંઈ જ નહીં, ઈશ્વરના વિવિધ ગુણોવાળાં કિરણો માત્ર છે, જે આકાશમાંથી મનરૂપી માધ્યમ દ્વારા નીચે ઉત્તરે છે.

શિવજીએ આકાશવાહિની ગંગાને પોતાના મસ્તક ઉપર ઝીલ્યાં હતાં અને ત્યાંથી પછી પૃથ્વી ઉપર ઉતાર્યા હતાં, બ્રહ્મની સર્વ પ્રધાન દિવ્યશક્તિ આકાશવાહિની ગાયત્રી રૂપી ગંગાને સાધક સૌપ્રથમ પોતાના મન:ક્ષેત્રમાં ઉતારે છે. આ અવતરણ થયા પછી જીવનના બીજા અવયવોમાં પણ પતિતપાવની પુણ્યધારાનો પ્રવાહ વહેતો થાય છે.

શરીરમાં મન અથવા મસ્તિષ્ક આકાશનું પ્રતિનિધિ છે. આકાશગામી પરમ કલ્યાણકારક તત્ત્વોનું અવતરણ મનમાં જ થાય છે. એટલા જ માટે સાધકે પોતાની મનોભૂમિ એવી શુદ્ધ, પરિમાર્નિત, સ્વસ્થ અને સતેજ રાખવી જોઈએ કે નેથી ગાયત્રીનું અવતરણ બહુ સહેલાઈથી થઈ શકે.

## તપશ્ચય

તપનો અર્થ છે - ઉણુતા, ગતિ, કિયાશીલતા, ધર્ષણ, સંધર્ષ, તિતિક્ષા, કષ સહેવું વગેરે. કોઈ પણ વસ્તુને નિર્દોષ, પવિત્ર અને લાભદાયક બનાવવી હોઈ તો એને તપાવવી જોઈએ. સોનું તપાવવાથી શુદ્ધ થાય છે. તોકુર પ્રથમ પોતાનાં ઓજારોને ગરમ કરી કે છે અને પછી જ ઓપરેશન કરે છે. ચાપુને સરાણ પર ચઢાવીને ઘસવામાં ન આવે તો એ કાપવાની શક્તિ ગુમાવી બેસે છે. હીરાને પહેલ પાડવામાં ન આવે તો એની ચમક અને સુંદરતા નષ્ટ થાય છે.

વાયામનો કષ્ટસાધ્ય શ્રમ કર્યા સિવાય કોઈ માણસ પહેલવાન થતો નથી. અધ્યયનની કઠોર સાધના કર્યા વિના કોઈ માણસ વિકાન થતો નથી. માતા બાળકને ગર્ભમાં રાખીને એના પાલનપોષણનું કષ સહન ન કરે તો માતૃત્વનું સુખ મેળવી શકે નહીં. કોઈમાં બંધ રાખવામાં આવેલ અનાજને તરફે નાખવામાં ન આવે તો તેની અંદર નંતુ પડી જશે. ઈટને ભફીમાં નાખી તપાવવામાં ન આવે તો એને મજબૂતી નહીં મળે.

પ્રાચીનકાળમાં પાર્વતીએ તપ કરીને મનવાંછિત ફળ મેળવું હતું. ભગીરથે તપ કરીને ગંગામૈયાને ભૂલોકમાં બોલાવ્યાં હતાં. ધ્રુવજીએ તપથી ભગવાનને પ્રસન્ન કર્યા હતા. તપસ્વીઓ કઠોર તપશ્ચય કરીને ઈચ્છિત સિદ્ધિઓ પ્રાપ્ત કરતા હતા. રાવણા, કુંભકરણ, મેઘનાદ, હિરણ્યકશ્યપ, ભસ્માસુર વગેરે એ તપના પ્રભાવથી વિલક્ષણ વરદાન મેળવ્યાં હતાં. આને પણ નેને જે કાંઈ પ્રાપ્ત થાય છે તે તપના પ્રભાવથી જ પ્રાપ્ત થાય છે.

ઇશ્વર તપસ્વી ઉપર પ્રસત્ર થાય છે અને તેને જ ઈચ્છિત આશીર્વાદ આપે છે. જે ધનવાન, સંપત્ર, સમૃદ્ધ, સુંદર, સ્વસ્થ, વિજ્ઞાન, પ્રતિભાશાળી, નેતા અથવા અધિકારીના સ્વરૂપમાં ચમકી રહ્યો હોય એની ચમકનો આધાર એનું વર્તમાન અથવા ભૂતકાળનું તપ જ હોય છે. જે એ નવું તપ નહીં કરે ને જૂની તપશ્ચયાની પૂજા પૂરી કરી નાંબે તો ત્યાર પછી એની ચમક ઝાંખી પડી જશે.

જે લોકો આને પતનની ખાઈમાં પડી રહ્યા છે તેઓની ઉત્ત્રતિ માટે તપ એ જ એક માર્ગ છે. સાંસારિક અથવા આત્મિક એવી કોઈ પાણ સિદ્ધિકે સફળતા તપ સિવાય મળી શકતી નથી. કલ્યાણરૂપી ચાવી તપની તિજેરીમાં રાખી મુકેલી છે. જે એ તિજેરીને ખોલશે તેને ઈચ્છિત વસ્તુ મળશે.

બંને હ્યેણી ધસવાથી ગરમ થાય છે. બે લાકડાંને ધસવાથી અગ્નિ પેદા થાય છે. ગતિ, ઉષગતા, કિયા, તેજ વગેરે ધસવાનાં પરિણામો છે. મશીનને ચલાવવા માટે એના કોઈ પાણ ભાગને ધક્કો મારવો પડશે, નહીં તો કિમતીમાં કિમતી મશીન પાણ બંધ પડી જશે.

શરીરને અટકો લગાવવા માટે વ્યાયામ અથવા પરિશ્રમ કરવાની જરૂર છે. આત્મામાં ચૈતન્ય, તેજસ્વિતા, સ્ફૂર્તિ અને સામર્થ્ય ઉત્પત્ત કરવા માટે તપ કરવાની જરૂર છે. વાસણ માંજ્યા સિવાય અને મકાનની સફાઈ કર્યા સિવાય અશુદ્ધ અને મલિનતા પેદા થઈ જાય છે. તપશ્ચયાની છોડી દેવાથી આત્મા પાણ અશક્ત, નિસ્તેજ અને વિકારગ્રસ્ત બની જાય છે. આગસ્તું અને આરામપ્રિય શરીરમાં અત્રમય કોશનું આરોગ્ય સ્થિર રહી શકતું નથી.

પ્રાચીનકાળમાં તપશ્ચયાને ધાર્યું મહત્વ આપવામાં આવતું હતું. જે વ્યક્તિ નેટલી પરાકર્મી, કષ્ટસહિષ્ણુ, સાહસિક, પુરુષાધી અને ક્રિયાશીલ હતી એટલી વધારે એની પ્રતિષ્ઠા હતી. ધનવાન, અમીર, રાજ અને મહારાજાઓ સર્વના બાળકોને ગુરુકુળમાં મોકલવામાં આવતા હતા કે નેથી કઠોર જીવનનું અને તપશ્ચયાનનું શિક્ષાણ પ્રાપ્ત કરીને પોતાને એટલા ખડતલ બનાવી લે કે વાસ્તવિક જીવનમાં મુકેલીઓનો સફળ રીતે સામનો કરવાની તાકાત આવે અને સંપત્તિ પ્રાપ્ત કરવાને શક્તિમાન થાય. આને તપનું અને કષ્ટસહિષ્ણુતાનું મહત્વ લોકો ભૂલી ગયા છે અને આરામપ્રિયતા, આગસ્ત અને નાજુકતાને અમીરીનાં લક્ષ્યાણ માનવા લાગ્યા છે. પરિણામે પુરુષાર્થ ઘટતો જાય છે અને યોગ્યતા દ્વારા ઉપાર્નન કરવાને બદલે છણકપટ અને અન્યાય દ્વારા ઉપર ચઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

ગાયત્રી સાધકોએ તપસ્વી બનવું જોઈએ. અસ્વાદવ્રત, ઉપવાસ, જીતુપ્રભાવોને સહેવાની તાકાત, તિતિક્ષા, કર્ષણ, આત્મકલ્પ, પ્રદાતવ્ય, નિષ્કાસન, બ્રહ્મચર્ય, ચાંદ્રાયાણ, મૌન, અર્નન વગેરે તપશ્ચયાનોની વિધિ ‘ગાયત્રી મહાવિજ્ઞાન’ના પ્રથમ ખંડમાં સવિસ્તાર આપવામાં આવી છે. એની પુનરુક્તિ જરૂરી નથી. અહીં તો એટલું કહેવું બસ થશે કે અત્રમય કોશ સ્વસ્થ રાખવો હોય તો શરીર અને મનને કાર્યક્રમ રાખવાં જોઈએ. શ્રમ, કર્ત્વપરાયાણતા, જગૃતિ અને પુરુષાર્થને સદા સાથે જ રાખવાં જોઈએ. સમયને અતિ મૂલ્યવાન સંપત્તિ સમજીને એક ક્ષાળ પાણ નકામી જવા દેવી નહીં.

પરોપકાર, લોકસેવા તથા સત્કાર્ય માટે દાન તથા યજ્ઞભાવનાથી પ્રેરાયેલું પરમાર્થમય જીવન એ પ્રત્યક્ષ તપ છે. અન્યના લાભ માટે પોતાના સ્વાર્થનું બલિદાન આપવું એ તપસ્વી જીવનનું પ્રધાન ચિન્હ છે. આજની પરિસ્થિતિમાં પ્રાચીનકાળની માફક તપ કરી શકાય નહીં. આને શરીરિક સ્થિતિ એવી નથી રહીકે નેથી ભગીરથ, પાર્વતી અથવા રાવાણ જેવાં ઉચ્ચ તપ કરી શકાય. લાંબા વખત સુધી સાધના કર્યા કરવી એ આને શક્ય નથી. એવું કરવાથી શરીર તરત પીડાગ્રસ્ત બની જશે અને પ્રાગું સંકટમાં આવી જશે.

સત્યુગમાં લાંબા વખત સુધી ધ્યાન અને તપ થઈ શકતાં હતાં, કેમકે એ વખતે શરીરમાં વાયુતત્ત્વનું પ્રમાણ મુખ્ય હતું.

તેતાયુગમાં શરીરોમાં અનિતત્ત્વની પ્રધાનતા હતી અને દ્વાપરમાં જળતત્ત્વ પ્રધાન હતું. એથી તે યુગોમાં લાંબી સાધનાઓ થઈ શકતી હતી. આજે એ સાધનાઓ શક્ય નથી, કેમકે આજે કળીયુગમાં માનવદેહીઓમાં પૃથ્વીતત્ત્વ પ્રધાન છે. પૃથ્વીતત્ત્વ બીજાં બધાં તત્ત્વો કરતાં સ્થૂળ હોવાથી આધુનિક કાળમાં શરીર એ તપશ્ચયાઓ સહન કરી શકે નહીં, ને સત, તેતા અને દ્વાપરમાં ઘણી સહેલાઈથી કરી શકતી હતી.

કેટલાક વખત અગાઉ નેતિ, ધોતિ, બસ્તિ, નૌલી, વજોલી, કપાલભાતિ વગેરે કિયાઓ સહેલાઈથી થતી હતી. અને સાધનારા અનેક યોગીઓ જેવા મળતા હતા, પાણ યુગપ્રભાવને લીધે એની સાધના કઠાણ થઈ ગઈ છે. કોઈક વીરલો જ હઠ્યોગમાં સહનતા મેળવી શકે છે. એમ છતાં જે કોઈ પાણ રીતે આ કિયાઓ રીતસર કરવામાં આવે, તો પાણ જે લાભ આવી કિયાઓથી મળવી જોઈએ એટલો મળતો નથી.

મોટા ભાગના હઠ્યોગીઓ આવી કઠાણ સાધનાઓથી કોઈક કષ્ટસાધ્ય રોગના ભોગ બને છે. રક્તપિત્ત, અન્તર્દાહિ, મૂત્રધાત, કદ્દ, અનિદ્રા જેવા રોગથી પીડાતા હોય એવા અનેક હઠ્યોગીઓ જેવામાં આવે છે. એટલા જ માટે વર્તમાનકાળની શારીરિક સ્થિતિને ધ્યાનમાં લઈને તપશ્ચયામાં બહુ સાવધાની રાખવી જરૂરી છે. આજે તો સમાજસેવા, જ્ઞાનપ્રચાર, સ્વાધ્યાય, દાન, ઈન્દ્રિયસંયમ વગેરેના આધાર પર જ આપણી તપસાધના ચાલવી જોઈએ.

## ૫. પ્રાણમય કોશની સાધના

પ્રાણ એ શક્તિ અને સામર્થનું પ્રતીક છે, માનવશરીરોમાં એકબીજાની વચ્ચે જે લિખતા છે તે ઘણી સામાન્ય બાબત છે. જેમ એક માણસ જેટલો આહાર દે છે, જેટલો શ્રમ કરે છે, જેટલો લાંબો અને વજનદાર હોય છે, તેમ બીજે પાણ એના પ્રમાણમાં વધતો ઓછો હશે, પરંતુ આંતરિક શક્તિમાં એકબીજા મનુષ્યની વચ્ચે જરૂરીન-આસમાનનો જે તક્ષાવત છે તે જ ઘણી મહત્વની વાત છે.

વિદ્યા, ચતુરાઈ, અનુભવ, દૂરદર્શિતા, સાહસ, દઢતા, શોર્ય, જીવનશક્તિ, ઓઝસ, પુષ્ટિ, પરાક્રમ, પુરુષાર્થ, મહના વગેરે ગુણોથી એ આંતરિક શક્તિ ઓળખાય છે. આધ્યાત્મિક લાખામાં એને જ પ્રાણશક્તિ કહેવામાં આવે છે. પ્રાણશક્તિ નેત્રો દ્વારા ચમકે છે. ચહેરા ઉપર એનું પ્રતિબિંબ પડે છે. હાવભાવમાં એના તરંગોનું દર્શન થાય છે. પ્રાણની સુવાસમાં એક એવી જતની વિલક્ષણ માદકતા હોય છે, જે સામા માણસને ભાવવિભોર બનાવે છે. પ્રાણવાન સ્ત્રીપુરુષો એટલાં આકર્ષક હોય છે કે તેમનો સંગ છોડવાની ઈચ્છા થતી નથી.

પ્રાણ વાણીમાં ચમકતો હોય છે. એની વાણી સાંભળનારના દિલને હલાવી નાંખે છે. મોતનો સામનો કરવા માટે જ્યારે માણસ પોતાનો જન હાથમાં લઈ અગ્રેસર થાય છે તારે પ્રાણશક્તિ જ એની એકમાત્ર ઢાલ બની જતી હોય છે. ચારેબાળું નિરાશાજનક ધોર અંધકાર છવાયો હોય છે, છતાં એવા વખતે પાણ પ્રાણશક્તિ આશાના પ્રકાશનું એક કિરાણ બનીને ચમકે છે. રેતીમાંથી તેલ કાઢવાનું, મરુભૂમિમાં બગીચો બનાવવાનું, અશક્ય વાતને શક્ય બનાવવાનું અને રાઈનો પર્વત કરવાનું સામર્થ્ય માત્ર પ્રાણવાનમાં જ હોય છે. જેનામાં પ્રાણની માત્રા અલ્પ હોય તેવો માણસ મૂઢેલો જ સમજલો. સ્થૂલ શરીર હાથીના જેવું હોવા છતાં પાણ એવો માણસ પરાધીન જ રહેવાનો. પોતાની મુશ્કેલીઓનો દોષ બીજાઓ પર ઢોળી એ એક જતનો માનસિક સંતોષ મેળવશે. ઊજળા ભવિષ્યની આશા માટે પાણ એને પોતાના સામર્થ્ય ઉપર વિશ્વાસ બેસશે નહિ. કોઈ સબળ વ્યક્તિની, કોઈ નેતાની, કોઈ અમલદારની, કોઈ ધનવાનની, કોઈ સિદ્ધપુરુષની અથવા કોઈ દેવીદેવતાની સહાય ઈચ્છશે. એ હમેશાં પોતાના દુંભિયને જ રડતો રહેશે.

ભવનાં બંધનો કાપી આત્માને પરમાત્મામાં લીન કરાવી આપનારી શ્રદ્ધા, નિષ્ઠા, દઢતા, એકાગ્રતા, ભાવના વગેરે ગુણો પ્રાણ દ્વારા જ પ્રાપ્ત થાય છે. ‘મુઝિન’ ને મોટામાં મોટો પુરુષાર્થ માન્યો છે. સંસારનાં અન્ય સુખસાધનો

અને સગવડો મેળવવા માટે જેટલા વિવેક, પ્રયત્ન અને પુરુષાર્થની જરૂર પડે છે, તેના કરતાં મુજિતને માટે વધારે પ્રયત્ન અને પુરુષાર્થની જરૂર પડશે.

સાહસિક શૂરવીર જ મુજિત મેળવશે. મુજિત એ વિજયની ભેટ છે. ભગવાન પોતે કોઈને બંધનમાં નાખતો નથી કે નથી મોક્ષ આપતો. પોતાને સ્વર્ગ અથવા નરકનો અધિકારી બનાવનાર પોતે જ છે. પોતાની આંતરિક સ્થિતિનો આધાર રાખીને જે દિશામાં જવાનું નક્કી કર્યું હોય તે જ ધ્યેય ઉપર પહોંચાય છે.

ઉપનિષદનું વચન છે કે “નાયમાત્મા બલહીનેન લભ્યः” - બણ વગરના માણસોથી આ આત્મા મેળવી શકતો નથી. એક નિસ્તેજ માણસ જે પોતાનાં કુટુંબીઓ ઉપર, પરોશીઓ ઉપર તથા મિત્રો ઉપર પ્રભાવ પાડી શકતો નથી, તો પછી પરમાત્મા ઉપર તો એ કશો જ પ્રભાવ પાડી ન શકે એ દેખીનું જ છે. તેજસ્વી વર્કિત જ આત્મલાભ મેળવી શકે છે અને એટલા માટે યોગશાસ્યોમાં પ્રાણસંચયને ધારું જ મહત્વ આપ્યું છે. આપું અધ્યાત્મશાસ્ત્ર પ્રાણાયામની મહત્વા ગાય છે.

નેમ સર્વત્ર ઈશ્વરની મહિમામયી ગાયત્રી શક્તિ વાપી રહી છે, તેમ અભિલ વિશ્વમાં પ્રાણનો ચૈતન્યમય સમુદ્ર ભરેલો છે. નેમ શ્રદ્ધા અને સાધનાથી ગાયત્રીશક્તિને ખેંચીને આપણામાં ધારણ કરીએ, તેમ આપણા પ્રાણમય ક્રોશને સતેજ અને ચૈતન્યપૂર્ગ બનાવીને વિશ્વવાપી પ્રાણશક્તિમાંથી યથૈ માત્રામાં પ્રાણતત્ત્વ ખેંચી શકાય છે. આ ભંડાર જેટલો વધારે હશે તેટલા આપણે વધારે પ્રાણવાન બનિશું અને તેટલા જ પ્રમાણમાં સાંસારિક અને આધ્યાત્મિક સંપત્તિના અધિકારી થઈશું.

દીર્ઘ જીવન, ઉત્તમ સ્વાસ્થ્ય, ચૈતન્ય, સ્ફૂર્તિ, ઉત્સાહ, કિયાશીલતા, કષ્ટસહિષ્ણુતા, બુદ્ધિની સૂક્ષ્મતા, સૌંદર્ય, મનમોહકતા વગેરે વિલક્ષણતાઓ પ્રાણશક્તિ રૂપી ફૂલજડીની નાની નાની ચિનગારીઓ છે.

**પ્રાણાયામ** - એ શ્વાસ ખેંચવાની, એને રોકવાની અને બહાર કાઢવાની એક વિરોધ ક્રિયાપદ્ધતિ છે. એ વિધાન પ્રમાણે નેમ સાયકલના પંપથી ટ્યુબમાં હવા ભરવામાં આવે છે તેમ પ્રાણને અંદર ભરવામાં આવે છે. આ પંપ એ પ્રકારનો બનાયો હોય છે કે એથી હવા તો ભરાય છે, પણ એ પાછી ખેંચ્યો નથી. પ્રાણાયામની વ્યવસ્થા એ જ પ્રમાણેની છે. સાધારણ શાસોચ્છ્વાસની ક્રિયામાં નેમ મુસાફર રસ્તા ઉપર ચાલતો-ફરતો હોય છે, તેમ પ્રાણ આવતો જતો હોય છે, પણ પ્રાણાયામની વિધિ અનુસાર જ્યારે શાસોચ્છ્વાસની ક્રિયા થાય છે તારે, એક યાત્રાનું ધર્મશાળામાં વ્યવસ્થિત મુકામ આપી ટકાવવામાં આવે છે, તેમ વાયુમાંથી પ્રાણને ખેંચીને ખાસ પદ્ધતિથી શરીરમાં સ્થાન આપવામાં આવે છે.

ભારતીય યોગશાસ્ત્ર પદ્દચઙ્કો પેડી સૂર્યચક્ષણ ધારું મહત્વ આપે છે. હવે પાશ્ચાત્ય વિજ્ઞાન પણ સૂર્યઘંથી એ અનેક સૂક્ષ્મ તંતુઓનું કેન્દ્ર છે એનો સ્વીકાર કરે છે. એટલું જ નહીં, પણ માનવશરીરમાં પ્રતિક્ષાળ જે ક્રિયાપ્રાણાલી ચાલી રહી છે તેનું સંચાલન પણ એની મારફતે જ થાય છે એનો સ્વીકાર કરે છે.

કેટલાક વૈજ્ઞાનિકો એને ‘પેટનું મગજ’ પણ કહે છે. સૂર્યચક્ષણ આમાશયની ઉપર હદ્યની પાછળ કરોળજુની બંને બાળુએ આવેલું છે. એ એક પ્રકારના સર્ફેન અને ભૂરા માવાનું બનેલું છે. પાશ્ચાત્ય વૈજ્ઞાનિકો માને છે કે શરીરની આંતરિક ક્રિયાવિધિની ઉપર એનો અધિકાર છે. એટલું જ નહીં, પણ અંદરના અવયવોની ઉત્ત્રતિ-અવનતિનો આધાર પણ આ જ કેન્દ્ર છે. પણ ઝરી વાત એ છે કે સૂર્યચક્ષણ શક્તિની શોધ હજુ અધૂરી છે. એ લોકો માને છે તેના કરતાં એ ચકનું કાર્ય અને મહત્વ અનેકગાણું વધારે છે. એવું જોવામાં આવ્યું છે કે આ કેન્દ્રને જે થોડોક પણ ફટકો લાગી જાય તો માણસનું તાત્કાલિક મરાણ થાય છે.

યોગશાસ્ત્ર આ કેન્દ્રને પ્રાણકોશ માને છે અને કહે છે કે આ કેન્દ્રમાંથી એક પ્રકારનો વિદ્યુતપ્રવાહ નીકળી

સર્વે નાડીઓમાં વહે છે. ઓજસથક્ષિત પાણ આ જ સ્થાનમાં રહે છે.

પ્રાણાયામથી આ સૂર્યચકની એક પ્રકારની હલકી હલકી માલિસ થાયછે, જેનાથી એમાં ગરમી, તેજ અને ઉત્તેજનાનો સંચાર થાય છે, એટલું જ નહીં, પાણ એની કિયાશીલતા પાણ વધે છે. પ્રાણાયામથી ફેફસાંમાં વાયુ ભરાય છે અને તે ફ્લેવે છે. આ કુલાવો સૂર્યચકના પરિધને સ્પર્શ કરે છે.

વારંવાર સ્પર્શ કરવાથી જેમ કામસેવનાનાં અંગોમાં ઉતેજના ઉત્પન્ન થાય છે, તેમ પ્રાણાયામની મારફકે ફેફસાંનો સૂર્યચક સાથે સ્પર્શ થવાથી એક પ્રકારની આશાણાટી, ઉતેજના અને હલચલ પેદા થાય છે. આ ઉતેજના વર્થ જતી નથી. ઊલટું એની સાથે જેડાયેલાં અંગપ્રત્યંગોને જીવન અને બળ આપે છે, જેથી શારીરિક અને માનસિક ઉત્ત્રતિનાં દ્વાર ખૂલ્લી જાય છે.

કરોડરનજુની ડાબી-જમાણી બંને બાજુએ નાડીગુચ્છકોની બે શ્રેણીઓ ફેલાયેલી છે. આ શ્રેણીઓ પરસ્પર સંકળાયેલી છે અને આ શ્રેણીઓમાં જ માથાની, ગળાની, છાતીની વગેરે નાડીઓ સામેલ છે. બીજા અનેક નાડીતંતુઓ પાણ અહીં ભેગા થાય છે. એનો પ્રથમ વિભાગ - જેને 'મસ્તિષ્ઠનો મેરુ વિભાગ' કહે છે તે શરીરના જ્ઞાનતંતુઓ સાથે ધનિષ્ઠ સંબંધ ધરાવે છે. આ સંસ્થાનમાંથી અસંખ્ય ઘાણા જ બારીક ભૂરા રંગના તંતુઓ નીકળી રહેતનાંથી એમાં ફેલાઈ જાય છે અને પોતાની અંદર વહેતી વિદ્યુતશક્તિથી અંદરના શારીરિક અવયવોનું સંચાલન કરતા રહે છે.

ઉપર બતાવાઈ ગયું છે કે કરોડરનજુની ડાબી-જમાણી બાજુ નાડીગુચ્છકોની બે પ્રધાન શ્રેણીઓ ફેલાયેલી છે. યોગમાં એમને ઈડા અને પિંગલા કહી છે. રક્તાભિસરણ, શ્વસનક્ષિયા, પાચનક્ષિયા વગેરે મુખ્ય કાર્યોને સુવ્યવસ્થિત રાખવાની જવાબદારી મુખ્યવે ઉપરોક્ત બંને નાડીગુચ્છકોની છે. પ્રાણાયામ-સાધના એ બંને ઈડા, પિંગલા નાડીઓને ચોક્કસ પદ્ધતિ અનુસાર બળવાન બનાવે છે. જેથી એની સાથે સંબંધ ધરાવતાં અંગોની કાર્યશક્તિમાં કોઈ વિકાર હોય તો દૂર થઈ આનંદવર્ધક આરોગ્ય પ્રાપ્ત થાય છે.

અન્યાંત્ર પ્રાચીનકાળથી આત્મવેતા પુરુષો પ્રાણાયામના મહત્વ અને લાભોનો સારી રીતે અનુભવ લેતા આવ્યા છે. તે જ પ્રમાણે સમસ્ત ભૂમંડળના યોગીઓ પોતપોતાની વિધિ પ્રમાણે એ કિયાઓ કરતા આવ્યા છે. મહાપ્રભુ નિસસ કાઈસ્ટ પોતાના શિષ્યો સહિત એક પર્વત ઉપર ચઢીને ઈશ્વરપ્રાર્થના કરતા હતા. તેમાં એમ કહેવાય છે કે આટલા ઊચા ચઢાણમાં આધ્યાત્મિક રહસ્ય છુપાયું હતું.

બૌધ ધર્મમાં 'જજન' નામનો પ્રાણાયામ ઘાણા જૂના કાળથી પ્રચલિત છે. પ્રસિદ્ધ જપાની પુરોહિત હુકુઈન જેથીએ પ્રાણાયામનો ખૂબ પ્રચાર કર્યો હતો. બીજા અનેક દેશોમાં પાણ આ વિદ્યાનો પ્રભાવ જાણીતો હતો, એનાં ઘણાં પ્રમાણો મળે છે.

યોગદર્શન સાધનપાદનાં સૂત્રો પર-પર માં બતાવ્યું છે કે પ્રાણાયામથી અવિદ્યાનો અંધકાર દૂર થઈ જ્ઞાનનો પ્રકાશ ફેલાય છે અને મનની એકાગ્રતા સધાય છે. એવી કથાઓ સાંભળવામાં આવે છે કે યોગી લોકો પ્રાણને વશ કરીને મૃત્યુને જતી લે છે, ઈચ્છે તાં સુધી જીવંત રહી શકે છે. પ્રાણશક્તિથી પોતાના અને બીજાઓના રોગો દૂર કરવાનું એક ખાસ વિજ્ઞાન છે. 'પ્રાણશિક્ષિત્સા વિજ્ઞાન' નામના પુસ્તકમાં એનું વિસ્તાર્થી વિવેચન કરવામાં આવ્યું છે. એ સિવાય પ્રાણાયામથી થતા બીજા અનેક જતના સાંભળવામાં અને જેવામાં આવ્યા છે. આ લાભો કેટલીક વખતે એવા વિચિત્ર અને વિલક્ષણ હોય છે કે જેથી ભારે આશ્રય ઉપને છે.

આ પુસ્તકમાં આવી અદ્ભુત અને આશ્ર્યનજનક ઘટનાઓની ચર્ચા ન કરતાં એટલું કહેવું બસ થશે કે પ્રાણાયામથી શરીરની સૂક્ષ્મ કિયાપદ્ધતિ ઉપર અદ્ય રૂપમાં એવો વેજાનિક પ્રભાવ પડે છે કે જેથી રહેતસંચાર, નાડીસંચાલન, પાચનક્ષિયા, સ્નાયુઓની દફતા, ગાઢનિદ્રા, સ્ફૂર્તિ વગેરે માનસિક વિકાસનાં ચિહ્નો સ્પષ્ટ રૂપમાં

દેખાય છે અને તેથી સ્વાસ્થ્ય, બળ, પ્રસત્રતા, ઉત્સાહ અને પરિશ્રમની યોગ્યતા વધે છે.

આત્મોન્તરિતિ, ચિત્તની એકાગ્રતા, સ્થિરતા, દફના વગેરે માનસિક ચુણું પ્રાણસાધનાની સાથે જ વૃદ્ધિ પામેલા જાગ્યાશે. આ લાભો ઉપર વિચાર કરવામાં આવે તો ખાતરી થશે કે પ્રાણાયામ એ આત્મોન્તરિતિની એક મહત્વપૂર્ણ સાધના છે.

પ્રાણતત્ત્વનો વાયુની સાથે ઘાણો સંબંધ છે. પાશ્ચાત્ય વિજ્ઞાન તો પ્રાણને વાયુનો એક સૂક્ષ્મ ભેદ જ માને છે. શાસોચ્છ્વાસ સારી રીતે લેવો અથવા ન લેવો એના ઉપર તો પ્રાણની માત્રાના ઓછાવતા પ્રમાણનો આધાર રહે છે અને એટલા જ માટે શાસપ્રશ્નાસની ચોક્કસ પદ્ધતિ પ્રત્યેક આબાલવુદ્ધે જાણી લેવી જોઈએ.

ઉંડો અને પૂરો શાસ લેવો જોઈએ, જેથી વાયુ ફેફસાંના દરેક ભાગમાં જઈને સર્વે કોષોના રક્તની સંક્ષેપી કરી શકે. અધ્યૂરા અને છીછા શાસથી થોડાક જ વાયુકોષોની સંક્ષેપી થશે કેમકે એનું દબાગ આખા કોઠાના કોષો સુધી પહોંચી શકે એટલું વધારે હોતું નથી. જે હવા ત્યાં સુધી પહોંચી જ ન શકે તો પછી સંક્ષેપી થાય જ શી રીતે? શાસનો સંપર્ક થવાથી રક્તની અશુદ્ધિ કાબોનિક એસિડ ગેસ બહાર નીકળી જાય છે અને શાસનો પ્રાણ ઓક્સિજન રક્તમાં મળી જાય છે.

આ સાફ થયેલા રક્તની પ્રાણશક્તિ બીજી વખતના વહનની સાથે શરીરનાં અંગ-પ્રત્યંગમાં પહોંચી જઈને તાજગી અને સ્ક્રૂતિ આપે છે. શુદ્ધ રક્તમાં એક ચતુર્થાંશ ભાગ ઓક્સિજનનો હોય છે, જે આ પ્રમાણ ઓછું થઈ જાય તો એનો પ્રભાવ પાચનક્રિયા ઉપર પરંપરા સિવાય રહેતો નથી અને એવી વક્તિનો જાગ્રાજિન મંદ થવા લાગે છે.

આ સર્વે પ્રક્રિયાઓનો વિચાર કરતાં એ સ્પષ્ટ થાય છે કે શાસ પૂર્ણ અને દીર્ઘ જ લેવો જોઈએ, કે જેથી રક્તની સંક્ષેપી કામ સારી રીતે થાય અને અશુદ્ધ રહેવા ન પામે તથા ઓક્સિજનનું જોઈનું પ્રમાણ મળી જતાં અંગ-પ્રત્યંગમાં તાજગી અને સ્ક્રૂતિનો સારી રીતે સંચાર થાય અને પાચનશક્તિમાં કોઈ જાતની ક્ષતિ ન આવે.

જાગ્રાજિન મંદ થતાં અન્ય અંગોમાં શિથિલતા આવે છે અને પાચનનું કામ અધ્યુરું રહે છે. આવો કમ જે લાંબો વખત ચાવે તો જીવનયાત્રામાં વિવિધ પ્રકારનાં વિધનો આવે છે. એટલું જ નહીં, પાણ વિવિધ રોગોનો પાણ સામનો કરવાનો વખત આવે છે.

અપૂર્ણ શાસ લેનારાઓનાં ફેફસાંનો મોટો ભાગ નકામો પડી રહે છે. જે મકાનોની સંક્ષેપી નથી થતી તેમાં ગંદકી, માંકડ, વાંદા, કીડી, મચ્છર, મંકોડી વગેરે જન્તુઓ પેદા થાય છે. એ જ પ્રમાણે ફેફસાંનાં જે છિદ્રોમાં વાયુ પહોંચતો નથી તેમાં ક્ષય, ખાંસી, સળેખમ, કદ, દમ વગેરે રોગોનાં કીટાણુઓ અડો જમાવે છે. ધીર ધીર તેઓ એવી રીતે ફેલાય છે, એવું આધિપત્ય જમાવે છે કે તેમને ત્યાંથી દૂર કરવાનું અશક્ય નહીં, પાણ મુશ્કેલ તો બની જ જાય છે.

પ્રાણાયામ વિજ્ઞાનનો સહૃથી સહેલો અને આરંભિક પાઠ તો એ છે કે દરેક પૂર્ણ અને ઉંડો શાસ લેવો જોઈએ. વાયુથી ફેફસાં ભરાઈ જાય એવી રીતે શાસ લેવાનો પ્રયત્ન કરવાની હંમેશાં ટેવ પાડવી જોઈએ. ધીમે ધીમે શાસ એવી રીતે ખેંચવો કે જેથી છાતી ભરપૂર પહોળી થાય અને એ જ કમથી વાયુ ધીર ધીર બહાર કાઢવો.

ફેફસાંને સ્વસ્થ રાખવાની, રક્તને શુદ્ધ કરવાની શરીરનાં અંગ-પ્રત્યંગોને ચેતના આપવાની, પાચનશક્તિને તંદુરસ્ત રાખવાની અને મનુષ્યને આરોગ્ય અને દીર્ઘજીવન આપવાની પાણ આ રીત છે.

પૂર્ણ શાસ લેવાનો અભ્યાસ કરવાથી છાતીનો ઘેરાવો વધે છે, ફેફસાંની મજબૂતાઈ અને વજનમાં વૃદ્ધિ થાય છે અને હદ્યની કમજોરીમાં સુધારો થઈને રક્તસંચારની ક્રિયામાં એક જાતનું ચેતન્ય દેખાઈ આવે છે. પાઠકે શાસવિજ્ઞાનના આ સત્યને ગંભીરતાપૂર્વક વિચારવું ધોરણે અને તરત જ પૂર્ણ દીર્ઘ શાસ લેવાની આદત પાડવાનો જાપની મહાવિજ્ઞાન - ભાગ-૩

પ્રયત્ન શરૂ કરી દેવો જેઈએ. થોડા દિવસ શસનક્રિયા ઉપર ધ્યાન આપવાથી અને એમાં થતી ભૂલ સુધારતા રહેવાથી આ ટેવ સારી રીતે પડી જશે.

પ્રાણાયામ વિજ્ઞાનનો બીજો પાઠ નાકથી શાસ લેવો એ છે. મોંથી પાણ શાસ લઈ શકાય છે, પાણ એવો શાસ એટલો ઉપયોગી નથી થતો, જેટલો નાકથી લેવાયેલો ઉપયોગી થાય છે. એકવાર મોટી સ્ટીમરના મુસાફરોમાં શીતળાનો રોગ ઉચ્ચ રૂપમાં ફાટી નીકળ્યો. ડોક્ટરોએ તેને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો. મરેલા માટે એમનો રિપોર્ટ એવો હતો કે તેઓ મોંઢા વાટે શાસ લેતા હતા. એ સ્ટીમરમાં નાક વાટે શાસ લેવાની આદત હોય એવો એક પાણ માણસ મરી ગયો ન હતો. સણેખમ અને શરદીના રોગો સંબંધી ડોક્ટરી રિપોર્ટ પાણ એવો છે કે મોંઢું ખોલીને શાસ લેવાથી આવા રોગોનો પ્રક્રોપ વિશેષ રૂપમાં થતો હોય છે. એટલું જ નહીં, પાણ આ ખરાબ ટેવના પરિણામે અનેક નાના મોટા રોગ થતા જેવામાં આવે છે.

નાકથી ફેફસાં સુધી હવા પહોંચાડનારી જે નળી છે અને રચના એવી રીતે કરવામાં આવી છે, જેથી અંદર જતા વાયુનું સારી રીતે સંશોધન અને પરિમાર્જન થાય. નાસિકાનાં છિદ્રોમાં નાના વાળ હોય છે. આ એક પ્રકારની આપણી ગળાણી છે, જેમાં ધૂળ તથા ગંદકીના આગુંઓ અટકી રહે છે અને ગળાયેલો વાયુ જ અંદર જઈ શકે છે. જ્યારે તમે નાસિકાનાં છિદ્રોમાં આંગળી નાખીને એની સફાઈ કરો છો તો એમાંથી મેલ નીકળે છે. ગળાયેલા વાયુમાંથી જે કચરો જમા થાય છે તે જ આ મેલ છે.

નાસિકામાં એક પ્રકારનો પ્રવાહી પદાર્થ વહેતો હોય છે. વાળની ચાળાણીમાંથી પાણ જે કચરો બાકી રહે છે તે આ પ્રવાહીમાં ચોંટી જય છે. નાસિકાનાં છિદ્રોમાંથી હવાનું આટલું સંશોધન થયા પછી જ તે આગળ ચાલે છે. શાસનળી, જે ફેફસાં સુધી જય છે એ ટીક ટીક લાંબી છે. આટલી લંબાઈમાં યાત્રા કરતી વખતે હવાનું તાપમાન સહન કરી શકીએ ટેટલું થઈ જય છે. જે તે ગરમ હોય તો શાસનળીના તાપમાન અનુસાર ઠંડી થઈ જય છે અને જે ઠંડી હોય તો ગરમ થઈ જય છે. આ પ્રમાણે હવા ફેફસાં સુધી જતાં જતાં બધી જ રીતે શુદ્ધ થઈ જય છે. મોંઢા વાટે શાસ લેવાથી પરિણામ ઊલટું જ આવે છે.

મોંઢામાં નાસિકાની માફક વાળ નથી કે જેથી વાયુ યોગ્ય રીતે ત્યાં ગળાય. બીજું મોંઢાનું છિદ્ર એટલું મોટું છે કે એમાંથી વાયુ સધળા પ્રકારના કચરા સાથે કોઈ પાણ જાતના અવરોધ વગર ચાલ્યો જઈ શકે છે. ત્રીજું મોંઢાથી ફેફસાં ઘણાં દૂર નથી એટલે વાયુની ગરમીઠંડીમાં પાણ બલ્લુ ફ્રક પડતો નથી. એ પ્રમાણે ગળાયા સિવાયની, કચરાયુક્ત, ઠંડી-ગરમ હવા જ્યારે મોંઢાએ વાટે ફેફસાંમાં પહોંચે છે તારે એને ઘણાં નુકસાન કરે છે અને અનેક બીમારીઓ ઉત્પત્ત કરે છે. જેવામાં આવ્યું છે કે, જે લોકો રાત્રે મોંઢાથી શાસ લે છે તેઓનું મોંઢું સવારે સુકાયેલું, દાહયુક્ત કરવું અને ગંધ મારતું હોય છે. બીમાર માણસની આવી આદતને લીધે તેમને સાજ થતાં વાર લાગે છે.

પ્રાણાયામના અભ્યાસીઓની-યોગીઓની એ કડક તાકીદ હોય છે કે તેમણે હંમેશાં નાક વાટે જ શાસ લેવો. નાસિકા- માર્જમાં કોઈ અવરોધ હોય કે જેથી મોંઢા મારફત શાસ લેવાની ફરજ પડે, તો નાસિકાનાં છિદ્રો જેમ બને તેમ જલદીથી સાફ કરી લેવાં.

સંગીતથી ફેફસાં મજબૂત થાય છે. ગાયન ગાવામાં જેને રૂચિ હોય છે તેને છાતીના રોગો બનતા સુધી બહુ ઓછા થશે. વધારે પડતું ગાવાથી અથવા અનુચ્ચિત અવસ્થામાં અવિધિસર ગાવાથી કાંઈક બીમારીઓ આવે છે, પાણ સાધારાણતાઃ ફેફસાંને મજબૂત કરનારા અભ્યાસો પૈકી સંગીતની પાણ ગણાતરી થઈ શકે છે.

કંઠ, હદ્ય, પાંસળી, આમાશય, આંતરડાં, લીવર વગેરે સર્વે આંતરિક અવયવોને સંગીતથી સારો વ્યાયામ મળે છે. જે સારી જાતનાં વાળ સાથે ધ્વનિપૂર્વક ગાવા અને વગાડવામાં આવે તો એક પ્રકારના વિદ્યુતતરંગો ઉત્પત્ત થઈને સ્નાયુતંતુઓને તરંગિત કરે છે. આને પરિણામે શાસસંચાલન ક્રિયામાં ઘણાં સહાયતા મળે છે, એટલું જ નહીં ૩૬૨

પાણ મંદ અને શિથિલ ગતિથી કાર્ય કરતાં અંગોમાં ચંચળતા અને ગતિશીલતાનો આવિભાવ થાય છે. જેઓને ગાવા વગરવાનું છે, તેઓએ ભોજનની પછી ઓછામાં ઓછા ત્રાણ કલાક પછી અભ્યાસ કરવો જોઈએ. જે વગાડી શકતો ન હોય તેણે ગાવું તો જોઈએ જ. સગવડ પ્રમાણે કદી વાદ કે ગાયન સાંભળવાનો અવસર મળે તો તેનો લાભ લેવો જોઈએ કેમકે સંગીતથી ઉત્પન્ન થનારી વિદ્યુત- લહરીઓ સાંભળનારને પાણ પ્રભાવિત કરે છે.

સવાર-સાંજ ગાયન, વાદ તથા નૃત્યની સાથે સંકીર્તન કરવાની ધાર્મિકપ્રથમનો આરોગ્યની સાથે ઘાણો ગાઢ સંબંધ છે. સંકીર્તનમાં સામેલ થનારાઓને ગળાનો અને ફેફસાંનો ધાણો સારો વ્યાયામ મળે છે. જેર જેરથી ધાર્મિક ભજનો ગાવાં અથવા શંખ ફુંકવાથી ફેફસાંને ધાણો સારો વ્યાયામ મળે છે. ઉપરોક્ત કિયાઓથી સાધારણ રીતે પ્રાણાયામના લાભો મળે છે.

સામાન્ય લોકોને ઉપયોગી થાય એવી સર્વસુલભ પ્રાણાકર્ષણની કિયા નીચે આપવામાં આવી છે. સ્લી, પુરુષ, બાળક, વૃદ્ધ સર્વને માટે એ ઉપયોગી છે. આનાંથી સાધકમાં ધીર ધીર પ્રાણતત્ત્વની વૃદ્ધિ નિરંતર થતી રહે છે. ગાયત્રીની બ્રહ્મસંધામાં બતાવેલા પ્રાણાયામની માફક પ્રાણાકર્ષણ કિયા પાણ સર્વને માટે લાભદાયક અને સરળ છે.

### પ્રાણાકર્ષણની સુગમ કિયાઓ

પ્રાતઃકાળે નિન્યકર્મથી નિવૃત્ત થઈ સાધનાને માટે કોઈ સ્વર્ચષ, શાંતિદાયક સ્થાનમાં આસન બિધાવીને બેસવું. બંને હાથ ધૂંટણો પર પર રાખવા અને કરોડરણજુ સીધી રાખવી, આંખો બંધ કરવી.

(૧) ફેફસાંમાં ભરાયેલી બધી હવા ખાલી કરી નાખવી. પછી ધીર ધીર નાસ્તિકા દ્વારા શ્વાસ લેવો. ફેફસાંમાં નેટલી હવા ભરી શક્ય તેટલી ભરવી. થોડોક વખત અને અંદર જ રોકી રાખવી. અંદરની હવાને શક્ય એટલી બહાર કાઢી નાખવી. થોડીવાર શ્વાસને બહાર રોકો રાખવો, એટલે કે શ્વાસ સિવાય જ રહેવું. ત્યાર પછી પાછો પૂર્વવંત વાયુ બેંચવો શરૂ કરવો. આ એક પ્રાણાયામ થયો.

(૨) શ્વાસ કાઢવાને રેચક, બેંચવાને પૂરુક અને રોકવાને કુંભક કહેવામાં આવે છે. કુંભકના બે બેદ છે. શ્વાસને અંદર ભરીને રોકવો તે “અંતરુંભક” અને ઝાલી કરીને વગર શ્વાસે રહેવું તે “બાધુંભક” કહેવાય છે. રેચક અને પૂરુક- બંનેમાં સરખો સમય આપવો અને કુંભક માટે એથી અદ્ધો સમય પૂરતો છે.

પૂરુક કરતી વખતે એવી ભાવના કરવી કે ‘જનશૂન્ય લોકમાં હું એકલો બેઠો છું. મારી ચારે બાજુએ ચૈતન્ય વિદ્યુત જેવી જીવનશક્તિના સમુદ્રની લહેરો ઊઠી રહી છે. શ્વાસ દ્વારા વાયુની સાથે સાથે પ્રાણશક્તિને પણ હું અંદર ખેંચી રહ્યો છું.’

અંતરુંભક કરતી વખતે ભાવના કરવી કે ‘શરીરમાંનો સંચિત મળ, રૂતમાં ભણેલું વિષ, મનમાં ધસી આવેલા વિકાર શ્વાસ છોડતી વખતે વાયુની સાથે બહાર કાઢી અંદરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી વિકારો પાછા અંદર જઈ ન શકે.

આવી ભાવનાઓ સાથે પ્રાણાકર્ષણ પ્રાણાયામ કરવો જોઈએ. શરૂઆતમાં પાંચ પ્રાણાયામ કરવા. ધીર ધીર અનુકૂળતા પ્રમાણે વધારતા જવું

(3) કોઈ એકાંત સ્થાનમાં જાઓ, સમતલ ભૂમિ ઉપર નરમ બિધાનું પાથરી પીઠ ઉપર સૂઈ જાઓ. મોંઢું ઉપર રહે. પગ, કમર, ધાતી, માથું સર્વે એક લાઈનમાં રાખો બંને હાથ સૂર્યચક ઉપર રાખો. મોંઢું બંધ રાખો. શરીરને બિલકુલ ઢીલું રાખો, જાગે કે એ એક નિર્જવ વસ્તુ છે અને એની સાથે તમારે કશો પણ સંબંધ નથી. થોડોક વખત શિથિલતાની ભાવના કરવાથી શરીર બિલકુલ ઢીલું પડી જશે. હવે નાક દ્વારા ધીર ધીર શાસ ખેંચો અને દઢ શક્તિની સાથે ભાવના કરો કે ‘વિશ્વવાપી મહાન પ્રાણભંડારમાંથી હું શાસ સાથે સ્વચ્છ પ્રાણ ખેંચી રહ્યો છું. આ પ્રાણ મારા રેંટપ્રવાહ તથા સમસ્ત નાડીતંતુઓમાં પ્રવાહિત થઈને સૂર્યચકમાં એકત્ર થઈ રહ્યો છે.’ આ ભાવનાને કલ્પનામાં એટલી દઢતાથી ઉતારો કે પ્રાણશક્તિનાં વીજળી જેવાં ડિરણો નાસ્કા દ્વારા દેહમાં ધૂમી વળતાં હોય એમ ચિત્રવત્ત દેખાવ લાગે તથા આપણા રેતનું વહન અને નાડીસમૂહ તથા એમાં વહેતો પ્રાણપ્રવાહ તસ્વીરની માફક નજર સમક્ષ સ્પષ્ટ થાય. આ ભાવના જેટલી મજબૂત હશે એટલા જ પ્રમાણમાં તમે પ્રાણને તમારામાં ખેંચી શક્શો.

ફેફસાં વાયુથી સારી રીતે ભરી લો અને પાંચથી દસ સેકન્ડ સુધી અંદર રોકો. શરૂઆતમાં પાંચ સેકન્ડ બસ થશે. પછીથી અભ્યાસ વધતાં દસ સેકન્ડ સુધી રોકી શકશો. શાસ રોકતી વખતે આપણી અંદર પ્રાણ પ્રચૂર પ્રમાણમાં ભરેલો છે એવો અનુભવ કરો. હવે વાયુને મોઢા દ્વારા ધીર ધીર બહાર કાઢો. બહાર કાઢતી વખતે એવી ભાવના કરો કે ‘શરીરના તમામ દોષ, રોગ અને વિષ આની મારફતે બહાર નીકળી રહ્યા છે.’ દસ સેકન્ડ સુધી હવા વિના રહો અને ફીરી પ્રાણકર્ષણ પ્રાણાયામ કરવાનો આરંભ કરો. ધ્યાનમાં રાખો કે પ્રાણકર્ષણનું મૂળતત્ત્વ શાસ ખેંચવામાં-છોડવામાં સમાયેલું નથી, પણ આકર્ષણની પેલી ભાવના જેમાં આપણા શરીરમાં પ્રાણનો પ્રવેશ થતો ચિત્રવત્ત જોઈ શકાય તેમાં રહેલું છે.

શાસ-પ્રશ્નાસની કિયા દસ મિનિટથી વધારતાં અડધા કલાક સુધી લઈ જવી. ‘શાસ દ્વારા ખેંચેલો પ્રાણ સૂર્યચકમાં જમા થઈ રહ્યો છે’ એવી વિશેષ રૂપમાં ભાવના કરો. જે મોઢા દ્વારા શ્વાસ છોડતી વખતે આકર્ષિત પ્રાણને પણ છોડવાની કલ્પના કરશો તો આખી કિયા વર્થ જશે અને કોઈ પણ જતનો લાભ નહીં મળે.

સારી રીતે પ્રાણકર્ષણ કરવાથી સૂર્યચક જગૃત થતું જય છે. એવી ખાતરી થાય છે કે પાંચળીઓ જ્યાં જોડાય છે, ત્યાં આમાશયના સ્થાન પર જે ખાડો છે, ત્યાં સૂર્ય જેવું એક નાનું સરખું પ્રકાશબિંદુ દેખાઈ રહું છે. આ બિંદુ શરૂઆતમાં નાનું અને થોડા પ્રકાશવાળું તથા આંખા જેવું દેખાય છે, પરંતુ જેમ જેમ અનુભવ અને અભ્યાસ વધતો જશે તેમ તેમ એ સાફ-સ્વચ્છ, કદમાં મોટું અને પ્રકાશવાન બનતું જશે. જેનો અભ્યાસ ધ્યાન જ આગળ વધેલો છે તેને તો આંખો બંધ કરતાંની સાથે જ સૂર્ય જેવું તેનસ્વી દેખાય છે. તે પ્રકાશિત તત્ત્વ એ જ સાચી પ્રાણશક્તિ છે. આ શક્તિથી મુશ્કેલ કાર્યોમાં પણ અદ્ભુત સહનતા મળે છે.

અભ્યાસ પૂરો થતાં તમને માલૂમ પડશે કે રૂતનો સંચાર તેજીથી થઈ રહ્યો છે. આખા શરીરમાં વિદ્યુતનું વહન થઈ રહું હોય એવો ભાસ થશે. અભ્યાસ પછી થોડોક સમય કોઈ શાંતિમય સ્થાનમાં બેસવું જોઈએ. અભ્યાસમાંથી ઊઠીને એકદમ કોઈ કામમાં લાગી જવું કે સ્નાન, ભોજન અથવા મૈથુન કરવું તે શાસ્ક્રમાં નિષિદ્ધ છે.

ઉપરસર્વ સાધારણ જનતાના ઉપયોગની શાસ-પ્રશ્નાસની કિયા અનું વર્ગન થઈ ચૂક્યું છે. આના ઉપયોગથી ગાયત્રી સાધકોની આંતરિક દુર્બળતાઓ દૂર થાય છે અને પ્રાણવાન બનવાનાં લક્ષણો પ્રગટ થતાં જય છે. પ્રાણમય કોશની ભૂમિકાને પાર કરવા માટે દશ પ્રાણોનું સંશોધન કરવું પડે છે.

મનુષ્યના શરીરમાં દસ જતના પ્રાણનો નિવાસ છે. એમાંથી પાંચને મહાપ્રાણ અને પાંચને લધુપ્રાણ કહે છે.

(૧) પ્રાણ, (૨) અપાન, (૩) સમાન, (૪) ઉદાન, (૫) વાન. આ પાંચ મહાપ્રાણ છે.

(૧) નાગ, (૨) કૂર્મ, (૩) કૃક્લ, (૪) દેવદત, (૫) ધનંજય. આ પાંચ લઘુપ્રાણ છે.

શરીરમાં કેટલાક એવા ભ્રમર છે, જેમના જગવાથી પ્રાણતત્ત્વની હિયા અને સ્થિતિ એ ભ્રમરોને અનુકૂળ થઈ જાય છે. વિદ્યુતનો પ્રવાહ બલબના સંપર્કથી પ્રકાશ આપે છે, પંખાની સાથે મળીને હવા આપે છે, મોટરમાં જઈને ગતિશક્તિ પેદા કરે છે અને રેડિયોમાં અનું કાર્ય ધ્વનિ પકડવાનું હોય છે.

પ્રાણતત્ત્વ એક પ્રકારની વિદ્યુતશક્તિ સમાન છે. વહેતા પાણીમાં જેમ ભ્રમરોને લીધી ખાડો પડે છે તે જ પ્રમાણે સૂક્ષ્મ શરીરમાં કેટલાક એવા ભ્રમર છે, જેમની સાથે પ્રાણનું સંમિશ્રાણ થવાથી એક વિશેષ પ્રક્રિયા થાય છે.

પાંચ મહાપ્રાણોને ‘ઓન્સ’ અને પાંચ લઘુપ્રાણોને ‘રેતસ’ કહેવામાં આવે છે. બંને પ્રાણો એકબીજાના પૂર્ક અને સહાયક છે. બંને આંખો, બંને નસકોરાં, બંને કાન, બંને હાથ, બંને પગ એકબીજાના સાથી, સહાયક અને પૂર્ક છે, એ જ પ્રમાણે મહાપ્રાણ અને લઘુપ્રાણ પણ આપસમાં સંબંધક અને સહાયક છે. એમાંના એક જ પ્રાણને જે વિભાગમાં વહેંચવામાં આવે છે. એક જ હોવા છતાં કેટલાક વિશિષ્ટ બેદોના કારણે મગજને આગળું મસ્તિષ્ણ અને પાછળું મસ્તિષ્ણ એમ બે ભાગોમાં વહેંચી નાખવામાં આવ્યું છે, એ રીતે જ પ્રાણતત્ત્વ બે ભાગોમાં વિભાજિત થયું છે.

‘પ્રાણ’નું નિવાસસ્થાન હદ્ય છે. ‘નાગ’ પણ એની બાજુમાં જ રહે છે. ‘અપાન’ ગુદા અને મૂત્રેન્દ્રિયની વચ્ચે મૂલાધારની બાજુમાં રહે છે. એની બાજુમાં જ ‘કૂર્મ’ લઘુપ્રાણનો નિવાસ છે. ‘સમાન’ અને ‘કૃક્લ’ નાભિમાં રહે છે. ‘ઉદાન’ અને ‘દેવદતનું’ સ્થાન કંઈ છે. ‘ધનંજય’માં આકાશતત્ત્વનું મિશ્રાણ અધિક હોવાથી તે સંપૂર્ણ શરીરમાં વાપ્ત રહે છે તેમ છતાં એનું મુખ્ય કેન્દ્ર મસ્તિષ્ણનો મધ્યભાગ છે.

સાધારણ રીતે એવું મનાય છે કે પ્રાણ દરાર શબ્દ અને મગજનું પોષણ થાય છે, અપાનથી મળમૂત્ર અને સ્વેદ વગેરેનું વિસર્જન થાય છે. ઉદાન વિવિધ વસ્તુઓ બહારથી શરીરમાં ચ્રહાણ કરે છે. વ્યાનનું કામ રક્તસંચાર કરવાનું છે. લઘુપ્રાણોમાં નાગથી ઓડકાર આવે છે. કૂર્મથી પલક મારવાની અને ઉધાડવાની હિયા થાય છે. કૃક્લથી છીકો આવે છે અને દેવદતથી બગાસું આવે છે. ધનંજય જીવિત અવસ્થામાં શરીરનું પોષણ કરે છે અને મર્યાદાની દેહમાં સરો પેદા કરી જલદીથી નષ્ટ કરવાનું કામ કરે છે.

આ માન્યતાઓ સર્વાંગપૂર્ણ નથી. જે સ્થાન પર જે પ્રાણનો નિવાસ બતાવાયો છે, ત્યાં એક પ્રકારનો વાયુનો ભ્રમર હોય છે અને ત્યાં પ્રાણનો વિશેષ સંચાર રહે છે. ગરમીના દિવસોમાં જલવાયુ ખૂબ ગરમ બની જાય છે, ત્યારે એક પ્રકારનો પવનનો ભ્રમર ઉત્પત્ત થાય છે, જે ધૂમતાં અને નાથતાં આંધીની માફક આગળ ચાલે છે. આ પ્રકારના કેટલાક ભ્રમર શરીરમાં મળી આવે છે.

સૂક્ષ્મ નિરીક્ષાણ કરવાથી માલ્યુમ પડે છે કે આ સ્થાનો ઉપર શરીરમાંના વાયુ અને પ્રાણની ઉભગતાને લીધી એક પ્રકારનું વમળયક ઉત્પત્ત થાય છે. વમળ સદા ઉપરથી પહોંણ હોય છે અને નીચેની બાજુએ સાંકંદું થતાં આખરે છેક નીચે નાનું વર્તુળ માત્ર રહી જાય છે. સૌથી ઉપરના ભાગને ‘સ્તર’ કહે છે અને નીચેના આણીદાર ભાગને બિંદુ કહે છે. આ રીતે પ્રાણવાયુના વમળના ઊર્ધ્વભાગને મહાપ્રાણ અને નીચેના ભાગને લઘુપ્રાણ કહેવામાં આવે છે. એક સ્તર છે જ્યારે બીજું બિંદુ છે. ખરી રીતે બંને એક જ મહાતત્ત્વના બે વિભાગ માત્ર છે.

ખરી રીતે જીવન ચલાવવું એ પ્રાણનું કાર્ય છે. હદ્યનો ધબકારો એ જીવનનું પ્રતીક છે. ધરિયાળમાં કમાનનો વળ સર્વ ચકોને ચલાવે છે. કમાનની ચાવી પૂરી થાય એટબે યંત્રોની ગતિ બંધ પડે છે. પ્રાણને લીધી હદ્ય ધબકે છે અને તેનાથી પછી રક્તસંચાર થાય છે, શાસ આવ-જ કરે છે. ત્યાર પછી શરીરની બીજી હિયાઓ થવા લાગે છે.

પ્રાણમાં શિથિલતા આવતાં જીવનશક્તિ પણ ઘઢી જાય છે. જીવનશક્તિ તદ્દન ઓછી થઈ જતાં હદ્યના

ધબકારા બંધ પડે છે. સમાધિ લગાવનારા મહાત્માઓનો પ્રાગ પર સંપૂર્ણ કાબૂ હોય છે. તેઓ લાંબા કાળ સુધી નિસ્તબ્ધ રહેવા છતાં જ્યારે ઈચ્છે ત્યારે પ્રાગનું સ્પંદન વધારી હૃદયના ધબકારા થડુકરી ટે છે અને સામાન્ય જીવન જીવા લાગે છે. જ્યાં સુધી એમના પ્રાગ ખેંચાઈને ભસ્તાંડમાં સ્થિર રહે છે, ત્યાં સુધી હૃદયના ધબકારા બંધ રહે છે અને શરીર નિશ્ચેષ થઈ જાય છે. આથી આવી વજિને લાંબા વખત સુધી સમાધિસુખ મળતું રહે છે.

પ્રાગ પર અધિકાર મેળવ્યા સિવાય લાંબા વખત સુધી સ્થિર સમાધિ લાગી શકતી નથી. પ્રાગ પર કાબૂ મેળવીને લાંબા વખત સુધી જીવન સ્થિર રાખવું અને ઈચ્છા પ્રમાણે મૃત્યુ લાવવું એ બિલકુલ સંભવિત છે. એક મનુષ્ય બીજાને પ્રાગદાન આપી શકે છે. નેમ એક માણસનું રહત બીજાના શરીરમાં પહોંચાડી શકાય છે, તેમ એક મનુષ્યનો પ્રાગ બીજામાં પ્રવેશી તેને જીવન અને મનોબળ આપી શકે છે.

‘અપાન’નું કાર્ય સ્થૂલ મળોનું સારી રીતે વિસર્જન કરવાનું છે. દેહની અંદર હમેશાં પેદા થતાં મળમૂત્ર, પરસેવો, કંદ, વિષ વગેરે વિજાતીય ત્યાજ્ય પદાર્થો છિંદ્રો દ્વારા હમેશાં શરીરની બહાર નીકળતા રહે છે. જે અપાન પોતાની આ કિયા બરાબર ન કરે તો શરીરની મળ નીકળવાની શક્તિ ઘટી જાય છે અને અપચો, શરદી વગેરે વિકારો પેદા થઈ જાય છે.

આ ઉપરાંત અપાનની સૂક્ષ્મ કિયા જનનેન્દ્રિયમાં થાય છે. કામવાસનાનો આધાર એના ઉપર રહ્યો હોય છે. મનને મથી નાખનારી, ચિત્તને અધીર, વ્યગ અને આતુર કરનારી વાસના અપાનથી જ ઉત્તેજિત થાય છે. એ જે શિથિલ થઈ જાય તો યુવાન પુરુષ પણ નાંસક બની જાય છે. સંતાનનું સૌંદર્ય, સ્વાસ્થ્ય, બુદ્ધિ, પરાક્રમ અને સ્વભાવ-એ બધું અપાનની સાથે જ સંબંધ ધરાવે છે. અપાનનો સાથી કૂર્મ લદ્યુપ્રાગ સુખ સ્થિતિમાં હોય તો શારીરિક દાખિએ પૂર્ણ આરોગ્યવાન હોવા છતાં ગર્ભની સ્થાપના કદાપિ થઈ શકતી નથી.

જ લ્લી-પુરુષોમાં અપાન સામ્ય હોય છે તેમને કામસેવનમાં અસાધારણ આનંદ મળે છે. કામતુષ્ટિ રૂપ-સૌંદર્ય ઉપર જ નહીં, પણ અપાનની સમાનતા ઉપર આધાર રાખે છે. પુરુષમાં અપાન અને લ્લીમાં કૂર્મ પ્રધાન હોય છે. તે અનેક શારીરિક તથા માનસિક અભાવોની પૂર્તિ કરે છે. અપાન પર અધિકાર જમાવવાની પદ્ધતિથી અજાગ હોવા છતાં જેને હઠપૂર્વક ભ્રસ્યાર્થ રાખવું પડે છે તેઓ કોઈને કોઈ રોગના ભોગ બનેલા જ હોય છે.

આને વિધુરો અને વિધવાઓ પૈકી મોટા ભાગના લોકોનું સ્વાસ્થ્ય ખરાબ જેવા મળે છે અને વસ્તી ગણતરીના રિપોર્ટોથી માલ્બુમ પડે છે કે ગૃહસ્થો કરતાં વિધુરોનું મરાગપ્રમાગ વધારે છે. નેમનામાં અપાનની સમાનતા હોય એ અનાયાસે સહન રીતે બહુ ગાઢ મિત્રો બની જાય છે. એવાઓને એકબીજા સાથે રહેવામાં ધારી શાંતિ મળે છે. આવા મિત્રો જ પ્રાગસાખા કહેવાય છે. એમને એકબીજાનો વિષોળ ધારું જ દુઃખ આપે છે.

‘સમાન’ પ્રાગ ઉદ્દરમાં નાભિની નીચે રહે છે. પાચન એનું મુખ્ય કાર્ય છે. ગરમી, ઉષગતા અને પિતુ ‘સમાન’નાં પ્રતીક કહેવાય છે. શરીરમાં ચંચળતા, સ્ક્રૂટિં, ઉત્સાહ, દોડાડોડી તથા ચમક વગેરે લક્ષણો એનાં જ દોતક છે. ચામડીની ચીકાશ, કોમળતા અને ચમકથી કુકલ પ્રાગનું અસ્તિત્વ જાળાય છે. ધારી ભૂખ લાગવી, અધિક આહાર લેવો, જલદી પચી જવું વગેરે સમાનની વિશેપાતા છે. જેનામાં આ પ્રાગની ઊણાપ હોય છે એ કંડી સહન કરી શકે નહીં. શિયાળાની ઝુકુમાં એનો ટેહ લથડેલો જ રહેવાનો. કાન, આંગળીઓ અને પગમાં એને ધારી કંડી લાગશે. કંડા પાણીથી કંડી ઝુકુમાં સ્નાન કરવું એને ધારું કષ્ટદાયક લાગશે. ધારું કપડાં પહેરવા છતાં પણ એને ખૂબ કંડી લાગશે.

એવા લોકોનું પેટ અલ્પ ભોજનથી ભરાઈ જશે. ગરમ પદાર્થો ખાવાની, તાપમાં અથવા અધિની પાસે બેસી રહેવાની એમને ઈચ્છા થયા કરશે. એવા લોકો પોતાની નિર્ભળતાના લીધે ગરમી સહન કરી શકશે નહીં, પણ ગરમીની મોસમ એમની પ્રકૃતિને અનુકૂળ રહેશે. ‘સમાન’ની ન્યૂનતાને લીધે શરીરમાં ઉષગતા હોણી રહે છે અને

એની પૂર્તિ ગરમીની ઝતુમાં થઈ જય છે. એવા લોકોની નાડી ધીમી ચાલે છે.

‘સમાન’ પ્રાગુનો આરોગ્ય સાથે ઘણો નિકટનો સંબંધ છે. ઇન્દ્રિયોની રસાનુભૂતિ સમાનના આધાર પર વધે કે ધેટે છે. સ્વાદિષ્ટ પદાર્થ, મનોરમ દાઢિ, મધુર ધ્વનિ, સુખદ સ્પર્શ, સુરભિત ગંધ વગેરેને સારી રીતે ગ્રહણ કરીને અમનો આનંદ લેવાની ક્ષમતા ‘સમાન’ પ્રાગુણ ધરાવનારમાં જ હોય છે. જેનો સમાન ઘટી જાય છે. તે સર્વ પ્રકારે સુખી હોવા છતાં પિંજી, અસંતુષ્ટ અને ધૂંધુંધાયેલો રહેશે. તેના દેહનું કોઈ ને કોઈ અંગ બીમારીનું કષ્ટ ભોગવતું જ રહેવાનું.

એવા લોકોને સત્ત્રિપાત, મોતીજરો વગેરે તીવ્ર રોગ તો નહીં થાય, પણ શરદી ખાંસી, પેટનું ભારેપણું, માથાનો દુઃખાવો, કમરનું દર્દ, દાંતોનું દુખવું, આંખાની કમજેરી, દેહનું તૂટવું, થાક વગેરે મંદ રોગો ધેરી રહેતા હોય છે. એકમાંથી છુટકારો મળે તે પહેલાં બીજાની થડાસ્ત થઈ જાય છે.

સમાન પિતુનું પ્રતીક છે. કુકલ કફનો પ્રતિનિધિ છે. બંને મળીને ‘વાત’ થાય છે. એ ત્રણેની વધધટ અને હેરેરથી બીમારી અને તંદુરસ્તીનું ચક્ક ફર્યા કરે છે. કહેવાય છે કે બીમારીનું મૂળ પેટમાં હોય છે. એનો અર્થ એ જ છે કે નાભિયકમાં રહેતા ‘સમાન’ મહાપ્રાગુણ અને ‘કુકલ’ લધુપ્રાગુણ જ આપણા સ્વાસ્થના સ્વામી છે. એમની પર કાબૂ મેળવી લેવામાં આવે તો કાયમી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.

‘ઉદાન’ પ્રાગુનો નિવાસ કંઈમાં છે. એ શ્રી અને સમૂહિકિનું સ્થાન છે. કંઈકુપની ‘સ્કુટા’ ના ઉતેજન માટે કંઈમાં સુવર્ણનાં આભૂષણો પહેરવામાં આવે છે. ‘સ્કુટા’ ઉપર ધાતુઓ તથા રનોનો પ્રભાવ પડે છે. તેથી એના આગકારો રન, કવચ, આભૂષણ, માળાઓ વગેરે ગળામાં ધારાગ કરે છે અને તેના સૂક્ષ્મ લાભો મેળવે છે.

‘ઉદાન’ પરિપુર્ણ થાય છે ત્યારે મનુષ્યમાં એવી યોગ્યતાઓ, સામર્થ્ય, શક્તિઓ, વિરોધતા અને ચતુરાઈનો સંચય થાય છે કે જેને લીધે સાંસારિક જરૂરિયાતની વસ્તુઓ અને પ્રચુર પ્રમાણમાં મળતી રહે છે. તૃષ્ણાઓનો તો અંત જ નથી. તેમને તો કુનેર પણ પૂરી કરી શકે નહીં, પણ જીવનોપ્યોગી કોઈ વસ્તુ એવી નથી જેને ‘ઉદાન’ પ્રાગુણના સામર્થ્યથી પ્રાપ્ત ન કરી શકાય. જેની ‘સ્કુટા’ ગંધિ જગૃત છે એ કદી અભાવગ્રસ્ત રહેતો નથી. એની દરેક સાચી આવશ્યકતા યોગ્ય વખતે પૂરી થાય છે.

‘દૈવદત્ત’ લધુપ્રાગુણ આધ્યાત્મિક સંપત્તિઓનો સ્વામી છે. આઠ સિદ્ધિઓ અને નવ નિધિઓ દૈવદત્તની સાથે સંબંધ રાખે છે. શાપ-વરદાન, દૂરદર્શન, દૂરશ્વવાગુણ, અણિગમા, લઘિમા, મહિમા વગેરે ચમત્કારોનું કેન્દ્ર પણ એ જ છે.

અમીર, સાધનસંપત્તિ, મોટો માણસ, વેપારી, ધનવાન, લક્ષ્મીપતિ બનવું, એને ધેર જન્મ લેવો, એવી જ જતની સહાયતા અચાનક મળી જવી, એવો અવસર-સગવડ અથવા મિત્ર મળી જવો વગેરેનો આધાર ઉદાન પ્રાગુણ જેની સહાયતા અચાનક મળી જવી, એવો અવસર-સગવડ અથવા મિત્ર મળી જવો વગેરેનો આધાર ઉદાન પ્રાગુણ જેની સહાયતા અચાનક મળી જવી ઉપર રહેલો છે. જ્યારે આ પ્રાગુણ નિર્બળ થઈ જાય છે ત્યારે લક્ષ્મીટેવી વિદ્યાય લેતાં વાર વગાડતાં નથી. એવું ભૂલભરેલું પગલું ભરી દેવાય છે અને એવી પરિસ્થિતિ ઉત્પત્ત થાય છે કે જેને લીધે વેપારમાં નુકસાન ઉપર નુકસાન થતું રહે છે અને ફટકા પડતા રહે છે, જેથી થોડા જ દિવસોમાં માણસ નિર્ધન અને દીનહિન બની જાય છે.

ન્યાં સુધી સ્કુટા જગૃત રહે છે ત્યાં સુધી મોટાં મોટાં નુકસાન થવા છતાં સ્થાયી રૂપમાં દરિદ્રતા આવી શકતી નથી, કેમ કે ‘સ્કુટા’માં ઉદાનના સંપર્કથી એક એવી ચૈતન્ય સ્કુરાગા ઉત્પત્ત થાય છે કે જે અદશ્ય લોકમાં છુહાયેલા ભવિષ્યનો પરિચય આપતી રહે છે. એને અજ્ઞાત રૂપે અનાયાસે એવો આભાસ થતો રહે છે કે આ કરવું સારું છે અને કરવું અનિષ્ટકારી છે. એક અજ્ઞાગુણ શક્તિ એને માર્ગદર્શન આપતી માલ્વમ પડે છે. એ એને મુશ્કેલીઓથી બચાવે

છે, આગળ જવાનો માર્ગ બતાવે છે અને કઠળ પરિસ્થિતિઓમાં મદદ કરે છે, જેથી દૂબતું વહાગ પાર થઈ જય છે. ઉદાન દ્વારા ચૈતન્ય સુદૂરાને શરીરવાસિની લક્ષ્મીજી કષ્ટાં છે.

જેના કંઠકૂપનો 'દેવદત્ત' પ્રબુદ્ધ (જગૃત) થાય છે એવો પુરુષ મહાચમત્કારી, પરમ સિદ્ધપુરુષ બની જય છે. એવી વ્યક્તિ પોતાના પ્રાણબળથી અદ્ભુત ઊથલપાથલ કરી શકે છે.

'વાન'નું સ્થાન મસ્તિષ્કના મધ્યભાગમાં છે. એ બીજા ચાર પ્રાણોનું નિયંત્રાગ કરે છે. બંને કાનોની વચ્ચે એક રેખા ખેંચવામાં આવે અને બીજી રેખા ભૂમધ્ય ભાગથી લઈને માથાના પાછલા ભાગ સુધી ખેંચવામાં આવે અને એ બંને રેખાઓ જ્યાં મળે તે સ્થાનને ત્રિકુટી કહેવામાં આવે છે. આ જ વાન'નું સ્થાન છે. એનો સહાયક લઘુપ્રાણ ધનંજય છે. વાનને કૃષ્ણ અને ધનંજયને અર્જુન કષ્ટો છે. આ ત્રિકુટીમાં યુદ્ધસ્થળીના મધ્યભાગમાં કૃષ્ણાર્જુન સંવાદ રૂપી ગીતાનો આવિભાવ થાય છે. મધ્ય મસ્તિષ્કમાં શતદળ કમળમાં સ્થિત થયેલા જે અમૃતકળશનું યોગશાસ્કોમાં વર્ણન છે તેને 'વાન' અને 'ધનંજય' નો પ્રસાદ જ માનવો જોઈએ.

'વાન'નું ઉત્થાન થવાથી ઝીતંભરા પ્રજ્ઞા મળે છે. જે ઉચ્ચ વિચારધારા જીવને આત્મકલ્યાણ તરફ ખેંચી જય તેને ઝીતંભરા પ્રજ્ઞા કહેવામાં આવે છે. સત્કર્મ, શુલ સંકલ્પ, સદ્ગુરૂત્વ વગેરે દેવી ગુરૂનો, કર્મ અને સ્વભાવોનો પ્રકાશ 'વાન' દ્વારા જ થાય છે. આત્મસાક્ષાત્કાર, ઈશ્વરદર્શન, બ્રહ્મપ્રાપ્તિ, દિવ્યદાસ્તિ તથા સમાધિનું કેન્દ્ર વ્યાન છે. વાનને ગરુડ પાણ કષ્ટો છે. ગરુડ એ ભગવાનનું વાહન છે. જેનો 'વાન' પ્રાણ જગૃત થયો હોય એના માનસમાં પરમાત્માના પ્રત્યક્ષ નિવાસનાં લક્ષણો જાગ્રાવા લાગે છે.

મસ્તિષ્કમાં અનેક શક્તિઓ છે, જેને લીધે મનુષ્ય પોતાની સર્વોપરી પ્રધાનતા સિદ્ધ કરે છે. સંસારમાં કેટલાય મહાપુરુષ એવા થયા છે, જેમની અદ્ભુત માનસિક યોગ્યતા અને પ્રતિભાએ લોકોને આશ્રમમાં નાંખી દીધા હતા. ધનંજય પ્રાણના વિકાસનો આ ચમત્કાર છે. મસ્તિષ્કમાં અનેક શક્તિઓનો નિવાસ છે. વ્યવસ્થાશક્તિ, શ્રહાશશક્તિ, નિર્ણયશક્તિ, રચનાશક્તિ, ઉપાર્નનશક્તિ, આમોદશક્તિ, ઉપકાંતિશક્તિ, અનુવર્તનનશક્તિ વગેરે અનેક શક્તિઓ મસ્તિષ્કમાં ભરેલી છે.

સર્વ પ્રકારની સારી કે ખરાબ, તુચ્છ અથવા મહાન શક્તિઓનો ભંડાર મસ્તિષ્ક છે. આ ભંડારની સુવ્યવસ્થા અથવા અભ્યવસ્થાનો આધાર ધનંજય પ્રાણ છે. જે કદાચ એમાં ક્ષતિ આવે તો મનુષ્યમાં અનેક માનસિક તુટીઓ ઉત્પત્ત થાય છે. એવા લોકો મૂર્ખ, મંદબુદ્ધ, ચિંતાગ્રસ્ત તથા દુઃખી હોય છે અને અડયાળોમાં સડતા રહે છે. કોઈ પાણ વ્યક્તિનો પૂર્ણ માનસિક વિકાસ તારે જ શક્ય બને છે કે જ્યારો એનો 'વાન' પ્રાણ સ્વર્થ હોય અને એનો મંત્રી ધનંજય જગૃત થઈને કામ કરે.

આ દસ પ્રાણોને સુધૂપ્ત દશામાંથી ઉઠાડીને જગૃત કરવા, એમાં ઉત્પત્ત થયેલી વિકૃતિઓનું નિવારણ કરવા, પ્રાણશક્તિ પર પરિપૂર્ણ અધિકાર જમાવવા અને આ મહાશક્તિ દ્વારા સાંસારિક અને આત્મિક જીવનને સુસંપત્ત બનાવવા માટે 'પ્રાણવિદ્યા'ને જાળવી ખાસ જરૂરી છે. જે આ વિદ્યાને જાગે છે એને પ્રાણસંબંધી ન્યૂનતા અને વિકૃતિથી ઉત્પત્ત થતી મુશ્કેલીઓ દુઃખ નહીં આપે.

પ્રાણવિદ્યાને હઠયોગ પાણ કરે છે. હઠયોગની અંતર્ગત આવેલા પ્રાણના પરિપાક માટે (૧) બંધ (૨) મુદ્રા (૩) પ્રાણાયામની સાધનાઓ બતાવી છે. ત્રણ બંધ, સાત મુદ્રા અને નવ પ્રાણાયામનું વર્ણન હવે આપવામાં આવે છે.

### ત્રણ બંધો

(૧) મૂલબંધ : પ્રાણાયામ કરતી વખતે શુદ્ધાના છિક્રને સંકોચીને પછી ઉપર તરફ ખેંચી રાખવું એને

મૂલબંધ કહેવાય છે. ગુદાને સંકોચવાથી અપાન સ્થિર રહે છે. વીર્યનો અધઃપ્રવાહ રોકાઈ સ્થિરતા પ્રાપ્ત કરે છે. પ્રાશની અધોગતિ અટકાને ઉર્ધ્વગતિ થાય છે. મૂલાધારમાં પણેલી કુંડલિનીમાં મૂલબંધથી ચૈતન્ય આવે છે, આંતરાં બળવાન થાય છે, મલાવરોધ મટે છે, ર્ખસંચારની ગતિ સારી રહે છે. અપાન અને કૂર્મ બંને ઉપર મૂલબંધની સારી અસર થાય છે. તે ને તંતુઓમાં ફેલાયેલા રહે છે એમનું સંકોચન થવાથી તે એક કેન્દ્રમાં એકત્રિત થવા લાગે છે.

(૨) જલધર બંધ : માથાને આગળની બાજુએ ઝુકાવી હડપચીને કંઠદૂપમાં લગાવવી એને જલધર બંધ કરે છે. જલધર બંધથી શાસ-પ્રશાસની ડિયા ઉપર સારો કાબુ મેળવાય છે. જ્ઞાનતંતુ બળવાન થાય છે. હઠ્યોગમાં બતાયું છે કે આ બંધથી સોળ જર્યાની નાડીઓ પર સારો પ્રભાવ પડે છે, (૧) પાદોંગુષ્ટ, (૨) ધૂંટી, (૩) ગોઠણ, (૪) સાથળ, (૫) સીવની, (૬) લિંગ, (૭) નાભિ, (૮) હદ્ય, (૯) શીવા, (૧૦) કંઠ, (૧૧) લંબિકા, (૧૨) નાસિકા, (૧૩) ભૂ, (૧૪) કપાળ, (૧૫) મૂર્ધા, (૧૬) બ્રહ્મરંધ્ર. આ સોળ સ્થાનો જલધર બંધનાં પ્રભાવક્ષેત્રો છે. વિશુદ્ધ ચકની જગૃતિ થવામાં જલધર બંધથી ઘણી સહાયતા મળે છે.

(૩) ઉડિયાન બંધ : પેટમાં આવેલાં આંતરાંને પીઠની તરફ ખેંચવાની ડિયાને ઉડિયાન બંધ કરે છે. પેટને ઉપર તરફ નેટલું ખેંચી શકાય એટલું ખેંચીને એને પાછળની બાજુએ પીઠની સાથે ચોટાડવાનો પ્રયત્ન આ બંધમાં કરવામાં આવે છે. મૃત્યુ ઉપર વિનય મેળવી આપનારો આંબંધ કહેવાય છે.

જીવનશક્તિની વૃદ્ધિ કરી દીધાર્યું સુધી જીવનને સ્વસ્થ રાખવાનો લાભ ઉડિયાન બંધથી મળે છે. આંતરાંની નિષ્ઠિયતા દૂર થાય છે, આંત્રપુર્ણ, જળોદર, પાંદુ, ય્યકૃતવૃદ્ધિ, બહુમૂત્ર નેવા ઉદર અને મૂત્રાશયના રોગો વગેરેમાં ઉડિયાન બંધથી ઘણો લાભ થાય છે. નાભિમાં રહેલા સમાન અને કુકલ પ્રાણોમાં સ્થિરતા આવે છે તથા વાત, પિત અને કફીની શુદ્ધિ થાય છે. સુષુપ્તા નાડીનું દ્વાર ખૂલી જાય છે અને સ્વાધિકાન ચકમાં ચેતના આવવાથી સ્વલ્પ પ્રયત્નથી એ જગ્રત બનવા પોત્ય રહ્ય જાય છે.

## સાત મુદ્રાઓ

(૧) મહામુદ્રા : ડાબા પગની એડાને ગુદા અને મૂત્રેન્દ્રયની વચ્ચેના ભાગ સીવની પર રાખવી અને જમાણો પગ લાંબો કરવો. લાંબા કરેલા જમાણા પગના અંગૂધાને બંને હાથથી પકડી રાખવો. માથાને ધૂંટણ સુધી નમાવવાનો પ્રયત્ન કરવો. ડાબા નસકોરાથી પૂરુષ શાસ લેવો અને થોડો વખત કુંભક કરી જમાણા નસકોરાથી રેચક પ્રાણાયામ કરવો. શરૂઆતમાં આવા પાંચ પ્રાણાયામ ડાબી મુદ્રાથી કરવા જોઈએ. ત્યાર પછી જમાણા પગને વાળી ગુદા ભાગમાં સીવની પર રાખી ડાબા પગને લાંબો કરી તેના અંગૂધાને બંને હાથથી પકડવાની ડિયા કરવી. આ વખતે જમાણા નસકોરાથી પૂરુષ શાસ લઈ કુંભક કરી ડાબા નસકોરાથી રેચક કરવો જોઈએ. આ મુદ્રા ડાબી બાજુએથી નેટલા વખતમાં થઈ એટલો જ વખત જમાણી બાજુએ પણ લેવો.

આ મહામુદ્રામાં કપિલ મુનીએ સિદ્ધ મેળવી હતી. આનાથી અહંકાર, અવિદ્યા, ભય, દ્વેષ, મોહ વગેરે પાંચ કુલેશોનું શમન થાય છે તથા ભગંદર, હરસ, સંગ્રહણી, પ્રમેહ વગેરે રોગો દૂર થાય છે, તેમજ શરીરનું તેજ વધે છે અને વૃદ્ધાવસ્થા દૂર ભાગે છે.

(૨) ખેચરી મુદ્રા : જીબને લાંબી કરીને એને ઉપરની તરફ વાળી તાળવાના ખાડામાં જીબના અચ્ચભાગને અટકાડવો એને ખેચરી મુદ્રા કરે છે. તાળવાના પાછલા ભાગમાં એક પોંચું સ્થાન છે, જેનાથી આગળ જતાં માંસની એક નાની સૂંધ નેટલું લટકું હોય છે, તેને પડજીબ પણ કરે છે. તેને જીબના અચ્ચભાગથી સ્પર્શ કરવાનો છે.

પ્રાચીનકાળમાં જીબને લાંબી કરવા માટે કેટલાક ઉપાયો કરવામાં આવતા હતા, તે વર્તમાનકાળની પરિસ્થિતિમાં જરૂરી નથી. જેવા કે (૧) પણુંનાં સ્લનોને જેવી રીતે દોહવામાં આવે છે તેવી રીતે જીબને દોહવી.

(२) જીબને મધ્ય, કાળાં મરી વગેરેથી મસળી તેના અચભાગને પકડીને બેંચવી. (૩) જીબની નીચેના નાડીનું તુંઓને કાપવા. (૪) લોખંડની સજીથી દબાવી જીબને લંબાવવી. આ બધી કિયાઓ દેશ, કાળ અને જ્ઞાનની વર્તમાન સ્થિતિને અનુકૂળ નથી. જેમ પ્રાચીનકાળની માફક અત્યારે હજારો વર્ષ સુધી નિરાહાર રહી કોઈ તપ્ય કરી શકતું નથી તેમ બેચરી મુદ્રા માટે જીબ વધારવાનું કષ્ટસાધ્ય કાર્ય અત્યારે અસામયિક છે.

કાળાં મરી અથવા મધ્યથી જીબ ઉપર હલકી માલિસ કરવાથી તાણાના તંતુઓમાં ઉતેજના આવે છે અને તેને વાળવામાં સહાયતા મળે છે. એવી જ રીતે જીબના અગ્ર ભાગને તાળવાના ખાડામાં અડકાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. જીબ ધીર ધીર ફરતી રહેવાથી તાળવાની હલકી માલિસ થતી રહે છે. આ વખતે દણ્ણ ભ્રમરોના મધ્યભાગમાં રાખવી.

બેચરીમુદ્રાથી પહુંચુંબમાં થઈને પ્રાણશક્તિનો સંચાર થવા લાગે છે અને સહસ્રદલ કમલમાંથી અમૃતરસ જરવા મારે છે. એનો આસ્વાદ લેવામાં દિવ્ય આનંદ મળે છે. પ્રાણની ઉર્ધ્વગતિ થવાથી મૃત્યુકાળ વખતે જીવ બ્રહ્મરંધ્રમાં થઈને પ્રયાણ કરે છે. આમ થવાથી એની મુક્તિ થાય છે અથવા સ્વર્ગમાં સદ્ગતિ પ્રાપ્ત થાય છે. ગુદા વગેરે અધોભાગથી જેના પ્રાણ નીકળે છે એ નશ્કળામી થાય છે. મુખ, નાક, કાન વગેરેથી જેના પ્રાણ જય છે તે મૃત્યુલોકમાં ભ્રમણ કરે છે, પરંતુ જેનો જીવ બ્રહ્મરંધ્રમાંથી જય છે તે અવશ્ય સદ્ગતિ પ્રાપ્ત કરે છે. બેચરીમુદ્રાની સહાયતાથી બ્રહ્માંડ સ્થિત શેષશાયી સહસ્રદલ નિવાસી પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. આથી આ મુદ્રા ધારી મહત્વપૂર્ણ છે.

**(૩) વિપરીતકરણી મુદ્રા :** મસ્તકને જમીન પર રાખી હાથને એની બંને બાજુઓ રાખવા. શરીરનો બધો ભાર મસ્તક અને કોણીઓ ઉપર લઈ પગને ઊચા કરી સીધા રાખવા. એને વિપરીતકરણી મુદ્રા કહે છે. એનું જ બીજું નામ શીર્ષસિન છે. મસ્તક નીચે અને પગ ઉપર હોવા એ એનું મુખ્ય લક્ષણ છે.

તાળવાના મૂળમાંથી ચંદ્રનાડી અને નાભીના મૂળમાંથી સૂર્યનાડી નીકળે છે. એ બંને ઉદ્ગમ સ્થાનોનો સંબંધ વિપરિત- કરણી મુદ્રા વારા થાય છે. ઝાંણપ્રાણ અને ધનપ્રાણનું આ મુદ્રાથી એકીકરણ થાય છે. એનાથી મસ્તિષ્ઠને બળ મળે છે.

**(૪) યોનિમુદ્રા :** આને ષર્મુખી પાણ કહે છે. પદ્મસનમાં બેસી બંને હાથના અંગૂઢાઓથી બંને કાન, બંને હાથની તર્દનીઓથી બંને આંખો, બંને મધ્યમાઓથી નાકનાં નસકોરાં તથા બંને અનામિકાઓથી મોંઢું બંધ કરી શાસ બેંચતાં બેંચતાં ગુદા સુધી લઈ જવો. પછી ઊલટા કમથી શાસને ધીર ધીર બહાર કાઢવો જોઈએ. યોનિમુદ્રાની આ સાધના યોગસિક્ષિતમાં ધારી ઉપયોગી થાય છે.

**(૫) શાંભવી મુદ્રા :** આસન લગાવીને બંને ભ્રમર વર્ચ્યે દણ્ણને સ્થિર કરી ભૂકુટિમાં ધ્યાન કરવું અને શાંભવી મુદ્રા કહે છે. કોઈ કોઈ જર્યાએ અર્ધી ઉઘાડાં નેત્રો અને ઉપર ચઢેલી કિંકીઓથી જે શાંતચિત્ત ધ્યાન થાય છે તેને પાણ શાંભવી મુદ્રા કહે છે. ભગવાન શાંભુએ આ જતની સાધના કરી તેથી એનું નામ શાંભવી મુદ્રા પહુંચું.

**(૬) અગોચરી મુદ્રા :** મનને બીજો ઠેકાણેથી વાળીને નાકના ટેરવા પર એકાગ્ર કરવું તેને અગોચરી મુદ્રા કહે છે.

**(૭) ભૂચરી મુદ્રા :** નાસિકાથી ચાર આંગળ દૂરના સ્થાન ઉપર બંને નેત્રોની દણ્ણ એક બિંદુ ઉપર કેન્દ્રિત કરવી.

આ સિવાય નભોમુદ્રા, મહાબંધ, શક્તિચાલિની મુદ્રા, તાડળી, માંડવી, અધોધારણ, આંભસી, વૈશ્વાનરી, વાયવી, નભોધારણા, અશ્વની, પાથની, માતંગી, કાકી, ધુંઅંગ વગેરે ૨૫ મુદ્રાઓનું ‘ધેરંડસંહિતા’માં સવિસ્તાર

વાર્ગન છે. આ સર્વે અનેક પ્રયોજનો માટે ધારી મહત્વપૂર્ણ છે. પ્રાણાયામ કોશના અનાવરણમાં જે મુદ્રાઓ ખાસ જરૂરી છે એવી સાતનું સંક્ષિપ્ત વાર્ગન આપવામાં આવ્યું છે. હવે ૮૬ જાતના પ્રાણાયામ પૈકી પ્રધાનપણે ખાસ ઉપયોગી એવા ૮ પ્રાણાયામનો ઉદ્ઘેખ નીચે કરવામાં આવે છે.

## નવ પ્રાણાયામ .

(૧) લોમવિલોમ પ્રાણાયામ : સિદ્ધાસન અથવા પભાસન ઉપર મૂલબંધ લગાવીને બેસવું. કરોડરણજીને સીધી રાખવો. અંદર ભરાયેલો શાસ બહાર કાઢી નાખવો. હવે ડાબા નસકોરાથી શાસ ભેંચવો. પછી જલંધર બંધ કરી, ઉદ્દિયાનબંધ કરી જમણા નસકોરામાંથી ધરિ ધરિ વાયુ બહાર કાઢવો. પછી એક સેફન્ડ વાયુ સિવાય રહેવું. ત્યાર પછી જમણા નસકોરાથી શાસ ભેંચો. થોડીવાર શાસ રોકો. પછી ડાબા નસકોરાથી હળવે બહાર કાઢવો. આવી રીતે બે પ્રાણાયામ થઈ જય છે.

(૨) સૂર્યભેદન પ્રાણાયામ : જમણા નસકોરાથી વાયુ ભેંચવો, યથાશક્તિ કુંભક કરવો અને ડાબા નસકોરાથી બહાર કાઢવો. આ ક્રિયા વારંવાર કરવી. આ જ સૂર્યભેદન પ્રાણાયામ છે. અનુલોમ, વિલોમ, પ્રાણાયામમાં બંને નસકોરાંથી પૂરુષ અને રેચક થાય છે, પરંતુ આ પ્રાણાયામમાં એક જ નસકોરાનો ઉપયોગ કરવાનો છે. (જમણાથી પૂરુષ અને ડાબાથી રેચક)

આ પ્રાણાયામથી શરીરમાં ઉખગતા વધે છે. તેથી એ હંડી પ્રકૃતિવાળાઓ માટે અથવા હંડીની ઝતુમાં વિશેષ ઉપયોગી થાય છે.

(૩) ઊંજાથી પ્રાણાયામ : મસ્તકને થોડું ઝુકવો. બંને નસકોરાંથી વાયુ ભેંચવાની ક્રિયા સિત્કાર બોલાવીને કરવી. ચાર-પાંચ સેકંડ સુધી કુંભક કરવો ત્યાર પછી ડાબા નસકોરામાંથી વાયુ બહાર કાઢવો. આ પ્રાણાયામમાં પૂરુષ, કુંભક અને રેચક બહુ થોડી માત્રામાં થાય છે. આમાં બંધનો પ્રયોગ કરવાની જરૂર નથી. હરતાં, ફરતાં, ઉઠતાં અને સૂતાં આ ઊંજાથી પ્રાણાયામ સહેલાઈથી થઈ શકે છે. રોગી લોકો પથારીમાં સૂતાં સૂતાં પણ કરી શકે છે. પેટના રોગો માટે આ ખૂબ ઉપયોગી છે. આનાથી પણ ઉખગતા વધે છે.

(૪) શીતકારી પ્રાણાયામ : બંને નસકોરાં બંધ કરીને જીબ અને હોઠોથી વાયુ ભેંચવો. યથાશક્તિ રોકી રાખવો અને પછી ધરિ ધરિ બંને નસકોરાંથી વાયુ બહાર કાઢવો.

દાંતોની વચ્ચે જીબને બહાર હોઠ સુધી કાઢી, હોઠોને કુલાવી મોઢી સિત્કાર કરતાં શાસ ભેંચવાની ક્રિયા આમાં મુખ્ય હોવાથી અને શીતકારી પ્રાણાયામ કરે છે. આ પ્રાણાયામમાં જીબની મદદથી વાયુ અંદર પ્રવેશ કરે છે. આ પ્રાણાયામ શીતળ છે. એટલા માટે ગરમ પ્રકૃતિવાળાઓને માટે તથા શ્રીભાગ્નિઝતુમાં એ ખાસ ઉપયોગી છે. શરીરને નિર્વિષ બનાવે છે. કહેવાય છે કે કક્ષબુણુંડીજીએ આ પ્રાણાયામથી સિદ્ધિ મેળવી હતી.

(૫) શીતળી પ્રાણાયામ : બંને નસકોરા બંધ કરવાં. હોઠોને કાગડાની ચાંચની માફક બનાવી જીબને હોઠોથી થોડીકી બહાર કાઢવી. પછી મુખ દ્વારા વાયુ ધરિ ધરિ અંદર ભેંચવો. યથાશક્તિ કુંભક કરી બંને નસકોરાં વાટે ધરિ ધરિ વાયુ બહાર કાઢવો. આ શીતળી પ્રાણાયામ કહેવાય છે. આ પણ શીતળ પ્રકૃતિનો છે અને રૂપ લાવણ્યને વધારે છે.

(૬) ભલ્લિકા પ્રાણાયામ : પભાસન લગાવીને બેસવું અને ડાબા નસકોરાથી વેગપૂર્વક જલદી જલદી સતત દશવાર પૂરુષ રેચક કરવા. કુંભક કરવાની જરૂર નથી. પછી અગિયારમીવાર ડાબા નસકોરાથી લાંબો પૂરુષ કરવો. યથાશક્તિ કુંભક કર્યા પછી જમણા નસકોરાથી વાયુ ધરિ ધરિ બહાર કાઢવો. આ ક્રિયાને જમણા નસકોરાથી ફરી પાછી કરવી. આ ભલ્લિકા પ્રાણાયામ થયો. શરૂઆતમાં આને પાંચ વારથી વધારે ન કરવો જોઈએ.

આ પ્રાણાયામ સમશીતોખણ છે. બ્રહ્મગ્રંથિ, વિષગુણંથિ અને દુદ્રગ્રંથિ- ત્રણેનું એ બેદન કરે છે. એના દ્વારા જાતીય મહાવિજ્ઞાન - ભાગ-૩

સુધુમશામાંથી પ્રાગુત્ત્વની વિહંગમ જતિ ઉર્ધ્વ પ્રદેશ તરફ થાય છે. તેનાથી અભિતત્ત્વ પ્રદીપ્ત થાય છે. આરંભમાં વધુ વેગથી વધારે સંખ્યામાં ન કરવો જોઈએ, કેમકે કુપ્પુસ કોષ ઉપર આધાત થવાનો ભય રહે છે.

(૭) ભામરી પ્રાગુણ્યામ : પદ્માસન લગાવીને નેત્ર બંધ કરીને બેસવું. ભૂકુટિના મધ્યભાગમાં ધ્યાન કરવું. જલંધર બંધ કરવો. પછી નાક દ્વારા ભ્રમરનાદની માફક ગુંજન ધ્વનિ કરતાં કરતાં પૂર્ક કરવો. પછી ત્રાણ સેકડ કુંભક જરીને ધીર ધીર ભ્રમર-ગુંજન ધ્વનિ સાથે રેચક કરવો. આ ભામરી પ્રાગુણ્યામ થયો.

કેટલાક યોગી બંને નસકોરાંથી વાયુ બેંચવા અને ધોડવાની તરફેણ કરે છે અને કેટલાક લોમવિલોમ પ્રાગુણ્યામની માફક ડાબા-જમાણા નસકોરાથી જ પૂર્ક રેચક કરવાનું શૈયસ્કર માને છે.

કુંભક વખતે અંદર રોકાયેલી હવાને મસ્તિષ્કમાં ડાબેથી જમાણી બાજુએ સતત ધૂમાવ્યા પછી રેચક કરવામાં આવે છે. આ ધૂમાવવાની કિયાના લીધે તથા ભ્રમરનાદ જેવો ધ્વનિ થતો હોવાને લીધે આ પ્રાગુણ્યામનું નામ ભામરી રાખ્યું છે. મનની એકાશતા અને પ્રાગુણી સ્થિતા માટે આ ખાસ લાભદાયક છે.

(૮) મૂર્છા પ્રાગુણ્યામ : બંને હાથના અંગૂઠાઓ બંને કાનોમાં અને તર્ફની બંને આંખો પર, બંને મધ્યમા નાસિકાનાં છિદ્રો પર તથા અનાસિકાઓ અને કનિછિકાઓ મુખ પર રાખી મૂલબંધ અને જલંધર બંધની સ્થિતિ પહેલાંથી છેદે સુધી કાયમ રાખી ડાબા નસકોરાથી પૂર્ક કરવો. યથાશક્તિ કુંભક કરી જમાણા નસકોરાથી રેચક કરવો. આ મૂર્છા પ્રાગુણ્યામ થયો.

આ પ્રાગુણ્યામમાં રેચક કરતી વખતે બંધ આંખોથી ભૂમધ્ય ભાગમાં ધ્યાન કરવાથી પંચતત્ત્વોના રંગો દેખાય છે. શરીરમાં જે તત્ત્વ અધિક હશે એનો રંગ વધારે દેખાશે. પૃથ્વીનો રંગ પીળો, જળનો સર્ફેન, અભિનો લાલ, વાયુનો લીલો અને આકાશનો રંગ વાદળી હોય છે. આ તત્ત્વોનું શોધન કરવાથી નાદાનુસંધાન તથા સમાધિમાં સુવિધા રહે છે.

(૯) પ્લાવિની પ્રાગુણ્યામ : પદ્માસન લગાવી બેસવું. બંને હાથને ઉપર લાંબા અને સીધા રાખવા. બંને નસકોરાંથી પૂર્ક કરવો અને સીધા સૂઈ જવું. સૂતી વખતે બંને હાથને ભેગા કરી ઓશિકાની માફક માથાની નીચે રાખવા. કુંભક કરવો અને જ્યાં સુધી કુંભક રહે તાં સુધી ભાવના કરવી કે માટું શરીર રૂની માફક હવું છે. ત્યાર પછી બેઢ થઈને પૂર્વવાદ સ્થિતિમાં આવી જવું અને ધીર ધીર બંને નસકોરાંથી વાયુને બહાર કાઢવો. આ પ્લાવિની પ્રાગુણ્યામ થયો. આનાથી રિદ્ધિઓ અને સિદ્ધિઓનો માર્ગ મોકલો થાય છે.

ક્યા પ્રાગુણ્યામને, કેટલી માત્રામાં, ક્યા પ્રયોજન માટે, કેવી રીતે જગૃત કરી શકાય એનો નિર્ણય કરવાનું કામ એટલું સહેલું નથી. સાધકની આત્મિક સ્થિતિ, સાંસારિક પરિસ્થિતિ, શરીરનું બંધારાશ, ઉંમર, મનોભૂમિ, સંસ્કાર વગેરેના આધારે જ વિચાર કરી શકાય કે વર્તમાન સ્થિતિમાં ક્યા પ્રકારની સાધના એના માટે ઈષ્ટ અને આવશ્યક છે. આ નિર્ણય કોઈ અનુભૂતિની નિષ્ગુતાની સલાહથી કરવો જોઈએ.

પ્રાગુમય કોશને સુવ્યવસ્થિત કરવા માટે સામાન્ય રીતે બંધ, મુદ્રા અને પ્રાગુણ્યામની કિયાઓ જ કરવામાં આવે છે. એમાં હેરફેર કરીને દશ પ્રાગુણોનાં ઉત્ત્રતિકારક વિધાન બનાવવામાં આવે છે. એમ છતાં કોઈવાર એવા અવસર પ્રાપ્ત થાય છે, જેમાં આવી સાધનાઓની કર્શી પાણ જરૂર પડતી નથી અને પ્રાગુવિદ્યામાં સાંગોપાંગ સફ્ફળતા મળી જય છે.

ગાયત્રીનું બીજું મુખ પ્રાગુમય કોશ છે. એ કોશને અનુકૂળ બનાવી લેવો એ વેદમાતાને પ્રસત્ર કરીને એના બીજા પુખથી આશીર્વાદ મેળવી લેવા સમાન છે. પ્રાગુમય કોશને શુદ્ધ અને જગૃત કરવો એ એક રીતે ગાયત્રી માતાની પ્રાગુમયી ઉપાસના છે. આને જ આત્મોત્ત્રાત્મિની બીજી ભૂમિકા કહી છે.

## ૬. મનોમય કોશ

પંચકોશો પૈકી ત્રીજો મનોમય કોશ છે. એને ગાયત્રીનું ત્રીજું મુખ પણ કષ્ટું છે. મન ધારું ચંચળ અને વાસનામય છે. સુખપ્રાપ્તિ માટે એ અનેક કલ્પનાઓ કર્યા કરે છે. કલ્પનાઓનાં એવાં રંગબેરંગી ચિત્રો એ તૈયાર કરે છે કે જે જેઠેને આપણી બુદ્ધિ બહેર મારી જાય છે. સુખપ્રાપ્તિ માટે એ કેટલીક વખત એવાં કામો હાથમાં બે છે કે જે બિલકુલ બિનજરૂરી હોય. એટલું જ નહીં, પણ એને માટે હાનિકારક પણ બને અને પાછળથી એ માટે એને પશ્ચાત્તાપ કરવો પડતો હોય. સારાં અને પ્રશંસનીય કાર્યોનો આધાર પણ મનની કલ્પના ઉપર રહેલો છે. મનુષ્યને નખની પતિતાવસ્થા તરફ ભેચી જવો અથવા એને માનવશરોમણી બનાવી ઉચ્ચ હેવોટિમાં વર્દી જવો એ મનનો જ ખેલ છે.

મન એ પ્રચંડ પ્રેરક શક્તિ છે. એ પ્રેરક શક્તિથી પોતાનાં કલ્પનાચિત્રોને એ એવાં સજ્જવ બનાવી દે છે કે મનુષ્ય તેને પ્રાપ્ત કરવા બાળકની માફક તેમની પાછળ દોડે છે, રંગબેરંગી પતંગિયાંની પાછળ નેમ બાળકો દોડતાં ફરે છે, એ જ્યાં જાય છે ત્યાં તેમને પણ જવું પડે છે, એ જ રીતે મનમાં નેવી કલ્પનાઓ, ઈચ્છાઓ, વાસનાઓ, આકાંક્ષાઓ, લાલસાઓ અને તૃષ્ણુગાઓ જાગે છે તે તરફ શરીરને પણ જવું પડે છે.

મનમાં સુખની આકાંક્ષા જ પ્રધાન રૂપે કામ કરે છે. એથી જે જે વાતોમાં અને જે જે દિશામાં એ સુખપ્રાપ્તિની કલ્પના કરી શકે છે, ત્યાં ત્યાં એ વાતોને અનુરૂપ એક સુંદર મનમોહક રંગબેરંગી યોજના તૈયાર કરી બે છે. પછી મગજ તેના તરફ લલચાય છે અને એ દિશા તરફ કામ કરવા મંડી પડે છે. એની સાથે સાથે જ મનની ચંચળતા પણ પ્રસિદ્ધ છે. એ નવી નવી કલ્પનાઓ કરવામાં બહુ હોશિયાર હોય છે. એક યોજના પૂરી ન થાય એટલામાં બીજી તૈયાર કરવા તરફ એ દોડી જાય છે. પહેલીને છોડીને બીજી તરફ દોડે છે અને બીજી પૂરી ન થાય એ પહેલાં ત્રીજાને પંકડવા દોડે છે. આ કામ ચાલ્યા જ કરે છે. એનો અંત આવતો નથી.

આ ગ્રાફારે અનેક અપૂર્વ યોજનાઓ ધૂટરી જાય છે અને નવી બનતી જાય છે. અનિયંત્રિત મનનો જ આ કાર્યક્રમ છે. મન મૃગતૃષ્ણાઓની નંજાળમાં મનુષ્યને ભટકાવ્યા કરે છે અને અસફળતાઓ અપૂર્વ યોજનાઓ અને અધૂરા કાર્યક્રમોની એક આખી જગ ઊભી કરીને જીવનને કટુ અને કર્કશ બનાવી દે છે.

ગીતામાં કષ્ટું છે કે ‘મન એ જ મનુષ્યનો શરૂ અને મિત્ર છે. બંધન અને મોક્ષનું કરાણ પણ મન જ છે.’ કાબૂમાં રાખેલું મન અમૃતતુલ્ય ગુણ આપે છે, જ્યારે અનિયંત્રિત મનને તો હળાહળ વિષની ઉપમા આપી છે, કારાગ કે મન ઉપર કોઈ પણ નિયંત્રણ અથવા કાબૂ નહીં હોય તો સૌથી પહેલાં ઈન્દ્રિયભોગોમાં એ સુખ શોધવા નીકળી પડે છે.

જીભને જતજાતના ચટકામટકા કરવાની લાલસા લાગે છે. રૂપ અને યોવનના કોત્રમાં કીડા કરવામાં મનને ઈદ્રના ઐશ્વર્ય સુખની જાંખી થાય છે. નૃત્ય, ગીત, વાદ્ય, મનોરંજન, સહેલસપાટા, મનોહર દશ્ય તથા સુવાસિત પદાર્થો અને એવું લોભાવે છે કે એમનાથી દૂર રહેવાની એને ઈચ્છા થતી નથી. સરકસ, થિયેટર સિનેમા, કલબ, ખેલ વગેરે મનોરંજનનાં કીડાસ્થળો અને ભારે રુચિકર લાગે છે, શરીરને શાશ્વતારવા અથવા આરામ આપવા માટે બહુમૂલ્ય વલ્લાભૂષણ, ઉપચાર; મોટર, વિમાન વગેરે વાહનો; કોમળ પલંગ, પંખા વગેરેની વ્યવસ્થાને નરૂરી માની બે છે.. આવા સર્વ ભોગો ભોગવાવા તથા વાહવાહ કરાવડાવા, અહંકારની પૂર્તિ કરવા તથા મોટા થવાનો શોખ પૂરો કરવાને માટે અધિકાધિક ધનની જરૂર પડવાની અને તેને માટે ધનસંચય કરવાની નવી નવી યોજનાઓ બનાવવાનું કામ કરવા માર્ગ છે.

અસંસ્કૃત અને સ્વચ્છંદ મન મુખ્યત્વે ઈન્દ્રિયના ભોગો, અહંકારની તૃપ્તિ અને ધનસંચયનાં ત્રાણ કોત્રમાં જાયત્રી મહાવિજ્ઞાન - ભાગ-૩

જ સુખની તૃપ્તિ શોધે છે. એના ઉપર કોઈ વાતનો અંકુશ ન હોવાથી એને ઉચિત અથવા અનુચિતનો વિચાર આવતો નથી અને ‘ગમે તે રીતે કામ પાર પાડવું’ વાળી નીતિ અપનાવવાથી એ જીવનને કુમાર્ગામી બનાવી દે છે. મનની ગતિ સ્વરચ્છંદ થઈ જવાથી બુલ્ધિનો અંકુશ પણ રહેતો નથી અને તેથી આખરે એક યોજના છોડી બીજુને પકડવામાં યોજનાઓના ગુણદોષની તપાસ કરવાની પણ તકલીફ લેવાનો ઈન્કાર કરે છે.

પાશ્વિક ઈચ્છાઓની તૃપ્તિ માટે અવ્યવસ્થિત કાર્યક્રમ બનાવવો અને તોડવો તથા એવી અવ્યવસ્થાના કારણે ને તકલીફો ઊભી થાય એમાં ભટકતા ફરજ અને ઢોકરો ખાતા રહેવું એવી કાર્યપ્રાણાલી સામાન્ય રીતે સ્વરચ્છંદ મનવાળાઓની હોય છે. એની પ્રતિક્રિયારૂપે જીવનભર કલેશ, અસંતોષ, પાપ, અનીતિ, નિંદા અને દુર્ગતિ જ થાય છે.

મનને વશમાં રાખવું એનો અર્થ એ છે કે એને બુલ્ધિપૂર્વક વિવેકના નિયંત્રણમાં રાખવું. બુલ્ધિ ને વાત વાજબી ઠરાવે, નેમાં કલ્યાણ જુઓ, આત્માનું હિત જુઓ, એનો લાલ અને સ્વાર્થ સમજે અને તેને અનુસરીને કલ્યાણાઓ કરાવીને યોજનાઓ ઘડવાની પ્રેરણ આપવાનું કામ જે મન કરે તો સમજવું કે મન વશમાં આવી ગયું. નાની નાની વાતમાં બીજાનજરી દોડાડોડી કરવી, નિરર્થક સંસ્મરણો અને કલ્યાણાઓમાં ભમણ કરવું એ અનિયંત્રિત મનનું કામ છે. જ્યારે મન વશીભૂત બની જય છે ત્યારે તો એને જે કામ સોંપવામાં આવે છે તેમાં બરોભર લાગી જય છે.

સૂર્યનાં કિરણો ચારે બાજુએ વિખરાયેલાં હોય છે તો એનો કોઈ ખાસ ઉપયોગ થતો નથી, પણ જે બિલોરી કાચ વડે એ જ કિરણોને એકનિત કરવામાં આવે તો જરા જેટલી જયના તાપથી અજિન સણગી ઉડે છે. એક-બે ઈચ્છના ક્ષેત્રમાં ફેલાયેલા તાપનું કેન્દ્રીકરણ બયેકર દાવાનળ સર્જવાની શક્તિ ધરાવે છે. મનની વિખરાયેલી કલ્યાણા, આકાંક્ષા અને પ્રેરણાશક્તિને પણ જે એક કેન્દ્રબિંદુ ઉપર એકત્ર કરવામાં આવે તો એના પરિણામ માત્રથી આપણને આશ્રય થશે.

મનની એકાગ્રતા અને તન્મયતામાં એટલી પ્રયંક શક્તિ છે કે એ શક્તિની તુલના સંસારની બીજી કોઈ પણ શક્તિની સાથે થઈ શકે તેમ નથી. અન્યાર સુધી ને કોઈ વિદ્વાન, લેખક, કવિ, વેજાનિક, સંશોધક, નેતા અને મહાપુરુષ થયા છે એવા દરેકે મનની એકાગ્રતાથી જ પોતાના ક્ષેત્રમાં સિદ્ધ મેળવી છે.

પાતંજલિ મુનિએ ‘યોગ’ શબ્દની વાખ્યા કરતાં કહ્યું છે કે “યોગસ્વિત્વુત્તિ નિરોધः” અર્થાત્ ચિત્તની વૃત્તિઓને રોકવી અને એકાગ્ર કરવી એ જ યોગ છે. યોગસાધનાનું વિશાળ કર્મકાંડ એટલા જ માટે યોજયું કે ચિત્તની વૃત્તિઓ ગતિ કરે. આ કાર્યમાં સફળતા મળતાની સાથે જ આત્મા પોતાના પિતા પરમાત્મામાં રહેલી સમસ્ત રિદ્ધિસિદ્ધિઓનો સ્વામી બની જય છે. વશીભૂત થયેલું મન એવું શક્તિશાળી હથિયાર છે કે તેનો જ્યાં ઉપયોગ કરો ન્યાં આશ્રયજનક ચમત્કાર કરશે. સંસારના કોઈ પણ કાર્યમાં એ શક્તિને લગાવો ત્યાં સફળતા જ મળશે. ધન, એશ્ર્ય, નેતૃત્વ, પ્રતિભા, યથ, વિદ્યા, સ્વાસ્થ્ય, ભોગ વગેરે જે કોઈ વસ્તુ તમારે જેઠી હોય તે વશવર્તી મનના પ્રયોગથી તમે અવશ્ય પ્રાપ્ત કરશો. સંસારની પણ કોઈ શક્તિ આ પ્રાપ્તિમાં અહયાણ નાંખી શકશે નહીં.

ભૌતિક પદાર્થો જ નહીં, પણ પરમાણુક આકાંક્ષાઓ પણ એ પૂર્ણ કરે છે. ‘સમાધિ-સુખ’ મનોબળનો જ એક ચમત્કાર છે. એકાગ્ર મનથી કરેલી ઉપાસનાથી ઈષ્ટેવનું સિંહાસન પણ હાલી જય છે અને એમને, ગરુડને છોડીને ખુલ્લા પગે ગન્યને બચાવવા જેમ ભાગવું પદ્ધું હતું તેમ ભાગવું પડે છે. અધૂરા મનથી કરેલી સાધના અધૂરી અને સ્વલ્પ હોવાથી ઓછું ફળ આપે છે, પણ એકાગ્ર વશવર્તી મન તો એ લાલ કાળાવારમાં મેળવી શકે છે, જે મેળવવાને યોગી લોકોને જન્મજન્માંતર સુધી તપશ્ચર્યા કરવી પડે છે. સદન કસાઈ, ગળિકા, ગીધ, અજમિલ વગેરે ભસંઘ્ય પાપીઓ જીવનભર દુષ્કર્મો કરતા હતા, ઇતાં પણ તેઓ પ્રભુ પ્રત્યેના કાળાવારના આર્તનાદથી આ સંસારસાગર

તरी गया.

मेस्मेरिज्म, हिप्नोटिज्म, पर्सनल मेनेटिज्म, मेन्टल थेरेपी, आक्लट सायन्स, मेन्टल हीलिंग, स्प्रिंग्युअलिज्म वगेरेना चमत्कारोंथी पश्चिमना देशोने भूब घेलुं लाग्युं छे. तंत्रज्ञिया, यंत्रज्ञित, प्राणविनिमय, सवारीविद्या, छायापुरुष, पिशाचसिद्धि, शबसाधना, दृष्टिबंध, अभियार, धात, चोकी, सर्प कीलन, जहु वगेरे चमत्कारोंनो भारतवासीओने धारा लांबा वर्षतथी परिचय छे. ऐमना माटे आ वस्तुओं कई नवी नथी. आ सर्व लीला एकाथ मननी प्रयंड संकल्पशक्तिनो नानकडो विनोद मात्र छे.

संकल्पनी पूर्ण शक्तिथी आपारा पूजनीय पूर्वजे सारी रीते परिचित हता. तेमना महान आध्यात्मिक गुणोने लीधे तेमागे समस्त भूमंडल पर चक्करी साम्राज्य स्थाप्युं छतुं, जेने जगद्गुडु कहीने आजे पाण लोको पूजे छे. तेमनी संकल्पशक्तिना प्रभावथी भूलोक, स्वर्गलोक, पाताललोक वगेरेनो संबंध पाठोशना महोद्धानी माफ्क धारो नज्ञक्त्वा थर्दी गयो हतो. आ शक्तिना नाना नाना भौतिक चमत्कारोंथी अनेक वक्तिओभे रावारुनी माफ्क उच्छव्यकूट करी हती, पाण मोटा भागना योगीओभे मननी एकाथताथी उत्पन्न थती प्रयंड शक्तिनो उपयोग पोतानुं अने पारकानुं साच्युं कल्याण करवामां ज कर्यो हतो.

अर्जुनने स्पष्ट आल हतो के मनने वश करी लेवाथी केटली अद्भुत सिद्धिओ मणी शक्ते छे. एटला माटे गीतामां भगवान कृष्णने ओगे पूछ्युं छे के 'हे अच्युत ! मनने वश करवानी विद्या मने बतावो, केम के अने वशमां लेवुं कठाण काम छे.' महत्वपूर्ण वस्तुओनी प्राप्ति खेमेशा मुखेल ज होय छे. वशमां लीधेलुं मन भूलोकनुं कल्पवृक्ष छे. ऐवा महान पदार्थने सिद्ध करवानुं काम अध्युं ज होय.

अर्जुने साच्युं ज कह्युं छे के मनने वशमां लेवानुं काम वायुने वशमां लेवा समान अध्युं छे. वायुने यंत्रनी मद्दथी नणाकारमां भरी शकाय छे, पाण मनने वशमां लेवानुं कोई यंत्र नथी.

भगवान कृष्णो मनने वशमां लेवा माटे अर्जुनने बे उपाय भताया : (१) अभ्यास, (२) वैराग्य. अभ्यासनो अर्थ योगसाधनाओ छे, जे मनने रोके छे. वैराग्यनो अर्थ व्यावहारिक ज्ञवनने संयमशील अने व्यवस्थित बनावतुं ते छे. विषयविकार, आणस, प्रमाद, हुर्व्य, हुराचार, लोलुपता, समयनो हुरुपयोग, कार्यकमनी अस्तत्वस्तता वगेरे कारारुओंथी सांसारिक अधोगति थाय छे अने लोल, मोह, कोध, तुष्णाथी मानसिक अधःपतन थाय छे.

शारीरिक, मानसिक अने सामानिक भूराईओंथी अलिख रहीने साढुं सरण, आदर्शवादी शांत ज्ञवन ज्ञवानी कणा ए वैराग्य क्लेवाय छे. केटलाक माणसो ऐम समन्जे छे के धर छोडीने भीझनो टुकडो मागता फर्खुं, विशित वेश सजवो, अव्यवस्थित कार्यकमधी ज्यां त्यां भटकवुं ए वैराग्य छे, परंतु तेवा उटपटांग ज्ञवनथी तो पाइलथी हेरान थाय छे. रागद्वेषधी निवृत्त थवुं ए वैराग्यनो साचो अर्थ छे.

भराब भावनाओ अने टेवोथी भयवानो अभ्यास करवा माटे ऐवा वातावरणमां रहेवानी जडूर छे के ज्यां ऐनाथी भयवाना प्रसंगो मणे. तरवानी कणा जागवा माटे पाणीनी जडूर होय छे. तरवानो प्रयत्न करवो एटले पाणीमां दूबवाना भयथी भयवानी योज्यता मेणववी. पाणीथी दूर रहीने तरवानुं शीझी शकाय नहीं. एटला माटे रागद्वेष ज्यां उत्पन्न थाय छे ए क्षेत्रमां रहीने ए भूराईओ उपर विन्य मेणववो ऐमां ज वैराग्यनी साची सङ्केता छे.

कोई वक्ति नंगलमां नदी एकांतवासमां रहे तो ए वैरागी थर्दी गर्दी ऐम न क्लेवाय, केम के नंगलमां ऐना वैराग्यनी परीक्षा थर्दी शक्ती नथी. परीक्षा मारक्षत ज्यां सुधी ए जाणी लेवामां न आवे के राग उत्पन्न करनारा अवसर होवा छतां आपागे ऐमना उपर विन्य मेणवी शक्या, त्यां सुधी ऐवो एकांतवासी वस्तुतः वैरागी छे ऐम

કહેવાય નહીં. પ્રલોભનોને જીતવાં એ જ વૈરાગ્ય છે. જ્યાં બૂરાઈઓનું અસ્તિત્વ હોય ત્યાં જ આવી જીતને વિજય કરી શકાય. એટલા માટે ગૃહસ્થ તરીકે સાંસારિક જીવનમાં સુખ્યવસ્થિત રીતે રહીને રાગ ઉપર વિજય મેળવવો એ જ વૈરાગ્ય છે.

અભ્યાસ માટે યોગશાસ્કોમાં એવી કેટલીયે સાધનાઓનું વાર્ણન છે કે જેનાથી મનની ચંચળતા, દોડાડોડી, વિષય લોલુપતા અને એખાણાઓને રોકીને એમને ઝતંભરા બુદ્ધિને તથા અંતરાત્માને આધીન કરી શકાય છે. આવી સાધનાઓને ‘મનોમય’ યોગ કહે છે. મનોમયની અંતર્ગત (૧) ધ્યાન, (૨) નાટક, (૩) નાય, (૪) તન્માત્રા સાધના - એ ચાર સાધના મુખ્યત્વે કરવામાં આવે છે. એ ચારેય મનોમય કોશની સાધનામાં બહુ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

## ધ્યાન

ધ્યાન એ એવી માનસિક પ્રક્રિયા છે કે જેમાં કોઈ વસ્તુની સ્થાપના આપાગું મનઃક્ષેત્રમાં કરવામાં આવે છે. માનસિક ક્ષેત્રમાં સ્થાપિત કરેલી વસ્તુ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બને છે. આ આકર્ષણની તરફ મગજની ધ્યાણી ખરી શક્તિઓ બેંચાય છે. ચુંબક પોતાની ચારે બાજુએ વિભરાયેલા લોંગંડા કાળોને બધી દિશામાંથી બેંચી લાવીને પોતાની પાસે એકન્ન કરે છે. એ જ રીતે ધ્યાન દ્વારા બધી બાજુથી મન બેંચાઈને એક કેન્દ્રબિંદુ પર એકાગ્ર થાય છે, વિભરાયેલી ચિત્તવૃત્તિઓ એક જગ્યાએ કેન્દ્રિત થાય છે.

કોઈ આદર્શ લક્ષ્ય, ઈષ્ટ નિર્ધારિત કર્યા પછી એમાં તન્મય થઈ જવું એને ધ્યાન કહે છે. જેનું ધ્યાન કરવામાં આવે છે તેવો જ માણસ બને છે. જેમ બીબામાં ભીની માટી દબાવવાથી જેવું બીબું હોય તેવી આકૃતિ બને છે, તેવી રીતે કીટ અને ભ્રમરનું ઉદાહરણ પ્રસિદ્ધ છે. કીટને ભ્રમરી પકડી લાવે છે અને તેની ચારે બાજુએ સતત ગુંજન કરે છે. કીટ એ ગુંજનને તન્મય બનીને સાંભળે છે અને ભ્રમરનું ઇંપ, એની ચેષ્ટાઓને એકાગ્રભાવથી નિહાળી રહે છે. કીટનું મન ભ્રમરીમય થઈ જતાં એનું શરીર પાણ એ જ ઢાંચામાં ઠળતું જાય છે. એનાં રક્ત, માંસ, નસ, નાડી, ત્વચા વગેરેમાં પણ મનની સાથે પરિવર્તન થતું જાય છે અને થોડા જ વખતમાં પેલો કીડો મનથી અને શરીરથી અસલી ભ્રમર સમાન બની જાય છે. એ જ રીતે ધ્યાનશક્તિ દ્વારા સાધકનો સર્વાગપૂર્ણ કાયાકલ્પ થઈ જાય છે.

સાધારણ ધ્યાનથી મનુષ્યનું શરીર બદલાતું નથી. એને માટે તો વિશિષ્ટ રૂપથી ઊરી સાધનાઓ કરવી પડે છે, પરંતુ હક્કોઈ વિક્ષિત ધ્યાનસાધના કરીને માનસિક કાયાકલ્પ કરવામાં ભરપૂર લાભ ઉઠાવી શકે છે. અધિષ્ઠાઓએ એ વાત ઉપર ભાર મૂક્યો છે કે દરેક પોતાના ઈષ્ટદેવ પસંદ કરી લેવા જોઈએ. ઈષ્ટદેવની પસંદગીનો અર્થ છે - જીવનનું મુખ્ય લક્ષ્ય સ્થિર કરવું. ઈષ્ટદેવની ઉપાસનાનો અર્થ એ છે કે એ લક્ષ્યની ઉપર પોતાની સધળી માનસિક ચેતના તન્મય કરી દેવી. આ પ્રકારની તન્મયતાનું પરિશુદ્ધ એ આવે છે કે મનની ગમે ત્યાં વિભરાયેલી શક્તિઓ એક બિંદુ ઉપર એકન્તિત થાય છે. એક જગ્યાએ એકાગ્ર થવાના કારણે સર્વ માનસિક શક્તિઓ એ દિશામાં કામે લાગી જાય છે. પરિશુદ્ધ સાધક, ગુણમાં, તર્કમાં, સ્વભાવમાં, વિચારમાં, પ્રયત્નમાં અને કર્મમાં અદ્ભુત ગતિથી આગળ વધે છે. અને થોડા જ વખતમાં બહુ સરળતાથી પોતાના ઈષ્ટ લક્ષ્ય સુધી પહોંચી શકે છે. આને ઈષ્ટસિદ્ધિ કહેવામાં આવે છે.

ધ્યાનસાધન માટે આદર્શોને દિવ્ય રૂપધારી દેવતાઓના રૂપમાં સ્વીકારીને એમનામાં માનસિક તન્મયતા સ્થાપિત કરવાનું યોગશાસ્કોનું વિધાન છે. પ્રીતિ સજ્જતિઓમાં જ થાય છે. એટલા માટે લક્ષ્ય રૂપી ઈષ્ટને દિવ્ય દેહધારી દેવ માનીને એમાં તન્મય થવામાં ગૂઢ અને રહસ્યમય મનોવૈજ્ઞાનિક આધાર રહેલો છે. એક એક ઈષ્ટદેવ એક એક અભિવાસ અને આદર્શનું પ્રતીક છે. જેમ બ્રણનું મૂર્તિમાન સ્વરૂપ દુગાછે, ધનનું લક્ષ્મી છે, બુદ્ધિનું સરસ્વતી છે, તેમ ધાર્મિક સંપત્તિનું પ્રતીક ગાયત્રી અને ભૌતિક વિજ્ઞાનનું પ્રતીક સાવિત્રીને માનવામાં આવે છે. ગૌરી, પદ્મા,

શચી, મેધા, સાવિત્રી વિજયા, જ્યા, દેવસેના, સ્વધા, સ્વાહા, માતર, લોકમાતર, ધૂષિ, પુષિ, તુષિ અને આત્મહેવી એ સોળ પ્રસિદ્ધ માતૃકાઓ છે. શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રધંટા, કુષ્ઠાંડા, સ્ંદમાતા, કાત્યાયની, કાલચાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી એ નવજુગાંઓ છે અને તે દરેકની પોતપોતાની વિશિષ્ટતા છે.

એવું પણ બની શકે છે કે એક જ ઈષ્ટદેવને જરૂર પ્રમાણે વિભિન્ન ગુણવાળા પણ માનવામાં આવે. જુદાં જુદાં પ્રયોજનો માટે એક જ મહાશક્તિની કાલી, તારા, ખોડશી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ત્રિપુરા, લેરવી, બગલા, માતંગી, કમલા, ઈદ્રાણી, વેણુગવી, બ્રહ્માણી, કૌમારી, નરસિંહી, વારાહી, માહેશ્વરી, લેરવી વગેરે વિવિધ રૂપે ઉપાસના કરવામાં આવે છે. એક જ મહાગાયત્રીની હી, શ્રી, કલીં (સરસ્વતી, લક્ષ્મી, કાલી) નાં ત્રણ રૂપોમાં આરાધના થાય છે. એ ત્રણમાંથી આગળ જતાં અનેક બેદ થાય છે. જો સાધક માતૃશક્તિ કરતાં પિતૃશક્તિમાં વધારે તુચ્છ રાખતો હોય તો (જેને નારીવાચક શક્તિ કરતાં પુરુપત્ત્વપ્રધાન (પુષ્ટિંગ) દિવ્ય તત્ત્વમાં વિશેષ ચિત્ત વાગતું હોય તો) તે ગાંધેશ, કુલેર, હનુમાન, નૃસિંહ, લેરવ, શિવ, વિષુ વગેરે ઈષ્ટની ઉપાસના કરે છે.

અહીં કોઈએ પણ ભ્રમમાં પડવાની જરૂર નથી. “અનેક દેવવાદ” નો કોઈ સ્વતંત્ર આધાર નથી. ઈશ્વર એક જ છે. એની અનેક શક્તિઓને અનેક દેવોના નામથી પોકારવામાં આવે છે. મનુષ્ય પોતાની ઈચ્છા, તુચ્છ અને જરૂર પ્રમાણે પેલી ઈશ્વરીય શક્તિઓ મેળવવા અને પોતાના તરફ આકર્ષવા માટે પેલા દેવ અથવા દેવીને પોતાના ઈષ્ટ તરીકે પસંદ કરી લે છે અને એમાં તન્મય થવાની વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા એ શક્તિઓને સારા પ્રમાણમાં પોતાની અંદર ધારણ કરી લે છે. ઈષ્ટદેવની પૂજાનું આ રહસ્ય છે.

ધ્યાનયોગ-સાધનામાં મનની એકાગ્રતાની સાથે સાથે લક્ષ્યને, ઈષ્ટને પ્રાપ્ત કરી યોગસ્થિતિ ઉત્પત્ત કરવાનો બેવડો લાભ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલા માટે મન:ક્ષેત્રમાં ઈષ્ટદેવનું એ જ રીતે ધ્યાન કરવાનું વિધાન બતાયું છે. ધ્યાનનાં પાંચ અંગો છે: (૧) સ્થિતિ, (૨) સંસ્થિતિ, (૩) વિગતિ, (૪) પ્રગતિ, (૫) સંસ્મિતિ. આ બધાની ઉપર થોડોક પ્રકાશ નાખીશું.

**સ્થિતિનો અર્થ** છે સાધકની ઉપાસના કરતી વખતની સ્થિતિ. મંદિરમાં, નદીતટ, એકાંતમાં, સ્મશાનમાં, સ્નાન કર્યા પછી, સ્નાન વિના, પદ્માસનથી, સિદ્ધાસનથી, કર્દ બાજુએ મુખ રાખીને, કર્દ મુદ્રામાં, કયે વખતે, કર્દ રીતે ધ્યાન કરવામાં આવે વગેરે વ્યવસ્થાને સ્થિતિ કહે છે.

**સંસ્થિતિનો અર્થ :** ઈષ્ટદેવની છબીનું નિર્માણ, ઉપાસ્ય દેવનાં મુખ, આકૃતિ, આકાર, મુદ્રા, વખ, આભૂષણ, વાહન, સ્થાન, ભાવ વગેરે નિશ્ચિત કરવાના કાર્યને સંસ્થિતિ કહે છે.

**વિગતિનો અર્થ ગુણાવલી** છે. ઈષ્ટદેવમાં કર્દ વિશેપતાઓ, શક્તિઓ, સામર્થ્ય, આદતો, પરંપરાઓ તથા ગુણાવલીઓ છે તે જાણવું એને વિગતિ કહે છે.

**પ્રગતિનો અર્થ :** ઉપાસનાકાળમાં સાધકના મનમાં રહેલી ભાવનાને પ્રગતિ કહી છે. દાસ્યભાવ, સભાભાવ, ગુરુભાવ, બંધુ, ભિત્ર, માતા, પિતા, પત્ની, પુત્ર, શત્રુ વગેરે ને ભાવથી ઉપાસ્ય દેવને માનવા હોય તે ભાવની સ્થિરતા તથા એ ભાવને મજબૂત બનાવવા માટે ઈષ્ટદેવને મુખ્ય ધ્યાનાવસ્થામાં પોતાની એ આંતરિક ભાવનાઓને વિવિધ શબ્દો તથા ચેષ્ટાઓ દ્વારા ઉપસ્થિત કરવી તેને પ્રગતિ કહી છે.

**સંસ્મિતિનો અર્થ:** આ એવી અવસ્થા છે કે જેમાં સાધક અને સાધ્ય અથવા ઉપાસક અને ઉપાસ્ય એક બની જાય છે. બંનેમાં કોઈ બેદ રહેતો નથી. ભમરી અને કિડાની તન્મયતા, દૈતના સ્થાને અદ્વૈતની ઝાંખી, ઉપાસ્ય અને ઉપાસકનો બેદ “હું પોતે ઈષ્ટદેવ થઈ ગયો છું અથવા ઈષ્ટદેવમાં મૂર્ગ લીન થઈ ગયો છું” એવો સ્પષ્ટ અનુભવ થવો વગેરેને સંસ્મિતિ કહે છે. કાષ અભિમાં પદ્મા પછી અભિમય લાલ રંગનું બની જાય છે, તે જ રીતે પોતાની સ્થિતિ

ઉપાસ્ય દેવ જેવી બની જવાનો અનુભવ થવો તેને સંસ્કૃતિ કહે છે.

એક જ ઈષ્ટેવતું જુદાં જુદાં પ્રયોજનો માટે જુદી જુદી રીતે ધ્યાન થાય છે. સાધકની વ્ય, મર્ગદા, સ્થિતિ, મનોભૂમિ, વાર્ગસંસ્કાર વગેરેના આધારે ધ્યાનની વિધિઓમાં ઘણો તફાવત પડે છે. એનું સવિસ્તાર વાર્ગન અહીં શક્ય નથી. અહીંયાં મારો હેતુ તો કોશને વ્યવસ્થિત કરવા માટે ધ્યાન મારફતે મનને એકાગ્ર કરવાની, કાબૂમાં લાવવાની વિધિ બતાવવાનો છે. આને માટે કેટલાંક ધ્યાન નીચે આપવામાં આવે છે.

(૧) ચીકણા પથ્થર અથવા ધાતુની ગાયત્રીની સુંદર પ્રતિમા બેવી. એને સારી રીતે શાળગારેલા એક આસન ઉપર સ્થાપવી. દરરોજ જળ, ધૂપ, દીપ, ગંધ, નૈવેદ્ય, અક્ષત, પુષ્પ વગેરે માંગલિક દ્રવ્યોથી એની પૂજા કરવી. આ પ્રકારનું એનું નિત્ય પૂજન નવા સાધકોની શ્રદ્ધા વધારનારું અને તેમનું મન આ દિશા તરફ વાળનારું છે. સાધનામાંથી અસુખિ દૂર કરીને દુઃખ ઉત્પન્ન કરવી એ આ પાર્થિવ પૂજનનું પ્રથમ સોપાન છે. મંદિરમાંની મૂર્તિપૂજા નવા સાધકો માટે સાધનાની શરૂઆત કરવા માટે ધારી ઉપયોગી છે.

(૨) શુદ્ધ થઈને પૂર્વ દિશા તરફ મુખ કરીને દર્ખના આસન ઉપર પદ્માસન વાળીને બેસવું. સામે ગાયત્રીનું ચિત્ર રાખીને વિશેષ ચિત્ર લગાડીને એની મુખાકૃતિ અને અંગ-પ્રત્યંગોનું નિરીક્ષણ કરવું. પછી નેત્રો બંધ કરવાં. આ ધ્યાનથી ચિત્રની બારીકાઈઓ ધ્યાનાવસ્થામાં પણ સારી રીતે દેખાશે. આ પ્રતિમાને માનસિક સાણંગ પ્રાણામ કરવા અને જવાબમાં તમને આર્થીવાદ મળ્યા છે એવો અનુભવ કરવો.

(૩) એકાંત સ્થાનમાં સ્થિર બેસવું. ધ્યાન કરવું કે આખા નીલવાર્ણિ આકાશમાં બીજી કોઈ વસ્તુ નથી, માત્ર સૂર્ય પોતાનાં સુવાર્ગમય કિરાગો સાથે પૂર્વ દિશામાં ચમકી રહ્યો છે. ધ્યાનાવસ્થામાં આ સૂર્યને બહુ જ ધ્યાનપૂર્વક જુઓ. એની વચ્ચે હંસારૂઢ માતા ગાયત્રીની છબી બહુ જ જાંખા રૂપમાં દેખાશે. અભ્યાસથી આ છબી ધીર ધીર સ્પષ્ટ દેખાતી થશે.

ભાવના કરોકે ‘આ ગાયત્રી-સૂર્યનાં સુવાર્ગમય કિરાગો મારા ઉધાડા શરીર ઉપર પડે છે અને તે મારા રોમેરોમમાં પ્રવેશ કરી પોતાના દિવ્ય પ્રભાવથી મારા દેહનાં સ્થૂળ-સૂક્ષ્મ બધાં અંગોને પ્રકાશથી તેજસ્વી બનાવે છે.’

(૪) દિવ્ય તેજયુક્ત, અત્યંત સુંદર અને દિવ્ય વસ્તો તથા આભૂષણોથી વિલૂષિત માતા આકાશમાં બેઠી હોય એવું ધ્યાન કરો. કોઈ સુંદર ચિત્ર ઉપરથી આવું ધ્યાન કરવામાં ઘણી સુગમતા થશે. વિશેષ ધ્યાનથી માતાના એક એક અંગને નિહાળો. એની મુખાકૃતિ, એની ભાવનામય ચેષ્ટા તથા ચિંતન્યુક્ત લલાટ ઉપર ખાસ ધ્યાન આપો અને તમને જાણાશે કે માતા પોતાની અસ્પષ્ટ ચેષ્ટા અને સંકેતો દ્વારા તમારા દિલમાં કોઈ નવીન ભાવોનો સંચાર કરી રહી છે.

(૫) શરીરને બિલકુલ ઢીલું કરી દો. આરામખુરશી, તકિયો અથવા દીવાલનો આશરો લઈને શરીરની તમામ નસ-નાડીઓ નિર્જવ થઈ ગઈ હોય તેવી રીતે શિથિલ કરી દો અને ભાવના કરોકે ‘સુંદર આકાશમાં અત્યંત ઊચાઈ પર રહેલા ધ્રુવતારામાંથી નીકળીને નીલવાર્ણનું એક શુભ કિરાગ અમૃતધારની માફક તમારા તરફ ચાલ્યું આવે છે અને તમારા હદ્ય તથા મસ્તિષ્કમાં ઝતંભરા બુદ્ધિના રૂપમાં અથવા તરણ-તારણી પ્રજ્ઞાના રૂપમાં પ્રવેશ કરી રહ્યું છે. એ પરમ દિવ્ય અને પ્રેરક શક્તિને પ્રાન્ત કરીને સમુદ્રમાં જેમ ભરતી ચેઢે છે તેમ તમારા હદ્યમાં સદ્ભાવના અને મસ્તિષ્કમાં સદ્વિચારની ભરતી આવે છે. જે ધ્રુવતારામાંથી આ દિવ્ય તેજ નીકળ્યું છે તે સત્ત્વોકની નિવાસી ગાયત્રી માતા જ છે.

(૬) ભાવના કરોકે ‘નેમ ભાળક પોતાની માતાનો ખોળો ખૂંટે છે, ખોળામાં નાચકૂદ કરે છે તેમ હું ગાયત્રી માતાના ખોળામાં રમું છું અને કિલ્લોલ કરું છું.’

(૭) મેરુંડ (કરોડરનજુ) ને સીધો કરીને પદ્માસનમાં બેસો. આંખ બંધ કરો. ભરમોની વર્ણેના ભાગમાં (ભૂકૃતિ ઉપર) શુભ વર્ણના દીપકની માફક દિવ્ય તેજનું ધ્યાન કરો. આ તેજ વિદ્યુતકેન્દ્રની માફક કિયાશીલ થઈ પોતાની શક્તિઓને પોષણ અને પ્રેરણા આપી રહ્યું છે એવો વિશ્વાસ કરો.

(૮) ભાવના કરો કે 'તમારું શરીર એક સુંદર રથ છે. એમાં મન, બુદ્ધિ, ચિન્તાને અહંકારદૂપી ચાર ધોડાઓ જોડેલા છે. આ રથમાં દિવ્ય તેજવાળી માતા વિરાજમાન છે અને ધોડાની લગામ તેજો પોતાના હાથમાં પહેલી છે. જે ધોડો તોફાન કરે તેને ચાબુકથી ફટકારી, લગામ ભેંચી, એને સીધે રસ્તે ચાલવાની ફરજ પાડવામાં સહી થાય છે. ધોડાઓ પણ માતાની ધાકથી લાચાર બની તેના અંકુશનો સ્વીકાર કરે છે.'

(૯) હદ્યસ્થાનની બાજુમાં આવેલા સૂર્યચકમાં સૂર્યના પ્રકાશનું ધ્યાન કરો. 'આ આત્માનો પ્રકાશ છે. એમાં માતાની શક્તિ ભણે છે અને પ્રકાશ વધે છે. આ વધેલા પ્રકાશમાં આત્માના સાચા સ્વરૂપની જાંખી થાય છે. સૂર્યચક એ આત્મસાક્ષાત્કારનું કેન્દ્ર જ છે.'

(૧૦) ધ્યાન કરો કે 'ચારે બાજુ અંધકાર જ છે. એમાં હોળીની માફક પૃથ્વીથી લાગેના આકાશ સુધી પ્રચંડ તેજ ફરી વળેલું છે. એમાં પ્રવેશ કરવાથી મારા શરીરનું પ્રત્યેક અંગ અને મનઃક્ષેત્ર એ તેજની સમાન અભિનય થઈ ગયાં છે. મારાં સધળાં પાપ, તાપ, વિકાર, કુસંસ્કાર બિલકુલ ભસ્મીભૂત થઈ જઈને શુદ્ધ સચ્ચિદાનંદ બાકી રહ્યો છે.'

ઉપર સુગમ અને સર્વોપયોગી એવી ધ્યાનની કેટલીક રીતે બતાવી છે. આ સર્વે સરળ અને સાદી છે. આને માટે ખાસ નિયમપાલનની જરૂર નથી. શુદ્ધ થઈને સાધનાના સમયે ઉપર બતાવેલી પદ્ધતિથી ધ્યાન કરવું ઉત્તમ છે. તેવી જ રીતે બીજા સમયે પાગ જ્યારે ચિન્તાંત હોય ત્યારે આ પૈકી રૂચિ હોય એવું ધ્યાન કરી શકાય છે. આ ધ્યાનમાં મનનો સંયમ અને એકાગ્રતા કરવાની ભારે શક્તિ છે. સાથે સાથે ઉપાસનાનો આધ્યાત્મિક લાભ મળતાં આવું ધ્યાન ધારું જ હિતકારક નીવડે છે.

## ત્રાટક

ત્રાટક એ પાગ ધ્યાનનું એક અંગ છે અથવા એમ પાગ કહી શકાય કે એ ત્રાટકનું એક અંગ ધ્યાન છે. આંતર અને બાહ્ય એ બને જતના ત્રાટકનો એકમાત્ર ઉદ્દેશ મનને એકાગ્ર કરવું એ છે. નેત્રો બંધ કરીને કોઈ એક વસ્તુ ઉપર ભાવનાને કેન્દ્રિત કરવી અને તેને આંતરિક ચક્ષુથી જોતા રહેવું એ કિયાને આંતર-ત્રાટક કરે છે. આગલા પ્રકરણમાં જે દશ ધ્યાન બતાવ્યાં એ બધાં આંતર-ત્રાટક છે. મેસ્મેરિઝમની પદ્ધતિથી જે લોકો ત્રાટક કરે છે તે કેવળ પ્રકાશબિંદુ ઉપર ધ્યાન કરે છે. એનાથી એકાંગી લાભ થાય છે, પ્રકાશબિંદુ ઉપર ધ્યાન કરવાથી મન તો એકાગ્ર થાય છે, પાગ ઉપાસનાનો આત્મલાભ મળી શકતો નથી. એટલા માટે ભારતીય યોગીઓ ઈષ્ટ ધ્યાનના રૂપમાં આંતર-ત્રાટકનો ઉપયોગ કરે છે.

બાધ્ય સાધનોના આધાર પર મનને વશ કરવું, ચિત્તવૃત્તિઓનું એકીકરણ કરવું એ બાધ્ય ત્રાટકનો ઉદ્દેશ છે. ધારું કરીને મનની શક્તિ નેત્રો દ્વારા જ બહાર આવે છે. દાણિને કોઈ ખાસ વસ્તુ ઉપર એકાગ્ર કરીને મનને તનમયતાપૂર્વક તેમાં પ્રવેશ કરાવો. એનાથી નેત્રો દ્વારા ફેલાઈ જતું મનોતેજ અને વિદ્યુતપ્રવાહ એક સ્થાન પર કેન્દ્રીભૂત થવા લાગે છે. આનાથી એક તો મનની એકાગ્રતા વધે છે અને બીજું નેત્રોનો પ્રવાહ-ચુંબકત્વ વધે છે. એવી રીતે વધેલી અકર્ષણ શક્તિવાળી દાણિને 'વેધક દાણિ' કહે છે.

વેધક દાણિ ફેલીને કોઈ વ્યક્તિને પ્રભાવિત કરું શકાય છે. મેસ્મેરિઝમ કરનાર પોતાનાં નેત્રોમાં ત્રાટકથી એટલો વિદ્યુતપ્રવાહ ઉત્પત્ત કરી લે છે કે નેથી જે કોઈ શરીરમાં આ પ્રવાહ પ્રવેશ કરે તે બેહોશ અને આજાંક્ષિત બની જાતી મહાવિશ્વાન - ભાગ-૩

જય છે.

આ બેહોશ કે અર્ધતન્દ્રિત વ્યક્તિના મગજ પર વેધક દિલ્લિયાળો માણસ કબજે મેળવી લે છે અને તેની પારે જે ઈચ્છે તે કામ કરાવી શકે છે. મેસ્મેરિઝમ કરનાર માણસ કોઈ વ્યક્તિને પોતાની ત્રાટક શક્તિથી પૂર્ગતંત્રિત અથવા અર્ધતન્દ્રિત બનાવીને વિવિધ પ્રકારના નાચ નચાવી શકે છે.

મેસ્મેરિઝમ વિદ્યાથી સત્સંકલ્પ, દાન, રોગનિવારણ, માનસિક નુટિઓનું પરિમાર્જન વગેરે લાભ તો થાય છે. એટલું જ નહીં, પણ એનાથી જીચી અવસ્થાએ જઈને અજ્ઞાત વસ્તુઓને શોધી કાઢવી તથા અપ્રકટ વાતોને જાણી લેવી વગેરે કાર્યો પણ થઈ શકે છે. દુષ્પ્રકૃતિની વેધક દિલ્લિયાળો સાધક પોતાના દિલ્લેજથી કોઈ લી-પુરુષના મગજ ઉપર પોતાનો અધિકાર જમાવી લે છે અને તેમને બ્રમમાં નાખી તેમનું સત્ત નાશ કરે અથવા ધન લૂંટી લે છે. ટેટલાક તો વેધક દિલ્લીથી ખેલતમાંશો કરી પૈસા કમાય છે. આવી મહત્વપૂર્ણ શક્તિનો આ દુદુપ્યોગ છે.

વેધક દિલ્લિયાળો માણસ કોઈ પણ વ્યક્તિના અંત:કરણના મર્મસ્થળ સુધી પહોંચી જઈ શકે છે અને તેની માનસિક સ્થિતિ તથા મનોગત ભાવનાઓ જાણી શકે છે. ત્રાટક દ્વારા નેત્રોમાં એવી આકર્ષણશક્તિ પેદા થાય છે કે એ વેધકદિલ્લીનાંખીને સામા માણસને પ્રભાવિત કરી શકાય છે. ત્રાટકના અભ્યાસમાં મનની એકાગ્રતા અનિવાર્ય રૂપે કરવી પડતી હોવાથી એની સાધનાની સાથે મન પણ કાબૂમાં આવતું જાય છે.

(૧) એક હાથ લાંબો અને એક હાથ પહોળો એવો ચોરસ કાગળ અથવા જું પૂં લઈ એની વચ્ચે રૂપિયા જેવું કાળું ગોળ નિશાન બનાવી એકસરખી શાહી લગાવો. એની વચ્ચે રાઈના દાણા જેવું નિશાન બનાવો. એ ટપકામાં પીળો રંગ ભરી દો, આ કાગળને કોઈ દીવાલ ઉપર ટાંગી દો. તમે એનાથી ચાર ફૂટ દૂર એવી રીતે બેસો કે એ કાળો ગોળો તમારી આંખોની બરાબર સામે આવે.

સાધનાનો ઓરડો એવો હોવો જોઈએ કે જેમાં ન તો વધારે પ્રકાશ હોય કે ન તો અંધારું હોય. વધુ ઠંડી કે ગરમી પણ ન હોવી જોઈએ. પલાંઠીવાળી કરોડરણ્ણ સીધી રાખીને બેસો અને કાળા ગોળાની વચ્ચે જે પીળું નિશાન છે તેના ઉપર દિલ્લીસ્થિર કરો. ચિત્તની સમગ્ર ભાવનાઓ એકનિત કરીને એ બિંદુને એવી રીતે જુઓકે જાગે તમે તમારી સધળી શક્તિ નેત્રો દ્વારા એની અંદર દાખલ કરવા માગો છો. એવી ભાવના કરો કે ‘મારી તીવ્ર દિલ્લી એ બિંદુમાં કાળું પડી રહ્યું છે.’ આ પ્રકારે જોવાથી આંખોમાં દર્દ થવા લાગે અને પાણી વહેવા લાગે ત્યારે અભ્યાસ બંધ કરી દો.

અભ્યાસ માટે પ્રાતઃકાળનો સમય ઉત્તમ છે. નિત્યકર્મથી નિવૃત થઈ નિયત સ્થાન પર બેસવું. પહેલે દિવસે જેશો તો જાગાશે કે ભષુ જ થોડા વખતમાં આંખ થાડી જાય છે અને પાણી આવી જાય છે. શરૂઆતમાં જેટલો અભ્યાસ કર્યો તેમાં દરરોજ એક અથવા અડધી મિનિટ વધારતા જવી.

દિલ્લીને સ્થિર કરીને જેશો તો એ કાળા ગોળામાં જાતજાતની આકૃતિઓ પેદા થતી જાગાશે. કદીક એ સંક્રેદ રંગનો થઈ જશે અને કદીક સોનેરી, કદીક એ આકૃતિઓ નાની જાગાશે, કદીક એ ચિનગારીઓની માફક ઊડતી જાગાશે અને કદીક વાદળથી છવાપેલી જાગાશે. એ પ્રકારે એ ગોળો પોતાનો રંગ અને આકૃતિ બદલતો રહેશે. તેમ છતાં જ્યારે દિલ્લીસ્થિર થવા લાગશે ત્યારે એમાં દેખાતી બિન્દુ આકૃતિઓ બંધ થઈ જશે અને ઘાણા વખત સુધી જોવા છતાં ગોળો જેમનો તેમ જ દેખાશે.

(૨) એક ફૂટ લાંબું અને એક ફૂટ પહોળું દર્પણ લો. વચ્ચો વચ્ચે પાવલી જેવડા કાળા રંગના કાગળનો ટુકડો કાપીને ચોટાડી દો. આ કાગળની મધ્યમાં રાઈના દાણા જેવું એક પીળું બિંદુ બનાવી તેના ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. આ અભ્યાસને એક એક મિનિટ રોજ વધારતા જાઓ. આ પ્રમાણે જ્યારે દિલ્લીસ્થિર થઈ જાય ત્યારે

તेनाथी आगणना अभ्यास शड करवो. दर्पाण उपर चोटारेला कागणने उभाडी नाभीने ऐमां पोतानुं भोंडु जेवुं तथा डाबी आंभनी कीझी उपर दृष्टि स्थिर करवी. ए कीझीमां ध्यानपूर्वक पोतानुं प्रतिबिंब जेवानो प्रयत्न करवो.

(३) गायना धीनो दीवो करी तेने आंभनी सीधी लीटीमां चार फूटना अंतरे राखवो. दीवानी ज्योत अर्धा ईच्छी वधारे न होवी जेईअ. तेनी वाट जडी राखवी अने धी ओगणेलु लेवुं, आंभना पलकारा मार्या सिवाय आ दीपन्योत सामे एकीटशे जेया करवुं अने भावना करवी के ‘आंभोनुं तेज दीपकनी ज्योत साथे अथडाईने तेमां एकाकार थई रखुं छे.’

(४) ग्रातःकाणना लाल सूर्य उपर अथवा रात्रीना चंद्रमा उपर न्याटक थर्द शके छे. सूर्य के चंद्र न्यारे माथा पर होय त्यारे न्याटक थर्द शक्तुं नथी, कारागुके आ वजते कां तो माथुं उच्चुं करवुं पडे छे अथवा सूर्य न्याईने आंभो जिथी करवी पडे छे. ए बंने स्थिति हानिकारक छे. एटला ज माटे उगतो सूर्य अथवा चंद्र न्याटक माटे उपयोगी थर्द शके छे.

(५) न्याटकना अभ्यास माटे स्वस्थ आंभोनी भास नजर होय छे. जेनी आंभो कमजेर होय, रोगी होय तेने भाव्यन्याटक करतां आंतरन्याटकनी वधारे नजर होय छे. ए वात ध्यान प्रकरागमां लभवामां आवी छे. आंतरन्याटक पाश्चात्य योगीओ एवी रीते करे छे के प्रथम दीवानी अजिनिशिखा, सूर्य, चंद्र अथवा कोई चमकतो प्रकाश पंदर सेंकड झुक्की आंभोथी जेवो. पछी आंभो बंध करीने ध्यान करवुं के ‘ए ज प्रकाश मारी सामे भोजूद छे. एकीटशे एने जेई रघ्यो छुं अने मारी समग्र ईच्छाशक्तिनी तीव्र आणी आरपार धुसाडी रघ्यो छुं.’

आपाणी पोतानी सगवड, स्थिति अने रुचि प्रभागे आ न्याटको पैकी गमे ते रीत पसंद करी लेवी अने तेने नियमपूर्वक नक्की करेला वजते दररोज करता रहेवुं. एथी मन एकाश थशे अने दृष्टिमां वेधकता, पारदर्शिता अने प्रभावशीलतानी वृद्धि थशे.

न्याटकमांथी उक्खा पैदी गुलाबजग्नीथी आंभो धोई नांभवी. गुलाबजग्नन मणे तो स्वच्छ गाणेलुं ताजुं पाणी पाण चाली शके. आंभो धोवा माटे काचनी नानी नानी घालीओ, जे अंगेछ दवा वेचनाराओने त्यां मणे छे ते वधारे सगवडवाणी होय छे, ए न मणे तो एक भोटा वाटकामां पाणी भरीने तेमां आंभो दुबाडवी अने पलक भारवी. एम करवाथी आंभो धोवाय छे. आ प्रकासना नेत्रस्नान वडे न्याटकथी उत्पन्न थयेली आंभोनी बीणतरा शांत थाय छे. न्याटकनो अभ्यास पूरो कर्या पैदी साधनाने लीये आवेली मानसिक गरभीनी शांति माटे दृध, दही, लस्सी, माखाण, शेरडी, इण, शरबत वगेरे कोई ठंडी पौष्टिक चीज झक्कुनुं ध्यान राखीने लेवी जेईअ. ठंडीनी भोसममां बदामनो खलवो, अवलेह वगेरे वस्तुओनो पाण उपयोग करी शकाय.

## ४५ साधना

मनोभय कोशनी स्थिरता अने एकाग्रता माटे न्यपसाधना धाणी उपयोगी छे. एनी उपयोगिता निविवाद छे, केमके सधगा धर्मो, मन्त्रहेतु तथा संप्रदाय न्यपनी उपयोगितानो स्वीकार करे छे. न्यप द्वारा मननी प्रवृत्तिओने एक ज केन्द्र पर एकाश्र करवानुं सरण थई जय छे.

क्षेवाय छे के एक वजत एक मनुष्ये कोई एक भूतने वशमां करी लीधुं. भूत धागुं भणवान झतुं अने तेजो कहुं के “तमारा ताबामां आवी गयो छुं ते ढीक छे. छे ने आज्ञा मणेते काम छुं तरत करीश, पाण लुं नकामुं बेसी रहीश नहीं अने जे छुं नवडु रखुं तो तमने ज खाई न्याईश. आ मारी शरत बहु ध्यानपूर्वक समज्ज लो.” आ माणसे भूतने धाणाये कामो बतायां अने बधां तेजो ताबडतोब पार पाऊँ: भूतनी नवराशथी उत्पन्न थनाहुं संकट आ माणसने खूब सतावतुं झतुं. आखरे थाकीने ते पोताना गुरुने शराणे गयो. गुरुअ आ माणसने युक्ति बतावी. आंगणामां वात्री भावाविज्ञान - भाग-३

એક વાંસ રોપવાનું કહ્યું અને ભૂતને કહેવું કે જ્યાં સુધી તને બીજું કોઈ કામ સોંપવામાં ન આવે ત્યાં સુધી તારે વાંસ ઉપર ચઢવાનું અને જિતરવાનું કામ કર્યું જ કરવું. આ યુદ્ધિલ મળી જવાથી ભૂત પાસેથી કામ વેવામાં સરળતા થઈ અને તેની નવરાશથી ઉત્પત્ત થનારું સંકટ પણ ટળી ગયું.

મન એવું એક ભૂત છે કે જ્યારે પણ એ નવરું પે છે ત્યારે કાંઈક ઉપદ્રવ કરે જ છે. તેથી જ્યારે પણ કામમાંથી એને છુદ્દી મળે ત્યારે એને જ્યપમાં લગાવી દેવું જોઈએ. જ્ય માત્ર સમય વ્યતીત કરવા માટે જ નથી. એ એક ઉત્પાદક અને રચનાત્મક મનોવૈજ્ઞાનિક શ્રમ છે. હંમેશાં પુનરાવૃત્તિ કરતા રહેવાથી મનમાં એ પ્રકારનો અભ્યાસ અને સંસ્કાર બની જય છે અને પછીથી એનું વર્તન પણ એ જ પ્રમાણે ઘડારું જય છે.

પથ્થર ઉપર વારંવાર દોરું ધસાવાથી ત્યાં ખારો પડી જય છે. પાંજરામાં રહેલા કભૂતરને છોડી દેવામાં આવે તો પણ તે પાછું અંદર જ આવશે. ગાયને જંગલમાં ચરવા છોડી દેવામાં આવે તો તે પણ સાંજે પાછી ખીલે આવી જશે. હંમેશના અભ્યાસથી મન પણ એવું ટેવાઈ જય છે. લાંબા વખતથી જે કાર્યક્રમ ચાલ્યો આવ્યો હોય તેમાં જ સ્વાભાવિક રીતે તે પ્રવૃત્ત થાય છે.

અનેક નિરર્થક કલ્યાણ-પ્રાપ્યમાં નાચકૂદ કરવાને બદલે આધ્યાત્મિક ભાવનાની ચોક્કસ મર્યાદામાં ભ્રમાશ કરવા માટે જ્યપની કિયા મનને માટે ઘણી જ ઉત્તમ છે. લાંબા વખત સુધી નિરંતર જ્યપનો અભ્યાસ કરવાથી મન એક જ દિશામાં પ્રવૃત્ત રહે છે. આત્મિક ક્ષેત્રમાં મનનું લાગી રહેવું એ એક દિવસ પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવાનું ચોક્કસ લક્ષણ છે. મન રૂપી ભૂત બહુ બળવાન છે. સાંસારિક કાર્યો પણ એ બહુ સહફળતાપૂર્વક પાર પાડે છે અને આધ્યાત્મિક ક્ષેત્રમાં જ્યારે એ લાગી જય છે ત્યારે ભગવાનનું સિંહાસન ડોલાવવાનું પણ એ ચૂકુંનું નથી. મનની ઉત્પાદક, રચનાત્મક અને પ્રેરક શક્તિ એટલી વિલક્ષણ છે કે એને માટે આ જગતની કોઈ પણ વસ્તુ અશક્ય નથી. ભગવાનને મેળવવા એ પણ એને માટે ઘણી સરળ વાત છે. મુશ્કેલી માત્ર એક જ નિયત ક્ષેત્રમાં સ્થિર થવાની છે. જ્યપના વ્યવસ્થિત કાર્યક્રમથી તે ઊણાપ પણ દૂર થાય છે.

આપાણું મન જમે તેટલું ઉદ્ઘરુંખલ ડેમ ન હોય, છીતાં જ્યારે એને વારંવાર એક જ ભાવના ઉપર કેન્દ્રિત કરવામાં આવે તો એવું કોઈ કારણ નથી કે કાળાંતરે તે એ જ પ્રકારનું ન બની જય. લાગલગાટ પ્રયત્ન કરવાથી સરકુસમાં ખેલ કરનાર વાનર, સિંહ, વાધ, રીંછ જેવાં ધાતક પ્રાણીઓ પણ માલિકની મરજી પ્રમાણે કામ કરવા લાગી જય છે, એના ઈશ્વરા માત્રથી નાચે છે, તો એવું કોઈ કારણ નથી કે ચંચળ અને કુમાર્ગામી મનને વશમાં લાવીને એને ઈચ્છા અનુસાર ન ચલાવી શકાય. પહેલવાનો દરરોજ પોતાની ચોક્કસ મર્યાદામાં રહીને દંડબેઠક વગેરે કરે છે. એમની આ કિયાપદ્ધતિથી એમનું શરીર દિવસે દિવસે હષ્ટપુષ્ટ થતું જય છે અને એક દિવસ એ સારા પહેલવાન બની જય છે.

હંમેશના જ્ય એ આધ્યાત્મિક વાયામ છે. તેનાથી આત્મિક સ્વાસ્થ્ય સુદૃઢ થાય છે અને સૂક્ષ્મ શરીરને બળવાન બનાવવાના કાર્યમાં મહત્વપૂર્ણ સહાયતા મળે છે.

એક એક ટીપું બેગું કરવાથી ધરો ભરાય છે. ચકલી પોતાની ચાંચમાં એક એક દાણો લાવીને માણબંધી અનાજ બેગું કરે છે. એક એક અક્ષર ભાણતાં પંડિત થવાય છે. એક એક ઉગલું ચાલતાં લાંબી મંનિલ કપાય છે. એક એક પેસો જમા કરવાથી તિજેરી ભરાય છે. એક એક તાંતાળાથી આખું દોરું બને છે. જ્યપમાં પણ એમનું બને છે. માળાનો એક એક માળુકો ફેરવવાથી ધાણું બધું પુણ્ય જમા થાય છે અને એટલું બધું જમા થાય છે કે જેથી આત્માનું કલ્યાણ થઈ જય. એટલા જ માટે યોગના ગ્રંથોમાં જ્યપને પજનું નામ આપ્યું છે. એનો મહિમા ગાયો છે. એટલું જ નહીં, પણ આત્મમાર્ગ પર ચાલનાર યાત્રીને માટે જ્યપને એક આવશ્યક કર્તવ્ય ગણ્યું છે.

ગોતાના અધ્યાય ૧૦, શ્લોક ૨૫ માં કહ્યું છે કે “યજ્ઞોમાં જ્યપ્તજ્ઞ શ્રેષ્ઠ છે.” મનુસ્મૃતિમાં અધ્યાય ૨, વાચની મહાવિજ્ઞાન - ભાગ-૩

શ્વોક ૮૬માં બતાવ્યું છે કે ‘હોમ, બલિકર્મ, શ્રાદ્ધ, અતિથિસેવા, પાક્યજી, વિધિયજી, દશ પૌર્ણમાસાદિ યજ્ઞ વગેરે સર્વ મળીને જપયજ્ઞના સોળમા ભાગ બરોબર પાગ નથી થઈ શકતાં. મહાર્ષિ ભારતને ગાયત્રી વાખ્યામાં લખ્યું છે કે “સમસ્ત યજ્ઞોમાં જપયજ્ઞ અધિક બ્રેષ્ટ છે. અન્ય યજ્ઞોમાં હિંસા થાય છે, પાગ જપ યજ્ઞમાં નથી થતી. જેટલાં કર્મ, યજ્ઞ, દાન, તપ વગેરે છે તે સર્વ જપયજ્ઞની સોળમી કળાની પાગ બરોબર આવી શકે નહીં. સમસ્ત પુરુષ સાધનાઓમાં જપયજ્ઞ સર્વશ્રેષ્ઠ છે.”’ આવા પ્રકારનાં અનેક પ્રમાણો શાસ્ત્રોમાંથી મળી આવે છે. આ શાસ્ત્રવચનોમાં જપયજ્ઞની ઉપયોગિતા અને મહત્તમાનું બહુ જ ભારપૂર્વક પ્રતિપાદન કરવામાં આવ્યું છે, કારણ કે જપ મનને વશ કરવાનું રામભાગ શક્ય છે. એ તો સર્વવિદિત સત્ય છે કે મનને કાબૂમાં લેવું એ એક જ સફળતા એવી છે કે જેની પ્રાપ્તિ થવાથી જીવન ધન્ય બની જય છે. સમસ્ત આત્મિક અને ભૌતિક સંપત્તિ આજ્ઞાકિત મનમાંથી ઉત્પત્ત કરી શકાય છે.

જપયજ્ઞના સંબંધમાં કેટલીક આવશ્યક સૂચનાઓ નીચે આપવામાં આવે છે:

(૧) જપને માટે પ્રાતઃકાળ અથવા ભ્રાત્મમુલ્લૂત સર્વોત્તમ સમય છે. બે કલાક રાત બાકી રહે ત્યાંથી સૂર્યોદય સુધીના વખતને ભ્રાત્મમુલ્લૂત કહે છે. સૂર્યોદયથી બે કલાક દિવસ ચડે ત્યાં સુધી પ્રાતઃકાળ કહેવાય છે. પ્રાતઃકાળ કરતાં ભ્રાત્મમુલ્લૂત અધિક બ્રેષ્ટ છે.

(૨) જપને માટે પવિત્ર એકાંત સ્થાન પસંદ કરવું. મંદિર, તીર્થ, બગીચો, જળાશય વગેરે શુદ્ધ અથવા એકાંત સ્થાન જપ માટે અધિક ઉપયોગી છે. ઘરમાં જપ કરવા હોય તો એવી જગ્યા પસંદ કરવી જોઈએ કે જ્યાં ધોંઘાટ ન હોય.

(૩) સંધ્યા સમયે જપ કરવા હોય તો સૂર્યસિંહ પછી એક કલાક સુધીમાં જપ પૂરા કરી લેવા જોઈએ. પ્રાતઃકાળના બે કલાક અને સંધ્યાકાળનો એક કલાક બાદ કરી, રાત્રીના બીજી સમયે ગાયત્રી મંત્ર જપવામાં આવતો નથી.

(૪) જપ વખતે શુદ્ધ શરીર અને શુદ્ધ વસ્ત્રો પહેરીને બેસવું જોઈએ. સામાન્ય રીતે સ્નાનથી જ શરીરની શુદ્ધિ થાય છે, પાગ કોઈ ખાસ કારાગથી છૂટું પ્રતિકૂળતાને લીધે અથવા અસ્વસ્થતાના કારાગે સ્નાન ન થાય તો હાથ-મોંધોણને અથવા ભીના કપડાથી શરીર લૂઢીને કામ ચલાવી શકાય છે. હંમેશાં ધોયેલાં વસ્ત્રોની વ્યવસ્થા ન થઈ શકે તો રેશમી અથવા ઊનનાં વસ્ત્રોથી કામ લેવું.

(૫) જપને માટે આસન સિવાય બેસવું નંહીં, કુશનું (દર્ભનું) આસન, ચહ્રાઈ અથવા ઘાસનું બનાવેલું આસન ઉપયોગમાં લેવું. પશુઓનું ચામડું, મૃગચર્મ વગેરે જે હિંસાથી પ્રાપ્ત થયું હોય એવું આસન નિષિદ્ધ છે.

(૬) પદ્માસન વાળીને કરોડરણજી સીધી રાંખીને જપ માટે બેસવું જોઈએ. સવારે પૂર્વ દિશામાં અને સાંને પશ્ચિમ દિશા તરફ મોં કરીને બેસવું.

(૭) માળા તુલસી અથવા ચંદનની લેવી. દરરોજ ઓછામાં ઓછી એક માળા કરવી. જ્યાં ધાળા માણસોની નજર માળા પર પડતી હોય એવા ઠેકાગે તેને કપડાથી ઢાંકી ટેવી અથવા ગૌમુખીનો ઉપયોગ કરવો.

(૮) માળા જપતી વખતે સુમેરુનું ઉદ્ધંધન કરવું નહીં. એક માળા પૂરી થયે એને મસ્તકે અને નેત્રોએ અડાડવી અને પછી માળા ઉલટાવીને જપ શરૂ કરવા.

(૯) લાંબી મુસાફરીમાં, માંદા પડી જતાં, કોઈ રોગીની સેવામાં રોકાઈ જતાં, જન્મ ને મૃત્યુ સમયના સૂતકકાળ દરમ્યાન, સ્નાન કરવાની સંગવડ ન હોય તારે માનસિક જપ ચાલુ રાખવા જોઈએ. પથારીમાં પડ્યા, રસ્તે ચાલતાં અથવા કોઈ પાગ પવિત્ર કે અપવિત્ર દશામાં માનસિક જપ કરી શકાય છે.

(૧૦) જપ એવી રીતે કરવા જોઈએ કે કંઈમાંથી ધ્વનિ નીકળતો રહે, હોઠ હાલતા રહે, પાગ પાસે બેઠેલો માણસ સ્પષ્ટ રૂપે મંત્ર સાંભળી શકે નહીં, મળમૂત્રનો ત્યાગ કરવા અથવા કોઈ અનિવાર્ય સંભેગોમાં સાધનામાંથી વાતની મહાવિજ્ઞાન - ભાગ-૩

વચમાં ઊઠવું પડે તો શુદ્ધ જળથી હાથપગ અને મોં ધોઈ કરી ફરીવાર બેસવું જોઈએ. જપકાળ દરમ્યાન યથાશક્તિ મૌન જળવવું. કોઈ વાત કહેવાની જરૂર પડે તો ઈશારાથી કહી દેવી.

(૧૧) જપ નિયત સમયે, નિયત સંખ્યામાં, નિયત સ્થાન પર શાંત અને એકાગ્ર ચિત્તથી કરવા જોઈએ. પાસે જળાશય અથવા જળથી ભરેલું પાત્ર હોવું જોઈએ. આચમન પછી જપનો આરંભ કરવો જોઈએ. કોઈ દિવસ અનિવાર્ય કારણથી જપ સ્થળિત કરવા પડે તો બીજે દિવસે પ્રાયશ્વિત સ્વરૂપે એક માળા વધુ કરવી.

(૧૨) જપ સમયે મસ્તિષ્ણના મધ્યભાગમાં ઈષ્ટટેવની પ્રકાશનનો તિનું ધ્યાન કરતા રહેવું જોઈએ. શારીરિક અથવા માનસિક દોષોથી બચવા માટે યથાશક્તિ પૂરો પ્રયત્ન કરવો. સાધકનો આધાર તથા વ્યવહાર સાત્ત્વિક હોવો જોઈએ.

(૧૩) જપને માટે ગાયત્રી મંત્ર સર્વશ્રેષ્ઠ છે. ગુરુ દ્વારા શ્રદ્ધાળું કરેલો મંત્ર જ સફળ થાય છે. સ્વેચ્છાપૂર્વક ગમે એવી વિધિથી ગમે એવા મંત્રના જપથી વિશેષ લાભ નથી થતો. આથી આપણી સ્થિતિને અનુકૂળ આવશ્યક વિધાનનું જ્ઞાન કોઈ અનુભવી માર્ગદર્શકની પાસેથી મેળવી લેવું જોઈએ.

આ સર્વે નિયમોના આધાર નર કરેલ ગાયત્રી જપ મનને વશ કરવામાં અને મનોમધ્ય કોશનો વિકાસ કરવામાં ધ્યાણ ઉપયોગી થશે.

## તન્માત્રા સાધના

આ વાત તો સુવિદિત છે કે શરીર અને સમસ્ત સંસાર પાંચ તત્ત્વોનો જ બનેલો છે. પૃથ્વી, જળ, વાયુ, અજિન અને આકાશ- આ પાંચ તત્ત્વોની માત્રામાં ફેરફાર થવાથી જુદા જુદા આકાર, પ્રકાર અને ગુણધર્મવાળી વસ્તુઓ બને છે.

આ પાંચ તત્ત્વોની જે સૂક્ષ્મ શક્તિઓ છે એના ઇન્દ્રિયજન્ય અનુભવને જ તન્માત્રા કહી છે. શરીરમાં પાંચ જ્ઞાનન્દિયો છે. આ પાંચ તત્ત્વોના બનેલા પદાર્થોના સંસર્જનમાં આવવાથી ઇન્દ્રિયો જે અનુભવ કરે છે તેને તન્માત્રા નામથી સંભોધવામાં આવે છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ- એ પાંચ તન્માત્રાઓ છે.

આકાશની તન્માત્રા ‘શબ્દ’ છે. કાન દ્વારા આપણને એનો અનુભવ થાય છે. કાન એ આકાશતત્ત્વની પ્રધાનતાવાળી ઇન્દ્રિય છે. અજિનતત્ત્વની તન્માત્રા ‘રૂપ’ છે. આ અજિનપ્રધાન તત્ત્વનો અનુભવ નેત્ર દ્વારા થાય છે. રૂપ નેત્રથી જેવામાં આવે છે. રસનો અનુભવ જપાપ્રધાન ઇન્દ્રિય નિઃહ્વા દ્વારા થાય છે. છ રસો-ખાટો, ખારો, મીઠો, તીખો, કડવો અને તૂરો વગેરેનો અનુભવ જ્ઞબ કરે છે. પૃથ્વીતત્ત્વની તન્માત્રા ‘ગંધ’ છે. પૃથ્વીતત્ત્વ પ્રધાન નાસિકા ગંધને ઓળખી શકે છે. એ જ પ્રમાણે વાયુની તન્માત્રા સ્પર્શનું જ્ઞાન ત્વચાને થાય છે. ત્વચામાં ફેલાયેલા જ્ઞાનતંતુઓ ગરમી, વજન, ધનતા વગેરેનો તથા એમના સ્પર્શની પ્રતિક્રિયાનો અનુભવ કરાવે છે.

ઇન્દ્રિયોમાં તન્માત્રાઓનો અનુભવ કરવાની શક્તિ ન હોય તો સંસાર સાથેનો સંબંધ દ્ઘટ્ટી જાય છે. જીવને સંસારમાં જીવન જીવવાની સગવડ ભલે હોય, પાણ એ જીવનમાં કશો આનન્દ જ નહિ રહે. સંસારના વિવિધ પદાર્થોમાં આને જે મોહ અને આકર્ષણ જાળાય છે તેનું એકમાત્ર કારણ તન્માત્રા શક્તિ છે. કલ્પના કરો કે આપણે જગતના કોઈ પાણ પદાર્થનું રૂપ જોઈ શકતા નથી, તો સર્વત્ર અંધકાર લાગશે. જો શબ્દ (અવાજ) ન સાંભળી શકીએ તો સર્વત્ર મૌન અને નીરવતા જ જાળાશે. સ્વાદ પારખી ન શકતા હોઈએ, તો ખાવામાં કશી મજા જ નહીં રહે. ગંધનો અનુભવ ન કરી શકીએ તો હાનિકારક ગંદકી અને ઉપયોગી બગીચો એ બનેમાં તફાવત જ નહિ જાળાય. ત્વચાની શક્તિ નહિ હોય તો તાપ, ટાઢ, કોમળ શૈથા, વાયુસેવન એ બધાનો કશો અર્થ જ નહીં રહે.

પરમાત્માએ આ પાંચ તત્ત્વોમાં તન્માત્રાઓ ઉત્પત્ત કરીને અને તેના અનુભવ માટે શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો બનાવીને શરીર અને સંસારનો સંબંધ ધારું મળજૂબુત અને આકર્ષક બનાવ્યો છે. આ પાંચ તત્ત્વો માત્ર સ્થૂલ જ હોત અને તેઓમાં તન્માત્રાઓ ન મૂકી હોત, તો ઈન્દ્રિયોને આ સંસારમાં કશો રસ્કે આનંદ ન આવત. સર્વ કાંઈ નીરસ, નિરર્થક અને બેકાર જેવું જાણાયું હોત. જે તત્ત્વોમાં તન્માત્રાઓ હોત, પણ એમનો અનુભવ કરવા શરીરમાં જ્ઞાનેન્દ્રિયો ન હોત, તો જેમ વાતાવરણમાં ફરતાં જીવનંતુંથી માત્ર જીવન ધારણ કરી રહે છે, તેમને સંસારમાં કર્ણા પ્રકારની રસાનુભૂતિ થતી નથી, તેમ માનવજીવન પણ નીરસ અને નિરર્થક બની જત. ઈન્દ્રિયોની અનુભવશક્તિ અને તત્ત્વોની તન્માત્રા શક્તિઓ એમ બંને મળીને પ્રાણીને એવા અનેક શારીરિક અને માનસિક રસાનુભવો કરાવે છે કે જેના લોભે પ્રાણી જીવન ધારણ કરી રહે છે અને આ સંસારને છોડવા ઈચ્છાનું નથી, એનાં આ ઈચ્છા અને લોભ જ એને જીવનમરાણના ચક્કમાં-ભવબંધનમાં બાંધી રાખે છે.

આત્મા તરફ ધ્યાન આપતાં અને આત્મકલ્યાણની કશી પ્રવૃત્તિ કરતાં માત્ર સાંસારિક વસ્તુઓનો સંશ્રદ્ધ કરવાની, તેમના સ્વામી બનવાની અને તેમના સંપર્કનો રસાનુભવ કરતા રહેવાની લાલસામાં જ માણસ દૂબેલો રહે છે. રંગબેરંગી રમકડાં સાથે રમવામાં જેમ બાળક તન્મય થઈ જય છે અને ખાવું-પીવું છોડીને માત્ર રમતમાં જ મશગૂલ રહે છે, તે જ પ્રમાણે તન્માત્રાઓ ઇપી રમકડાં મનમાં એવાં વસી જય છે અને એટલા સુંદરલાગે છે કે તેમને છોડવાનું દિલ જ થતું નથી. જીવન અનેક રીતે કષ્ટમય હોય, છતાં લોકો મરવા તેયાર થતા નથી. મરાણનું નામ સાંભળતા જ લોકો ધ્રુજી જય છે. એનું એકમાત્ર કારણ એ છે કે સાંસારિક પદાર્થોની તન્માત્રાઓમાં એટલું મોહક આકર્ષણ છે કે એ સંસારનાં કષો અને અભાવોની તુલનામાં મોહક અને સરળ લાગે છે. કષો સહેવા છતાં કોઈ પ્રાણી એમને છોડવા તેયાર થતું નથી.

પાંચ ઈન્દ્રિયોના ખીલા સાથે પાંચ તન્માત્રાઓની દોરી વડે જીવને બાંધી ટેવામાં આવ્યો છે. આ દોરીઓ ધારું જ આકર્ષક છે. આ દોરીઓમાં ચમકતું રંગીન રેશમ અને સોનેરી તાર લગાવેલા હોય છે. ખીલાઓ ચાંદી-સોનાના બનાવ્યા હોય છે. એમના ઉપર હીરા-જવેરાત ઝગમગી રહ્યાં છે. જીવિધી ધોડો આ દોરીઓથી બંધાયેલો છે. તે બંધનાં દુઃખોને ભૂલી જય છે અને આ દોરીઓ તથા ખૂંટાઓનું સૌંદર્ય અને મોહકતા જોઈને ધૂટવાની ઈચ્છા પણ છોડી દે છે, એને આ બંધન ધારું સારું લાગે છે. રશમી ચમકવાળી દોરી અને સોના-ચાંદીના ખીલાઓની તુલનામાં દિવસભર ગાડીમાં જોડાઈને ચાબુક ખાવાનું કણ તેને ભારે લાગતું નથી. આ બાળકબુદ્ધિને, આ ટૂંકી દાણિને, વાસ્તવિકતા ન સમજનારી આ અક્કલને શાસ્ત્રોમાં અવિદ્યા, માયા, ભ્રાંતિ વગેરે નામથી ઓળખવામાં આવે છે અને આવી ભૂલથી બચવા માટે અનેક પ્રકારની ધાર્મિક કથાઓ, ગાથાઓ, ઉપાસનાઓ અને સાધનાઓનું વિધાન બતાવવામાં આવ્યું છે.

ઈન્દ્રિયો તથા તન્માત્રાઓના સંયોગથી જે ઝાગઝાગાટ પેદા થાય છે તેની શાંતિ માટે જ મનુષ્ય સધળા વિચારો અને કાર્ય કરે છે. આ ઝાગઝાગાટના શમન માટે જ દિવસરાત એ અનેક કાળાંધોળાં કરતો હોય છે. મનને કબજ્જમાં લઈ એકાગ્ર કરવામાં આ તનમનાટ જ મોટી અડયાળ રૂપ છે, જે ચિત્તને બીજી બાજુ જવા જ દેતો નથી. એમાં જે મજા આવે છે તેની તુલનામાં બીજી બધી વાતો ગૌણ બની જય છે, તેથી જ એકાગ્રતાની સાધના પરથી મન ધારુણીવાર ઊંઠી જય છે.

તન્માત્રાઓની રસાનુભૂતિ (રસાસ્વાદ) ધોડાની દોરી અથવા ખૂંટલી સમાન છે. એ બહુ જ હલકી, નાની અને મહત્વહીન બાબત છે. એ ભાવના અંતઃકરણમાં દઢકરવા માટે, મનોમય કોશની સુઅવરસ્થા માટે તન્માત્રાઓની સાધનાનો અભ્યાસ બતાવાયો છે. આ સાધનાઓથી અંતઃકરણ એવો અનુભવ કરી લે છે કે ‘તન્માત્રાઓ’ અનાત્મ વસ્તુ છે. આ જ પંચતત્ત્વોની સૂક્ષ્મ પ્રક્રિયા માત્ર છે. એંધોમય કોશમાં ખૂંટલીની માફક ચોટી જય છે. આ

નિરર્થક કામમાં ફસાવીને મનુષને પોતાના સાચા લક્ષ્યથી વિમુખ કરી દે છે. એટલા માટે એમનું પોકળપણું, વર્ધતા અને તુચ્છતા સારી રીતે સમજ બેવાં જોઈએ.

આગળ ઉપર પાંચ તન્માત્રાઓની નાની નાની સરળ સાધનાઓ બતાવવામાં આવશે, જેની સાધના કરવાથી બુદ્ધિ એવો અનુભવ કરી લે છે કે જીવનને ચલાવવામાં શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનો ફક્ત એટલો જ ઉપયોગ છે કે જેટલો યંત્રોના ભાગોમાં તેવનો ઉપયોગ હોય. એમાં આસક્ત થવાની જરૂર નથી.

બીજુ વાત એ છે કે મન પોતે એક ઇન્દ્રિય છે. તેનો સંબંધ હંમેશાં તન્માત્રાઓ સાથે રહ્યો છે. મનનો વિષય જ રસાનુભૂતિ છે. સાધનાન્ભક રસાનુભૂતિમાં તેને લગાવી ટેવામાં આવે તો એ પોતાના વિષયમાં લાગી જાય છે. એટલું જ નહીં, પણ એને સૂક્ષ્મ પરિશ્રમ કરવો પડે છે. તેના પરિણામે અતિ સૂક્ષ્મ મનઃશક્તિઓ જગ્યત થતાં અનેક પ્રકારના માનસિક લાભો પણ થાય છે. હવે પાંચ તન્માત્રાઓની સાધનાઓ આ પ્રમાણે છે:

### શબ્દ સાધના :

ન્યાં કોઈ જતનો કોલાહલ ન થતો હોય એવા શાંત અને એકાંત સ્થાનમાં જરૂર. બહારનો કોઈ પણ અવાજ ન સંભળાવો જોઈએ. રાત્રિના સમયે ન્યારે ચારે બાજુએ સર્વત્ર શાંતિ વાપેલી હોય તેવો સમય આ સાધના માટે ઉત્તમ ગણાય. દિવસ દરમ્યાન સાધના કરવી હોય તો ઓરડાનું બારાણું બંધ કરવું કે જેથી બહારનો અવાજ અંદર ન આવે.

(૧) શાંત ચિત્તથી પદ્માસન લગાવીને બેસવું. આંખો બંધ કરવી. એક નાની ઘડિયાળ કાન પાસે લાવો અને તેનો ટીક ટીક અવાજ ધ્યાનપૂર્વક સાંભળો. હવે ધીર ધીર ઘડિયાળને કાનથી દૂર ને દૂર હટાવતા જાઓ અને ધ્યાનપૂર્વક એનો ટીક ટીક અવાજ સાંભળવાનો પ્રયત્ન કરતા રહો. ઘડિયાળ અને કાનનું અંતર વધારતા જાઓ. ધીર ધીર અભ્યાસથી ઘડિયાળ ધારી દૂર હોવા છતાં ટીક ટીકનો અવાજ સાંભળવાનો રહેશે. વચ્ચમાં વચ્ચમાં ન્યારે ધ્વનિપ્રવાહ શિથિલ થઈ જાય ત્યારે ઘડિયાળને પાસે લાવીને કાનથી ટીક ટીક અવાજ સાંભળી લેવાનો પ્રયત્ન કરવો અને વળી પાછી ઘડિયાળને દૂર ને દૂર હટાવી સૂક્ષ્મ કાર્યોન્નિય દ્વારા અવાજ સાંભળવાનો પ્રયત્ન કરવો.

(૨) ધંટનો એક ટકોરો મારી તેનો અવાજ ધારા લાંબા સમય સુધી સાંભળવાનો પ્રયત્ન કરવો. ત્યાર પછી એટલા જ લાંબા વખત સુધી સૂક્ષ્મ કાર્યોન્નિય દ્વારા સાંભળવાનો પ્રયત્ન કરવો. ન્યારે ધ્યાન શિથિલ થઈ જાય ત્યારે ફરી પાછી હથોડી મારીને અવાજ સાંભળવો. આ સાધનાને મુશ્કિયોગ કહે છે અને યોગચ્છ્વાસમાં અનું વાર્ણન છે.

(૩) કોઈ ઝરાણાની અથવા નહેરના સરોવરની બાજુમાં ન્યાં જળધોધનો ધ્વનિ થતો હોય એવા સ્થાનમાં જાઓ. શાંત ચિત્તથી આ ધ્વનિપ્રવાહને કેટલોક વખત સુધી સાંભળ્યા કરો. પછી સૂક્ષ્મ કાર્યોન્નિય દ્વારા આ ધ્વનિને સાંભળતા રહો. વચ્ચમાં ન્યારે અવાજ શિથિલ થઈ જાય ત્યારે આંગળીઓ ઢીલી કરીને અવાજ સાંભળી લો અને ફરી પાછા કાન બંધ કરી દો અને ધ્યાન દ્વારા ધ્વનિ ચ્છાણ કરો.

આવી શબ્દસાધનામાં લાગી રહેવાથી મન એકાગ્ર થાય છે અને સાથે સાથે સૂક્ષ્મ કાર્યોન્નિય પણ જગ્યત થાય છે. આને લીધે દૂર બેસીને વાત કરનારાઓનો અવાજ સૂક્ષ્મ કાર્યોન્નિયમાં આવી જાય છે. અતિ દૂર થતી ગુપ્ત વાતોનો આભાસ થઈ જાય છે. દેશવિદેશમાં થતાં નૃત્ય, ગીત, વાદ્ય આદિના ધ્વનિતરંગો કાનોમાં આવીને ચિત્તને આનંદ અને ઉદ્ઘાસથી ભરી દે છે.

### રૂપસાધના :-

(૧) વેદમાતા ગાયત્રીની અથવા સરસ્વતી, દુર્ગા, લક્ષ્મી, રામ, કૃષ્ણ વગેરે કોઈ પણ ઈષ્ટેવની જે સારામાં

સારી પ્રતિમા અથવા ચિત્ર હોય તે લેવું. એકાંત સ્થાનમાં જ્યાં પૂરતો પ્રકાશ હોય ત્યાં બેસવું. આ ચિત્ર અથવા પ્રતિમાના દરેક અંગને બરાબર ધ્યાનપૂર્વક જોવું. એના રૌંદર્ઘ અને વિશેષતાઓનું બારીકાઈથી નિરીક્ષાગુરુનું કરવું. એક મિનિટ એવી રીતે જોયા પછી આંખો બંધ કરી દેવી. હવે આ ચિત્રના રૂપનું ધ્યાન કરો અને જે બારીકાઈઓ, વિશેષતાઓ અને સુંદરતાઓ ચિત્રમાં જોઈ હતી તે સર્વને કલ્પનાશક્તિ દ્વારા ધ્યાનચિત્રમાં યોજ્ય સ્થળે બેસાડો. પછી નેત્રો ખોલી દો અને આ છબીને જુઓ. ધ્યાનની સાથે તું મંત્રનો જ્યપ પાગ ચાલુ રાખો. આ પ્રમાણે વારેવાર કરવાથી એ રૂપ મનમાં બેસી જશે. આપણાં દિવ્ય નેત્રોથી આ રૂપનાં દર્શન કરવાથી ધ્યાનો આનંદ આવશે. ધીર ધીર આ ચિત્રની મુખાકૃતિ બદલાય છે તેવો ભાસ થશે. હસતી હોય, સ્મિત કરતી હોય, કદીક નારાજ થતી હોય, કદીક ઉપેક્ષા કરતી હોય એવા વિવિધ ભાવો ધારાગુરુની જાગ્રાશે. આ પ્રતિમા કદી સ્વર્ણમાં અથવા જગૃત અવસ્થામાં પાગ દેખા દેશે અને એક વખત એવો પાગ આવશે કે જ્યારે તેનો સ્પષ્ટ અને પ્રત્યક્ષ સાક્ષાત્કાર પાગ થાય. શરૂઆતમાં આ સાક્ષાત્કાર બહુ જ આંખો હેશે. પછી ધીર ધીર ધીર ધ્યાનસિદ્ધ થતાં આ પ્રતિમા અધિક સ્પષ્ટ થતી જશે. પહેલાં આ દિવ્યદર્શન ધ્યાનશૈન્ત્રમાં જ રહેશે અને ધીમે ધીમે એ પ્રત્યક્ષ સ્વરૂપ ધારાણ કરશે.

(2) કોઈ પાગ મનુષ્યના રૂપનું ધ્યાન પ્રબળ માનસિક આવેગપૂર્વક ને ભાવનાથી કરવામાં આવશે તે જ ભાવનાઓને અનુરૂપ પ્રભાવ એ વક્તિ ઉપર પડશે. કોઈના વિચાર બદલવા, દ્વેષ દૂર કરવો, મધુર સંબંધ બાંધવો ને તોડવો, આશીર્વાદ તથા શાપથી હાનિ-લાભ પહોંચાડવાં વગેરે પ્રયોગો આ સાધનાના આધારે થાય છે. તાત્ત્વિક આકર્ષણ કરીને તેને રોગી, ગાંડો અથવા આજ્ઞાનુસારી બનાવી દેતા જોવા મળે છે.

(3) છાયાપુરુષની સિદ્ધિ એ પાગ સાધનાનું એક અંગ છે. ભોજન કર્યા વગર શુદ્ધ શરીર અને શુદ્ધ વસ્ત્રો સાથે મનુષ્યની લંબાઈ નેટલા મોટા દર્પણમાં પોતાની આકૃતિ ધ્યાનપૂર્વક જોવી. થોડા વખત પછી આંખો બંધ કરીને એ જ આકૃતિનું ધ્યાન ધરવું. તમારી છબી તમને પ્રત્યક્ષ દેખાશે. કોઈ કોઈ વક્તિ દર્પણને બદલે પોતાની મુખાકૃતિ સ્વચ્છ પાણીમાં, તલના તેલમાં અથવા પીગાળેલા ધીમાં જોઈને તેનું ધ્યાન કરે છે, દર્પણની સાધના મનોરંજક, જળસાધના શાંતિદાયક, તેલની સાધના સંહારક અને ધીની સાધના ઉત્પાદક હોય છે. સૂર્ય અથવા ચંદ્ર જ્યારે આકાશમાં એવા સ્થાન પર હોય કે જેના પ્રકાશમાં ઊભા રહેવાથી પોતાનો પહંચાયો તાં હાથનો રહે. એવા વખતે પોતાની છાયા પર પાગ આ પ્રકારે સાધના થઈ શકે છે. સૂર્યની સાધના સિદ્ધિદાતા અને ચંદ્રની સાધના કલ્યાણકારક માનવામાં આવી છે.

દર્પણ, જળ, તેલ, ધી વગેરેમાં પોતાની મુખાકૃતિ સ્પષ્ટ દેખાય છે અને આંખો બંધ કર્યા પછી તેવું જ ધ્યાન થાય છે. ચંદ્રની સામે પીઠ ફેરવીને ઊભા રહેતાં પોતાની છાયા સામે આવે છે. એને ખુલ્લી આંખોથી સારી રીતે જોઈ લીધા પછી આંખો બંધ કરીને એ કાળી છાયાનું ધ્યાન કરવામાં આવે તો થોડાક દિવસના અભ્યાસ પછી એ છાયામાં પોતાની મુખાકૃતિનાં પાગ દર્શન થશે.

અમુક વખત નિરંતર આ છાયા-સાધના કરતા રહેવામાં આવે તો પોતાની આકૃતિનું એક અલગ વક્તિન્ય બની જશે અને તેમાં જે પોતાના સંકલ્પબળ અને પ્રાગશક્તિનું સંમિશ્રણકરવામાં આવે તો એ એક સ્વતંત્ર ચેતનાવાળું પ્રાણી બની જશે તેમાં શંકા નથી. તેના અસ્તિત્વને આપણે “આપણું જીવતું ભૂત” પાગ કહી શકીએ. શરૂઆતની અવસ્થામાં એ આકાશમાં ઊડતું અથવા આપણી આસપાસ ફરતું માલૂમ પડશે. પછી જ્યારે તેના ઉપર આપણું નિયંત્રણ આવી જશે ત્યારે તો એ આજ્ઞાનુસાર પ્રકટ થશે અને કાર્ય કરશે. જેનો પ્રાગ નિર્બળ હોય તેનો આ માનસપુત્ર (છાયાપુરુષ) પાગ નિર્બળ હોય અને પોતાનું રૂપ બતાવ્યા સિવાય બીજું કાંઈ વિશેષ નહીં કરી શકે, પાગ જેનો પ્રાગ બળવાન છે તેનો છાયાપુરુષ બીજા અદશ્ય શરીરની માફક કામ કરે છે. એક સ્થૂળ દેહ બીજો સૂક્ષ્મ દેહ- બંને પ્રકટ દેહો વડે સાધક ધારો સુંદર લાભ મેળવી શકે છે. સાથે સાથે રૂપસાધના દ્વારા મનને વશમાં લેવાનું અને એકાગ્રતા

કેળવવાનું કામ થાય છે એ તો પ્રત્યક્ષ લાભ જ છે.

## રસસાધના :

જે ફળ તમને સૌથી વધારે સ્વાદિષ્ટ અને રુચિકર લાગે તેને જ રસસાધના માટે પસંદ કરો. પાકેલી કલમી કેરી તમને બહુ ભાવતી હોય તો તેના પાંચ નાના નાના ટુકડા કરો. એ પૈકી એક ટુકડો જાબ ઉપર મૂકી ત્યાં તેને એક મિનિટ સુધી રહેવા દઈ તેના સ્વાદનો અનુભવ કરો. પછી એ ટુકડો ફેંકી દો અને તેના પૂર્વસ્વાદનું સ્મરણ એવી રીતે કરો કે જેથી કેરી ખાધા સિવાય જ તેનો સ્વાદ જીબને આવ્યા કરે. બે મિનિટમાં અનુભવ શિથિલ થતો જશે, એટલે બીજો ટુકડો મોંમાં મૂકવો અને પૂર્વવત્ત એના સ્વાદનો અનુભવ કરી તેને ફેંકી દેવો. આ પ્રમાણે પાંચ વાર કરવામાં લગભગ પંદર મિનિટ થઈ જશે.

આ પ્રમાણે આસ્તે આસ્તે જીબને ટેવ પાડવી. કોઈ સ્વાદિષ્ટ વસ્તુ જાબ ઉપર રાખી મૂકવાનો સમય ઓછો કરવો અને તે વસ્તુ સિવાય તેના રસના આસ્વાદનો સમય વધારતા જવું. કેટલાક વખત પછી કોઈ પાણ વસ્તુને જાબ ઉપર રાખ્યા સિવાય જ કેવળ ભાવના માત્રથી ઈચ્છિત વસ્તુનો રસાસ્વાદ ઠીક ઠીક લાંબા વખત સુધી ચાલુ રહેશે.

શરીરને માટે જે રસોની આવશ્યકતા છે તે જોઈએ તે જોઈએ પ્રમાણમાં આકાશમાં ભ્રમણ કરતા રહે છે. સંસારમાં જેટલા પદાર્થો છે તેમનો અંશ વાયુ રૂપમાં, થોડો પ્રવાહી રૂપમાં અને થોડો ધન રૂપમાં હોય છે. અત્રને આપાણે ધન સ્વરૂપમાં જ જોઈએ છોએ. ભૂમિમાં અને જળમાં એ પરમાણુ રૂપમાં રહે છે અને આકાશમાં તેનો વાયુઅંશ ઊડતો ફેરે છે. રસસાધનાની સિદ્ધિ થઈ જવાથી આકાશમાં ઊડતા અત્રના વાયુઅંશને મનોબળ દ્વારા સંકલ્પશક્તિથી આકષ્મિત કરીને ઉદ્રસ્થ કરી શકાય છે. પ્રાચીનકાળમાં ઔષિલોકો દીદીકાળ સુધી અત્રનજીવિ લીધા સિવાય તપ કરી શકતા હતા. એ લોકો તેમની સિદ્ધિ દ્વારા આકાશમાંથી જોઈતો અન્નાહાર બેંચી શકતા હતા અને તેથી તેમનું કામ ચાલતું હતું. આ સાધનાના સાધક મૂલ્યવાન પૌષ્ટિક પદાર્થો, ઔષધીઓ અને સ્વાદિષ્ટ રસનો ઉપભોગ પોતાના સાધનાબળ દ્વારા પ્રાપ્ત કરી શકે છે તથા આકાશમાંથી બેંચીને આ રીતે બીજાઓને આપી પાણ શકે છે.

## ગંધસાધના :

આ સાધનામાં નાસિકાના અચ્ચભાગ ઉપર ત્રાટક કરવાની આવશ્યકતા છે. બંને નેત્રોથી એકીસાથે નાસિકાના અચ્ચભાગ ઉપર ત્રાટક થઈ શકતું નથી. તેથી એક મિનિટ જમાણી અને એક મિનિટ ડાબી આંખથી ત્રાટક કરવું. જ્યારે જમાણી આંખથી ત્રાટક થતું હોય ત્યારે નાકની જમાણી બાજુ અને ડાબી આંખથી ત્રાટક થતું હોય ત્યારે નાકની ડાબી બાજુએ ગંભીર દણી નાંખવી. શરૂઆત એક એક મિનિટથી કરતાં કરતાં અંતમાં પાંચ મિનિટ સુધી વધારતા જવું. આ ત્રાટકથી નાસિકાની સૂક્ષ્મ શક્તિઓ જગ્યત થાય છે.

આ ત્રાટક પછી કોઈ સુગંધિત તથા સુન્દર પુષ્પ બેનું. તેને નાસિકાની નજીક લઈ જઈ એક મિનિટ સુધી ધરી ધરિ સુધ્યબું અને તેની ગંધનું સારી રીતે સ્મરણ કરવું. પછી એ ફ્લાને ફેંકી દેવું અને ફ્લાન સિવાય જ તેની સુવાસનું બે મિનિટ સુધી સ્મરણ કરવું. ત્યાર પછી બીજો ફ્લાન લઈ એ જ ફ્લાન પુનરાવૃત્તિ કરવી. આવી રીતે પાંચ ફ્લાનોનો પંદર મિનિટ સુધી પ્રયોગ કરવો. ધ્યાન રાખો કે ઓછામાં ઓછું એક અઠવાડિયા સુધી એક જતનાં ફ્લાનોનો પ્રયોગ કરવો જોઈએ.

કોઈ પાણ સુંદર અને સુવાસિત ફ્લાન ગંધસાધના માટે લઈ શકાય છે. જુદાં જુદાં ફ્લાના ગુણો જુદા જુદા હોય છે. ગુલાબ પ્રેમોત્પાદક, ચમેલી બુદ્ધિવર્ધક, હજારી ઉત્સાહવર્ધક, ચંપો સૌદ્યવર્ધક, મોગરો સંતાનવર્ધક, કેદકી રોગનાશક, કંદબ શાંતિદાયક, કરેણ ઉષળ, સૂર્યમુખી ઓજસવર્ધક છે. આવી રીતે દરેક પુષ્પમાં ખાસ ગુણ હોય છે. જે પુષ્પને સામે રાખીને ધ્યાન કરવામાં આવે તેનો સૂક્ષ્મ ગુણ આપાણામાં વધશે.

ગંધયોગની સાથે હવનનો સંબંધ છે. કોઈ પણ પદાર્થની પ્રાણશક્તિ પ્રાપ્ત કરવી હોય તો તેનો વિધિપૂર્વક હવન કરવો જોઈએ. તેનાથી પદાર્થનું સ્થૂલ રૂપ નાશ પામશે, પણ તેનું સૂક્ષ્મ રૂપ વાયુની ચારે બાજુ ફેલાઈને સમીપવર્તી લોકોની પ્રાણશક્તિમાં જરૂર વધારો કરશે. સુગંધિત વાતાવરણમાં અનુકૂળ પ્રાણની માત્રા અધિક હોય છે. એટલા માટે નાસિકા દ્વારા એવી સુગંધ પ્રાપ્ત થતાં અંતઃકરણ પ્રસંગ થાય છે.

ગંધસાધનાથી મનની એકાશ્રતા ઉપરાંત ભવિષ્યની કાંઈક આંખી થવાની શક્તિ પણ વધે છે. સૂર્યસ્વર (જમણો) અને ચન્દ્ર સ્વર (ડાબો) સિદ્ધિ થતાં સાધક એક સારો ભવિષ્યવેત્તા બની શકે છે. નાસિકા દ્વારા સધાતો સ્વરયોગ પણ ગંધ સાધનાની એક શાખા છે.

## સ્પર્શસાધના :

(૧) બરઝ અથવા કોઈ અન્ય શીતળ પદાર્થ શરીર પર એક મિનિટ લગાડી પછી હઠાવી લેવો અને બે મિનિટ સુધી એ જ શીતળતાનો અનુભવ કરવો. સહન થઈ શકે ટેટલો ગરમ કરેલો પથ્થર શરીરને અડકાડીને તેનો અનુભવ કાયમ રાખવાની ભાવના કરવી. પંખો નાખીને હવા લેવી, સુંવાળા કાચનો ગોળો અથવા નરમ ઇનો દડો ત્વચાને અડકાડીને પછી એ સ્પર્શનું ધ્યાન કરવું એ પણ એક એવી જાતનો અભ્યાસ છે. બ્રથથી ઘસવું અથવા લોંડનો ગોળો ઉઠાવવો વગેરે અભ્યાસથી પણ એ રીતે ધ્યાનભાવના થઈ શકે છે.

(૨) કોઈ સપાટ જમીન ઉપર બહુ જ સુંવાળી ગાદી બિધાવવી અને તેના ઉપર ચત્તા સૂઈ જવું. થોડીકવાર સુધી તેની કોમળતાનું સ્પર્શસુખ અનુભવતા રહેવું. ત્યાર પછી આવી ગાદી સિવાય કઠણ જમીન અથવા પાટિયા પર સૂઈ જવું. કઠણ જમીન પર સૂતાં સૂતાં કોમળ ગાદીના સ્પર્શની ભાવના કરવી. એથી ઊલટું ગાદી પર સૂઈ જઈને કઠણ જમીનની ભાવના કરવી. આવી રીતે એક પરિસ્થિતિમાં રહીને તેનાથી વિરુદ્ધ વાતાવરણની ભાવના કરવાથી તિતિક્ષાની સિદ્ધિ મળે છે. સ્પર્શસાધનામાં સફળતા મળતાં શારીરિક કષ્ટોને હસતાં હસતાં સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે.

સ્પર્શસાધનાથી તિતિક્ષાની સિદ્ધિ મળે છે. ઠંડી, ગરમી, વરસાદ, ચાંદું, દરદ વગેરેથી જે કષ્ટ થાય છે તેનું કારણ ચામડીમાં જળની માફક ફેલાઈ રહેલા જ્ઞાનતંતુઓ છે. આ જ્ઞાનતંતુઓ નાના સરખા આધાત અથવા કષ્ટના અનુભવને મગજ સુધી પહોંચાડે છે અને તે જ પ્રમાણે મગજને પીડાનું ભાન થાય છે. કોકેનનું ઈન્ફેક્શન આપીને આ જ્ઞાનતંતુઓને શિથિલ કરી દેવામાં આવે તો ઓપરેશન કરતી વખતે પણ તે સ્થાન પર પીડા થતી નથી, કોકેનના ઈન્ફેક્શનથી પાછળથી શરીરને હાનિ થાય છે, પણ સ્પર્શસાધના દ્વારા પ્રાપ્ત થયેલી “જ્ઞાનતંતુ-નિયંત્રણ શક્તિ” કોઈ પણ પ્રકારની હાનિ કર્યા સિવાય નાડી-સંસ્થાનતા અનેક વિકારોને દૂર કરવામાં સફળ થાય છે અને સાથે સાથે શારીરિક પીડાઓનું ભાન પણ થવા દેતી નથી.

ભીજ પિતામહ ઉત્તરાણના સૂર્યની પ્રતીક્ષા કરતા કરતા મહિનાઓ સુધી બાણશયા પર પડી રહ્યા હતા. શરીરના ઇંવે ઇંવે બાળો ધૂસ્યાં હતાં, તે છતાં એના કષ્ટી આંકંદ કરવાનું તો બાજુમાં રહ્યું, પણ તેમની આસપાસ એકુન્ન થયેલા લોકોને શાલ્કના અનેક ગૂઢ વિષયો પર ઉપદેશ આપવાનું ચાલુ રાખ્યું. આટલું સહન કરવાની શક્તિ ત્યારે જ આવી શકે, જ્યારે એમાણે તિતિક્ષા માટે સિદ્ધિ મેળવી હોય.

સ્પર્શસાધનાથી ચિત્તની વૃત્તિઓ એકાશ થાય છે. મનને વશ કરવાનો લાભ થાય છે જ, પણ તે ઉપરાંત તિતિક્ષાની સિદ્ધિ પણ મળે છે, જેને લીધે કર્મયોગ અને પ્રકૃતિપ્રવાહથી શરીરને થતાં કષ્ટો ભોગવવામાંથી સાધક બચી જાય છે.

મનને આજાંકિત, નિયંત્રિત અને અનુશાસિત બનાવવું એ જીવનને સફળ બનાવવાની અત્યંત મહત્વપૂર્ણ

આવી છે. પોતાનો દિક્કોણ આધ્યાત્મિક હોય કે ભૌતિક હોય, પોતાની પ્રવૃત્તિ સ્વાર્થની હોય કે પરમાર્થની હોય, ગમે તેવી સ્થિતિમાં મન ઉપર સંપૂર્ણ કાબૂ હોવો એ અત્યંત અગત્યની વાત છે. ઉચ્છુંખલ, ચંચળ અને અવ્યવસ્થિત મન ન તો આ લોક મેળવી શકશે, ન તો પરલોક. આથી મનોનિયાત્ર પ્રત્યેક વ્યક્તિ માટે આવશ્યક છે.

માનસિક અવ્યવસ્થા દૂર કરીને મનોબળ પ્રાપ્ત કરવા જે સાધનાઓ આ પ્રકરણમાં બતાવવામાં આવી છે એ ઘણી સરળ ઉપયોગી અને સર્વસુલભ છે. ધ્યાન, ત્રાટક, જ્યષ્ઠ અને તન્માત્રા સાધનાથી મનની ચંચળતા દૂર થશે અને સાથે બીજી સિદ્ધિઓ પણ મળશે. પાશ્ચાત્ય યોગીઓની મેસ્મેરિઝમની પદ્ધતિથી કરવામાં આવતી માનસિક વિધિથી થતી મનોસાધના બેવડો લાભ કરે છે.

વશમાં આગેલું મન સર્વથી મોટો મિત્ર છે. મન સાંસારિક અને આત્મિક- બંને પ્રકારની અનેક એવી બેટો આપે છે કે જેને મેળવીને માનવજીવન ધન્ય બની જાય છે. એવું કહેવાય છે કે દેવલોકમાં એક એવું કલ્પવૃક્ષ છે કે જેની નીચે બેસવાથી માનવી પોતાની ગમે તે કામના પૂરી કરી શકે છે. મૃત્યુલોકમાં વશવર્તી આજ્ઞાધીન મન એ એવું જ કલ્પવૃક્ષ છે. આવું પરમ સૌભાગ્ય જેને પ્રાપ્ત થાય તેને અનંત ઐશ્વર્યનું આધિપત્ય મળી ગયું સમજવું.

અનિયંત્રિત મન અનેક વિપત્તિઓનું મૂળ છે. જ્યાં અગિન રાખ્યો હોય તે સ્થાનને તે સળગાવે છે. જે દેહમાં અસંયમિત મન રહેતું હોય તેને હંમેશાં નવી નવી વિપત્તિઓ, આપદાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. એટલા જ માટે અધ્યાત્મવિદ્યાના શાલાઓએ મનને વશમાં વેવાની સાધનાઓને ખૂબ મહત્વપૂર્ણ માની છે.

ગાયત્રીનું ત્રીજું મુખ મનોમય કોશ છે. આ કોશને સુઅવસ્થિત બનાવી લેવોએ દેહનું ત્રીજું બંધન ખોલવા બરાબર છે, આત્મોન્તતિની બીજી કક્ષાને પાર કરવા બરાબર છે.

## ૭. વિજ્ઞાનમય કોશ

અન્નમય, પ્રાણમય અને મનોમય એમ ત્રાણે કોશો ઉપરાંત આત્માનું ચોથું આવરાણ, ગાયત્રીનું ચોથું મુખ વિજ્ઞાનમય કોશ છે. આત્મોન્તતિની ચતુર્થ ભૂમિકામાં વિજ્ઞાનમય કોશની સાધના કરવાની હોય છે.

વિજ્ઞાનનો અર્થ છે વિશેષ જ્ઞાન. સાધારાણ જ્ઞાનથી આપાગે પોતાના વહેવારની તથા શારીરિક, વ્યાપારી, સામાજિક, કલાત્મક તથા ધાર્મિક વાતોને જ સમજ છીએ. શાળાઓમાં આજે સામાન્ય જ્ઞાનનું શિક્ષણ મળે છે. રાજ્યાંત્રિ, અર્થશાસ્ત્ર, શિલ્પ, રસાયણવિદ્યા, ચિકિત્સા, સંગીત, વક્તૃત્વ, લેખન, વિવસાય, કૃષિ, નિર્માણ વગેરે જુદા જુદા વિષયોનું જ્ઞાન જુદી જુદી રીતે મેળવી શકાય છે. આ જ્ઞાનના આધારે શરીરની સાથે સંબંધ રાખું સાંસારિક જીવન ચાલે છે. જેની પાસે આ જ્ઞાન જેટલા પ્રમાણમાં વધારે હોય તેટલા પ્રમાણમાં તેનો વહેવાર અને એનું સાંસારિક જીવન ઉત્ત્રત, યશસ્વી, પ્રતિષ્ઠિત અને ઐશ્વર્યવાન હોય.

પરંતુ એ સાધારાણ જ્ઞાનનું પરિણામ સ્થૂલ શરીર સુધી જ મયાદિત છે. આત્માનો તેની સાથે બહુ ઓછો સંબંધ હોય છે. ઘણી વખત જેવામાં આવે છે કે કોઈ વ્યક્તિ બહુ ધનવાન, પ્રતિષ્ઠિત, નેતા અને ગુણવાન હોવા છતાં આત્મિક દિક્કોએ ખૂબ જ પાછળ હોય છે. ઈશ્વર, જીવ, પ્રકૃતિ, વેદાંત, યોગ વગેરે બાબતમાં વાંચી-સાંભળીને ઘણું જાગુણી લે છે અને મોટી મોટી વાતો કરે છે અને મિત્રવર્ગમાં પોતાની વિજ્ઞતાની છાપ પાડવાનો પ્રયત્ન કરે છે. છતાં વાસ્તવિક રીતે એની આત્મિક ધારણાઓ ઘણી નિર્બળ હોય છે. શ્રદ્ધા અને વિશ્વાસની દિક્કોએ એમની સ્થિતિ સામાન્ય લોકો કરતાં વધારે સારી હોતી નથી.

ગીતા, ઉપનિષદ, રામાયાણ, વેદ, શાસ્ત્રો વગેરે સદ્ગાંથોનું વાંચન તથા સત્પુરુષો અને આચાર્યોનાં પ્રવચન અને વ્યાખ્યાન વગેરે સાંભળીને આત્મિક વિષયોનું જ્ઞાન વધે છે, જે એ ક્ષેત્રમાં આગળ જવાની ઈચ્છાવાળાઓને

ઉપયોગી પણ છે, પરંતુ એ વિષયોનું વિસ્તૃત જ્ઞાન હોવા માત્રથી આત્મજ્ઞાન થઈ જય એવું નથી.

આ પુસ્તકના આરંભમાં જ વાગુણ અને ભૂગુની કથા આપવામાં આવી છે. ભૂગુ પૂર્ણ વિજ્ઞાન હતો, વેદાંતનો તે જ્ઞાતા હતો, એમ છતાં એ જાગતો હતો કે એને આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન તથા વિજ્ઞાન પ્રાપ્ત થયું નથી. એટલા માટે જ એ પોતાના પિતા વાગુણ પાસે ગયો અને તેણે પ્રાર્થના કરી કે “હે ભગવાન, મને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપો.” વાગુણ ભૂગુને કોઈ પુસ્તક ન ભાગુણું કે ન આપ્યું કોઈ વાખ્યાન કે પ્રવચન. ઊંઠું એને આદેશ આપો કે “તપ વાગુણ ભૂગુને કોઈ પુસ્તક ન ભાગુણું કે ન આપ્યું કોઈ વાખ્યાન કે પ્રવચન. ઊંઠું એને આદેશ આપો કે “તપ કરો.” તપ કરતાં કરતાં એક એક કોશ પાર કરતાં કરતાં કુમશ: એણે બ્રહ્મજ્ઞાન મેળવ્યું. આવી અનેક કથાઓ છે. ઉદાલકે શૈતકેતુને, બ્રહ્માએ ઇન્દ્રને, અંગિરાએ વિવસ્ત્વાનને આ જ રીતે તપ કરીને બ્રહ્મને જાગવાનો ઉપદેશ આપો હતો.

જ્ઞાનનો અર્થ છે જાગવું. વિજ્ઞાનનો અર્થ છે શ્રદ્ધા, ધારણા, માન્યતા, અનુભૂતિ. આત્મવિજ્ઞાના જિજ્ઞાસુઓ જાગુ છે કે ‘આત્મા અમર છે, શરીરથી ભિન્ન છે અને ઈશ્વરનો અંશ છે, સાચ્યદાનંદ સ્વરૂપ છે,’ પરંતુ એ જ્ઞાનનો એક કાગ પાગ અનુભવમાં આવ્યો હોતો નથી. પોતાને અને પોતાના જેવા બીજાઓને મરતા જોઈને હદ્ય હાલી ઊંઠે છે. શરીરિક લાભો માટે પ્રતિ જ્ઞાન આત્માના લાભોની ઉપેક્ષા કરવામાં આવતી હોય છે. દીનતા, અભાવ, દૃષ્ટિ, લાલસા એ વૃત્તિઓ હંમેશાં સત્તાવતી હોય તો કેવી રીતે કહી શકાય કે આત્માની અમરતામાં, શરીરની ભિન્નતામાં અને ઈશ્વરના અંશ હોવાની માન્યતામાં અમને વિશ્વાસ છે, આસ્થા છે, શ્રદ્ધા છે?

પોતાના સંબંધમાં આ જાતની તાત્ત્વિક માન્યતા સ્થિર કરવી અને એનો પૂરેપૂરો અનુભવ કરવો એ વિજ્ઞાનનો ઉદ્દેશ છે. સામાન્ય માણસ પોતાને શરીર જ માને છે. પોતે કોણ છે એ પ્રશ્નના ઉત્તરમાં એ એની જાતિ, વંશ, પ્રદેશ, સંપ્રદાય, વ્યવસાય, પદ, વિદ્યા, ધન, આયુષ, સ્થિતિ, લિંગ વગેરેનો આધાર લે છે. સામાન્ય માણસ પોતાને ઓળખાવવા ઉપલી વાતોનો જ આધાર લે છે અને સાચેસાચ એ પોતાને એવો જ સમજે છે. એની માન્યતાના આધારે જ પોતાનો સ્વાર્થ નક્કી કરે છે. જે સ્થિતિમાં એ પોતે છે તે સ્થિતિનો અહંકાર પોતાનામાં જગૃત થતાં એ સ્થિતિ અને અહંકારની જે રીતે પૂર્તિ, પુષ્ટિ અને સંતોષ થવાનો સંભવ હોય એવી જ એના જીવનની અંતરંગ નીતિ બની જય છે.

બહારના લોકો ધર્મ અને સદાચારની તથા સિદ્ધાંતો અને આદર્શોની વાતો કરતા હોય જ ત્યારે પાણ પોતાના અંતરંગ જીવનની નીતિ જે પ્રેરણા આપે છે તે જ દિશામાં તેમનું અંત:કરાગ કામ કરશે. જ્યારે આપાગે શરીરને જ અંતરંગ જીવનની લીધું છે ત્યારે શરીરનું સુખ એ જ આપાગું ધ્યેય બનવું જોઈએ. ઇન્દ્રિયભોગોની, મોન્યમજાની, માન-સર્વસ્વ માની લીધું છે ત્યારે શરીરનું સુખ એ જ આપાગું ધ્યેય બનવું જોઈએ. આ સુખને માટે ધનની જરૂર પડે છે અને તેથી વધારે ધન બેગું કરવું અને ભોગ તથા ઐશ્વર્યમાં મજબ રહેવું એ જ આપાગો મુખ્ય કાર્યક્રમ થઈ જય છે. એના ઉપરાંત જે કંઈ કરવામાં આવે તે માત્ર મન બહેલાવવા માટે માત્ર વિનોદ ખાતર જ હોય છે.

એવા લોકો કદી કદી ધર્મચર્ચા અથવા પૂજાપાઠ કરતા જેવા મળે છે, પાણ એ માત્ર એમના માનસિક આનંદ ખાતર જ હોય છે. એમનું સ્થિર લક્ષ્ય તો પોતાની માન્યતાના આધારે નક્કી કર્યું હોય એ જ રહે છે. સામાન્ય રીતે આને આવી જ ભૌતિક દાણિ સર્વત્ર જેવા મળે છે. ધન અને ભોગની લૂંટ કરવામાં એકબીજાની હરીકાઈ કરવામાં એ જ દાણિઓ લોકો મરણિયા બનીને પ્રયત્ન કરે છે. આજનો ભયંકર જીવનકલબ અને કલેશ કંકાસ એનું જ પરિગ્રામ છે.

આ અજ્ઞાનરૂપી અંધકારમાંથી વિજ્ઞાન આપાગને બચાવે છે. જે મનોભૂમિ ઉપર પહોંચીને જીવ એવો અનુભવ કરે છે કે “હું શરીર નથી, પાણ આત્મા છું.” એ મનોભૂમિને વિજ્ઞાનમય કોશ કહે છે. જ્યાં સુધી જીવ અત્રમય કોશમાં રહે છે ત્યાં સુધી એ પોતાને લ્યી, પુરુષ, મનુષ્ય, જાડો, પાતળો, પહેલવાન, રોગી, કાળો, ગોરો જાથી મહાવિજ્ઞાન - ભાગ-૩

વગેરે શરીર સંબંધી લેદોથી પિછાણે છે. જ્યારે જીવ પ્રાણમય કોશમાં હોય છે ત્યારે ગુણોના આધારે પોતાને ઓળખે છે. શિલ્પી, સંગીતકાર, વિજ્ઞાન, મૂર્ખ, કાયર, શૂરવીર, લેખક, વક્તા, ધનવાન, ગરીબ વગેરેની માન્યતા પ્રાણમય ભૂમિકાની હોય છે. મનોમય કોશની ભૂમિકામાં પોતાની ઓળખનો આધાર સ્વભાવ ઉપર હોય છે. જેમને લોભી, દંભી, ચોર, ઉદાર, વિષયી, સંયમી, આસ્તિક, નાસ્તિક, સ્વાર્થી, પરમાર્થી, દ્યાળું વગેરે. કર્તવ્ય અથવા ધર્મની ઉચ્ચિતતા અથવા અનુચ્ચિતતા સંબંધી માન્યતાઓ ઉપર આપણો જીવ મનોમય ભૂમિકા ઉપર-ત્રીજી કક્ષામાં પહોંચે છે. આનાથી ઊચી ચોથી કક્ષા વિજ્ઞાનમય ભૂમિકાની છે, જ્યાં પહોંચીને જીવને એવો અનુભવ થાય છે કે “હું શરીરથી, ગુણોથી, સ્વભાવથી ઊચો છું. હું ઈશ્વરનો રાજકુમાર, અવિનાશી આત્મા છું.”

પોતાને આત્મા કહેવડાવનરા અસંખ્ય લોકો છે. એમને આત્મજ્ઞાની કહી શકાય નહીં. આત્મજ્ઞાની તો એ છે કે જે દદ વિશ્વાસપૂર્વક અને પૂર્ણ શ્રદ્ધાથી પોતાના અંતરમાં એવો અનુભવ કરે છે કે “હું વિશુદ્ધ આત્મા છું અને આત્મા સિવાય બીજું કાંઈ જ નથી. શરીર માટું વાહન છે. પ્રાણ માટું અલ્લ છે. મન મારો સેવક છે. હું તે સહુથી ઉપર, તે સહુથી જુદો, તે સહુનો સ્વામી આત્મા છું. મારો સ્વાર્થ એ બધાથી અલગ છે. મારો લાભ અને સ્થળું શરીરના લાભોમાં, સ્વાર્થોમાં મોટું અંતર છે.” એ અંતરને સમજીને જીવ જ્યારે પોતાના લાભ, સ્વાર્થ, હિત અને કલ્યાણ માટે કટિબદ્ધ થાય છે, આત્મોન્તરિત માટે કમર કસે છે ત્યારે એને પોતાનું સ્વરૂપ વધારે સ્પષ્ટ જાગ્રાવા લાગે છે.

વિજ્ઞાનમય કોશની ચોથી ભૂમિકામાં પહોંચેલા જીવનો દિશિકોણ સાંસારિક જીવોના દિશિકોણથી ભડું ભિન્ન હોય છે. ગીતામાં યોગીનાં લક્ષણો બતાવ્યાં છે કે “જ્યારે સંઘણા જીવો સૂતા હોય છે ત્યારે યોગી જગતો હોય છે અને જ્યારે સર્વ જીવો જગતા હોય છે ત્યારે યોગી સૂઅે છે” આ આલંકારિક શબ્દોમાં રાતમાં જગવાની અને દિવસમાં સૂવાની વાત નથી, પણ એમ બતાવ્યું છે કે જે વસ્તુઓ માટે સામાન્ય જનસમાજ અતિશય ઈચ્છા કરતો હોય, તરફડતો હોય, વૃધુણાતુર રહેતો હોય તે વસ્તુ તરફ યોગી બેદરકાર હોય છે, કારણ કે એ જાગે છે અને નુઅે છે કે કામિની અને કંચનની માયા શરીરને ગલીપચી કરે છે અને આત્માને હાગે છે. એવા ક્ષણિક સુખને માટે સ્થિર આનંદનો નાશ કરવો ઈષ્ટ નથી. જે ધન, સંતાન, કુટુંબકબીલા, શત્રુ, ભિન્ન, હાનિ, લાભ, નિંદા, સ્તુતિ વગેરે પ્રશ્નોમાં સામાન્ય લોકો રચાપચા રહે છે એ બાબતો યોગી માટે અબુધ બાળકોની બાલકીડા જેવી તુચ્છ અને મહત્વ વગરની હોય છે અને તેથી જ એ તરફ એ ઉદાસીન હોય છે. તે આ જંગળને કશું જ મહત્વ આપતો હોતો નથી. પરિણામે આ પ્રશ્નો આપોઆપ ઉક્લી જાય છે અથવા સમાપ્ત થઈ જાય છે.

જે કાર્યોમાં, જે વિચારોમાં કામી લોકો, માયથી મોહિત થયેલી વજ્ઞિત અત્યન્ત મોહગ્રસ્ત થઈને દદતાથી વળણી રહે છે તેનાથી યોગી દૂર ભાગે છે. એ રીતે અન્ય જીવો જગે છે, તાં યોગીને સૂતેલો માન્યો છે. એ રીતે જે કાર્યોમાં સંયમ, ત્યાગ, પરમાર્થ, આત્મલાભ વગેરે તરફ જીવોનું લક્ષ જતું નથી તે તરફ યોગીજન સંપૂર્ણપાણે સંલગ્ન રહે છે. આવી સ્થિતિ માટે ગીતાએ કહું છે કે જ્યારે બીજી જીવો સૂતા હોય ત્યારે યોગી જગતો હોય છે.

શરીરાત્રાને માટે સર્વ લોકોને લગભગ એકસરખો કાર્યક્રમ રાખવો પડે છે, પણ યોગી અને તેના જીવન તથા રીતિમાં તદ્દાવત હોય છે. સામાન્ય રીતે સર્વલોકો પ્રાતઃકાળ ઉઠે છે, નિત્યકર્મથી નિવૃત્ત થઈ ભોજન કરી કામમાં પરોવાય છે. સાંજ સુધી શ્રમ કરવો પડે છે. તેમાં મોટા ભાગનો સમય અન્ન, વશ્ય, જીવન અને આશ્રિતોની વ્યવસ્થામાં જાય છે. સાંજે ફીરી પાછું નિત્યકર્મ, ભોજન અને અંતે શ્યયન હોય છે. આ જ રીતે ધરતી ઉપર સર્વનું જીવન વ્યતીત થાય છે, પરંતુ બંનેની આંતરિક સ્થિતિમાં જમીન-આસમાનનો તદ્દાવત હોય છે. એક મનુષ્ય પોતાને શરીર માનીને શરીરસુખને માટે ધન અને ભોગ એકાંક્ષા કરવાનો આશય રાખીને દરેક વિચાર અને કાર્ય કરે છે. બીજે માણસ પોતાને આત્મા સમજીને આત્મકલ્યાણની નીતિ પર ચાલે છે અને શરીરને આત્માનું વાહન માત્ર સમજે છે.

આ દિક્કોણના તફાવતને લીધે પ્રથમ વક્તિનું કામ પાપ ને બંધન બની જય છે, જ્યારે બીજી વક્તિનું કામ પુરુષ અને યેજ બને છે.

આત્મજ્ઞાન, આત્મસાક્ષાત્કાર, આત્મલાભ, આત્મપ્રાપ્તિ, આત્મદર્શન અને આત્મકલ્યાણને જીવનનું લક્ષ્ય માન્યું છે. આ લક્ષ્ય યારે જ પૂરું થાય છે, જ્યારે આપણી અંતઃચેતના પોતાને માટે ‘પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ’ ની ભાવના સાથે એવો અનુભવ કરે કે વાસ્તવિક રીતે હું પરબ્રહ્મ પરમાત્માનો અંશ છું, અવિનાશી આત્મા છું. આ ભાવનાની પૂર્ણતા, પરિપૂર્વતા અને સફળતાનું નામ જ આત્મસાક્ષાત્કાર છે.

આત્મસાક્ષાત્કારની ચાર સાધના નીચે આપવામાં આવી છે. (૧) સોડહં સાધના, (૨) આત્માનુભૂતિ, (૩) સ્વરસંયમ, (૪) ગ્રંથિભેદ, આ ચાર સાધના વિજ્ઞાનમય કોશને પ્રબુદ્ધ- જગૃત કરનારી છે.

## સોડહં સાધના

આત્માના સૂક્ષ્મ અંતરાલમાં દૂરેક વક્તિને પોતાના સ્વત્વનું પૂર્ણ જ્ઞાન હોય છે. એ પોતાની સ્થિતિની પ્રત્યેક જ્ઞાન ધોખણા કરતું જ હોય છે કે જેથી એની બુદ્ધિ ભ્રમિત ન થાય અને એનું સાચું સ્વરૂપ એ ન ભૂલે. થોડુંક ધ્યાન આપવામાં આવે તો આત્માની આ ધોખણા આપણે સ્પષ્ટ રૂપમાં સાંભળી શકીએ છીએ અને આ અવાજ ઉપર નિરંતર ધ્યાન આપવામાં આવે તો ધોખણા કરનારા અમૃતતના ભંડારરૂપી આત્મા સુધી પહોંચી શકે છે.

જ્યારે આપણે શાસ લઈએ છીએ ત્યારે વાયુપ્રવેશની સાથે એક સૂક્ષ્મ ધ્વનિ થાય છે, જેનો અવાજ ‘સો.....’ જેવો થાય છે. જેટલો વખત શાસ અંદર રહે છે, એટલે કે સ્વાભાવિક કુંભક રહે છે, એટલીવાર અડ્ડા ‘અડડ’ ના જેવો વિરામ ધ્વનિ થાય છે અને જ્યારે શાસ બહાર નીકળે છે ત્યારે ‘હં.....’ એવો ધ્વનિ નીકળે છે. આ ત્રણે ધ્વનિઓ ઉપર ધ્યાન આપવામાં આવે તો અન્યા-અન્યની ‘સોડહં’ સાધના સધાય છે.

પ્રાતઃકાળે સૂર્યોદયની પૂર્વ નિત્યકર્મથી પરવારીને પૂર્વ તરફ મોઢું કરીને કોઈ શાંત જગ્યા પર બેસવું. કરોડરૂણું સીધી રાખવી. બંને હાથેને ભેગા કરીને ખોળામાં લઈ લેવા, આંખો બંધ કરવી. જ્યારે નાસિકા દ્વારા વાયુ અંદર જતો હોય ત્યારે સૂક્ષ્મ કાર્યાન્દ્રને સતેજ કરીને ધ્યાનપૂર્વક સાંભળવું કે વાયુની સાથે સાથે “સો.....” નો સૂક્ષ્મ ધ્વનિ પણ થઈ રહ્યો છે. એ જ પ્રમાણે જેટલો વખત શાસ અંદર રહેશે તેટલો વખત “અડડ.....” અને વાયુ નીકળતી વખતે “હં....” ના ધ્વનિ પર ધ્યાન કેન્દ્રિત કરવું. સાથે સાથે હદ્યપ્રદેશમાં રહેલા સૂર્યશક્ના પ્રકાશબિંદુમાં આત્માના તેજેમય સુદુરિંગની શ્રદ્ધા કરવી. જ્યારે શાસ અંદર જતો હોય અને ‘સો’ નો ધ્વનિ થઈ રહ્યો હોય ત્યારે એવો અનુભવ કરવો કે આ તેજબિંદુ પરમાત્માનો પ્રકાશ છે. ‘સો’ એટલે કે પરમાત્મા, ‘હમ્’ એટલે ‘હું.’ જ્યારે વાયુ બહાર આવે અને ‘હમ્’ નો ધ્વનિ થાય ત્યારે એ જ પ્રકાશબિંદુ હું છું એવી ભાવના કરવી.

‘અ’ ની વિરામ ભાવના પરિવર્તનના અવકાશની સૂચક છે. શરૂ શરૂમાં પેલા હદ્યશક્માં રહેલા પ્રકાશબિંદુને ‘સો’ ધ્વનિ થતી વખતે પરમાત્મા માનવામાં આવે છે અને પછી એ જ બિંદુને ‘હમ્’ ધ્વનિ વખતે જીવ માન્યો છે. આ ભાવ-પરિવર્તનને માટે ‘અ’ ની વચ્ચે અવકાશકાળ રાખ્યો છે. આ જ રીતે જ્યારે ‘હું’ સમાપ્ત થઈ જય, વાયુ બહાર નીકળી જય અને નવો વાયુ પ્રવેશ કરે છે ત્યારે પણ દીનભાવને હટાવી એ તેજબિંદુમાં બ્રહ્મભાવની સ્થાપના કરવાનો અવકાશ મળી જય છે. આ બંને અવકાશ ‘અડડ’ સમાન છે. એનો ધ્વનિ સાંભળી શકતો નથી. માત્ર ‘સોડહં’ નો ધ્વનિ થાય છે.

‘સો’ બ્રહ્મનું પ્રતિબિંબ છે, ‘ડ’ પ્રકૃતિનો પ્રતિનિધિ છે અને ‘હમ્’ જીવનો સૂચક છે. બ્રહ્મ, પ્રકૃતિ અને જીવ એ ત્રણેનું ‘અન્યા અપ’ માં ભિલન થાય છે. સોડહમ્ સાધનામાં ત્રણે મહાકારણ એકત્રિત થઈ જય છે, જેને લીધે આત્મજગૃતિનો સુવાર્ગ્યોગ એક સાથે મળે છે.

‘સોડહમુ’ સાધનાની જેમ જેમ ઉત્ત્રતિ થતી જય છે તેમ તેમ વિજ્ઞાનમય કોશનો વિકાસ થતો જય છે, આત્મજ્ઞાન વધે છે અને ધીમે ધીમે આત્મસાક્ષાત્કારની ધરી નિકટ આવતી જય છે. આગળ જતાં શાસ પર ધ્યાન આપવાનું ધૂટી જય છે અને કેવળ હૃદયમાં સૂર્યચકમાં વિશુદ્ધ બ્રહ્મતેજનું દર્શન થાય છે. એ વખતે સમાધિની અવસ્થા આવી જય છે. હંસયોગની પરિપક્વતાના પરિણામે સાધક ભ્રાહ્મી સ્થિતિનો અવિકારી બની જય છે.

આ સિવાય સ્વામી વિવેકાનંદજીએ વિજ્ઞાનમય કોશની સાધના માટે “આત્માનુભૂતિ” ની વિધિ બતાવી છે. એમના અમેરિકન શિષ્ય રામચંદ્રે એમના “મેન્ટલ ડેવલપમેન્ટ” પુસ્તકમાં આ વિધિનું વિસ્તારપૂર્વક વાર્ગન કર્યું છે.

### આત્માનુભૂતિ યોગ

(૧) કોઈ શાંત અથવા એકાંત સ્થાનમાં જવું. નિર્જન, કોલાહલરહિત સ્થળ આવી સાધના માટે પસંદ કરવું જોઈએ. ઘરનો કોઈ સ્વચ્છ હવાવાળો ઓરડો પાગ ચાલી શકે અને નદીકિનારો અથવા કોઈ બગીચો પાગ પસંદ કરી શકાય. સાધના માટે હાથ મોં ધોઈને બેસવું. આરામખુરશી ઉપર અથવા દીવાલ, વૃક્ષ કે તકિયાના સહારે બેસીને પાગ આ સાધના સારી રીતે થાય છે.

સંપૂર્ણ આરામથી બેસવું. ત્રાણ લાંબા શાસ લેવા, ફેફસાંમાં ભરાયેલા વાયુને સંપૂર્ણ રીતે બહાર કાઢવો અને ફરી પાછી ફેફસાંમાં પૂરી હવા ભરવી. આ એક પૂર્ણ શાસ કહેવાય છે. સ્નાન કરવાથી અથવા હાથ, પગ અને મોં ધોઈને બેસવાથી જેમ શરીરની શુદ્ધિ થાય છે, તેમ આવા ત્રાણ પૂર્ણ દીર્ઘ શાસ લેવાથી હૃદય અને ફેફસાંની ધાર્મિક શુદ્ધિ થાય છે.

ત્રાણ પૂરા શાસ વર્દ્ધ રહ્યા પછી શરીરને શિથિલ કરવું અને શરીરના દરેક અંગમાંથી પ્રાણશક્તિ ખેંચાઈને હૃદયમાં ભેગી થાય છે એવી ભાવના કરવી. હાથ, પગ વગેરે સધળાં અંગો અને ઉપાંગો શિથિલ, નિર્જવ અને નિષ્પ્રાણ થઈ ગયાં છે એવી ભાવના કરવી. ‘મગજનમાં સધળી વિચારધારાઓ અને કામનાઓ શાંત થઈ ગઈ છે’ અને આખા શરીરની અંદર એક શાંત નીલવાર્ણ આકાશ ફેલાઈ રહ્યું છે’ એવી ભાવના કરવી.

આવી શાંત અવસ્થા એકદમ પ્રાપ્ત થતી નથી. તેને માટે લાગલગાટ કેટલાક દિવસો સુધી અભ્યાસ કરવો પડશે. અભ્યાસથી થોડા વખતમાં વધારે શિથિલતા અને શાંતિનો અનુભવ થશે.

શરીર સારી રીતે શિથિલ થઈ ગયા પછી હૃદયસ્થાનમાં એકનિત અંગૂહાની બરાબર શુભ્ર-શૈત ન્યોતિ સ્વરૂપ પ્રાણશક્તિનું ધ્યાન કરવું. હું “અજર, અમર, શુદ્ધ, બુદ્ધ, ચેતન, પવિત્ર ઈશ્વરીય અંશ હું.” “મારું વાસ્તવિક સ્વરૂપ જ એ છે.” “હું સત્ત- ચિત્ત- આનંદ સ્વરૂપ આત્મા હું.” કલ્પનાનાં દિવનેત્રોથી એ ન્યોતિનાં દર્શન કરતાં કરતાં ઉપરોક્ત ભાવનાઓ મનમાં રાખવી.

(૨) ઉપરોક્ત શિથિલાસનની સાથે આત્મર્દશન કરવાની સાધના આ યોગની પ્રથમ સાધના છે. જ્યારે આ સાધનાનો સારી રીતે અભ્યાસ થઈ જય ત્યાર પછી જ આગળની સીડી ઉપર પગ મૂકવો જોઈએ.

(૩) ઉપર લખેલી શિથિલાવસ્થામાં અખિલ આકાશમાં નીલવાર્ણ આકાશનું ધ્યાન કરવું. આવા નીલવાર્ણ આકાશમાં બહુ જ ઊંચે સૂર્ય સમાન ન્યોતિ સ્વરૂપ આત્મા બિરાજમાન છે તેવું ધ્યાન કરવું. “આ પ્રકાશવાન આત્મા તે હું જ હું” એવો ચોક્કસ સંકલ્પ કરવો. કોઈ પાગ જાતની હિલચાલ સિવાય શરીર ભૂમિ ઉપર નિશ્ચેષ પહુંચ છે એવું જુઓ. અનાં અંગ-પ્રાંગનનું નિરીક્ષણ અને પરીક્ષણ કરવું. તેનો દરેક અવયવ મારું ઓઝર છે, મારું વસ્ત્ર છે. આ ધ્યાન મારી ઈચ્છા મુજબ કિયા કરવા માટે મને મળેલું છે. આ વાત વારંવાર મનમાં લાવ્યા કરો અને મન તથા બુદ્ધિને બે સેવક શક્તિના રૂપમાં નુંઓ. આ બંને તમારી ઈચ્છાનુસાર કાર્ય કરવા ખરે પગે તેથાર છે. આથી આ

શરીર, મન, બુદ્ધિ તથા હાથ તમને તમારી મરજી પ્રમાણે સેવા કરવા મળ્યા છે, એ વિચારથી તમે પ્રસત્ર થાઓ અને સાચા આત્મલાભ માટે જ તમે તેનો ઉપયોગ કરશો એવી ભાવના તમારા મગજમાં ગુંજતી રહેવા દો.

(૪) જ્યારે બીજી ભૂમિકાનું ધ્યાન સારી રીતે આવડી જય ત્યાર પછી ત્રીજી ભૂમિકાના ધ્યાનની શરૂઆત કરવી.

તમે ઉપર આકાશમાં સૂર્યના સ્થાન પર બેઠા હો તેમ જુઓ. “હું સમસ્ત ભૂમંડળ ઉપર મારો પોતાનો પ્રકાશ ઇકી રહ્યો છું. સંસાર મારું ક્રમક્ષેત્ર અને લીલાભૂમિ છે. ભૂતળની વસ્તુઓ અને શક્તિઓને હું મારા ઈચ્છિત પ્રયોગનો માટે ક્રમમાં લાવું છું, પણ તે મારી ઉપર કોઈ પ્રભાવ પાડી શકતી નથી. પંચભૂતોની ઊથલપાથલથી સંસારમાં જે હિલચાલ હરધડી થયા કરે છે તે મારે માટે એક વિનોદ અને મનોરંજક દશ્ય માત્ર છે. સંસારનાં કોઈ પણ હાનિ-લાભ મને અસર કરી શકતાં નથી. હું શુદ્ધ, ચૈતન્ય, સત્યસ્વરૂપ, પવિત્ર, નિર્લેપ, અવિનાશી આત્મા છું. હું આત્મા છું, મહાન આત્મા છું. મહાન પરમાત્માનો વિશુદ્ધ સ્કુલ્પિંગ છું.” આ મંત્ર મનમાં ને મનમાં જાયા કરવો.

ત્રીજી ભૂમિકાનું ધ્યાન જ્યારે અભ્યાસથી પૂર્ણ રીતે પાંકું થઈ જય અને હરધડી આ જ ભાવના રોમરોમમાં વાપેલી રહે અને તેમાં જ મસ્ત રહેવાય ત્યારે સમજજું કે આ સાધનાની સિદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ છે. આ જ જગૃત સમાપ્તિ છે અને આને જ જીવનમુક્ત અવસ્થા કહી છે.

### આત્મચિંતનની સાધના

રાત્રે સર્વ કાર્યોથી નિવૃત્ત થઈ સૂતા પહેલાં ચત્તા સૂઈ જવું, પગ સીધા રાખવા, હાથ વાળીને પેટ પર મૂકવા, માથું સીધું રાખવું, બચી બળતી હોય તો બુઝાવી નાખવી અથવા આંખી કરી દેવી. નેત્રો ખુલ્ખાં રાખવાં.

અનુભવ કરો કે આપનો આજનો આખો દિવસ એક જીવન જેવો છે. એક દિવસ પૂરો થતાં એક જીવન પૂરું થયું સમજજું. નિદ્રા એક મૃત્યુ છે. આજનો દિવસ પૂરો થતાં એક જીવન પૂરું થયું સમજ રાત્રે મૃત્યુના મુખમાં જઈ રહ્યા છો એવો ભાવ અનુભવો.

આજના જીવનની આધ્યાત્મિક દિનિએ સમાલોચના કરો. પ્રાતઃકાળથી શરૂ કરી સૂવાના વખત સુધીમાં જે જે કાર્યો કર્યા હોય તેના ઉપર દિનિપાત કરો. આ કાર્યો મારા આત્માને માટે ઉચિત હતાં કે નહીં તેનો વિચાર કરો. જે ઉચિત હતાં તો જેટલી દક્ષતાથી એ કરવાં જોઈતાં હતાં તેટલી સાવધાનીથી થયાં છે કે કેમ? આજના અમૂલ્ય સમયનો કેટલો ભાગ ઉચિત રીતે, કેટલો અનુચિત રીતે અને કેટલો નિરર્થક રીતે વતીત થયો છે તેનો હિસાબ કરો. આ દેનિક જીવન સફળ થયું કે અસફળ રહ્યું? આત્મિક પૂંજીમાં વધારો થયો કે ઘટાડો થયો? સદ્ગુર્તિઓ પ્રધાન રહી કે દુષ્ટવૃત્તિઓ? આવા પ્રકારના પ્રશ્નોથી આજના દિવસભરનાં કામોનો હિસાબ કરો.

જે અનુચિત કામો થયાં તેનો આત્મહેવની સન્મુખ પશ્ચાત્તાપ કરો. ભવિષ્યમાં આવી ભૂલો ન થવા દેવાનો નિશ્ચય એ જ પ્રશ્નાત્તાપ છે. જે ઉચિત થયાં છે તેને માટે પરમાત્માને ધન્યવાદ આપો. પ્રાર્થના કરો કે આગામી જીવનમાં-કાલના જીવનમાં એવાં કાર્યોમાં જ આગળ વધવાની પ્રેરણા આપો. ત્યાર પછી શુદ્ધ વાર્ષ આત્મજ્યોતિનું ધ્યાન કરતાં કરતાં નિપ્રાદેવીની ગોદમાં સુખપૂર્વક ચાલ્યા જવું.

### બીજી સાધના

પ્રાતઃકાળે જ્યારે ઉંઘ પૂરી થાય અને આંખો ઉંઘડી જય ત્યારે આળસ મરડી ત્રણ લાંબા શાસ લઈ સાવધ થવું.

ભાવના કરવી કે આજે નવું જીવન ગ્રહણ કરી રહ્યો છું. નવો જન્મ લઈ રહ્યો છું. આ જન્મનો હું એવો જાણતી મહાવિજ્ઞાન - ભાગ-૩

ઉપયોગ કરીશ કે નેથી આત્મિક પૂજુમાં વૃદ્ધિ થાય. ગઈ કાલે, આગલે દિવસે જે ભૂલો થઈ હતી અને નેને માટે આત્મદેવની સમક્ષ પશ્ચાત્તાપ કર્યો હતો તેનું ધ્યાન રાખીને આજનો દિવસ ધારી જ ઉત્તમ રીતે ગાળીશ.

આખા દિવસના કાર્યક્રમની યોજના બનાવો. આ કાર્યોની સામે જે મુશ્કેલીઓ આવવાનો સંભવ હોય તેનો વિચાર કરી તેમનાથી બચવા માટે સાવધાન થાઓ. આ કાર્યોમાં જે આત્મલાભ થવાનો હોય તેનાથી વધારે થાય તેની તૈયારી કરવી. આજનો દિવસ, આજનો જન્મ પાછલા દિવસો કરતાં વધારે સફળ થાય તેવો સંકલ્પ કરી તેનો સહર્ષ સ્વીકાર કરો.

પરમાત્માનું ધ્યાન કરવું અને પ્રસંગ અંતઃકરણપૂર્વક શૈતન્ય, તાજગી, ઉત્સાહ, સાહસ, આશા તથા આત્મવિશ્વાસની ભાવનાઓની સાથે ઊઠી પથારીનો ત્યાગ કરો. પથારીની નીચે પગ મૂકવો એને આજના જીવનની શરૂઆત સમજવી.

આવા આત્મચિંતનની સાધનાથી દિનપ્રતિદિન શરીરનો અભ્યાસ ઘટતો જશે. શરીરને લક્ષ્યમાં રાખીને જે વિચાર અને કાર્ય થતાં હશે તે સર્વ શિથિલ થાય છે, વિચારધારા અને કાર્યો ઉત્તેત બને છે અને આત્મલાભ માટે અનેક પ્રકારનાં પુણ્યકર્મોનું આયોજન થાય છે.

## સ્વરયોગ

વિજ્ઞાનમયકોશ વાયુપ્રધાન હોવાથી શરીરનું વાયુસંસ્થાન વિશેષ જગૃત રહે છે. આ વાયુતત્ત્વ પર અધિકાર મેળવી લેવાય તો અનેક પ્રકારે પોતાનું હિત સાધી શકાય છે.

સ્વરથાય્ય પ્રમાણે શાસોર્ધ્વાસના માર્ગોને નાડી કહેવામાં આવે છે. શરીરમાં આવી નાડીની સંખ્યા ૭૨૦૦ નેટલી છે. એ નસો નથી, પણ સાચી રીતે તે પ્રાણવાયુના આવાગમનના માર્ગો છે. નાભિમાં આ પ્રકારની એક નાડીકુંડલી આકારમાં છે, નેમાંથી (૧) ઈડા (૨) પિંગળા, (૩) સુષુપ્તા, (૪) ગાંધારી (૫) હસ્તનિહિત્વા (૬) પૂષા, (૭) યથશ્વિની (૮) અલંબુધા, (૯) કુદૂંતથા (૧૦) શંખિની નામની દશ નાડીઓ નીકળે છે અને શરીરના વિભિન્ન ભાગો તરફ જય છે એમાંની પ્રથમ ત્રણ મુખ્ય છે. ઈડાને ‘ચંદ્ર’ કહે છે, કેમકે એ ડાબા નસકોરામાં છે. પિંગળાને સૂર્ય કહે છે. તે જમણા નસકોરામાં છે. સુષુપ્તાને વાયુ કહે છે. એ બંને નસકોરાની વચ્ચે છે. જે રીતે આ જગતમાં સૂર્ય અને ચંદ્ર નિયમિત રૂપે પોતાનું કામ કરે છે તે પ્રમાણે ઈડા અને પિંગળા પણ આપણા જીવનમાં પોતપોતાનું કામ નિયમિત રૂપે કરે જ જય છે. આ ત્રણ સિવાય બીજી સાત મુખ્ય નાડીઓનાં સ્થાન આ પ્રમાણે છે:

ગાંધારીનું સ્થાન નાકમાં, હસ્તનિહિત્વાનું જમણી આંખમાં, પૂષાનું જમણા કાનમાં, યથશ્વિનીનું ડાબા કાનમાં, અલંબુધાનું મોંમાં, કુદૂંતથાનું લિંગપ્રદેશમાં અને શંખિનીનું ગુદામાં હોય છે. આ પ્રમાણે શરીરનાં દશ દ્વારોમાં દશ નાડીઓનાં સ્થાન છે.

હઠ્યોગમાં નાભિકુંડ અર્થાત્કુંડલિનીનું સ્થાન ગુદાદ્વારથી લિંગ તરફ બે આંગળ દૂર મૂલાધાર ચક્કને માનવામાં આવ્યું છે. સ્વરયોગમાં આ સ્થિતિ માન્ય નથી. સ્વરયોગ શરીરથાય્યની સાથે સંબંધ રાખે છે અને શરીરની નાભિ-મધ્યકેન્દ્ર ગુદાના મૂલમાં નહીં, પણ ઉદરની ઝૂંટીમાં હોય છે. એટલા માટે અહીંનાભિદેશનો અર્થ ઉદર (પેટ) ની ઝૂંટી જ માનવો યોગ્ય છે. શાસોર્ધ્વાસ કિયાનો પ્રત્યક્ષ સંબંધ ઉદરની સાથે જ છે. એટલા માટે પ્રાણાયામ દ્વારા ઉદર સંસ્થાન સુધી પ્રાણવાયુને લઈ જઈને નાભિકેન્દ્રની સાથે તેનું એવી રીતે ધર્ષણ કરવામાં આવે છે કે નેથી નાભિકેન્દ્રની સુપ્ત શક્તિઓ જગૃત થઈ શકે.

ચંદ્ર અને સૂર્યનાં અદશ્ય કિરણોનો પ્રભાવ સ્વરો-ઉપર પડે છે. સૌ જાગે છે કે ચંદ્રમાનો ગુણ શીતળ અને સૂર્યનો ગુણ ઉષગ છે. શીતળતાથી સ્થિરતા, ગંભીરતા, વિવેક વગેરે ગુણો ઉદ્ભબે છે અને ઉષગતાથી તેજ, વીર્ય, ૩૮૬

શોર્ય, ચંચળતા, ઉત્સાહ, કિયાશીલતા વગેરે ગુણો ઉત્પત્ત થાય છે. મનુષને સાંસારિક જીવનમાં શાંતિપૂર્ણ અને અશાંતિપૂર્ણ બંને જાતનાં કામ કરવાં પડે છે. કોઈપણ કામનું અંતિમ પરિણામ એના આરંભ ઉપર આધાર રાખે છે. એટલા માટે વિવેકી પુરુષ પોતાના કામનો આરંભ કરતી વખતે એ જોઈદે છે કે પોતાના શરીર અને મનની સ્વાભાવિક સ્થિતિ આ કાર્ય કરવા માટે અનુકૂળ છે કે કેમ? એક વિદ્યાર્થીની જ્યારે ઉંઘ આવતી હોય ત્યારે પાઠ તૈયાર કરવા આપવામાં આવે તો ભાગ્યે જ એને સારી રીતે તૈયાર કરી શકશે. જ્યારે એ પાઠ એને સવારની અનુકૂળ સ્થિતિમાં તૈયાર કરવાનું કહેવામાં તો તેને યાદ કરવામાં ઘણી સારી સફળતા મળશે. ધ્યાન, ભજન, પૂજાપાઠ ઈત્યાદિને માટે એકાંતની જરૂર છે, પરંતુ ઉત્સાહ જગાડવા માટે, યુદ્ધ માટે, કોલાહલપૂર્ણ વાતાવરણની, વાનિંગ્રોના ધોર ધ્વનિની જરૂર હોય છે. આવી ઉચિત સ્થિતિમાં કરેલાં કાર્યો સફળ થાય છે. વસ્તુસ્થિતિ આવી હોવાથી સ્વરંગોગીઓએ આદેશ આપ્યો છે કે વિવેકપૂર્ણ અથવા સ્થાયી કાર્યો ચંદ્રસ્વરમાં કરવાં જોઈએ. જેમ કે વિવાહ, દાન કરવું, મંદિર, કૂવા, તળાવ બનાવવાં, નવાં વસ્તુ ધારણ કરવાં, શાંતિનાં કામો, ઔષધી આપવી, મૈત્રી, વ્યાપાર, જમીનમાં બીજ વાવવાં, દૂરની યાત્રા કરવી, વિદ્યારંભ કરવો, ધર્મ, યજ્ઞ, દીક્ષા, મંત્ર, વિદ્યાભ્યાસ, યોગક્રિયા વગેરે કાર્યો એવાં છે કે જેમાં ગંગીરતાથી બુદ્ધિપૂર્વક યોજના કરવાની જરૂર પડે છે. એટલા માટે તેમનો આરંભ પણ એવા સમૈયે થવો જોઈએ કે જ્યારે શરીરના સૂક્ષ્મ કોશોમાં ચંદ્રમાની શીતળતા હોય.

ઉતેજના, આવેશ અને નુસ્સાપૂર્વક કરવાથી જે કામો સારાં થાય છે તે સૂર્ય સ્વર ચાલતો હોય ત્યારે આરંભવાં જોઈએ. જેમ કે કૂર કર્મ, સ્તુલોગ, ભૃષ કાર્ય, યુદ્ધ કરવું, દેશને રંજાડવો, એર આપવું, શિકાર ખેલવો, મદ્ય પીવું, હત્યા કરવી, કાષ, પત્યર, પૃથ્વી, રન્ન વગેરેને તોડવાં, તંત્રવિદ્યા, જુગાર ખેલવો, ચોરી, વ્યાપાર, નદી પાર કરવી વગેરે આ કઢોર કર્મોનો અહીંયાં નિષેધ અથવા સમર્થન કરવાનો હેતુ નથી. શાસ્કારે એક વૈજ્ઞાનિકની માફક સ્પષ્ટ કહી દીધું છેકે આવાં કાર્યો એવા વખતે સફળ થશે જ્યારે સૂર્યની ઉણતાના પ્રભાવથી જીવનતત્ત્વ ઉતેજિત થઈ રહ્યું હોય. શાંતિપૂર્ણ મગજનથી વિચાર કરનાર કોઈ પણ સજાજન આવાં કાર્યો કેવી રીતે કરી શકે? મતલબ કે આવાં કાર્યો નિષિદ્ધ છે, છતાં એવું પણ નથી કે સૂર્યસ્વરમાં સારાં કામ નથી થતાં. દેશ, સમાજ અથવા આશ્રિતોના રક્ષણ માટે કરવામાં આવતા યુદ્ધને દરેક જગા પ્રશંસનીય ગણે છે. આ જ રીતે ખૂબ પરિશ્રમનાં કાર્યો કરવાં સમાજ તથા પરિવાર માટે જરૂરી હોય છે. આવાં કાર્યો પણ સૂર્યસ્વરમાં જ ઉત્તમ રીતે થાય છે.

કેટલીક ક્ષાળો માટે બંને નાડી ઈડા-પિંગલા બંધ હોય અને સુષુપ્તિ ચાલતી હોય ત્યારે શરીર સંધિ અવસ્થામાં હોય છે. આ સંધ્યાકાળ કહેવાય છે. દિવસના ઉદ્ય અને અસ્તને પણ સંધ્યાકાળ કહે છે. આ વખતે જન્મમરણ કાળની માફક પારલોક્ઝ ભાવનાઓ મનુષ્યમાં જગૃત થાય છે અને સંસાર તરફ વિરક્ષિત, ઉદાસીનતા અને અરુચિ પેદા થાય છે. સ્વરની સંધ્યા વખતે પણ મનુષ્યનું ચિત્ત સાંસારિક કાર્યો પર પશ્ચાત્તાપ સ્વરૂપ નિબત્તા પ્રકટ કરતાં કરતાં આત્મચિંતન તરફ ઢળી જાય છે. આ કિયા ઘણી જ સૂક્ષ્મ છે અને ઘણા જ થોડા વખત સુધી ચાલે છે અને તેથી સારી રીતે ઓળખી પણ શકતી નથી. આ વખતે જે પરમાર્થનું ચિંતન અથવા ઈશ્વરનું આરાધન કરવામાં આવે તો એમાં અવશ્ય બહુ જ ઉત્ત્રતિ થાય, પણ સાંસારિક કાર્યો માટે આ સ્થિતિ બહુ ઉપયોગી નથી. તેથી સુષુપ્તિ સ્વરમાં આરંભાયેલાં કામોનું પરિણામ સારું હોતું નથી. એ કાં તો અધૂરાં રહે છે અથવા અસ્ક્રણ બને છે. સુષુપ્તિનાની દશામાં માનસિક વિકારો દબાઈ જાય છે અને ઊડા આનિષ્ક ભાવોનો થોડાધણા પ્રમાણમાં ઉદ્ય થાય છે. તેથી આ વખતે આપેલો શાપ અથવા વરદાન મોટેભાગે ફળીભૂત થાય છે, કેમકે આ ભાવનાઓની સાથે આત્મતત્ત્વનું થોડુંધાણ મિશ્રણ થયું હોય છે. ઈડા શીતાત્મકતું છે અને પિંગળા ગ્રીભાત્મકતું છે. જે પ્રમાણે શીતાત્મકતુના મહિનાઓ દરમાન ઠંડીની પ્રધાનતા રહે છે અને ગ્રીભાત્મકતું દરમાન ગરમીની પ્રધાનતા રહે છે, તે જ પ્રમાણે સૂર્યનાડીમાં ઉણતા અને ઉતેજનાનું પ્રાધાન્ય રહે છે.

## સ્વર બદલવો

કેટલાંક ખાસ કાર્યોના સંબંધમાં સ્વરશાસ્ક્રોનો જે અનુભવ છે તેનું જ્ઞાન સામાન્ય જગતાને માટે ઘણું ઉપયોગી નીવડશે. કહેવાય છે કે પ્રસ્થાન કરતી વખતે ચલિત સ્વરવાળા શરીરભાગને હાથથી સ્પર્શ કરી એ જ પગને આગળ કરી (જે ચંપનાડી ચાલતી હોય તો ચાર વખત અને સૂર્યનાડી ચાલતી હોય તો પાંચ વખત એ જ પગને જમીન પર પદ્ધાડીને) પ્રસ્થાન કરવું જોઈએ. જ્યારો કોઈ પુરુષની પાસે જવાનું હોય તો અચલિત સ્વર (જે સ્વર ચાલતો ન હોય તે) વાળા પગને પહેલાં આગળ કરી પ્રસ્થાન કરવું અને અચલિત સ્વરવાળી બાજુએ એ પુરુષને રાખીને વાતચીત કરવી, તેમ કે એ રીતે તેની વધેલી ઉષ્ગતાને પોતાના અચલિત સ્વરવાળી બાજુની શાંતિ પોતાની આકર્ષક વિદ્યુતથી બેચીને શાંત બનાવી દેશે અને એ રીતે મનોરથ સિદ્ધ થશે. ગુરુ, મિત્ર, ઓફિસર, રાજકીયબાર વગેરેને લગતાં કામ કરવા માટે ડાબો સ્વર ઘણું ઉપયોગી થશે.

કોઈ વાર એવો અવસર આવે છે કે જ્યારે કાર્ય ઘણું જ જરૂરનું હોય, પણ અનુકૂળ સ્વર ચાલતો ન હોય, તે વખતે શું નકામા બેસી રહેવું? ના. એમ કરવાની જરૂર નથી. જેમ રાત્રે કોઈ ખાસ કામ હોય અને ઊંઘને અટકાવવા માટે ચાહ વગેરે માદાંક પદાર્થ લઈ શરીરમાં ચૈતન્ય આપુણી કામ પતાવીએ છીએ, તેમ કેટલાંક નિયમો નીચે આપવામાં આવે છે:

(૧) જે સ્વર ચાલતો ન હોય તેને અંગુઠાથી દબાવી જે સ્વર ચાલતો હોય તે નસકોરાથી હવા ખેંચવી. પછી જેનાથી શાસ ખેંચો હોય તેને દબાવી પહેલાં નસકોરાથી (એટલે જે સ્વર ચલાવવો હોય તે) શાસ છોડવો. આમ થોડો વખત વારંવાર કરવું. શાસની ચાલ બદલાઈ જશે.

(૨) જે નસકોરાથી શાસ ચાલી રહ્યો હોય તે પડાએ સૂઈ જવું, એટલે સ્વર બદલાઈ જશે. આ પ્રયોગની સાથે સાથે પહેલો પ્રયોગ કરવાથી સ્વર જલ્દીથી બદલાશે.

(૩) જે બાજુનો સ્વર ચાલી રહ્યો હોય તે બાજુની બગલમાં કોઈ સખત ચીજ દબાવી રાખો તો સ્વર બદલાઈ જશે. પહેલાં અને બીજા પ્રયોગની સાથે આ પ્રયોગ કરશો તો સફળતા જલદી મળશે.

(૪) ધી ખાવાથી ડાબો સ્વર અને મધ્ય ખાવાથી જમાણો સ્વર ચાલતો થાય છે એમ કહેવાય છે.

(૫) ચાલતા સ્વરના નસકોરામાં જૂના સ્વરથી ઝનું પૂમહું રાખવાથી સ્વર બદલાશે.

જેવી રીતે માંદળી વખતે શરીરને રોગમુક્ત કરવા માટે ચિકિત્સા કરવામાં આવે છે, તેમ સ્વરને ઢીક કરવા માટે આ ઉપાયો કામે લગાડવા જોઈએ.

### સ્વરસંયમથી દીર્ઘજીવન :

પ્રતેક પ્રાણીએ પૂર્ણ આયુષ્ય પ્રાપ્ત કરવું, દીર્ઘજીવી થવું એનો આધાર તેની શાસ કિયા પર રહેલો છે. પૂર્વકર્માને અનુસરીને જીવિત રહેવા માટે પરમાના તેને એક ચોક્કસ સંખ્યામાં શાસ પ્રદાન કરે છે, જે સંખ્યા પૂરી થતાં તેનો દેહાંત થઈ જાય છે. આ ખજનાને જે પ્રાણી જેટલી હોશિયારીથી વાપરશે તેટલા પ્રમાણમાં એ વધારે સમય સુધી જીવિત રહેશે અને જેટલા પ્રમાણમાં તેનો નકામો વ્યય કરશે તેટલો જ તેનો વહેલો અંત આવશે. સામાન્ય રીતે દરેક મનુષ્ય દિનરાતમાં ૨૧૬૦૦ શાસ લે છે. જેવી રીતે ધનનો ઓછો વ્યય કરનાર માણસનું ધન લાંબા કાળ સુધી સંચિત રહે છે, તેમ ઉપરોક્ત સંખ્યા કરતાં ઓછો શાસ લેનાર દીર્ઘજીવી થઈ શકે છે. સમસ્ત પ્રાણીઓ પૈકી જે જીવો જેટલો ઓછો શાસ લે છે તેઓ તેટલા જ વધારે કાળ સુધી જવનટકાવી શકે છે. નીચેનો કોઈ તેનું સ્પષ્ટીકરણ કરે છે :

| પ્રાણીનું નામ | શાસની ગતિ<br>(મિનિટના હિસાબે) | પૂર્જ આયુષ |
|---------------|-------------------------------|------------|
| સસલું         | ૩૮ વખત                        | ૮૧૪        |
| વાંદું        | ૩૨ વખત                        | ૧૦૧૪       |
| કૂતરો         | ૨૮ વખત                        | ૧૧૧૪       |
| ઘોડો          | ૧૮ વખત                        | ૩૫૧૪       |
| મનુષ          | ૧૩ વખત                        | ૧૨૦૧૪      |
| સાપ           | ૮ વખત                         | ૧૦૦૦૧૪     |
| કાચબો         | ૫ વખત                         | ૨૦૦૦૧૪     |

સામાન્ય કામકાજ કરવામાં દર મિનિટે ૧૨ વખત, દોડકૂદ કરવામાં ૧૮ વખત, મૈથુન કરવામાં ૨૬ વખત શાસ ચાલે છે. એટલા માટે લંપટ અને વિષયી માણસનું આયુષ ઘટી જાય છે અને પ્રાગાયામ કરનાર યોગાભ્યાસી લાંબા કાળ સુધી જીવે છે. અહીંયાં એવું ન વિચારવું કે ચુપચાપ બેસી રહેનાર ઓછો શાસ લે છે, તેથી નિષ્ઠિ બેસી રહેનારનું આયુષ લાંબું હોય કેમ કે નકામા બેસવાથી શરીરનાં બીજાં અંગો નિર્ભળ, અશક્ત અને રોગિક થઈ જશે અને શાસની ગતિ બહુ જ વધી જશે. તેટલા માટે શારીરિક અંગોને સ્વસ્થ રાખવા માટે પાણ પરિશ્રમ કરવો જરૂરી છે. શક્તિ બહારનો શ્રમ પાણ ડાનિકારક છે.

હુમેશાં શાસ પૂરો અને ઊડો લેવો તથા વાંકા વળીને કદી બેસવું નહીં. નાભિ સુધીનો ઊડો શાસ લેવાથી એક પ્રકારનો કુંભક પાણ થાય છે અને સાથે સાથે શાસની સંખ્યા પાણ ઘણી ઘટી જાય છે. કરોડરનજુની અંદર એક પ્રકારનો પ્રવાહી પદાર્થ વહેતો હોય છે, જે સુષુમણા નાડીને બળવાન રાખવામાં ઘણો ઉપયોગી થાય છે. સુષુમણાનું બળ મસ્તિષ્કને બળવાન અને મજબૂત રાખે છે. જે કરોડરનજુ વાંકી રહે તો પેલો પ્રવાહ અટકી જાય છે અને નિર્ભળ સુષુમણા નાડી મગજને સારી રીતે પોપાણ આપી શકતી નથી.

સૂતી વખતે કદાપિ ચંતા સૂવું નહીં, તેમકે તેથી સુષુમણા સ્વર શરૂ થઈ વિધનો પેદા કરે છે તથા અશુભ અને ભયાનક સ્વભનો આવે છે. એટલા માટે ખાંધા પછી પ્રથમ વામકુક્ષી કરી પછી જભાગી તરફ પાસું ફેરવું. ભોજન પછી ઓછામાં ઓછું ૧૫ મિનિટ આરામ કર્યા પછી જ ચાલવું કે બીજું કામ હાથ પર લેવું.

શીતળતાથી અચિ મંદ પડે છે અને ગરમીથી તેજ થાય છે. જારાઓ ઉપર એવી જ અસર થાય છે. જ્યારે સૂર્યસ્વર ચાલતો હોય છે ત્યારે પાચનશક્તિ પાણ તેજ થાય છે અને એટલા જ માટે એ સ્વર દરમિયાન ભોજન આરોગણું જોઈએ. સર્વ લોકો આ નિયમ આગે છે કે ભોજન પછી તરત જ વામકુક્ષી-ડાને પડાયે સૂવું. તેનો ઉદેશ એ છે કે ડાબે પડાયે સૂવાથી સૂર્યસ્વર-જમાણો સ્વર ચાલે છે અને પાચનશક્તિ તેજ બને છે.

ઈડા, પિંગલા અને સુષુમણા નાડીઓની ગતિવિધિ ઉપર ધ્યાન આપવાથી વાયુતત્ત્વ ઉપર આપણો અધિકાર આવી જાય છે. વાયુના માધ્યમથી કેટલીયે એવી વાતો જાળી શકાય છે કે જે સામાન્ય માણસ જાળી શકતો નથી. વર્ષાઝ્રિતુમાં સૌથી પહેલાં કરોળિયાને ખબર પડી જાય છે કે હેવે વરસાદ પડવાનો છે અને તે પ્રમાણે પોતાના રક્ષાળનો પ્રબંધ શરૂઆતથી જ કરી લે છે, કરારણ કે વરસાદની સાથે વાયુનો સૂક્ષ્મ સંયોગ રહેતો હોય છે. માણસની સમજમાં આ વાત નથી આવતી, પાણ કરોળિયાનું ચૈતન્ય તેને અનુભવ કરાવી આપે છે કે આટલા વખત પછી આટલા વેગથી આટલું પાણી પડશે. સૂક્ષ્મ વાયુની પરીક્ષા કરવાની સંવેદનશક્તિ જેટલા પ્રમાણમાં કરોળિયામાં હોય છે તેના કરતાં

વિશેષ જગત ચૈતન્ય એક સ્વરથોળીમાં હોય છે. વરસાદ અને ગરમી જ નહીં, પણ તેના કરતાં વધારે સૂક્ષ્મ વાતો, ભવિષ્યની ઘટનાઓ, દુર્ઘટનાઓ, પરિવર્તનો, વિલક્ષણતાઓ વગેરે સ્વરથોળી પોતાની દિવ્યદિષ્ટી જાળી લે છે.

## વિજ્ઞાનમય કોશની વાયુસાધના

(૧) શાંત વાતાવરણમાં કરોડરનજુ સીધી રાખીને બેસી જવું અને નાભિયકમાં શુભ્ર જ્યોતિમંડળનું ધ્યાન કરવું. આ જ્યોતિકેન્દ્રમાં સમુદ્રની ભરતીઓટ માફક મોંઝ ઊંઠતાં રહેતાં જાગાશે.

(૨) જે ડાબો સ્વર ચાલતો હશે તો આ જ્યોતિકેન્દ્રનો વાર્ષ ચંદ્રમાની માફક પીળો દેખાશે અને તેની ડાબી બાજુથી નીકળનારી ઈડા નાડીમાં થઈને શાસપ્રવાહનું આવાગમન થશે. નાભિની નીચે મૂલાધાર ચકમાં (ગુદા અને લિંગના મધ્યવર્તી ભાગ) થઈને, કરોડરનજુમાં થઈને, મસ્તિષ્કની પરિકમા કરીને નાકના ડાબા નસકોરા સુધી ઈડા નાડી જાય છે. નાભિકેન્દ્રના ડાબા ભાગની કિયાશીલતાના કારણે આ નાડી કામ કરે છે અને ડાબો સ્વર ચાલે છે. આ સન્ય હકીકતને દિવ્ય નેત્રોથી ચિત્રોની માફક સારી રીતે (કલ્પનામાં) જેવાનો પ્રયત્ન કરો.

(૩) જે જમણો સ્વર ચાલતો હશે તો નાભિનું જ્યોતિમંડળ સૂર્યની માફક કંઈક ભૂરા જાંખા શેત રંગનું હશે અને તેની બાજુમાંથી નીકળની પિંગળા નાડીમાં થઈને શાસપ્રશાસની કિયા થશે. નાભિની નીચે મૂલાધારચકમાં થઈને કરોડરનજુ તથા મસ્તિષ્કમાં થઈને જમણા નસકોરા સુધી પિંગળા નાડી જાય છે અને નાભિયકમાં જમણી બાજુમાં ચૈતન્ય પ્રવાહ શરૂ થાય છે અને જમણો સ્વર ચાલે છે. આ સૂક્ષ્મ કિયાનું ધ્યાનશક્તિ માફકતે એવા મનોયોગથી નિરીક્ષણ કરો કે જેથી આખી પરિસ્થિતિનું ચિત્ર સ્પષ્ટ રૂપમાં ધ્યાનક્ષેત્રમાં ઊભું થાય.

(૪) જ્યારે સંવિસ્વર ચાલતો હોય તારે નાભિયક સ્થિર થઈ જાય છે. તેમાં કશી હિલચાલ થતી નથી અને એ દરમાન વાયુનું આવાગમન પણ બંધ થઈ જાય છે. આ સંવિકાળમાં એક ત્રીજી નાડી કરોડરનજુમાં અત્યંત ઝડપી ગતિથી વીજળીની જેમ ચમકારા મારે છે. સામાન્ય રીતે એક ક્ષાળના સોમા ભાગમાં એ ચમકી જાય છે. આને જ સુષુમ્ણા નાડી કહેવામાં આવે છે.

(૫) સુષુમ્ણા નાડીનો આ વિદ્યુતપ્રવાહ એ જ આત્માની ચંચળ જાંખી છે. શરૂઆતમાં તે એક હલકા જબકારા સરખી, પ્રકાશના એક મંદ કિરાગ સમાન હોય છે. સાધના જેમ જેમ પ્રખર થતી જાય છે તેમ તેમ આ જબકારો અધિક પ્રકાશવાન અને અધિક સ્થાયી થતો જાય છે. કેટલાક વખત પછી વર્ષાશ્રતુમાં વાદળો વચ્ચેની વીજળીની માફક તેનો પ્રકાશ અને વિસ્તાર વધતો જાય છે. સુષુમ્ણાની જ્યોતિમાં કયાંક રંગનો આભાસ થવો, તે સીધી, વાંકી, ત્રાંસી અથવા વર્તુલાકાર થવી એ આનિક સ્થિતિનું દોતક છે. ત્રાણ ગુણ, પાંચ તત્ત્વો, સંસ્કાર અને અંત: કરાગની જેવી સ્થિતિ હશે તેને અનુરૂપ જ ધ્યાનાવસ્થામાં સુષુમ્ણાનું રૂપ દેખાશે.

(૬) ઈડા-પિંગળાની કિયાઓ જ્યારે સ્પષ્ટ રૂપમાં જોવા મળે તારે સાક્ષી રૂપે તેનું ભારીક નિરીક્ષણ કરતા રહેવું. નાભિયકના જે ભાગમાં ભરતી-ઓટ થતી રહેતી હોય તેમ તેમ તેને સ્વાભાવિક દશામાં ચાલતી જોવાનો મહાવરો કરવો. એક શાસ પૂરો દેવાઈ રહે અને તે બહાર નીકળે તે દરમાનના કાળને 'અભ્યંતરસંધિ' અને જ્યારે પૂરો શાસ બહાર રહે અને પછી બીજે શાસ અંદર દેવાની શરૂઆત થાય તે કાળને 'બાધ્યસંધિ' કહેવામાં આવે છે. આ કુંભક સંવિઓ દરમાન સુષુમ્ણાની અતિ ઝડપવાળી વિદ્યુતભાબાનો અત્યંત ચ્યાપળ પ્રકાશ ધાર્ગી જ જગરૂકતાથી દિવ્ય નેત્રોથી જોવો જોઈએ.

(૭) જ્યારે જ્યારે ઈડા નાડી બદલાઈને પિંગળામાં આવે છે અથવા પિંગળા નાડી ઈડામાં જાય છે, એટલે કે જ્યારે એક સ્વરનું બીજામાં પરિવર્તન થાય છે તારે સુષુમ્ણાનો સંવિકાળ આવે છે. આપોઆપ સ્વર બદલાવાના સમયે સ્વાભાવિક સુષુમ્ણાની પ્રાપ્તિ થવી લગભગ મુશ્કેલ છે. એટલા માટે સ્વરવિદ્યાનો સાધક આગળ બતાવાયેલ ૪૦૦

સ્વર બદલવાના ઉપાયોનો આધાર લે છે અને સ્વર-પરિવર્તનની વેળાએ સુષુમ્ભગાની સંધિ વખતે આત્મજ્ઞોતિનું દર્શન કરે છે. આરંભમાં આ જ્યોતિ ચંચળ અને વિવિધ આકૃતિઓવાળી હોય છે, પણ અંતમાં સ્થિર અને મંડલાકાર બની જાય છે. આ સ્થિરતા જ વિજ્ઞાનમય કોશની સહીણતા છે અને આ જ સ્થિતિમાં આત્મસાક્ષાત્કાર થઈ શકે છે.

સુષુમ્ભગાનાડીમાં સ્થિર થવું તેને જ વાયુ પર પ્રભુત્વ મેળવી લીધું એમ કહે છે. આ સહીણતા દ્વારા જ લોકલોકાંતર સુધી આપણી દાટિ પહોંચી શકે છે અને આખા બ્રહ્માંડ ઉપર આપણું પ્રભુત્વ છે તેવો અનુભવ થાય છે. પ્રાચીનકાળમાં સ્વરશક્તિ માર્ગથે અણિમા, લઘિમા, મહિમા વગેરે સિદ્ધિઓ પ્રાપ્ત થતી હતી. આજના યુગપ્રવાહમાં એવું તો નથી થતું, પણ એવો અનુભવ તો જરૂર થાય છે કે નેથી આ માનવદેહનું આવરણ રહેવા છતાં દેવી તત્ત્વોનું પ્રમાણ અતિશય વધી જાય છે. વિજ્ઞાનમય કોશના વિજેતાને ભૂલોકનો દેવ અથવા શરીરધારી દિવ્ય આત્મા કહી શકાય છે.

### ગ્રંથિલેદ

વિજ્ઞાનમય કોશની ચોથી ભૂમિકા ઉપર પહોંચા પછી જીવને એવું લાગશે કે ત્રાણ જતનાં સૂક્ષ્મ બંધનોથી એ બંધાયેલો છે. પાંચ તત્ત્વોથી શરીર બન્યું છે. આ શરીરમાં પાંચ કોશ છે. આ પાંચ કોશ એ જ ગાયત્રીનાં પાંચ મુખ છે. આ પાંચ બંધનો ખોલવા માટે જ દરેક કોશની અલગ અલગ સાધના બતાવી છે. વિજ્ઞાનમય કોશની અંતર્ગત ત્રાણ બંધન છે, જે પંચભૌતિક શરીર નહીં રહેવા છતાં દેવ, ગંધર્વ, યક્ષ, ભૂત, પિશાચ વગેરે યોનિઓમાં પણ હોય છે.

આ ત્રાણ બંધન તુદ્રંથિ, વિષગુંથિ અને બ્રહ્મગુંથિના નામથી પ્રસિદ્ધ છે. તેને ત્રાણ ગુણો પણ કશ્યા છે. તુદ્રંથિ એટલે તમોગુણ, વિષગુંથિ એટલે રણગુણ અને બ્રહ્મગુંથિ એટલે સત્ત્વગુણ. આ ત્રાણ ગુણોથી પર થવાથી, જીચે ઊઠવાથી જ આત્માને આનંદ અને શાંતિ મળે છે.

આ ત્રાણ ગ્રંથિઓ ખોલવાનું મહત્વપૂર્ણ કાર્ય હંમેશાં ધ્યાનમાં રહે એટલા માટે જ ત્રાણ તારનું યજોપવીત ધારણ કરવામાં આવે છે. આનું તાત્પર્ય એ જ છે કે સત્ત, રજ અને તમ એ ત્રાણ ગુણો દ્વારા સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ શરીર બન્યું છે. યજોપવીતના અંતિમ ભાગમાં ત્રાણ ગાંઠો લગાવવામાં આવે છે, તેનું તાત્પર્ય એ જ છે કે તુદ્રંથિ અને વિષગુંથિ અને બ્રહ્મગુંથિની સાથે જીવ બંધાયેલો છે. એ ત્રાણને ખોલવાની જવાબદારીનું નામ જ પિતૃજ્ઞાણ, ઋપિત્ર્ણાણ અને દેવજ્ઞાણ છે. ‘તમ’ ને પ્રકૃતિ, રજને જીવ અને સત્તને આત્મા કહ્યો છે.

વ્યાવહારિક જગતમાં તમને સાંસારિક જીવન, રજને વ્યક્તિગત જીવન અને સત્તને આધ્યાત્મિક જીવન કહ્યું છે. જેમ આપણા પૂર્વજીએ સહયોગ દ્વારા નિર્ભળ દશાના લોકોને જીચે ઊઠાવી બળ, બુદ્ધિ, વિદ્યા, સંપત્તિ વગેરેથી સંપત્ત કરી અનેક ઉપકારો કર્યા છે, તેમ આપણું કર્તવ્ય છે કે સંસારમાં આપણા કરતાં કોઈ પણ રીતે નિકૃષ્ટ કોટિના લોકોને સહયોગ આપીને જીચે લાવવા અને સમાજ પ્રત્યેના આપણા કર્તવ્યનું પાલન કરવું એ જ ઋપિત્ર્ણાણમાંથી મુક્ત થવાનો, પૂર્વજેના ઉપકારોમાંથી ધૂટવાનો માર્ગ છે. વ્યક્તિગત જીવનને શારીરિક, બૌધ્ધિક અને આર્થિક શક્તિથી સુસંપત્ત બનાવી પોતાને મનુષ્યજાતિનો એક સભ્ય બનાવવો એ પિતૃજ્ઞાણમાંથી મુક્ત થવાનો રસ્તો છે. સ્વાધ્યાય, સત્સંગ, મનન, ચિંતન, નિદ્રાધાસન વગેરે આત્મિક સાધનાઓ દ્વારા કામ, કોથ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે અપવિત્રતાઓને દૂર કરીને આત્માને પરમ નિર્મળ દેવતુલ્ય બનાવવો એ દેવજ્ઞાણમાંથી મુક્ત થવાનો માર્ગ છે.

તાત્ત્વિક દાખિથી વિચાર કરતાં એમ લાગે છે કે તમનો અર્થ ‘શક્તિ’ થાય છે. રજનો અર્થ ‘સાધના’ થાય છે અને સત્તનો અર્થ ‘જ્ઞાન’ થાય છે. આ ત્રાણેની ન્યૂનતા તથા વિકૃત અવસ્થા બંધનકારક, અનેક મુશ્કેલીઓ અને ભૂરાઈઓને ઉત્પત્ત કરનારી હોય છે. એટલા માટે જ્યારે એ ત્રાણેની સ્થિતિ સંતોષકારક હોય તો જ ત્રિજ્ઞાણાતીત

અવસ્થા પ્રાપ્ત થાય છે.

આધ્યાત્મિક ક્ષેત્રમાં સૂક્ષ્મ સંશોધન કરનારા ઝષિઓએ જોયું છે કે ત્રણ ગુણો, ત્રણ શરીર અને ત્રણ ક્ષેત્રોનું વ્યવસ્થિત કે અવ્યવસ્થિત હોવું એ અદશ્ય કેન્દ્રો પર આધાર રાખે છે, સર્વે દિશાઓને ઉત્તમ બનાવવાથી આ કેન્દ્રો ઉત્ત્રત અવસ્થામાં આવી શકે છે. બીજે ઉપાય એ પાણ છે કે અદશ્ય કેન્દ્રોને આત્મિક સાધનાવિધિથી ઉત્ત્રત અવસ્થામાં લાવી શકાય તો સ્થ્યુલ, સૂક્ષ્મ અને કારણ શરીરોને એવી સ્થિતિએ પહોંચાડી શકાય છે કે જ્ઞાન એમને માટે કોઈ બંધન અથવા મુશ્કેલી બાકી રહે નહીં.

સાધક જ્યારે વિજ્ઞાનમય કોશમાં સ્થિર થાય છે ત્યારે તેને એવો અનુભવ થાય છે કે જાગે તેની અંદર ત્રણ કઠોર, મજબૂત ચમકદાર, હાલતી ચાલતી હલકી ગાંઠો છે. એ પૈકી એક ગાંઠ મૂત્રાશયની પાસે, બીજી આમાશયના ઉપરના ભાગમાં અને ત્રીજી મસ્તિષ્કના મધ્ય કેન્દ્રમાં આવેલી છે. એ પૈકી મૂત્રાશયવાળી ગ્રંથિને રુદ્રગ્રંથિ, આમાશયવાળીને વિષગુંગ્રંથિ અને મસ્તકવાળી ગ્રંથિને બ્રહ્મગ્રંથિ કહેવામાં આવે છે એ ત્રણે મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી પાણ કહેવામાં આવે છે.

આ ત્રણે મહાગ્રંથિઓની બબ્દે સહાયક ગ્રંથિઓ પાણ હોય છે, જે કરેડરજન્જુમાં આવેલી સુધુમણા નાડીના મધ્ય ભાગમાં રહેતી બ્રહ્મનાડીની અંદર રહે છે. આ ગ્રંથિઓને ચક પાણ કહેવામાં આવે છે. રુદ્રગ્રંથિની સહાયક બે ગ્રંથિઓને મૂલાધાર ચક અને સ્વાયિષાનચક કહેવામાં આવે છે. વિષગુંગ્રંથિની બે શાખાઓને મણિપુર ચક અને અનાહત ચક કહે છે તથા મસ્તિષ્કમાં નિવાસ કરતી બ્રહ્મગ્રંથિની સહાયક ગ્રંથિઓને વિશુદ્ધચક અને આજ્ઞાચક કહે છે. હઠ્યોગની વિધિથી પદ્થચકોનું વેધન કરવામાં આવે છે. આ પદ્થચકના વેધનની આખી ક્રિયા ઉપર ગાયત્રી મહાવિજ્ઞાનના પ્રથમ ભાગમાં પૂરતો પ્રકાશ નાખવામાં આવ્યો છે. તેથી તેની પુનરાવૃત્તિ કરવાની જરૂર નથી. જેને હઠ્યોગના બદલે જાયત્રીની પંચમુખી સાધનાની અંતર્ગત વિજ્ઞાનમય કોશમાં ગ્રંથિબેદ કરવો હોય તેને આવશ્યક જ્ઞાન આપવાનો અહીં પ્રયત્ન કરવામાં આવશે.

રુદ્રગ્રંથિનો આકાર બોર જેવો ઉપરથી આગીદાર અને નીચેથી જાડો હોય છે. એનો રંગ લાલમાં કાળો રંગ બેળવતાં બનતા રંગ જેવો છે.

આ ગ્રંથિના બે ભાગ છે. જમણા ભાગને રુદ્ર અને ડાબા ભાગને કાલી કહે છે. જમણા ભાગની અંદર પ્રવેશ કરીને જ્યારે એની જાંખી કરવામાં આવે છે ત્યારે એના ઉપરના ભાગમાં સફેદ રંગની નાની સરખી નાડીમાં પાતળો સફેદ રસ વહેતો દેખાય છે અને તેની સાથે બીજો એક તંતુ ત્રાંસો, પીળાવર્ણની જ્યોતિ જેવો ચમકે છે. મધ્ય ભાગમાં એક કાળા રંગની નાડી સાપની માફક મૂલાધાર ચકની આનુભાનુ વીટણાઈ પડેલી છે. આ ભાગની સાથે પ્રાણવાયુનો જ્યારે સંપર્ક થાય છે ત્યારે ઉમરમ જેવો ધ્વનિ નીકળે છે. રુદ્રગ્રંથિની આંતરિક સ્થિતિનાં દર્શન કરીને જ ઝષિઓએ રુદ્રનું સુંદર ચિત્ર અંકિત કરેલું છે. મસ્તક ઉપર ગંગાની ધારા, જટામાં ચંદ્રમા, ગળામાં સર્પ, ઉમરુનો ઉમરમ અવાજ, ઉપરના ભાગમાં ત્રિશૂલ મેવું ભગવાન શંકરનું ધ્યાન કરવા લાયક સુંદર ચિત્ર બનાવ્યું છે. આ ચિત્રમાં આલંકારિક રૂપમાં રુદ્રગ્રંથિની સાચી વાસ્તવિકતા ભરી દીધી છે. આ ગ્રંથિનો ડાબી બાનુનો ભાગ જે સ્થિતિમાં છે તેને અનુરૂપ કાલીનું સુંદર ચિત્ર સૂક્ષ્મદર્શી આધ્યાત્મિક ચિત્રકારોએ તેથાર કર્યું છે.

વિષગુંગ્રંથિ ક્રિયા વર્ણની, ક્રિયા ગુણવાળી, ક્રિયા આકારની, કંઈ આંતરિક સ્થિતિની, ક્રિયા ધ્વનિની હોઈ શકે એ સધાનું વિષગુના ચિત્રમાંથી સહજ રીતે પ્રતીત થઈ જાય છે. નીલ વાર્ષ, ગોળ આકાર, શંખધ્વનિ, કૌસ્તુભમણિ, વનમાળા - આવું ચિત્ર પેદી મધ્ય ગ્રંથિનું સહજ પ્રતિબિંબ છે.

નેમ મનુષ્યને મોઢાની બાનુથી જોવામાં આવે તો તેનું સ્વરૂપ એક પ્રકારનું દેખાય છે અને પીઠ પાછળથી જોવામાં આવે તો તેનું સ્વરૂપ બીજી પ્રકારનું દેખાય છે. એક જ મનુષ્યનાં બે પાસાં બે જતનાં હોય છે, એ જ પ્રમાણે

એક જ ગ્રંથિ નમાળી બાજુથી જોઈએ તો પુરુષત્વપ્રધાન લાગે અને ડાબી બાજુથી જોઈએ તો લીત્વપ્રધાન દેખાશે. એકની એક ગ્રંથિને તુદ્ર અથવા શક્તિગ્રંથિ કહી શકાય છે. વિષગુ અને લક્ષ્મી અથવા ભ્રમા અને સરસ્વતીનો સંયોગ પાગ એ જ પ્રકારે થયો છે.

ભ્રમગ્રંથિ મધ્ય મસ્તિષ્કમાં છે. તેના ઉપર સહસ્રાર શતદળ કમળ છે. આ ગ્રંથિ આકારમાં ઉપરથી ચતુર્ખોળ અને નીચેથી ફેલાયેલી છે. એની નીચેનો એક તંતુ ભ્રમરંધ્રની સાથે જોડાયેલો છે. તેના ઉપરથી જ સહસ્ર મુખવાળા શૈષનાગની શૈયા ઉપર પોઢેલા ભગવાનના નાભિકમળમાંથી ઉત્પન્ન થયેલા ચાર મુખવાળા ભ્રમાનું ચિત્ર રચાયું છે. ડાબા ભાગમાં એ ગ્રંથિ ચાર ભુજવાળી સરસ્વતી છે, વીણાના ઝાગકાર સાથે ઝાગકાર ધ્વનિનો અહીં નિરંતર ગુંજરવ થતો હોય છે.

આ ગ્રંથિઓ જ્યાં સુધી સુપ્ત અવસ્થામાં રહે છે, બંધનમાં રહે છે ત્યાં સુધી જીવ દીન-હીન દશામાં હોય છે. અશક્તિ, અભાવ અને અજ્ઞાન અને હંમેશાં વિવિધ પ્રકારે સત્તાવતાં રહે છે, પણ જ્યારે તેમના ખૂલવાનો આરંભ થાય છે ત્યારે તેમનો સાચો વૈભવ પ્રગટ થાય છે. જ્યાં સુધી પુર્ણની કળીનું મુખ બંધ હોય છે ત્યાં સુધી તેમાં નથી હોતું રૂપ કે નથી હોતું સૌંદર્ય, નથી હોતી ગંધ કે નથી હોતું આકર્ષણ, પણ જ્યારે એ જ કળી ભીબે છે અને પુર્ણના રૂપમાં પ્રકટ થાય છે ત્યારે તેનું સાચું સૌંદર્ય પ્રગટ થાય છે. જ્યાં સુધી ખજાનાને તાળું લગાવેલું હોય છે, થેલીનું મોંઢું બંધ હોય છે ત્યાં સુધી દરિદ્રતા દૂર નથી થતી, પણ જેવો રત્નરાશિનો ભંડાર ખૂલી જાય છે તે જ વખતે અમૂલ્ય વૈભવનું સ્વામિત્વ પ્રાપ્ત થાય છે.

રાને જ્યારે કમળનું મુખ બંધ થાય છે ત્યારે ભ્રમર પાણ તેમાં બિડાઈ જઈકેદ થાય છે. સવારે જ્યારે એ જ ફૂલ ભીબે છે ત્યારે ભ્રમર બંધનમુક્ત થાય છે. આ ત્રાણ કળીઓ જેવી ત્રાણ ત્રાણ ગ્રંથિઓએ જીવને બાંધી રાખ્યો છે. જ્યારે એ કળીઓ ભીબે છે ત્યારે મુજિત્તનો અધિકાર આપોઆપ પ્રાપ્ત થાય છે. આ રત્નરાશિઓનાં તાળાં ખૂલતાની સાથે જ શક્તિ, સંપત્તા અને પ્રક્ષાનો અખૂટ ભંડાર પ્રાપ્ત થાય છે.

પક્ષીઓ પોતાની છાતીની ગરમીથી ઠૂડાને સેવે છે. ચુલાની ગરમીથી ભોજન રંધાય છે. સૂર્યની ગરમીથી વૃક્ષો, વનરૂપતિઓ અને ફૂલ પાકે છે. માતા નવ માસ ગર્ભને પેટમાં રાખી એવી સ્થિતિમાં બાળકને લાવે છે કે નેથી એ જીવન ધારણ કરી શકે. વિજાનમય કોશની આ ત્રાણ ગ્રંથિઓ પાણ તપની ગરમીથી પાકે છે. તપ દ્વારા ભ્રમા, વિષગુ અને મહેશ; સરસ્વતી, લક્ષ્મી અને કાળી- બધાનો પરિપાક થાય છે. એ બધી શક્તિઓ સમદર્શી છે. તેમને કોઈની સાથે પ્રેમ નથી, તેમજ દેખ પાણ નથી. રાવણ જેવો અસુર પાણ શંકરનું વરદાન મેળવી શક્યો હતો, જ્યારે અનેક ટેવોએ કોઈ ખાસ સફળતા મેળવી નથી. તેમાં સાધકનો પુરુષાર્થ જ મુખ્ય છે. શ્રમ અને પ્રયત્ન જ પરિપક્વ બનીને સંફળતા બની જાય છે.

તુદ્ર, વિષગુ અને ભ્રમગ્રંથિઓને ખોલવા માટે એ ગ્રંથિઓના મૂળ ભાગમાં નિવાસ કરનારી બીજ શક્તિઓનો સંગ્રહ કરવો પડે છે. તુદ્રગ્રંથિના નીચેના ભાગમાં બોરના ડાંટાની માફિક એક સૂક્ષ્મ પ્રાણ હોય છે, જેને કલીં બીજ કહે છે. વિષગુગ્રંથિના મૂળમાં શ્રી બીજ હોય છે અને ભ્રમગ્રંથિના મૂળમાં હીં તત્ત્વનું સ્થાન છે. મૂળબંધ કરીને એક બાજુ અપાન અને બીજી બાજુ ફૂર્ભપ્રાણને ચીપિયાની માફિક બનાવીને તેનાથી તુદ્રગ્રંથિને પકડીને રેચક પ્રાણાયામ દ્વારા દબાવવામાં આવે છે. આ દબાણની ગરમીથી કલીં બીજ જગત થાય છે. આ અણીદાર ડાંટા જેવી આફુતનું બીજ પોતાના ધ્વનિ અને લાલ વર્ણના પ્રકાશ જ્યોતિની સાથે દેખા દે છે.

જગત થયેલા આ કલીં બીજની આગળની અણીથી કુંચુકી કિયા કરવામાં આવે છે. જેમ કોઈ વસ્તુમાં કાણું પાડવા માટે કોઈ અણીદાર વસ્તુ ધોંચવામાં આવે છે, તેવા જ પ્રકારની વેધન સાધનાને કુંચુકી કિયા કહેવામાં આવે છે. તુદ્રગ્રંથિના મૂળ કેન્દ્રમાં કલીં બીજની અધિશિખાથી જ્યારે કુંચુકી કિયા થાય છે ત્યારે આ કલિકામાં અંદર ને જાણી મહાવિજ્ઞાન - ભાગ-૩

અંદર એક ખાસ પ્રકારનો વિદ્યુતપ્રવાહ વહેવા લાગે છે. એની આકૃતિ અને ગતિ સર્પ જેવી હોય છે. આવા વહેતા પ્રવાહોને જ શંભુના ગળામાં કુંફડા મારતો સર્પ બતાવ્યો છે. જે પ્રમાણે જવાળામુખી પર્વતના ઉચ્ચ શિખર પરથી ધૂમ્રમિશ્રિત અચિનીકળે છે, તે જ પ્રમાણે તુદ્રાંથિના ઉપલા ભાગમાં પ્રથમ કલીં બીજની અચિનિહૃદ્વા પ્રગત થાય છે. એને જ કાલિકાની જીભ માનવામાં આવી છે. તેને જ શંભુનું ગ્રીજું નેત્ર પાણ કહું છે.

જેમ ફૂલજાડની એક કળી ખીલીને ફૂલ બની જય છે તેમ મૂળબંધ, અપાન અને ફૂર્મપ્રાગુના આધાતથી જગૃત થયેલા કલીં બીજની કુંચુકી કિયાથી ધીર ધીર તુદ્રાંથિ શિથિલ થઈને ખૂલવા લાગે છે. આ કમળપુષ્પના ખીલવાને પચાસન કહું છે. ત્રણે દેવોનાં કમલાસન પર વિરાજમાન હોવાનાં જે ચિત્રો રન્દૂ થયાં છે તેનું તાત્પર્ય એ જ છે કે તેમના સ્વરૂપનો સારી રીતે વિકાસ થયેલો છે.

સાધકના પ્રયત્નથી ખુલ્લી થયેલી તુદ્રાંથિનો ગ્રીજે ભાગ જ્યારે પ્રકટ થાય છે ત્યારે સાક્ષાત્ રુદ્રનો, કાલીનો અથવા લાલ રંગના સર્પ સમાન લબ્ધારા મારતી કલીં ધોષ કરતી અચિશિખાનો સાક્ષાત્કાર થાય છે. રુદ્રની આ જગૃતિ સાધકમાં પ્રગત અને ગુપ્ત એવી અનેક શક્તિઓ ભરી રહે છે. સંસારની સર્વ પ્રકારની શક્તિઓનું મૂળ કેન્દ્ર તુદ્રાંથિ છે. તેને જ રુદ્રલોક અથવા કેલાસ પાણ કહેવામાં આવે છે. પ્રલય વખતે સંસારની સંચાલન શક્તિનો ક્ષય થતાં જ્યારે તે સંપૂર્ણ શિથિલ થઈને સુપુન અવસ્થામાં જતી રહે છે ત્યારે રુદ્રનું તાંડવનૃત્ય થાય છે. આ તાંડવનૃત્યના મહામંથનથી ફરી પાછી એટલી શક્તિ પેદા થાય છે કે બીજ પ્રલય સુધી ખૂટતી નથી. રુદ્રશક્તિની શિથિલતાથી જ જીવો અને પદાર્થોનું મૃત્યુ થાય છે અને એટલા જ માટે રુદ્રને મૃત્યુના દેવ માનવામાં આવ્યા છે.

વિષગુંઘથિને જગૃત કરવા માટે જાંધર બંધ મારફત ‘સમાન’ અને ‘ઉદાન’ પ્રાણો વહે તેને દબાવવી જોઈએ કે જેથી તેના મૂળ ભાગનું ‘શ્રી’ બીજ જગૃત થાય. આ જગૃત થયેલું મૂળ બીજ ગોળ દડાની માફક પોતાની ધરી ઉપર બહુ જ વેગથી ફરે છે અને ફરવાની આ કિયા ચાલતી હોય ત્યારે સનસનાટી જેવો સૂક્ષ્મ ધ્વનિ નીકળે છે, જેને દિવ્ય કાનથી સાંભળતાં શ્રી જેવો અવાજ સંભળાય છે.

વિષગુંઘથિના બાધ્યભાગમાં શ્રી બીજને ભામરી કિયા પ્રમાણે ફેરવવામાં આવે છે. જે રીતે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તેવી જ રીતની પરિકમાને ભામરી કહે છે. લગ્નમાં વરવધૂની ફેરા ફરવાની કિયા અને દેવમંદિરોની અથવા યજ્ઞની પ્રદક્ષિણા કરવી એ ભામરી કિયાનું એક રૂપ જ છે. વિષગુની આંગળી ઉપર સુદર્શન ચક્રને ધૂમતું બતાવવામાં યોગીઓએ પોતાની સૂક્ષ્મ દિશ્યા અનુભવેલું રહસ્ય જ પ્રકટ કર્યું છે, કેમ કે જ્યારે ‘શ્રી’ બીજ વિષગુંઘથિની આસપાસ ભામરી ગતિથી પ્રદક્ષિણા કરે છે, ત્યારે એ મહાતત્વનું જગરાગ થાય છે.

પૂર્ક પ્રાણાયામની પ્રેરણથી ‘સમાન’ અને ‘ઉદાન’ પ્રાણો દ્વારા જગૃત કરેલું શ્રી બીજ જ્યારે વિષગુંઘથિના બાધ્ય આવરાગના મધ્ય પરિધમાં ભામરી કિયા કરે છે ત્યારે તેના ગુંજનથી તેની અંદરનો ભાગ સચેતન બને છે. ચૈતન્યના વિદ્યુત- તરંગો એવી રીતે પેદા થાય છે કે જાગે પક્ષી પોતાની પાંખો બંને બાજુએ હલાવતું ન હોય. આ જ ગતિના આધારે વિષગુનું વાહન ગરૂડ નક્કી કરવામાં આવ્યું છે.

આ સાધનાથી વિષગુંઘથિ ખૂલે છે અને સાધકની માનસિક સ્થિતિને અનુરૂપ વિષગુ, લક્ષ્મી અથવા પીતવર્ગની અચિશિખાની ઝાળો સમાન મહાન જ્યોતિપૂંજનો સાક્ષાત્કાર થાય છે. વિષગુનું પીતાંબર આ પીતવર્ગના જ્યોતિપૂંજનું જ પ્રતીક છે. આ ગ્રંથિ ખૂલી જવી એ વેકુંઠ, સ્વર્ગ અથવા વિષગુલોકની પ્રાપ્તિ કરવા બરાબર છે. વેકુંઠ અથવા સ્વર્ગ એ અનંત ઐશ્વર્યનું ધામ મનાયું છે. ત્યાં સર્વોત્કૃષ્ણ સુખસાધન અને સગવડો રહેલાં છે. વિષગુંઘથિ એ વૈભવનું કેન્દ્ર છે અને જે તેને ખોલી શકે એ આ વિશ્વનું સમગ્ર ઐશ્વર્ય મેળવી શકે છે.

બ્રહ્મગુંઘથિ સહસ્રદાલ કમળની છાયામાં મસ્તિષ્ણના મધ્ય ભાગમાં આવેલી છે. તેને અમૃતકળશ પાણ કહેવામાં આવે છે. એવું બતાવવામાં આવે છે કે સુરલોકમાં અમૃતકળશની રક્ષા ફેણવાળો શેષનાગ કરે છે. આનો સંબંધ રામની મહાવિજ્ઞાન - ભાગ-૩

ભ્રષ્ટગ્રંથિ સાથે જોડાયેલો છે.

ઉક્તિયાનબંધ લગાવીને 'વાન' અને 'ધનંજય' પ્રાણો દ્વારા ભ્રષ્ટગ્રંથિને પકાવવામાં આવે છે. પાકવાથી તેના મૂળાધારમાં વાસ કરતી હીં શક્તિ જાગૃત થાય છે. એની ગતિને ખાવિની કહેવામાં આવે છે. નેવી રીતે જ્ઞાનમાં મોંઝ ઉત્પત્તિ થાય છે અને એ નેમ આગળને આગળ વધતાં જય છે, તેવી જ રીતે હીં બ્રીજની ખાવિની ગતિ ભ્રષ્ટગ્રંથિને દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ ધકેલે છે. ચતુર્ખોણ ગ્રંથિના ઉપરના ભાગમાં આ હીં તત્ત્વ રોકાઈને ગાંઠો નેવા આકારો બનાવતું આગળ ચાલે છે અને છેવટે પ્રદક્ષિણા કરીને પાદું પોતાના મૂળ સ્થાન પર આવે છે.

ગાંઠો બનાવતાં આગળ ચાલવાની ઊંચી નીચી ગતિના આધાર પર માળાના મણુકા બનાવવામાં આવ્યા છે. હીં તત્ત્વ એક પરિધ પૂરો કરવામાં ૧૦૮ હિલોળા મારે છે. તેથી માળાના મણુકા પણ ૧૦૮ હોય છે. આ હીં તત્ત્વના તરંગો મંદ ગતિથી એવી રીતે ચાલે છે કે જાણો હંસ ચાલતો હોય અને એટલા જ માટે ભ્રષ્ટા અથવા સરસ્વતીનું વાહન હંસ માનવામાં આવ્યું છે. વીણાના તારોના જાગુકારને બરાબર મળતો આવતો હીં ધ્વનિ સરસ્વતીની વીણાનો પરિચય કરાવે છે.

કુંભક પ્રાણાયામની પ્રેરણાથી હીં બ્રીજની ખાવિની ડિયાનો આરંભ થાય છે. આ ડિયા નિરંતર ચાલુ રહેવાથી ભ્રષ્ટગ્રંથિ ખૂલે છે. જ્યારે એ ગ્રંથિ ખૂલી જય છે ત્યારે ભ્રષ્ટના ઇપમાં, સરસ્વતીના ઇપમાં અથવા શેત વર્ણ-શુદ્ધ જ્યોતિશિખાના ઇપમાં તેનો સાક્ષાત્કાર થાય છે. આ સ્થિતિને આત્મજ્ઞાન, ભ્રષ્ટપ્રાપ્તિ અથવા બ્રાહ્મી સ્થિતિ કહી છે. આ જ સ્થિતિને ભ્રષ્ટલોક અથવા ગોલોક પણ કહે છે. આ સ્થિતિને પ્રાપ્ત કરનારો સાધક જ્ઞાનબળથી પરિપૂર્ણ થાય છે. તેની આત્મિક શક્તિ જગત થઈને પરમેશ્વર સુધી તેને પહોંચાડી દે છે. પોતાના પિતાનો વારસો આનંદ-ભ્રષ્ટાનંદ પ્રાપ્ત કરે છે.

તે જીવનમુક્ત થઈને પદ્યક વેધનના હઠયોગની વિધિ અથવા મહાયોગનું આ ગ્રંથિભેદન બંને એક જ કક્ષાનાં છે. સાધક પોતાની સ્થિતિ અને રુચિ પ્રમાણે એમને અપનાવે છે. એ બંનેથી વિજ્ઞાનમય કોશની શુદ્ધ થાય છે.

## ૮. આનંદમય કોશ

ગાયત્રીનું પાંચમુખ આનંદમય કોશ છે. જે સ્થાન પર પહોંચતા આત્માને આનંદ મળો, જ્યાં તેને શાંતિ, ચુંબિધા, સ્થિરતા, નિશ્ચિંતતા તથા અનુકૂળતાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. એ જ આનંદમય કોશ છે. ગીતાના બીજા અધ્યાયમાં 'સ્થિતપ્રકષ' ની વ્યાખ્યા આપી છે અને સમાધિસ્થનાં જે લક્ષ્ણો બતાવ્યાં છે તે જ ચુણ, કર્મ, સ્વભાવ આનંદમયી સ્થિતિમાં બની જય છે. આત્મિક પરમાર્થની સાધનામાં મન સંપૂર્ણપણે એકાગ્ર થઈ જતાં સાંસારિક આવશ્યકતાઓ બહુ જ મર્યાદિત બની જય છે. એ આવશ્યકતાઓને સંતોષવામાં અડયાળો નથી આવતી, કેમકે સાધક પોતાની શારીરિક અને માનસિક સ્થિરતા અને સ્વસ્થતાને લીધે જીવનની આવશ્યક વસ્તુઓ જોઈતાં પ્રમાણમાં સહેલાઈથી મેળવી શકે છે.

પ્રકૃતિનું પરિવર્તન, વિશ્વવ્યાપી ચડતીપડતી, કર્માની ગહન ગતિ, પ્રારંભનો ભોગ, જગતની વસ્તુઓની નશરતા, વૈભવની શંચળતા વગેરે કારણોથી જે મુશ્કેલીઓ સામે આવીને હેરાન કરે છે તે જેઠીને તે હસે છે. તે વિચારે છે કે પ્રભુએ આ જગતમાં કેવો તડકોછાંયડો અને આભ-મીચામણીનો ખેલ ખડો કરી દીધો છે. હમણાં ખુશાલી અને ઘડીમાં દિલગીરી, ઘડીમાં વૈભવ અને ઘડીમાં નિર્ધનતા, હમણાં યુવાની તો ઘડીકમાં બુઢાપો, હમણાં જન્મ અને ઘડીકમાં મૃત્યુ, હમણાં બટાશ અને ઘડીકમાં મીઠાશ-આવી બેરંગી દુનિયા કેવી વિલક્ષણ છે! દિવસની શરૂઆત થઈ ત્યાં રાતની તૈયારી થવા લાગે છે અને રાતનો થોડો વખત ગયો એટલે પ્રભાતનો ફૂકડો બોલવા મારો છે. આ જાણતી મહાવિજ્ઞાન - ભાગ-૩

જગતનો અનાદિ ખેલ છે. વાદળાંની માફક પળે પળે તડકોછાંયદો બદલાય છે. આવાં આવાં પતંગિયાંની પાછળ હું ક્યાં ક્યાં દોહું? ક્ષાળે ક્ષાળે બદલાતી લહરીઓને હું ક્યાં ગગવા જઉ? ધડીકમાં રડવાની અને ધડીકમાં હસવાની બાળક્યા હું શા માટે કરું?

આનંદમય કોશમાં પહોંચેલો જીવ પોતાના પાછલાં ચાર શરીરો અત્રમય, પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમયને સારી રીતે સમજી લે છે. આ શરીરોની અપૂર્ગતા અને સંસારની પરિવર્તનથીલતા બંનેના સંયોગથી એક જેરી ગેસ તૈયાર થાય છે, જે જીવને પાપ-તાપડપી કાળા ધૂમાડાથી કલુષિત બનાવી દે છે. આ બંને પક્ષોના ગુણદોષોનો સમજપૂર્વક વિચાર કરવામાં આવે અને તેમને અલગ અલગ રાખવામાં આવે તો - દારૂગોળો અને અધ્યિને એકસાથે રહેવા દેવામાં ન આવે તો - ભડકાની કોઈ સંભાવના નથી રહેતી. સાધક આ વસ્તુ સમજી લઈને પોતાના દષ્ટિકોણમાં તત્ત્વદર્શન, વાસ્તવિકૃતા, સૂક્ષ્મદર્શિતાને મુખ્ય સ્થાન આપે છે, જેથી કરીને સાંસારિક સમસ્યાઓ બહુ જ હળવી અને મહત્વહીન થઈ જાય છે. જે વાતોને લીધે સામાન્ય માણસબહુ દુઃખી રહેતો હોય એવી વાતોને હલકા વિનોદની માફક સમજીને એ ઉડાવી દે છે અને આત્મિક ભૂમિકામાં પોતાનું સ્થાન દઢ બનાવી સંતોષ અને શાંતિનો અનુભવ કરે છે.

ગીતાના બીજા અધ્યાયમાં ભગવાને બતાવ્યું છે કે સ્થિતપ્રકાશ મનુષ્ય પોતાની આત્મિક સ્થિતિમાં જ રમમાણ રહે છે. સુખદુઃખમાં સમાન રહે છે, પ્રિય વસ્તુમાં આસક્ત થતો નથી અને અપ્રિય વસ્તુને વિષ્ણુરતો નથી, ઈન્દ્રિયોને તેમની મધ્યદાિમાં જ રાખે છે, આત્મા ઉપર તેમનું વર્યસ્વ ર્થપાવા દેતો નથી. જેમ કાચબો પોતાનાં બધાં અંગોને પોતાના શરીરમાં બેંચીને સમેટી લે છે, તેમ સ્થિતપ્રકાશ મનુષ્ય પોતાની કામના અને લાલસાઓને સંસારમાં ન ફેલાવતાં અંતરમાં સમાવી લે છે. જેમની માનસિક સ્થિતિ આવી હોય છે તેમને યોગી, બ્રહ્મભૂત, જીવનમુક્ત અથવા સમાધિસ્થ કહે છે.

આનંદમય કોશની ભૂમિકા પાંચમી છે. તેને સમાધિ અવસ્થા પાણ કહે છે. સમાધિ અનેક પ્રકારની હોય છે. કષ સમાધિ, ભાવસમાધિ, ધ્યાનસમાધિ, પ્રાણસમાધિ, સહજસમાધિ વગેરે મળીને ૨૭ પ્રકારની સમાધિ છે.

મૂર્છા, નશો અને કલોરોઝોર્મ સુંધવાથી આવતી સમાધિ કષસમાધિ કહેવાય છે. કોઈ ભાવનાનો એટલો અતિરેક થઈ જાય કે મનુષ્યની શારીરિક ચેષ્ટા નામશૂન્ય થઈ જાય તેને ભાવસમાધિ કહેવાય છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસને આવી ભાવસમાધિ વારંવાર આવતી હતી. ધ્યાનમાં એટલી તન્મયતા આવી જાય કે જેથી અદશ્ય અને નિરાકાર સત્તા આકાર ધારાશ કરતી માલૂમ પડે અને ધ્યાનસમાધિ કહે છે. ઈષ્ટદેવનાં દર્શન નેને થાય છે એને ધ્યાનસમાધિની અવસ્થામાં એવી ચેતના આવી જાય છે કે એને ખબર જ નથી પડતી કે જે પ્રતિમાનાં તેને દર્શન થાય છે તેનું એ દિવ્યનેત્રોથી ધ્યાન કરી રહ્યો છે કે પ્રત્યક્ષ ચર્મચક્ષુથી જોઈ રહ્યો છે એ કહી શકતો નથી. બધા પ્રાણોને બ્રહ્મરંધ્રમાં એકનિત કરવાથી પ્રાણસમાધિ સધાય છે. હઠ્યોગીઓ આ સમાધિ દ્વારા શરીરને ધાળા સમય સુધી મૃત:પ્રાય બનાવીને પાણ જીવતા રહી શકે છે. જે અવસ્થામાં પોતાને બ્રહ્મમાં લીન થવાનો બોધ થાય તે અવસ્થાને બ્રહ્મસમાધિ કહેવામાં આવે છે.

આ રીતે બધી મળીને ૨૭ પ્રકારની સમાધિઓ હેઠાં વર્તમાનકાળમાં સર્વને અનુકૂળ આવે તથા સુલભ અને સુખસાધ્ય હોય તેવી એક જ સહજસમાધિ” છે. મહાત્મા કબીરિ સહજસમાધિ પર બહુ ભાર મૂલ્યો છે. પોતાના અનુયાયીઓને આ સમાધિ માટે પ્રેરણા આપી છે.

## મહಾತ್ಮಾ ಕರ್ಬಿರಂತು ವಚನ ಛೇ ಕೇ:-

ಸಾಧೋ ! ಸಹಜ ಸಮಾಧಿ ಭಲೀ ।

ಗುರು ಪ್ರತಾಪ ಭಯೋ ಜಾ ಟಿನ ತೆ ಸುರತಿ ನ ಅನತ ಚಲೀ॥

ಆಂಖ ನ ಮುಂದು ಕಾನ ನ ರುಂ, ಕಾಯಾ ಕಷಟ ನ ಧಾಡುಂ ।

ಖೂಲೆ ನಯನ ಮೆ ಹಂಸ ಹೆಖು ಸುಂದರ ಶಪ ನಿಹಿಡುಂ ॥

ಕಹು ಸೋರ್ದಿನಾಮ, ಸುಂದರ ಸೋರ್ದಿಸುಭಿರನ, ಖಾಂಡ ಸೋರ್ದಿಪೂಜಾ ।

ಗೃಹ ಉದಾನ ಏಕ ಸಮ ಲೆಖು ಭಾವ ಭಿತಾವು ದೂಜಾ ॥

ಜಹಾಂ ಜಹಾಂ ಜಾಂ ಸೋರ್ದಿಪರಿಳಿಕ್ಮಾ ಜೋ ಕುಣ ಕುಣ ಸೋ ಸೇವಾ ।

ಜಬ ಸೋಂ ತಬ ಕುಣ ದಂಡವತ ಪೂಜು ಔರ ನ ಟೆವಾ ॥

ಶಾಂಡ ನಿರಂತರ ಮನುಂಾ ರಾತಾ, ಮಲಿನ ವಾಸನಾ ತ್ಯಾಗಿ ।

ಬೈಠತ ಉಠತ ಕರ್ಬಹುಂ ನಾ ವಿಸರೆಂ, ಐಸಿ ತಾಡಿ ಲಾಗಿ ॥

ಕಹೆ ಕರ್ಬಿರ್ ವಹ ಉಂಭನಿ ರಹತಿ, ಸೋರ್ದಿಪ್ರಕಟ ಕರ ಗಾಈ ।

ಹುಃಖ ಸುಖಕೆ ಏಕ ಪರೆ ಪರಮ ಸುಖ, ತೆಹಿ ಸುಖ ರಹಾ ಸಮಾರ್ಥಿ ॥

ಸದಗುರು ಕರ್ಬಿರಜ್ಞಾ ಸಹಜ ಸಮಾಧಿನು ಸ್ಪರ್ಶಿಕರಣ ಕರತಾಂ ಪುಲಾಸೋ ಕರ್ಣೋ ಛೇ ಕೆ ಆ ಸಮಾಧಿ ಸಹಜ ಅನೆ ಸುಲಭ ಛೇ. ಸರ್ವ ಸಾಧಾರಣನಿ ಸಾಧನಾಶಕ್ತಿನಿ ಮರ್ಯಾದಾಮಾಂ ಛೇ. ಏಟಲಾ ಜ ಮಾಟೆ ತನೆ ಸಹಜ ಸಮಾಧಿನು ನಾಮ ಆಪವಾಮಾಂ ಆಯ್ದು ಛೇ. ಹಳ ಸಾಧನಾಓ ಧಾಗಿ ಅಧರ್ಯಾ ಛೇ. ಏ ಸಾಧನಾಓನೋ ಅಭ್ಯಾಸ ಕರತಾಂ ಕರತಾಂ ಸಮಾಧಿ ಸುಧಿ ಪಣಂಚವುಂ ಏ ಕಾಮ ಖೂಬ ಕಷ್ಟಮಯ ಛೇ. ಲಾಂಬಾ ವಖತ ಸುಧಿನೀ ತಪಶ್ಚಯಾಓ ಅನೆ ಪಟ್ಟಕ್ರಮೋನೀ ಸಾಧನಾ ಸರ್ವನೆ ಮಾಟೆ ಸುಲಭ ಹೋತೀ ನಥಿ. ಅನುಭವಿ ಗುರುನೀ ಸಮಕ್ಷ ತೆಮನಿ ಪ್ರತ್ಯಕ್ಷ ಸೂಚನಾ ಅನುಸಾರ ಕೆಟಲ್ವಿಕ ಸಾಧನಾಓ ಖಾಸ ಧ್ಯಾನ ಆಪಿನೆ ಕರವಾನೀ ಹೋಯ ಛೇ ಅನೆ ತೆಮಾಂ ಪಾಣ ಕಂಡೀಕ ನೃತಿ ರಹಿ ಜಯ ತೋ ಸಂಕಟ ಉಳ್ಳಿ ಥಾಯ ಛೇ. ಯೋಗಭಾಷಣ ಲೋಕಿನೀ ನೇಮ ಧಾಗಿ ವಖತ ಭಯಂಕರ ಜೋಖಮನೋ ಸಾಮನೋ ಕುರವೊ ಪಡೆ ಛೇ.

ಆಟಲಾ ಜ ಮಾಟೆ ಕರ್ಬಿರಜ್ಞ ಸಹಜ ಯೋಗನೆ ಜ ಮಹತ್ವ ಆಪೆ ಛೇ. ಸಹಜ ಯೋಗ ಏಟಲೆ ಶುಂ ? ಸಹಜ ಯೋಗನು ತಾತ್ಪರ್ಯ ಏ ಛೇ ಕೆ ಸಿಂಧಾಂತಮಯ ಶ್ವಾಸ, ಕರ್ತವ್ಯಪೂರ್ಣ ಕಾರ್ಯಕ್ರಮ. ಆಧಿ ಉಲ್ಲಟು ಸಮಾಜನೋ ಸಾಮಾನ್ಯ ಮಾನವಿ ಇಂದ್ರಿಯ ಭೋಗಿ, ಪಾಶವಿ ವೃತ್ತಿಓ ನೇಮ ಕೆ ಕಾಮ, ಕ್ರಿಧ, ಲೋಭ, ಮೋಹನಿ ತುಳ್ಳಿ ಈಶ್ವರಾಓಧಿ ಪ್ರೇರಾಧಿನೆ ಪೋತಾನೋ ಕಾರ್ಯಕ್ರಮ ನಷ್ಟಿ ಕರೆ ಛೇ. ತಥಿ ಅನೆಕ ಜಾತನಾಂ ಹುಃಖ ಅನುಭವೆ ಛೇ.

ಸಹಜ ಸಮಾಧಿ ಏ ಅಸಂಖ್ಯ ಪ್ರಕಾರನಿ ಯೋಗಸಾಧನಾಓಮಾಂನಿ ಏಕ ಛೇ. ಏನಿ ವಿಶೇಷತಾ ಏ ಛೇ ಕೆ ಸಾಮಾನ್ಯ ರೀತ ಸಾಂಸಾರಿಕ ಕಾಮೋ ಕರತಾಂ ಕರತಾಂ ಪಾಣ ಸಾಧನಾನೋ ಕುಮ ಚಾಲು ರಹೆ ಛೇ. ಶ್ವಾಸವಹಾರನಾ ಪ್ರತ್ಯೇಕ ಕಾರ್ಯ ಸಾಯೆ ಜ ಸಾಧನಾ ಪಾಣ ಚಾಲತೀ ರಹೆ ಛೇ. ಏ ವಾತನೆ ಉಲ್ಲಾವಿನೆ ಏಮ ಪಾಣ ಕಬ್ಬಿ ಶಕಾಯ ಕೆ ಟೆನಿಕ ಶ್ವಾಸನು ದರೆಕ ಕಾರ್ಯ ಸಾಧನಾಮಯ ಜ ಬನೀ ಜಯ ಛೇ. ಸಹಜ ಯೋಗಿ ಪೋತಾನಾ ಸಾಂಸಾರಿಕ ಕಾರ್ಯನೆ ಕರ್ತವ್ಯ, ಯಶ, ಧರ್ಮ ತರೀಕಿ ಓಣಭೀ ಈಶ್ವರನೀ ಆಜ್ಞಾನಾ ಪಾಲನ ತರೀಕಿ ಜ ಕರೆ ಛೇ. ಶರೀರನೆ ಪ್ರಭುನು ಪವಿತ್ರ ಮಂದಿರ ಗಾಣಿನೆ ತನೆ ನಿಭಾವವಾ ಮಾಟೆ ಜ ಯೋಗಿ ಭೋಜನ ಕರೆ ಛೇ. ಖಾದ್ಯಪದಾರ್ಥೋ ಪಸಂದ ಕರತಿ ವಖತೆ ತೆನು ಧ್ಯಯ ಶರೀರನೀ ಸ್ವಸ್ಥತಾ ಹೋಯ ಛೇ. ತೆ ಸ್ವಾಧನೋ ವಿಚಾರ ಸರಖೋ ಪಾಣ ಕರತೋ ನಥಿ. ಕುಂಬಾಂತು ಪಾಲನಪೋಧಾಗ ಕರತಿ ವಖತೆ ಏ ಪರಮಾನ್ಮಾಭೇ ಆಪೆಲೀ ಸುರಭ್ಯ ವಾಟಿಕಾನೋ ಪಾತೆ ಮಾನಿ ಛೇ ಏಮ ಮಾನಿನೆ ತೆನಾ ಸಿಂಚನ ಅನೆ ಸಂವರ್ಧನನು ಧಾನ ರಾಖೆ ಛೇ. ಕುಂಬಿಓನೆ ಏ ಪೋತಾನಿ ಭಿಲಕ್ತತ ನಥಿ ಗಣತೋ. ಆಜ್ಞವಿಕಾ ಮೆಣವವಾನೆ ಈಶ್ವರೆ ಆಪೆಲೀ ಜಡಿಂಧಾತೋನಿ ಪೂರ್ತಿನು ಏಕ ಪವಿತ್ರ ಸಾಧನ ಜ ಮಾನೆ ಛೇ.

અમીર બનવા માટે ગમે તે રીતે ધનનો સંગ્રહ કરવાનાં તૃણગા એને નથી થતી. વાતચીત કરવી, ચાલવું, હરવું-ફરવું, ખાવું, જગવું, કમાવું, પ્રેમ, દેખ વગેરે સર્વ કાર્યોમાં પરમાર્થને, કર્તવ્યને, ધર્મને પ્રધાનતા આપતાં એ બધાં સામાન્ય કામકાજ પાણ યક્ષ રૂપ બની જય છે.

જે દરેક કાર્યના મૂળમાં કર્તવ્યભાવના પ્રધાન રહેતી હોય તો એમાં પુણ્યનો ભાગ રહેવાનો જ. સદ્દ્બુદ્ધિ અને સદ્દ્બાવનાથી કરેલાં કાર્યથી પોતાને તથા બીજાઓને સુખશાંતિ પ્રાપ્ત થાય છે. એવાં સંકાર્યો મુક્તિદાતા જ હોય છે. એ કદી બંધન કરતાં નથી. સાત્ત્વિકતા, સદ્દ્બાવના અને લોકસેવાની પવિત્ર આકાંક્ષા સાથે જીવનનું સંચાલન કરતાં એ નીતિ અને કાર્યપ્રાણાલી જીવનમાં ઓતપ્રોત થઈ જય છે અને સ્વભાવમાં વળાઈ જય છે. જે ચીજનો સારી રીતે અભ્યાસ થઈ ગયો હોય તે પ્રિય લાગવા માર્ગ છે તથા તેમાં રસ પડે છે.

ખરાબ સ્વાદવાળી, ખચળ, પ્રત્યક્ષ હાનિકારક, દુષ્પાચ્ય, નશાવાળી ચીજો, મહિરા, અફીણ, તમાકુ વગેરે વસ્તુઓનું જે થોડાક વધત સુધી સેવન થાય તો પાણ પ્રિય લાગવા માર્ગ છે અને ઘારી મહેનત કરવા છતાં પાણ તેમની ટેવ છૂટતી નથી. જે તામસી તત્વો કાલાંતરના અભ્યાસથી પ્રાણપ્રિય બની શકતાં હોય તો પછી સાત્ત્વિક તત્વો એના કરતાં પાણ વધારે પ્રિય કેમ ન બની શકે ?

સાત્ત્વિક સિદ્ધાંતને જીવનનો આધાર બનાવી લેવાથી અને અનુસાર જ વિચાર અને કાર્ય કરવાથી આત્માને સત્ત તત્ત્વમાં ભ્રમણ કરવાની-રમણ કરવાની ટેવ પડી જય છે. જેમ જેમ અધિક દઢતા, શ્રદ્ધા, વિશ્વાસ, ઉત્સાહ અને સાહસની સાથે સત્યપરાયણતામાં, સિદ્ધાંતયુક્ત જીવનમાં સંબંધ રહેતો જય છે તેમ તેમ એની વૃત્તિ સ્થાપી બની જય છે. એ એમાં તન્મય થતો જય છે. દિવ્ય આવેશ એની ઉપર છવાયેલો રહે છે. એની મસ્તી, પ્રસત્રતા તથા સંતોષ અસાધારણ હોય છે. આ સ્થિતિને ‘સહજ યોગની સમાધિ’ અથવા ‘સહજ સમાધિ’ કહેવામાં આવે છે.

કબીરજીએ આ જ સમાધિનો ઉપરોક્ત પદમાં ઉદ્દેખ કર્યો છે. એ કહે છે કે હે સાધુઓ, સહજ સમાધિ શ્રેષ્ઠ છે. જે દિવસથી ગુડુની કૃપા થઈ અને એ સ્થિતિ પ્રાપ્ત થઈ છે તે દિવસથી મન બીજે ટેકાળે નથી ગયું. ચિત્ત ઊંમાડોળ નથી થયું. હું આંખ, કાન બંધ કરીને કાયાને કણ આપે એવી હઠ્યોગની સાધના નથી કરતો, પાણ હું તો આંખો ખુલ્લી રાખી હસી હસીને પરમાત્માની પવિત્ર કૃતિઓનાં સુંદર રૂપો નીરખી રહું છું. જે કહું છું, બોલું છું એ નામ જાપ છે, જે સાંભળ્યું છું તે સ્મરણ છે, જે ખાઉંપીઉં છું તે પૂજા છે. ધર અને નંગલ બંને સરખાં જ જોઉં છું અને દૈતનો ભાવ દૂર કરું છું. જ્યાં જ્યાં હું જઈ છું તે પરિક્રમા છે અને જે જે હું કરું છું તે સેવા જ છે. જ્યારે હું સુઉં છું તે મારા દંડવત્પ્રાણમ છે. હું એક દેવને છોડીને બીજાને પૂજાતો નથી. મનની મલિન વાસના તજને નિરંતર અંત:કરાળની ઈશ્વરીય વાણી સાંભળવામાં જ મજ રહું છું. મને એવી લગની લાગી છે અને નિષ્ઠા જામી છે કે ઊકતાં-બેસતાં કદી ભુલાતી નથી. મારી આ મનોદશ હર્ષશોકથી રહિત સ્થિતિ છે અને એ સ્થિતિમાં રહીને ગાઉં છું કે દુઃખસુખથી પર જે એક પરમ સુખ છે, તેમાં હું સમાઈ ગયો છું.

એ સહજ સમાધિ તેને જ પ્રાપ્ત થાય છે જે હરહંમેશાં શબ્દભ્રત્યામાં રત રહેતો હોય. ભોગ અને તૃણગાની શુદ્ધવૃત્તિઓનો ત્યાગ કરીને અંત:કરાળમાં પ્રતિક્ષાળ ધ્વનિત થતો ઈશ્વરીય સંદેશ જે જીવ્યા કરે છે, સત્યની દિશા બતાવતા દેવી સંકેતને જે સતત જેયા કરે છે અને તેને જ જે પોતાની જીવનનીતિ બનાવે છે તે શબ્દરત સહજ યોગીને સહજ સમાધિમાં પરમ આનંદ પ્રાપ્ત થાય છે. એનો ઉદેશ જીયો હોય છે અને દેવી પ્રેરણા પર આધારિત રહેતો હોવાથી તેનાં બધાં કાર્યો-સધળો વ્યવહાર પુણ્યમય બની જય છે. ઝાંડાનાં બનાવેલાં રમકડાં આકારમાં ગમે તેવાં હોય, પાણ મીઠાં જ લાગવાનાં. એ જ પ્રમાણે સદ્દ્બાવના અને ઉચ્ચ ઉદેશથી કરેલાં કામો ભાવ્ય આફ્ક્રિતિમાં ગમે તેવાં દેખાતાં હોય છતાં એ યક્ષરૂપ હોય છે, પુણ્યમય હોય છે.

સ્વલ્પ પ્રયાસથી સમાધિનું શાશ્વત સુખ મેળવવાની ઈચ્છા રાખનારા અધ્યાત્મ માર્ગના યાત્રીઓએ જીવનનો

દિલ્લીએ બહુ ઉચ્ચ રાખવો જેઈએ, રોનિંદા જીવનવહેવારને પાણ સિદ્ધાંતને અનુકૂળ રાખવો જેઈએ. ભોગને ત્યાગીને યોગમાં આસ્થા સ્થિરકરવી જેઈએ. આ દિશામાં જે લેટલી પ્રગતિ કરશે તેટલા જ પ્રમાણમાં તેને સમાધિના લોકોત્તર સુખનો સ્વાદ ચાખવા મળશે. આનંદમય કોશની સાધનામાં આનંદનો રસ અનુભવાય છે. આ પ્રકારની આનંદમય સાધનાઓમાંથી ત્રાણ મુખ્ય સાધનાઓ નીચે આપી છે.

## નાદસાધના

“શબ્દ” ને બ્રહ્મ કહેવામાં આવ્યો છે, કેમ કે ઈશ્વર અને જીવને એક ગાંઠમાં બાંધવાનું કામ શબ્દ મારફતે જ થાય છે. સૃષ્ટિની ઉત્પત્તિની શરૂઆત પાણ શબ્દ દ્વારા જ થઈ છે. પાણ તરનો પૈકી પહેલું આકાશ બન્યું. આકાશની તન્માત્રા શબ્દ છે. અન્ય પદાર્થોની માફક શબ્દના પાણ બે પ્રકારથે- સૂક્ષ્મ અને સ્થૂલ. સૂક્ષ્મ શબ્દને વિચાર કરે છે અને સ્થૂલને નાદ કરે છે.

આપણા માટે હંમેશાં ઈશ્વરીય શબ્દપ્રવાહ બ્રહ્મલોકમાં વહેતો રહે છે. આપણી સાથે ઈશ્વર વાર્તાલાપ કરવા ઈચ્છા છે, પાણ આપણામાંના ઘણા ઓછા લોકો એ સાંભળવા ઈચ્છતા હોય છે. ઈશ્વરીય શબ્દ હંમેશાં એક એવી વિચારધારા પ્રેરિત કરે છે, જે આપણા માટે ઘણી કલ્યાણકારી હોય છે. જે એને કદી સાંભળી અને સમજ શકાય અને એ અનુસાર જે આપણે આપણું જીવન ઘડી શકીએ તો આપણે આપણા જીવનના ઉદ્દેશ તરફ ઘણી જ જલદીથી પહોંચી શકીએ. આ વિચારધારા આપણા આત્મા સાથે અથડાતી હોય છે.

આપણું અંતકરણ રેઝિયો જેવું છે. જે આપણે તેના તરફ ધ્યાન આપીએ અને આપણી વૃત્તિઓને અંતમુખી બનાવી આત્મામાંથી નીકળતી દિવ્ય વિચારલખરીઓને સાંભળીએ તો ઈશ્વરીય વાણી આપણને પ્રત્યક્ષ સાંભળવા મળશે. એને જ આકાશવાણી કરે છે. આપણે શું કરવું જેઈએ અને શું ન કરવું, આપણા માટે શું ઉચિત છે અને શું અનુચિત એનો પ્રત્યક્ષ સંદેશ ઈશ્વર તરફી પ્રાપ્ત થાય છે. અંતકરણનો પોકાર, આત્માનો આદેશ, ઈશ્વરીય સંદેશ, આકાશવાણી વગેરે નામોથી આ વિચારધારા ઓળખાય છે. પોતાના આત્માદૂપી યંત્રને સ્વચ્છ કરીને જે આ દિવ્ય સંદેશને સાંભળવા સમર્થ બને છે તે આત્મદર્શી તથા ઈશ્વરપરાયાણ કહેવાય છે.

જે પોતાની વાત ઈશ્વરને સંભળાવે છે અને જે તેની વાત પોતે સાંભળે છે તે ઈશ્વરની બહુ જ પાસે હોય છે. આવા દિવ્ય મિલન માટે હાડમાંસની બનેલી નિષ્ઠ્વા અને કાનનો ઉપયોગ કરવાની જરૂર નથી. આત્માની પાસે જ બેઠેલું અંતકરણ પોતાની દિવ્ય ઈન્દ્રિયોની સહાય્યે આ કામ ઘણી આસાનીથી કરી શકે છે. જ્યાં સુધી આત્મા મલિનતાઓથી ઢંકાયેલો હોય ત્યાં સુધી આ અન્યાંત સૂક્ષ્મ બ્રહ્મશબ્દ, દિવ્ય વિચાર બહુ અસ્પષ્ટ રૂપમાં સંભળાશે. જેમ જેમ આત્માની આંતરિક પવિત્રતા વધતી નશે તેમ તેમ આ દિવ્ય સંદેશ વધારે સ્પષ્ટતાથી સાંભળી શકાશે. શરૂઆતમાં આપણું કર્તવ્ય શું છે તેની સૂચના મળશે, પાપ-પુણ્યનું જ્ઞાન થશે. ખરાબ કામ કરતી વખતે અંતકરણમાં જથ્ય, ઘૃણા, લજા વગેરે ઉત્પત્ત થશે. સારાં કાર્ય કરતી વખતે આત્મસંતોષ, પ્રસંગતા, ઉત્સાહ વગેરે લાગણીઓ જ નમશે.

આગળ જતાં આ દિવ્ય સંદેશ ભૂત, ભવિષ્ય અને વર્તમાનની બધી ઘટનાઓને પ્રગટ કરશે. કોના માટે શું બની રહ્યું છે અને ભવિષ્યમાં કોને માટે શું થવાનું છે વગેરે સર્વ વાતોની ખબર પડી જાય છે. તેના કરતાં પાણ વધારે ઉચ્ચસ્થિત પર પહોંચતાં સૃષ્ટિનાં સંધળાં રહસ્યો તેને માટે ખુલ્લાં થઈ જાય છે. કોઈ વાત એવી નહીં હોય કે જે તેનાથી અજાણી રહે, પાણ જેવું તેને આ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે તેમ તેના ઉપયોગમાં તે ઘણો જ સાવધ બની જાય છે. ભાજક-બુદ્ધિવાળો મનુષ્ય આવું દિવ્યજ્ઞાન બાળગરની જેમ રમત કરવામાં વેડફી નાભે છે, પાણ અધિકારી પુરુષ આવી શક્તિનો કોઈને પરિચય પાણ નથી થવા દેતો અને પોતાની અને બીજાઓની આત્મોન્તતિ કરવામાં જ તેનો સદુપ્યોગ કરે છે.

શબ્દભક્તિનું બીજું રૂપ જે વિચારસંદેશના કરતાં કાંઈક સ્થૂળ છે તે નાદ છે. પ્રકૃતિના અંતરાળમાં પ્રતિક્ષાળ એક ધ્વનિ ઉઠતો રહે છે. તેના આધાતથી પરમાણુઓમાં ગતિ ઉત્પત્ત થાય છે, જેનાથી ચુંછિની બધી હિંયાઓ ચાલે છે. જેમ જેમ બીજાં તત્ત્વોનાં ક્ષેત્રોમાં થઈને તે પ્રસાર થાય છે તેમ તેમ ધ્વનિમાં ફેર પડતો જય છે. વાંસળીના છિદ્રમાં હવા ફુંકવામાં આવે તો તેમાંથી અમુક પ્રકારનો ધ્વનિ નીકળે, પણ આંગળનાં બીજાં છિદ્રોમાંથી હવા નીકળતાં મિન્ન મિન્ન સ્વરો નીકળે છે, તે જ પ્રમાણે ઊં ધ્વનિ પણ જુદાં જુદાં તત્ત્વોના સંપર્કમાં આવતાં વિવિધ પ્રકારની સ્વરલહરીઓમાં પરિણમે છે. આ સ્વરલહરીઓને સાંભળવી એ જ નાદયોગ છે.

પંચ તત્ત્વોની પ્રતિધ્વનિત થયેલી ઊં કારની સ્વરલહરીઓ સાંભળવાની નાદયોગ સાધના કેટલીક દિશાએ ધારા મહત્ત્વની છે. પ્રથમ તો આ દિવ્ય સંગીત સાંભળવામાં એટલો બધો આનંદ આવે છે કે તેટલો આનંદ મધુરમાં મધુર સંગીત સાંભળતાં પણ નથી આવતો અને બીજું એ કે આ નાદશ્વરાણથી માનસિક તંતુઓ ધારા પ્રકૃતિની ધ્વનિ પ્રકારની વીજાનીનો પ્રવાહ વહે છે. મૂગનું મસ્તિષ્ઠ મધુર સંગીત સાંભળીને એટલું ઉક્ખાસિત થઈ જય છે કે અને એના શરીરનું પણ ભાન રહેતું નથી. યુરોપમાં ગયોને દોહતી વખતે મધુર વાનિંગ વગાડવામાં આવે છે કે જેથી તેમના સ્નાયુઓ ઉત્તેજિત થઈ વધારે પ્રમાણમાં દૂધ આપે. નાદનું દિવ્ય સંગીત સાંભળીને માણસના મળજનમાં પણ એવી સ્કુરાણ થાય છે કે જેના પરિણામે તેની અનેક ગુપ્ત માનસિક શક્તિઓ વિકાસ પામે છે. આ રીતે તેની ભૌતિક અને આત્મિક એવી બંને દિશાઓમાં ઉત્ત્રતિ થતી જય છે.

ત્રીજે લાભ એકાગ્રતા છે. એક જ વાત ઉપર-નાદ ઉપર ધ્યાન એકાગ્ર થવાથી મનની વીભરાઈ જતી શક્તિઓ એકનિત થાય છે અને એ રીતે મનને વશ કરીને તેને એક નિશ્ચિત કાર્ય ઉપર લગાવવાની સાધના સફળ થાય છે. આ સફળતા કેટલી મૂલ્યવાન હોય છે તે તો અધ્યાત્મમાર્ગનો પથિક જ જાણી શકે છે. બિલોરી કાચ ઉપર માત્ર બે દીય જેટલી જગ્યામાં પડતાં સૂર્યકિરણથી અણી પ્રગટી ઉઠે છે. માનવના આવડા મોટા શરીરમાં જુદે જુદે ડેકાણે પથરાયેલી અનંત દિવ્યશક્તિઓના એકીકરણથી એવી મહાન શક્તિ પેદા થાય છે કે જે દ્વારા આખા સંસારને હલાવી શકાય છે અને પોતાના માટે આકાશમાં માર્ગ કરી શકાય છે.

નાદની સ્વરલહરીઓને પકડતાં પકડતાં સાધક ઊંકારની દોરી પકડી આત્માના અંતિમ સ્થાન બ્રહ્મ સુધી પહોંચી જય છે. બ્રહ્મલોકની પ્રાણિને મુક્તિ, નિવાણ, પરમપદ વગેરે નામોથી આળખવામાં આવે છે. નાદના આધાર પર મનોલય સાધતાં સાધતાં સાધક યોગની છેદ્ધી અવસ્થાએ પહોંચે છે અને પોતાનું અંતિમ લક્ષ્ય સાચે છે. નાદનો અભ્યાસ શી રીતે કરવો તે સંબંધમાં થોડોક પ્રકાશ પાડવામાં આવે છે.

અભ્યાસને માટે એવી જગ્યા પસંદ કરો કે જ્યાં એકાંત હોય અને બહારનો કોઈ અવાજ ન આવતો હોય. આ સાધના માટે તીવ્ર પ્રકાશ પણ અવરોધૃપ છે. તેથી અંધારી કોટડી પસંદ કરવી જોઈએ. એક પહોર રાત્રી વીતી ગયા બાદ સૂર્યોદિસ સુધીનો સમય તેને માટે ઉત્તમ છે. આ સમય અનુકૂળ ન હોય તો સવારે નવ વાગતા સુધીમાં અથવા સાંજે સૂર્યસ્ત પછીનો સમય પસંદ કરવો. હંમેશાં નિયમિત સમયે જ અભ્યાસ થવો જોઈએ. પસંદ કરેલા સ્થળે એક આસન અથવા આરામખુરશી ઉપર બેસો. નીચે આસન ઉપર બેસો તો પીઠ પાછળ તક્કિયો અથવા કપડાની નરમ ગાદી રાખો. આ પણ શક્ય ના હોય તો એક ખુણામાં તમારું આસન જમાવો અને શરીરને આરામ મળો એ રીતે બેસો અને શરીરને તદ્દન ઢીલું રાખવાનો પ્રયત્ન કરો.

ભાવના કરો કે ‘મારું શરીર ઝનો ઢગલો છે અને અત્યારે હું તેને પૂરી સ્વતંત્રતા આપી છોડી દઉં છું. થોડા જ વખતમાં શરીર બિલકુલ ઢીલું થઈ જશે અને પોતે પોતાનો ભાર પણ ઉપાડી ન શકે એટલું ઢીલું થઈ આમ તેમ ઢળવા લાગશે. આરામખુરશી, તક્કિયા અથવા દીવાલના ટેકાથી શરીર પોતાના સ્થાને રહેશે. સ્વર્ણ ઝનું બે નરમ દાટા

બનાવી બંને કાનોમાં એવી રીતે લગાવો કે બહારનો કોઈ અવાજ અંદર પ્રવેશ ન કરી શકે. આંગળીઓથી કાનનાં બંને છિંગો બંધ કરી દેવાથી પાણ કામ ચાલી શકશે. હવે બહારનો કોઈ અવાજ તમને સંભળાય નહીં અને કદાચ અવાજ આવે તો ત્યાંથી ધ્યાન હટાવી પોતાના મૂર્ખાંસ્થાન પર લઈ જાઓ અને ત્યાં ને શબ્દનો ધ્વનિ થતો હોય તેને ધ્યાનપૂર્વક સાંભળવાનો પ્રયત્ન કરો.

શરૂઆતમાં કદાચ કાંઈ જ સંભળાય નહીં, પાણ બે ચાર દિવસના પ્રયત્ન પછી જેમ જેમ સૂક્ષ્મ કારોન્દ્રિય નિર્મળ બનતો જશે તેમ તેમ ધ્વનિની સ્પષ્ટતા વધતી જશે. શરૂ શરૂમાં વિવિધ પ્રકારના ધ્વનિ સંભળાશે. શરીરમાં જે રૂત વહી રહ્યું છે તેનો પ્રવાહ રેલવેના અવાજની માફક ધક ધક કરતો સંભળાશે. વાયુના પ્રવાહનો અવાજ વાદળની ગર્વના જેવો લાગશે. રસોનું પાકવું અને તેની ગતિનો અવાજ ટક ટક જેવો આવશે. આમ, આ ત્રાણ પ્રકારના ધ્વનિઓ શરીરની ક્રિયાઓ દ્વારા થાય છે. આ જ પ્રમાણે બીજી બે પ્રકારના ધ્વનિ માનસિક ક્રિયાઓ દ્વારા થાય છે. મનમાં જે ચંચળતાનાં મોઝાં ઉઠે છે તે માનસતંતુઓ ઉપર અથડાઈને એવો અવાજ કરે છે કે જાગે ટીનના પતરા ઉપર વરસાદનાં બિંદુઓ પડી રહ્યાં હોય અને જ્યારે મસ્તિષ્ય બાધ્ય જ્ઞાનને ગ્રહણ કરે છે ત્યારે એવું લાગે છે કે જાગે કોઈ પ્રાણી શાસ લઈ રહ્યું હોય. આ પાંચેય ધ્વનિઓ શરીર અને મનના છે. થોડાક દિવસમાં ધ્વનિ સ્પષ્ટ રૂપમાં સંભળાશે. આ ધ્વનિઓને સાંભળવાથી સૂક્ષ્મ ઇન્દ્રિયો નિર્મળ થતી જશે અને ગુપ્ત શક્તિઓને ગ્રહણ કરવાની એમની યોગ્યતા વધતી જશે.

જ્યારે નાદશ્વરણ કરવાની યોગ્યતા વહી જાય છે ત્યારે વાંસળી અથવા સીટીને મળતી અનેક પ્રકારની શબ્દાવલીઓ સંભળાય છે. આ શબ્દાવલીઓ સૂક્ષ્મલોકમાં થતી ક્રિયાઓનો પરિચય આપનારી હોય છે. ઘણા દિવસોથી વિખૂટું પહેલું બચ્ચું જ્યારે એની માતાની ગોદમાં પહોંચી જાય ત્યારે તેને જે આનંદ થાય છે તે જ જતના આનંદનો અનુભવ આ સૂક્ષ્મ ધ્વનિ સાંભળનારને થાય છે.

વાસ્તવિક રીતે આ ધ્વનિ એવા તત્ત્વની અંદર થઈને આવતો હોય છે કે જ્યાં આત્મા અને પરમાત્મા વિખૂટા પેડ છે અને જ્યાં પહોંચીને બંને પાછા એક થઈ શકે છે. ધરિ ધિર આ અવાજ સ્પષ્ટ થતો જાય છે અને અભ્યાસીને એ સાંભળવામાં અદ્ભુત આનંદ આવે છે. તે એટલે સુધી કે કોઈ કોઈ વખત આ શબ્દોમાં મસ્ત બનીને તે વિહૃવણ થઈ જાય છે અને પોતાની તનમનની સુધ્બુધ પાણ ભૂલી જાય છે. આ અંતિમ શબ્દ ઝું છે, જે ઘણો જ સૂક્ષ્મ છે. તેનો ધ્વનિ ધંટારવ જેવો હોય છે. જાલર પર ટકોરા મારવાથી થોડા વખત સુધી જેમ તેની ઝણઝણાટી રહે છે તે જ પ્રમાણે ઝું નો ધંટારવ સાંભળવામાં આવે છે.

ઝુંકાર ધ્વનિ જ્યારે સંભળાવા લાગે છે ત્યારે નિદ્રા, તંદ્રા અથવા બેભાન જેવી અવસ્થા ઉત્પન્ન થાય છે. સાધ્યક તન-મનની સુધ્બુધ ભૂલી જાય છે અને સમાધિસુખની તુરીય અવસ્થાનો આનંદ લેવા લાગે છે. આ સ્થિતિથી પાણ ઉપર જતાં આત્મા પરમાત્મામાં પ્રવેશ કરતો જાય છે અને છેવટે તે પૂર્ણપાણે પરમાત્મ અવસ્થા પ્રાપ્ત કરી લે છે.

અનાહત નાદ એ અનહદ નાદનું શરૂઆતનું સ્વરૂપ છે. ‘આહત’ નાદ એ છે જે કોઈપ્રેરણા અથવા આધાતથી ઉત્પન્ન થયો હોય. વાણીના આકાશતત્ત્વની સાથે અથડાવાથી અથવા કોઈ બે વસ્તુઓ અથડાવાથી ઉત્પન્ન થતા અવાજને ‘આહત’ કહેવામાં આવે છે. કોઈ આધાત અથવા અથડામાણ સિવાય માત્ર દિવ પ્રકૃતિની અંદર આપોઆપ જે ધ્વનિઓ થાય છે તેમને ‘અનાહત’ અથવા ‘અનહદ’ કહેવામાં આવે છે.

અનાહત અથવા અનહદ નાદ મુખ્યત્વે દશ છે, જેમનાં નામ (૧) સંહારક (૨) પાલક, (૩) સુંજાક, (૪) સહસ્રદલ, (૫) આનંદમંડળ, (૬) ચિદાનંદ, (૭) સચ્ચિદાનંદ (૮) અખંડ, (૯) અગમ અને (૧૦) અલખ છે. એમનો ધ્વનિ અનુક્રમે પગની ધૂધરીઓના ઝણકાર જેવો, સાગરની લહેરો જેવો અને બુલબુલ જેવો હોય છે.

જેવી રીતે અનેક રેખિયોમથકેથી એક સાથે અનેક જુદા જુદા પ્રોગ્રામ બ્રોડકાસ્ટ થાય છે, તેવી રીતે અનેક ચખુછી મહાવિશ્વાન - ભાગ - ૩

પ્રકારના અનાહત શબ્દો પણ પેદા થતા રહે છે. જુદા જુદા ૬૪ પ્રકારના ધ્વનિ અત્યાર સુધી ગાગવામાં આવ્યા છે, પણ તેમને સાંભળવા અને સમજવા દરેકને માટે શોક્ષ નથી. જેની આત્મિકશક્તિ નેટલી ઊચી હશે તેટલા પ્રમાણમાં તે સૂક્ષ્મ શબ્દો સાંભળી શકશે, પણ ઉપરોક્ત દશ ધ્વનિ તો સામાન્ય આત્મશક્તિ ધરાવતો માણસ પાણ સહેલાઈથી સાંભળી શકે છે.

આ અનહદ સૂક્ષ્મ લોકોની દિવ્ય ભાવના છે. સૂક્ષ્મ જગતમાં કયા સ્થાન પર શું થઈ રહ્યું છે, કયા પ્રયોજન માટે કયો પ્રબંધ થઈ રહ્યો છે વગેરે પ્રકારનું ગુફા રહસ્ય આ નાદ દ્વારા જાળી શકાય છે. કયો સાધક કયા ધ્વનિને ખૂબ સ્પષ્ટ રીતે અથવા કયા ધ્વનિને મંદ રીતે સાંભળી શકશે તેનો આધાર અને તેની માનસિક સ્થિતિ ઉપર રહે છે.

અનહદ નાદ તાર વિનાની એક દૈવી સંદેશપાણાલી છે. તેનું જ્ઞાન મેળવીને સાધક બધું જાળી શકે છે. આ શબ્દોમાં ઊં ધ્વનિ આત્મકલ્યાણકારક છે અને બાકીના ધ્વનિઓ જુદા જુદા પ્રકારની સિદ્ધિઓ આપવનારા છે. આ પુસ્તકમાં તેનું વિસ્તૃત વાર્ણિક થઈ શકે એમ નથી. ગાયત્રી યોગ દ્વારા આનંદમય કોશની જગૃતિ માટે નેટલું જાગવાની જરૂર છે તેટલું જ આ પૂછો પર આપવામાં આવ્યું છે.

## બિંદુસાધના

બિંદુસાધનાનો એક અર્થ બ્રહ્મચર્ય પાણ થાય છે. અન્નમય કોશના પ્રકરણમાં આ બિંદુ શબ્દનો અર્થ ‘વીર્ય’ કરવામાં આવ્યો છે. આનંદમય કોશની સાધનામાં બિંદુનો અર્થ પરમાણુ કરવામાં આવ્યો છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ ને આણુ છે ત્યાં સુધી પહોંચવાની શક્તિ મળતાં બ્રહ્મ સુધી પહોંચી શકાય છે અને એ રીતે સામીય સુખનો અનુભવ કરી શકાય છે.

કોઈ ચીજને ખાડીને ચૂર્ણ બનાવવામાં આવે અને એ ચૂર્ણને દૂરભીનથી જોવામાં આવે તો નાના નાના ટુકડાઓનો એક સમૂહ જોવા મળશે. આવો પ્રયેક ટુકડો બીજા ધારણા નાના ટુકડાઓનો બનેલો હોય છે. આવા નાના ટુકડાઓને પાણ વેશાનિક પદ્ધતિથી તોડવામાં આવે તો અંતમાં જે ન જ તૂટી શકે તેવા જે ટુકડા રહેશે તેને પરમાણુ કહે છે. આવા પરમાણુઓની લગભગ સો જતિઓ અત્યાર સુધી ઓળખી શકાઈ છે. એમને જ આગુતત્વ કહેવામાં આવે છે.

અણુઓના બે ભાગ છે - એક સઞ્ચલ અને બીજો નિર્જવ. બંને એક પિંડ અથવા ગ્રહના રૂપમાં જાળાય છે, પાણ ખરી રીતે એમની અંદર પાણ અનેક ટુકડાઓ હોય છે. પ્રત્યેક આણુ પોતાની ધરી ઉપર ધારણ જ વેગથી ફર્યા કરે છે. પૃથ્વી દર સેંકડે ૧૮૮ માઈલની ગતિથી સૂર્યની આસપાસ ફેરે છે, ન્યારે આ ૧૦૦ પરમાણુઓની ગતિ દર સેંકડે ચાર હજાર માઈલ નેટલી હોય છે.

આ પરમાણુ પાણ અનેક વિદ્યુતકાળોના બનેલા હોય છે, જેના બે વર્ગો છે - (૧) ઝાણ કાળ (૨) ધન કાળ. ધન કાળોની ચારે બાજુએ ઝાણ કાળ એક લાખ એસી હજાર માઈલની ગતિથી પરિબ્રમણ કરે છે. ધન કાળ ઝાણ કાળનું કેન્દ્ર હોવા છતાં પાણ શાંત બેસતો નથી. જેમ સૂર્ય એ પૃથ્વીની પરિકમાનું કેન્દ્ર હોવા છતાં તે પોતાની ધરી ઉપર પાણ ફેરે છે અને સાથે સાથે આખા સૂર્યમંડળને લઈને કૃતિકા નક્ષત્રની ફરતે પાણ પ્રદક્ષિણ કરે છે, તેમ ધન કાળ પાણ પરમાણુની આંતરિક ગતિનું કારણ હોય છે. ઝાણ કાળો, જે ધારી જરૂરી ગતિથી પરિબ્રમણ કરતા જ રહે છે તે પોતાની શક્તિ સૂર્યમાંથી અથવા વિશ્વાપી અભિતત્વમાંથી મેળવે છે.

વેશાનિકો કહે છે કે ફેક્ટ એક જ પરમાણુની અંદરનો શક્તિપુંજ ફૂટે તો એક જ કાળમાં લંડન નેવાં ત્રાણ શહેરોને ભસ્મીભૂત થતાં વાર ન લાગે. પરમાણુની આ વિસ્ક્રોટની વિધિની શોધ ઉપરથી તો એટમબોંબનો જન્મ થયો છે. એક પરમાણુના ફૂટવાથી ભયંકર વિસ્ક્રોટ થાય છે, જેનો પરિચય ગયા વિશ્વયુદ્ધમાં આપાણે મળી ગયો છે.

અને હજુ વધારે મોટી ભયંકરતાનો પરિચય થવાનો બાકી છે. વૈજ્ઞાનિકો એની શોધ કરવા પાછળ ખાઈ-પીને પડ્યા છે.

આ તો પરમાણુ શક્તિની વાત થઈ. હવે એના અંગ જેવા ઝાણ કાણો અને ધન કાણોના સૂક્ષ્મ ભાગોની શોધ પાણ થઈ છે. તેઓ પાણ પોતાના કરતાં અનેકગાળા સૂક્ષ્મ પરમાણુઓના બનેલા હોય છે અને આ પરમાણુ ઝાણ કાણની અંદર રહીને દર સેક્યુડ એક લાખ છયાસી હજાર ત્રાણસો ત્રીસ માઈલની ગતિથી પરિભ્રમાણ કરે છે. હજુ એની અંદર રહેલા કષાણિયુઓની શોધ થઈ રહી છે અને વિશ્વાસ રાખવામાં આવે છે કે કષાણિયુઓમાં પાણ બીજા સર્ગાણુઓની હસ્તી છે. પરમાણુઓ કરતાં ઝાણ કાણ અને ધન કાણોની શક્તિ અને ગતિ અનેકગાળી છે. એવી જ રીતે એ સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ આણુઓની શક્તિ અને ગતિ પાણ એટલા જ પ્રમાણમાં અનેકગાળી હશે. જ્યારે પરમાણુના વિસ્ફોટથી લંડન જેવાં ત્રાણ મોટાં શહેરોનો નાશ સર્જ શકાય છે, તો સર્ગાણુની શક્તિ અને ગતિની કલ્પના કરવી પાણ આપાણ માટે મુશ્કેલ છે. તેનાથી આગળ તેના સૂક્ષ્મતમ કેન્દ્રને અનુપમ, અમાપ અને અચિન્ત્ય જરૂર કહી શકાય.

પૃથ્વી દેખાવમાં ચપટી લાગે છે, પાણ વસ્તુત: ભમરડાની માફક તે પોતાની ધરી ઉપર ફર્ધ કરે છે. ચોવીસ કલાકમાં એનું એક ચક્કર પૂરું થાય છે. સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરવી એ એની બીજી ગતિ છે. એ ચક્કર એક વર્ષમાં પૂરું થાય છે. પૃથ્વીની ત્રીજી ગતિ એ છે કે સૂર્ય પોતાના ગ્રહ અને ઉપગ્રહો સમેત ધાળા વેગથી અભિજિત નક્ષત્ર તરફ જઈ રહ્યો છે. અનુમાન છે કે તે અત્યારે કૃતિકા નક્ષત્રની પરિક્રમા કરી રહ્યો છે. એમાં પૃથ્વી પાણ સાથે છે. કૃતિકા નક્ષત્ર પાણ સૌરમંડળ વગેરે ઉપગ્રહોને લઈને ધ્વનિ પરિક્રમા કરે છે. આ સ્થિતિમાં પૃથ્વીની ગતિ પાંચમી થઈ જાય છે.

સૂક્ષ્મ પરમાણુના સૂક્ષ્મતમ ભાગ સર્ગાણુ સુધી તો માનવબુદ્ધિ પહોંચી ગઈ છે અને મોટામાં મોટા આણુના રૂપમાં પૃથ્વીની પાંચ ગતિ છે એ પાણ જાગવા મળ્યું. આકાશના અસંખ્ય ગ્રહો, નક્ષત્રો અને તારાઓનો સંબંધ કેટલા મહા આણુઓ સાથે પૂરો થતો હશે તેની કલ્પના કરતાં બુદ્ધિ થાકી જાય છે. અને અનુપમ, અમાપ અને અચિન્ત્ય કહી શકાય.

આણુને યોગની ભાષામાં અંડ પાણ કહે છે. વીરનો એક કાણ એ અંડ છે. એ એટલું નાનું હોય છે કે મોટા દુરભીનથી પાણ ધારી મુશ્કેલીથી જોઈ શકાય છે, પરંતુ એ જ્યારે વિકાસ પામીને સ્થૂલ રૂપમાં આવે છે ત્યારે એ મોટું હીંદું બની જાય છે. આ હીડામાં પક્ષી રહે છે. એના અનેક વિભાગો હોય છે. એ વિભાગોમાં અસંખ્ય સૂક્ષ્મ ઉપવિભાગો હોય છે અને એમાં પાણ પાછા અગણિત કોષાંડો હોય છે આ જ પ્રમાણે શરીર પાણ એક આણુ છે અને તેને જ અંડ અથવા પિંડ કહે છે. આખા વિશ્વબ્રહ્માંડમાં અસંખ્ય સૂર્યમાળાઓ, આકાશગંગાઓ અને ધ્વનોનાં ચકો છે.

આ ગ્રહોનું અંતર અને એમના વિસ્તારનું કોઈ માપ જ નથી. પૃથ્વી ધારો મોટો પિંડ છે, પાણ સૂર્ય એનાથી તેર લાભગાળો મોટો છે. સૂર્યથી પાણ કરોડોણા મોટા બીજા ગ્રહો છે. તેમના એકબીજા વચ્ચેના અંતરનો ખ્યાલ આપવા માટે એમ કહેવું પડશે કે પ્રકાશની ગતિ એક સેક્યુડની એક લાખ છયાસી હજાર માઈલની છે અને એ ગ્રહોનો પ્રકાશ પૃથ્વી સુધી આવતાં ત્રીસ લાખ વર્ષ લાગે છે. એટલે કે જે પેલો ગ્રહ આને નાણ થાય તો પાણ તેનો પ્રકાશ ભવિષ્યમાં ત્રીસ લાખ વર્ષ સુધી આવતો જ રહેશે. જે નક્ષત્રોનો પ્રકાશ પૃથ્વી પર આવે છે એ સિવાય તેના કરતાં અનેકગાળી સંખ્યાનાં નક્ષત્રો પૃથ્વીથી એટલાં દૂર છે કે જે મોટાં દૂરભીનોની મદદથી પાણ જોઈ શકતાં નથી. આટલા બધા મોટા અને આટલે દૂર આવેલા ગ્રહો જ્યારે પ્રદક્ષિણા કરતા હોય અને આપાણ સૂર્યમંડળને સાથે લઈને કોઈ દૂરના સ્થાન તરફ પ્રયાણ કરતા હોય ત્યારે કેટલા અનંતગાળા શૂન્ય આકાશમાં આ યાત્રા થતી હશે તેના વિસ્તારની કલ્પના કરવાનું માનવીના મગજ માટે ધારું અધરું કામ છે.

આવડું મોટું બ્રહ્માંડ પણ એક આગું અથવા અંડ છે, એટલા માટે તેને બ્રહ્મ + અંડ = બ્રહ્માંડ કહ્યું છે. પુરાણોમાં વાર્ણિંદ્ર હેડે જે બ્રહ્માંડને આપાગે જાગીએ છીએ તે સિવાય તેના જ જેવાં બીજાં અનેક બ્રહ્માંડો અસ્તિત્વમાં છે. તે સર્વના એક સમૂહને મહાઅંડ કહ્યું છે. એ મહાઅંડની તુલનામાં આપણી પૃથ્વીનું કદ પરમાગુની તુલનામાં સર્ગાંગું હોય તેમ બિલકુલ નાનું છે.

આ નાનામાં નાના અને મહાનમાં મહાન અંડમાં જે શક્તિ રહેલી છે, તે આ બધાને ગતિશીલ, વિકસિત, પરિવર્તિત અને ચૈતન્યમય રાખે છે. તેને બિંદુ કહેવામાં આવ્યું છે. આબિંદુ જ 'પરમાત્મા' છે. તેને નાનામાં નાનો અને મોટામાં મોટો કહેવાયો છે. ઉપનિષદોએ એની ઓળખ 'આગોરણીયાન મહતો મહીયાન' કહીને આપી છે.

આનંદમય કોશમાં રહેલા જીવને આ બિંદુનું ચિંતન કરતાં કરતાં પેલા પરબ્રહ્મના રૂપની કાંઈક જાંખી થાય છે અને તેને ખાતરી થાય છે કે આ બ્રહ્મની- આ મહાઅંડની તુલનામાં માનું અસ્તિત્વ મારો પિંડ કેટલો તુચ્છ છે.

આ તુચ્છતાનું ભાન થતાં તેનો અહંકાર અને ગર્વ ઓગળી જાય છે. બીજી ભાજી સર્ગાંગું એ અખૂટ શક્તિનો અક્ષય ભંડાર છે અને એવા શક્તિશાળી અનંત સર્ગાંગુઓનું આ શરીર બનેલું છે તો પછી એ પોતાને દીનહીન શા માટે સમજે? એક વખત આ શક્તિનો ઉપયોગ કરતાં આવડી જાય તો આ સંસારમાં કોઈ પાગ બાબત એવી નથી જે આપણા માટે અશરૂ હોય.

નેમ મહાઅંડની તુલનામાં આપણું શરીર અત્યંત કુદ્ર છે અને નેમ આપણા શરીરની તુલનામાં આ મહાઅંડનો વિસ્તાર અનુપમ છે તે જ પ્રમાગે સર્ગાંગુઓની દિલ્હીમાં આપણું શરીર એક મહાબ્રહ્માંડ નેટબું વિશાળ લાગશે. આ તુલનાત્મક લઘુતા-મહત્વાનું ચિંતન કરતાં કરતાં જે સ્થિતિ સમજમાં આવશે તે પ્રકૃતિના અંડથી લિભ્ર એવી એક દિવ્યશક્તિના રૂપમાં જાગુશે. તે વખતે એમ લાગશે કે હું મધ્યબિંદુ છું, કેન્દ્ર છું, સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને સ્થૂળમાં સ્થૂળ એવી તમામ વસ્તુઓમાં માનું અસ્તિત્વ છે, મારી વાપકતા છે.

લઘુતા અને મહાનતાનું એકાંતચિંતન એ જ બિંદુસાધના કહેવાય છે. આ સાધનાના સાધકને એમ થાય છે કે હું અનંતશક્તિનું ઉદ્ભવસ્થાન હોવાથી આ સૂદ્ધિનું મહત્વપૂર્ણ મધ્યબિંદુ છે. નેમ જાપાન પર ફૂટેલો પરમાગું આગુંબોંબના રૂપમાં ઈતિહાસમાં ચિરસ્મરણીય રહેશે તેમ આપણા શક્તિભંડારનો સદુપયોગ કરવામાં આવે તો અપ્રત્યક્ષ રીતે આ સંસારમાં ભારે પરિવર્તન કરી શકાય તેવી દરેક શક્યતા છે.

વિશ્વામિત્રે રાજ હરિશ્ચદ્રના પિંડનો એટમબોંબ બનાવીને 'અસત્ય' ના સામાન્ય ઉપર એવો વિસ્ફોટ કર્યો હતો કે લાખો વર્ષો વીચાં છતાં તેનાં 'એક્ટિવ કિરાગો' હજુ સુધી નાશ થયાં નથી. એટબું જ નહિ, પણ પોતાના પ્રભાવથી અસંખ્ય માનવીઓને આજ સુધી બરાબર પ્રભાવિત કરતાં રહ્યાં છે. મહાત્મા ગાંધીએ બચપણમાં રાજ હરિશ્ચદ્રનું ચરિત્ર વાંચ્યું. તેમણે પોતાની આત્મકથામાં લખ્યું છે કે એ ચરિત્રની તેમના પર એવી છાપ પડી કે તરત જ તેમણે પોતે હરિશ્ચદ્રનેવા સત્યવાદી થવાનો નિશ્ચય કરી લીધો અને તે પ્રમાગે પોતે હરિશ્ચદ્ર થયા પણ ભરા. રાજ હરિશ્ચદ્ર આને નથી, છતાં પણ તેમનો આત્મા આને પણ મહાન કાર્ય કરી રહ્યો છે. આપણને શું ખબર કે એટલા ગાંધી આ પ્રમાગે અપ્રગટ રીતે નિમાણ થતા હોયે? ગીતાકાર આને નથી, પણ તેમની ગીતા આને કેટલાય લોકોને અમૃત પાઈ રહી છે તે કોણ આગે? પિંડનો આ સૂક્ષ્મ પ્રભાવ છે, જે પ્રગટ અથવા અપ્રગટ રીતે પોતાનું અને બીજાનું કલ્યાણ કર્યા જ કરે છે.

કાર્બ માર્ક્સના સૂક્ષ્મ શક્તિકેન્દ્રમાંથી પ્રસ્કૃતિત થયેલી ચૈતનાએ આને અદ્ધી દુનિયાને કોમ્યુનિસ્ટ બનાવી દીધી છે. પૂર્વકાળમાં મહાત્મા કાર્બસ્ટ, મહંમદ પેગમ્બર, બુદ્ધ, કૃષ્ણ વગેરે અનેક મહામાનવો એવા થયા છે કે નેઓએ સંસાર ઉપર ધાર્યો જ પ્રભાવ પાડ્યો છે. આવા પ્રગટ મહાપુરુષો સિવાય એવા અનેક અપ્રગટ આત્માઓ પાંગ છે કે નેઓએ સંસારની સેવા માટે, જીવોના કલ્યાણ માટે ગુણ રીતે ધારું ભારે કામ કર્યું છે. આપણા દેશમાં

યોગી અરવિંદ, મહાર્ષિ રમાગ, રામકૃષ્ણ પરમહંસ, સમર્થ ગુરુ રામદાસ વગેરે દ્વારા જે કાર્ય થયું અને આજે પણ અનેક મહાપુરુષો જે કાર્ય કરી રહ્યા છે તેને સ્થુલ દિશ્યી સમજ શકતું નથી. યુગપલટો નજીકમાં આવી રહ્યો છે. એટલા માટે સૂક્ષ્મ જગતમાં રચનાત્મક અને બંડનાત્મક જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે જે ચર્મચયક્ષુથી દેખાય તો ખબર પડે કે કેવું અદભુત અને અભૂતપૂર્વ પરિવર્તનચક ચાલી રહ્યું છે અને બહુ નજીકના ભવિષ્યમાં કેવા કેવા વિલક્ષણ ફેરફાર કરીને માનવજીને એક નવો પ્રકાશ આપવા આગળ વધી રહ્યું છે.

વિષ્યાંતરની ચર્ચા કરવાનો આપણો ઉદ્દેશ નથી. અહીં તો હું એ બતાવવા માગું છું કે લઘુતા અને મહાનતાના ચિંતનની બિંદુસાધના દ્વારા આત્માનું ભૌતિક અભિમાન અને લોભ ઓગળી જાય છે અને સાથે સાથે આંતરિક શક્તિનો એટલો વિસ્તાર થાય છે કે ને પોતાના તથા જગતના કલ્યાણ માટે અંત્યે મહત્વપૂર્ણ છે.

બિંદુસાધકની આત્મશક્તિ ધારી ઉજાવળ થતી જાય છે. તેના વિકારો દૂર થઈ જાય છે. તેના ફળ સ્વરૂપે તેને આનંદની પ્રાપ્તિ થતી જાય છે. આ આનંદ પ્રાપ્ત કરવો એ જ જીવનનો પ્રધાન હેતુ છે.

## કલાસાધના

કલા એટલે કિરણ. સામાન્ય રીતે પ્રકાશ અંત્યે સૂક્ષ્મ છે. આવી સૂક્ષ્મતાનો એક સમૂહ જે આપણને એક નિશ્ચિત પ્રકારનો અનુભવ કરાવે તેને ‘કલા’ કહેવામાં આવે છે. સૂર્યમાંથી નીકળીને પ્રકાશના ધારા સૂક્ષ્મ તરંગો પૃથ્વી પર આવે છે. તેમનો એક સમૂહ એવા પ્રકારનો બને છે કે જેનો અનુભવ આપણે નેત્રોથી કરી શકીએ. સૂર્યના કિરણોના સાત રંગો પ્રસિદ્ધ છે. પરમાણુઓની અંદર જે પરમાણ છે તેમના વિદ્યુતતરંગો જ્યારે આપણી આંખો સાથે અથડાય છે ત્યારે આપણને કોઈ રૂપ અને રંગનું જ્ઞાન થાય છે. રૂપને પ્રકાશવાન બનાવી પ્રગટ કરવાનું કામ કલા દ્વારા જ થાય છે.

કલાના બે પ્રકાર છે-(૧) આપ્તિ (૨) વ્યાપ્તિ. આપ્તિ કિરણો એ છે કે ને પ્રકૃતિના આગુંઓમાંથી પ્રક્રિયા થાય છે. વ્યાપ્તિ એ છે કે ને પુરુષના અંતરમાંથી પ્રગટ થાય છે. તેને તેજસ કહે છે. બધી વસ્તુઓ પાંચ તત્ત્વોમાંથી બનેલી છે. એટલે પરમાણુમાંથી નીકળતાં કિરણો પોતાના મુખ્ય તત્ત્વની વિશિષ્ટતાઓ સાથે લાવે છે. રંગ દ્વારા આ વિશિષ્ટતા ઓળખી શકાય છે. કોઈ વસ્તુનો ભૌતિક રંગ જોઈને એમ કહી શકાય કે એમાં તત્ત્વો પૈકીનું ક્ષું તત્ત્વ કેટલા પ્રમાણમાં વિદ્યમાન છે.

કોઈ પાણ મનુષ્યના તેજસમાં વ્યાપ્તિ કલાનું દર્શન થાય છે. આ તેજસ ખાસ કરીને મુખની આસપાસ પ્રકાશમંડળની માફક ફેલાયેલું હોય છે. જે કે સામાન્ય રીતે આખા શરીરની આસપાસ આ પ્રકાશ ફેલાયેલો રહે છે. આને અંગ્રેજીમાં ‘ઓરા’ અને સંસ્કૃતમાં ‘તેજેવલય’ કહે છે. ટેવતાઓનાં ચિત્રોમાં એમના મુખની આસપાસ એક પ્રકાશના ગોળા જેવું ચિત્ર હોય છે. આ એમની કલાનું જ ચિહ્ન છે. અવતારોના સંબંધમાં એમની શક્તિનું માપ એમની કળાઓના પ્રમાણમાં થાય છે. પરશુરામમાં ત્રાણ, રામચંદ્રજીમાં બાર અને ફુષ્ણગમાં સોળ કળાઓ બતાવાઈ છે. એનો અર્થ એ થથો કે એમનામાં એટલાગણી આત્મિક શક્તિ હતી.

સૂક્ષ્મદર્શી લોકો કોઈ વ્યક્તિ અથવા વસ્તુની આંતરિક સ્થિતિનું માપ તેના તેજેવલય અથવા રૂપ, રંગ, ચમક અને ચૈતન્યને જોઈને કરી બે છે. કળાવિદ્યાનું જેને જ્ઞાન છે, તેવો માણસ ભૂતળની અંદર છુપાયેલા પદાર્થો અથવા વસ્તુઓની અંદર છુપાયેલા તેમના ગુણ, પ્રભાવ અને મહત્વ ધારી જ સહેલાઈથી જ્ઞાની બે છે. કોઈ મનુષ્યમાં કેટલી કળા છે, તેનામાં કઈ કઈ શારીરિક, માનસિક અને આત્મિક વિશેષતાઓ છે તથા કયા કયા ગુણો, દોષો, યોગ્યતાઓ અને સામર્થ્યો કેટલો પ્રમાણમાં એનામાં મોજૂદ છે, તેનું સહજ જ્ઞાન તેને થઈ જાય છે. આ જ્ઞાન હોવાને લીધી કોઈ મનુષ્યની સાથે કેટલો સંબંધ રાખવો તે તેના માટે સરળ થઈ જાય છે.

કળાવિદ્યાના જાગુકાર પોતાના શરીરનાં તત્ત્વોની ન્યૂનતા તથા અધિકતાનું જ્ઞાન મેળવીને પોતાના આત્મબળથી જે તેને સુધારી શકે છે અને પોતાની કળાઓમાં યોગ્ય સંશોધન, શુદ્ધિ અને વિકાસ કરી શકે છે. કળા જ સામર્થ્ય છે. પોતાના આત્મિક સામર્થ્યનું, આત્મિક ઉત્ત્રતિનું માપ કળાઓની પરીક્ષા મારફતે પ્રગત થઈ શકે છે અને સાધક નક્કી કરી શકે છે કે તેની ઉત્ત્રતિ થઈ રહી છે કે નહીં અને તેને સંતોષકારક સફ્ફળતા મળી છે કે નહિએ.

સધણી બાજુથી ચિત્તને હટાવીને, આંખો બંધ કરીને ભૂકુટીના મધ્ય ભાગમાં ધ્યાન એકનિત કરવાથી મસ્તકમાં તથા તેની આજુભાજુ રંગબેરંગી ધજાઓ કે પાંચિયાં જેવું જાગુણે. તેમના રંગોનો આધાર તત્ત્વો ઉપર રહે છે. પૃથ્વી રંગનું તત્ત્વ પીળું, જળનું તત્ત્વ સફેદ, અધિનું લાલ, વાયુનું લીલું અને આક્રાશનું તત્ત્વ ભૂરું હોય છે. જે રંગનું પ્રમાણ વધારે પ્રદર્શિત થાય તેના ઉપરથી એ જાગી શકાય છે કે એ વખતે આપણામાં કયાં તત્ત્વો વધારે છે અથવા કયાં ઓછાં છે.

દ્રેક રંગમાં પોતપોતાની વિશિષ્ટતાઓ હોય છે. પીળાં રંગમાં જ્ઞમા, ગંભીરતા, પાચન, ઉત્પાદન, સ્થિરતા, વૈભવ, મજબૂતી, ભારેપાણું વગેરે. સફેદ રંગમાં શાંતિ, રસિકતા, કોમળતા, પવિત્રતા, એકદમ પ્રભાવિત થવું, વૃદ્ધિ, શીતળતા, સુંદરતા, બુદ્ધિ, પ્રેમ વગેરે. લાલ રંગમાં ગરમી, ઉણગતા, કોધ, ઈધા, દ્વેષ, અનિષ્ટ, શૂરવીરપાણું, સામર્થ્ય, ઉત્તેજના, કડોરતા, કામુકતા, તેજ, ચમક, સ્ફૂર્તિ વગેરે. લીલા રંગમાં ચંચળતા, કલપના, સ્વઘનશીલતા, શરીર જકડાવું, દર્દ, અપહરણ, ધૂર્તિના, ગતિશીલતા, વિનોદ, પ્રગતિશીલતા, પ્રાણ, પોષણ, પરિવર્તન વગેરે. નીલા રંગમાં વિચારશીલતા, બુદ્ધિ-સૂક્ષ્મતા, વિસ્તાર, સાત્ત્વિકતા, પ્રેરણા, વ્યાપકતા, સંશોધન, સંવર્ધન, સિંચન, આકર્ષણ વગેરે ગુણો હોય છે.

જે અથવા ચેતન કોઈ પાણ પદાર્થના બાધ્ય રંગ ઉપરથી અને તેમાંથી નીકળતી સૂક્ષ્મ પ્રકાશન્યોત્તિ ઉપરથી જાગી શકાય છે કે આ વસ્તુ અથવા પ્રાણીના ગુણ, સ્વભાવ અને પ્રભાવ કેવા છે. સામાન્ય રીતે આ પાંચ તત્ત્વોની કલા છે, જેના દ્વારા આપણાને આ પ્રમાણે લાભ મળે છે - (૧) વ્યક્તિઓ અને પદાર્થોની આંતરિક સ્થિતિ સમજી જવી. (૨) પોતાના શારીરિક અને માનસિક ક્ષેત્રમાં જે ગુણદોષો હોય તેમને સપ્રમાણ બનાવવા. (૩) બીજ્ઝોની શારીરિક તથા માનસિક વિકૃતિઓ સુધારીને સુયવસ્થિત કરવી. (૪) તત્ત્વોના મૂળ આધાર સુધી પહોંચીને તેમની ગતિવિધિઓ અને ડિયાપદ્ધતિને જાગી લેવી. (૫) તત્ત્વો ઉપર અધિકાર સ્થાપિતે સાંસારિક પદાર્થોનું નિર્માણ, પોષણ અને વિનાશ કરવો.

આ પાંચેય લાભો એવા છે કે જે એમની બરોબર વ્યવસ્થા કરવામાં આવે તો તે રિદ્ધિ અને સિદ્ધિઓની માફક આશ્ર્યજનક લાગશે. આ પાંચ ભૌતિક કળાઓ છે, જેનો ઉપયોગ રાજ્યોગી, હઠ્યોગી, મંત્રયોગી અને તાંત્રિક પોતપોતાની રીતે કરે છે અને એ તાત્ત્વિક શક્તિનો સદૃષ્યોગ કે દુરુપ્યોગ કરી ભલું અથવા ભૂરું પરિણામ મેળવે છે. કળા દ્વારા સાંસારિક ભોગવેબન પાણ મળી શકે છે, આત્મકલ્યાણ પાણ થઈ શકે છે, એટલું જ નહીં પાણ કોઈને શાપ આપીને દુઃખી પાણ બનાવી શકાય છે. પાંચ તત્ત્વોની કળાઓ આવી પ્રભાવશાળી હોય છે.

આત્મિક કળાઓની ત્રાણ છે-સત્ત, રંજ અને તમ. તમો ગુણીય કળાઓનું મધ્યબિંદુ શિવ છે. રાવાણ, હિરણ્યકશ્યપ, ભર્માસુર, કુંભકુર્ણ, મેધનાદ વગેરે અસુરો આ તાત્ત્વિક કળાઓના સિદ્ધપુરુષો હતા. રજેનુણી કળાઓ વિષગુમાંથી ઉદ્ભાવે છે. ધીન્દ, કુલ્ભર, વરુણ, બૃહસ્પતિ, મૃવ, અનુર્ણ, લીમ, યુવિષિર, કર્ણ વગેરેમાં આ રાજસિક કળાઓની વિશેષતા હતી. સતોનુણી સિદ્ધિઓ બ્રહ્માંથી ઉદ્ભાવે છે. વાસ, વસિષ્ઠ, અત્રિ, બૃજ, મહાવીર, ગાંધી વગેરે સાત્ત્વિક કળાના પ્રતિનિધિઓ હતા.

આત્મિક કળાઓની સાધના ગાયત્રી યોગમાં વારુવિલ ગ્રંથિલેદન દ્વારા થઈ શકે છે. તુદ્રાંગિ, વિષગુંગિ અને બ્રહ્માંથી ખૂલી જવાથી સાધકને એ ત્રાણેય કળાઓનો સાક્ષાત્કાર થાય છે. પ્રાચીનકાળમાં લોકોના શરીરમાં ૪૧૬

આકાશતત્ત્વનું પ્રમાણ ધારું વધારે રહેતું હોવાથી આ સાધનાઓથી તેમને ભારે સામર્થ્ય પ્રાપ્ત થતું હતું, પણ આજના યુગમાં લોકોનાં શરીરોમાં પૃથ્વીતત્ત્વ પ્રધાન છે. તેથી અગિમા, મહિમા વગેરે સિદ્ધિઓ તો નહીં, પણ સત્ત, ૨૮ અને તમની શક્તિઓના વિકાસથી આજે પણ ધારું હિત સાધી શકાય.

## પાંચ કુળાઓ દ્વારા તાત્ત્વિક સાધના

**પૃથ્વી તત્ત્વ :** આ તત્ત્વનું સ્થાન મૂલાધાર ચક અર્થાત् ગુદાથી બે આંગળ અંડકોશ તરફ સીવનમાં આવેલું છે. સુષુપ્તિમાં આરંભ આ સ્થાનથી થાય છે. પ્રાયેક ચકનો આકાર કમળના પુષ્પ જેવો હોય છે. તે ભૂલોકનું પ્રતિનિધિ છે. પૃથ્વીતત્ત્વનું ધ્યાન આ મૂલાધાર ચકમાં કરવાનું હોય છે.

પૃથ્વીતત્ત્વની આકૃતિ ચતુર્ભોગુણ છે. રંગ પીળો અને ગુણ ગંધ છે. એટલા માટે તેની શાનેન્દ્રિય નાસિકા અને કર્મન્દ્રિય ગુદા છે. આ તત્ત્વની વિકૃતિથી જ શરીરમાં પાંદુ અને કમળા જેવા રોગો થાય છે. ભય વગેરે માનસિક વિકારોમાં આ તત્ત્વની પ્રધાનતા હોય છે. મૂલાધાર ચકમાં ધ્યાનને સ્થિર કરવાથી આ તત્ત્વના વિકારો આપોઆપ શાંત થાય છે.

**સાધનાવિધિ :** સવારે જ્યારે એક પ્રહર અંધારું હોય ત્યારે ઊઠીને કોઈ શાંત સ્થાનમાં જઈને પવિત્ર આસન પર બેસવું. બંને પગને પાછળ વાળી તેના ઉપર બેસો. બંને હાથને ઊંધા કરીને ધૂંટળ ઉપર એવી રીતે રાખો કે જેથી આંગળીઓના છેડાઓ પેટ તરફ રહે. પછી નાસિકાના અગ્રભાગ ઉપર દિશિ રાખીને મૂલાધાર ચકમાં ‘બ’ બીજવાળી અને ચારે બાજુએ પીળા રંગવાળી પૃથ્વીનું ધ્યાન કરવું. આ પ્રમાણે કરવાથી નાસિકા સુગંધથી ભરાઈ જશે અને શરીર ઉજાવળ કાંતિવાળું બની જશે. ધ્યાન કરતી વખતે ઉપર વાણવિલા પૃથ્વીતત્ત્વના સમસ્ત ગુણોનું સારી રીતે ધ્યાન કરવાની કોણિકા કરવી અને ‘બ’ એ બીજ મંત્રનો મનમાં જાપ કરવો.

**જળતત્ત્વ :** પેહુની નીચે અને જનનેન્દ્રિયની ઉપર મૂળ ભાગમાં સ્વાધિકાન ચકમાં જળતત્ત્વનું સ્થાન છે. આ ચક ‘ભુવ’ લોકનું પ્રતિનિધિ છે. જળતત્ત્વનો રંગ શૈત, આકૃતિ અર્ધચંદ્રાકાર અને ગુણ રસ છે. કડવો, ખાટો, તીખો, મધુર વગેરે સર્વ રસોનો સ્વાદ આ તત્ત્વને લીધે આવે છે. તેની શાનેન્દ્રિય નિષ્ઠાવા અને કર્મન્દ્રિય લિંગ છે. આ તત્ત્વની વિકૃતિથી મોહ વગેરે વિકારો થાય છે.

**સાધના વિધિ :** પૃથ્વીતત્ત્વની સાધના માટે બતાવેલ આસન પર બેસી ‘બ’ બીજવાળા અર્ધચંદ્રાકાર ચંદ્રમા જેવી કાંતિવાળા જળતત્ત્વનું સ્વાધિકાન ચકમાં ધ્યાન કરવું. આથી ભૂખ-તરસનું દુઃખ મટે છે અને સહનશક્તિ ઉત્પત્ત થાય છે.

**અભિનત્ત્વ :** નાભિસ્થાનમાં આવેલા મણિપૂરક ચકમાં અભિનત્ત્વનો નિવાસ છે. આ તત્ત્વ ‘સ્વ’ લોકનું પ્રતિનિધિ છે. આ તત્ત્વની આકૃતિ ત્રિકોણ, રંગ લાલ અને ગુણ રૂપ છે. શાનેન્દ્રિય નેત્ર અને કર્મન્દ્રિય પગ છે. કોથ વગેરે માનસિક વિકાર અને સોજ વગેરે શારીરિક વિકારો આ તત્ત્વની વિકૃતિથી થાય છે. આ તત્ત્વની સિદ્ધિ થવાથી મંદાશિ, અજ્ઞાન વગેરે પેટના વિકાર દૂર થાય છે અને કુંડલિની શક્તિ જગ્રત થવામાં મદદ મળે છે.

**સાધના વિધિ :** નિયત સમય પર બેસીને ‘ર’ બીજ મંત્રવાળા ત્રિકોણ આકૃતિના અને અભિની માફક લાલ પ્રભાવવાળાં અભિનત્ત્વનું મણિપૂરક ચકમાં ધ્યાન કરવું. આ તત્ત્વની સિદ્ધિ થવાથી સહન કરવાની શક્તિ અને કગાળી વધી જશે.

**વાયુતત્ત્વ :** આ તત્ત્વ હૃદય પ્રદેશમાં આવેલા અનાહત ચકમાં છે અને મહા: લોકનું પ્રતિનિધિ છે. રંગ લીલો, આકૃતિ પદકોણ તથા ગોળ બંને પ્રકારની છે. ગુણ સ્પર્શ, શાનેન્દ્રિય ત્વચા અને કર્મન્દ્રિય હાથ છે. આ તત્ત્વની વિકૃતિથી વાયુવિકાર, દમ વગેરે રોગો થાય છે.

**સાધનાવિધિ :** નિયત વિધિથી 'ં' બીજવાળા અને લીલી આભાવાળા વાયુતત્ત્વનું અનાહત ચકમાં ધ્યાન કરવું. આ ધ્યાનથી શરીર અને મનમાં હલકાપણું આવશે.

**આકાશતત્ત્વ :** શરીરમાં આ તત્ત્વનો નિવાસ વિશુદ્ધચકમાં છે. આ ચક કંઈસ્થાનમાં છે. એ 'જન' લોકનું પ્રતિનિધિ છે. તેનો રંગ વાઇની, આકૃતિ ઈડાની માફક લંબગોળ અને ગુણ શબ્દ છે. તેની જ્ઞાનેન્દ્રિય કાળ અને કર્મન્દ્રિય વાગી છે.

**સાધનાવિધિ :** પૂર્વોક્ત આસન પર બેસીને 'હ' બીજ મંત્રનો જ્ય કરતાં કરતાં ચિત્રવિચિત્ર રંગવાળા આકાશતત્ત્વનું વિશુદ્ધ ચકમાં ધ્યાન કરવું જોઈએ. આ ધ્યાનથી ત્રણેય કાળનું જ્ઞાન, ઐશ્વર્ય અને અનેક સિદ્ધઓ પ્રાપ્ત થશે.

દરરોજ નિયમિત રીતે આ પાંચ તત્ત્વોનું છ માસ સુધી ધ્યાન કરવામાં આવે તો તત્ત્વો સિદ્ધ થઈ જય છે અને પછી તેમને ઓળખીને તેમાં વધધટ કરવાનું સરળ થઈ જાય છે. તત્ત્વોનું સામર્થ અને કળાઓની વૃદ્ધિ થવાથી સાધક કલાધારી બની જાય છે. તેની કળાઓ પોતાનો ચમત્કાર બતાવા વિના રહેતી નથી.

### તુરિયાવસ્થા

મનને સંપૂર્ણ રીતે સંકલ્પરહિત કરી દેવાથી ખાલી મગજનીને નિર્વિષ્ય સ્થિતિ થઈ જાય છે તેને તુરિયાવસ્થા કહે છે. આ સ્થિતિમાં મનમાં કોઈ પણ પ્રકારનો સંકલ્પ રહેતો નથી. ધ્યાન, ભાવ, વિચાર, સંકલ્પ, ઈચ્છા અને કામનાનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવે અને ભાવરહિત બનીને માત્ર આત્માના એક જ કેન્દ્રમાં અંતકરણને પૂર્ણપણે સમાવી દેવામાં આવે તો સાધક તુરિયાવસ્થામાં પહોંચી જાય છે. આ સ્થિતિમાં એટલો આનંદ આવે છે કે આ આનંદના અતિરેકમાં પોતાપણાની સુધભૂધ ઘૂંઠી જાય છે. પૂર્ણ મનોયોગ હોવાથી વિભરાયેલો આનંદ એકીભૂત થઈ સાધકને આનંદના મહાસાગરમાં તરબોળ કરી નાંબે છે. આ સ્થિતિને સમાધિ કહેવામાં આવે છે.

સમાધિકાળમાં આપણો સંકલ્પ જ એક સજ્જવ અને અનંત શક્તિશાળી દેવ બની જાય છે અને તેની જાંખી એકદમ સ્પષ્ટ થતી જાય છે. નેત્રોના દોષ અને ચંચળતાના લીધે કોઈપણ વસ્તુ ધૂધળી દેખાય છે અને તેની બારીકીઓ સૂઝતી નથી, પણ સમાધિ અવસ્થામાં જે સંકલ્પ પર દિવ્ય ઈન્દ્રિયો અને ચિત્તવૃત્તિઓનું એકીકરણ થાય છે તે સંકલ્પ સર્વ રીતે મૂર્તિમાન અને સક્રિય દેખાય છે. જે કોઈને જ્યારે પણ ઈશ્વરનો મૂર્તિમાન સાક્ષાત્કાર થાય છે ત્યારે સમાધિ અવસ્થામાં તેનો સંકલ્પ જ મૂર્તિમાન થયેલો હોય છે.

ભાવાવેશમાં પણ ક્ષાળિક સમાધિ થઈ જાય છે. ભૂતપ્રેતનો આવેશ, દેવોન્માદ, હર્ષ અથવા શોકની મૂર્છા, નૃત્ય-વાદ્યમાં લીન થઈ જવું, આવેશમાં આવી જઈને પોતાની અથવા કોઈની હત્યા કરવી અથવા કોઈ ભયંકર કૃત્ય કરી નાખવું, કોધનો અતિરેક, વિભૂતા પદેલાઓનું પ્રેમમિલન, કીર્તન વગેરે સમયમાં ભાવવિલુણતા, અશ્વપાત, ચિત્કાર, આર્તનાદ, કરુણારુદ્ધન વગેરેમાં આંશિક સમાધિ હોય છે. સંકલ્પમાં, ભાવનામાં આવેશની જેટલી અધિક માત્રા હોય તેટલી સમાધિ પણ ઊરી હોય અને તેનું ફળ પણ સુખ અથવા દુઃખના ઇપમાં એટલું જ અધિક હોય. ભયનો અતિરેક કે આવેશ હોતાં ઉરના લીધે ભાવના માત્રથી કેટલાક લોકોનાં મૃત્યુ પણ થયેલાં જોવામાં આવે છે. કેટલાક લોકો ફાંસી પર ચઢતા પહેલાં જ ઉરને લીધે પ્રાણ ત્યાગી દે છે.

આવેશની દશામાં આંતરિક શક્તિઓ અને વૃત્તિઓનું એકીકરણ થઈ જવાથી પ્રચંડ ભાવોદેગ થઈ આવે છે. આ ઉદ્વેગને જુદી જુદી દશાઓમાં મૂર્છા, ઉન્માદ, આવેશ વગેરે નામોધી ઓળખવામાં આવે છે, પણ દિવ્ય ભૂમિકામાં જ્યારે એ આત્મતન્મયતાની સાથે હોય છે ત્યારે તેને સમાધિ કહેવામાં આવે છે. પૂર્ણ સમાધિમાં પૂર્ણ તન્મયતાને લીધે પૂર્ણ આનંદનો અનુભવ થાય છે. આરંભ અલ્ય માત્રાની આંશિક સમાધિ સાથે થાય છે. દેવી

ભાવનાઓમાં એકાગ્રતા અને તન્મયતાની સાથે જ્યારે પૂર્ગ ભાવાવેશ થાય છે ત્યારે આંખો મીંચાઈ જાય છે. સુસ્તિ, તંત્રા અને મૂર્ખી પણ આવવા લાગે છે. માળા હાથમાંથી ધૂટી જાય છે અને જ્ય કરતાં કરતાં જીબ પણ અટકી જાય છે. આ વખતે પોતાના ઈષ્ટેવની હળવી જાંખી થાય છે અને એકાએક બેવા આનંદનો ક્ષાળિક અનુભવ થાય છે કે જે સંસારના કોઈ પણ પદાર્થી મળતો નથી. આ સ્થિતિ શરૂઆતમાં બહુ અંદ્ય માત્રામાં થાય છે, પણ ધીર ધીર તેનો વિકાસ થઈને પરિપૂર્ણ તુરિયાવસ્થા તરફ આગળ વધે છે અને અંતમાં સિદ્ધ મળી જાય છે.

આનંદમય કોશનાં ચાર પ્રધાન અંગો છે, જેમનાં નામ (૧) નાદ, (૨) બિન્દુ, (૩) કળા, (૪) તુરિયા છે. આ સાધનાઓથી સાધક પોતાની પાંચમી ભૂમિકા સિદ્ધ કરે છે. ગાયત્રીના આ પાંચમા મુખને ખોલી નાખનાર સાધક જ્યારે એક એક કરીને પાંચે મુખોથી માતાના આશીર્વાદ પ્રાપ્ત કરી વે છે ત્યારે તેને કશું પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી.

## ૮. પંચકોશી સાધના સંબંધી જાગ્રવા જેવું

પાછલા પ્રકરણમાં પાંચ કોશોની સાધના અંતર્ગત આવી ગયેલી યોગવિદ્યાની એટલી જ સાધનાઓ બતાવવામાં આવી છે જે ને સામાન્ય જનતા માટે ઉપયોગી હોય. એ તો દેખીનું જ છે કે આ બધામાં આધ્યાત્મિક મહાત્ત્વ તો ગાયત્રી જ છે. જેટલું જ્ઞાનવિજ્ઞાન અને યોગ છે એ સર્વ ગાયત્રીમાંથી જ ઉદ્ભવ્યું છે. એટલે એવી કોઈ સાધના નથી જે ગાયત્રીના મહાવર્તુળની બહાર હોય. નિશ્ચિત રીતે આખું યોગશાસ્ત્ર ગાયત્રીના મહાવર્તુળની અંદર જ સમાપ્તેલું છે.

યોગસાધનાઓ અનેક છે. એ સર્વ એક જ મહાત્ત્વની પ્રાપ્તિ માટે છે. ગાયત્રીનું નામ જ મુજિનું છે અને તેને જ સિદ્ધ કહે છે. જેમ કોઈ નગરમાં પેસવા માટે અનેક દરવાજાઓ હોય છે તે જ પ્રમાણે પ્રભુપ્રાપ્તિને માટે અનેક યોગ છે. પ્રયેક માર્ગમાં અલગ અલગ પ્રકારનાં દશ્યો, પદાર્થો અને મનુષ્યો મળે છે, તેમને ધ્યાનમાં રાખીને લોકો પોતાના નિયતસ્થાન પર પહોંચવાનો માર્ગ નક્ષે કરે છે. એ જ પ્રમાણે પ્રયેક યોગસાધનાની એ વિશેષતા છે કે તેમાં વિશિષ્ટ અનુભવો થાય છે અને બિજ્ઞ બિજ્ઞ સિદ્ધિઓ, શક્તિઓ અને સામર્થ્યો પ્રાપ્ત થાય છે. અંતમાં બધા એક જ સ્થાન પર પહોંચે છે.

યોગસાધનાઓ અનેક પ્રકારની એટલા માટે છે કે મનોભૂમિ, સ્થિતિ, શક્તિ, સુવિધા, રૂચિ, દેશ, કાળ અને પાત્રતાના લેદવાળા અનેક લોકો તેમને અપનાવી શકે. યુગપરિવર્તન અનુસાર તત્ત્વોની સ્થિતિમાં ફેરફાર થતો રહે છે. પૂર્વકાળમાં હવા અને પાણીમાં જે શુણો હતા તે આજે નથી અને જે ગુણ આજે છે તે હવે પછી નહીં રહે. સુષ્ઠિ ધીર ધીર દરરોજ વૃદ્ધત્વ પામતી જાય છે. બાળકમાં જેટલી સ્ફૂર્તિ, ચંચળતા, કોમળતા, ઉમંગ અને ઉત્સાહ હોય છે તેટલો વૃદ્ધોમાં નથી હોતો. જુવાન માણસ જેટલો ભાર ઉઠાવી શકે તેટલો વૃદ્ધને માટે શક્ય નથી.

સત્તું સુષ્ઠિનું બાળપણ છે, તેતા જુવાની, દ્વાપર આધેડ અવસ્થા અને કલિયુગ એ વૃદ્ધાવસ્થા છે. પાંચેય તત્ત્વોની આવી સ્થિતિ હોય છે. જ્યારે વૃદ્ધાવસ્થા અધિક આવે છે ત્યારે સુષ્ઠિ મરી જાય છે, તેનો પ્રલય થઈ જાય છે. ન્યાર પછી તેનો નવો જન્મ થાય છે. સત્તું પંચતત્ત્વોમાં પ્રાણીઓનાં શરીર પણ એવાં જ હતાં. ખાદ્યપદાર્થો અને જળવાયુમાં પણ એવી જ વિશેષતા હતી. માનસિક ચેતના, ઈન્દ્રિયલાલસા, આહારવિહાર, આયુષ્ય અને શરીરના બંધારાળનો ગરમી તથા વાયુના પ્રભાવની સાથે ઘણો સંબંધ રહે છે.

ભૂસ્તરશાસ્ત્રીઓએ કંઈ હજારો વર્ષ જૂનાં હોય એવાં જીવનેતુઓનાં હાડપિંજરો મેળવીને શોધ્યું છે કે વર્તમાન જીવોની તુલનામાં તેમની આકૃતિ કંઈક જુદા જ પ્રકારની અને કદમાં પણ ઘણી મોટી હતી. મનુષ્યનું હાડપિંજર દશ ફૂટ લાંબું હું. મહાગજ, મહામકર અને મહાશ્શુકર તેમના અત્યારના વંશજેના પ્રમાણમાં પાંચથી માંડીને સાડત્રીસ જાયતી મહાવિજ્ઞાન - ભાગ-૩

જાણા મોટા હતા એવાં પ્રમાણો મળ્યાં છે. જે પ્રમાણે સૂર્યકાળમાં અભિતત્ત્વપ્રધાન શરીરવાળાં પ્રાગુંઝીઓ રહેતાં હતાં તે પ્રમાણે સત્ત્યુગમાં આ પૃથ્વી પર આકાશતત્ત્વની પ્રધાનતા હોવાથી એ સમયે તે તત્ત્વની પ્રધાનતાવાળાં પ્રાગુંઝીઓ આ પૃથ્વી પર હતાં. તેમને માટે તે વખતે પાંખો વિના પણ ઉડવાનું ઘણું સરળ હતું. હનુમાનજીએ પાંખો વિના માત્ર છલાંગ મારીને સમુદ્ર ઓળંઝો હતો. ત્રેતાયુગમાં થોડાક લોકો માટે જ આવી છલાંગ મારવાનું શક્ય હતું. તેથી જ હનુમાનને ઘણું મહત્ત્વ મળ્યું. સત્ત્યુગમાં આ બાબત ઘણી સામાન્ય હતી.

અહીં પૂર્વયુગોની સ્થિતિનો થોડોક પરિચય આપવાની જરૂર એટલા માટે પડી કે જેથી સાધક જાગું જય કે જે યોગસાધનાઓ સત્ત્યુગના મનુષ્યો માટે અન્યાંત સરળ અને સ્વાભાવિક હતી, એ હવે થઈ શકે એમ નથી. જે સિદ્ધિઓ પૂર્વકાળમાં થોડીક સાધનાથી મળી જતી હતી તે આજે લગભગ અશક્ય છે. શિવને મેળવવા માટે પાર્વતીને કેટલા લાંબા સમય સુધી કેટલું કષણસાધ્ય તપ કરવું પડ્યું હતું, એવું આજની સ્થિતિમાં કોઈને માટે શક્ય નથી. શક્ય એટલા માટે નથી કે મનુષ્યનું આયુષ્ય માત્ર સો વર્ષ જેટલું ઢંકું થઈ ગયું છે અને પૃથ્વીતત્ત્વપ્રધાન થઈ જવાથી શરીરમાં જરૂતાનો અંશ વધી ગયોછે.

આજે જેમ સોનાને અજિનમાં તપાવવામાં આવે છે તેવી રીતે એક જમાનામાં પોતે પાપી નથી એમ સાબિત કરવા આચેપરીક્ષા કરવામાં આવતી હતી. સીતાજીએ હસતે હસતે એવી અજિનપરીક્ષા આપી હતી, છતાં એમના શરીરને સહેજ પણ કષ થયું નહોતું, પરંતુ આજે તો પરમ સાધ્યાનું શરીર પણ અજિનમાં બજ્યા વગર ન રહે. કલિયુગમાં સતીપ્રથાનો નિષેધ એટલા માટે છે કે આજે કોઈ સ્ત્રી પતિની ચિત્તામાં બળી મરે અને તેને જરાય કષ ન થાય એવું બની શકે નહિ. તેથી પ્રાચીનકાળની સતીઓની જેમ તે પતિને શાંતિ આપી શકતી નથી, ઊલટું પોતાના આર્તનાદથી પતિના આત્માને દુઃખ અને નાર્કીય વથા પહોંચાડે છે.

કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે યુગની સ્થિતિ અનુસાર યોગસાધનાનો માર્ગ અને પરિણામ બદલાતાં રહે છે. એટલા માટે સાધનાક્રમોની વ્યવસ્થા અને વિધિવિધાનમાં તફાવત પડતો જય છે. આ યુગનો તત્ત્વવેત્તા પોતાની સુક્ષ્મ દિશિથી તપાસ કરીને એ નિશ્ચય કરી લે છે કે આજની સ્થિતિમાં કઈ સાધના જરૂરી છે અને કઈ પ્રકૃતિનો અને કઈ મનોભૂમિવાળો સાધક કયા પ્રકારની સાધના સારી રીતે કરી શકશે. જો આ નિર્ણય યોગ્ય નહિ હોય તો યોગસાધના ઘણીવાર લાભને બદલે હાનિકરક નીવડવાનો સંભવ છે.

એવી અનેક ધર્મનાઓ મેં મારી આંખોથી જીઈ છે. પ્રાગુને બ્રહ્માંડમાં ચઢાવ્યા પછી તેને પાછો લાવવાની કિયા જાણતો ન હોવાથી એક સાધકનું અર્ધા કલાકમાં મૃત્યુ થયું હતું. એક સજાનન કુંડલિનીને જગૃત કરવાનો પ્રયત્ન કરતાં લક્વાના પંજમાં ફસાઈ ગયા હતા. કુંડલિનીનો કૂર્મ-મેનુ જરા જેટલો જ વિશલિત થયો હતો, એટલામાં જ તેઓ પિંગળામાં કુકલ પ્રાગુનો પ્રવેશ કરવા લાગતાં વાયુ કુપિત થયો અને લક્વાથી તેમના હાથપગ જકડાઈ ગયા. ગાયત્રી તંત્રની સાધના કરતાં પ્રાગુણોની હિંસા થંથિને એક ગૃહસ્થ જગૃત કરી રહ્યો હતો. બીજા કોઈકના ઉપર હુમલો કરવાનો તેનો ઈરાદો હતો, પણ હિંસા જગૃત ન થઈ અને ભૂલથી તેના ડાબા પરખામાં રહેલો તિર્યક આગુણી શાટી ગયો. એના મુખ અને નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. ત્રાણ શેર જેટલું લોહી નીકળી જવાથી ૪૦ મિનિટમાં જ તેનું મૃત્યુ થઈ ગયું.

હઠયોગની ઘણી ચર્ચા આપગે સાંભળીએ છીએ, કેમકે નજીકના ભૂતકાળમાં કણિયુગના પ્રારંભના દિવસોમાં તેનો ઘણું પ્રચાર હતો. નાગાર્જુન હઠયોગના મોટા સિદ્ધ હતા. નાથ સંપ્રદાયના આચાર્ય ગોરખનાથ અને મર્યાદનાથ પૂર્ણ હઠયોગીઓ હતા. બૌધ્ધકાળમાં મહાયાન અને વજયાન વગેરેનો પ્રચાર હતો, પણ હવે કોઈ જ ઠેકાણે પૂર્ણ આરોગ્યવાન હોય એવા હઠયોગી નજરે પડે છે. ધટકમ જેવાં કે નેતિ, ધોતિ, બસ્તિ, ન્યોલી, વજોલી, કપાળભાતિ વગેરે કરનારા કેટલાએ સાધકોને ઉદરોગથી પીડાતા અમે જેયા છે. નાસ્કામાંથી સૂતરની દોરી ચઢાવતા એક

સજનને આંખો ખોઈ હતી. મુખમાંથી કપડાની પડી પેટમાં ઉતારવાની કિયાથી એક માણસને સંગ્રહણીનો રોગ લાગુ પડ્યો હતો અને પછી તેમાંથી તેનો છુટકરો થયો ન હતો. વજોલી કિયા કરનારા ઘણીવાર બહુમૂત્ર અને મૂત્રપિંડના સોજથી ગ્રસિત થઈ જય છે.

કરાગુ એ છે કે સાધકની સ્થિતિનો સારી રીતે વિચાર કર્યા સિવાય જ તેની પ્રકૃતિથી વિપરીત સાધના બતાવવામાં આવે તો તેનું અહિત જ થાય. કોઈક સાધક એવા અહંકારી, ઉતાવળિયા અને દુસ્સાહસી હોય છે કે ચોક્કસ માર્ગદર્શકની સલાહ લીધા સિવાય જ પોતાની મરજી પ્રમાણે પુસ્તકિયા જ્ઞાનના આધારે સાધના કરવા લાગી જય છે, મરજીમાં આવે એવા લાભોની કલ્પના કરી લે છે અને મરજીમાં આવે એવી વિધિવ્યવસ્થા કરી લે છે. એમાં એમને લાભને બદલે હાનિ જ વધારે થાય છે. એટલા માટે યોગમાર્ગના સાધકે ગુરુ કરવાની ખાસ જરૂર છે.

આ પુસ્તકમાં પંચકોશોની સાધનાની ચર્ચા દરમ્યાન ગાયત્રી યોગનો ઉદ્દેખ કરવામાં આવ્યો છે. તેમાં યોગકિયાઓની બિલકુલ ચર્ચા કરવામાં આવી નથી કેમ કે જે સાધનાઓ દ્વારા, તેતા અને સત્યુગ નેવા યુગો માટે ઉપયોગી હતી તે સાધનાઓ આકાશ, અભિ, વાયુ અને જળતત્ત્વપ્રધાન શરીરવાળા સાધકો જ આસાનીથી કરી શકતા હતા. આ પુસ્તકમાં ઉપરોક્ત સાધનાઓની ચર્ચા બિનનજરૂરી જ નહીં, પરંતુ અનુચ્ચિત પાગ લેખાય, કેમ કે તેના આધારે કોઈ એવી સાધનાઓ કરવા લાગે તો તેને લાભ થવાને બદલે હાનિ જ થાય અને સમયનો અપવય થવા ઉપરાત યોગસાધન માટે અશ્વધા, નિરાશા, અરુચિ તથા નુકસાન થવાનો સંભવ અને ભય રહે છે. એટલા માટે અહીં એવી જ સાધનાઓની ચર્ચા અને વાર્ગન કરવામાં આવ્યું છે, જે આજની પરિસ્થિતિમાં ઉપયોગી હોય.

જે સાધનાઓનું વાર્ગન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે તેના સંબંધમાં એટલું કહેવું જોઈએ કે વાર્ગન સંક્ષિપ્ત રૂપમાં કરવામાં આવ્યું છે. તેનું પૂરું વિધિવિધાન અને સમસ્ત નિયમ ઉપનિયમ બતાવ્યા નથી, કેમ કે હઠયોગ માટે સર્વે એકસરખાં વિધિવિધાન લાગુ પડી શકે નહીં. નાદયોગની સાધના બધા લોકો એક જ વિધિથી કરી શકે નહીં. ઉષુગુ પ્રકૃતિવાળાઓને અસ્થિર, ચંચળ અને અનેક ધ્વનિઓવાળો નાદ સંભળાય છે. એવા સાધકોને એવો ઉપાય બતાવવો જોઈએ કે જેણે તેમની ઉષુગતા શાંત થાય અને દિવ્ય ધ્વનિ સારી રીતે સંબળી શકે. તેનાથી ઉલટું જેમની પ્રકૃતિ શીતપ્રધાન છે તેમને અનાહત નાદ ધ્યાણો ધરિ ધરિ અને મંદ રીતે સંભળાય છે. તેમની દિવ્ય કાર્ણેનિયોને ઉષુગુ સાધનાથી ઉત્તેજિત કરવી જોઈએ, જેથી નાદ સ્પષ્ટતાથી સાંભળી શકાય. જેમ શીત અને ઉષુગુ પ્રકૃતિના મે બેદો ઉપર બતાવ્યા છે તેવા બીજા પાગ અનેક બેદ અને ઉપલેદી છે, જેને લીધે એક જ સાધના માટે અનેક પ્રકારના નિયમ અને ઉપનિયમો બનાવવા પડે છે, એવી દશામાં બધી જ પ્રકૃતિના લોકો માટે પરિસ્થિતિને અનુકૂળ જુદી જુદી સાધનાવિધિઓ એક જ પુસ્તકમાં બતાવવાનું શક્ય નથી.

ચિકિત્સાશાસ્ક્રમાં નિદાન, નિધંટુ તથા ઔષધિ નિમાણની વિસ્તારપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે, તે છતાં એવો કોઈ ગ્રંથ અત્યાર સુધી લખાયો નથી, જેમાં સર્વ પ્રકારના રોગીઓને માટે સર્વ પ્રકારની પરિસ્થિતિઓ અનુસાર બધી જ જાતની ચિકિત્સા-વિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો હોય. યોગસાધનાની બાબતમાં પાણ એવું જ છે. કોઈ એક નાની સરખી સાધના માટે પાગ સાધકના બેદ પ્રમાણે વિધિવિધાનમાં જે જુદી જુદી જાતના ફેરફારો કરવા પડે છે તેનું વાર્ગન પૂરેપૂરું થઈ શકે નહીં. ગાયત્રીની પંચમુખી સાધનાની અંતર્ગત જે જે સાધનાઓ આ પુસ્તકમાં બતાવી છે તે સામાન્ય રૂપમાં લખાયેલી હોવાથી તેમાં અપૂર્ણતાનો દોષ રહી જવાનો સંભવ છે.

એવું નથી કે પંચકોશોની અંતર્ગત આવતી બધી સાધનાઓ કરવાથી જીવનનો ઉદ્દેખ પૂરો થાય. જે સાધકની વર્તમાનકાળમાં જે કોશમાં જે સ્થિતિ હોય તે એક કોશ માટે બતાવેલી બધી સાધનાઓ પૂરી કરીને પોતાનું બંધન ખોલી શકે છે. આ પુસ્તકમાં ચોવીસથી પાગ વધારે સાધનાઓ બતાવી છે. એ સિવાય બીજી અનેક સાધનાઓ છે. તે આપણા આજના ટૂંકા જીવનમાં પૂરી કરવાનું શક્ય નથી. જે કે એવું કરવાની જરૂર પાગ નથી.

આયુર્વેદમાં હજરો ઔષધીઓનું વાર્ણન છે. એ રોગ દૂર કરી સ્વાસ્થ્ય મેળવવાના એક જ ઉદ્દેશથી બનાવવામાં આવે છે, તે છતાં કોઈ બધી જ ઔષધીઓનું સેવન નથી કરતો. બુદ્ધિમાન ચિકિત્સક રોગીની પરીક્ષા કરે છે. તેની આયુ, સ્થિતિ અને પ્રકૃતિ જોઈને ક્રયું ઔષધ કેટલી માત્રામાં અને કયા અનુપાન સાથે આપવું તેનો નિર્ણય કરે છે. કોઈવાર થોડી થોડી માત્રામાં ધાળી ઔષધીઓનું મિશ્રાળ આપવાનું હોય છે. સાધનાની બાબતમાં પાળ આવું જ છે. સાધકની મનોભૂમિ અનુસાર સાધના નક્કી કરવાની હોય છે. બધાને એક જ લાક્ઝીથી હાંકવાનો પ્રયોગ ધાળો જ જોખમકારક છે.

રોગી પોતે પોતાના રોગ માટે ઔષધીનો નિર્ણય નથી કરી શકતો. કોઈ વૈદ્ય અથવા ડોક્ટર બીમાર પડે છે, તો તે પાળ બીજા કુશળ ચિકિત્સક પાસે પોતાનો ઈલાજ કરાવે છે, કેમકે પોતે પોતાની પરીક્ષા કરવી ધાળી મુશ્કેલ છે. બીજાની ભૂલો જટ ધ્યાનમાં આવે છે. પોતાના દોષો પોતાને માલૂમ પડતા નથી. પોતાની આંખો આપણને દેખાતી નથી. આપણી આંખ માટે બીજાને પૂછું પડે છે અથવા દર્ખણની મદદ લેવી પડે છે. આ જ વાત આપણી મનોભૂમિની પરીક્ષા માટે અને તેના યોગ્ય ઉપયોગની તપાસ માટે લાગુ પડે છે. એમાં બીજા કોઈ અનુભવી મનુષ્યની સલાહ અને માર્ગદર્શનની જરૂર છે. આ જરૂરી સહાયતા અને સુવ્યવસ્થાનું નામ જ “ગુરુ કરવા” કહેવાય છે. સાચા માર્ગદર્શક ગુરુ મળી જવા એ અદ્ધી સફળતા મળવા બરોબર છે.

પ્રત્યેક વ્યક્તિને આ સાધનાઓનો અધિકાર છે. લીપુરુષ, બાળક-વૃદ્ધની સ્થિતિબેદને અનુકૂળ સાધનાવિધિઓમાં ફેરફાર હોય, પાળ એવું નથી કે ગાયત્રી સાધનાથી અમુક વર્ગને વંચિત રાગ્યામાં આવે. બધાં એક જ માતાનાં સંતાન છે. સર્વ બાળકો ઉપર તેને સમાન મમતા છે. સર્વને એક સરખાં લાડ લડાવે છે અને સર્વને પયપાન કરાવવા ઈર્છા છે. કોઈ માતા એવી નથી કે પુત્ર જન્મે તો તેને પયપાન કરાવે અને પુત્રી જન્મે તો તેનો તિરસ્કાર કરે. એવો વ્યવહાર મનુષ્યમાં નથી હોતો કે પશુપક્ષીઓમાં પાળ નથી, તો પછી ગાયત્રી નેલેવી દિવ્ય સત્તા આવો પક્ષપાત કરે એવી કલ્પના જ ન કરવી જોઈએ. પૂર્વકાળમાં અનેક બ્રહ્મવાદિની અને પરમ યોગિની મહિલાઓ થઈ ગઈ છે, તેઓ સધણી વેદોક્ત કાર્યોમાં સદ્ગ્રાવ પુરુષોનું ડાબું અંગ બનીને સમાન રૂપમાં ભાગ લેતી હતી. માતાનાં સર્વ સંતાનો કોઈ પાળ જતના લેદભાવ સિવાય સમાનતાથી તેની ઉપાસના કરી શકે છે અને તેનો સ્નેહ અને આશીર્વાદ મેળવી શકે છે.

આધુનિક પરિસ્થિતિઓમાં જે સાધનાઓ સાધી શકાય તે જ કરવી ઉચિત છે. આજને હવે સત્તયુગ વગેરે યુગો નેલેવી સ્થિતિ રહી નથી. તેથી એવી યોગસાધનાઓ પાળ નથી થઈ શકતી અને પરિણામે તેવું ફળ પાળ મળતું નથી અને તેવી સિદ્ધિઓ પાળ મળતી નથી. યોગના ગ્રંથોમાં અણિમા, લઘિમા, મહિમા વગેરે સિદ્ધિઓનું વાર્ણન છે તે પૂર્વ યુગોની છે.

મહાભારતમાં દિવ્ય અસ્ત્રશ્લોનું વાર્ણન મળે છે. શબ્દવેધી બાળ, અગ્ન્યાસ્ત, વરુગ અસ્ત, વાયુ અસ્ત, સમ્મોહન અસ્ત, સુર્દર્શન ચક વગેરેનો ઉપયોગ એ યુદ્ધમાં થયો હતો. એ જમાનામાં મનુષ્યો તથા પશુપક્ષીઓમાં વિચારોની આપ-લે થતી હતી. જે કે પશુપક્ષી તથા મનુષ્યની વાળી અને ઉચ્ચારમાં અંતર હતું, પાળ બનેનાં શરીરમાં અભિતત્ત્વ અને જળતત્ત્વની સૂક્ષ્મતા પૂરતા પ્રમાણમાં હોવાથી એકબીજાના વિચારોની સારી રીતે આપ-લે થતી હતી. તેતા અને દ્વાપર યુગોની અનેક એવી કથાઓ મળે છે, જેમાં મનુષ્યો અને પશુપક્ષીઓ અરસપરસ વાતચીત કરતાં હતાં.

આ યુગમાં પ્રકૃતિનું પેટાળ પહેલાંની માફક સૂક્ષ્મ નથી રહ્યું. સૂછિનું બાળપાળ અને યુવાની સમાન થયાં છે અને વૃદ્ધાવસ્થા આવી ગઈ છે. આજે જળતત્ત્વ અને પૃથ્વીતત્ત્વની સંધિ ચાલી રહી છે. જળતત્ત્વ ઘટતું જય છે અને પૃથ્વીતત્ત્વ વધતું જય છે. જળતત્ત્વનો ગુણ મન છે. એથી કરીને આધ્યાત્મિક મહાપુરુષોનું મનોબળ બહુ જ વિકસિત

હોય છે. એમનામાં વિચારશક્તિ, ઈચ્છાશક્તિ અને પ્રેરણશક્તિ આને પણ ધારા સારા પ્રમાણમાં છે. એમના એ મનોબળથી તેઓ બીજોઓનું ધારું હિત કરી શકે છે. આ યુગમાં બુદ્ધ, ઈસુ, મહંમદ, ગાંધી, કાર્લમાર્કર્સ વગેરે મહાપુરુષોએ પોતાની પ્રચંડ પ્રેરણશક્તિથી સંસારને ખૂબ પ્રભાવિત કર્યો છે.

મેસ્ટેરિઝમ મનોબળનો જ એક ખેલ છે. બીજાને આપણા વિચારો આપવા, સામાના વિચારો જાગવા અથવા તે વિચારોનું પરિવર્તન કરવું એ મનોબળની જ એક સિદ્ધિ છે. એ સિવાય બીજી અનેક નાની મોટી સિદ્ધિઓ આને મળી શકે છે. જેનું વાર્ણન આ પુસ્તકમાં જે તે વિભાગમાં કરવામાં આવ્યું છે. કોઈ સિદ્ધપુરુષ એવો પણ મળે છે, જેને પૂર્વ યુગોની જેમ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થયેલી હોય છે, પણ એમની સંખ્યા બહુ જ ઓછી છે. જળતત્ત્વ ધર્મી રહ્યું છે, તેથી આધ્યાત્મિક પુરુષો પ્રયત્ન કરીને મનોબળ જ મેળવી શકે છે. ધીમે ધીમે એ પણ ઓછું થતું જશે અને ન્યારે પૃથ્વીતત્ત્વની જડતા વાપક થઈ જશે ત્યારે શરીરબળ જ લોકોની વિશેષતા બની રહેશે. આગળ જતાં શારીરિક દિનથી જે શક્તિમાન હોશે તે જ સિદ્ધપુરુષ મનાશે.

કુટલાક લોકો યોગસાધના દ્વારા ચમત્કાર પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે કે જેથી લોકોને આશ્રયમાં નાખીને તેમની ઉપર પોતાની મહત્તમાની છાપ પાડી શકે. આવા લોકો ધૂર્તોના પંજમાં ફસાઈને સમય અને ધનની બંરબાદી જ કરે છે. મેં પોતે ચમત્કારી સિદ્ધોની શોધમાં મારા જીવનનો થોડોક સમય ચુમાવ્યો છે. એ સમય દરમ્યાન અજ્ઞાત રહેનારા એક-બે મહાપુરુષો સિવાય બીજા ચમત્કારી સિદ્ધોમાં ધૂર્તતા સિવાય બીજું કશું જ જેવા મળ્યું નથી.

અમારા વાચકોને અમારી સંલાઘ છે કે તેઓ ચમત્કારી બનવાની બાળકીડામાં ન પડે, કેમકે એક તો વર્તમાન યુગ પણ આવી સિદ્ધિઓ માટે અનુકૂળ નથી અને છતાં ભારે પરિશ્રમથી કોઈ કાંઈક મેળવે તો તે બહુમૂલ્ય પરિશ્રમની તુલનામાં બિલકુલ તુચ્છ જ જાણાશે. બાજુગર કેવા કેવા ખેલ બતાવે છે અને સરકસવાળા પણ લોકોને આશ્રયમાં નાખી દે છે, પણ આખરે તો ક્ષાળિક મનોરંજન અને કૌતુક ઉત્પત્ત કર્યા સિવાય એ બીજું શું કરે છે? આ તો બધી બાળકો જેવી વાત છે. સાચો બુદ્ધિમાન એવું કરતો નથી.

ગાયત્રીની પંચમુખી યોગસાધનાનું વાર્ણન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. આ સાધનાઓથી સાધકના અંતઃકરણમાં ચેતનાનો વિકાસ થાય છે. આ આત્મવિકાસથી સર્વતોમુખી સ્વસ્થતા પ્રાપ્ત થાય છે તથા મન અને શરીરના સર્વ વિકાર દૂર થાય છે. ઈચ્છા, રુચિ, ભાવના, આકાંક્ષા, વિવેક, ગુણ, સ્વભાવ, વિચારધારા, કાર્યપ્રાપ્તાલી વગેરેમાં એવું અદ્ભુત સત્ત્વયુગુણી પરિવર્તન થાય છે કે જેથી જીવનની સર્વ દિશામાં આનંદનો મહાસાગર જ જિદ્ધણતો જાણાય છે. તેને આરોગ્ય ધન, વિદ્યા, ચતુરાઈ તથા સહ્યોગની ઊંઘાપ રહેતી નથી. આ વસ્તુઓની પ્રાપ્તિથી તે પ્રતિષ્ઠા, ક્રીતિ, પ્રેમ અને શાંતિથી જીવન જીવે છે. એ સિવાય આત્મરિક જીવનની આત્મજ્ઞાન, આત્મદર્શન, આત્મલાભ અને આત્મકલ્યાણની અમૂલ્ય સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ લાભોની તુલનામાં ચમત્કાર, કુતૂહલ, આશ્રયજનક કૃત્ય વગેરેની કશી જ ક્રિમત નથી. ગાયત્રીનો ઉપાસક પંચમુખી માતાની ઉપાસના શ્રદ્ધાપૂર્વક કરશે તો તેને કલ્પના ન હોય એવો લાભ થશે. ભલે કોઈ એને ચમત્કારી બાબા ન કહે, પણ ગૃહસ્થ રહીને પણ પોતે પોતાનામાં એવું પરિવર્તન કરી શકશે કે જે અનેક ચમત્કારોની તુલનામાં એને માટે અતિશય મંગલમય હોય.

‘સદ્બુદ્ધિ’એ માનવજીવનની મોટામાં મોટી સંપત્તિ છે. જેની પાસે ‘સદ્બુદ્ધિ’ રૂપી સંપત્તિ છે તેને કોઈ વાતની ઊંઘાપ રહેશે નહીં. વસ્તુઓનો અભાવ તથા પરિસ્થિતિઓની મુશ્કેલી તેનું કાંઈ બગાડી શકતી નથી. ગાયત્રી એ સદ્બુદ્ધિનો મહામંત્ર છે. આ મંત્રથી સાધકને એવી દિવ્ય શક્તિ પ્રાપ્ત થાય છે કે જે સંસારના સમસ્ત સૌભાગ્યની જનની છે.

## ૧૦. પંચમુખી સાધનાનો ઉદ્દેશ

સ્થળ દિલ્લી જેતાં એમ લાગશે કે શરીરની અંદર એક જ છુય છે, પણ લાંબા વિચારને અંતે સૂક્ષ્મ દિલ્લી જેતાં શરીરના એક જ આવરણમાં પાંચ જુદી જુદી ચૈતન્ય શક્તિઓ કામ કરતી જણાશે. એવું જોવામાં આવે છે કે પ્રત્યેક મનુષ્યમાં અનેક પરસ્પર વિરોધી તત્ત્વો વિદ્યમાન છે. જ્યારે જે તત્ત્વ પ્રભળ હોય છે ત્યારે તેના આધારે પોતાની દિલ્લી અનુસાર પૂર્ણ તત્પરતાથી મનુષ્ય પોતાનું કામ કરતો હોય છે.

એવું પણ જોવામાં આવે છે કે એક મનુષ્ય બહુ લોલી છે, ખાવા-પીવામાં અને પહેરવા-ઓફ્વામાં એ ભારે કંજૂસાઈ કરતો હોય, એક પૈસો પણ ધૂટો ન હોય, છીતાં એ જ મનુષ્ય પોતાના પુત્ર કે પુત્રીના લગ્ન અવસર પર એટલો ઉડાઉપણાથી ખર્ચ કરતો હોય છે કે તે વખતે ધનની જાગે કશી કિમત જ નથી એવું હેખાય. એક જ માણસના જીવનમાં સમય સમય પર આવું પરસ્પર વિરોધી વર્તન જોવામાં આવે છે.

એક સમય પર એક વ્યક્તિ ઘણી દયાળું હોય, દરેકની સાથે ભારે ઉદારતા અને સજાજનતાથી વર્તતી હોય, તે જ વ્યક્તિ બીજા સમયે બીજાઓ પ્રત્યે અનુદાર અને દુર્જન બની જતી જોવામાં આવે છે. એક વ્યક્તિ બહુ સંયમી અને સદાચારી હોય છે, પણ કોઈ કોઈ વખત એ ભારે દુરાચારી બની જાય છે. એ જ પ્રમાણે આસ્તિકતા ને નાસ્તિકતા, સુધારકપણું ને રઢિયુસ્તપણું, દયાળુતા ને નિષ્ઠુરતા, સદાચાર ને દુરાચાર, સત્ય ને અસત્ય, લોભ ને ત્યાગ, મૂર્ખતા ને બુલ્લિમત્તા, નિષ્પટતા ને ચંચળતા વગેરે પરસ્પર વિરોધી ગુણો સમય સમય પર માણસમાં પ્રકટ થાય છે.

આ વિસંગતિઓ જોઈને આપણે સામાન્યપણે એવું અનુમાન કરીએ કે અમુક વ્યક્તિ ખરી રીતે એક પ્રકારના સ્વભાવવાળી હોય છે, તેનું બીજું રૂપ તો માત્ર લોકોને છેતરવાનો ઢોંગ છે. સામાન્ય રીતે મનુષ્યનું વાસ્તવિક સ્વરૂપ બૂરાઈના આધારે માનવામાં આવે છે અને એની સારી બાજુને માત્ર ઢોંગ કહેવામાં આવે છે. કોઈ માણસ દાનેશ્વરી પણ હોય અને સાથે ચોર પણ હોય, તો સામાન્ય જનતા તેને ચોર જ માનશે અને એમ પણ કહેશે કે લોકોને ભ્રમમાં નાખવા જ એ દાનનો ઢોંગ કરે છે, પણ હકીકત એવી નથી. કોઈ વ્યક્તિ માત્ર આંબરને માટે જ પોતાનો સમય, શ્રમ, ધન વગેરે અધિક પ્રમાણમાં ખર્ચી શકે નહીં. જ્યારે કોઈ દિશામાં તેને વિશેષ શ્રદ્ધા અને ભક્તિ હોય છે ત્યારે તેના માટે એ વધારે ત્યાગ અને શ્રમ કરે એ શક્ય છે.

વાત એમ છે કે એક જ શરીરમાં જુદી જુદી અનેક શક્તિઓનો નિવાસ હોય છે. એક જ માળામાં કેટલાંય બચ્ચાં ભેગાં રહે છે, પરંતુ એ માળો બહારથી તો એક જ હેખાય છે. તે જ પ્રમાણે આ દેહની અંદર અનેક પ્રકૃતિઓ, સ્વભાવ અને રુચિઓનું અલગ વ્યક્તિત્વ રહેલું હોય છે. એક જ ધરમાં રહેનાર બધી વ્યક્તિઓની પ્રકૃતિ, રુચિ અને કાર્યપ્રાણાલી અલગ અલગ હોય છે, તેમજ આ મનુષ્યદેહની આંતરિક પ્રકૃતિઓ અનેક દિશાઓમાં ચાલતી હોય છે.

માણું એક છે, પણ તેમાં નાક, કાન આંખ, મુખ અને ત્વચાની પાંચે ઇન્દ્રિયો પોતપોતાનું અલગ કામ કરતી હોય છે. હાથ એક છે, પણ પાંચે આંગળીઓ તેની સાથે જોડાયેલી છે અને તે દરેકનું કામ જુદું જુદું હોય છે. વીણા એક છે, પણ તેના તાર અનેક છે અને એ બધાના ઝાંકારથી જ કોઈ કામ પાર પડે છે. માથામાં પાંચ જ્ઞાનેન્દ્રિયો જોડાયેલી ન હોય તો મસ્તકનું કથું જ મૂલ્ય ન હોત, વિસંગતિઓનું એકીકરણ એ જ જીવન છે. એ બિત્તતાઓને લીધે જીવનમાં ચૈતન્ય, કિયાશીલતા, વિચારમંથન અને પ્રગતિનો સંચાર થાય છે.

સૂક્ષ્મદર્શી ઋષિઓએ પોતાના યોગબળથી જ્યેણું કે મનુષ્ય શરીરમાં પાંચ પ્રકારનું વ્યક્તિત્વ, પાંચ ચૈતન્ય,

ચેતના એ જ પાંચ કોશો છે. આ પાંચે પૃથક હોવા છતાં એક જ મૂળ કેન્દ્ર સાથે એ જોડાયેલા છે ગાયત્રીનાં પાંચ મુખનો અલંકાર આના આધાર પર છે. માનવપ્રાણીની પાંચ પ્રકૃતિઓ છે એ જ ગાયત્રીનાં પાંચ મુખ છે. આ પાંચ કોશો એક જ આત્મા સાથે સંબંધ ધરાવે છે.

મહાભારતના આધ્યાત્મિક ગૂઢ રહસ્ય પ્રમાણે પાંચ પાંડવ શરીરમાં રહેલા પાંચ કોશો જ છે. પાંચેની એક જ સ્ત્રી દ્રોપદી છે. પાંચ કોશોની કેન્દ્રિય શક્તિ એક આત્મા છે. પાંચ પાંડવોની અલગ અલગ પ્રકૃતિ છે. પાંચ કોશોની પ્રવૃત્તિ પાણ અલગ અલગ છે. એ પૃથક્તાને એકરૂપતામાં-સંતુલિત સમસ્વરતામાં ઢાળી દેવામાં આવે તો એમની શક્તિ અનેય બની જાય છે. પાંચે પાંડવોની એક પત્ની, એક નિષ્ઠા, એક શ્રદ્ધા, એક આકંશા બની જાય તો તેમનો રથ હંકવા ખુદ ભગવાનને આવવું પડે છે અને અંતમાં વિજય તેમને જ મળે છે.

પાંચ કોશોને મનુષ્યની પંચધા પ્રકૃતિ પાણ કહે છે: (૧) શરીરાભ્યાસ, (૨) ગુણ, (૩) વિચાર, (૪) અનુભવ, (૫) સત્ત. આ પાંચ ચેતનાઓને અત્રમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય કોશ કહેવામાં આવે છે. આ જ ગાયત્રીનાં પાંચ મુખ છે.

સામાન્ય રીતે આ પાંચમાં એકસૂત્રતા નથી હોતી. કોઈ આમ ચાલે છે, તો કોઈ તેમ જાય છે. સ્વાસ્થ્ય, યોગ્યતા, બુદ્ધિ, રુચિ અને લક્ષ્ય એ બધામાં એકતા ન હોવાના લીધે મનુષ્ય એક જ દિશામાં ચાલી શકતો નથી. કોઈ રથને ધોડાઓ જુદી જુદી દિશામાં બેંચતા હોય તો રથની શી દશા થાય? ઝારેક એક ફ્લાંગ પૂર્વમાં જશે તો ઝારેક એક માઈલ પશ્ચિમ તરફ ઘસડાશે. કોઈ ધોડો તેને ઉત્તર તરફ લઈ જશે તો બીજે તેને દક્ષિણ તરફ બેંચશે આ રીતે રથ કોઈ નિશ્ચિત જગ્યા પર નહીં પહોંચે અને ધોડાઓની શક્તિ પાણ એકબીજાના પ્રયત્નને રોકવામાં ખર્ચાઈ જશે અને આ બેંચતાણમાં રથ આમતેમ અથડાતો કુટાતો રહેશે અને અંતે તૂટી જશે.

પાણ જે બધા જ ધોડા એક ચોક્કસ દિશામાં ચાલે અને સર્વની શક્તિ એક જ દિશામાં પ્રયોજય તો રથ બહુ જ જવદીથી પોતાના સ્થાને પહોંચી જાય. વીણાના તાર વેરવિભેર હોય તો તેને વગાડવાથી કોઈ પરિણામ આવશે નહીં, પાણ જે તેમને એક સ્વર્કેન્દ્ર ઉપર મેળવવામાં આવે અને રાગબદ્ધ વગાડવામાં આવે તો હદ્યને આનંદ આપે તેવું મધુર સંગીત તેમાંથી નીકળશે. જીવનમાં પરસ્પર વિરોધી ઈરણાઓ, આકંશાઓ, રુચિઓ, પ્રકૃતિઓ, પ્રવૃત્તિઓ, ભાવવનાઓ અને માન્યતાઓ એ રીતે ક્રિયાશીલ રહે છે કે જેથી એમ લાગે છે કે એક જ દેહમાં જાગે પાંચ માણસો બેઠા છે અને તેમાંનો દરેક પોતાની મરજી પ્રમાણે ચાલી રહ્યો છે અને ગમે તેવો રાગ કાઢી રહ્યો છે.

અધ્યાત્મવિદ્યાના જાગુકારોએ આ પૃથક્તાઓને અને વિવિધતાને એક સ્થાન પર કેન્દ્રિત કરવા અને તેમને એકબીજા સાથે એક સૂત્રમાં જોડવા માટે પાંચ કોશોની પાંચમુખી ગાયત્રી સાધનાનું વિધાન બનાવ્યું છે. ગાયત્રીના શિન્તમાં પાંચ મુખ બતાવવામાં આવ્યાં છે, પાંચેની દિશાઓ, આકૃતિઓ અને ચેષ્ટાઓ અલગ અલગ દેખાય છે, પાણ તેમનો મૂળ કેન્દ્ર સાથે સંબંધ હોવાથી એકસ્વરતા ધારાણ કરે છે. ગાયત્રી સાધકનો આ જ આદર્શ હોવો જોઈએ. તેની દિનયાર્થી, તેનો શ્રમ, વિચારધારા, તેની અભિનુચ્છિ અને તેની આકંશાઓ એક જ લક્ષ્ય પર પહોંચવામાં સંલગ્ન રહેવી જોઈએ. પાંડવો પાંચ હોવા છતાં એક જ હતા, એક જ પાંડવ શબ્દ કહેવા માત્રથી યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહેદેવ અને નકુળનો બોધ થાય છે. આવી જ એકતા આપણી અંદર રહેવી જોઈએ.

ડૉક્ટરો જાગે છે કે રક્તમાં વિજાતીય દ્રવ્યનો પ્રવેશ થયો હોય તો તેને અનેક રોગ થાય છે. કુટુંબમાં વિરોધી સ્વભાવની વહુ આવી જાય તો ધરમાં કલેશ અને કંકાસ શરૂ થાય છે, જ્યાં સુધી મનમાં પરસ્પર વિરોધી તત્ત્વો કામ કરતાં હોય, તેની દિશાઓ અલગ અલગ રહેતી હોય, ત્યાં સુધી એ વ્યક્તિને ચેન પડશે નહીં અને એના દિલમાં અશાંતિ અનુભવશે. સામાન્ય રીતે આવો માણસ બીજી રીતે સાધનસંપત્ત હોવા છતાં તેનો અમૂલ્ય જન્મ એણે ગયો એમ તેને લાગશે. અંતર્િક વિરોધોથી ઉત્પન્ન થતી, ગુંચવણો તેને માટે એક કોથડો બની જાય છે અને મરાગપર્વત ગાયત્રી મહાવિજ્ઞાન - ભાગ-૩

તેનો ઉકેલ આવતો નથી.

ગાયત્રીની પંચમુખી સાધનાનો ઉદ્દેશ જ એ છે કે આવા આંતરિક વિરોધો મિટાવી સમસ્વરતા અને એકરૂપતાની સ્થાપના કરવી. અંતરમાં સત્ત-અસત્તની રસાકસી થતી રહે છે, દેવાસુર સંશ્રામ, રામ-રાવણ યુદ્ધ, મહાભારત ચાલી રહ્યું હોય છે. આ કલાહ ત્યારે જ શાંત થાય છે જ્યારે એક પક્ષ અશક્ત બની જાય. અસુરનો, અસત્તનો પક્ષ લઈને સત્તને કચડવાનો પ્રયત્ન કરવામાં આવશે તો એ બની શકવાનું નથી, કેમકે અસુરતા-અસત્ત એ પોતે જ એક વિપત્તિ છે અને એ પોતે જ અનેક સંકટો ઉત્પન્ન કરે છે. જ્યારે સતતું સ્થાન આત્મામાં એટબું સુદૃઢ થયેલું હોય છે, કે તેને સંપૂર્ણપણે કચ્છી નાંખવું શક્ય જ નથી. એટલા જ માટે આંતરિક કુલહોની શાંતિનો એક જ ઉપાય છે અને તે એકે સતતું સમર્થન, સંવર્ધન અને પોપણ કરી આત્મામાં તેનું સ્થાન એટબું મજબૂત બનાવવું કે અસત્ત તેની સાથે સંઘર્ષમાં ઉત્તરવાનું સાહસ જ ન કરે. લાદીયોર બકરો જ્યારે પોતાને સામે સિંહને ઊભેલો જેણે ત્યારે તે લડવાની હિંમત જ નહિ કરે. જ્યાં સુધી ટેવી તત્ત્વો કુમળેર હોય તાં સુધી જ આસુરી તત્ત્વો જેર કરે છે. જ્યારે સાધના દ્વારા સત્તવશુણનું પ્રમાણ પૂરી રીતે વધારી વેવામાં આવે તો અસુરતા પોતાનું હથિયાર ભ્યાન કરી લેશે અને શાંતિનું સામ્રાજ્ય સ્થપાઈ જશે.

પાછલાં પ્રકરણોમાં પાંચ કોષોની જે સાધના બતાવી છે તે મનુષ્ણની પાંચ મહાશક્તિઓને વિનાશકારી માર્ગે જતાં રોકી, તેમને નિર્યાતશુણમાં લાવીને ઉપયોગી કાર્યોમાં જોડે છે. સરકસવાળા વાધ અને ચિત્તાઓને વંગલમાંથી પછી લાવે છે અને તેમને એવા પ્રકારની કેળવણી આપે છે કે એ કોઈ પ્રકારનું નુકસાન તો કરતા જ નથી. ઊભાંદું એમના માલિકને માટે ખૂબ ધન તથા પ્રતિક્રિયા મેળવવાનું એક સાધન બની જાય છે. પાંચ કોષો એ પાંચ વાધ છે. તેમને સાધવા માટે સરકસવાળાની માફક ગાયત્રી સાધકે અદભ્ય સાહસ, અવિચલ ધૈર્ય રાખી સતત પ્રયત્ન કરવો પંડે છે. આ સાધનાના આરંભમાં ધાર્ણી મુશ્કેલીઓ અને નિરાશાઓ ઉત્પન્ન થશે, પણ ધીર ધીર સફળતા મળતી જશે અને ગાયત્રી સાધક જ્યારે એ પાંચે કોશોને, પાંચ સિંહોને પોતાને તાબે કરી લે છે, ત્યારે તેને અનંત ઐશ્વર્ય અને અક્ષય કીર્તિનો લાભ મળે છે. સરકસના સિંહો કરતાં આ આત્મિક સિંહોની મહત્તા અનેકગાર્ણી વધારે છે. એટલા માટે તેમને સાધી લીધા પછી સરકસવાળા કરતાં પણ અનેકગાર્ણો લાભ મળે છે. કાયર આ સાધનાની કલ્યાણ માત્રથી ડરી જાય છે, જ્યારે શૂરવીરો આપત્તિથી ભરેલા પરમ પુરુષાર્થમાં જ આનંદ માને છે.

કોષો અસંતુલિત, અવિકસિત અને અનિયંત્રિત રહેવાથી માનવના અંત:કરણની સ્થિતિ ધાર્ણી ખરાબ રહે છે. તેમાં પરસ્પર વિરોધી વિચારો, ભાવનાઓ અને રુચિઓ પેદા થતી રહે છે અને દબાતી રહે છે. આ સર્વમાં એકતા ઉત્પન્ન કરવાનું કામ ગાયત્રી સાધના કરે છે. ગાયત્રી સાધના અંતરના સમસ્ત સંકલ્પ-વિકલ્પોને દૂર કરે છે અને એક સુન્યવસ્થિત ગતિશીલતા પેદા થાય છે. આવી વ્યવસ્થિત પ્રગતિ જે દિશામાં ચાલશે એ દિશામાં આશાજનક સફળતા મળ્યા વગર નહીં રહે.

યોગસાધનાનો સૌથી મોટો લાભ માનસિક સ્થિતિના શુદ્ધિકરણનો છે. શુદ્ધ થયેલ મનોભૂમિ એક પ્રકારનું કલ્યાણ છે, જેમાંથી માનવજીવનને ઉપયોગી, જરૂરી, લાભદાયક અને આનંદવર્ધક એવી સર્વ વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે છે. પાંચ વ્યક્તિઓનું એકીકરણ સત્તવશુણોના આધાર પર થયું હોય છે. સાત્ત્વિક આત્મબળની પ્રયંક વૃદ્ધિ સાથે પંચમુખી ગાયત્રી સાધનાનો સાધક મહામાનવ, મહાપુરુષ અને મહાન આત્મા બની જાય છે.

કીટ-પતંગિયાની માફક તો બધાય જીવે છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુનની તુચ્છ કિયાઓમાં સંલગ્ન રહી દિવસો પૂરા કરવા એ કાંઈ મોટી વાત નથી. એ રીતે તો પશુપક્ષી અને અનેક જીવો પણ જીવે છે. આ દિનેએ તો મનુષ્ય કરતાં અન્ય જીવોનું જીવન ધાર્ણું જ સારું છે. તેમને ઈર્ધા, દેખ, મત્સર, છલ, કપટ, દંબ, કામ, કોધ, અસંતોષ, શોક, વિયોગ, ચિંતા વગેરે આંતરિક અભિમાં હરધડીએ શેકાવું પડતું નથી. તેઓ અનેક પ્રકારનાં પાપોની

ગાંસડી તો બાંધતાં નથી. બીજાં સર્વ જીવન્તુઓ કરતાં મનુષ્ય વધારે ખોટમાં રહે છે. મરતાં મરતાં બીજાં જીવન્તુઓ પોતાના મૃત શરીરથી બીજા જીવોનું ભલું કરી જાય છે, પરંતુ મનુષ્ય તો તે પણ કરી શકતો નથી.

માનવજીવનની જે મહત્ત્વા અને પ્રશંસા છે તે એની આત્મિક વિશેષતામાં છે. આ વિશેષતાઓ સાચા સ્વરૂપમાં વિકાસ પામે તો જ મનુષ્ય તેના સાચા અર્થમાં માનવજીવનનો લાભ મેળવી શકે. યોગસાધનાનો મુખ્ય ઉદેશ વ્યક્તિનો પૂર્ણ વિકાસ કરવો એ જ છે. તેની અંદર જે અદ્ભુત શક્તિઓ છુપાયેલી છે તેમને યોગ દ્વારા ઉત્ત્રત સ્થિતિએ પહોંચાડવામાં આવે છે, જેથી મનુષ્યમાં દેવત્વનાં દર્શન થઈ શકે.

ભારતીય જીવનમાં આદિકાળથી જ ચોક્કસ ઉદ્દેશમય, આદર્શ યુક્ત અને શુદ્ધ જીવનને જ પ્રધાનતા આપવામાં આવી છે. એ જ તેની વિશિષ્ટતા છે. આ દેશમાં એ જ વ્યક્તિને મનુષ્ય ગાણ્યવામાં આવે છે, જે ઉદ્દેશ્યુક્ત આદર્શ જીવન જીવતી હોય. અજ્ઞાન, અશક્તિ અને અભાવની સાથે સતત યુદ્ધ ભેલવાનું પ્રત લેનાર જ દિજ કહેવાય છે. જે દિજ નથી એટલે કે જે પારમાર્થિક જીવનનું પ્રત નથી લેતો અને જે લોભી, સ્વાર્થી અને વિષયી તે મનુષ્યની શૂદ્ધ તરીકે નિંદા થાય છે અથવા બીજા અર્થમાં તેનો અર્ધ સામાજિક બહિક્ષાર કરવામાં આવે છે. આજે તો વ્યાપક રૂપમાં શૂદ્ધતા જ ફેલાઈ છે. ગુણ, કર્મ અને સ્વભાવથી આજે ચંડાળગાણુનો અને કૃત્ત્વાનો જ વિસ્તાર વધી ગયો છે.

ભારતીય સંસ્કૃતિની આ અદ્ભુત મહત્ત્વા છે કે એ પોતાના પ્રત્યેક અનુયાયીને એ જ પ્રેરણ આપે છે કે પશુપક્ષીઓ અને કીટ-પતંગોની માફક માત્ર પેટ ભરવા પૂરું તુચ્છ જીવન ન જીવે, પણ પોતાની પ્રત્યેક ક્ષાળ મહાન આદર્શોની પૂર્તિની પાછળ ખર્ચે. આપણી પોતાની વ્યક્તિગત જરૂરિયાતોને, શરીરનિવાહની આવશ્યકતાઓને ઓછામાં ઓછી કરી નાંખી તેમને પૂરી કરવામાં એ ઓછામાં ઓછો સમય અને શક્તિ ખર્ચે અને બ્રાકી રહેલાં અવકાશ, બુદ્ધિબળ અને ઉસ્સાહને મહાનતા પ્રાપ્ત કરવામાં પૂરા મનથી લગાવે.

આ સાંસ્કૃતિક પ્રેરણાને ઝીતંભરા પ્રક્ષા અથવા સદ્ભુદ્વિના નામથી ઓળખવામાં આવે છે. આને જ ગાયત્રી કહી છે. ગાયત્રી મંત્રમાં આપણને સદ્ભુદ્વિ આપવાની પરમાત્માને પ્રાર્થના કરવામાં આવી છે. આ સદ્ભુદ્વિ પ્રાચીનકાળમાં મોટા ભાગના ભારતવાસીઓને પ્રાપ્ત હતી, એટલા જ માટે એ ભૂમિને પુણ્યભૂમિ, તપોભૂમિ, સ્વર્ગાર્દપિ ગરીયસી એવાં નામોથી ઓળખવામાં આવતી હતી.

આથી જ આ દેશમાં દેવતાઓ પણ જ ન લેવા દઈછુતા હતા અને જીવનમુક્ત આત્માઓ લલચાઈ લલચાઈને અવતાર લેવા માટે મુક્તિધામથી પાછા આવતા હતા. ઝીતંભરા બુદ્ધિએ જ આ દેશમાં મહાન માનવોની પરંપરા સર્જી હતી. વિદ્યામાં, બુદ્ધિબળમાં, પરાક્રમમાં, વિજ્ઞાનમાં, ધનમાં, સ્વાસ્થ્યમાં અને ઐશ્વર્ય તથા સૌંદર્યમાં આ દેશ ભરપૂર હતો, કારણ કે સદ્ભુદ્વિએ ભારતવાસીઓની આંતરિક ભૂમિકાનું એવું શુદ્ધિકરણ કરી નાખ્યું હતું કે જેમાં ભૌતિક અને આધ્યાત્મિક શક્તિઓનો ભંડાર અક્ષય અને અખૂટ બની જાય છે.

જે મુશ્કેલીઓ આપણાં સુખશાંતિ અને ઉત્તુતિની આડે આવતી હોય તેમને આપણી સદ્ભુદ્વિ નષ્ટ કરી નાખે છે અને આપણને સુસંપત્ર બનાવવા માટે જે સગવડોની જરૂર હોય તેમને આપણી સદ્ભુદ્વિ વધારે છે. આ સદ્ભુદ્વિનો એક અંત્યંત મહત્વપૂર્ણ અને વૈજ્ઞાનિક આધાર તે ગાયત્રી છે. આ મહામંત્રના એક એક અક્ષરમાં જે ગૂઢ જ્ઞાન બર્થ્યું છે તે એટલું ઉજ્જવળ છે કે તેના પ્રકાશમાં અજ્ઞાનનો બધો અંધકાર દૂર થઈ જાય છે. આ ૨૪ અક્ષરોમાં એવો અદ્ભુત જ્ઞાનભંડાર ભયો છે કે જેમાં તત્વજ્ઞાન, કર્મ, નીતિ, વિજ્ઞાન, શિક્ષાણ, શિલ્પ વગેરે પૂરતા પ્રમાણમાં મોન્ફૂદ છે. આ જ્ઞાનમાં દૂબકી મારવાથી તુચ્છ માનવી મહામાનવ બની શકે છે.

ગાયત્રીના અક્ષરોમાં જ્ઞાનનો ભંડાર તો ભયો છે જ, પણ એ ઉપરાંત આ મહામંત્રની રચના પણ એવી વિલક્ષણ રીતે કરવામાં આવી છે કે તેનું ઉચ્ચારણ અને સાધના કરતાં કરતાં શરીર અને મનનાં સૂક્ષ્મ કેન્દ્રોમાં છુપાઈ

રહેલી અત્યંત મહત્વપૂર્ણ શક્તિઓ જગૃત થાય છે, નેના લીધે દેવી વરદાનની માફક સદ્ભુદ્ધિ પ્રાપ્ત થાય છે.

સદ્ભુદ્ધિ દ્વારા અનેક લાભો ઉઠાવવા ધારા સહેલા છે, પણ સદ્ભુદ્ધિ વગરનાઓ માટે પોતાના કુસંસ્કારો હટાવીને સુસંસ્કારિત, સદ્ભુદ્ધિના સ્વામી થંડું એ ધારું મુશ્કેલ કામ છે. એ મુશ્કેલીને દૂર કરવાનું કામ ગાયત્રી મહામંત્રની ઉપાસના દ્વારા થઈ શકે છે. ને આ સાધના કરે છે તેને અનુભવ હોય કે કોઈ અજ્ઞાત શક્તિ પોતાની અંદર નવીન પ્રકાશ, નવીન ઉત્સાહ કોઈ અનુભ રીતે વધારી રહી છે.

આ નાનો સરખો મંત્ર ‘અમરઝળ’ ના નામથી પ્રસિદ્ધ છે. અમૃત ફળ ખાવામાં પાણ મધુર હોય છે અને તેનાથી અમરતાનો અમૂલ્ય લાભ પણ મળે છે. ગાયત્રીના અજ્ઞાતોમાં સંસારનું સમર્પણ જ્ઞાનવિજ્ઞાન બીજુદુપમાં વિઘમાન છે. એ સિવાય દિવ્ય માર્ગથી સદ્ભુદ્ધિને અંતઃકરણમાં સ્થાપિત કરવાની શક્તિ પાણ એમાં છે. સોનું અને સુંગધની લોકોક્તિ ગાયત્રીની બાબતમાં યથાર્થ રીતે લાગુ પડે છે. ગાયત્રીને કામધેનું કહી છે. કામધેનું અત્યંત સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દૂર્ધિ સારા પ્રમાણમાં હંમેશાં આપ્યા જ કરે છે. એ સિવાય તેના આશીર્વાદથી અનેક આપત્તિઓનું નિવારણ અને સંપત્તિઓની પ્રાપ્તિ થાય છે. આ બંને પ્રકારના લાભના લીધે સામાન્ય ગાય કરતાં કામધેનુંનું મહત્વ ધારું વધારે હોય છે. ગાયત્રીની બંને મહત્ત્વાઓ કામધેનું જેવી છે. તેથી તેને ભૂલોકની કામધેનું કહી છે.

ભારતવર્ષમાં શિલ્પ, ખેતી, વ્યાપાર, વિજ્ઞાન, રસસાધના, શસ્ત્રવિજ્ઞાન વગેરે ભૌતિક ઉત્ત્રતિઓના સંબંધમાં સદાય મહત્વપૂર્ણ પ્રયત્નો થતા હતા. આને પાણ તેમની આવશ્યકતા છે. પૂઞ્ચ, કુશળતા, શ્રમ અને સહકારના આધારે તેમની વૃદ્ધિ કરવી જોઈએ અને વૃદ્ધિ થઈ પાણ રહી છે, તેમકે સારી રીતે જીવન માટે ભૌતિક સાધનસામગ્રીની ખાસ જરૂર હોય છે. ભૂખ્યો માણસ ઈમાનદારી અને શાંત ચિન્ત બેમાંથી એકેય જાળવી શકતો નથી. એટલે જીવનયાત્રાની સંગવડો વધારવા માટે ભૌતિક સંપત્તિઓનું ઉપાર્ન આવશ્યક છે, પરંતુ એ વાત લક્ષમાં રાખવાની છે કે ભૌતિકતા ઉપર જ માત્ર ધ્યાન રાખવામાં આવે અને સંપત્તિ ઉપરથી આધ્યાત્મિક અંકુશ દૂર કરવામાં આવે તો જે કાંઈ સાંસારિક ઉત્ત્રતિ થશે એ કેવળ મનુષ્યની આપત્તિઓ વધારવાનું જ સાધન બનશે.

આજના જમાનામાં વિજ્ઞાનનું ભારે જોર છે. દરરોજ નવાં નવાં સુખસગવડનાં સાધનો શોધાતાં જય છે. પરિણામે મનુષ્ય વિલાસી, આળસુ, દુર્બળ, કાયર અને અલ્પજીવી બની ગયો છે. ને મોટા દેશોએ પોતાની શક્તિ વધારી છે, તેઓ નાના દેશોને ગુલામ બનાવીને તેમનું શોષ્ણગ કરવાની તબક્કીન્માં પડ્યા છે. વિજ્ઞાનની શોધોનું પરિણામ એ આચ્યુત છુકે એટમબોંબ અથવા હાઇડ્રોજનબોંબ સંસારનો પ્રલય કરવા માટે તૈયાર છે. સામાન્ય જનસમાજ ઉપર નજર નાખતાં જાળાશે કે તેની પાણ એ જ હાલત છે. ભૌતિક શક્તિ મેળવીને લોકો પોતાનો અને બીજાનો વિનાશ જ નોંટે છે. વકીલોની વિદ્યાથી કોનું શું બલું થયું? વધારે કમાનાર મન્દૂર પોતાની કમાળી દાડ અને તાડીમાં ગુમાવી દે છે. સાહસિક સ્વભાવ અને મજબૂત શરીરવાળો માણસ ગુંડો અને અત્યાચારી બનવામાં પોતાનું ગૌરવ માને છે. ગામડામાં આજકાલ અગ્રની મોંદવારીને લીધે ખેડૂતોની આર્થિક દશા કાંઈક સુધરી છે, ત્યારે ફોન્ડારી જગડાઓ, વિવાહલશોમાં થતો ઉડાઉ ખર્ચ વગેરે ધારું વધી ગયાં છે. એ વાત ચોક્કસ છે જે ભૌતિક ઉત્ત્રતિ ઉપર આધ્યાત્મિક અંકુશ નહીં હોય તો ભસ્માસુરના વરદાનની માફક તે પોતે પોતાનો જ સર્વનાશ નોંટરશે એમાં શંકા નથી.

એટલા માટે એ વાત ખાસ જરૂરની છે કે ભૌતિક ઉપાર્ન ની સાથે આત્મિક ઉત્ત્રતિ પાણ સધાવી જોઈએ. સુંદર આરોગ્યવાળા શરીર ઉપર જ બહુમૂલ્ય વસ્ત્રાભૂષણો શોભા આપે છે. મરણપથારીએ પરેવા અને હાઉપિંજર જેવા રોગીને જરનવેરત અને રેશમી કપડાંથી લાદી દેવામાં આવે તો તેની શોભા તો નથી જ વધતી, ઉલ્લંઘની અગવડમાં વધારો જ થશે. આત્મિક ઉત્ત્રતિ સિવાયની ભૌતિક સંપત્તિ અહંકાર, ઈર્ષા, અનીતિ, વિલાસપ્રિયતા, કુરુચિ, ચિંતા વગેરે દુર્ગુણો જ પેદા કરશે.

ગાયત્રી એ આત્મોત્ત્રતિનું- આત્મબળ વધારવાનું એક સર્વત્રીક સાધન છે. સંસારની સંપત્તિઓ મેળવવી જેટલી જરૂરી છે તેટલો જ ગાયત્રી સાધના દ્વારા આત્મિક પૂંજી વધારવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. બંને દિશામાં સાથે સાથે એકસરખો સમતોલ વિકાસ થાય તો જ ઉત્ત્રતિ હિતકર બને છે, પાણ જે કદાચ કેવળ સંચયને મહત્વ આપીને તેને માટે જ બધો પુરુષાર્થ કરવામાં આવે તો ભલે એ સંચય મનને બેધડી આનંદ આપનારો નીવડે, પાણ એથી સાચી શાંતિ અને મુખ તો નહીં જ મળે. સાંસારિક વસ્તુઓનો જે ખરેખરો લાભ લેવા માગે તોણે આત્મોત્ત્રતિ માટે પાણ એટલો જ પુરુષાર્થ કરવાની જરૂર છે.

આંખો સિવાય સુંદર દશ્ય જેવાનો લાભ નથી મળી શકતો, કાન બહેરા હોય તો મધુર સંગીતનો આનંદ નથી મળી શકતો, તેવી રીતે આત્મિક શક્તિ નહીં હોય તો સાંસારિક વસ્તુઓનો સાચો લાભ નથી લઈ શકતો. સુંદર દશ્યની સાથે તીવ્ર નેત્રન્યોત્ત્તિના સંયોગથી જ ચિત્ત પ્રસત્ત થાય છે. ભૌતિક સંપત્તિ અને આત્મિક ઉત્ત્રતિના સંયોગથી જ જીવનમાં સાચી શાંતિ સ્થિર થાય છે. ધન કર્માઈએ, વિદ્યા મેળવીએ અને બીજી અનેક સુખસગવડો ભલે મેળવીએ, પરંતુ એ કદ્દી ભૂલવું ન જોઈએ કે એ બધાનો સાચો લાભ તો ત્યારે જ મળે કે જ્યારે આત્મોત્ત્રતિ માટે પાણ એટલા જ પ્રમાણમાં સાધના કરવામાં આવી રહી હોય.

(૧) સ્વાસ્થ્ય, (૨) ધન, (૩) વિદ્યા, (૪) ચાતુર્ય, (૫) સહયોગ- આ પાંચ સંપત્તિઓ સંસારમાં હોય છે. આ પાંચેની અંદર સંસારનો સમસ્ત વૈભવ આવી જાય છે. એ જ પ્રમાણે પાંચ કોશોની સંપૂર્ણ શુદ્ધિ એ જ પાંચ આધ્યાત્મિક સંપત્તિઓ છે. અત્રમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય- એ પાંચ કોશો આધ્યાત્મિક શક્તિના પાંચ ભંડારો છે. આ કોશો ઉપર જે પોતાનો અધિકાર સ્થાપે છે તેની આંતરિક શક્તિ જગૃત થઈ જાય છે અને તેને (૧) આત્મજ્ઞાન, (૨) આત્મદર્શન, (૩) આત્માનુભવ, (૪) આત્મલાભ (૫) આત્મકલ્યાણ- એવી પાંચ આધ્યાત્મિક સંપત્તિઓની પ્રાપ્તિ થાય છે.

ગાયત્રીના ચિત્તની અંદર દશ ભુજાઓ બતાવવામાં આવી છે. પાંચ જમાણી બાજુએ અને પાંચ ડાબી બાજુએ છે. ડાબી બાજુની પાંચ ભુજાઓ એ સાંસારિક સંપત્તિઓનું પ્રતીક છે અને જમાણી બાજુની ભુજાઓ એ પાંચ આત્મિક શક્તિઓનું પ્રતીક છે. ગાયત્રીનો ઉપાસક એ દશેય લાભો મેળવે છે.

(૧) આત્મજ્ઞાન : આત્મજ્ઞાનનો અર્થ છે- પોતાને જાગુ લેવો. શરીર અને આત્માની બિજ્ઞતાને સારી રીતે સમજી લેવી એ એનો અર્થ છે. આત્મલાભની તુલનામાં શારીરિક લાભોને જેટલું મહત્વ આપવું જોઈએ તેટલું જ આપવું, એથી વધારે નહીં. આત્મજ્ઞાન થવાથી મનુષ્યનો અસંયમ દૂર થાય છે. ઈન્દ્રિયભોગોની લાલયને કારણે લોકોની શારીરિક અને માનસિક શક્તિઓનો નકારો અપય્ય થાય છે અને તેને લીધે શરીર અકાળે જ દુર્બળ, રોગી, કુરૂપ અને જીર્ણ થઈ જાય છે. આત્મજ્ઞાની મનુષ્ય ઈન્દ્રિયભોગોની જરૂરિયાત-બિનજરૂરિયાતનો નિર્ણય આત્મલાભની દશ્યથી કરશે. એ સ્વભાવત : સંયમી રહેશે અને પરિણામે શરીર સાથે સંબંધ ધરાવતાં બધાં દુઃખોથી એ બચી જશે. દુર્બળતા, રોગ અને કુરૂપતાનું કષ્ટ તેને ભોગવવું નહીં પડે અને પ્રારબ્ધ કર્માનું જે કષ્ટ તેને ભોગવવાનું હોય છે તે પણ એ ધારુણી આસાનીથી ભોગવી શકે છે.

(૨) આત્મદર્શનનું તાત્પર્ય છે-પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો. સાધના દ્વારા આત્માના પ્રકાશનો જ્યારે સાક્ષાત્કાર થાય છે ત્યારે પ્રતીતિ, શ્રદ્ધા, નિષ્ઠા અને વિશ્વાસની ભાવના વધે છે. ભૌતિકવાદ અને આધ્યાત્મિકવાદ વચ્ચેની ડામાડોળ માનસિક દશ સ્થિર થાય છે અને એવાં ચુણ, કર્મ અને સ્વભાવ પ્રગટ થતાં રહે છે, જે એક આત્મદિલ્લિયાળી વ્યક્તિને માટે ઉચ્ચિત હોય. આત્મદર્શનની આ ભૂમિકા પર પહોંચા પણી બીજાને જાગુવા, સમજવા અને તેના પર પ્રભાવ પાડવાની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

જેને આત્મદર્શન થયું છે તેની આત્મિક સૂક્ષ્મતા ધારુણી વ્યાપક થઈ જાય છે. આ સંસારનાં સર્વ શરીરોમાં તે જાગ્યાની મહાવિજ્ઞાન - ભાગ-૩

પોતાને સમાયેલો જુબે છે. દરેકમાં તે પોતાનું જ આત્મતત્ત્વ નિહાળે છે. જેમ પોતાનો મનોભાવ, આચરણ, ગુણ, સ્વભાવ, વિચાર અને ઉદ્દેશ્ય પોતાને માલૂમ હોય છે, તેમ બીજાના અંતરની સર્વ વાત પાણ તેને માલૂમ પડે છે. સામાન્ય મનુષ્ય ને રીતે પોતાના મન અને શરીર પાસે કામ લેવામાં સમર્થ હોય છે, તેમ આત્મદર્શન પામેલો મનુષ્ય બીજાના મન અને શરીરો પર અધિકાર સ્થાપી, પ્રભાવ પાડી જેઠું કામ કઢાવી શકે છે.

(૩) આત્માનુભવનું તાત્પર્ય એ છે કે - પોતાના વાસ્તવિક સ્વરૂપનું ક્રિયાશીલ થવું, પોતાની ભાવના પોતાના અધ્યાત્મકાનના આધાર પર હોવી એનું જ નામ "આત્માનુભવ." સામાન્ય રીતે લોકો મનમાં વિચાર તો બહુ ઊચા કરે છે, પાણ બાધ્ય જીવનમાં અનેક કારણોને લીધી તેમને ચરિતાર્થ કરી શકતા નથી. તેમનું વ્યાવહારિક જીવન નીચી કોઈનું હોય છે, પાણ નેટેમને આત્માનુભવ થયો હોય છે તેઓ અંદર-બહાર એક હોય છે. તેમના વિચાર અને કાર્યોમાં કશો પાણ તફાવત હોતો નથી. સામાન્ય લોકોને ઉચ્ચ જીવન જીવવામાં ને કારણો પર્વત સમાન દુર્ગમ લાગે તેમને આત્માનુભવી એક ઢોકરથી તોડી નાખે છે અને તેનું જીવન અધિજીવન બની જાય છે.

આત્માનુભવથી સૂક્ષ્મ પ્રકૃતિની ગતિવિધિના જ્ઞાનની સિદ્ધિ મળે છે. કોનું શું ભવિષ્ય ઘાટાઈ રહ્યું છે? ભૂતકાળમાં કોણ શું કરી રહ્યો હતો? ક્યાં કાર્યોમાં દૈવી પ્રેરણા શું છે? હવે પછી શું ઉપદ્રવ થવાનો છે? લોકલોકાંતરોમાં શું થઈ રહ્યું છે? ક્યારે, ક્યાં કઈ વસ્તુ ઉત્પત્ત અથવા નાશ થવાની છે? વગેરે નેવી અદ્ધય, અગમ્ય અને અજ્ઞાત વાતો ને સામાન્ય મનુષ્ય જાગ્યાતો નથી તે, આત્માનુભવની ભૂમિકામાં પહોંચેલી વક્તિ સારી રીતે જાગ્યી શકે છે. શરૂઆતમાં તેને એવો અનુભવ બહુ જાંખો થશે, પાણ નેટેમ તેની દિવ્યદિષ્ટ નિર્ભળ થતી જરૂર તેમ તેમ એ સર્વ તેને ચિત્રવત્ત દેખાતું થશે.

(૪) આત્મલાભનું તાત્પર્ય છે - પોતાનામાં પૂર્ણ આત્મતત્ત્વની પ્રતિષ્ઠા. જેમ બહીમાં પરેલું લોખંડ તપીને અધ્યિવાર્ષ નેવું લાલ થઈ જાય છે, તેમ એ ભૂમિકામાં પહોંચેલો સિદ્ધપુરુષ દૈવી તેજપુંજથી પરિપૂર્ણ થઈ જાય છે. એ સતની પ્રત્યક્ષ મૂર્તિ બની જાય છે. જેમ અંગારાની બાજુમાં બેસવાથી ગરમીનો અનુભવ થાય છે, તેમ મહાપુરુષોની આસપાસ એવું સતોજાગ્યી વાતાવરણ છાવાઈ રહે છે, જેમાં પ્રવેશતાં સામાન્ય મનુષ્ય પાણ બિલકુલ શાંતિનો અનુભવ કરે છે. વડના વૃક્ષની સધન શીતળ છાયામાં શ્રીમના તાપમાં તપેલો માનવી વિશ્રામ મેળવે છે, તેમ આત્મલાભ પ્રાપ્ત કરેલ મહાપુરુષ અને દુઃખીઓને શાંતિ પ્રદાન કરે છે.

આત્મલાભની સાથે સાથે આત્મા તથા પરમાત્માનો અનેક દિવ્ય શક્તિઓ સાથે સંબંધ બંધાઈ જાય છે. પરમાત્માની એક એક શક્તિનું પ્રતીક એક એક દેવ હોય છે. એક દેવ અનેક રિદ્ધિસિદ્ધિનો અધિપતિ હોય છે. આ દેવ નેટે વિશ્વબ્રહ્માંડમાં વ્યાપક છે તેમ એ માનવશરીરમાં પાણ મોન્ઝુદ છે. આ પિંડદેહ એ વિશ્વબ્રહ્માંડનું એક નાનું રૂપ છે. આ પિંડદેહમાં લે દૈવી શક્તિઓનું ગૂઢ સંસ્થાન છે તે આત્મલાભ કરનાર મહાપુરુષ માટે પ્રકટ અને પ્રત્યક્ષ થઈ જાય છે અને તે પેલી દૈવી શક્તિઓ પાસે ઈશ્વરાનુસાર કાર્ય કરવી શકે છે.

(૫) આત્મકલ્યાણનો અર્થ છે - જીવનમુક્તિ, સહજસમાધિ, કેવલ્ય, અક્ષય આનંદ, બ્રહ્મનિવારિગચ્છિતિ, પ્રજ્ઞાવસ્થા, પરમહંસગતિ, ઈશ્વરપ્રાપ્તિ. આ પાંચમી ભૂમિકામાં પહોંચેલો સાધક બ્રાહ્મીભૂત થાય છે. આ ભૂમિકામાં પ્રવેશેલો આત્મા ઈશ્વરની માનવ પ્રતિમૂર્તિ બની જાય છે. એને દેવદૂત, અવતાર, પથગંબર, યુગનિર્મિતા વગેરે નામથી ઓળખવામાં આવે છે તેને શું સિદ્ધ મળે છે તેના જવાબમાં એટલું જ કહેવાનું કોઈ પાણ ચીજ એવી નથી કે ને એને ન મળે. અક્ષય આનંદનો એ સ્વામી બને છે. બ્રહ્માનંદ, પરમાનંદ અથવા આત્માનંદ કરતાં બીજું કોઈ મોટું સુખ આ ત્રિગુણાત્મક પ્રકૃતિમાં નથી. આ સર્વોચ્ચ લાલ આત્મકલ્યાણની ભૂમિકામાં પહોંચેલાને પ્રાપ્ત થાય છે.

ગાયત્રીની દશ ભૂજમાંથી પાંચ ભૂજ સાંસારિક છે અને પાંચ આત્મિક છે. આત્મિક ભૂજાઓ આત્મકાન,

આત્મલાભ, આત્મદર્શન, આત્માનુભવ અને આત્મકલ્યાણ છે. આ દેવી સંપત્તિઓના સ્વામીના વેભવની તુલના કુબેરની સાથે પણ ન થઈ શકે. ગાયત્રીનો ઉપાસક આત્મિક દાખિએ એટલો સુસંપત્ર અને પરિપૂર્ણ થઈ જય છે કે તેની તુલના કોઈ પણ સાંસારિક સંપત્તિ સાથે નથી થઈ શકતી. દરેક કોશની સાધના એક એક ભૂમિકામાં પ્રવેશ કરાવે છે. અત્રમયકોશનો સાધક આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે, પ્રાગુમયકોશના સાધકને આત્મદર્શન થાય છે, મનોમયકોશનો સાધક આત્માનુભવ પ્રાપ્ત કરે છે, વિજ્ઞાનમય કોશ સાથે આત્મલાભનો સંબંધ છે અને આનંદમયકોશમાં આત્મકલ્યાણ સમાઈ જય છે.

ગાયત્રીની દશ ભૂજમાંથી પાંચ ભૂજાઓ સ્થૂળ અને પાંચ સૂક્ષ્મ છે. નિષ્ઠામ ઉપાસના કરનારા સાધકને ગાયત્રીમાતા સૂક્ષ્મ હાથોથી આશીર્વાદ આપે છે અને સકામ સાધકને સ્થૂળ હાથોથી પ્રસાદ આપે છે. અસંઘ્ય વ્યક્તિઓ એવી છે કે જેઓએ માતાની ફૂપાથી સાંસારિક સંપત્તિઓ પ્રાપ્ત કરી છે અને અનેક મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવ્યો છે. આરોગ્ય, ધન, વિદ્યા, ચતુરાઈ અને સહયોગ એ પાંચ સાંસારિક સંપત્તિઓ પંચમુખી માતાની સ્થૂળ ભૂજાથી મળે છે.

એવા કેટલાય અનુભવો અમારી પાસે છે કે જેમાં લોકોએ થોડીક ગાયત્રી સાધનાથી અનેક સાંસારિક સફળતાઓ મેળવી હોય. જેના ધરમાં રોગે અડો જમાયો હોય અને બીમારીની પીડા સહન કરતાં કરતાં અને ડોક્ટરોનું બિલ ચૂકવતાં થાકી ગયા હોય તેવાઓએ રોગમુક્તિનું વરદાન મેળવ્યું છે. ક્ષય જેવા પ્રાણાધાતક રોગની પથારીમાંથી ધાળા ઊભા થયા છે. કેટલાય લોકોએ વારસાગત ઊતરી આવેલી બીમારીમાંથી મુક્તિ મેળવી છે. કેટલાય બેકાર અને દરિદ્ર લોકોને આજીવિકાનું સારું સાધન મળી ગયું છે. સાધનહીન, મંદબુદ્ધિવાળા અને અવિકસિત લોકો ચુતુર, બુદ્ધિમાન, કલાકાર, શિલ્પી, ગુગુવાન, પ્રતિભાવાન, પ્રિય, નેતા અને યશસ્વી બન્યા છે. જેને સર્વ તરફથી તિરસ્કાર, અપમાન, દૈખ, સંદર્ભ અને અસહકાર જ મળતો હતો એમને ધરની બહાર સર્વત્ર પ્રેમ, સહયોગ, આવકાર, સદ્ભાવ તથા મધુર વ્યવહાર મળવા લાગ્યો છે.

એવા અનેક લોકો છે, જેઓએ આવા અનેક ચમત્કારિક લાભો મેળવ્યા છે તેમને એમે વ્યક્તિગત ઓળખીએ છીએ. એમાંના કેટલાકનો ઉદ્દેશ ‘ગાયત્રીના અનુભવો’ અને ‘ગાયત્રી કામધેનું છે’ એ પુસ્તકોમાં કરવામાં આવ્યો છે. મુક્તદમાઓ, આક્રમાગ, બંધન, ભય, આશંકા, પરીક્ષા, બીમારી, દરિદ્રતા, ભૂતભાધા, સંતતિનું કંદ, વસન વગેરે અનેક મુસીબતો અને દુર્ગુણોનાં ગ્રાસદાયક વર્તુળોમાંથી ધાણી વ્યક્તિઓએ છુટકારાનો દમ લીધો છે. કષ્ટદાયક વર્તમાન અને દ્યાંકર ભવિષ્ય જોઈને જેઓ બાધા જેવા, મૂઢ થઈ ગયા હતા, તેમાંથી ગાયત્રીનો આશરો વઈને તરત જ ધૈર્ય, સાહસ અને પ્રકાશ મેળવ્યાં છે. હકીકિત એવી છે કે કોઈ દેવતા આવીને એમનું કામ નથી કરી ગયા, પણ સત્ય એ છે કે એમને અનાયાસે જે એવી મતિ સૂજી અને એવી યુક્તિ મળી ગઈ કે જેથી પર્વત જેવી ભારે મુશ્કેલી રાઈના દાણા જેવડી બનીને ઊરી ગઈ. આપત્તિમાં શું શું થઈ જશે એવી આશંકા હતી તે જેતજેતામાં દૂર થઈ ગઈ અને માર્ગ સૂરળ થઈ ગયો. માતાની ફૂપાથી અનેકવાર આવા ચમત્કારો જેવા-જાગુવા મળ્યા છે.

આરોગ્ય અને ધનની માફક દશ ભૂજવાળી ગાયત્રીની ત્રીજી સ્થૂળ ભૂજનો પ્રસાદ ‘વિદ્યા’ ના ઇપમાં મળે છે. મંદબુદ્ધ, મંદ મગજ, ભૂલકણા, ધૂની, મૂર્ખ વગેરેને બુદ્ધિમાન, દૂરદર્શી અને તીવ્ર બુદ્ધિવાળા થતા જોયા છે. જેના મગજની દશ જોઈને એમ જ થાય કે એમને કટકો રોટલો પણ શી રીતે મળશે, તેઓનાં મગજ અને ભાગ્ય એવો સરસ પલટો ખાધો કે લોકો તેની સલાહ દેવામાં પોતાનું ગૌરવ અને ભલાઈ જેવા લાગ્યા.

જેઓ ભાગવામાં ઠોડ હતા તેઓ મહાપંડિત થયા. દર વરસે નાપાસ થનારા વિદ્યાર્થી ગાયત્રીની થોડીક ઉપાસના કરવાથી તીવ્ર બુદ્ધિવાળા બની હંમેશાં ઊચા ટકાથી પાસ થવા લાગ્યા. અનેક મુસીબતો તથા સમયનો અભાવ છતાં કેટલીય સાધનહીન વ્યક્તિઓ વિદ્વાન બની ગઈ. મગજનું કામ કરનારા કેટલાય બુદ્ધિજીવી મનુષ્યોનાં

મગજ ગાયત્રી સાધનાથી અતિશય પ્રખર બન્યાં છે અને પરિણામે તેઓ ઉજ્જવળ નક્ષત્રની માફક સંસારમાં ચમકી રહ્યા છે. પોતાના બુદ્ધિબળથી તેઓએ સારી સફળતા, પ્રતિષ્ઠા, કીર્તિ તથા સંપત્તિ મેળવ્યાં છે.

વિકૃત મસ્તિષ્કવાળો, અર્ધપાગલ, ડરપોક, આળસુ, જઘડાળુ અને થીહિયા પ્રકૃતિનો મનુષ્ય બીજી ભૂજના પ્રસાદથી સ્વસ્થ મનોભૂમિ પ્રાપ્ત કરે છે. ભૂતોન્માદ, પ્રેત, વળગાડ, લીઓ અને બાળકો ઉપર થતા દુષ્ટ આત્માઓના હુમલાઓથી રક્ષાગુણ આપવાની અદ્ભુત શક્તિ ગાયત્રી ઉપાસનામાં રહેલી છે. હજર ભૂવા, જતિઓ અને તાંત્રિક સાધકોને એક પક્ષમાં મૂકી સામી બાળુએ બીજ પક્ષમાં ગાયત્રીને મૂકો તો ગાયત્રીનું પદ્ધું જરૂર નમી જશે.

ચતુરાઈ ભરેલાં કામોનો આરંભ કરતી વખતે શારદા અને સરસ્વતીનું આવાહન, વંદન અને પૂજન કરવાની પ્રથા છે, એનું કારણ એ છે કે બુદ્ધિત્વમાં માતાની કૃપાથી એક એવી સૂક્ષ્મતા પ્રવેશ કરે છે કે નેથી એમાંની વિશિષ્ટતા લોકોના હૃદયમાં સીધી અસર ઊપજાવી શકે. ચિત્રકળા, સંગીત, કવિતા, ભાષાગુ, લેખન, શિલ્પ, રસાયણ, ચિકિત્સા, શિક્ષાગુ, નેતૃત્વ, સંશોધન, નિર્ણય, દલાલી, પ્રચાર, વ્યવસાય, જેલ વગેરે અનેક વાતો એવી છે કે નેમાં વિશેષ સફળતા તેને જ મળે છે કે જેની બુદ્ધિમાં સૂક્ષ્મતા હોય. આવાં કામોમાં માત્ર અફ્કલથી કામ નથી ચાલતું. ગાયત્રી માતાના પુરુષપ્રસાદથી એવું કુશાગ્ર સૂક્ષ્મવેધી ચારુર્ય પ્રાપ્ત થાય છે એવી શ્રદ્ધા હોવાથી લોકો પોતાનાં કાર્યોનો આરંભ કરતી વખતે શારદાપૂજન કરે છે.

ગાયત્રીની પાંચ સ્થૂળ ભૂજાઓ પૈકી પાંચમી ભૂજાનું નામ સહયોગ છે. એ નેને પ્રાપ્ત થાય છે તે પોતે નમ્ર, મધુરભાષી પ્રસત્રચિત્ત, હસમુખ, ઉદાર, દયાળુ, ઉપકારી, સેવાભાવી અને નિરહંકારી બની જય છે. આ વિશેષતાઓ બહુ જ જલદીથી તેનામાં વિકાસ પામે છે. પરિણામે તેના સંપર્કમાં આવનાર દરેક તેના ગુલામ બની જય છે. આવા સ્વભાવવાળા સજ્જનની લીધી, પુત્ર, ભાઈ, ભાનીજા, કાકા, મામા વગેરે સર્વ સ્વજનનો તેના સહકારી, સહાયક અને પ્રશંસક બની જય છે. આખા ધરમાં તેનું માનપાન સારી રીતે જળવાય છે અને બધાં તેની સુખસગવડો ઉપર પૂર્વું ધ્યાન આપે છે. ધરમાં હોય અથવા બહાર, બજરમાં કે દુકાન ઉપર, મિત્રોમાં અથવા પરિચિતોમાં સર્વત્ર તેને પ્રેમ, સહયોગ અને સત્કાર મળતો જ રહે છે. આવા સ્વભાવવાળી વ્યક્તિ કદી મિત્રહીન રહેતી નથી. એ જ્યાં હોય ત્યાં તેને પ્રશંસક, મિત્ર, સહાયક અથવા સહયોગી મળી જ રહે છે.

જમાગું અને ડાબી, સૂક્ષ્મ અને સ્થૂળ મળીને ગાયત્રીની પાંચ આત્મિક અને પાંચ ભૌતિક સિદ્ધિઓ છે. આ દશ સિદ્ધિઓ એવી છે કે જે માર્યાતે આ જીવનમાં, આ લોકમાં સ્વગીથિ સુખનો અનુભવ કરી શક્યા છે. આ જીવન આવતા જીવનની પૂર્વભૂમિકા છે. એ મનુષ્ય આને સંતુષ્ટ હશે તો કાલે પણ તેને સંતોષ જ મળશે. આને જે તેને કલ્યાણનો અનુભવ થશે તો કાલે પણ તેને કલ્યાણ જ પ્રાપ્ત થશે. સજ્જનનો મોટે ભાગે સાહસપૂર્ણ અને વર્તમાન વાતાવરણથી લિખ્ર કાર્યક્રમ જ અપનાવશે. એથી બાધ્ય દશ્થી તેમને કંઈક અગવડ જેવું દેખાય, પણ તેમની આંતરિક સ્થિતિ પ્રસત્ર અને સંતુષ્ટ રહે છે. આવી દશામાં એ પણ એટલું જ સાચું અને નિશ્ચિયત છે કે તેમનું ભાવિ જીવન પૂર્ણતા, પ્રસત્રતા અને સંતોષથી ભરેલું રહેશે, એટલું જ નહીં, એ ગુણોનો સંપૂર્ણ વિકાસ થતાં આજની બાધ્ય મુશ્કેલીઓ આપોઆપ અદશ્ય થશે.

શું યોગસાધના માટે ગૃહસ્થે ધર છોડી, સાધુ બની, કપડાં રંધી, જ્યાં ત્યાં ભ્રમાગ કરવું જરૂરી છે? આ પ્રશ્નનો વિચાર કરતાં આપણે પૂર્વકાળના યોગીઓની વાસ્તવિક સ્થિતિનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. પ્રાચીનકાળના ઝષિઓ અવિવાહિત રહેતા એ માન્યતા ભૂલભરેલી છે. ઝષિમુનિઓ પૈકી કોઈક થોડા સમય માટે અથવા આજીવન બ્રહ્મચારી રહ્યા હશે, પણ મોટે ભાગે તેઓ ગૃહસ્થ હતા, એ વાત બિલકુલ સાચી છે. લી તથા બાળકોની સાથે રહેવામાં એમને તપશ્ચર્યા અને આત્મોક્રતિમાં સહાયતા મળતી હતી.

ઈતિહાસ, પુરાણોમાં દરેક જરૂર્યાએ એ વાતના પુરાવાઓ મળે છે કે ભારતવર્ષનો મહિષિગાણ, યોગી, યતિ,

સાધુ, સંન્યાસી, તપસ્વી, સંશોધક, ચિકિત્સક, વક્તા, રચયિતા, ઉપદેશક, દાર્શનિક, અધ્યાપક, નેતા વગેરે પોતાનાં વિવિધ રૂપોમાં પોતાનું જીવન વ્યતીત કરતા હતા અને તેમનાં એ મહાન કાર્યોમાં તેઓ પોતાનાં ખી-પુત્રોને પણ સહાયક અને ભાગીદાર બનાવતા હતા. ભ્રત્યા, વિષણુ, મહેશ એ ત્રણે ટેવો વિવાહિત હતા. ભ્રત્યાને ગાયત્રી અને સાવિત્રી એમ બે પત્નીઓ હતી. વિષણુને પણ તુલસી અને લક્ષ્મી એમ બે સ્ત્રીઓ હતી. સતીના અવસાન પછી મહાદેવજીએ પણ પાર્વતી સાથે બીજાં લગ્ન કર્યા હતાં. બાસ, અત્રિ, ગૌતમ, વિશ્વિષ, વિશ્વામિત્ર, યાજ્ઞવળ્ય, ભારત્વાજ, ચ્યાવન વગેરે સર્વ ઋષિઓ ગૃહસ્થ હતા. અશ્વત્થામા, શુંગી ઋષિ, નથિકેતા, આરુણિ, ઉદાલક, શુક્રદેવ, પરશુરામ વગેરે ઋષિકુમારો હતા. એમનાં માતાપિતા ઋષિ જ હતાં. યાજ્ઞવળ્યને બે પત્નીઓ ગાર્ગી અને મૈત્રેયી હતી. અત્રિની પત્ની અનસૂયા પોતાના સમયની પ્રભર ભ્રત્યાદિની હતી. આવાં પ્રમાણોથી ઈતિહાસ- પુરાણોનાં પાનાં ભરેલાં છે, જેથી પ્રતીત થાય છે કે પૂર્વકાળમાં યોગી લોકો પણ ગૃહસ્થર્મનું પાલન કરતા હતા.

તે સમયની પરિસ્થિતિઓ, પ્રથાઓ, સગવડો અને સાદી જીવનપદ્ધતિ અનુસાર ઋષિલોકો સાદું સાત્ત્વિક જીવન જીવતા હતા. વેશ બદલવાનીકે ધર છોડવાની કોઈ વાત જ નહોતી. લાકડાની પાવડી અને તુંબડીનું જળપાત્ર એ સાદા જીવનની નિશાનીઓ હતી. એ વખતે વસ્તી ઓછી અને નંગલ ખૂબ હતાં. સહેલાઈથી બનતી ઝૂંપડી અને નાનાં ગામો એ તે વખતની સ્થિતિ હતી. આજના બદલાયેલા જમાનામાં તે વખતની નકલ કરવી ક્યાં સુધી ઉચિત છે તે વાયક પોતે જ વિચારી શકે છે.

એ વખતે દૂધ પીને અને ફ્લાઇ ખાઈને જીવનારા લોકો ત્યાગી નહોતા ગાણાતા કેમકે વિશાળ વનોમાં ચારો મેળવવાની ઉત્તમ સગવડો હોવાથી ગમે તે માણસ ગમે તેટલી ગાયો રાખી શકતો અને નંગલોમાં મળી આવતાં ફળો ખાઈને જીવન વિતાવવામાં કોઈ મુશ્કેલી ન હતી. આજે તો ગાય પાળવામાં સેકડો રૂપિયાનો ખર્ચ થાય છે. સારાં ફળો ખરીદવામાં પણ ખાસ્સો ખર્ચ થાય. જ વાત તે સમયે તદ્દન સાદગીની હતી તે આજે અમીરોને માટે પણ દુર્બિભ છે.

નંગલી જનવરોના ડુમલાથી બચવા માટે રસ્સો રોકીને પહેલાં વૃક્ષોનાં સૂક્ષ્મ લાકડાંથી રાતદિન ધૂળી સળગતી રખવામાં આવતી હતી, પણ આજે તો લાકડાંનો ભાવ એટલો બધો છે કે ધૂળી સળગાવવી કોઈને પણ ન પોસાય. એ સમયે સ્વાભાવિક મોતથી મરતાં મૃગ વગેરે પશુઓનાં ચામડાં જોઈએ તેટલાં મળતાં હતાં, પણ આજે તો અહિસ્ક ચામડું મેળવવું લગભગ અશક્ય જ છે. એક પશુના ચામડાની કિમત પણ કદ્દી ન શકાય એટલી હોય છે. આટલી કિમતમાં તો દર્ભનાં અનેક આસન ખરીદી શકાય. ઠંડી ગરમીથી બચવા માટે શરીર પર ભસ્મ લગાવવાથી કામ ચાલી જતું, કારણ તે વખતે નંગલોમાં વસ્તો નહોતાં. આજે જ્યારે વસ્તો સહેલાઈથી મળી શકે છે ત્યારે ભસ્મની જરૂર જ શું છે?

એ જમાનામાં વૃક્ષા કાપવાં, અંધ્રિ સળગાવવો અને નંગલી પશુઓથી રક્ષાણ કરવા માટે મોટા ચીપિયા સાથે રખવાની જરૂર હતી. આજે એ ત્રણે કારણો રથા નહીં હોવાથી ચીપિયાની જરૂર પણ રહી નથી. અમે આખા ભારતવર્ષની એક છોડાથી બીજા છોડા સુધી કેટલીયવાર આધ્યાત્મિક યાત્રાઓ કરી છે. એ અનુભવના આધારે કહી શકીએ છીએ કે હવે કાંઈ એવાં નંગલો નથી રથાં કે જ્યાં ગાયો આપોઆપ ચરીને આવે અને તેના દૂધ ઉપર ગુજરો કરી શકાય અથવા ફળો ખાઈને દિવસ કાઢી શકાય. આજે માણસોનાં શરીર પણ એવાં થઈ ગયાં છે કે મકાન અથવા વસ્તો સિવાય માણસને ચાલતું જ નથી. જે યોગીઓ, યતિઓ ગંગોત્રી વગેરે જગ્યાએ નિવાસ કરે છે તેમને પણ વસ્તુ, મકાન વગેરેની વ્યવસ્થા કરવી પડે છે.

આજની બદલાયેલી પરિસ્થિતિમાં પૂર્વજીનું આંધળું અનુકરણ કરી ભિક્ષાજીવી બનીને આજની દરિદ્ર અને અંધશ્રદ્ધાળું જનતા ઉપર ભારરૂપ બનવા સાધુ વેશ લેવો એ કોઈ પણ રીતે ઉચિત નથી. પોતાની આવશ્યકતાને પૂરી કરવા માટે ગૃહસ્થોને નેટલો પ્રયત્ન કરવો પડે છે તેટલો પ્રયત્ન સાધુભાવાઓને પણ કરવો પડે છે. એટલા માટે એ જાતની મહાવિશ્વાન - ભાગ-૩

જ યોગ્ય છે કે દરેક પોતાની આજીવિકાની વ્યવસ્થા કરવાની સાથે સંસારમાં જ રહીને સાદું અને સાન્નિવક જીવન જીવે.

સાધના મનથી થાય છે, નહીં કે વેશથી. ગમે તેવી ભીડમાં પાણ મન શાંત રહી શકે છે અને ગમે તેવા એકાંતમાં વિકારચ્છસ્ત પાણ થઈ શકે છે. એકાંતસેવી લોકોનો ઈન્દ્રિયવિજ્ઞય કાચો હોય છે. જેને ચોરી કરવાનો પ્રસંગ જ નથી મળતો એ ઈમાનદાર છે એવું કેવી રીતે કહેવાય? પ્રલોભન વખતે જે અદગ રહે એ જ વિશ્વાસલાયક ઈમાનદાર કહી શકાય. એકાંત નંગલમાં બેસીને લોકો સાથેનો બધો સંબંધ છોડીને કોઈ વિકિન્દ્ર દુર્ગુણોથી બચ્યો જાય, તેના સંસ્કારો એટલા દઢ નથી હોતા નેટલા નિરતર બૂરાઈઓનો મુકાબલો કરીને પોતાની ભલાઈઓનો વિકાસ કરનારના હોય છે. શૂરવીરની પરીક્ષા યુદ્ધના મેદાનમાં જ થાય છે. ધરમાં બેઠાં બેઠાં તો એક દર્દી પાણ તીસમારખાંની જેમ શેખી મારી જાય છે.

જાયત્રી સાધના દ્વારા યોગસાધના કરી આત્મિક ઉત્ત્રતિ કરવા અને કલ્યાણના રસ્તા ઉપર ચાલવા માટે એ બિલકુલ જરૂરી નથી કે સાધકે વેશ બદલવો પડે, ધરબાર છોડીને જ્યાં ત્યાં બટકવું પડે અને હાથપગથી રળીને આજીવિકા મેળવવાનું છોડી બીજ પાસેથી ભીખ માળીને જીવવું પડે. કોઈ વિશિષ્ટ શક્તિવાળા આત્માઓ સંન્યાસના અધિકારી બને છે. એ અધિકાર તો ત્યારે જ મળે જ્યારે સાધના પૂર્ણ પક્ષ થઈ હોય અને પરિવ્રાજક બની સંસારના માર્ગદર્શક બની શકાય તેવી મનોભૂમિ તૈયાર થઈ હોય. સામાન્ય સાધકો માટે આ માર્ગ બ્રહ્માણ કરવો ઈષ્ટ નથી.

જાયત્રીની પંચમુખી સાધના માટે કોઈ ને પાણ ધર છોડવાની જરૂર નથી કેમકે નિશ્ચિત સમય પર નિશ્ચિત સાધના અને નિશ્ચિત આહારવિહારની નિશ્ચિત વ્યવસ્થા ધર છોડવાવાળાને મળતી નથી. પાત્ર-કુપાત્રનું અખ પેટમાં જઈને બુદ્ધિ ઉપર અનેક જાતના સંસ્કારો પાડે છે. એટલા માટે મહેનત કરીને પોતાની કમાણી ઉપર ગુજરો કરવો અને ગૃહસ્થજીવનની સાથે જ સાધનાકુમ ચાલુ રાખવો એ જ સર્વોત્તમ માર્ગ છે.

બ્રહ્મચર્ય ઉચિત અને જરૂરી છે. જેનાથી જેટલો સંયમ રાખી શકાય તેટલો રાખવો જોઈએ. પુરશ્વરાગુની ચોક્કસ મુદ્દત દરમ્યાન જ્યાં સુધી નિશ્ચિત સંકલ્પ પ્રમાણે જપ પૂરા ન થાય ત્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન કરતું જરૂરી છે, પરંતુ નિયતકાલીન વિશેષ પુરશ્વરાશો સિવાય સામાન્ય સાધનાકુમમાં બ્રહ્મચર્યની શરત અનિવાર્ય નથી. ગૃહસ્થ પોતાનો સામાન્ય અને સ્વભાવિક દાંપત્યધર્મ બજાવવાની સાથે સાધનાકુમ પ્રસત્તતાથી ચાલુ રાખી શકે છે. તેનાથી તેની સાધનામાં કોઈ વિધન આવતું નથી.

મન પર નિયંત્રણ રાખવાની અને સાન્નિવકતા જાળવવાની સગવડ ધેર જ સારી રીતે હોય છે. જ્યાં પાણી હોય ત્યાં જ તરવાની કણા શીખી શકાય છે. પાણીથી માઈલો દૂર રહેનાર કેવી રીતે સારો તરવૈયો બની શકે? તરવાનાં અનેક પુસ્તકો વાંચવા છતાં, તેનું શિક્ષાણ મેળવવા છતાં, પાણીમાં રહીને ડુબકી મારવાની પોતાની યોગ્યતા એ સિદ્ધ ન કરે ત્યાં સુધી તેનું શિક્ષાણ અધ્યુતું જ રહેવાનું. ગૃહજીવનમાં અનેક અનુકૂળ-પ્રતિકૂળ, સારા-નબળા, હર્ષ-વિષાદના પ્રસંગો આવવાના અને એ પરીક્ષા પ્રસંગોમાં પોતાના મનને કાબૂમાં રાખવાથી સ્વભાવ અને સંસ્કારોમાં પ્રોફેટા અને પરિપક્વતા આવે છે.

પોતાના ખરાબ સંસ્કારો અને સ્વભાવની સાથે સતત સંધર્ષ કરવો જોઈએ. પ્રતિકૂળ પરિસ્થિતિઓને અનુકૂળ બનાવવાનો સખત પ્રયત્ન કરવો જોઈએ, આ સખત પ્રયત્ન અને સંધર્ષને મંથન કરે છે. આને જ ગીતામાં ‘ધર્મયુદ્ધ’ અથવા ‘કર્મયોગ’ કહ્યો છે. અનુર્જન ઈચ્છાએ છે (આપણું અજ્ઞાનગ્રસ્ત મન કરે છે) કે આ જંજાળથી દૂર રહીને એકાંતવાસી બની સફળતાનો કોઈ બીજો માર્ગ મળી જાય. એ લડવા નહોતો માગતો કારણ કે એ સંધર્ષ હમેશાં કષ્ટસાધ્ય જ હોય છે. મનુષ્યની કાયરતા તેને એમ કરતાં રોકે છે. કાયર સ્થિપાણી હંમેશાં લડાઈના મોરચેથી ભાગી જવાની જ યોજના કરતો હોય છે. એ જ રીતે પોતાના સ્વભાવની, પરિવારની, સમાજની તથા દેશકાળની

પરિસ્થિતિઓથી કંટાળીને કેટલાય માગણસો એટલા નિરાશ થઈ જય છે કે બૂરાઈઓની સામે પોતે સમર્પણ કરી દે છે.

આ સ્થિતિના પ્રતિનિધિ જેવા અજુનનો ભગવાન કૃષ્ણને ઈક ઈક ડિક ડિક ઉધડો લીધો છે. તેની દબીલોમાં છુપાયેલી કાયરતાનો પડદો ભગવાને ચીરી નાખ્યો. ભગવાને કહ્યું - “લજ્યા સિવાય કલ્યાણ નથી. સફળતા-અસફળતાના અક્રમભાગને પડ્યા વગર યુદ્ધને કર્તવ્ય માનીને તું લડ.” સાધકોને માટે આ જ માર્ગ છે. વિપરીત પરિસ્થિતિઓની સાચે હમેશાં તેણે ઉત્સાહપૂર્વક યુદ્ધ કર્યા જ કરવું જોઈએ. “આટલો પ્રયત્ન કરવા છતાં આટલી જ સફળતા મળી” આવો વિચાર કરવો એ ધર્મયુદ્ધના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. સંઘર્ષ એક સાધના છે. તેનાથી પ્રકાશ અને તેજની વૃદ્ધિ થવાની જ છે. મંથનથી હિયા, ગતિ અને શક્તિ ઉત્પત્ત થવાનાં એ નિશ્ચિત છે. સાધના યુદ્ધના સૈનિકનું પ્રયોક કદમ લક્ષ્ય તરફ જ લઈ જય છે. મનિલ ગમે તેટલી દૂર હોય, પ્રગતિ ગમે તેટલી મંદ કેમ ન હોય, પાણ એ હૃદ નેટલી નિશ્ચિત વાત છે કે જે સાધક પોતાની સાધના એ દિશામાં ચાલુ રાખ્યે તો એ આજે નહીં તો કાલે પાણ પૂર્ણ સફળતા પ્રાપ્ત કરીને જ રહેશે.

## ૧૧. ગાયત્રી સાધના નિષ્ફળ જતી નથી

પંચમુખી ગાયત્રીની પાંચ સાધનાઓ પૈકી ગમે તે એક (આપણી પોતાની આંતરિક સ્થિતિને અનુકૂળ હોય તે) નક્કી કરી લેવી જોઈએ. વિદ્યાર્થી જે ધોરણમાં હોય તે જ ધોરણનાં પુસ્તકો તેને ભાગવા માટે આપવાં જોઈએ. બી.એ. ના વિદ્યાર્થીનિ છઢા ધોરણનાં પુસ્તકો આપવામાં આવે તો તેનાથી તેની પ્રગતિ થતી નથી. એ જ પ્રમાણે પાંચમા ધોરણના વિદ્યાર્થીનિ દશમા ધોરણનાં પાઠ્યપુસ્તકો આપવામાં આવે તો, ગમે તેટલા પ્રયત્ન કરવામાં આવે તો પાણ તેને સફળતા નહીં મળે. સાધનાના સંબંધમાં પાણ એ જ વાત લાગુ પડે છે. જે પોતાની મનોભૂમિને અનુરૂપ સાધના પસંદ કરી લે છે તે મોટે ભાગે સફળતા મેળવશે.

ગાયત્રી સાધનાનો પ્રભાવ તત્કાળ જ પડે છે. તેનું પરિણામ જેવા માટે લાંબો વખત રાહ જેવી પડતી નથી. સાધનાની શરૂઆત થતાં જ ચિત્તમાં સાત્ત્વિકતા, શાંતિ, પ્રકુલ્પતા, ઉત્સાહ અને આશા જગ્યાત થાય છે. કોઈ વ્યક્તિ કેટલીયે મુસીબતો, અગવડો અને સંકટોમાં પડી હોય, છતાં પાણ ગાયત્રી સાધનાનો આરંભ થતાં તેની માનસિક શિંતા, બેચેની અને ગલ્ભરાટ તત્કાળ ઓછાં થતાં જાગુશે.

નેમ દર્દ કરતા ધા ઉપર શીતળ મલમ લગાડવાથી તત્કાળ બેચેની દૂર થાય છે અને દર્દ બંધ થાય છે, તેમ અનેક મુશ્કેલીઓની પીડાને લીધે દુઃખી થયેલા અંતઃકરણ ઉપર ગાયત્રી સાધના રૂપી મલમ શાંતિદાયક અસર કરશે અને ગરમ થયેલા મગજનો ધારુશો ભાર તત્કાળ હલકો થયેલો માલૂમ પડશે.

નેમ ધારુશાલાંબા કાળથી વિખૂટું ખરેબું બચ્ચું પોતાની માંતાને મળતાં તેને જે આનંદ અને શાંતિ મળે છે તેવી જ શાંતિ ગાયત્રી સાધકને થશે. એટલું જ નહીં, પાણ માતાની ગોદમાં લાપાઈને બેસતાં તેને તેના જન્મજન્માંતરનું દુઃખ ટળી ગયું છે તેવો અનુભવ થશે. પોતાની માતાની સાથે ફરનાંદું હરણનું નાનું સરખું બચ્ચું નંગલમાં ગમે તેવાં હિસ્ક અનવરોની વચ્ચે ફરતું હોવા છતાં બિલ્કુલ નિર્ભયતા અનુભવે છે. એ એટલું નિશ્ચિંત થઈ જય છે કે જ્યાં સુધી માતા મારી પડશે છે ત્યાં સુધી મને કશી જ હિકર નથી. માતા પાણ પોતાના પ્રાણની માફક તેને પ્રેમ કરે છે અને તેનો પ્રેમ કદી પાણ ઓછો થતો નથી.

સારી કે ખરાબ પરિસ્થિતિઓ તો દરેક મનુષ્ય સામે આવે છે. સુખદુઃખનું ચક એ સંસારનો નિયમ છે. ગાયત્રી ઉપાસના કરનાર મનનો સંયમ કરવાનું શીખી લે છે અને એને દર્દ વિશ્વાસ થાય છે કે સન્માર્ગ પર ચાલનારને તે મહાશક્તિ અવશ્ય સહાય કરે છે. તે કદી વિપરીત પરિસ્થિતિઓથી વ્યકુળ બનતો નથી. તે ગાયત્રી માતાની ગાયત્રી મહાવિજ્ઞાન - ભાગ-3

અનુકૂળા પર ભરોસો રાખી પ્રયત્નશીલ રહે છે અને વિપત્તિઓમાંથી શીધ છુટકારો મેળવે છે.

વિપત્તિની આંશંકા, કલ્યાણ અથવા ભાવનાથી જેટલું દુઃખ થાય છે, તેટલું દુઃખ ખરેખર વિપત્તિથી નથી થતું. કોઈનો વેપાર બગડે અને તેમાં નુકસાન આવે, તેથી કાંઈ શરીરના હલનચલનમાં વાંધો આવતો નથી. એ નુકસાનથી રોટી, કપડાં અથવા મકાન હાણી જતાં નથી અથવા તેનાથી શરીરમાં કોઈ દાહ, બળતરા અથવા દર્દ થતું નથી અને છતાં લોકો માનસિક કારણોથી ખૂબ દુઃખી રહે છે. આ માનસિક યાતનામાં ગાયત્રી સાધનાથી તત્કાળ શાંતિ મળે છે. આ સાધનાથી એક એવું આત્મબળ પ્રાપ્ત થાય છે અને એવી આંતરિક દફ્તા અને નિર્ભયતા આવે છે કે નેથી આવેલી મુશ્કેલી પ્રમાણમાં તુચ્છ લાગે છે અને એવો વિશ્વાસ થઈ જાય છે કે આ મુશ્કેલીનું પરિણામ ગમે તેવું ગંભીર હોય છતાં મને કશું નુકસાન થવાનું નથી. અનેક મનુષ્યોની તુલનામાં મારી સ્થિતિ સારી જ રહેવાની છે.

ગાયત્રી સાધનાની આ વિશેષતા છે કે તેનાથી તત્કાળ આત્મબળ મળે છે અને માનસિક યાતના એકદમ ઓછી થઈ જાય છે. અમને પોતાને એવા અનેક અનુભવો થાય છે કે દુઃખોના કારણે આત્મહત્યા કરવા તૈયાર થયેલા મનુષ્યોનાં આંસુ સુકાયાં છે અને તેમણે સંતોષનો શાસ લઈને આશાનો પ્રકાશ નેત્રોમાં ચમકાયો છે. નુકસાન, બીમારી, મુક્કદમો, વિરોધ, ગૃહકલેશ, શરૂતા વગેરેનાં પરિણામોની કલ્યાણાથી નેત્રો હમેશાં ચિંતાતુર રહેતા હતા, તેમના વિષાદગ્રસ્ત ચહેરા પર માતાની કૃપાથી હર્ઘની રેખાઓ ફૂટેલી જોવા મળી છે.

‘જે બનવાનું છે તે તો બનશે જ. પ્રારંભના ભોગ આપણે પોતે જ ભોગવવા પડશે. જે ટળી શકવાનું નથી તેને માટે શોક કરવો, દુઃખી થવું નકારું છે. પોતાનાં કર્મોનાં પરિણામ ભોગવવા જેટલી બહાદુરી આપણે કેળવવી જ જોઈએ.’ જે અડચણો અને મુશ્કેલીઓ કાલ સુધી નેતે પર્વત સમાન ભયંકર અને અસાધ લાગતી હતી તે જ અડચણો ઉપરોક્ત ભાવનાથી તેને તુચ્છ લાગે છે.

જે લોકોને એવો ભય હતો કે અમને સત્તાવવામાં આવશે, દુઃખ દેવામાં આવશે, કોણ જાણ અમને શું શું વિપત્તિઓ પડશે અને કેવા અંધકારમાં અટવાં પડશે, એ સર્વના મનમાં ગાયત્રી સાધનાથી સદ્ભૂતિ પ્રેરણાં એવું સાહસ પેદા થઈ જાય છે કે અવિનાશી આત્માનું કોઈ કશુંય બગાડી શકવાનું નથી. દિવસ પછી રાત્રિ અને રાત્રિ પછી દિવસ તેવી ઘટમાણ ચાલ્યા જ કરવાની. તે જ પ્રમાણે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ એ પણ નિશ્ચિત છે. આજની મુશ્કેલીઓ હમેશાં રહેવાની નથી અને આજનું સુખ પણ શાશ્વત નથી. મુશ્કેલીઓનો સામનો કરવાનું બળ અથવા તેની ભયંકરતા ઓછી કરવાનો ઉપાય પ્રભુ અવશ્ય બતાવશે.

આવા અનેક શ્રદ્ધાપ્રેરક વિચારો મનમાં આવવા શરૂ થઈ જાય છે. આ આત્મબળને લિધિ સાધકની અડધી મુશ્કેલીઓ તો તત્કાળ દૂર થઈ જાય છે. તેના દિલમાંથી વિષાદની છાયા દૂર થાય છે અને આશા તથા ઉત્સાહનાં કિરણો ચારે બાજુએ ફેલાતાં નજરે ચેરે છે.

‘જે પ્રભુ ધરીભરમાં રાઈનો પર્વત અને પર્વતને રાઈબનાવી શકે છે તે જ પ્રભુ આપણા ભાગ્યમાંનો અંધકાર દૂર કરી કાળજીવારમાં પ્રકાશ ફેલાવી શકે છે.’ આવા દઢ વિશ્વાસનું એક ઉત્સાહભર્યું મોજું સાધકનાં અંત:કરણને આનંદિત બનાવી દે છે.

અનેકવાર એવું બને છે કે ગાયત્રીના ઉપાસકની કેટલીયે મુશ્કેલીઓનો એવો તો સરસ રીતે ઉકેલ આવી જાય છે કે તેને દેવી ચ્યામત્કાર જ કહેવો પડે. તેવી અનેક ઘટનાઓનો હું સ્વયં સાક્ષી છું કે જ્યારે સર્વ લોકો પૂર્ણ નિરાશ થઈ જયા હોય, કાર્ય સિદ્ધ થવું લગભગ અશક્ય લાગતું હોય, ભય અને શંકાની ધરી જ જાગુણી હોય, વિપત્તિનું વાદળ જાગે તૂટી પડવાનું હોય, લોકોનાં હદ્ય વિષાદથી ઘેરાઈ જયાં હોય અને રક્ષાગાળો કોઈ પણ ઉપાય નજર સામે દેખાતો ન હોય, એવા દુઃખ સમયે જુદી જુદી પરિસ્થિતિઓએ જાહુની માફક પલટો ખાંધો છે. બધા લોકો

આશ્રમ વ્યક્ત કરતા જ રહી જાય છે કે આ શો ચમત્કાર થઈ ગયો ! અંધકારની કાળી ઘટા વિખરાઈ જાય છે અને તેની જગ્યાને પ્રકાશના સોનેરી સૂરજનો ઉદ્ય થઈ જાય છે. ‘પ્રભુની કૃપાથી કશું જ અશક્ય નથી.’ આવા શબ્દો લોકોના મોઢામાંથી નીકળી જતા સાંભળ્યા છે. “મૂકું કરોતિ વાચાં પંગું લંઘયતે ગિરિમ્બ” એ પ્રભ્યાત સૂત્ર પ્રત્યક્ષાયવહારમાં ચરિતાર્થ થતું જોયું છે.

કેટલીકવાર પ્રારબ્ધની પ્રબળ રેખા એવી અટલ હોય છે કે કોઈ પણ ઉપાયે ટાળી શકતી નથી. હરિશ્ચંદ્ર, પ્રહ્લદાદ, પાંડવો, નળ રાજ તથા દશરથ સરખા મહાપુરુષો પણ પ્રારબ્ધના કુચકનો ભોગ થઈ પડ્યા હતા. તેમના સહાયકો, સંબંધીઓ અને ગુરુજનો અન્યત ઉચ્ચ કોટીના આત્મશક્તિસંપત્ત પુરુષો હોવા છતાં તેમને પણ અનેક વિપત્તિઓ સહેવી પડી હતી. જ્યાં આપત્તિઓ અનિવાર્ય હોય છે ત્યાં પણ ગાયની મહાશક્તિની સાધનાથી પ્રાપ્ત થયેલા આત્મબળના પ્રતાપે માનસિક ત્રાસ તદ્દન ઓછો થઈ જાય છે. એટલું જ નહીં, પણ મનનો વિષાદ, કાયરતા, દીનતા, બેચેની, નિરાશા અને ગભરાટનો ત્યાગ કરીને સાધક પરિસ્થિતિઓનો અતિ ઉત્સાહથી સામનો કરતાં કરતાં શાંતિથી એ ખરાબ દિવસો ગુજરી નાખે છે.

વેદમાતા ગાયનીની આરાધના એક પ્રકારનો આધ્યાત્મિક કાયાકલ્પ છે. જેને કાયાકલ્પ કરવાની વિદ્યાનું જ્ઞાન છે એ જાગે છે કે આ મહાપ્રયોગમાં કેટલા ધૈર્ય અને સંયમનું પાલન કરવું પડે છે. એ સંયમથી જ શરીરની ઊર્જાતા દૂર થઈ નવીનતા આવે છે. ગાયની આરાધનાનો આધ્યાત્મિક કાયાકલ્પ તેના કરતાં પણ અધિક મહત્વની વસ્તુ છે. તેનો લાલ શરીર પૂરો જ મર્યાદિત નથી, પણ સાધકનું શરીર, મગજ, ચિત્ત, સ્વભાવ અને દાખિબિંદુ એ બધાનું નવનિમણિંશ થાય છે અને સાથે સાથે આરોગ્ય, મનોબળ તથા સાંસારિક સુખ-સૌભાગ્યમાં પણ વૃદ્ધિ થાય છે.

આવા અસાધારણ મહત્વના પ્રયોગમાં સાચી શ્રદ્ધા, સાવધાની, રુચિ અને તત્પરતા રાખવી પડે તો તે કાંઈ મોટી વાત ન કહેવાય. માત્ર શરીરને કેળવી પહેલવાન જેવું બનાવવું હોય તો પણ લાંબા સમય સુધી ધીરજપૂર્વક વ્યાયામ કરવાની જરૂર પડે છે. દંડ, બેઠક, કુસ્તી વગેરેનો કષ્ણસાધ્ય કાંઈકમ અપનાવવો પડે છે તથા દૂધ, ધી જેવા ખોરાક માટે સારો એવો ખર્ચ કરવો પડે છે, ત્યારે જ શરીરને પહેલવાન જેવું બનાવી શકાય છે. આધ્યાત્મિક કાયાકલ્પ કરવો એ શું પહેલવાન બનવા કરતાં ઓછા મહત્વનો છે? બી.એ. ની પદવી મેળવવાની ઈચ્છા રાખનાર જાગે છે કે તેને માટે ધન, શ્રમ અને સમયનો ભોગ આપવો પડે છે ત્યારે એ પદવી પ્રાપ્ત થાય છે. પહેલવાન બનવા માટે, બી.એ. ની પદવી મેળવવા માટે જે પ્રયત્નો કરવા પડે છે, તેટલા પ્રયત્નો ગાયનીની સિદ્ધિ માટે કરવા પડતા હોય તો તે કોઈ મોટી વાત ન ગાણાય. એ ખોટનો સોદો નથી. પ્રાચીનકાળમાં આપણા પૂર્વજોએ જે મહાન સિદ્ધિઓ મેળવી હતી તેનું યથાયોગ્ય મૂલ્ય તેમણે ચૂકવું હતું. વિનામૂલ્યે કોઈ વસ્તુ મળતી નથી. ગાયની સાધનાનો આધ્યાત્મિક કાયાકલ્પ જે પોતાનું યોગ્ય મૂલ્ય માગતો હોય તો તે આપવામાં ઈમાનદાર ગાયની સાધકે આનાકાની કરવી જોઈએ નહીં.

ગાયની ઉપાસનાનો લાલ કેટલીકવાર જાહુની જેમ થાય છે. આવેલી વિપત્તિ કોઈકવાર તત્કાળ જ દૂર થઈ જાય છે અને ઈષ મનોરથ તરત જ પૂરા થાય છે, પણ કેટલીકવાર એવું પણ બને છે કે પ્રારબ્ધ ભોગ ટાળી શકતો નથી અને મનોરથ સિદ્ધ થતો નથી. રાજ હરિશ્ચંદ્ર, નળ, પાંડવ, રામ, મોરધવજ વગેરે મહાપુરુષોને દારુંશ ભાવિના શિકાર થવું પડ્યું હતું. તેટલા જ માટે સકામ ઉપાસના કરતાં નિષ્કામ ઉપાસના જ શ્રેષ્ઠ ગાણાય છે. ભગવાન શ્રીકૃષ્ણની જીતામાં નિષ્કામ કર્મયોગનો જ ઉપદેશ આપ્યો છે. સાધના કદી નિષ્ફળ જતી નથી, તેનું પરિશ્યામ તથા વાસ્તવિક હિતને આપણે સમજું શકતા નથી. માતા સર્વજ્ઞ હોવાથી બધું સમજે છે અને જાગે છે. તેથી એટલું અને એવું જ હણ આપે છે, જેમાં આપણું સાચું અને વાસ્તવિક હિત હોય. સાધનાકાળમાં એક જ કાર્ય થઈ શકે છે-કાં તો મન ભક્તિમાં તન્મય થઈ જાય અથવા કામનાઓની ભાવના કરતું રહે. મન કામનાઓમાં ભટકતું રહે તો ભક્તિ થતી નથી.

અને પરિશામે ધારેલો લાભ મળતો નથી. મનમાંથી કામનાઓને દૂર કરી દેવામાં આવે અને તેને ભક્તિપૂર્વક સાધનામાં તન્મય કરવામાં આવે તો સફળતાનો માર્ગ મોકળો થઈ જાય છે અને ઈષ્ટ મનોરથ સિદ્ધ થતાં વાર લાગતી નથી.

કોઈ એક યુવક બીજા યુવકને કુસ્તીમાં હરાવવા માટે વાયામ કરતો હોય અને પૌણિક ખોરાકથી શરીરને સુદૃઢ બનાવવાની તૈયારી કરતો હોય અને કદાચ એ કુસ્તીમાં હારી પણ જાય, છતાં પણ એણે મેળવેલી તકાત નિષ્ણળ જતી નથી. તેની પૂર્વતેયારીનો લાભ તો તેને મળશે જ. શરીરની સુદૃઢતા, મુખની કાંતિ, અંગોનો મરોડ, ફેફસાની મજબૂતાઈ, કાર્યક્ષમતા, દીર્ઘજીવન, બળવાન સંતાન વગેરે લાભો તો એના વિશેલા આરોગ્યથી તેને મળવાના જ. કુસ્તીમાં સફળતાન મળી એ જુદી વાત છે, પણ બળવૃદ્ધિથી મળન્તા બીજા લાભોથી તેને કોઈ વંચિત રાખી શકવાનું નથી. ગાયત્રીનો સાધક પોતાનો ઈષ્ટ મનોરથ સાધવામાં સફળ ન થઈ શકે તો પણ બીજા અનેક માર્ગોથી તેને એવા લાભો મળશે, જેની આશા સાધના કર્યા સિવાય શક્ય નહોતી.

બાળક જે ચીજે માગે છે એ બધી જ ચીજે માતા આપતી નથી. રોગીની બધી જ ઈચ્છાઓ બુદ્ધિમાન વૈદ્ય અથવા દાક્તર પૂરી કરતા નથી. ઈશ્વરની સર્વજ્ઞતાના પ્રમાણમાં માણસ, બાળક અથવા રોગી જેવો છે. જે અનેકવિધ કામનાઓ આપણે નિત્ય કરીએ છીએ, એ બધામાં કઈ કઈ આપણા સાચા હિતની છે અને કઈ કઈ આપણને નુકસાન કરનારી છે તે આપણે જાણતા નથી, પણ ઈશ્વર જાણે છે અને આપણને ઈશ્વરની દયા અને ભક્તિવત્સલતા પર વિશ્વાસ હોય તો કામનાઓની વાત સંદર્ભ તેની ઉપર છીડી દેવી જેઠીએ. એટલું જ નહીં, પણ આપણું સધણું ધ્યાન એકાગ્ર રીતે સાધનામાં લગાવી દેવું જેઠીએ. એમ કરવાથી આપણને નુકસાન નથી, તીવ્યાં સકામ સાધના કરતાં એમાં સારો લાભ થશે જ તેમાં શેંકા નથી.

આ ઈતિહાસની વાત છે. મહારાજ રામસિંહ મહાન રાજવી હતા. એક વખત શિક્ષાર કરવા જતાં નિર્જન નંગલમાં રસ્તો ભૂલી ગયા. ત્યાં તેમને એક અપરિચિત વનવાસીનો ભેટો થયો અને તેણે સુંદર આતિથ્ય કર્યું. રાજીએ થોડોક વખત પછી તેની લૂખીસૂકી રોટલીનો વિપુલ ધનરાશિથી બદલો આપ્યો. જો કદાચ પેલા વનવાસીએ ત્યાંને ત્યાં જ તેની રોટલીની કિમત મારી લીધી હોત તો એ મહારાજનો પ્રીતિપાત્ર ન બન્યો હોત. સકામ સાધના કરતા મતલબી ભક્તો કરતાં નિષ્કામ સાધકોની શ્રદ્ધા માતાને અધિક પ્રિય લાગે છે અને ફળ આપવામાં તે વધારે ઉદાર બને છે.

અમારો લાંબા વખતનો અનુભવ છે કે કદી પણ કોઈની ગાયત્રી સાધના નિષ્ણળ જતી નથી. તેનું તીવ્યાં પરિશામ પણ આવતું નથી. જરૂર માત્ર એક જ વાતની છે કે ધૈર્યપૂર્વક વિવેક અને એકાગ્રતાથી આગળ વધીએ. આમાં છીછરાપણાની નહિ, પણ સુદૃઢ અને બુદ્ધિપૂર્વકની તૈયારીની જરૂર છે. આ દિશામાં કરેલો સાચો પુરુષાર્થ બીજા કોઈ પણ પુરુષાર્થ કરતાં વધારે લાભદાયક સિદ્ધ થશે. ગાયત્રી સાધનામાં જેટલો સમય, શ્રમ, ધન અને મનોયોગ લાગે છે એ સર્વનું સાંસારિક દાણથી જે મૂલ્ય થાય તેનું અનેકગણું બનીને સાધકની પાસે કોઈ ને કોઈ રૂપમાં પાછું આવે છે એ બિલકુલ નિશ્ચિત છે.

## ૧૨. ગાયત્રીનો તંત્રોક્ત વામમાર્ગ

વામમાર્ગનો, તંત્રવિદ્યાનો આધાર પ્રાણમય કોશ છે. જેટલી શક્તિ પ્રાણમાં અથવા પ્રાણમય કોશમાં હોય તેટલી જ તંત્રોક્ત પ્રયોગોમાં કામ લાગી શકે છે. ઈશ્વરપ્રાપ્તિ, આત્મસાક્ષાત્કાર, જીવનમુક્તિ, અંત:કરણની શુદ્ધિ વગેરે કાર્ય તંત્રથી થઈ શકતું નથી. વામમાર્ગથી તો વૈજ્ઞાનિક યંત્ર દ્વારા સિદ્ધ થનારાં ભૌતિક કાર્યો જ સિદ્ધ થઈ શકે છે.

બંદુકથી કે એરી ઈન્નોકશનથી કોઈ પણ મનુષ્યને મારી શકાય છે. તંત્ર દ્વારા પણ અભિચાર કિયા કરીને બીજાનો પ્રાણ લઈ શકાય છે. જેમ નાની ચક્કલીને મારવા માટે મશીનગનની જરૂર પડતી નથી, તે તો નાની કંંકરી ગિલોલમાં મૂકીને મારવાથી પાંખો ફૂફડાવીને મરી જાય છે, તેવી જ રીતે નિર્જળ પ્રાણવાળા કમનેર, બીમાર, બાળક યા ડરપોક મનુષ્ય પર તો મામૂલી તાંત્રિક પણ સહેલાઈથી પ્રયોગ કરી શકે છે.

દારુ, ચરસ, ગાંઝે, અફીણ વગેરે નશાવાળી ચીજેનું પ્રમાણ શરીરમાં વધુ થઈ જવાથી મસ્તકની કિયાપદ્જતિ વિકૃત થઈ જાય છે. નશામાં મસ્ત થયેલ માણુસ સારી રીતે વિચારવા, સમજવા, નિર્ણય કરવા અને પોતાની ઉપર કાબૂ રાખવામાં અશક્ત બની જાય છે. એની વિચારધારા, વાગ્ની અને કાર્યમાં અસ્તયસ્તતા આવી જાય છે. નશાવાળી ચીજે વધુ પ્રમાણમાં બેવાથી ગાંઠપણ આવી જાય છે. તેવી જ રીતે તાંત્રિક પ્રયોગોથી એક એવો સૂક્ષ્મ નશાવાળો પ્રભાવ કોઈના પણ મસ્તકમાં દાખલ કરી શકાય છે. તેનાથી તેની બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. તીવ્ર પ્રયોગથી કપડાં ફૂડનારો પાગલ બની જાય છે અથવા હલકા પ્રયોગથી બુદ્ધિ ગુમાવી બેસીને મૂર્ખ એવો બની જાય છે.

કેટલીક એરી ઔષધીઓ એવી છે કે તેમનું સેવન કરવામાં આવે તો શરીરમાં ભયંકર મુશ્કેલી ઊભી થઈ જાય છે, જેમકે જાડા થઈ જવા, હેડકી, છીંક, બેશુદ્ધિ, ઊંઘ ના આવવી, ભ્રમ વગેરે અનેક રોગ થઈ જાય છે. આ જ રીતે તાંત્રિક પ્રયોગોમાં પણ એવી અનેક વિધિઓ છે, જેમના દ્વારા કોઈના શરીરમાં એરી પદાર્થ ઉત્પન્ન કરી શકાય છે.

વિજ્ઞાને રેઝિયો ક્રિયાની શક્તિથી પોતાની મેળે ડિડનાર “રેડાર બોમ્બ” નામનું એક એવું યંત્ર બનાવેલ છે કે જે કોઈ નક્કી કરેલા સ્થળે જઈને જ પડે છે. ફૂટ્યા, ધાત, મારણ વગેરેના અભિચારોમાં એવી જ સૂક્ષ્મ કિયા પ્રાણશક્તિના આધારે કરવામાં આવે છે. દૂર રહેતી વ્યક્તિ પર એ તાંત્રિક ‘રડાર’ પડીને લક્ષ્યનો નાશ કરી નાખે છે.

યુદ્ધના સમયમાં બોંબમારો કરીને બેતર, મકાન, કારખાનાં, ઉદ્યોગ, ઉત્પાદન, ટ્રેન, મોટર, સર્ક, પુલ વગેરનો નાશ કરવામાં આવે છે અને તેથી એ સ્થળના લોકો સાધન વિનાના બની જાય છે. તેમની શક્તિ અને ધન એ બોંબમારાને લીધે નાશ પામે છે અને થોડા જ સમયમાં તેઓ અસહાય બની જાય છે, તેવી જ રીતે તંત્રથી પણ કોઈના સૌભાગ્ય, વૈભવ અને શક્તિ-સામર્થ ઉપર પ્રયોગ કરવાથી તેમનો નાશ થઈ જાય છે અને લોકો નવાઈ પામે છે કે આ બધું અચાનક કેવી રીતે નષ્ટ થઈ જયું?

કપટી, અસૂસ અને બદમાશ લોકો છણકપટ અને કુચકની એવી જાળ બિછાવે છે કે તેમાં સમજદાર, માણુસો પણ ફ્લાઇને મૂર્ખ બને છે. મેસ્મેરિઝમ અને હિન્નોટિઝમથી માણુસના મસ્તકને અર્ધસંમોહિત કરી વશમાં કરી લઈને તે વ્યક્તિ પાસેથી મનધાર્ય કામ કરાવી શકાય છે. મેસ્મેરિઝમ કે તંત્રથી વંશ થયેલ માણુસ પ્રયોગ કરનારની ઈચ્છા પ્રમાણે વિચારવા અને કરવા લાગે છે. તેને જેવી પ્રેરણા અપાતી હોય તેવી જ તેની ઈચ્છા અને મનોવૃત્તિ થઈ જાય છે. મેસ્મેરિઝમ કરતાં તંત્રવિદ્યામાં અનેકગણી શક્તિ છે. તેના દ્વારા જે વ્યક્તિ પર ગુપ્ત રીતે બૌધ્ધિક વશીકરણની જાળ ફેંકવામાં આવે છે તે એક પ્રકારની સૂક્ષ્મ તંત્રમાં આવીને વશ થઈ જાય છે. ગુપ્ત પદ્યંત્ર દ્વારા જે કાંઈ કરાવવામાં આવે તે જ પ્રમાણે તેની બુદ્ધિ વિચારધારા ભૂલી

જય છે.

અભિચારી પુરુષ કેટલીયે સરળ સ્વભાવની લીઓ પર આ જતનો જદુ ચલાવે છે અને તેમને ભણ્ણ કરવામાં સફળ થઈ જાય છે. સીધી-સાદી, ચારિ-અશીલ અને સન્માન કરનાર દેવીઓ બીજાના વશમાં આવી જઈને પોતાની પ્રતિષ્ઠા, લોકલાન વગેરેને છોડીને એવું આચરણ કરે છે કે તે જેઈને નવાઈ લાગે છે કે એકાએક તેની બુદ્ધિ કેમ ઊલટું આચરણ કરવા લાગી? પરંતુ હક્કીકિતતમાં તે બિચારી નિર્દોષ હોય છે. તે બાજના પંજમાં ફસાયેલ પક્ષી કે વાધના મોંડામાં ફસાયેલ બકરીની જેમ જે તરફ ઘસડાવમાં આવે તેમ ઘસડાઈ જાય છે. આ જ રીતે દુરાચારિણી લીઓ કોઈ પુરુષ પર પોતાનો તાંત્રિક પ્રભાવ પાડીને તેની નાકમાં નાથ બાંધી ટે છે અને મન ચાહે તે રીતે તેને નચાવે છે. ધારી વેશયાઓને આ જતનો જદુ આવડતો હોય છે. તે એવાં પક્ષીઓ ફસાવી લે છે કે જે પોતાનું બધું જ ખોઈ બેસીને પણ તેની જળમાંથી ધૂટી શકતાં નથી. એ પક્ષીઓનું સ્વાસ્થ્ય, સૌંદર્ય અને ધન લૂંટી લઈને તેઓ પોતાના સ્વાસ્થ્ય, સૌંદર્ય અને ધનને વધારતી રહે છે.

તંત્રથી લીપુરુષ પરસ્પર એકબીજાની શક્તિને ચૂસે છે. એવી તાંત્રિક સાધનાઓ છે, જેનાથી પુરુષ પોતાની સહગામિની લીની જીવનશક્તિને, પ્રાણશક્તિને ચૂસીને પોતે પરિપુષ્ટ થઈ શકે છે. ઈડાની પ્રાણશક્તિ ચૂસીને પહેલવાન બનવાના અને બીજાના લોહીનું ઈનેકશન લઈને પોતાના શરીરને પુષ્ટ કરવાના અનેક દાખલાઓ હોય છે, પરંતુ સમાગમ દ્વારા સાથીની સૂક્ષ્મ પ્રાણશક્તિને ચૂસી લેવાના દાખલા પણ છે. તાંત્રિકતાની પ્રધાનતાવાળા મધ્યકાલીન યુગમાં મોટા માણસો આ આધારે જ અનેક લીઓ સાથે લગ્ન કરતા હતા અને રાણીવાસોમાં સેંકડો રાણીઓ રાખતા હતા.

આ પ્રક્રિયા લીઓ પણ અપનાવે છે. જદુગરણી લીઓ સુંદર યુવકોને ઘેટો, બકરો, પોપટ વગેરે બનાવી દેતી હતી તેવી કથાઓ સાંભળવામાં આવે છે. આને પોપટ કે બકરી બનાવવાનું મુશ્કેલ છે, છતાં હજુ પણ એવા પ્રસંગો જોવા મળે છે કે વૃદ્ધાઓ યુવકોને ચૂસે છે અને ઈચ્છા ન હોવા છતાં પણ યુવકો પોતાની પ્રાણશક્તિ ખોવા માટે લાચાર બને છે. તેથી એક પક્ષ બળવાન થાય છે અને બીજો પક્ષ પોતાની સ્વાભાવિક શક્તિથી દૂર રહીને દિવસે દિવસે અશક્ત થથો જય છે.

વામમાર્ગના પંચમકારોમાં પાંચમો મકાર ‘મૈથુન’ છે. અન્નમય કોશ અને પ્રાણમય કોશના મૈથુનથી આ મહત્વપૂર્ણ કાર્ય થાય છે. તેમાં અનેક ગુપ્ત, આંતરિક શક્તિઓના અનુલોમ-વિલોમ ક્રમથી આકર્ષણ-વિકર્ષણ, ધૂર્ણન-ધૂર્ણન, આંકુંચન-પ્રસરણ, પ્રત્યારોહણ, અભિવર્ધન, ઝાણીકરણ, પ્રત્યાવર્તન વગેરે સૂક્ષ્મ મૈથુન થાય છે અને તેથી લી-પુરુષોનાં શરીરોમાં પરસ્પર મહત્વની આપ-દે થાય છે. રતિક્રિયા એક ખૂબ જ સામાન્ય ક્રિયા દેખાય છે, પણ તેનું સૂક્ષ્મ મહત્વ ધારું જ છે. તે મહત્વને સમજુને ભારતીય ધર્મમાં સર્વસાધારણની સુરક્ષાનું, હિતોનું ધ્યાન રાખીને તે સંબંધમાં અનેક મર્યાદાઓ બાંધવામાં આવી છે.

મસ્તક, હદ્ય અને જનનેન્દ્રિય એ ત્રણ શરીરના શક્તિપુંજ છે. એ સ્થાનોમાં બ્રહ્મગ્રંથિ, વિષગ્રંથિ અને કુદ્રગ્રંથિ છે. વામમાર્ગમાં કાલી તત્ત્વથી સંબંધિત ડોવાને લીધે રુદ્રગ્રંથિની ન્યારે શક્તિસંચય કરવા માટે કૂર્મપ્રાણનો આધાર બનાવવાનો હોય છે ત્યારે મૈથુનથી શક્તિભંડાર ભેગો કરવામાં આવે છે. જનનેન્દ્રિયના પ્રભાવ કોત્રમાં મૂલાધાર ચક્ક, સ્વાધિષ્ઠાન ચક્ક, વજ-મેરુ, તડિત, કચ્છપ, સર્પિણી, રુદ્રગ્રંથિ, સમાન, કુકલ, અપાન, કૂર્મ, પ્રાણ, અલમ્બુધા, ડાકીની, સુધુમગ્ના વગેરેનાં સ્થાન રહેવાં છે. તેનું આંકુંચન-પ્રસરણ ન્યારે તંત્રવિદ્યાના આધારે થાય છે ત્યારે એ શક્તિ ઉત્પન્ન થાય છે અને તે શક્તિ બંને બાજુએ ઊલટી-સૂલટી ચાલી શકે છે. આ વિદ્યાના જાણકાર જનનેન્દ્રિયનો યોગ્ય રીતે પ્રયોગ કરીને ખૂબ લાભ ઉઠાવે છે, પરંતુ જે લોકો આ બાબતમાં અજાણ છે તેઓ સ્વાસ્થ્ય અને જીવનશક્તિ ગુમાવી બેસે છે. સામાન્ય રીતે રતિક્રિયામાં ક્ષય જ વધુ થાય છે. મોટા ભાગના લીપુરુષો તેમાં

પોતાની શક્તિ ગુમાવે છે, પણ તંત્રનાં ગુપ્ત વિધાનોથી અન્નમય અને પ્રાણમય કોશોની સુપ્ત શક્તિઓ જગાડી પણ શક્યા છે.

વામમાર્ગમાં ઇન્દ્રિયભોગની કૃત્રિમ વાસનાના રૂપમાં મેધુન કરવામાં આવતું નથી, પરંતુ શક્તિકેન્દ્રોના જગરણ અને મંથનથી ઇચ્છિત સિદ્ધિ માટે તેનો ઉપયોગ થાય છે. સાત પ્રાણોનું જગરણ અને એકની શક્તિનું બીજામાં પરિવર્તન, હસ્તાન્તરણ કરવા માટે તેનો ‘રતિ-સાધના’ ના રૂપમાં પ્રયોગ થાય છે. માનવ માટે પરમાત્માએ આપેલ આ ખૂબ જ મહત્વપૂર્ણ બેટ આ ‘રતિ’ અને ‘પ્રાણ’ ના પુંજને ઈશ્વરીય ભાવથી પરમ શ્રદ્ધાથી પૂજવામાં આવે છે. શિવલિંગની સાથે શક્તિયોગનિની મૂર્તિઓ ખાસ કરીને પૂજવામાં આવે છે તેમાં જનનેન્દ્રિયમાં રહેલી દિવ્ય શક્તિ પ્રયે ઉચ્ચ કોટિની શ્રદ્ધાનો સંકેત છે. હલકી વાસના માટે તેના પ્રયોગને હલકો જ માનવામાં આવે છે.

આ વિધાના સાર્વજનિક ઉદ્ઘાટનથી (તેનું વિધિવિધાન અત્રે રંજૂ કરવાથી) તેનો દુરુપ્યોગ થવાનો અને અનૈતિકતા ફેલાવાનો પૂરો ભય છે. તેથી તેને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવેલ છે. મારો ઉદ્દેશ્ય અહીં એ મહાશક્તિનો ફક્ત પરિચય કરાવવાનો જ હતો. ઉપરોક્ત પંજિઓમાં તંત્રમાં રહેલ શક્તિઓના સંબંધમાં થોડો પ્રકાશ પાડવાનું અહીં યોગ્ય છે.

કોઈ પણ અખ્રને આગળ પણ ચલાવી શકાય છે અને પાછળ પણ ચલાવી શકાય છે. શેરીમાંથી સ્વાદિષ્ટ મિષ્ઠાન બની શકે અને દારૂ પણ બની શકે છે. ગાયત્રી મહાશક્તિનો આત્મકલ્યાણ અને સાત્ત્વિક ઉદ્દેશ માટે ઉપયોગ થઈ શકે છે, તો તેનો તામસિક ઉદ્દેશ્યો માટે પણ ઉપયોગ થઈ શકે છે. ગાયત્રીનો દક્ષિણમાર્ગ પણ છે અને વામમાર્ગ પણ છે. દક્ષિણમાર્ગ-વેદોક્ત, સતોગુણી, સરળ, ધર્મમય અને કલ્યાણ કરનારો છે. વામમાર્ગ તંત્રોક્ત, તમોગુણી, દુસ્સાહસવાળો, અનૈતિક અને સાંસારિક ચમત્કારોને સિદ્ધ કરનાર છે.

ગાયત્રીના દક્ષિણમાર્ગની શક્તિના સ્તોત્રનું પરમ સતોગુણી ‘હી’ તત્ત્વ છે અને વામમાર્ગનું મહાતત્ત્વ ‘કલી’ કુન્દ્રમાંથી પોતાની શક્તિ પ્રાપ્ત કરે છે. પોતાના કે બીજાના પ્રાણનું મંથન કરીને તંત્રની તડિત શક્તિ ઉત્પત્ત કરવામાં આવે છે. રતિ અને પ્રાણના મંથન અને રતિકર્મના સંબંધમાં પાછલાં પૂછો પર થોડો પ્રકાશ પાડવામાં આવ્યો છે. બીજું મંથન કોઈ પ્રાણીના વધ દ્વારા થાય છે. મરતી વખતે પ્રાણીનો પ્રાણ મેધુનની નેમ જ ઉત્તેનિત, ઉદ્ધ્ર અને બ્યકુળ થાય છે. તે સ્થિતિમાં પણ તાંત્રિક લોકો એ પ્રાણશક્તિનો ધારો ભાગ ખેંચીને પોતાનો શક્તિભંડાર ભરી લે છે. નીતિ અનીતિનું ધ્યાન ન રાખનારા તાંત્રિકો પશુપક્ષીઓનું બલિદાન તે ઉદ્દેશ માટે જ આપે છે.

મૃત્યુ પામેલા મનુષ્યોનાં શરીરેમાં પણ થોડા સમય સુધી ઉપપ્રાણોનું અસ્તિત્વ સૂક્ષ્મ અંશમાં રહે છે. તાંત્રિક લોકો રમશાન ભૂમિમાં રમશાન જગાડવાની સાધના કરે છે. અધોરી લોકો શબ્દસાધના કરીને મરેલાઓની બચેલી શક્તિ ચૂસે છે. ધારી વખત એવું જોવા મળે છે કે અધોરી બાવા મરેલાની લાશ જમીનમાંથી ભોદીને લઈ જય છે. મરેલાની ખોપરીઓ એકઠી કરે છે. ચિતાઓ પર ભોજન પકાવે છે. તે બધું એટલા માટે કરવામાં આવે છે કે મૃત શરીરના અતિ સૂક્ષ્મ ભાગોની અંદર, ખાસ કરીને ખોપરીમાં જ્યાં ત્યાં ઉપપ્રાણોની પ્રસુત ચેતના મળી જય છે. દાણો દાણો વીળીને અનાજનો કોથળો ભરનાર કંન્જુસોની નેમ અધોરી લોકો હાડકાંઓ માંથી ફોસ્ફરસ મિશ્રિત ‘ધ’ તત્ત્વ મોટા પ્રમાણમાં એકઢું કરી લે છે.

દક્ષિણમાર્ગ ખેડૂત દ્વારા વિધિપૂર્વક ખેતી કરીને ન્યાયભર્યું અન્ન મેળવવા બરાબર છે. ખેડૂત પોતાના અન્નને ખૂબ જ સાવધાનીપૂર્વક વાપરે છે કેમકે તેમાં તેનો લાંબા સમયનો શ્રમ લાગેલો હોય છે, પણ ચોર લૂંટારાઓની સ્થિતિ એવી હોતી નથી. તે ખોટા સાહસથી ખુમલો કરે છે અને જો તેમાં સફળ થાય તો તે કમાણીને હોળીની નેમ ફૂકી દે છે. યોગી લોકો ચમત્કાર બતાવવામાં પોતાની શક્તિ ખર્ચતાં ખેડૂતની નેમ અચકાય છે, પણ તાંત્રિક લોકો પોતાનું ગૌરવ અને મોટાઈની ધાપ પાડવા માટે, હલકા સ્વાર્થ માટે બીજાઓને અયોગ્ય નુકસાન કે લાભ પહોંચાડે.

છે. અધોરી, કાપાલિક, રક્તબીજ, ભ્રસ્તરાક્ષસ, વૈતાલિક વગેરે તાંત્રિકોના અનેક સંપ્રદાયો છે. તેમની સાધનાપદ્ધતિ અને કાર્યપ્રણાલી જુદી જુદી હોય છે. સ્વીઓમાં ડાક્ઝિની, શાક્ઝિની, કપાલહુંડલા તથા સર્પસૂત્રા પદ્ધતિઓનો પ્રચાર વધુ જેવામાં આવે છે.

બંદૂકમાંથી ગોળી ધૂટતી વખતે પાછળ તરફ થોડો ધક્કો મારે છે. જે સાવધાનીથી છાતી ઉપર બંદૂકને સરખી રીતે રાખવામાં ન આવે તો તે એવા જોરથી અટકો મારે છે કે તે બંદૂક ચલાવનાર નીચે પડી જાય છે. કદીક તો ગળાની હાંસડી પણ તૂટી જાય છે. તંત્ર દ્વારા પણ બંદૂક જેવી તેજીની સાથે અવાજ થાય છે. જે સાધકની સ્થિતિ તેનો અટકો સહન કરવા યોગ્ય ન હોય તો તેને અંયકર મુશ્કેલીમાં મુકાઈ જરૂર પડે છે.

તંત્રનો શક્તિસોત દેવી કે ઈશ્વરીય શક્તિ નથી, પરંતુ ભૌતિક શક્તિ છે. પ્રકૃતિના સૂક્ષ્મ પરમાણુ પોતાની ધરી પર ઝડપી ગતિથી ભ્રમાળ કરે છે ત્યારે તેમના ધર્ષણાથી જે ગરમી ઉત્પન્ન થાય છે તેનું નામ કાલી કે દુર્ગા છે. તે ગરમીને મેળવવા માટે અસ્વાભાવિક ઊલટો માર્ગ ગ્રહણ કરવો પડે છે. પાણીનું વહેણ રોકવાથી એક શક્તિનો ઉદ્ભબ થાય છે. તાંત્રિક વામમાર્ગ પર ચાલે છે, પરિણામે કાલીશક્તિનો સામનો કરીને પોતાને એક તામસિક પંચભૌતિક બળથી બળવાન બનાવી દે છે. ઊલટો આહાર, ઊલટો વિહાર, ઊલટી દિનચરણ, બધું જ ઊલટું હોય છે. અધોરી, રક્તબીજ, કાપાલિક, ડાક્ઝિની વગેરેના સંપર્કમાં જે લોકો રહે છે, તે જાગે છે કે તેમનાં આચરણકેટલાં ઊલટાં, ધૂળિત અને બીજાંત્સ હોય છે.

ઝડપી ગતિથી એક ચોક્કસ દિશામાં દોડતી ટ્રેઇન, મોટર, નદી, વાયુ વગેરેની સામે આવીને તેમની ગતિને રોકવી અને તે વિરોધથી શક્તિ પ્રાપ્ત કરવી એ એક ખતરનાક ખેલ છે. સૌ કોઈ તેમ કરી પણ શકતા નથી, તેમકે પ્રતિરોધ વખતે ઝડપો લાગે છે. પ્રતિરોધ જેટલો સખત હશે તેટલો જ જબરદસ્ત ઝડપો લાગશે. તંત્રસાધકો જાગે છે કે જ્યારે ધમાલિયા વાતાવરણથી દૂર એકાંત ખેડોમાં, સ્મશાનોમાં અદ્ધી રાતે તેની સાધનાનો સમય આવે છે ત્યારે કેટલાક રોમાંચકારી ભય સામે આવે છે. આકાશે પહોંચી શકે તેવા રાક્ષસો, મોટા મોટા નાગ, લાલ આંખોવાળાં સુવર અને પાડા, ધરી જેવા દાંતોવાળા સિંહ વગેરે સાધકની આસપાસ જે રોમાંચકારી ભયકરતાથી જન્મનાઓ કરતાં રહીને કોલાહલ મચાવે છે અને હુમલો કરે છે તેનાથી ન ડરવું અને ન ઉગરવું એ કોઈ સાધારણ કામ નથી. સાહસના અભાવમાં આ વિરોધી ઊલટી કિયાથી સાધક જે ડરી જાય તો તેનો જીવ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તેવા સંજોગોમાં કોઈ તાંત્રિક પાગલ, મૂંગો, બહેરો અને આંધળો થઈ જાય છે. ધણાઓનું તો મૃત્યુ પણ થઈ જાય છે. આ માર્ગમાં હિંમતવાન અને નીડર પ્રકૃતિના મનુષ્યો જ સફળતા મેળવે છે.

તાંત્રિક સાધકોને જોખમી પ્રસંગોમાંથી પસાર થવું પરયું હોય એવા ધારા ધારા પ્રસંગો અને જાળીએ છીએ. ખાસ કરીને જ્યારે કોઈ સૂક્ષ્મ પ્રાણસત્તાને વશ કરવાની હોય છે ત્યારે તેની કિયા ધારી મુશ્કેલ હોય છે. સૂક્ષ્મ જગતરૂપી સમુદ્રમાં માછલીઓની જેમ થોડાં ચેતન પ્રાણીઓમાં, સ્વતંત્ર સત્તાઓનું અસ્તિત્વ જેવા મળે છે. જેમ સમુદ્રમાં અનેક જતની માછલીઓ હોય છે તેવી જ રીતે આ સત્તાઓ પણ અનેક સ્વભાવો, ગુણો તથા શક્તિઓથી સંપર્ન હોય છે. તેમને પિતૃ, યક્ષ, ગંધર્વ, કિન્નર, રાક્ષસ, ટેવ, દાનવ, ભ્રસ, વૈતાલ, કુદ્ધાંડ, બેરવ, રક્તબીજ વગેરે કહેવાય છે. તેમાંથી કોઈને પણ સિંહ કરીને તેની શક્તિથી પોતાનો ઉદ્દશ્ય સાધી શકાય છે, તેને સિંહ કરતી વખતે તે કરદાયેલા નાગની જેમ હુમલો કરે છે ત્યારે નબળા સાધકો માટે તે હુમલાને સહન કરવો મુશ્કેલ બને છે. એવી મુશ્કેલીમાં પડીને ધારી બ્યક્ઝિનો એટલી ભયભીત થતી અને ગભરાતી અમે જોઈ છે કે તેની છાતીની લોહી વહેનારી નાડીઓ ફાટી જઈને મોંહું, નાક તથા મળમાર્ગથી લોહી વહેવા લાગ્યું હતું. તેવા લોકોમાંથી ધારા લોકોનું મૃત્યુ પણ થયું છે. જે બચી જવા પામે છે તેઓનું શરીર અને મસ્તકુ વિકારવાનું થઈ જાય છે.

ભૂતોન્માદ, માનસિક ભ્રમ, આવેશ, અજાણ્યા આત્માઓ દ્વારા હુઃખ અપાવું, ખરાબ સ્વપનાં, તાંત્રિકના

અભિચારી આકમણ વગેરે કોઈ સૂક્ષ્મ પ્રક્રિયા દ્વારા ને વ્યક્તિ પીડાઈ રહી હોય તેને તાંત્રિક પ્રયોગથી રોકી શકાય છે અને તે પ્રયોગ કરનાર ઉપર જ સામો પ્રયોગ કરીને તે અન્યાચારની તેને મજા ચખાડી શકાય છે. એ જતનું કાર્ય દક્ષિણમાર્ગી (સાત્ત્વિક) ગાયત્રી ઉપાસનાથી પાણ થઈ શકે છે. અભિચારીઓ (પ્રયોગ કરનારાઓ) કે દુષ્ટો પર તાત્કાલિક સામું આકમણ કરવું એ તો તંત્ર દ્વારા જ શક્ય છે. પાણ હા, તેના પ્રયત્નોને વેદોક્ત સાધનાથી પાણ નિષ્ફળ બનાવી શકાય છે અને તેની શક્તિને આંચ્યુને ભવિષ્ય માટે તેમને ઝેર વિનાના નાગ નેવા અશક્ત બનાવી શકાય છે. તંત્ર દ્વારા કોઈ લી કે પુરુષની કામશક્તિનું અપહરણ કરીને તેમને નાસુંસ્ક બનાવી દેવામાં આવે છે, પાણ ખૂબ અસંયમીને દક્ષિણમાર્ગથી પાણ સંયમિત કરી શકાય છે. ખાસ કરીને તંત્રની શક્તિ મારક અને હુમલો કરનારી હોય છે, પાણ યોગથી શોધન, પરિમાર્જન, સંચય અને રચનાત્મક કાર્ય થઈ શકે છે.

તંત્રનું ચમત્કારિક આકર્ષણ ખૂબ હોય છે અને તેનાથી બીજા ઉપર હુમલો કરવો તો ખૂબ જ સરળ છે. કોઈને બીમારી, ગાંઢપાણ, બુદ્ધિભ્રમ, ઉચ્ચાટન કરી દેવું, મૃત્યુ જેવું હું ખ આપવું સહેલું છે. સૂક્ષ્મ જગતમાં ફરતી કોઈ ‘શેતના ગ્રંથિ’ને પ્રાણવાન બનાવીને તેની પાસે પ્રેત, પિશાચ, વેતાલ, લેરવ, કાર્ણપિશાચિની, છાયાપુરુષ વગેરેના રૂપમાં સેવકની જેમ કામ લેવું, દૂર દૂરના દેશોમાંથી અદ્ભુત ચીજે મંગાવવી, ગુપ્ત રાખેલી ચીજે અથવા અજાણી વ્યક્તિઓનાં નામ-ઠેકાણાં બતાવી દેવાં કે કોઈ વસ્તુનું રૂપ બદલી નાખવું પાણ તેને માટે શક્ય છે. આવાં અનેક નવાઈભર્યાં કાર્યો કરતાં જેઈને લોકો ખૂબ પ્રભાવિત થઈને તેની પૂજા પાણ ખૂબ કરવા લાગે છે, પરંતુ એ યાદ રાખવું જોઈએ કે આ વ્યક્તિઓનો જ્યોત (શક્તિનું અરાણું) પરમાણુમાં રહેલી ઉધ્ઘાટા (કાલી) જ છે. તે પરિવર્તનશીલ છે. જો થોડા દિવસ તેની સાધના બંધ રાખવામાં આવે કે પ્રયોગ છોડી દેવામાં આવે તો એ શક્તિ ઘટી જય છે કે સમાપ્ત થઈ જય છે.

તંત્રથી કેટલાક નાનામોટા લાલ પાણ થઈ શકે છે. કોઈના તાંત્રિક હુમલાને નિષ્ફળ કરીને કોઈ નિર્દોષને નુકસાનમાંથી બચાવી દેવો એ સદૃપ્યોગ જ છે. તાંત્રિક વિધિથી ‘શક્તિપાત’ કરીને પોતાની ઉત્તમ શક્તિઓનો થોડો ભાગ કોઈ નભળા મનવાળાને આપીને તેને આગળ વધારવો એ પાણ સદૃપ્યોગ છે. બીજા પાણ કેટલાક એવા પ્રયોગ છે કે નેને વિશેષ પરિસ્થિતિમાં ઉપયોગમાં દેવામાં આવે તો પાણ તે સદૃપ્યોગ જ છે, પરંતુ અસંસ્કૃત માણસ આ તમોગુણી શક્તિનો હેમશાં સદૃપ્યોગ જ કરશે તેનો કોઈ જ ભરોસો નથી. સ્વાર્થ સાધવાનો સમય આવતાં તેનો લોલ છોડવો એ કોઈ વીરલાઓનું જ કામ હોય છે.

તંત્ર ખુદ પોતે ખરાબ નથી. તે એક વિશુદ્ધ વિજ્ઞાન છે. વૈજ્ઞાનિક લોકો યંત્ર અને રાસાયણિક પદાર્થોની સહાયતાથી પ્રકૃતિની સૂક્ષ્મ શક્તિઓનો ઉપયોગ કરે છે. તાંત્રિક પોતાને એવી રાસાયણિક અને યાંત્રિક સ્થિતિમાં ઢાળી દે છે કે પોતાના શરીર અને મનને ખાસ રીતે સંચાલિત કરીને પ્રકૃતિની સૂક્ષ્મ શક્તિઓનો મનમાન્યો ઉપયોગ કરી શકે. આ વિજ્ઞાનનો વિદ્યાર્થી કોમળ પરમાણુઓવાળો અને સાહસિક પ્રકૃતિનો હોવો જોઈએ. કઠોર અને નભળા મનવાળા આ માર્ગમાં પ્રગતિ કરી શકતૂ નથી. પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ તાંત્રિક બનતી હોવાનું આ જ કારણ છે. શરૂઆતની નાની નાની સિદ્ધિઓ તો તેમને થોડાક પ્રયત્નથી પાણ મળી જય છે.

તંત્ર એક સ્વતંત્ર વિજ્ઞાન છે. વિજ્ઞાનનો સદૃપ્યોગ અને દુરુપ્યોગ પાણ થઈ શકે છે, પરંતુ તેનો આધાર અયોજ્ય અને ખતરનાક છે અને શક્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ અનેતિક અને અયોજ્ય છે. ઉપરાંત મળેલી સિદ્ધિઓ પાણ થોડાક સમય પૂરતી જ હોય છે. ખાસ કરીને તાંત્રિકો ખોટમાં જ રહે છે. તેમનાથી સંસારનું જેટલું સાંકું થઈ શકે છે તે કરતાં ખરાબ વધારે થાય છે. તેથી ચમત્કારી હોવા છતાં પાણ આ માર્ગને નિષ્પિદ્ધ અને ગુપ્ત માનવામાં આવેલ છે. બીજી અનેક તંત્રસાધનાઓ કરતાં ગાયત્રીનો વામમાર્ગ-તંત્રવિદ્યા ખૂબ શક્તિશાળી છે. બીજી બધી વિધિઓ કરતાં આ વિધિનો માર્ગ સરળ છે, તો પાણ નિષ્પિદ્ધ વસ્તુ તજવા યોગ્ય જ છે. માટે તેનાથી દૂર રહેલું જ યોગ્ય છે.

એમ તો તંત્રની કેટલીક સરળ વિધિઓ પાણ છે. અનુભવી માર્ગદર્શક તે મુશ્કેલ માર્ગને સરળ બનાવી શકે છે. હિંસા, અનીતિ અને ખરાબ કાર્યથી બચીને વ્યાવહારિક જીવનમાં ઉપયોગી હોય અને અનર્થથી બચીને સ્વાર્થ સધાતો રહે તે માટે સાધના કરી શકાય છે, પાણ આવા અનેક લાભો તો દક્ષિણમાર્ગી સાત્ત્વિક સાધનાથી પાણ મેળવી શકાય છે. જલદી લાભ મેળવવાનું પ્રલોભન છોડીને જે ધીરજથી સાત્ત્વિક સાધના કરવામાં આવે તો તેના લાભો પાણ ઓછા નથી. અમોદે બંને માર્ગોની લાંબી સાધના કરીને એ અનુભવ્યું છે કે દક્ષિણમાર્ગી સાત્ત્વિક સાધનાનો રાજમાર્ગ જ સોને માટે શ્રેષ્ઠ છે.

ગાયત્રી દ્વારા તંત્રવિદ્યા સાધવાનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે. સર્વવિદ્યા, પ્રેતવિદ્યા, ભવિષ્યનું જ્ઞાન, અદશ્ય વસ્તુઓને જોવી, પરકાયાપ્રવેશ, ધાત-પ્રતિધાત, દાયિબંધન, મારાણ, ઉન્માદીકરાણ, વશીકરાણ, વિચારસંદોહ, મોહન . . ., રૂપાંતરાણ, વિસ્મૃતિ, સંતાન-સુયોગ, ધ્યાયપુરુષ, જૈરવી, અપહરાણ, આર્કણું વગેરે એવાં અનેક કાર્ય થઈ શકે છે ને બીજી કોઈ તાંત્રિક ક્રિયાથી પાણ થઈ શકે છે, પરંતુ એ સ્પષ્ટ છે કે તંત્રની પ્રાણાલી સર્વોપયોગી નથી. તેના અવિકારી કોઈ વિરલા જ હોય છે.

દક્ષિણમાર્ગી, વેદોક્ત, યોગસંમત, ગાયત્રી સાધના ખેડૂત દ્વારા અને પક્વવાની નેમ ધર્મસંગત, કાયમી લાભ આપનારી અને લોકગરલોકમાં સુખશાંતિ દેનારી છે. વેદોક્ત સાધનાથી જે લાભ મળે છે તે જ આત્માને શાંતિ આપનાર, કાયમી રૂપથી ઉત્તી કરનાર અને મુશ્કેલીઓનો અંત લાવનાર છે. તંત્રમાં ચ્યમત્કર ખૂબ જ છે. વામમાર્ગથી આસુરી શક્તિઓ પ્રાપ્ત થાય છે. તેમની સંહારક અને હુમલો કરનારી શક્તિ ઘણી જ છે, પરંતુ તેથી કોઈનું ભલું થતું નથી. તાત્કાલિક લાભને ધ્યાનમાં રાખીને જે લોકો તંત્રના ચક્કરમાં પડે છે તે છેછે ખોટમાં જ રહે છે. તુચ્છ સ્વાર્થોમાંથી જેઓ ઊચા ઉંડે છે તે જ તંત્રવિદ્યાના અવિકારી બની શકે છે. પરમાણુ બોંબનું રહસ્ય અને પ્રયોગ સૌ કોઈને બતાવવામાં આવતા નથી, તેવી જ રીતે તંત્રની ખતરનાક જવાબદારી ફક્ત સત્પાત્રોને જ સોંપી શકાય છે.

### ૧૩. અનાદિ ગુરુમંત્ર ગાયત્રી

અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યમાં કેટલીક વિશેષતાઓ છે એને કેટલીક ઊણપો પાણ છે. સૌથી મોટી ઊણપ એ છે કે જ્યારે પશુપક્ષીઓનાં બચ્યાં બીજા કોઈની પાણ મદદ સિવાય પોતાની જીવનચ્યાણની સામાન્ય બાબતો પોતાની જાતે જ શીખી જય છે, ત્યારે મનુષ્યનું બાળક તેમ કરી શકતું નથી. તેને બીજાઓ તરફથી શિક્ષાણ આપવામાં ન આવે તો મનુષ્યમાં જે વિશેષતાઓ છે તે તેને પ્રાપ્ત થતી નથી.

કેટલાક દિવસ પહેલાની વાત છે કે દક્ષિણ આફિકનાં નંગલોમાં એક વરુ માદા મનુષ્યનાં બે નાનાં બાળકોને ઉપાડી ગઈ અને આશ્વર્થની વાત તો એ છે કે એ બાળકોનું ભક્તિશ્રદ્ધ કરી જવાને બદલે તેમને પોતાનું દૂધ પાઈને મોટાં કર્યાં. એ બાળકો મોટાં થયાં. એક દિવસ શિકારીઓનું એક ન્યૂથ વરુઓની તપાસમાં એ નંગલમાં આવી ચન્દ્રનું અને આવાં હિંસક પશુઓની વચ્ચે ઉદ્ઘરતાં બે માનવ બાળકોને સુરક્ષિત જોયાં. તેઓ તેમને પકડી ગયા. એ બાળકો વરુની માફક ચાલતાં હતાં, તેની માફક ગર્જના કરતાં હતાં, તેઓ બધું જ ખાતાં હતાં અને તેમની માનસિક સ્થિતિ વરુ જેવી બની ગઈ હતી, કેમકે નેવું તેઓએ જેવું તેવું જ શીખ્યાં અને તેઓ તેવાં જ બની ગયાં.

જ બાળક જન્મથી જ બહેરું હોય તે સાથે સાથે મૂંગું પાણ હોય છે, કેમકે બીજાના મોંમાંથી નીકળતા શર્દી સાંભળીને જ તેની નકલ કરે છે. કાન બહેરા હોવાને લીધે બીજાના શર્દી સાંભળી શકતા નથી અને તેથી નકલ કરવાનું અથડય બની જય છે. ધર્મ, સંસ્કૃતિ, રિવાજ, ભાષા, વેશભૂષા, શિષ્ટાચાર, આહારવિહાર વગેરે વાતો બાળક પોતાની આસપાસના લોકો પાસેથી શીખે છે. કદાચ કોઈ બાળકને જન્મથી જ એકલું રાખવામાં આવે, તો મનુષ્યને જરૂરી એવી બધી બાબતોથી તે વંચિત રહી જય તેમાં શંકા નથી.

પશુપક્ષીઓની સંતતિમાં એવું નથી. પક્ષીનું નાનું બચ્યું પકડી લેવામાં આવે તો એ માબાપ પાસેથી કાંઈ નહીં શીખે, તો પણ મોટું થયા પછી બીજાં પક્ષીઓ બનાવે છે તેવો એક સુંદર માળો પોતાને માટે બનાવી લેશે, પણ એકલું મનુષ્યનું બાળક ભાષા, ધર્મ, ફુષિ, શિલ્પ, સંસ્કૃતિ, શિષ્ટાચાર, લોકવ્યવહાર, શ્રમ, ઉત્પાદન વગેરે સર્વે બાબતોમાં કશી જ પ્રગતિ કરી શકશે નહીં. પશુઓનું બચ્યું જન્મથી જ ચાલતાં, હરતાં ને ફરતાં શીખી જાય છે અને માતાને ધાવી શકે છે, પણ મનુષ્યનું બાળક ધારા દિવસ પછી જ કાંઈક સમજ શકે છે. શરૂઆતમાં તો પણ ફેરવાનું, દૂધનું સ્થાન શોધવાનું પણ બની શકતું નથી અને માતાને પણ ઓળખી શકતું નથી. આ સર્વ વાતોમાં પશુઓનું બચ્યું વધારે ચતુર હોય છે.

માણસ કોરા કાગળ નેવો છે. કાગળ ઉપર શાહીથી લેવા અક્ષરો કાઢવા હોય તેવા નીકળી શકે છે. ફોટોઓફીની પ્લેટ પર જેવી છાયા પેરે છે તેવું જ ચિત્ર નીકળે છે. માનવીનું મસ્તક પણ કોરા કાગળ નેવું અથવા ફોટોઓફીની પ્લેટ નેવું જ છે. મનુષ્ય આજુભાજુના વાતાવરણમાંથી અનેક વાતો શીખે છે. તેના ઉપર જે વાતોનો વધારે પ્રભાવ પડતો હોય તેને એ પોતાના માનસકોત્રમાં ધારણ કરી લે છે. માણસ ભીની માટી નેવો છે. તેને જે આકાર આપવો હોય તેવા બીબામાં તેને મૂકવો જોઈએ. ઉચ્ચ કુટુંબમાં ઉછરતાં બાળકોમાં એવી જ વિશિષ્ટતાઓ હોય છે, જ્યારે હલકા કુટુંબનાં છોકરાઓમાં એવી જ કુદ્રતાઓ જેવા મળે છે.

આપણા દીર્ઘદિશા પૂર્વઝે મનુષ્યની આ નિર્બળતા સારી રીતે જાણતા હતા. તેમને બહુ સારી રીતે અભર હતી કે જે બાળક ઉપર શરૂઆતથી જ માનવોચિત સુધારાનો પ્રભાવ પાઢવામાં નહીં આવે તો પાછળથી તેનામાં સારા સંસ્કરોની આશા રાખવી વર્થ છે. સામાન્ય રીતે સર્વ માતાપિતા એટલાં સુસંસ્કારી નથી હોતાં કે જેઓ પોતાનાં બાળકોને સારા સંસ્કારો જ આપે અને ખરાબ ટેવોથી બચાવે. બીજું એ પણ છે કે કેટલાંક માબાપો બાળકોને બહુ જ લાડ અને પ્રેમ કરે છે અને તેથી તેઓ પોતાનાં બાળકોની કુટેવોને દેખી શકતાં નથી. તેઓ ખૂબ ઉદાર અને મોહગ્રસ્ત બની જાય છે. એવાં સૂક્ષ્મદર્શી માબાપો ક્રાંતિ છે, જેઓ પોતાનાં બાળકોની માનસિક દશાનું સૂક્ષ્મ નિરીક્ષાળ કરે, તેનું પૃથક્કરણ કરે અને જો કુસંસ્કારો હોય તો તે દૂર કરે?

## સારા શિક્ષાળની આવશ્યકતા

મનુષ્ય બીજાઓ પાસેથી જ બધું શીખે છે એ તેની નિર્બળતા તેના ઉચ્ચ વિકાસની અવરોધક છે, કેમકે સામાન્ય વાતાવરણમાં સારાં તત્ત્વોને બદલે ખરાબ તત્ત્વો જ વધારે પ્રમાણમાં હોય છે અને એ ખરાબ તત્ત્વોમાં એવું આકર્ષણી હોય છે કે કાચા મગજનો માણસ સહેલાઈથી તેમાં તણાઈ જઈ શકે. પરિણામે આગળ જતાં તેની જાણતરી બૂરા માણસ તરીકી થાય છે. નાની ઉમેરમાં એ કેવા સંસ્કારો ગ્રહણ કરે છે એ કહી શકતું નથી અને મોટી ઉંમરે જ્યારે સંસ્કારો અને સ્વભાવ પ્રકટ થાય છે ત્યારે નબળા અને ખોટા સંસ્કારો લાંબા વખતથી દઠ થયેલા હોઈ તેમને દૂર કરવાનું મુશ્કેલ બની જાય છે.

આ સર્વ મુશ્કેલીઓ અને માનવીય નિર્બળતાઓનો જ્યાલ રાખીને આપણા ઋષિઓએ બહુ જ દુરેદેશી વાપરીને એક ધારો જ મહત્વનો અને સુંદર રસ્તો નિર્માણ કર્યો. તેમણે નક્કી કર્યું કે પ્રત્યેક બાળકને પોતાનાં માબાપ ઉપરાંત એક એવી વ્યક્તિના નિયંત્રણ નીચે રાખવું જોઈએ કે જે મનોવિજ્ઞાનની સૂક્ષ્મતાઓનો જાતા હોય, દીર્ઘદિશા હોય, તત્વજ્ઞાની હોય, પારદર્શી હોય, બાળકનો સ્વભાવ ઓળખી તેમાં જોઈતો સુધારો કરવાની શક્તિવાળો હોય. બાળકના સુંદર અને એકધારા વિકાસ માટે આવા નિયામકની ખાસ જરૂર છે તેવું આપણા સમાજદારોએ નક્કી કર્યું છે.

શાસ્ત્રોમાં કહેવાયું છે કે મનુષ્યના જ્ઞાન પ્રત્યક્ષ દેવો હોય છે. (૧) માતા, (૨) પિતા, (૩) ગુરુ. તેમને ભ્રમા,

વિષગુ અને મહેશની ઉપમાઓ આપી છે. માતા જન્મ આપે છે, માટે બ્રહ્મા છે. પિતા પાલન કરે છે, માટે એ વિષગુ છે. ગુરુ કુંસસ્કારોનો નાશ કરે છે, માટે મહેશ છે. ગુરુનું સ્થાન માતા અને પિતાની બરોબરીનું છે. કોઈ એમ કહે કે હું માતા સિવાય પેદા થયો છું, તો તે વાત જૂઠી છે, કેમકે માતાના ગર્ભમાં રહ્યા સિવાય એ જન્મ લઈ શકતો નથી. કોઈ એમ પણ કહે છે કે મારે પિતા નથી, તો તે પણ જૂઠી વાત છે. તેને આપણે વાર્ષસંકર કહીશું, કેમ કે જેના બાપનો પત્નો નથી તેવું બાળક તો વેશયાઓને ત્યાં જ જન્મે અને કોઈ એમ કહે કે મારો કોઈ ગુરુ નથી, તો જાણવું કે એ અસભ્ય અને અસંસ્કારી છે, કારણ કે જેના માનસિક વિચારો, સ્વભાવ, જ્ઞાન અને ગુણ તથા કર્મો ઉપર કોઈ દૂરદર્શીસમાજદાનું નિયંત્રણ નથી, તેના સ્વભાવનો શો ભરોસો? આવી અસભ્ય અને અસંસ્કારી વ્યક્તિને નગુરો કહી છે. નગુરાનો અર્થ ગુરુ વિનાનો એવો થાય છે. કેટલાક સમય પૂર્વે નગુરો વાર્ષસંકરની માફક ગાળવાચક શબ્દ ગણાતો હતો.

માતા વિનાનો, પિતા વિનાનો અને ગુરુ વિનાનો કોઈ મનુષ હોઈ શકે એ વાત જ પ્રાચીનકાળમાં અશાય ગાળાતી હતી, કારણ કે ભારતીય સમાજમાં માનવીના સુસંબંધ વિકાસ માટે જીવિઓની અનિવાર્ય વ્યવસ્થા હતી કે પ્રત્યેક આયને ગુરુ હોવો જ જોઈએ કે જેથે એ મહાન પુરુષ બની શકે. એ કાળમાં પ્રત્યેક માતાપિતાને પોતાનો બાળક મહાપુરુષ બને તેવી અભિવાધા રહેતી હતી. એટલા માટે એ જરૂરી હતું કે બાળક પ્રથમ કોઈ મહાન અને વિદ્વાન આચાર્યનો શિષ્ય બને.

એ કાળમાં ગુરુકુળ ગ્રાળાલી પ્રચલિત હતી. શિક્ષણ લેવા યોગ્ય વય થતાં જ બાળકને જીવિઓના કોઈ આશ્રમમાં મોકલી આપવામાં આવતો હતો. રાજ-મહારાજાનાં સંતાનો પણ આવા ગુરુકુળમાં કઠોર જીવન જીવતાં હતાં કે જેથે કુશળ નિયંત્રણમાં રહીને તેઓ સારા સંસ્કારો પામે અને આગળ જતાં માનવતાના ગૌરવની રક્ષા કરનાર મહાપુરુષ બને.

હું અમુક આચાર્યનો શિષ્ય છું એ વાત ધારણ ગૌરવથી કહેવામાં આવતી હતી. પ્રાચીન પ્રથા પ્રમાણે જ્યારે કોઈ મનુષ બીજા કોઈને પોતાનો પરિયય આપતો ત્યારે કહેતો કે હું અમુક આચાર્યનો શિષ્ય, અમુક પિતાનો પુત્ર, અમુક ગોત્રનો વંશજ અને અમુક નામની વ્યક્તિ છું. સંકલ્પો કરવામાં, પ્રતિશાઓ કરવામાં, સાક્ષીમાં, રાજદરબારમાં જ્યાં જ્યાં પરિયય આપવાનો હોય ત્યાં ત્યાં આ જ ધોરણ પ્રચલિત હતું

## મનોભૂમિનું શુદ્ધિકરાગુ

બગીચાને જો સુંદર બનાવવો હોય તો તેને માટે કોઈ કુશળ માળીની નિમાણુંક કરવી જોઈએ. જ્યારે જ્યારે જરૂર હોય ત્યારે બગીચાને પાણી પાવું, વધારે પાણી હોય તો કાઢી નાખું, વખતોવખત બગીચાને ગોડ મારવો, નીંદવું, ખાતર નાખવું, પણુંથી તેનું રક્ષણ કરવું વગેરે વગેરે કામો માટે માળી હંમેશાં જ્ઞાગ કહે છે અને પરિગુમે બગીચો ફણક્ષુલથી ભરેલો, લીલા હરિયાણા ધાસથી થોભતો અને ઊરીને આંખે વળજે ટેટલો સુંદર લાગે છે.

મનુષનું મગજ એક બગીચો છે. તેમાં જત જાતના મનોભાવ, વિચાર, સંકલ્પ, ઈચ્છા, વાસના, યોજના રૂપી વૃક્ષો અને છોડવાઓ ઊગે છે. તેમાં કેટલાક ઉપયોગી હોય છે, બીજા કેટલાક નિરુપયોગી હોય છે. બગીચામાં જાડીઝાંઝરાં પણ આપમેળે ઊગી નીકળે છે અને તેમની સંખ્યા વધી જય તો આખા બગીચાને નષ્ટ કરી દે છે. તેટલા માટે માળી તેમને કાપી નાખે છે અને દૂર દૂરથી પણ સારાં બીજા લાવીને વાયા કરે છે. ગુરુ પોતાના શિષ્યના મગજ રૂપી બગીચાનો માળી છે. તે એમાંથી જાડીઝાંઝરાં જેવા નકામા સંકલ્પો, સંસ્કારો, આકર્ષણ અને પ્રભાવો ઉખાડી નાખે છે અને પોતાની બુદ્ધિ, દીર્ઘદિન અને ચતુરાઈથી એવાં સંસ્કારરૂપી બીજ વાવે છે કે જેથી મગજરૂપી બગીચો બહુમૂલ્ય બની જય.

કોઈ વ્યક્તિ એમ જ વિચાર કરતી હોય કે હું પોતે આત્મનિર્માણ કરીશ. હું પોતે જ સુસંસ્કારી બનીશ અને તેથી મારે ગુરુની જરૂર નથી, તો તેવું બની શકે તેમ છે. આત્મામાં અનંત શક્તિ છે. પોતાનું કલ્યાણ કરવાની તેનામાં સંપૂર્ણ તકાત છે, પરંતુ એવો પ્રયત્ન કરવામાં કોઈ વિરલ વ્યક્તિ જ સહ્ફળ થાય છે. સર્વસાધારણને માટે આ વાત કષસાધ્ય છે. પોતાના દોષ પોતાને દેખાતા નથી.

કોઈ બીજા માણસની અથવા દર્પશુણની સહાયતાથી જ આપણે આપણી આંખો પણ જોઈ શકીએ છીએ. ન્યારે કોઈ વૈદ અથવા ડોક્ટર બીમાર પડે છે ન્યારે તે પોતે પોતાનો ઈલાજ નથી કરતો કારણ કે પોતાની નાડી જોવાનું અને પોતાનું નિધાન કરવાનું ઘણું અધંકું હોય છે. એટલા જ માટે તેની ચિકિત્સા બીજા વૈદ અથવા ડોક્ટર પાસે કરાવવી પડે છે.

કોઈ સારી વ્યક્તિ પણ આત્મનિરીક્ષણમાં સહ્ફળ થતી નથી. આપણે બીજાઓની જેવી આલોચના કરી શકીએ, બીજાઓને જેવી સાચી સલાહ આપી શકીએ, તેવી આપણે પોતાને માટે કરી શકતા નથી, કારણ કે આપણે આપણે પોતાનો જ નિર્ણય કરી શકતા નથી. કોઈ અપરાધી એવો નથી, જેને કદાચ મેન્જિસ્ટ્રેટ બનાવી દેવામાં આવે, તો તે પોતાના અપરાધ માટે સાચો ફેસલો લખે. નિષ્પક્ષ ફેસલો કરાવવો હોય તો બીજા કોઈને જ તરફે નિયુક્ત કરવો જોઈએ. આત્મનિર્માણનું કાર્ય પણ એવું જ છે કે જેને માટે બીજા સુધોણ્ય સહાયકની, ગુરુની આવશ્યકતા હોય છે.

સાચા બૌદ્ધિક વિકાસ માટે ભારતીય ધર્મ પ્રમાણે ગુરુની જરૂરિયાત માનવામાં આવી છે, જેથી મનુષ્યની વિચારધારા, સ્વભાવ, સંસ્કાર, ગુણ, પ્રકૃતિ, ટેવો, ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓ વગેરેનો પ્રવાહ ઉત્તમ દિશામાં રહેતો રહે અને મનુષ્ય પોતાનામાં સંતુષ્ટ રહી પ્રસત્ત, પવિત્ર અને પરિશ્રમી બને અને બીજાઓને પોતાની ઉદારતા અને સાચા વચ્ચારથી સુખ પહોંચાડે. આવા સુસંસ્કારી મનુષ્યો જે સમાજમાં અને દેશમાં અધિક સંખ્યામાં હશે તે દેશ અને સમાજ નિશ્ચયપૂર્વક સુખશાંતિમાં, સારી વચ્ચાસ્થામાં, અરસપરસના સહયોગમાં અને પ્રેમમાં બહુ જ આગળ વધેલો હશે. આપણે પૂર્વ ઈતિહાસ તેની સાક્ષી પૂરે છે કે સારા સંસ્કારવાળા ભારતીય મહાપુરુષોએ કેવાં મહાન કાર્યો કર્યા હતાં અને સ્વર્ગને પૃથ્વી પર કેવી રીતે ઉત્તર્યુ હતું.

આપણા ગૌરવવંતા ભૂતકાળના પાયામાં ઝાંખિઓની દીઘદિશાઓએલિ છુપાયેલી છે, જેને અનુસરીને પ્રત્યેક ભારતીયને પોતાની માનસિક વિશુદ્ધિ માટે કોઈ ઉચ્ચ ચારિત્ર્યવાળા, આદર્શવાદી, તીવ્ર બુદ્ધિવાળા અને વિદ્વાનના નિયંત્રણમાં રહેવાનું ખાસ જરૂરી હતું. જે માણસ આવી માનસિક શુદ્ધિ માટે આનાકાની કરતો હોય તેને નગુરાની ગાળ આપવામાં આવતી હતી. નગુરાનો અર્થ લગભગ બાપ વિનાનો અથવા વાર્ગસંકર એવો થતો હતો. ધન કમાવું, વિદ્યા ભાગવી, શસ્ત્રો ચલાવવાં એ બધાં કામો જરૂરી હતાં, પણ માનસિક શુદ્ધિની તોબે તો કોઈ આવે જ નહીં. એ તો સૌથી વધારે જરૂરી છે, કારણ કે સંસ્કારહીન મનુષ્ય સમાજમાં શાપરૂપ બની રહે છે. પછી ભલેને તેની પાસે અનેકગણી ભૌતિક સંપત્તિ હોય. ત્રણ પ્રત્યક્ષ પૂણ્ય દેવોમાં ગુરુને સ્થાન આપવામાં આવું છે તે એટલા જ માટે આપાયું છે.

## દુષ્પિત વાતાવરણનો પ્રભાવ

આને એ પ્રથાનો નાશ થઈ ગયો છે. ગુરુ કહેવાવવાની અધિકારી વ્યક્તિઓ મળવી મુશ્કેલ છે. જેનામાં ગુરુ બનવાની યોગ્યતા છે તે પોતાના વ્યક્તિગત, આત્મિક કે ભૌતિક લાભો મેળવવામાં પડ્યા છે. લોકસેવા અને રાષ્ટ્રનિર્માણની રચનાત્મક પ્રવૃત્તિ તરફ, સુસંસ્કૃત બનાવવાની જવાબદારી માયે લેવા તરફ તેઓનું ધ્યાન નથી. તેઓ એમાં થોડો લાભ, વધુ મુશ્કેલી અને ભારે બોજી છે એવું સમજે છે. તે કરતાં બીજા સરળ ઉપાયોથી વધુ ધન અને પણ

ક્રમાઈ લેવાના અનેક માર્ગ જ્યારે સામે આવે છે ત્યારે ગુરુની મહાન જવાબદારી માથે લેવાની છોડી દે છે.

ત્યારે બીજી બાજુ જેનામાં જ્ઞાન, અનુભવ, વિવેક વગેરે કાંઈ પણ નથી તેવા અયોધ્ય લોકો, જેનામાં બીજાને સુસંસ્કારી બનાવવાની શક્તિ તો દૂર રહી, પણ જે પોતાને પણ સુસંસ્કારી અને યોગ્ય બનાવી શકતા નથી તેવા લોકો પગ પૂજાવવા અને દક્ષિણા લેવાના લોભમાં કાનમાં મંત્ર ફૂંકવા લાયા. ખુશામદ, ગરીબી અને બિક્ષાવુતિનો સહારો લઈને શિષ્યોની તપાસ કરવા લાયા. તેથી ગુરુત્વની પ્રતિષ્ઠા-ગુરુનું માહાત્મ્ય નાશ પામ્યું છે. જે કામને કુપાત્ર લોકો હથમાં લઈ લે છે તે સાચું કામ પણ બદનામ થઈ જય છે અને જે સામાન્ય કામને સારી વ્યક્તિ કરવા લાગે તો તે સાચું થઈ જય છે. ગાંધીજી નેવા મહાપુરુષના હાથનો ચરખો ગરીબ-હુદ્દીઓના હાથમાં પહોંચી જતાં યજ્ઞ બની જય છે. ઝાંખિઓના હાથમાં જ્યાં સુધી ગુરુત્વ હતું તાં સુધી તેની પ્રતિષ્ઠા-માહાત્મ્ય રહ્યું, પણ આને કુપાત્ર, બિખારી અને કુદ્ર લોકો ગુરુ બનવાનું ખોટું સાહસ કરવા લાયા છે, તેથી એ ગુરુનું મહાન પદ જ બદનામ થઈ ગયું. આને સમાજમાં બધે જ ગુરુ કે ગુરુધંટાલ શબ્દનો ઉપયોગ કોઈ પાપી કે ધૂતારા માટે કરવામાં આવે છે.

લોકોએ જેયું કે એક માણસ દક્ષિણા લે છે અને પગ પણ પૂજાવે છે, છતાં તેનાથી કોઈ જતનો લાભ થતો નથી ત્યારે એ નકામી માથાકૂટને દૂર કરવી જ યોગ્ય માનવાના કારણે ગુરુ શિષ્યની પરંપરા દૂર થવા લાગી અને ધીમે ધીમે તેનો નાશ થવા લાગ્યો અને એ બરાબર પણ છે. કોઈ ઉદ્દેશ્ય વિનાની, પ્રાણવિહીન, બિનજરૂરી અને ખર્ચળ પરંપરા લાંબો સમય ચાલી શકતી નથી. જે ગુરુની જરૂરિયાત સમજે છે અથવા તો નગુરો ગાણવામાં પોતાનું અપમાન સમજે છે તેવા ખૂબ થોડા જ માણસો રહ્યા છે.

આજના દૂષિત વાતાવરણે બધી બાબતોમાં ગરબડ કરી દીધી છે. અસલી સોનું થોડું છે, પણ નકલી સોનું અઢળક પ્રમાણમાં તૈયાર થઈ રહ્યું છે. અસલી ધી મળવું મુશ્કેલ છે ત્યારે નકલી વેજુટેબલ ધીની દુકાનોની લાઈન લાગે છે. અસલી જવેરાત થોડું છે, પણ નકલી મોતી અને નકલી રતનો દગ્ગલાંખ વેચાય છે, તેમ છતાં પણ અસલી ચીજોનું મહત્વ ઓછું થયું નથી. લોકો વનસ્પતિ ધી ખૂબ ખરીદ-વેચે છે, પણ અસલી ધીની ઉપયોગિતા ઓછી થઈ નથી. નકલી રતનો ધારું વેચાય છે, છતાં પણ અસલી સોનું, અસલી રતન વગેરે નકામાં બની જતાં નથી. બેળસેળ, નકલ, દગાબાળ અને કગણી હોવા છતાં પણ સાચી વસ્તુની રતિભર પણ કિમત ઘટતી નથી, ઊલટી વધે જ છે.

વ્યક્તિ દ્વારા વ્યક્તિનું નિમાણ એ એક સત્ય છે કે જે આજની વિષમ સ્થિતિમાં તો શું, પણ ખરાબમાં ખરાબ સ્થિતિમાં પણ ખોટું સાબિત થઈ શકતું નથી. રોટલી બનાવવી હોશે તો લોટ, પાણી અને અભિની જરૂર પડશે જ. તે અનિવાર્ય જરૂરિયાતમાં કોઈ જ તફાવત પડતો નથી. સારા માણસ, સાચા માણસ, સદ્ગુહસ્થ તથા સુખી માણસના સર્જન માટે એ જરૂરી છે કે સારા, સુયોગ અને દૂરદર્શી મનુષ્યો દ્વારા આપણાં મસ્તકોનું નિયંત્રણ, સુધારો, નિમાણ અને વિકાસ કરવામાં આવે. માણસ કોરા કાગળ જેવો છે. તે જેવો પ્રભાવ ચખાણ કરશે, જેવું શીખશે તેવું જ કરશે. સાથે સાથે એ પણ ચોક્કસ જ છે કે જે શરૂઆતની અવસ્થામાં પ્રયત્નપૂર્વક સદગુણ શીખવવામાં નહિ આવે તો તે ખૂબ રાઈ તરફ જ જશે. જે ખૂબ રાઈથી બચવું હોય તો બલાઈની સાથે સંબંધ બાંધવો જરૂરી છે. મનુષ્યનું મન ખાલી રહી શકતું નથી. જે તેને બલાઈનો પ્રકાશ નહિ મળે તો તેને ખૂબ રાઈના અંધકારમાં રહેવું પડશે.

### શિક્ષણ અને વિદ્યાનું મહત્વ

મનુષ્યને લાયક બનાવવા માટે તેના મનને બે પ્રકારે ઉચ્ચત બનાવવામાં આવે છે. (૧) શિક્ષણ મારફત, (૨) વિદ્યા મારફત. શિક્ષણની અંદર એ સર્વ વાતો આવે છે, જે શાળામાં, કોલેજેમાં, ટ્રેનિંગ કેમ્પોમાં, હાટબજરમાં, ધરમાં, દુકાનમાં, સમાજમાં શીખવવામાં આવે છે. ગણિત, ભૂગોળ, ઇતિહાસ, ભાષા, શિલ્પ, વ્યાયામ, રસાયાણ,

શિક્ષિત્સા, વ્યાપાર, કૃષિ, સંગીત, કલા વગેરે થીખીને માણસ વ્યવહારકુશળ, ચતુર, લોકપ્રિય, કમાઉ અને શક્તિસંપત્ત બને છે. વિદ્યા મારફતે મનુષ્યની મનોભૂમિનું નિર્માણ થાય છે. મનુષ્યની ઈચ્છા, ભાવના, શ્રદ્ધા, માન્યતા, તુચ્છ તથા ટેવોને ઉત્તમ બીબામાં ઢાળવાનું કામ વિદ્યાનું છે. ચોરાશી લાખ યોનિઓમાં ફરતાં ફરતાં જે પાશવી સંસ્કારો મનમાં જામી ગયા હોય તેમની શુદ્ધિ કરવાનું કામ વિદ્યાનું છે.

શિક્ષક શિક્ષાણ આપે છે. શિક્ષાણનો અર્થ સામાજિક જ્ઞાન તેવો થાય છે. વિદ્યાનો અર્થ છે મનોભૂમિનું શુદ્ધિકરણ અને સુવ્યવસ્થા. શિક્ષાણ અગત્યનું છે, પણ વિદ્યા તેથી પણ વધારે અગત્યની છે. મનોભૂમિ દૂષિત હોય અને છતાં સાંસારિક સંપત્તિ વધે તો પરિણામ ઘણું ભયંકર આવે છે. આજના કાળમાં લક્ષ્મીની, ચતુરાઈની, શિક્ષાણની, વિજ્ઞાનની ઉત્ત્રતિ બહુ જ થઈ છે, પણ સ્પષ્ટ છે કે આ ઉત્ત્રતિની સાથે સાથે આપણે સર્વનાશ તરફ ધસડાઈ રહ્યા છીએ. ઓછાં સાધન હોવા છતાં પણ વિદ્યાવાન માણસ સુખી રહી શકે છે, પણ બોલ્દિક તથા સાંસારિક શક્તિઓ હોવા છતાં દૂષિત મનોભૂમિવાળો મનુષ્ય પોતાને માટે પણ વિપત્તિ, વિંતા, કવેશ અને મુશ્કેલી જ ઊભી કરશે. એટલા જ માટે શિક્ષાણ ઉપર નેટલો ભાર મૂકવામાં આવે છે તેના કરતાં અનેકગાણું વધારે લક્ષ વિદ્યા પર અપાવું જોઈએ.

આને આપણાં બાળકોને ગ્રેનયુએટ બનાવવા માટે આપણે મબલખ પૈસા ખર્ચીએ છીએ, પણ તેમની આંતરિક ભૂમિકા શુદ્ધ અને સુવ્યવસ્થિત કરવા માટે શિક્ષાણનો કોઈ પ્રબંધ કરતા નથી, પરિણામે ઊંચું શિક્ષાણ પ્રાપ્ત કર્યા પછી પણ બાળક પોતાના પ્રત્યે, પોતાના પરિવાર પ્રત્યે, પોતાના સમાજ પ્રત્યે તેની કોઈક ફરજ છે એમ સમજતો નથી. કોઈ પણ દિશામાં તેની પ્રગતિ એવી નથી, નેથી આપણે પ્રસત્ર થઈએ. સાંસારિક શિક્ષાણની સાથે તેનામાં જે અનેક દુર્ગુણો આવે છે તેનાથી તેની કમાળી બરબાદ થઈ જાય છે.

આપણા પૂર્વને આ સત્યને સમજતા હતા અને તેઓ જાણતા હતા કે શિક્ષાણ કરતાં વિદ્યાનું મહત્વ વધારે છે. એટલા જ માટે તેઓ નાની વયમાં જ બાળક ઉપર ગુરુનું નિયંત્રણ સ્થાપી દેતા હતા. ગુરુઓ પોતાનું ગંભીર જ્ઞાન, વિજ્ઞાન અનુભવ, સૂક્ષ્મદર્શી વિવેક અને ઉન્નત્વળ ચરિત્ર દ્વારા શિષ્ય ઉપર પ્રભાવ પાડીને તેની મનોભૂમિનું નિર્માણ કરતા હતા. પોતાની પ્રચંડ શક્તિનાં કિરણો દ્વારા તેના અંતઃકરણમાં એવાં બીજા રોપી દેતા હતા કે જે ફૂલીક્ષાલીને વજ્જિને મહાપુરુષ બનાવી દે.

## ગાયત્રી દ્વારા દ્વિજનત્વની પ્રાપ્તિ

આપણા ભારતીય ધર્મ પ્રમાણે પ્રયેક ભારતીય માટે ગુરુની આવશ્યકતા છે. જેમ ઈશ્વર પ્રત્યે, શાસ્ત્રો પ્રત્યે, ભારતીય આચાર પ્રત્યે, ઝિવિઓ અને દેવતાઓ પ્રાને આસ્થા અને આદરભુલિ હોવી પ્રયેક ભારતવાસી માટે જરૂરી છે તેવી જ રીતે એ પણ જરૂરી છે કે તે નગરો ન હોય. જે તેના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી થાય તેવા કોઈ સુયોગ્ય સત્પુરુષનું માર્ગદર્શન તેને હંમેશાં મળવું જ જોઈએ.

સાચા ભારતીય ધર્મનુયાદીને દ્વિજ કહે છે. બેવાર જેનો જન્મ થયો છે તેને દ્વિજ કહે છે. માતાપિતાના રન્વીધી એકવાર બધાનો જન્મ થાય છે. આવી રીતે જન્મ લેવાથી કોઈ મનુષ્ય પ્રતિષ્ઠિત આર્થ બની શકતો નથી. ફક્ત જન્મ માત્રથી મનુષ્યને કોઈ ગોરવ પ્રાપ્ત થતું નથી. કેટલાય મનુષ્યો એવા છે જે પણ પણ અનુભૂતિ પણ બદલતર હોય છે. સ્વભાવત: જન્મજત પણતા તો લગભગ બધામાં જ હોય છે. એ પણતાનું મનોવિજ્ઞાન દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવે છે. એ શુદ્ધિકરણની પદ્ધતિને જ દ્વિજનત્વ પ્રાપ્તિ અથવા બીજો જન્મ કહે છે.

શાશ્વત બતાવાયું છે કે “જન્મના જયતે શૂદ્ર: સંસ્કારાત દ્વિજ ઉચ્યતે.” અર્થાત્ જન્મથી બધા શૂદ્ર હોય છે. સંસ્કારો દ્વારા મનુષ્યનો બીજો જન્મ થયો કહેવાય છે. આ બીજો જન્મ માતા ગાયત્રી અને પિતા આચાર્ય મારફતે થાય

છે. ગાયત્રીના ૨૪ અક્ષરોમાં એવા સિદ્ધાંતો અને આદર્શો સમાયેલા છે કે જે માનવીના અંત:કરાળને ઉંચી કક્ષાએ લઈ જઈ શકે. બધા વેદ, શાસ્ત્ર, પુરાણ, સ્મૃતિ, ઉપનિષદ, આરાધક, ભાક્તિશાસ્ત્ર, સૂત્ર વગેરે ગ્રંથોમાં જે કાંઈ પણ શિક્ષણ છે એ સર્વ ગાયત્રીના અક્ષરોમાં સમાયેલા શિક્ષણની વિસ્તારપૂર્વકની સમજ માત્ર છે. સમસ્ત ભારતીય ધર્મ, સમસ્ત ભારતીય આદર્શ, સમસ્ત ભારતીય સંસ્કૃતિનું બીજ ગાયત્રીના ૨૪ અક્ષરોમાં સમાયેલું છે. તેથી જ દ્વિજત્વને માટે-બીજ જન્મ માટે ગાયત્રીને માતા માનવામાં આવી છે.

માત્ર મંત્ર યાદ કરવાથી અથવા પુસ્તકો વાંચી જવાથી શિક્ષણ મળી જતું નથી. વાંચવાથી જે તે બાબતોની જાગ્રત્તા તો મળી જય છે, પણ હદ્યમાં તેને ઉત્તરવાનું કામ કોઈ સુયોગ વિકિત દારા જ થઈ શકે છે. એદ દીવાથી બીજો દીવો સળગે છે, અખિથી અખિ ઉત્પન્ન થાય છે, વક્તિઓથી વક્તિઓનું નિર્માણ થાય છે. એટલા માટે ગાયત્રીના શિક્ષણને વ્યાવહારિક રૂપમાં અને જીવનમાં ઉત્તરવાનું કામ પોતાની જેતે કરી શકાતું નથી અથવા તેને વાંચવા માત્રથી થતું નથી. એ માટે કોઈ પ્રતિભાશાળી વક્તિની જરૂર હોય છે. આવી વક્તિને ગુરુ કહેવામાં આવે છે.

ગુરુ ગાયત્રીના આપારે જે શિક્ષણ આપે છે તેને હદ્યમાં ઉત્તરવા માટે અને જીવનમાં તાણાવાણાની માફક વણી દેવા માટેની જવાબદારી પોતાના શિરે છે એ વાત હરહંમેશ આંખ સામે રહે તે માટે દ્વિજત્વના પ્રતીક તરીકે યજોપવીત પહેરવવામાં આવે છે. યજોપવીત ગાયત્રીની મૂર્તિમાન પ્રતિમા છે. ગાયત્રીનાં નવ પદ છે: ૧-તત્ત્વ, ૨-સવિતુઃ, ૩-વરેણ્ય, ૪-ભર્ગો, ૫-ટેવસ્ય, ૬-ધીમહિ, ૭-ધિયો, ૮-યોનઃ, ૯-પ્રથોદ્યાત્. યજોપવીતમાં પણ નવ દોરા છે. પ્રત્યેક દોરો ગાયત્રીના એક એક પદનું પ્રતીક છે. યજોપવીતમાં ત્રણ ગ્રંથિઓ અને એક બ્રહ્મગ્રંથિહોય છે. મોટી ગ્રંથિ ગાયત્રીના ઝુંની છે અને બાકીની ત્રણ ગાંઠો ભૂઃ, ભૂવઃ, સ્વઃ ની પ્રતીક છે. જેમ પથ્થર અથવા ધાતુની મૂર્તિમાં દેવતાની પ્રતિષ્ઠા કરીને તેની પૂજા કરવામાં આવે છે તેમ સૂતરની ગાયત્રીની મૂર્તિ બનાવી તેને હદ્યમંદિરપર પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. મંદિરની મૂર્તિની સમજ હરધડી રહી શકાતું નથી, પણ ગાયત્રીની પ્રતિમા જેવા યજોપવીતને હંમેશાં પાસે જ રાખી શકાય છે. તેને તો એક ક્ષાળાવાર માટે પણ દૂર કરવું ન જોઈએ. એ તો હરહંમેશ હદ્ય પર જૂલતું રહેતું જ હોય છે. તેનો ભાર હંમેશાં ખભા ઉપર રાખેલો જ હોય છે. આ રીતે ગાયત્રીની પૂજાને, ગાયત્રીની પ્રતિમાને, ગાયત્રીના શિક્ષણને જીવનસંગિની-જીવનસાથી બનાવી દેવામાં આવ્યાં છે. ભારતીય ધર્મનો કોઈ પણ અનુયાયી યજોપવીતને છોડી શકતો નથી, તેમજ તેની મહત્ત્વાનો ઈન્કાર કરી શકતો નથી.

કહેવામાં આવે છે કે ગાયત્રીનો અધિકાર કેવળ દ્વિજને જ છે. દ્વિજત્વનું તાત્પર્ય એ છે કે ગુરુ દારા ગાયત્રીને શ્રદ્ધા કરવી. જે લોકો અંધશ્રદ્ધાળું છે, આનનિમાણિંશ તરફ બેદકાર છે, આદર્શ જીવન જીવવામાં ઉદાસીન છે, જેને સન્માર્ગ તરફ પ્રવૃત્તિ નથી એવા લોકો શૂદ્ર કહેવાય છે. જે બીજ જન્મનો, આદર્શ જીવનનો, મનુષ્યની મહત્ત્વાનો, સન્માર્ગનો સ્વીકાર નથી કરતા તેવા લોકોનું જીવન પાશવિક કહેવાય છે. આવા લોકો ગાયત્રીમાં રુચિ લઈ શકતા નથી. જેને જે માર્ગમાં શ્રદ્ધા નથી તેમાં તેને સફળતા શી રીતે મળે? એટલા માટે એમ કહેવાય છે કે શૂદ્રોને ગાયત્રીનો અધિકાર નથી. આ મહાવિજ્ઞાનના એ જ અધિકારી છે, જે આત્મિક કાયાકલ્પનું લક્ષ્ય રાખે છે, જેને પાશવિક જીવન કરતાં ઉચ્ચ જીવન પર આસ્થા છે અને જે દ્વિજ બનીને સૈદ્ધાંતિક જન્મ લઈ સત્પુરુષ બનવા માગે છે.

## ઉત્કીલન અથવા શાપમોચન

શાસ્ત્રમાં કહું છે કે ગાયત્રી મંત્ર કીલિત છે અને એનું જ્યાં સુધી ઉત્કીલન ન થાય ત્યાં સુધી એ મંત્ર ફળદાયક બનતો નથી. સાથે સાથે એમ પણ કહેવાય છે કે ગાયત્રીને શાપ બાંધો છે અને એ શાપનું વિમોચન ન થાય ત્યાં સુધી

તેના સાધકને કોઈ લાભ મળતો નથી. કીલિત હોવું અને શાપ લાગવો એ શું છે એ જાગુવું જોઈએ. ઉત્કીલન અને શાપમોચન શું છે એ પણ જાગુવું જોઈએ. આ બાબતો વિચારણીય છે.

એમ કહેવામાં આવે કે ઔષધિ વિદ્યા કીલિત છે તો એનો અર્થ શું? કોઈ વ્યક્તિ ને શરીરશાસ્ક, નિદાન, નિધંટુ અને ચિકિત્સા વિજ્ઞાનની બારીકાઈઓને નથી સમજતી અને પોતાની અધૂરી માન્યતા અને અપક્રય જ્ઞાનના આધારે લોકોમાં વેદું કરે તો તેનાથી લાભ થવાને બદલે હાનિ જ થવાની. જે ઔષધિઓનો સાચો લાભ ઉદાહરણ હોય તો અનુભવી વૈદ્ય અથવા ડેક્ટરની સલાહ દેવી ખાસ જરૂરી છે. આયુર્વેદના ગ્રંથોમાં ધારું બધું લખ્યું છે, તે વાંચીને ધારી વાતો જાગી શકાય, પણ એમ છતાં અનુભવી વૈદ્યની જરૂર પડવાની જ. વૈદ્ય વિના હજરો ઇપિયાના ચિકિત્સા ગ્રંથો અને લાખો ઇપિયાનાં ઔષધાલયો રોગીને કથો ફાયદો નહીં કરી શકે. આ દિનીએ એમ કહી શકાય કે ઔષધિ કીલિત છે. ગાયત્રી મહાવિદ્યાની બાબતમાં પણ એવું જ છે. સાધકની મનોભૂમિના આધારે સાધના પદ્ધતિમાં, નિયમ-ઉપનિયમોમાં, આદર્શોમાં, ધ્યાનમાં અનેક ફેરફાર કરવામાં આવતા હોય છે. બધાની સાધના પદ્ધતિ એકસરખી નથી હોતી. આવી સ્થિતિમાં એવા માર્ગદર્શકની જરૂર પડે છે, જે આ વિદ્યાનો જ્ઞાતા હોય, અનુભવી હોય, નિખારાત હોય.

આવા માર્ગદર્શક જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ઔષધીવિદ્યાની માફક ગાયત્રીવિદ્યા પણ સાધક માટે કીલિત ગાગાય. સાચા ગુરુનું-સાચા માર્ગદર્શકનું મળી જરૂર એ જ ઉત્કીલન છે. શાસ્કશંથોમાં કદ્યું છે કે ગુરુ દ્વારા ગ્રહણ કરાયેલી ગાયત્રી જ ઉત્કીલિત હોય છે અને એ જ સફળ થાય છે.

‘સ્કુંદપુરાણ’માં વાર્ણન છે કે એક વખત વશિષ્ઠ, વિશ્વામિત્ર અને બ્રહ્માએ કોધમાં આવી જઈને ગાયત્રીને શાપ આપ્યો કે “ને કોઈ તારી સાધના કરશે તે નિષ્ફળ જશે” આવડી મોટી શક્તિને નિષ્ફળ જતી જોઈને સર્વ ઠેકાણે હાહકાર મચી ગયો. સર્વે દેવતાઓ એ જેગા મળીને પ્રાર્થના કરી કે આ શાપનું વિમોચન થવું જોઈએ. અંતે એવો માર્ગ કાઢવામાં આવ્યો કે જે શાપ વિમોચનની વિધિ કર્યા પછી સાધના કરશે તેની સાધના સફળ થશે અને બાકીનાની નિષ્ફળ જશે. આ કથામાં એક મોટું રહસ્ય છુપાયું છે, જેને ન જાગુવાથી કેવળ “શાપ મુક્તો ભવ” વાળો મંત્ર બોલી જવાથી એમ માની વેવામાં આવે છે કે અમારી સાધના શાપમુક્ત થઈ.

વિશ્વામિત્રનો અર્થ છે- સંસારનો મિત્ર, લોકસેવક, પરોપકારી. વશિષ્ઠનો અર્થ છે- વિશેષ રૂપમાં શ્રેષ્ઠ. બ્રહ્માનો અર્થ છે- બ્રહ્મપરાયાણ. આ ત્રણે ગુરુશોવાળા પથદર્શક-ગુરુના આદેશ પ્રમાણે કરવામાં આવતી આધ્યાત્મિક સાધના અથવા પ્રયત્ન જ સફળ થાય છે અને તે જ કલ્યાણકારી નીવડે છે.

સ્વાધીન, બીજાનું બૂનું કરવા તૈયાર રહેનાર અને વામમાર્ગી મનોવૃત્તિનો મનુષ્ય જે સાધકને આવી જ સાધના શીખવે તો તેને અને સાધકને બંનેને નુકસાન જ થશે. જેનું ચારિત્ર ઊંચું નથી, જે ઉદાર નથી, જેનામાં મહાનતા અથવા પ્રતિભા નથી એ બીજાને શું શીખવે? એ જ પ્રમાણે જે બ્રહ્મપરાયાણ નથી, જેનામાં સાધના અને તપ નથી, એવો ગુરુ બીજાના આત્માને શું પ્રકાશ આપવાનો?

તાત્પર્ય એ છે કે વિશ્વામિત્ર એટલે ઉદારતા, વશિષ્ઠ એટલે મહાનતા અને બ્રહ્મા એટલે બ્રહ્મપરાયાણ- આ ત્રણ ગુરુશોવાળો નિર્દ્દશક ગુરુ જ્યારે કોઈ વ્યક્તિને આધ્યાત્મિક રીતે તૈયાર કરે છે ત્યારે તેનો પ્રયત્ન નિષ્ફળાં નહીં જાય. એનાથી ઊંબંદું કુપાત્ર, અયોજ્ય અને અનુભવહીન વ્યક્તિઓના આદેશ પ્રમાણે કરવામાં આવેલી સાધના કોઈએ શાપ આપ્યો હોય તેવી રીતે નિષ્ફળ જશે. શાપ લાગવો અને તેમાંથી મુક્તિ મેળવવી તેનું ગુપ્ત રહસ્ય ઉપર જાગાવ્યા પ્રમાણે વિશેષ વ્યક્તિના માર્ગદર્શન પ્રમાણે પોતાની કાર્યપદ્ધતિનું નિર્માણ કરવું તે છે.

ગાયત્રી ઉચ્ચ માનવજીવનની જન્મદાતા છે, તેનો પાયો છે, તેની બીજશક્તિ છે. ભારતીય સંસ્કૃતિરૂપી

જ્ઞાનગંગાની ઉદ્ગમભૂમિ ગંગોત્રી એ જ આપણી ગાયત્રી છે. એટલા માટે અને દિજોની માતા કહી છે. ભૌતિક માતાના પેટમાં રહીને મનુષનો આધ્યાત્મિક, સૈધ્યાત્મિક અને દિવ્ય વિશેષતાઓવાળો બીજો જન્મ થયો છે, પરંતુ આ માતા સર્વસंપત્ત હોવા છતાં પિતાના અભાવમાં અપૂર્વ છે. દિજાત્વના બીજા શરીરનું નિર્માણ માતા અને પિતા બંનેનાં તત્ત્વબિંદુઓથી થાય છે.

શુદ્ધ દ્વારા જ ગાયત્રી માતાની અદશ્ય શક્તિનું શિખની મનોભૂમિમાં આરોપણ થાય છે. તેથી જ્યારે દિજાત્વનો સંસ્કાર થાય છે ત્યારે આ બીજા આધ્યાત્મિક જન્મમાં ગાયત્રી માતા અને આચાર્યને પિતા તરીકે જહેર કરવામાં આવે છે.

ઉચ્ચ આદર્શોનું શિક્ષાણ આપોઆપ પ્રાપ્ત થતું નથી, તેમજ ગ્રંથોના આધારે પાણ આ શિક્ષાણ મળતું નથી. ચારિન્યહીન અધ્યોત્પ્ર વ્યક્તિ બીજાઓને આવા ઉચ્ચ આદર્શો તરફ આકર્ષી શકે જ નહીં. કોઈ વ્યક્તિ પાસે મોટું ધનુષ હોવા માત્રથી તે શબ્દવેદી બાણું ચલાવનાર નથી બની શકતો, તેમજ કોઈ અનાડી શિક્ષક દ્વારા બાળાની વિદ્યામાં કોઈ પ્રવીણ બની શકતું નથી. ઉત્તમ ધનુષબાળું અને ઉત્તમ શિક્ષક હોય તો જ ઉત્તમ પરિણામ મળી શકે છે. ગાયત્રી કીલિત હોવાનું અને તેના શાપવિમોચન કરવાનું આ જ રહસ્ય છે.

## આત્મકલ્યાણની ત્રાણ કક્ષાઓ

આધ્યાત્મિક સાધનાક્ષેત્ર ત્રાણ ભાગોમાં વહેંચાયેલું છે. ત્રાણ વ્યાહતિઓમાં તેનું સ્પષ્ટીકરાણ કરવામાં આવ્યું છે: (૧) ભૂઃ, (૨) ભુવઃ, (૩) સ્વઃ - આ ત્રાણને આત્મિક ભૂમિકાઓ માનવામાં આવી છે. ભૂઃ નો અર્થ છે - સ્થૂળ જીવન, સાંસારિક અને સામાજિક જીવન. ભુવઃ નો અર્થ છે - મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારના અંતઃકરણ-ચતુર્થનું ક્ષેત્ર. સ્વઃ નો અર્થ છે - વિશુદ્ધ આત્મિક સત્તા. મનુષ્યની આત્મિક સ્થિતિ આ ત્રાણ ક્ષેત્રોમાં હોય છે.

ભૂઃ નો સંબંધ અત્રમય કોશની સાથે જ છે. ભુવઃ નો સંબંધ પ્રાણમય અને મનોમય કોશ સાથે હોય છે. સ્વઃ નો પ્રભાવ વિજ્ઞાનમય અને આનંદમય કોશ ઉપર પડે છે. શરીરની સાથે સંબંધ રાખનારી તમામ બાબતો નેમ કે ઉપાર્જન, સ્વાસ્થ્ય, લોકવ્યવહાર, નીતિ, કલા, શિલ્પ, વ્યાપાર, સામાજિક અને રાજનૈતિક જ્ઞાન, નાગરિક કર્તવ્ય વગેરે ભૂઃ ના ક્ષેત્રમાં આવે છે. જ્ઞાન, વિદેશ, દૂરદર્શિતા, ધર્મ, દર્શન, મનોભળ, પ્રાગશક્તિ, તાંત્રિક પ્રયોગ, યોગસાધના વગેરે બાબતો ભુવઃના ક્ષેત્રમાં આવે છે. આત્મસાક્ષાત્કાર, ઈશ્વરપરાયણતા, ભ્રાહ્મી સ્થિતિ, પરમહંસગતિ, સમાધિ, તુરિયાવસ્થા, પરમાનંદગતિ, મુક્તિ વગેરે બાબતો સ્વઃ ના ક્ષેત્રમાં આવે છે. આધ્યાત્મિક ક્ષેત્રના આ ત્રાણ લોક છે. પૃથ્વી, પાતાળ અને સ્વર્ગની માઝક આપણી અંદર પાણ ભૂઃ, ભુવઃ અને સ્વઃ એમ ત્રાણ લોક છે.

આ ત્રાણ સ્થિતિઓના આધાર પર જ ગાયત્રીના ત્રાણ ભાગ કરવામાં આવ્યા છે અને તેને ત્રિપદા કહી છે. તેનાં ત્રાણ ચરાગ છે. પહેલી ભૂમિકા-પ્રથમ ચરાગ ભૂઃ ના ક્ષેત્ર માટે છે. તેમાં એવું શિક્ષાણ અપાય છે જે મનુષ્યના વ્યક્તિગત અને સામાજિક જીવનને વ્યવસ્થાપૂર્વક ગોઠવે તથા એવી વ્યવસ્થામાં સહાયક બને.

‘ગાયત્રી ગીતા’ અથવા ‘ગાયત્રી સ્મૃતિ’માં ગાયત્રીના ચોવીસ અક્ષરોની સમજાળ આપવામાં આવી છે. એક એક અક્ષર અને શબ્દથી જે જે આદર્શો, ઉપરદ્શો અને સિદ્ધાંતોનું શિક્ષાણ મળે છે એ એવું અમૂલ્ય છે કે તેના આધાર પર જીવન નીતિમય બનાવવાનો પ્રયત્ન કરનાર મનુષ્ય દિવસે દિવસે સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઉત્ત્રતિ અને પ્રતિક્રિયાના પદ પર ઉત્તોતર આગળ વધતો જ જય છે. ‘ગાયત્રી મહાવિજ્ઞાન’ના પ્રથમ ભાગમાં ગાયત્રી કુલપુત્રનું શિત્ર બનાવીને એવું સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે તત્ત્વ સવિતુઃવરેણ્ય વગેરે અક્ષરોમાં મનુષ્ય માટે કેટલું જરૂરી અને મહત્વપૂર્ણ શિક્ષાણ સમાયેલું છે. આ શિક્ષાણ અન્તયંત સરળ, શીધ ફળદાયી અને ધરની બહાર અને અંદર

शांतिनुं साम्राज्य स्थापनाकुं छ.

ગાયત્રીની દશ ભૂજાઓના સંબંધમાં ‘ગાયત્રી મંત્રરી’માં એમ બતાવ્યું છે કે આ દશ ભૂજાથી માતા દશ શૂળોને નષ્ટ કરે છે. (૧) દૂષિત દષ્ટિ, (૨) પરાવલંબન, (૩) ભય, (૪) કુદૃતા, (૫) અસાવધાની, (૬) સ્વાર્થપરાયાણતા, (૭) અવિવેક, (૮) આવેશ, (૯) તૃષ્ણા, (૧૦) આળસ. આ દશ શૂળો મનાય છે. આ દશ દોષો અથવા માનસિક શત્રુઓને નષ્ટ કરવા માટે પ્રથમ વ્યાહૃતિ અને નવ પદો દ્વારા જે દશ પ્રકારનું શિક્ષાણ મળે છે તે માનવજીવનમાં સ્વર્ગાર્થ આનંદની સૂષ્ટિ ઉત્પન્ન કરી શકે છે. નીતિ, ધર્મ, સદાચાર, સંપત્તિ, વ્યવહાર, આર્થિક, સ્વાર્થ અને પરમાર્થનો જેવો સુંદર, સુમેળ આ શિક્ષાણમાં મળે છે તેવો બીજે ઝાંખે મળતો નથી. વેદશાસ્કોના સંપૂર્ણ શિક્ષાણનો નિયોગ આ અક્ષરોમાં ભરવામાં આવ્યો છે. આનો જે જેવો અને જેટલો ઉપયોગ કરશે તેટલો લાભ તેને જરૂર મળશે.

## प्रथम भूमिका - मंत्रनी दीक्षा

જીવનનું પ્રથમ ચરાગ ભૂઃ છે. વિક્રિત અને સામાન્યિક વ્યવહારમાં જે અનેક સમસ્યાઓ અને મુસીબતો આવે છે એ સર્વનો ઉકેલ આ અક્ષરોમાં આપવામાં આવેલા શિક્ષણથી થાયં છે. સાંસારિક જીવનનો કોઈ પણ પ્રશ્ન એવો નથી કે જેનો જવાબ અને ઉપાય આ અક્ષરોમાં ન હોય. આ રહસ્યમય વ્યવહારિક શાનની આપણા માટે ઉપયોગી વ્યાખ્યા કરાવવા માટે જે ગુરુની જરૂર હોય છે તેને આચાર્ય કહે છે. આચાર્ય મંત્રદીક્ષા આપે છે. મંત્રનો અર્થ છે - વિચાર, તર્ક, પ્રમાણ. અવસર અને સ્થિતિ પર વિચાર કરતાં આચાર્ય પોતાના શિષ્યને વખતો વખત સલાહ અને ઉપદેશ ગાયત્રી મંત્રના શિક્ષણના આધાર પર આપે છે અને તેનાથી શિષ્યની અનેક શંકાઓનું સમાધાન થતું જય છે અને તેની ઉત્ત્રતિનો રસ્તો મોકળો થતો જય છે. આ પ્રથમ ભૂમિકા છે. આને ભૂઃ ક્ષેત્ર કહું છે. આ ક્ષેત્રમાં શિષ્યને આચાર્ય દ્વારા મંત્રદીક્ષા આપવામાં આવે છે.

મંત્રદીક્ષા લેતી વખતે શિષ્ય પ્રતિજ્ઞા કરે છે કે “હું ગુરુની આશાનું શ્રદ્ધાપૂર્વક પાલન કરીશ. વખતો વખતો તેમની સલાહ પ્રમાણે મારી જીવનનીતિ નક્કી કરીશ. મારી સર્વ ભૂલો નિષ્પત્ત રીતે ગુરુની સમજ પ્રકૃત કરીશ.” આચાર્ય શિષ્યને મંત્રનો અર્થ સમજાવે છે અને ગાયત્રી માતાના ઇપમાં યજ્ઞોપવીત આપે છે. શિષ્ય ટેવભાવથી આચાર્યનું પૂજન કરે છે. અને ગુરુપૂજામાં તેમને વસ્ત્ર, આભૂષણ, પાત્ર, ભોજન, દિક્ષાણા વગેરેની સમયાનુસાર બેટ આપે છે. તિલક, અક્ષત વગેરેથી બંને એકબીજાને બાંધે છે. મંત્રદીક્ષા એ એક પ્રકારનો બે વ્યક્તિઓ વચ્ચેનો આધ્યાત્મિક સંબંધ છે, સ્થાપના છે. આ દીક્ષા પછી પાપ-પુરુષમાં બંનેની સોમા હિસ્સાની ભાગીદારી સ્થપાય છે. શિષ્યનાં સો પાપો પૈકી એક પાપનું ફળ ગુરુને ભોગવવાનું હોય છે. આ જ રીતે ગુરુના એક પાપનું ફળ શિષ્યે ભોગવવું પડે છે. પુરુષમાં એવી જ ભાગીદારી હોય છે. આ સામાન્ય દીક્ષા થઈ. સાધારણ કક્ષાનો સુશ્રક્તિ સજ્જન આચાર્યન્વ ગ્રહાગ કરીને પ્રારંભિક સાધકને આ મંત્રદીક્ષા આપી શકે છે.

## દ્વિતીય ભૂમિકા-અર્થિનદીક્ષા

બીજુ ભૂમિકામાં પહોંચ્યા પછી બીજી દીક્ષા લેવી પડે છે. તેને પ્રાણદીક્ષા અથવા અનિદીક્ષા કહે છે. પ્રાણમય કોશ અને મનોમય કોશની અંદર રહેવી શક્તિઓને જગૃત કરવાની સાધનાઓનું શિક્ષાળ ક્ષેત્ર આ જ છે. સાધના સંગ્રહમનાં અલ્લ શસ્ત્રોને ઓળખવા, સંભાળવા અને વાપરવાનું આ ભૂમિકામાં શીખવાય છે. પ્રાણશક્તિની ન્યૂનતાનો ઉપયાર આ ક્ષેત્રમાં થાય છે. સાહસ, ઉત્સાહ, પરિશ્રમ, દઢતા, સ્કુર્તિ, આશા, ધૈર્ય, લગન વગેરે વીરોચિત ગુણોની વૃદ્ધિ આ જ ભૂમિકામાં થાય છે. મનુષ્ય શરીરની અંતર્ગત એવાં અનેક ચક્ક, ઉપચક્ક, ઉપત્યકા, સૂત્ર, પ્રત્યાવર્તન, બીજ, મેડુ વગેરે ગુપ્ત સંસ્થાન હોય છે, જે પ્રાણમય ભૂમિકાની સાધનાથી જગૃત થાય છે. આ જાગરાતાના

પરિણામે સાધકમાં એવી અનેક વિશેષતાઓ ઉત્પન્ન થાય છે, જે સાધારણ મનુષ્યમાં હોતી નથી.

ભુવ: ભૂમિકામાં જ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારના ચતુર્યનું સંશોધન, પરિમાર્ઝન અને વિકાસ થાય છે. આ સધયું કાર્ય મધ્યમાં અને પશ્યતિ વાળી દ્વારા કરવામાં આવે છે. ભુ: ક્ષેત્રમાં મંત્ર દીક્ષિત પ્રારંભિક સાધકને વૈખરી વાળીનાં વચ્ચેનોના માધ્યમથી શિક્ષાશ અને સલાહ આપવામાં આવે છે, જ્યારે પ્રાણદીક્ષા અપાય છે. ત્યારે ગુરુ પોતાનો પ્રાણ શિષ્યના પ્રાણમાં ઓતપ્રોત કરી દે છે. પોતાનું આત્મબળ બીજરંગમાં સાધકના અંતકરણમાં સ્થાપિત કરે છે. જેમ અભિનથી અજિન સણગે છે, વીજળીથી બલ્બમાં પ્રકાશ થાય છે અથવા પંખો ફરવા લાગે છે તે જ પ્રમાણે બીજરંગમાં પોતાનો શક્તિ ભાગ બીજની મનોભૂમિમાં સ્થાપીને ત્યાં તેને સીચી તેની વૃદ્ધિ કરવામાં આવે છે. આ ક્રિયાપદ્ધતિને અભિનદીક્ષા કહે છે. અશક્તને સશક્ત બનાવવો નિષ્ઠિયને સક્રિય બનાવવો અને નિરાશને આશાન્વિત કરવો એ પ્રાણદીક્ષાનું કામ છે. મંત્રથી વિચાર ઉત્પન્ન થાય છે, અભિનથી ક્રિયા ઉત્પન્ન થાય છે અને અંત: ભૂમિકામાં હવલનયલન, ક્રિયા, પ્રગતિ, ચેષ્ટા, કાંતિ, અકાંક્ષા વગેરે તીવ્ર ગતિથી ઉદ્ય પામે છે.

સામાન્ય રીતે લોકો આત્મનીતિ તરફ બહુ ધ્યાન નથી આપતા. એ તરફ થોડુંક ધ્યાન આપે છે તો જાણે કોઈ મોટો બોલો ઉઠાયો હોય એવું સમજે છે. થોડુંક જન્મતપ કરે છે તો જાણે કોઈ મોટો મોરચો શરૂ કર્યો હોય એવું લાગે છે, પરંતુ જ્યારે આંતરિક સ્થિતિ ભુવ: ક્ષેત્રમાં પહોંચે છે ત્યારે સાધકને ધાળી બેચેની અને અસંતોષ નેવું જાણાય છે. તેને પોતાની સાધના બહુ જ સામાન્ય માલૂમ પડે છે અને તેની ઉત્ત્રતિ તેને બહુ જ ધીમી લાગે છે. તેને એવો ચચરાટ થાય છે કે જલદીમાં જલદી પ્રારે લક્ષ્ય સુધી પહોંચી જાઉ! પોતાની ઉત્ત્રતિ ચાહે ગમે તેટલી વ્યવસ્થિત પદ્ધતિથી ચાલતી હોય છતાં તેથી તેને સંતોષ થતો નથી. આ વ્યકૃતિના એ એની ભૂલ નથી, પણ અંદરને અંદર જે તીવ્ર ક્રિયાશક્તિ કામ કરી રહી હોય છે તેની એ પ્રતિક્રિયા માત્ર જ છે. આંતરિક ક્રિયાપ્રવૃત્તિ અને પ્રેરણા વગેરેનું બાધ્ય લક્ષ્યાશ અસંતોષ જ છે. ઊલટું આ અસંતોષ જે ન હોય તો સમજવું કે સાધકની ક્રિયાશક્તિ શિથિલ થઈ ગઈ છે. જે સાધક બીજી ભૂમિકામાં છે તેનો અસંતોષ જે ન હોય તો સાધકને પોતાની નાની નાની ભૂલો, ભૂરાઈઓ અને ન્યૂનતાઓનો સારી રીતે ઘ્યાલ આવે છે. તેને માલૂમ પડતું જ્યાં છે કે હું અસંખ્ય ન્યૂનતાઓ અને ભૂરાઈઓનો બંડાર છું. નિમ્ન કક્ષાના મનુષ્ય કરતાં ય મારામાં વધારે ભૂરાઈઓ છે, હજુ પણ પાપ મારો પીછો છોડતું નથી, એવી રીતે એ પોતાની અંદર જ તિરસ્કાર ઉપયોગ એવાં તત્ત્વોને મોટા પ્રમાણમાં જુએ છે. જે નબળાઈઓને સાધારણ શ્રેણીનો મનુષ્ય કાંઈ લિસાબમાં લેખતો નથી તેને એ હંસ-ક્ષીર ન્યાયથી જુએ છે અને માનસિક પાપોથી દુઃખી થાય છે.

મહાત્મા સુરદાસ જ્યારે પરમ ભક્ત બની રહ્યા હતા ત્યારે જ તેમને તેમની ભૂરાઈઓનો ઘ્યાલ આવ્યો. જ્યાં સુધી તેઓ પાપી અને વ્યભિચારી રહ્યા ત્યાં સુધી તેમને પોતાના કોઈ કામમાં કોઈ ભૂરાઈ ન લાગી, પણ જ્યારે તેઓ ભગવાનાના શરણે ગયા ત્યારે ભૂતકાળની ભૂરાઈઓ સમરણમાં આવતાં જ તેમનો આત્મા કંપી ઊઠ્યો અને અતિશ્ય તીવ્ર વેદનાને શાંત પાડવા માટે પોતાનાં નેત્રો ફોડી નાર્થ્યાં. એમ છતાં આત્મનિરીક્ષાણ કરતાં તેમને પોતાની અંદર

દોષ જ દેખાયા, જેની જહેરાત એમાગે પોતાના પ્રસિદ્ધ પદમાં ગાઈ છે :

**“મો સમ કીન કુટિલ, ખલ, કામી !”**

ભુવઃ ભૂમિકામાં પહોંચેલા સાધકમાં ત્રાણ લક્ષણો પ્રધાનપણે હોય છે : (૧) આત્મકલ્યાણ માટેની તપશ્ચયમાં તીવ્ર પ્રવૃત્તિ, (૨) પોતાની પ્રગતિને મંદરૂપમાં અનુભવવી, પોતાની ઉત્ત્રતિ પ્રતિ અસંતોષ, (૩) પોતાના વિચાર, કાર્ય અને સ્વભાવમાં અનેક ભૂરાઈઓ જોવી. આ ભૂમિકા ધરિ ધરિ પાકતી જય છે. જ્યાં સુધી તપેલીમાં દાળ ચડી જતી નથી ત્યાં સુધી ભારે ઉલ્લઘાથલ થતી રહે છે. જે તપેલીમાં શાંતિ હોય તો તેનાં બે કારણો હોય : (૧) કાં તો દાળ ચડવાની શરૂઆત જ નથી થઈ અને તપેલી હજુ ઢંડી જ છે, અથવા (૨) દાળ ચડીને તેથાર થઈ ગઈ. કાં તો મૂર્ખ અને અજ્ઞાનના અંધકારમાં રૂભી ગયેલો જરૂર પ્રકૃતિનો માનવી પ્રસત્ર રહે છે અને પોતાની ભૂરાઈઓમાં આનંદ માગે છે અથવા અંતિમ કક્ષામાં પહોંચેલો યોગી આત્મસાક્ષાત્કાર કરીને બ્રહ્મજ્ઞાન સુધી પહોંચી સાચી શાંતિનો અનુભવ કરે છે. મધ્યમ કક્ષામાં જરૂર, તપ, પ્રયત્ન, અસંતોષ અને વેદનાની પ્રધાનતા રહે છે. આ સ્થિરતિ જરૂરી છે. આને જ આત્માનો અધિસંસ્કાર કરે છે. આનાથી અંતકરણનો પરિપાક થાય છે. શરીરને તપશ્ચયમાં અભિનિમાં અને અંતઃકરણને અસંતોષના અભિનિમાં તપાવીને પકવવામાં આવે છે. પૂરતા પ્રમાણમાં અધિસંસ્કાર થઈ ગયા પછી ન તો શરીરને તપાવવાની જરૂર રહે છે અને ન તો મુનને તપાવવું પડે છે. ત્રીજી કક્ષામાં સ્વઃની શાંતિ પ્રાપ્ત કરે છે.

મંત્રદીક્ષા કોઈ પણ વિચારવાન, દૂરદર્શી, ઉચ્ચ ચરિત્રવાન, પ્રતિભાશાળી સજ્જન આપી શકે છે. એ પોતાની તર્કશક્તિ અને ભુલ્લિમત્તાથી શિષ્યના વિચારોનું શુલ્લિકરણ કરી શકે છે. તેના કુવિચારો-ભૂમોને સુધારીને ભલાઈના માર્ગ પર ચાલવા માટે જોઈતી સલાહ, શિક્ષણ, ઉપદેશ આપી શકે છે. પોતાના પ્રભાવથી શિષ્યને પ્રભાવિત કરી દે છે. અધિદીક્ષા માટે એવા ગુરુ જોઈએ જેમના અંતરમાં અધિનું પ્રમાણ અને તપાયું જ સારા પ્રમાણમાં મોજૂદ હોય. દાન તે જ કરી શકે જેની પાસે ધન હોય, વિદ્યા એ જ આપી શકે જે પોતે વિદ્ધાન હોય. જેની પાસે જે વસ્તુ ન હોય તે બીજાને શી રીતે આપી શકે? જેણે પોતે તપ કરીને પ્રાણશક્તિનો સંચય કર્યો હોય, જેણે પ્રયત્ન કરીને પોતાના અંતઃકરણમાં અધિ જલતો રાખ્યો હોય તે જ બીજાને પ્રાગ અથવા અભિન આપીને એને ભુવઃ ભૂમિકાની દીક્ષા આપી શકે છે.

### **ત્રીજી ભૂમિકા - “બ્રહ્મદીક્ષા”**

ત્રીજી ભૂમિકા સ્વઃ છે. તેને જ બ્રહ્મદીક્ષા કરે છે. જ્યારે દૂધને ઉકાળીને પછી નીચે ઉતારી ઠંડુ કરી તેમાં મેળવણ નાખવામાં આવે છે ત્યારે એ બધા દૂધનું દહી થઈ જાય છે. મંત્ર દ્વારા દિનિંદુને શુલ્ક કરી સાધક પોતાનું સાંસારિક જીવન આનંદથી વિતાવતો હોય છે. અભિન દ્વારા પોતાના કુસંસ્કાર, પાપો, ભૂલો, દુર્ભિનતા વગેરેને બાળી નાખે છે અને પોતાના પિંડને બંધનમુજા કરતો હોય છે તથા છેવટે તપની ઉભાધી અંતઃકરણને તપાવી બ્રહ્મભૂત કરતો હોય છે. દૂધ બળી બળીને જ્યારે રબડી તથા મલાઈના રૂપમાં ફેરવાઈ જાય છે ત્યારે તેની કિમત અને સ્વાદ અનેકગણાં વધી જાય છે.

પહેલી જ્ઞાનભૂમિ, બીજી શક્તિભૂમિ અને છેવટે ત્રીજી બ્રહ્મભૂમિ આવે છે. એક પછી એક બધી ભૂમિઓને પાર કરવી પડે છે. પાછલી બે ભૂમિકાઓ પાર કર્યા પછી સદગુરુ દ્વારા બ્રહ્મદીક્ષા વેવાની જરૂર ઊભી થાય છે. એ “પરા” વાણી માર્ગતે થાય છે. વૈખરી વાણી દ્વારા મોઢેથી શબ્દોચ્ચાર કરીને જ્ઞાન આપવામાં આવે છે. મધ્યમાં અથવા પથંતિ વાણી દ્વારા શિષ્યના પ્રાણમય અને મનોમય કોશમાં અધિસંસ્કાર કરવામાં આવે છે. પરા વાણી દ્વારા આત્મા બોલે છે અને તેનો સંદેશ બીજો આત્મા સાંભળે છે. જીબની વાણી કાન સાંભળે છે, મનની વાણી આત્મા

રોન સેંકડો કથા, પ્રવચન, વ્યાખ્યાન થતાં હોય છે, અખબારોમાં, પોસ્ટરોમાં, પત્રિકાઓમાં જતજતની વાતો આવે છે અને રેલિયો ઉપર નિત્ય ઉપદેશ થયા જ કરે છે, પણ તેના ઉપર કોણ ધ્યાન આપે છે, કેમકે સાંભળનારાઓને સંભળાવનારાઓ ઉપર શ્રદ્ધા જ હોતી નથી. એથી મહત્વપૂર્વિકા વાતો પણ નિરર્થક વેવી લાગે છે. કોઈ ઉપદેશ ત્યારે જ પ્રભાવશાળી થાય છે, જ્યારે એ ઉપદેશકર્તા ઉપર લોકોને શ્રદ્ધા હોય. એ શ્રદ્ધા એટલી તીવ્ર હોય એટલો જ એનો પ્રભાવ પણ મજબૂત હોય છે. પ્રથમ કક્ષાનો મંત્રદીક્ષિત સાધક ગાયત્રીનો સાચો લાભ મેળવી શકે, એટલા માટે તેને દીક્ષા વેતી વખતે ગુરુમાં અત્યુત્ત શ્રદ્ધા રાખવાની પ્રતિક્ષા વેવી પડે છે. એ ગુરુને દેવતુલ્ય પરમાત્માનું પ્રતીક માનશે. શ્રદ્ધાને લીધે જ્યારે માટી, પત્થર અને ધાતુની બનેલી મૂર્તિ આપણા માટે દેવ બની જય છે, તો પછી જીવિત મનુષ્યમાં દેવત્વના શ્રદ્ધાપૂર્વકના આરોપણથી એ સાચો દેવ કેમ ન બની જય?

### શ્રદ્ધાના પ્રકટીકરણની જરૂર

એકુલય ભીલ દ્રોષ શુદ્ધની માટીની પ્રતિમા બનાવી તેની પાસેથી બાળવિદ્યા શીઝ્યો હતો. એ મૂર્તિએ ભીલને બાળવિદ્યામાં એવો પ્રવીણ બનાવી દીધો કે એનાં બાળથી એ ફૂતરાનું મોઢું સીવી શકેલો. આ જેઈને દ્રોણાચાર્ય પાસે બાળવિદ્યા શીખતા પાંડવોને ઈર્ષા થઈ. સ્વામી રામાનંદે ના પાડી હોવા છતાં કબીર તેમનો શિષ્ય થયો હતો અને શ્રદ્ધાના જેરે એણે એટલો બધો લાભ ઉદ્ઘાયો કે એમના વિધિવત્ત દીક્ષા પામેલા શિષ્યો પૈકી એકે પણ એટલો લાભ લીધો ન હતો. રજેદ્ધન થયા પછી ગભરશયમાં વીરિનું એક બિંદુ જવાથી ગર્ભ ધારણ થઈ જય છે, જ્યારે જેને રજેદ્ધન નથી થતું એવી વંધ્યા સ્વીને પૂર્ણ પુરુષત્વવાળો પતિ પણ ગર્ભ ધારણ કરાવી શકતો નથી. શ્રદ્ધા એક પ્રકારનો રજેદ્ધમ છે, જેથી સાધકના અંત:કરાગમાં સદ્ગુપદેશ રૂપી બીજ પડે છે અને ફેણે ફેલે છે. અશ્રદ્ધાણુ દિલમાં બ્રહ્મા પણ શ્રદ્ધા ઉપજવી શકતા નથી. શ્રદ્ધાના અભાવથી કોઈ મહાપુરુષના સાંનિધ્યમાં દિવસ-રત રહેવા છતાં કોઈ વ્યક્તિ કશો જ લાભ ઉદ્ઘાવી શકતી નથી, જ્યારે શ્રદ્ધાવાળી દૂર રહેતી વ્યક્તિ પણ યશેચ્છ લાભ ઉદ્ઘાવી શકે છે. એટલા માટે આરંભિક કક્ષામાં મંત્રદીક્ષિતે ગુરુના પ્રતિ તીવ્ર શ્રદ્ધા રાખવી પડે છે.

વિચારોને મૂર્તિમાન રૂપમાં લાવવા માટે તેમને પ્રકટ રૂપથી બ્રવહારમાં લાવવા પડે છે. જેટલાં પણ ધાર્મિક કર્મકાંડ, દાન, પુર્ણ, પ્રત, ઉપાસના, હવન, પૂજન, કથા, કીર્તન વગેરે હોય એ સર્વનું એ જ પ્રયોજન છે કે આંતરિક શ્રદ્ધા બ્રવહારમાં પ્રકટ થાય અને સાધકના મનમાં એ પુષ્ટ બની જય. મંત્રદીક્ષામાં ગુરુ પ્રતિ શ્રદ્ધા રાખવાની એક ખાસ શરત છે. શ્રદ્ધા નહીં હોય અથવા શિથિલ હોય તો એ દીક્ષા કેવળ નામની જ હોય છે. અશ્રદ્ધાણુ આવી ગુરુદીક્ષાથી કોઈ ખાસ કાર્ય સિદ્ધ નહીં કરી શકે. દીક્ષા વખતે સ્થાપેલી શ્રદ્ધા કર્મકાંડ મારફતે જગત રહે એ જ કરારણને લીધે વખતો વખત ગુરુપૂજન યોજનવામાં આવે છે. દીક્ષા વખતે વદ્ધ, પાત્ર, પુણ્ય, ભોજન, દક્ષિણા વગેરે દ્વારા ગુરુનું પૂજન કરવામાં આવે છે. ગુરુપૂર્ણિમા (અષાઢ સુદ ૧૫) ઉપર યથાશક્તિ એમનાં ચરાગોમાં શ્રદ્ધાંજલિ રૂપે કાંઈક બેટ અર્પણ કરવામાં આવે છે. આ પ્રથા પોતાની આંતરિક શ્રદ્ધાને મૂર્તિ સ્વરૂપ આપવા, એને વધારવા અને એને પરિપુષ્ટ કરવા માટે નિર્માણ થઈ છે. કેવળ વિચાર માત્રથી કોઈ ભાવના પરિપક્વ થતી નથી. કિયા અને વિચાર એ બંનેના સંમિશ્રણથી એક સંસ્કાર બને છે, જે મનોભૂમિમાં સ્થિર થઈને બહુ જ સુંદર પરિણામો આપે છે.

પ્રાચીનકાળમાં એ નિયમ હતો કે ગુરુની પાસે જતી વખતે શિષ્ય ખાલી હાથે નહોતો, પણ કોઈ વસ્તુ, પછી ભલે તે અતિસ્વલ્ય મૂલ્યની હોય એ લેટ તરીકે લઈ જતો હતો. સમિધા હાથમાં લઈને શિષ્ય ગુરુની પાસે જતો હતો. તેને સમિત્યાગુણી કહેવામાં આવે છે. એ સમિધાઓ એની શ્રદ્ધાનું પ્રતીક હતી, પછી તેનું મૂલ્ય ગમે તેટલું અલ્ય કેમ ન હોય. શુકૃદેવજી જ્યારે રાજ જનક પાસે બ્રહ્મવિદ્યાનું શિક્ષણ વેવા જયા ત્યારે રાજ જનક મૌન રહ્યા અને એમાંથી ઉપદેશનો એક શબ્દ પણ ન કહ્યો. શુકૃદેવજી પાછા ચાર્ચા આવ્યા આવ્યા. પછી તેમને ધ્યાનમાં આવ્યું કે પોતે ભલે એક સંન્યાસી છે અને રાજ જનક ગૃહસ્થ છે, પણ જ્યારે હું એમની પાસે કાંઈક શીખવા જઉં દું ત્યારે મારે

મારી શ્રદ્ધાના પ્રતીક જેવું કાંઈક સાથે લઈ જવું જોઈએ. બીજી વખતે શુક્રદેવજી હાથમાં સમિધાઓ લઈ નમ્રભાવથી જનકરાજ સમક્ષ ઉપસ્થિત થયા અને તેમણે તેમને વિસ્તારપૂર્વક ભ્રષ્ટવિદ્યા સમજાવી.

શ્રદ્ધા ન હોય તો સાંભળનાર અને કહેનાર બંનેનો સમય અને શ્રમ નિરર્થક જાય છે. એટલા માટે શિક્ષાગુણની સાથે સાથે શ્રદ્ધા પણ વધારવાની કોણિશ કરવી જોઈએ. નિર્ધન વ્યક્તિ ભલે અતિ અદ્ય મૂલ્યવાળી વસ્તુઓ લેત આપે, પણ એણે વારંવાર પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા રહેવું જોઈએ. આ ભેટપૂજા એક પ્રકારનો આધ્યાત્મિક વ્યાયમ છે, જેના લીધે ‘શ્રદ્ધારૂપી શ્રદ્ધાંજલિ’ નો તીવ્ર વિકાસ થાય છે. શ્રદ્ધા એવું અસ્ય છે, જેનાથી પરમાત્માને પકડી શકાય છે. બીજી કોઈ પણ વસ્તુથી ને ભગવાન વશમાં આવતો નથી તે શ્રદ્ધારૂપી ભ્રષ્ટપાશમાં ફસાઈને ભક્તનો મિત્ર બની જાય છે. ઈશ્વરને પરાસ્ત કરવાનો એટમબોંબ માત્ર શ્રદ્ધા છે. આ મહાન દેવી સંમોહનાસ્ત્રને બનાવીને ચલાવવાનો પ્રારંભિક અભ્યાસ ગુરુની પાસે કરવાનો હોય છે, જ્યારે આ અસ્ય સારી રીતે હસ્તગત થઈ જાય તારે ભગવાનને પોતાના વશમાં લેવાનું કામ સાધક માટે ધારું જ સહેલું થઈ જાય છે.

આરંભિક કક્ષાનો રસાસ્વાદ કરવાથી સાધકની મનોભૂમિ બહુ સુદૃઢ અને પરિપક્વ બની જાય છે. એ ભૌતિકવાદની તુચ્છતા અને આત્મિકવાદની મહત્તમ, વ્યાવહારિક દિશાઓ અને દાર્શનિક દિશાઓ સમજી લે છે, તારે એને પૂર્ણ વિશ્વાસ આવી જાય છે કે મારો સાચો લાભ આત્મકલ્યાણના માર્ગ પર ચાલવામાં જ છે. શ્રદ્ધા પરિપક્વ થઈને જ્યારે નિષ્ઠાના રૂપમાં રૂપાંતર પામે છે ત્યારે એ ધારી મજબૂત બની જાય છે. પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવામાં એ એટલી દફ્તા ધારાણ કરે છે કે ગમે તે કષ્ટ સહન કરવામાં અને ગમે તેટલું તપ કરવામાં એ પાછી પાની નહીં કરે તથા ત્યાગની પરીક્ષાનો સમય આવે તારે બિલકુલ વિચલિત નહિ થાય. જ્યારે મનોભૂમિ આવી પાકી બની જાય છે તારે તપના અભિનિમાં પાકીને તે પૂર્ણતા પામે.

## તપસ્વીની ગુરુદક્ષિણા

લીલા લાકડાને માત્ર સૂર્યના તાપથી જ સૂક્ષ્મી શકાય છે. એથી લાકડાને ઘોડીક ગરમી મળશે. ધીમે ધીમે એની છાલ અને પદ્ધી તેનો ગર્ભ સુકાઈ જાય છે અને જ્યારે એ સારી રીતે સુકાઈ જાય ત્યારે તેને અભિનિમાં પદ્ધરાવતાં પ્રયંત અભિન બની જશે. લીલાં લાકડાને ચૂલામાં નાખવામાં આવે તો પરિણામ સાંદું આવતું નથી. પ્રથમ કક્ષાના સાધક માટે માત્ર ગુરુ ઉપર શ્રદ્ધા રાખવી અને પોતાનું દિશિનિંદુ સુધારી પ્રત્યક્ષ જીવન સુધારવાનું જ માત્ર કામ હોય છે. પ્રારંભિક છાન માટે આટલું જ બસ છે. સાધકને શરૂઆતથી જ તીવ્ર સાધનામાં નાખી દેવામાં આવે તો એ યુંગળાઈ જશે, તપની તીવ્રતા જોઈને જ ડરી જશે અને કદાચ પ્રયત્ન છોડી દેશે. બીજી કક્ષાનો સાધક ગરમીમાં ઘોડો તપ્યો હોવાથી નાની મુશ્કેલીઓ હસ્તાં-હસ્તાં સહન કરશે અને શ્રમનો બોંજે રાજ્યભૂષણી ઉદ્ઘાસે.

અભિનિદીક્ષાના સાધકને તપાવવા માટે કેટલાય પ્રકારનાં પ્રત, નિયમ, ત્યાગ વગેરે કરવાનાં હોય છે. પ્રાચીનકાળમાં ઉદ્ધારક, ધોર્ય, અરુણી, ઉપમન્યુ, કચ વગેરે અનેક શિષ્યોએ પોતાના ગુરુના આદેશ પ્રમાણે અનેક કષ્ટો ભોગવ્યાં અને ગુરુનાં બતાવેલાં કામો પૂરાં કર્યા હતાં. સ્થૂળ દિશિયો જોતાં આ મહાપુરુષોની સાથે તેમના ગુરુઓનો જે વ્યવહાર હતો તેને હદ્યહિન કહી શકાય તેવો હતો, પણ સાચી વાત તો એ છે કે એમણે નિંદા અને આજ્ઞાપોનો ભાર પોતાની ઉપર લઈને શિષ્યોને અમર અને પ્રકાશવાન બનાવી દીધા હતા. જે મુશ્કેલી અને યાતનાઓમાંથી રાજ હરિશ્ચન્દ્રને પસાર થવું પડ્યું ન હોત તો અનેક રાજ-મહારાજાઓની માફક એ પણ વિસ્તુતિના ખાડામાં પડી ગયા.

અભિનિદીક્ષા લઈને શિષ્ય ગુરુને પૂછે છે, “આદેશ આપો કે હું આપને શું ગુરુદક્ષિણા આપું?” ગુરુ શિષ્યની

રોજ સેકંડો કથા, પ્રવચન, વાખ્યાન થતાં હોય છે, અખબારોમાં, પોસ્ટરોમાં, પત્રિકાઓમાં જતજતની વાતો આવે છે અને રેડિયો ઉપર નિય ઉપરેશ થયા જ કરે છે, પાણ તેના ઉપર કોણ ધ્યાન આપે છે, કેમકે સાંભળનારાઓને સંભળાવનારાઓ ઉપર શ્રદ્ધા જ હોતી નથી. એથી મહત્વપૂર્ણ વાતો પાણ નિરર્થક લેવી લાગે છે. કોઈ ઉપરેશ ત્યારે જ પ્રભાવશાળી થાય છે, જ્યારે એ ઉપરેશકર્તા ઉપર લોકોને શ્રદ્ધા હોય. એ શ્રદ્ધા જેટલી તીવ્ર હોય એટલો જ એનો પ્રભાવ પાણ મજબૂત હોય છે. પ્રથમ કક્ષાનો મંત્રદીક્ષિત સાધક ગાયત્રીનો સાચો લાભ મેળવી શકે, એટલા માટે તેને દીક્ષા લેતી વખતે ગુરુમાં અતૃપ્ત શ્રદ્ધા રાખવાની પ્રતિજ્ઞા લેવી પડે છે. એ ગુરુને દેવતુલ્ય પરમાત્માનું પ્રતીક માનશે. શ્રદ્ધાને લીધે જ્યારે માટી, પન્થર અને ધાતુની બનેલી મૂર્તિ આપાણા માટે દેવ બની જય છે, તો પછી જીવિત મનુષ્યમાં દેવત્વના શ્રદ્ધાપૂર્વકના આરોપાણથી એ સાચો દેવ કેમ ન બની જય?

## શ્રદ્ધાના પ્રકટીકરણની જરૂર

એકલબ્ય ભીલ દ્રોષ શુદ્ધાની માટીની પ્રતિમા બનાવી તેની પાસેથી બાળગવિદ્યા શીખ્યો હતો. એ મૂર્તિએ ભીલને બાળગવિદ્યામાં એવો પ્રવીણ બનાવી દીધો કે એનાં બાળોથી એ ફૂતરાનું મોઢું સીવી શકેલો. આ જેઠિને ગ્રોણાચાર્ય પાસે બાળગવિદ્યા શીખતા પાંડવોને દીખ્યા થઈ. સ્વામી રામાનંદે ના પાડી હોવા છતાં કબીર રેમનો શિષ્ય થયો હતો અને શ્રદ્ધાના જેરે એણે એટલો બધો લાભ ઉઠાવ્યો કે એમના વિધિવત્ દીક્ષા પામેલા શિષ્યો પૈકી એકે પાણ એટલો લાભ લીધો ન હતો. રજેદર્શન થયા પછી ગર્ભશિયમાં વીરયનું એક બિંદુ જવાથી ગર્ભ ધારાણ થઈ જય છે, જ્યારે જેને રજેદર્શન નથી થતું એવી વંધ્યા ખ્યાને પૂર્ણ પુરુષત્વવાળો પતિ પાણ ગર્ભ ધારાણ કરાવી શકતો નથી. શ્રદ્ધા એક પ્રકારનો રજેદર્શ છે, જેથી સાધકના અંત:કરણમાં સહૃપદેશ રૂપી બીજ પડે છે અને ફળે ફૂલે છે. અશ્રદ્ધાણુ દિલમાં બ્રહ્મા પાણ શ્રદ્ધા ઉપજાવી શકતા નથી. શ્રદ્ધાના અભાવથી કોઈ મહાપુરુષના સાંનિધ્યમાં દિવસ-રાત રહેવા છતાં કોઈ વ્યક્તિ કશો જ લાભ ઉઠાવી શકતી નથી, જ્યારે શ્રદ્ધાવાળી દૂર રહેતી વ્યક્તિ પાણ યશેચ્છ લાભ ઉઠાવી શકે છે. એટલા માટે આરંભિક કક્ષામાં મંત્રદીક્ષિતે ગુરુના પ્રતિ તીવ્ર શ્રદ્ધા રાખવી પડે છે.

વિચારોને મૂર્તિમાન રૂપમાં લાવવા માટે તેમને પ્રકટ રૂપથી વ્યવહારમાં લાવવા પડે છે. જેટલાં પાણ ધાર્મિક કર્મકાંડ, દાન, પુણ્ય, પ્રત, ઉપાસના, હવન, પૂજન, કથા, કીર્તન વગેરે હોય એ સર્વનું એ જ પ્રયોજન છે કે આંતરિક શ્રદ્ધા વ્યવહારમાં પ્રકટ થાય અને સાધકના મનમાં એ પુષ્ટ બની જય. મંત્રદીક્ષામાં ગુરુ પ્રતિ શ્રદ્ધા રાખવાની એક ખાસ શરત છે. શ્રદ્ધા નહીં હોય અથવા શિથિલ હોય તો એ દીક્ષા કેવળ નામની જ હોય છે. અશ્રદ્ધાણુ આવી ગુરુદીક્ષાથી કોઈ ખાસ કાર્ય સિદ્ધ નહીં કરી શકે. દીક્ષા વખતે સ્થાપેલી શ્રદ્ધા કર્મકાંડ મારફતે જાચત રહે એ જ કરારણને લીધે વખતો વખત ગુરુપૂજન યોજનવામાં આવે છે. દીક્ષા વખતે વસ્તુ, પાત્ર, પુણ્ય, ભોજન, દક્ષિણા વગેરે દ્વારા ગુરુનું પૂજન કરવામાં આવે છે. ગુરુપૂર્ણિમા (અષાઢ સુદ ૧૫) ઉપર યથાશક્તિ એમનાં ચરાગોમાં શ્રદ્ધાંજલિ રૂપે કાંઈક બેટ અર્પણ કરવામાં આવે છે. આ પ્રથા પોતાની આંતરિક શ્રદ્ધાને મૂર્તિ સ્બરૂપ આપવા, એને વધારવા અને એને પરિપુષ્ટ કરવા માટે નિર્માણ થઈ છે. કેવળ વિચાર માત્રથી કોઈ ભાવના પરિપક્વ થતી નથી. કિયા અને વિચાર એ બનેના સંમિત્રાણથી એક સંસ્કાર બને છે, જે મનોભૂમિમાં સ્થિર થઈને બહુ જ સુંદર પરિણામો આપે છે.

પ્રાચીનકાળમાં એ નિયમ હતો કે ગુરુની પાસે જતી વખતે શિષ્ય ખાલી હાથે જતો નહોતો, પાણ કોઈ વસ્તુ, પછી ભલે તે અતિસ્વલ્ય મૂલ્યની હોય એ ભેટ તરીકે લઈ જતો હતો. સમિધા હાથમાં લઈને શિષ્ય ગુરુની પાસે જતો હતો. તેને સમિત્પાણી કહેવામાં આવે છે. એ સમિધાઓ એની શ્રદ્ધાનું પ્રતીક હતી, પછી તેનું મૂલ્ય જમે તેટલું અદ્ય કેમ ન હોય. શુકૃદેવજી જ્યારે રાજ જનક પાસે બ્રહ્મગવિદ્યાનું શિક્ષણ લેવા ગયા ત્યારે રાજ જનક મૌન રહ્યા અને એમારો ઉપરેશનો એક શબ્દ પાણ ન કહ્યો. શુકૃદેવજી પાછા ચાલ્યા આવ્યા. પછી તેમને ધ્યાનમાં આવ્યું કે પોતે ભલે એક સંન્યાસી છે અને રાજ જનક ગૃહસ્થ છે, પાણ જ્યારે હું એમની પાસે કાંઈક શીખવા જઉં છું ત્યારે મારે

મારી શ્રદ્ધાના પ્રતીક જેવું કાંઈક સાથે લઈ જવું જોઈએ. બીજી વખતે શુકૃદેવજી હાથમાં સમિધાઓ લઈ નમ્રભાવથી જનકરાજ સમજ્ઞ ઉપરિસ્થિત થયા અને તેમાળે તેમને વિસ્તારપૂર્વક ભ્રષ્ટવિદ્યા સમજાવી.

શ્રદ્ધા ન હોય તો સાંભળનાર અને કહેનાર બંનેનો સમય અને શ્રમ નિરર્થક જાય છે. એટલા માટે શિક્ષાગની સાથે શ્રદ્ધા પણ વધારવાની કોણિશ કરવી જોઈએ. નિર્ધન વિક્ષિત ભવે અતિ અલ્પ મૂલ્યવાળી વસ્તુઓ બેટ આપે, પણ એણે વારંવાર પોતાની શ્રદ્ધાનાલિ અર્પણ કરતા રહેવું જોઈએ. આ બેટપૂજા એક પ્રકારનો આધ્યાત્મિક વ્યાયામ છે, જેના લીધે ‘શ્રદ્ધારૂપી ગ્રહણશક્તિ’ નો તીવ્ર વિકાસ થાય છે: શ્રદ્ધા એવું અસ્ત્ર છે, જેનાથી પરમાત્માને પકડી શકાય છે. બીજી કોઈ પણ વસ્તુથી જે ભગવાન વશમાં આવતો નથી તે શ્રદ્ધારૂપી બ્રહ્મપાશમાં ફ્સાઈને ભક્તનો મિત્ર બની જાય છે. ઈશ્વરને પરાસ્ત કરવાનો એટમબોંબ માત્ર શ્રદ્ધા છે. આ મહાન દૈવી સંમોહનાસ્ત્રને બનાવીને ચલાવવાનો પ્રારંભિક અભ્યાસ ગુરુની પાસે કરવાનો હોય છે, જ્યારે આ અસ્ત્ર સારી રીતે હસ્તગત થઈ જાય તારે ભગવાનને પોતાના વશમાં લેવાનું કામ સાધક માટે ઘણું જ સહેલું થઈ જાય છે.

આરંભિક કક્ષાનો રસાસ્વાદ કરવાથી સાધકની મનોભૂમિ બહુ સુદૃઢ અને પરિપક્વ બની જાય છે. એ ભૌતિકવાદની તુચ્છતા અને આત્મકવાદની મહત્તમા, વ્યાવહારિક દિશિથી અને દાર્શનિક દિશિથી સમજી લે છે, ત્યારે એને પૂર્ણ વિશ્વાસ આવી જાય છે કે મારો સાચો લાભ આત્મકલ્યાણના માર્ગ પર ચાલવામાં જ છે. શ્રદ્ધા પરિપક્વ થઈને જ્યારે નિષ્ઠાના ઝૂપમાં ઝૂપાંતર પામે છે ત્યારે એ ઘણી મજબૂત બની જાય છે. પોતાનું લભ્ય સિદ્ધ કરવામાં એ એટલી દફ્તા ધારાણ કરે છે કે ગમે તે કષ્ટ સહન કરવામાં અને ગમે તેટલું તપ કરવામાં એ પાછી પાણી નહીં કરે તથા ત્યાગની પરીક્ષાનો સમય આવે ત્યારે બિલકુલ વિચલિત નહિ થાય. જ્યારે મનોભૂમિ આવી પાકી બની જાય છે ત્યારે ગુરુ દ્વારા એને અભિનીતીક્ષા આપી ગરમ કરવામાં આવે છે, જેથી તેનો મેલ બળી જાય, કિર્તિનો પ્રકાશ થાય અને તપના અભિનમાં પાકીને તે પૂર્ણતા પામે.

### તપસ્વીની ગુરુદ્વિક્ષાગ્ના

લીલા લાકડાને માત્ર સૂર્યના તાપથી જ સૂક્ષ્વવી શકાય છે. એથી લાકડાને થોડીક ગરમી મળશે. ‘થીમે થીમે એની છાલ અને પછી તેનો ગર્ભ સુકાઈ જાય છે અને જ્યારે એ સારી રીતે સુકાઈ જાય ત્યારે તેને અભિનમાં પદ્ધરાવતાં પ્રચંડ અભિન બની જશે. લીલાં લાકડાને ચૂલ્બામાં નાખ્યવામાં આવે તો પરિણામ સાણું આવતું નથી. પ્રથમ કક્ષાના સાધક માટે માત્ર ગુરુ ઉપર શ્રદ્ધા રાખવી અને પોતાનું દિશિબિંદુ સુધારી પ્રત્યક્ષ જીવન સુધારવાનું જ માત્ર કામ હોય છે. પ્રારંભિક છાત્ર માટે આટલું જ બસ છે. સાધકને શરૂઆતથી જ તીવ્ર સાધનામાં નાખી દેવામાં આવે તો એ ગુંગળાઈ જશે, તપની તીવ્રતા જોઈને જ ડરી જશે અને કદાચ પ્રયત્ન છોડી દેશે. બીજી કક્ષાનો સાધક ગરમીમાં થોડો તપ્યો હોવાથી નાની મુશ્કેલીઓ હસ્તાં-હસ્તાં સહન કરશે અને શ્રમનો બોજે રાજ્યભૂશીથી ઉદાવશે.

અભિનીતીક્ષાના સાધકને તપાવવા માટે કેટલાય પ્રકારનાં ત્રત, નિયમ, તાગ વગેરે કરવાનાં હોય છે. પ્રાચીનકાળમાં ઉદાલક, ધૌમ્ય, અરુણી, ઉપમન્યુ, કચ વગેરે અનેક શિષ્યોએ પોતાના ગુરુના આદેશ પ્રમાણે અનેક કષ્ટો ભોગવાં અને ગુરુનાં બતાવેલાં કામો પૂરાં કર્યા હતાં. સ્થૂળ દિશિથી જોતાં આ મહાપુરુષોની સાથે તેમના ગુરુઓનો જે બ્યાંહાર હતો તેને હદ્યહીન કહી શકાય તેવો હતો, પણ સાચી વાત તો એ છે કે એમાળે નિંદા અને આદેશોનો ભાર પોતાની ઉપર લઈને શિષ્યોને અમર અને પ્રકાશવાન બનાવી દીધા હતા. જે મુશ્કેલી અને યાતનાઓમાંથી રાજ હરિશ્ચંદ્રને પસાર થવું પડ્યું ન હોત તો અનેક રાજ-મહારાજાઓની માફક એ પણ વિસ્તૃતિના ખાડામાં પડી ગયા હોત.

અભિનીતીક્ષા લઈને શિષ્ય ગુરુને પૂછે છે, “આદેશ આપો કે હું આપને શું ગુરુદ્વિક્ષાગ્ના આપું?” ગુરુ શિષ્યની

મનોભૂમિ, સામર્થ્ય, યોગ્યતા, શ્રદ્ધા, ત્યાગવૃત્તિ વગેરે જોઈને ગુરુદક્ષિણા માગે છે. આ યાચના પોતાને માટે ધન, દોલત અથવા રૂપિયા-પૈસાનાં રૂપમાં કદાપિ હોતી નથી. સદ્ગુરુ હંમેશાં પરમ ત્યાગી, અપરિગ્રહી, કષણહિંબગુ અને સ્વલ્પ સંતોષી હોય છે. જે ગુરુ પોતાના માટે શિષ્ય પાસેથી કાંઈક માગે છે એ ગુરુ નથી. આવા લોકો ગુરુ જેવા પરમ પવિત્ર પદના અધિકારી હોઈ શકે નહીં. અજિનદીક્ષા આપીને ગુરુ જે કાંઈ માગે છે તે શિષ્યને અધિક ઉજ્જવળ, અધિક સુદૃઢ, અધિક ઉદાર અને અધિક તપ્સસ્વી બનાવવા માટે જ હોય છે. આ યાચના એના પણના વિસ્તાર માટે, પુણ્યનો વિશેષ સંચય કરવા માટે અને ત્યાગનો આત્મસંતોષ તેને આપવા માટે હોય છે.

શિષ્ય કહે છે, “ગુરુજી દક્ષિણા માગો! હું સુદૃઢ છું, મારી આત્મિક સ્થિતિની પરીક્ષા લો.” સ્કૂલ-ક્રોલેજેમાં પરીક્ષા લેવામાં આવે છે અને પાસ થનાર વિદ્યાર્થીનિ પ્રમાણપત્ર આપવામાં આવે છે. પ્રમાણપત્રથી સફળ ઉમેદવારની લાયકાતનું માપ નીકળે છે. પરીક્ષા ન હોય તો લાયકાત થી રીતે મપાય? સંસારમાં કોઈ વ્યક્તિની મહત્તમતાનો પ્રચાર કરવા માટે, એના ગૌરવને સર્વસાધારણ સામે પ્રકટ કરવા માટે અને સાધકને પોતાની મહાનતાનો આત્મવિશ્વાસ પેદા કરાવવા માટે ગુરુ પોતાના શિષ્ય પાસે ગુરુદક્ષિણા માગે છે અને શિષ્ય તે આપી કૃતાર્થ થાય છે.

પ્રારંભિક કક્ષામાં મંત્રદીક્ષાનો શિષ્ય પોતાના ગજ પ્રમાણે ગુરુપૂજન કરે છે. શ્રદ્ધા રાખવી અને તેમની સલાહથી પોતાનું જીવન તથા ચારિત્ર સુધારવું એટલું જ અનું કાર્યક્ષેત્ર છે. એ વખતે ગુરુ ન તો ગુરુદક્ષિણા માગે છે અને ન તો શિષ્ય તેમને માગવાનું કહે છે. બીજી કક્ષાનો શિષ્ય અજિનદીક્ષા લઈને ‘ગુરુદક્ષિણા માગવા અને તેની પરીક્ષા લેવા માટે’ પ્રાર્થના કરે છે. ગુરુ કૃપા કરીને એ વિનંતીનો સ્વીકાર કરે છે અને એ રીતે શિષ્યની પ્રતિક્ષા, મહત્તમતા, કીર્તિ અને પ્રમાણિકતા ચારણાણી વધારી હોય છે. ગુરુની હંમેશાં એવી જ ઈચ્છા હોય છે કે નેથી સર્વનું સર્વ વાતે કલ્યાણ જ થાય. એમાં વ્યક્તિનું તથા સમાજનું પાણ ભલું જ હોય. કેટલીકવાર નિર્ભળ મનોવૃત્તિના લોકોને પાણ આગળ વધારવામાં આવે છે. ગુરુ એવાઓની પાસેથી ગુરુદક્ષિણામાં એવી નાની નાની ચીજ માગે છે, જે સાંભળીને આપણને રમ્ભૂજ પેદા થાય અને હસવું આવે. અમુક ઇણ, અમુક શાક, અમુક મીઠાઈ વગેરેનો ત્યાગ કરવાનું કહેવામાં આવે છે. આવી વાત કશા મહત્વની હોતી નથી, પાણ શિષ્યનું મન હલકું થઈ જાય છે અને તે અનુભવ કરે છે કે “મેં કાંઈક ત્યાગ કર્યો” ગુરુના આદેશનું પાલન કર્યું, ગુરુદક્ષિણા ચૂકવી દીધી, ઝાગુમાંથી છૂટ્યો અને પરીક્ષામાં પાસ થયો. બુદ્ધિમાન ગુરુ સાધકની આ મનોદશાનો ઝ્યાલ કરીને જ અને તપાવે છે.

### ભક્તદીક્ષાની દક્ષિણા-‘આત્મદાન’

ક્રમશ: દીક્ષાની મહત્તમ વધતી જાય છે. સાથે સાથે અનું મૂલ્ય પાણ વધે છે. વસ્તુ નેટલી મહાન હોય તેટલી તેની કિંમત પાણ વધારે હોય છે. લોહું સસ્તું મળે છે. મામૂલી દુકાનદારને ત્યાંથી લોઢાની વસ્તુ ખરીદી શકાય છે, પાણ સોનાચાંડી અને જવેરાતની ચીજે તો જવેરીને ત્યાં જ મળે અને તેની કિંમત પાણ બહુ આપવી પડે. ભક્તદીક્ષામાં વિચારશક્તિથી કામ ચાલતું નથી અને પ્રાણશક્તિ પાણ ઉપયોગમાં આવતી નથી. એક આત્મા બીજા આત્મા સાથે પરાવાણીથી વાતાવાપ કરે છે. આત્માની ભાષાને પરા કહે છે. વૈભરીવાણી કાનથી સંભળાય છે, મધ્યમા મન સાંભળે છે, પણ્યંતિ હદ્ય સાંભળે છે અને પરાવાણીથી બે આત્માઓ વાતથીત કરી શકે છે. આત્મા બીજી વાણીઓ સમજી શકતો નથી. નેમ કીડીની ભાષા મનુષ સમજી શકતો નથી, તેમ વ્યાખ્યાન અને ઉપદેશ આત્મા સુધી પહોંચી શકતાં નથી. ઉપનિષદનું વચન છે કે “ધારું વાંચનાર અથવા ધારું સાંભળનાર આત્માની પ્રાપ્તિ કરી શકતો નથી, કારણ સ્પષ્ટ છે. બજ વગરનાને તે પ્રામ થતો નથી.

કીચાંમાં ફ્લાયેલા હાથીને બીજે હાથી જ બહાર કાઢી શકે છે. પાણીમાં દૂબતી વસ્તુને કોઈ તરવૈયો જ કાઢી શકે. રાજને મદદ કરવા માટે રાજ જ જોઈએ. એક આત્માને ભક્તશાન આપવું, તેનું ભક્તત્વ જગત કરવું, એને ભક્તપરાયણ બનાવવો એ તે જ કરી શકે ને પોતે ભક્તત્વવાળો હોય, જેનામાં સ્વય અજિન હોય તે જ બીજાને અજિન

અને ઉધ્મા આપી શકે. અજિનનું ચિત્ર ગમે તેટલું આકર્ષક હોય છતાં તે ખીચડી રંધવા કામમાં આવતું નથી.

કોઈ વ્યક્તિ સાધુ-મહામાનો વેશ બનાવી લેતેટલા માત્રથી તેનામાં ભ્રસ્તેજ નથી આવતું. જેનામાં સાધુતા હોય તેજ સાધુ છે, જેનામાં આત્માની મહાનતા હોય એ જ મહાત્મા છે, જેનામાં ભ્રસ્તનું જ્ઞાન છે એ જ બ્રાહ્માણ છે, જેનામાં રાગ નથી એ વૈરાગી છે, જે સ્વાધ્યાયમાં, મનમાં લીન રહે છે એ મુનિ છે, જોણ અહંકાર અને મોહમતાને ત્યાગી દીધાં છે એ સંન્યાસી છે, જે તપમાં રચ્યોપચ્ચો રહે છે એ તપસ્વી છે. કોણ શું છે તેનો નિર્ણય તેના ગુરુ-કર્મથી થાય છે, વેશમાત્રથી નહીં. એટલા માટે ભ્રસ્તપરાયાણ થવા માટે કોઈ જતનું પ્રદર્શન કર્યા સિવાય માત્ર સીધી અને સાદી રીતે રહીને પોતાનું આત્મકલ્યાણ સહાતું હોય તો પછી બહારનો ડોળદમામ શા માટે કરવો જેઈએ? સાદાં વસ્ત્ર, સાદો વેશ અને સાદા જીવનથી જ જે ઉત્તમ આધ્યાત્મિક સાધના થઈ શકતી હોય તો પછી ચિત્રવિચિત્ર વેશ અને કાર્યક્રમ અપનાવવાની શી જરૂર?

બ્રાહ્મી દષ્ટિ-દિવ્યદષ્ટિ, મળવી એ જ ભ્રસ્તસમાધિ છે. સર્વત્ર સર્વમાં ઈશ્વરનાં દર્શન કરવાં, આપણા પોતાનામાં જ તેજયુંજની ઉજાવળ જાંખી થવી અને આપણી પોતાની ઈચ્છાઓ અને આકંક્ષાઓનું દિવ્ય અને દૈવી બની જવું એ જ બ્રાહ્મી સ્થિતિ છે. પૂર્વકાળમાં આકાશતત્ત્વની પ્રધાનતા હોવાથી લાંબા વખત સુધી પ્રાણને રોકીને ભ્રમાંડમાં સ્થિર કરવાને અને શરીરને નિશ્ચેષ બનાવી દેવાને જ સમાધિ કહેવામાં આવતી હતી. ધ્યાનકાળમાં પૂર્ણ તન્મયતા થઈ જવી અને શરીરની સુધબુધ જતી રહેવી એ જ એ યુગમાં સમાધિનાં લક્ષણો હતાં. એ યુગમાં વાયુ અને અજિનતત્ત્વોની પ્રધાનતા હતી. આજના જમાનામાં બળ અને પૃથ્વીતત્ત્વની પ્રધાનતા હોવાથી બ્રાહ્મીસ્થિતિને જ સમાધિ કહેવામાં આવે છે. આજના યુગમાં તો આપણા સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર ‘ભગવદ્ગીતા’ના બીજ અધ્યાયમાં ભ્રસ્તસમાધિની વિસ્તારપૂર્વક સમજ આપી છે. એ સ્થિતિને પ્રાપ્ત કરનાર ભ્રસ્તસમાધિસ્થ કહેવાય છે.

આજે પણ કોઈ વ્યક્તિ જમીનમાં ખાડો ખોડીને દટાઈ રહેવાનું પ્રદર્શન કરી સમાધિસ્થ થયો એમ કહેવડાવે છે. આવી બાલકીડા ઘણું હાસ્યાસ્પદ નીવડે છે. આ તો મનના ગભરાત ઉપર કાણૂ મેળવવા માટે કરેલી માનસિક સાધનાનો ચ્યમકાર માત્ર છે. રજાઈની અંદરની ઘોડી ઘણું હવાથી આખી રાત માણસ ઊંધી શકતો હોય તો પછી આટલી લંબાઈ પહોળાઈવાળા ખાડામાં પંદર દિવસ કાઢી નાખવાનું ખાસ મુશ્કેલ નથી. ગુજરાતાં રહેવાના અભ્યાસવાળા મનુષ્યને જમીનના ખાડામાં રહી સમાધિનું પ્રદર્શન કરવું ઘણું સહેલું છે. એવી કુડા અને કુતૂહલ તરફ ધ્યાન આપવાની જરૂર નથી.

### ‘પરાવાણી’ દ્વારા અંતરિક પ્રેરણા

આત્મામાં ભ્રસ્તતત્ત્વનો પ્રવેશ કરવાની બાબતમાં બીજ આમા મારફતે ભ્રસસંસ્કારનો થતો પ્રયત્ન ઘણું અગત્યનું કામ કરે છે. સાપ ન્યારે મનુષ્યને કરેદે છે ત્યારે માત્ર એક તલભાર જગ્યામાં જ દંશ મારે છે અને માત્ર એક રતિભાર જેટલું જ ઝેર અંદર નાખે છે, પણ એ તવભાર જગ્યામાં માત્ર રતીભાર નાં મેલું એર આખા શરીરમાં ફેલ્લઈ જઈ આખા દેહને વિષમય બનાવી દે છે અને અતે મૂન્યુ થાય છે. ભ્રસ્તદીક્ષા એ આધ્યાત્મિક સર્વદંશ જ છે. એકનું કેર બીજાને ચઢી જય છે. અજિની ચિનગારી આખા ઝના ઢગલાને અજિનૃપ્ત બનાવી દે છે સારી રીતે વિષપૂર્વક કરેલો દીક્ષાસંસ્કાર ઘણી તેજીથી ફેલાય છે. થોડા જ વખતમાં સુંદર વિકાસ સાથે છે. ભ્રસ્તજ્ઞાનનાં પુસ્તકો વાંચવા અને આધ્યાત્મિક પ્રવચનો સાંભળતા રહેવાથી મનોભૂમિ તો તેયાર જ થેણી હોય છે, પણ બીજ વાચા સિવાય અંકુર ઊગતો નથી અને અંકુર ઊગા સિવાય શીતળ ધાયા અને મધુર ફળવાણું વૃક્ષ થતું નથી. સ્વાધ્યાય અને સત્સંગ ઉપરાંત આત્મકલ્યાણ માટે સાધનાની પાણ ખાસ જરૂર હોય છે. સાધનાના પાયામાં સજીવ પ્રાણ અને સજીવ પ્રેરણા હશે તો તે અધિક સગવડ અને સુગમતાપૂર્વક વિકાસ પામશે.

ભ્રાહી સ્થિતિનો સાધક પોતાની અંદર અને બહાર ભ્રમનો, પુણ્ય પ્રકાશનો પ્રત્યક્ષ રૂપમાં અનુભવ કરે છે. તેથી સ્પષ્ટ થાય છે કે એ ભ્રમના જોળામાં આનંદ કરી રહ્યો છે. ભ્રમના આનંદસિંહુમાં મજન થઈ રહ્યો છે. આ દશામાં પહોંચીને એ જીવનમુક્ત થઈ જાય છે. જે પ્રારબ્ધ બની ગયું છે એવાં કર્માનો બાકી રહેલો હિસાબ આપવા જ એ જીવતો રહ્યો હોય છે. જ્યારે હિસાબ પૂરો થાય છે ત્યારે પૂર્ણ શાંતિથી અને પૂર્ણ ભ્રમદશામાં એની જીવનલીલા સમામ થાય છે. પછી તેને ભવબંધનમાં પાછા આવવાનું હોય નથી. પ્રારબ્ધને પૂરું કરવાને માટે જ એ શરીર ટકાવી રાખે છે, પણ સામાન્ય શ્રેણીના માણસની માફક એનું જીવન સીધું અને સાદું હોવા છતાં તેની આત્મિક સ્થિતિ બહુ ડાંચી હોય છે. અમારા જાગવા પ્રમાણે એવા અનેક ઝાપિ, રાજ્યિ અને ભ્રમાર્થિઓ છે, જેઓ બહારથી બહુ જ સાધારણ રીતે જીવન વિતાવતા હોવા છતાં તેમની આંતરિક સ્થિતિ સત્યાગના શ્રેષ્ઠ ઝાપિઓના જેવી જ મહાન છે. યુગપ્રભાવ પ્રમાણે આને ચમત્કારોનો જમાનો રહ્યો નથી, તો પણ આત્માની ઉત્ત્રતિમાં કદી કોઈ યુગ, કાળ અથવા જમાનો અવરોધ કરી શકતો નથી. પૂર્વકાળમાં જેમ મહાપુરુષો થતા હતા, તેવી જ રીતે આને પણ મહાપુરુષો પાડે છે. એ વખતે યોગી અથવા મહાર્થિઓ ઓળખાઈ જતા હતા, આને એમને ઓળખવા મુશ્કેલ છે. એ ઓળખવાની મુશ્કેલી હોવા છતાં પણ આત્મવિકાસનો માર્ગ તો એટલો જ બુદ્ધો અને સરળ છે.

ભ્રમદીક્ષાના અધિકારી ગુરુ અને શિષ્ય આ મહાન સંબંધને ફરીથી સ્થાપી શકે છે. શિષ્ય ગુરુને આત્મસમર્પણ કરે છે. ગુરુ તેનાં કામોની જવાબદારી અને પરિણામ પોતાના શિરે લઈ કે છે. ઈશ્વરને આત્મસમર્પણ કરવાની ભૂમિકા ગુરુને આત્મસમર્પણ કરવાથી જ શરૂ કરે છે. શિષ્ય પોતાનું સર્વસ્વ ગુરુને ચરાગે ધરી દે છે. ગુરુ સર્વ ચીજેનો સ્વીકાર કરે છે અને અમાનત તરીકે શિષ્યને પાછી આપે છે અને આદેશ કરે છે કે આ સર્વ વસ્તુઓ ગુરુની સમજીને તેનો ઉપયોગ કરવો. આ સમર્પણથી વસ્તુસ્થિતિમાં કાંઈ ખાસ ફરંક પડતો નથી કેમ કે ભ્રમજ્ઞાની ગુરુ અપરિણી હોવાના કારણે આ સમર્પણને કરે પણ શું ? બીજું વ્યવસ્થા અને વ્યવહારની દાખિએ પણ શિષ્ય સોચેલું સધારણું એમના પોતાના સંરક્ષણમાં રહે એ જ ઢીક છે. એટલા માટે બહારથી જેતાં સમર્પણમાં કોઈ ખાસ બાબત નથી, પણ આત્મિક દાખિથી આ આત્મદાનની કિમત એટલી મોટી છે કે તેની તુલનામાં ગમે તેવા ત્યાગ અથવા પુણ્યની કશી જ કિમત નથી.

જ્યારે બે ચાર રૂપિયા દાન કરવાથી મનુષ્યને આંત્મસંતોષ અને પુણ્ય પ્રાપ્ત થાય તો પછી આખું શરીર દાનમાં આપી દેતાં કેટલું પુણ્ય અને આત્મસંતોષ મળશે તેની કલ્પના જ કરી શકતી નથી. આ જગતમાં આત્મદાન કરતાં બીજું કોઈ મોટું દાન પ્રાણીમાત્ર માટે શક્ય નથી. એટલા જ માટે આખા વિશ્વભ્રમાંડમાં તેના જેટલું પુણ્યકળ પણ બીજું કોઈ નથી. નિય સવા માણ સોનાનું દાન કરનાર કાર્ય દાનવીરના નામથી પ્રસિદ્ધ હતો. જે દાનીએ પોતાની પાસે કર્યું જ રાખ્યું નથી તેની તુલનામાં બીજે કોઈ પણ દાની આવી શકતો નથી.

‘આત્મદાન’ મનોવૈજ્ઞાનિક દાખિથી એક મહાન કાર્ય છે. પોતાની સર્વ વસ્તુઓ ગુરુની અને છેવટે પરમાત્માની છે એવું સમજીને જ્યારે તેનો તેમના આદેશ પ્રમાણે નોકરની માંફક ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેનો સ્વાર્થ, મોહ, અહંકાર, માન, મદ, મત્સર, કોધ વગેરે સર્વ કાંઈ ઓંગળી જાય છે. જ્યારે મારું કશું જ નથી તો પછી અહંકાર શા માટે ? જ્યારે ઉપાર્નિત વસ્તુઓનો સ્વામી ગુરુ અથવા પરમાત્મા છે તો પછી હાનિલાભમાં શોક અને સંતાપ ડેવાં? આવી રીતે આત્મદાનમાં વસ્તુત : અહંકારનું પણ દાન થઈ જાય છે. ‘મારાપણા’ નું અભિમાન ઓગળી જાય છે. ‘મારાપણા’ની ભાવનાને બદલે ‘ગુરુ’ની અથવા પરમાત્માની ભાવના જગ્યાત થાય છે. આ ભાવના-પરિવર્તન (આત્મપરિવર્તન) એક અન્યાંત રહસ્યમય અસાધારણ ક્રિયા છે. તેનાથી સાધક સહજ રીતે જ બંધનોમાંથી ધૂટી જાય છે. અહંકારને લીધે જે અનેક સંસ્કાર તેના ઉપર લદાય છે તેમાંનો એક પણ તેના ઉપર પડતો નથી. જેમ નાનું બાળક પોતાના ઉપર ભાર નથી લેતું અને તેનો સધળો ભાર માતાને અને પિતાને સહજ કરવાનો હોય છે તેમ

આત્મદાનીનો સધળો ભાર કોઈ ઉચ્ચતર સત્તા ઉપર જતો રહે છે.

બ્રહ્મદીક્ષાનો શિષ્ય ગુરુને આત્મદાન કરે છે. મંત્રદીક્ષિતને ગુરુપૂજા કરવી પડે છે. અજિન્દીક્ષિતને ગુરુદક્ષિણા આપવી પડે છે. બ્રહ્મદીક્ષિતને આત્મસમર્પણ કરવું પડે છે. રામને રાજ્યનો અધિકાર છે એમ માનીને તેમની પાદુકા સિંહાસન પર મૂકીને જેમ ભરત રાજુકાળ ચલાવતો હતો, તે જ પ્રમાગે આત્મદાની પોતાની વસ્તુઓનું સમર્પણ કરીને તેના વ્યવસ્થાપકના રૂપમાં સ્વયં કામ કરે છે.

### વર્તમાનકાળની મુશ્કેલીઓ

આજે વ્યાપક રૂપમાં અનેતિકતા ફેલાઈ છે. સ્વાધી અને ધૂર્તોનું ધારું જેર છે. સાચા સત્ત્વાત્માનો અભાવ વર્તાઈ રહ્યો છે. આજે તૈવ ઉત્કંઠાવણા શિષ્ય પાણ નથી અને સાચો રસ્તો બતાવનારા યોગ્ય ચારિત્ર્યવાન તપસ્વી ગુરુ પાણ નથી. આ દશામાં ગુરુશિષ્યનો આધ્યાત્મિક અને મહત્વપૂર્ણ સંબંધ થવો જ મુશ્કેલ બની ગયો છે. શિષ્ય દીયાં છે કે પોતાને કશું જ ન કરવું પડે તેવા ગુરુ મળી જાય કે જે પોતાની નમતા જોઈને પોતાને માટે બધું જ તૈયાર કરી હે. ગુરુની મનોવૃત્તિ પાણ એવી હોય છે કે શિષ્યોને ઉલ્લભ બનાવીને તેમની પાસેથી આર્થિક લાભ મેળવી લેવાય અને તેમની શ્રવ્યાને દોહી લેવાય. એવી જોડ--લોભી ગુરુ અને લાલચું ચેલા, બંને નરકમાં ડેલમઢેલા ઉદાહરણ બની જાય છે. આવા લોકોનું પ્રમાગ વધારે હોવાના લિધે આત્મહાન સંબંધ શિથિલાથઈ ગયો છે. અત્યારે કોઈને પાણ ગુરુ બનાવવો એ આઉંબરમાં ફસાવા જેવું છે અથવા કોઈને શિષ્યે બનાવવો એટલે નકામી વધારે પડતી જાંઝળમાં ઊત્તરવા જેવું છે. જ્યાં સર્વાથી છે ત્યાં પાણ બંને પક્ષોની સ્થિતિ ગમે તેટલી બગડી ગઈ હોય અને નિરાશાજનક થઈ ગઈ હોય, પાણ એક ભારતીય ધર્મની મુખ્ય આધારશિલાનું મહત્વ ઓછું આંકી શકાય નહીં.

ગાયત્રી દ્વારા આત્મવિકાસની ત્રાણે કક્ષાઓ પાર કરી શકાય છે. સર્વસાધારણની જાગુકારી માટે 'ગાયત્રી મહાવિજ્ઞાન' ના ત્રાણે ભાગોમાં બની શકે તેટલું અને ઉપયોગમાં આવે એવું જ્ઞાન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પુસ્તકોમાં એવું જ્ઞાન આપવામાં આવ્યું છે કે જેથી દેરેકનો દાસ્તિકોણ શુદ્ધ થાય. આ શુદ્ધિકરણને જ પરિમાર્જન, મંત્રદીક્ષા કરી છે. યજોપવીતનું રહસ્ય, ગાયત્રી એ જ કલ્પવૃક્ષ છે, ગાયત્રી ગીતા, ગાયત્રી સ્મૃતિ, ગાયત્રી રામાયણ, ગાયત્રી ઉપનિષદ, ગાયત્રીની દશ ભૂજ વગેરે પ્રકરણોમાં આ બતાવાઈ ગયું છે કે આપાણે પોતાના વિચારો, ભાવનાઓ અને ઈચ્છાઓનું શોધન કરીને તેમને શુદ્ધ કરીને કેવી રીતે સુખમય જીવન જીવી શકીએ. આ ત્રાણે ભાગોમાં અજિન્દીક્ષાની બીજી ભૂમિકાનું શિક્ષણ પાણ વિસ્તારપૂર્વક આપવામાં આવ્યું છે બ્રહ્મસંધ્યા, અનુષ્ઠાન, ધ્યાન, પાપનાશક તપશ્ચર્યાઓ, ઉદ્ઘાપન સાધના, વિશેષ સાધનાઓ, ઉપવાસ, પ્રાપુષવિદ્યા, મનોમય કોશની સાધના, તંત્ર, પુરશ્રાગ વગેરે પ્રકરણોમાં શક્તિ ઉત્પત્ત કરવાની વિદ્યા આપવામાં આવી છે. આ બ્રહ્મદીક્ષાનું શિક્ષણ, ગાયત્રી પિંજર, ગાયત્રી હૃદય કુરુલિની જગરણ, ગ્રંથિભેદ, વિજ્ઞાનમય કોશની-આનંદમય કોશની સાધનાની અંદર સારી રીતે આપવામાં આવ્યું છે. આ શિક્ષણ એવી રીતે આપવામાં આવ્યું છે કે યોગ્ય સાધક જ તેને પ્રાપ્ત કરી શકે છે.

આવી યોગ્યતાવાળો ગુરુ ન મળે તો કોઈ સ્વર્ગભૂતિ. અને પૂર્વકાલીન વ્યક્તિની પ્રતિમાને ગુરુ સમાન ગાણીને આપણી શિક્ષણસેવનની યાત્રા શરૂ કરવી. એક આવશ્યક પ્રાગુલ્લીનો ભંગ ન થાય એટલા માટે કોઈ સાધારણ શ્રેણીના સત્ત્વાત્મ પુરુષથી પાણ કામ ચલાવી શકાય. ગુરુ નિલોભી, નિરહંકારી અને શુદ્ધ ચારિત્ર્યવાન હોવા જરૂરી છે. આવી યોગ્યતાઓ જે વ્યક્તિમાં હોય તેને કામચલાઉ ગુરુ તરીકે સ્થાપી શકાય. જે તેનામાં શક્તિદાન કરવાની અથવા રસ્તો બતાવવાની યોગ્યતા ન હોય તો પાણ એ આપણી શ્રવ્યા વધારવામાં સાથીની માફક જરૂર સહકાર આપશે. 'નગુરા' રહેવા કરતાં મધ્યમ શ્રેણીનો પાણ માર્ગદર્શક કરવો જરૂરી છે. ઘઉં ન મળે તો જુવાર ભાજરી

ખાઈને પણ કામ ચલાવવું. યજોપવીત ધારણ કરીને ગુરુદીક્ષા લેવી એ પ્રતેક દ્વિજની અનિવાર્ય આવશ્યકતા છે. ચિહ્નપૂજાના રૂપમાં પણ આ પ્રથા ચાલતી રહે તો વખત જતાં તેમાં જરૂર સુધારો કરી શકશે, પણ તેની શુંખલાને જ તોડી નાખવામાં આવે તો એની જગ્યાએ બીજી નવી રૂચના કરવાનું મુશ્કેલ પડશે.

ગાયત્રી દ્વારા આત્મોન્તરિ થાય છે એ નિશ્ચિત છે. મનુષ્યના અંત:કરણના સંશોધન, પરિમાર્જન, સંતુલન અને વિકાસ માટે ગાયત્રી લેવી ઉત્તમ સાધના ભારતીય ધર્મશાસ્કોમાં બીજી કોઈ નથી એ અનાદિકાળથી અસંખ્ય વ્યક્તિઓના અનુભવમાં સાચું પુરવાર થતું આવ્યું છે. મન, બુદ્ધિ, ચિન્તા અને અહંકારના અંત:કરણ ચતુર્થને ગાયત્રી દ્વારા શુદ્ધ કરી લેનાર વ્યક્તિ માટે સાંસારિક જીવનમાં સર્વ બાનુથી સર્વ પ્રકારની સફળતાઓનાં દ્વાર ખૂલ્લી જય છે. ઉત્તમ સ્વભાવ, સારી ટેવો, સ્વસ્થ મગજ, દીર્ઘદિન, પ્રકૃષ્ટ મન, ઉચ્ચ ચારિત્ર, કર્તવ્યનિષ્ઠા, સત્તપ્રવૃત્તિને પ્રાપ્ત કરવાથી જીવનમાં કોઈ કષ્ટકર હુઃખ આવતું નથી. તેને માટે સામાન્ય પરિસ્થિતિઓમાં પણ સુખ જ હોય છે.

પરંતુ ગાયત્રીનો આ લાભ માત્ર ૨૪ અક્ષરોના મંત્રથી જ સિદ્ધ થતો નથી. એક હાથથી તાળી પડતી નથી, એ જ પ્રમાણે એકલી ગાયત્રી સાધના અપૂર્ણ છે. તેનો બીજો હિસ્સો ગુરુનું માર્ગદર્શન છે. ગાયત્રી ગુરુમંત્ર છે. આ મહાનશક્તિની કીલિત કુંચી અનુભવી અને સુધોળ્ય ગુરુના માર્ગદર્શનમાં ધૂપાયેલી છે. જ્યારે ઉભયપક્ષી સાધન, ગાયત્રી માતા અને પિતા ગુરુની છિત્રછાયા મળી જય તો ગમે તેવી આશાઓ અને આકાંક્ષાઓ સફળ થવામાં વાર નહીં લાગે.

### સંસ્થાનાં બે પ્રભાવશાળી માસિકો

(૧) અખંડ જ્યોતિ (માસિક) નિયમિત પ્રગટ થતું ભારતીય ધર્મ, સંસ્કૃતિ, તત્ત્વદર્શન, સદાચાર, નૈતિકતા, ગાયત્રીની ઉચ્ચસ્તરીય સાધના વગેરેનું લેખન પ. પુ. ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજીની અમૃતમયી વાગી-તેઽશ્રીના માસિકના માધ્યમથી ધેર બેઠાં સત્સંગ. આ માસિક દેશવિદેશમાં લાખો વ્યક્તિઓનું પ્રાગપ્રિય બનેલ છે. ન્યિરંગી આકર્ષક ટાઈટલ, જહેરાતરહિત વાચનસામ્રાજીની.

(૨) યુગશક્તિ ગાયત્રી (માસિક) અખંડ જ્યોતિના સિદ્ધાંતોને વાવહારિક જીવનમાં કદ્ય રીતે ઉત્તરી શક્ય તેનું માર્ગદર્શન આ માસિકમાં જીવનશરિર, સંસ્મરણ, સત્ય ધટનાઓ, લેખ અને સમાચારોના માધ્યમથી આપવામાં આવે છે. ધાર્મિક, સાંસ્કૃતિક, નૈતિક અને સહજુણી જીવન જીવવાની કલાનું આ ઉત્તમ માસિક છે. ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્ડ્વા વગેરે ભાષાઓમાં છપાય છે.

## યુગનિમાર્ગ યોજના, ગાયત્રી તપોભૂમિ, મથુરા